



વંદિતુ કાવ્યકિશોદ્રે



સામયકાર અનુશીલન



ડૉ. હુકમચંદ ભારિલ્લ

પ્રકાશકીય નિવેદન

શ્રીમહ્ ભગવાન કુંદુંદ આચાર્ય દેવપ્રણિત શ્રી સમયસાર શાસ્ત્ર
જિનાગમનું અનેડ રત્ન છે. આચાર્ય અમૃતચંદ્ર તેને 'જગતનું અદ્વિતીય
અક્ષય ચક્ષુ' કહ્યું છે. પૂ. ગુરુદેવ શ્રી કાનલુસ્વામી તેને 'અશરીરી થવાનું
શાસ્ત્ર' કહેતાં.

આવા અલોકિક શાસ્ત્ર ઉપર વિશ્લેષણ કરીને સરળ રીતે પોતાની
આગામી શૈલીથી હિંદી ભાષામાં અનુશીલન લખીને પં. ડૉ. હુકમચંદ્લ
ભારિદે અધ્યાત્મરસિક જિજાસુ જીવોને ઉપકૃત કર્યા છે. તે બદલ તેઓ
અત્યંત ધન્યવાદને પાત્ર છે.

આ અનુશીલન પહેલાં વીતરાગ વિજ્ઞાનના સંપાદકીય લેખના
રૂપમાં અને પછી પુસ્તકાકારે ક્રમશા: બહાર પડવાનું શક્ય થયા બાદ ગુજરાતી
ભાષામાં તેના અનુવાદની માંગ આવી રહી હતી. તેના ફળસ્વરૂપે સમયસાર
અનુશીલન ભાગ-૧ (જીવ-અજીવ અધિકાર), ભાગ-૨ (કર્તાકર્મ અને
પૂર્ણ-પાપ અધિકાર), ભાગ-૩ (આસ્ત્ર, સંવર, નિર્જરા અધિકાર, બંધ
અધિકાર) તો બહાર એડી ચૂક્યાં છે, અને હવે આ ભાગ-૪ (મોક્ષ અધિકાર
અને સર્વવિશુદ્ધજ્ઞાનાધિકાર)નું પ્રકાશન કરતાં અમને આનંદ થાય છે.

અનુવાદનું આ કામ અમેરિકા જેવા વિદેશમાં રહીને નિયમિત રીતે સમૂહ સ્વાધ્યાય કરનાર કેટલાક ભાઈ-બહેનોએ અત્યંત પ્રસંગતાપૂર્વક ઉપાડી લીધું છે એ બદલ તેઓ પણ ધન્યવાદને પાત્ર છે.

પૂજ્ય કાનળુસ્વામી સ્મારક ટ્રસ્ટનો ઉદ્દેશ્ય પૂરુષાદેવશ્રીએ પ્રદ્દેશ તત્ત્વજ્ઞાનનો પ્રચાર-પ્રસાર કરવાનો છે. ટ્રસ્ટ તરફથી અનેક ગુજરાતી, હિન્દી તથા અંગેળુમાં પુસ્તકો પ્રસિદ્ધ થયા છે. તે ઉપરાંત બાળ-શિબિર, પ્રૌઢ શિક્ષણ શિબિર, સમૂહ પૂજન ઈત્યાદિ પ્રવૃત્તિઓ વર્ષ દરમિયાન ચાલુ જ હોય છે.

લોકોમાં તત્ત્વની રુચિ દિન પ્રતિદિન વધતી રહે તેવી પ્રવૃત્તિઓ ભવિષ્યમાં પણ ટ્રસ્ટ કરતું રહે એજ આ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ છે..

આ અનુસંધાનમાં સમયસાર પર ડૉ. ભારિશ્વાર દારા થઈ રહેલા સંપૂર્ણ અનુશીલનના અનુવાદને પ્રકાશિત કરવાની ટ્રસ્ટની ભાવના છે. છેલ્લો ભાગ નાલુકના ભવિષ્યમાં જ પ્રકાશિત કરવામાં આવશે.

આ પુસ્તકના ટાઈપસેટીંગ અને ડિજાઇનીંગ માટે મે. કિએટીવ પેજ સેટર્સના શ્રી સમીર પારેખ તથા પુફ રીડિંગ માટે શ્રી કાંતિભાઈ મોટાણીના અમો આભારી છીએ.

પૂજ્ય શ્રી કાનળુસ્વામી સ્મારક ટ્રસ્ટ.

દિનાંક ૧-૧-૨૦૦૬ (સં. ૨૦૬૨)

- ટ્રસ્ટીગાળ

અનુવાદકોની વાત

નમું હું તીર્થનાયકને, નમું ઝેંકાર નાદને,
ઝેંકાર સંધર્યો જોણો, નમું તે કુંદકુંદને.

અહો ! ઉપકાર જિનવરનો, કુંદનો ધ્વનિદિવ્યનો,
જિન-કુંદ-ધ્વનિ આપ્યાં, અહો ! તે ગુરુ કહાનનો.

સમયસાર અનુશીલન ભાગ-૪ (મોક્ષ અધિકાર અને
સર્વવિશુદ્ધજ્ઞાનાધિકાર)નો આ ગુજરાતી અનુવાદ આપના હાથમાં
મૂકૃતાં અમે હર્થની લાગણી અનુભવીએ છીએ. આ પછીના બીજા ભાગો
નજીકના ભવિષ્યમાં એક પછી એક પ્રસ્તુત થતા રહે એ માટે પણ
પ્રયત્નશીલ છીએ.

વોશિંગ્ટન વિસ્તારના અમારા પ્રૌઢ જૈન વર્ગમાં અમે સમયસાર
સ્તુતિ, પૂર્ણ ગુરુદેવના ધ્વનિમુદ્રિત પ્રવચનો, પ્રવચન રત્નાકર, સમયસાર
અનુશીલન તથા પરસ્પર ચર્ચાના માધ્યમથી સમયસારનો સામુહિક
સ્વાધ્યાય નિયમિત રીતે દર રવિવારે કરીએ છીએ. અનુશીલનનો
અનુવાદ આ રીતે અમને બધાને ખૂબ જ ઉપયોગી થઈ રહ્યો છે. આશા
છે કે ગુજરાતી ભાષી સર્વ મુશ્કુલુભાઈ-બહેનોને પણ તે એવી જ
રીતે લાભદાયી નિવડશે.

છેદ્ધા પચીસેક વર્ષોથી અમેરિકા અને કેનેડા આવીને વસેતા
જૈનોની પહેલી પેઢી હવે નોકરી-ધંધામાંથી નિવૃત્તિ લેવાની ઉંમરની

નજીક પહોંચી રહી છે અને સાથે સાથે જૈન સાહિત્યની માંગ પણ વધી રહી છે. પરમાગમકથિત અધ્યાત્મજ્ઞાનના પ્રચાર-પ્રસારને પ્રતિકૂળ વાતાવરણ અને પ્રસંગોની અહીં બધે ટેકાણે બાહુલ્યતા હોવા છતાં પણ ઘણા શહેરોમાં તત્ત્વજ્ઞાનની તુચ્છપૂર્વક સમૂહમાં સ્વાધ્યાય કરનાર મુમુક્ષુ ભાઈ-બહેનાની સંખ્યા હવે ધીરે-ધીરે વધતી જય છે. પૂર્ણ ગુરુદેવ દ્વારા પ્રરૂપિત અધ્યાત્મવિદ્યાનો સેદેશો લઈને જ્યાપુર અને સોનગઢથી દર વર્ષે અહીં આવતા વિદ્વાનોનું પણ આમાં મહત્વનું યોગદાન છે. આશા છે કે સમયસારનો અભ્યાસ કરવા તત્પર થયેલા બધા જિજ્ઞાસુઓને આ પુસ્તક સાચી દિશા તરફ લઈ જવામાં મદદરૂપ થશે.

આ પુસ્તકમાં દેરક પ્રકરણને અંતે ખાલી રહેતી જગ્યામાં આ વખતે 'જ્ઞાનગોઢી' તથા 'વૈરાગ્ય-વર્ષા' માંથી અવતરણો છાપવામાં આવ્યા છે.

બીજુ એક વાત - 'જે આપણે સમયસાર પર અનુશીલન છપાવશું તો પ્રવચન રત્નાકરના વાંચનથી લોકો વિમુખ થઈ જશે' એવી આશાંકા જે કોઈને થાય તો તે બરાબર નથી એમ અમારું માનવું છે. આ અનુશીલન એ કાંઈ પ્રવચન રત્નાકરનું પ્રતિસ્પદ્ધા નથી, બલ્કે જિજ્ઞાસુ જવડુપ મુલાકાતીને પૂર્ણ ગુરુદેવની અનુભવમંડિત આત્મસ્પર્શી વાણીના પ્રસાદ સમાન પ્રવચન રત્નાકરદુપ તાજીમહાલને અંગુલિનિર્દેશ દ્વારા બતાવનાર ભોમિયાના સ્થાને છે. જુવાળવાધિકાર અને કર્તાક માર્ગિકારના અનુશીલનમાં સૂક્ષ્મ વિષયના સ્પષ્ટીકરણની જ્યાં જ્યાં જરૂર લાગી ત્યાં ત્યાં પ્રવચન રત્નાકરમાંથી અનુકૂળે દુપ અને ૧૨૦ અવતરણો મૂળ લેખકે ટાંક્યા છે. આથી ખરેખર તો આ અનુશીલનના વાંચનના ફળસ્વરૂપે મુમુક્ષુ જવો પ્રવચન રત્નાકરના સ્વાધ્યાયથી વિમુખ થવાને બદલે તેનો ઊંડાણથી અભ્યાસ કરવા પ્રેરાશે.

- પ્રેરાવા જોઈએ, એવું અમારું મંતવ્ય છે.

આ અનુવાદને તૃટિઓ રહિત અને સર્વાગસુંદર બનાવવા બનતા પ્રયાસો અમે કર્યા છે, તેમ છતાં જે કાંઈ ભૂલો રહી જવા પામી હોય તે બહલ અથે પાઠકોની ક્ષમા પ્રાચીએ છીએ અને એ તરફ અમારું ધ્યાન દોરીને યોગ્ય માર્ગદર્શન આપવા વિદ્વજનોને નમ્ર વિનંતી કરીએ છીએ.

સમયસારયુગપ્રવર્તક પૂરુષેવની મંગળવર્ધિની છતછાયામાં સર્વ જ્ઞાસુ જીવો આત્મકલ્યાણના માર્ગ વિચરો એ જ અભ્યર્થના.

- અનુવાદકો



અનુકમણિકા

મોશ અધિકાર	૧-૧૧૭	સર્વવિશુદ્ધશાનાધિકાર ૧૧૮-૪૧૮	
કળશ ૧૮૦	૨	કળશ ૧૯૩	૧૨૨
ગાથા ૨૮૮-૨૮૦	૭	કળશ ૧૯૪	૧૨૬
ગાથા ૨૮૧-૨૮૩	૧૨	ગાથા ૩૦૮-૩૧૧	૧૨૮
ગાથા ૨૮૪	૨૩	કળશ ૧૯૫	૧૩૮
કળશ ૧૮૧	૪૨	ગાથા ૩૧૨-૩૧૩	૧૪૧
ગાથા ૨૮૫-૨૮૭	૪૮	ગાથા ૩૧૪-૩૧૫	૧૪૬
કળશ ૧૮૨	૫૨	કળશ ૧૯૬	૧૪૨
ગાથા ૨૮૮-૨૮૯	૫૬	ગાથા ૩૧૬	૧૪૪
કળશ ૧૮૩	૬૨	કળશ ૧૯૭	૧૪૮
કળશ ૧૮૪	૬૬	ગાથા ૩૧૭-૩૧૮	૧૪૧
ગાથા ૩૦૦	૬૮	કળશ ૧૯૮	૧૪૫
કળશ ૧૮૫	૭૦	ગાથા ૩૧૯-૩૨૦	૧૪૬
કળશ ૧૮૬	૭૪	કળશ ૧૯૯	૧૬૬
ગાથા ૩૦૧-૩૦૩	૭૬	ગાથા ૩૨૧-૩૨૩	૧૬૬
ગાથા ૩૦૪-૩૦૫	૭૮	કળશ ૨૦૦	૨૦૨
કળશ ૧૮૭	૮૩	ગાથા ૩૨૪-૩૨૭	૨૦૪
ગાથા ૩૦૬-૩૦૭	૮૪	કળશ ૨૦૧	૨૦૮
કળશ ૧૮૮	૮૭	કળશ ૨૧૧	૨૧૧
કળશ ૧૮૯	૯૦૦	ગાથા ૩૨૮-૩૩૧	૨૧૪
કળશ ૧૯૦	૯૦૬	કળશ ૨૦૨	૨૧૭
કળશ ૧૯૧	૯૦૮	કળશ ૨૦૩	૨૨૩
કળશ ૧૯૨	૯૧૪	કળશ ૨૦૪	૨૨૭

ગાથા ૩૩૨-૩૪૪	૨૩૦	કળશ રૂફ	૩૮૩
કળશ રૂફ	૨૪૫	કળશ રૂફ	૩૮૭
કળશ રૂફ/૨૦૭	૨૪૬	કળશ રૂફ-૨૨૬	૩૮૧
ગાથા ૩૪૪-૩૪૮	૨૪૭	કળશ રૂફ	૩૮૮
કળશ રૂફ	૨૬૪	કળશ રૂફ-૨૩૧-૨૩૨	૪૧૬
કળશ રૂફ	૨૬૭	કળશ રૂફ	૪૨૩
કળશ રૂફ	૨૭૧	કળશ રૂફ	૪૨૭
ગાથા ૩૪૮-૩૫૫	૨૭૩	ગાથા ૩૫૦-૪૦૪	૪૨૮
કળશ રૂફ	૨૭૮	કળશ રૂફ-૨૩૫-૨૩૬	૪૪૬
કળશ રૂફ	૨૮૧	કળશ રૂફ	૪૫૧
કળશ રૂફ-૨૧૩-૨૧૪	૨૮૨	ગાથા ૪૦૫-૪૦૭	૪૫૨
ગાથા ૩૫૬-૩૬૫	૨૮૦	કળશ રૂફ	૪૫૬
કળશ રૂફ-૨૧૫-૨૧૬	૩૦૭	ગાથા ૪૦૮-૪૧૧	૪૬૧
કળશ રૂફ	૩૧૪	કળશ રૂફ	૪૬૬
ગાથા ૩૬૬-૩૭૧	૩૧૭	ગાથા ૪૧૨	૪૭૦
કળશ રૂફ	૩૨૬	કળશ રૂફ	૪૭૬
કળશ રૂફ	૩૨૮	કળશ રૂફ	૪૭૮
ગાથા ૩૭૨	૩૩૨	ગાથા ૪૧૩	૪૮૩
કળશ રૂફ-૨૨૦-૨૨૧	૩૩૮	કળશ રૂફ	૪૮૪
ગાથા ૩૭૩-૩૮૨	૩૪૪	કળશ રૂફ	૪૮૬
કળશ રૂફ	૩૪૨	ગાથા ૪૧૪	૪૮૨
કળશ રૂફ	૩૪૭	કળશ રૂફ	૪૦૧
ગાથા ૩૮૩-૩૮૬	૩૬૧	કળશ રૂફ	૪૦૫
કળશ રૂફ	૩૬૭	ગાથા ૪૧૫	૪૦૮
ગાથા ૩૮૭-૩૮૯	૩૭૧	કળશ રૂફ	૪૧૩
કળશ રૂફ	૩૭૫		



૬૦૮	૧૯૫-૧૯૭૫	૨૧૯	૧૭૬-૧૭૮૮ ૧૯૧૮
૬૦૯	૧૯૫-૧૯૭૫	૨૨૦	૧૦૭-૧૭૯૬
૭૨૬	૧૯૫-૧૯૭૫	૨૨૧	૦૦૯-૧૦૯ ૧૯૭૫
૩૬૬	૧૯૫-૧૯૭૫	૨૨૨	૧૪૬-૧૪૮૮ ૧૯૧૮
૩૮૪	૧૯૫-૧૯૭૫	૨૨૩	૧૦૬-૧૭૦૬
૬૭૫	૧૯૫-૧૯૭૫	૨૨૪	૧૦૭-૧૭૦૬
૬૭૬	૧૯૫-૧૯૭૫	૨૨૫	૧૦૭-૧૭૦૬
૩૮૫	૧૯૫-૧૯૭૫	૨૨૬	૧૭૬-૧૭૮૮ ૧૯૧૮
૩૮૬	૧૯૫-૧૯૭૫	૨૨૭	૧૦૭-૧૭૦૬
૩૮૭	૧૯૫-૧૯૭૫	૨૨૮	૧૦૭-૧૭૦૬
૩૮૮	૧૯૫-૧૯૭૫	૨૨૯	૧૦૭-૧૭૦૬
૩૮૯	૧૯૫-૧૯૭૫	૨૩૦	૧૦૭-૧૭૦૬
૩૯૦	૧૯૫-૧૯૭૫	૨૩૧	૧૦૭-૧૭૦૬
૩૯૧	૧૯૫-૧૯૭૫	૨૩૨	૧૦૭-૧૭૦૬
૩૯૨	૧૯૫-૧૯૭૫	૨૩૩	૧૦૭-૧૭૦૬
૩૯૩	૧૯૫-૧૯૭૫	૨૩૪	૧૦૭-૧૭૦૬
૩૯૪	૧૯૫-૧૯૭૫	૨૩૫	૧૦૭-૧૭૦૬
૩૯૫	૧૯૫-૧૯૭૫	૨૩૬	૧૦૭-૧૭૦૬
૩૯૬	૧૯૫-૧૯૭૫	૨૩૭	૧૦૭-૧૭૦૬
૩૯૭	૧૯૫-૧૯૭૫	૨૩૮	૧૦૭-૧૭૦૬
૩૯૮	૧૯૫-૧૯૭૫	૨૩૯	૧૦૭-૧૭૦૬
૩૯૯	૧૯૫-૧૯૭૫	૨૪૦	૧૦૭-૧૭૦૬
૩૧૩	૩૬૫-૩૮૫	૨૪૧	૧૦૭-૧૭૦૬

મોક્ષ અધિકાર

૬૧૦	૧૯૫-૧૯૭૫	૨૪૨	૧૦૭-૧૭૦૬
૬૧૧	૧૯૫-૧૯૭૫	૨૪૩	૧૦૭-૧૭૦૬
૭૩૧	૧૯૫-૧૯૭૫	૨૪૪	૧૦૭-૧૭૦૬
૭૩૨	૧૯૫-૧૯૭૫	૨૪૫	૧૦૭-૧૭૦૬
૭૩૩	૧૯૫-૧૯૭૫	૨૪૬	૧૦૭-૧૭૦૬
૭૩૪	૧૯૫-૧૯૭૫	૨૪૭	૧૦૭-૧૭૦૬
૭૩૫	૧૯૫-૧૯૭૫	૨૪૮	૧૦૭-૧૭૦૬
૭૩૬	૧૯૫-૧૯૭૫	૨૪૯	૧૦૭-૧૭૦૬
૭૩૭	૧૯૫-૧૯૭૫	૨૫૦	૧૦૭-૧૭૦૬
૭૩૮	૧૯૫-૧૯૭૫	૨૫૧	૧૦૭-૧૭૦૬
૭૩૯	૧૯૫-૧૯૭૫	૨૫૨	૧૦૭-૧૭૦૬
૭૪૦	૧૯૫-૧૯૭૫	૨૫૩	૧૦૭-૧૭૦૬
૭૪૧	૧૯૫-૧૯૭૫	૨૫૪	૧૦૭-૧૭૦૬
૭૪૨	૧૯૫-૧૯૭૫	૨૫૫	૧૦૭-૧૭૦૬
૭૪૩	૧૯૫-૧૯૭૫	૨૫૬	૧૦૭-૧૭૦૬
૭૪૪	૧૯૫-૧૯૭૫	૨૫૭	૧૦૭-૧૭૦૬
૭૪૫	૧૯૫-૧૯૭૫	૨૫૮	૧૦૭-૧૭૦૬
૭૪૬	૧૯૫-૧૯૭૫	૨૫૯	૧૦૭-૧૭૦૬
૭૪૭	૧૯૫-૧૯૭૫	૨૬૦	૧૦૭-૧૭૦૬
૭૪૮	૧૯૫-૧૯૭૫	૨૬૧	૧૦૭-૧૭૦૬
૭૪૯	૧૯૫-૧૯૭૫	૨૬૨	૧૦૭-૧૭૦૬
૭૫૦	૧૯૫-૧૯૭૫	૨૬૩	૧૦૭-૧૭૦૬
૭૫૧	૧૯૫-૧૯૭૫	૨૬૪	૧૦૭-૧૭૦૬

મોક્ષાધિકાર

જીવાળાધિકારથી સંવરાધિકાર સુધી ભગવાન આત્માને પરપદાથો અને વિકારી ભાવોથી બિન્ન બતાવીને અનેક પ્રકારે બેદવિજ્ઞાન કરાવવામાં આવ્યું છે અને નિર્જરાધિકારમાં બેદવિજ્ઞાન સંપત્ત્ર આત્માનુભવી સમ્બંધાદિઓને ભૂમિકાનુસાર ભોગ અને સંયોગોનો યોગ હોવા છતાં પણ બંધ થતો નથી, પરંતુ નિર્જરા થાય છે - આ વાતને યુક્તિસહિત સ્પષ્ટ કરવામાં આવી છે. ત્યાર બાદ બંધાધિકારમાં બંધના મૂળ કારણો પર પ્રકાશ નાખ્યા પછી. હવે આ મોક્ષાધિકારમાં મુક્તિના વાસ્તવિક ઉપાય પર પ્રકાશ પાથરે છે.

અન્ય અધિકારોની જેમ આ અધિકારનો આરંભ પણ આત્મભ્યાતિકાર અથ પ્રવિશતિ મોક્ષ: - આ પ્રકારના વાક્યથી કરે છે. તાત્પર્ય એમ છે કે મોક્ષ પણ એક સ્વાંગ છે, મૂળ વસ્તુ નથી.

આ વાતને પૂજ્ય ગુરુદેવ આ પ્રમાણે સમજાવે છે - “મોક્ષ એ પર્યાય છે, ત્રિકાળી વસ્તુ નથી. જે પ્રમાણે સંસાર વિકારી વેષ છે, મોક્ષમાર્ગ આંશિક નિર્મળ વેષ છે; તે જ પ્રમાણે મોક્ષ પૂર્ણ આનંદની દૃશાનો વેષ છે. જે પણ નવીન અવસ્થાઓ થાય છે; તે બધાં વેષ છે, સ્વાંગ છે. સ્થાયી રહેનાર તત્ત્વ તો ત્રિકાળી એક, ધૂષ, ચિદાનંદસ્વરૂપ આત્મા જ છે.

જે રીતે નૃત્યના અખાડામાં અર્થાત્ નાટકના રંગમંચ પર નાટક કરનાર પ્રવેશ કરે છે; તે જ રીતે અહીં મોક્ષતત્ત્વનો સ્વાંગ ધારણ કરીને

જીવ પ્રવેશ કરે છે. ત્યાં જ્ઞાન સમ્યક્ પ્રકારે સર્વ સ્વાંગોને જણનાં છે. શુદ્ધ ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માનું જ્ઞાન આસ્રવ-બંધ-સંબર-નિર્જરા-મોક્ષ આદિ બધા સ્વાંગોને જણે છે.”

આ મોક્ષાધિકારના આરંભમાં સૌથી પ્રથમ મંગળાચરણ કરતાં આચાર્ય અમૃતચંદ્રદેવ આત્મભ્યાતિમાં તે જ્ઞાનનું સ્મરણ કરે છે; જે જ્ઞાને બંધ અને આત્માને બિન્ન-બિન્ન કરીને આત્માને કર્મબંધનથી મુક્ત કર્યો છે.

મંગળાચરણનો ઉકિટ છંદ મૂળથી આ પ્રમાણે છે -

(શિખરણી)

દ્વિધાકૃત્ય પ્રજ્ઞાક્રકચદલનાદ્વબંધપુરુષૌ,
નયન્મોક્ષં સાક્ષાત્પુરુષમુપલંભૈકનિયતમ् ॥
ઇદાનીમુન્મજ્જત્સહજપરમાનંદસરસં,
પરं પૂર્ણ જ્ઞાનं કૃતસકલકૃત્ય વિજયતે ॥૧૮૦॥

(હરિગીત)

કરીને વિદારાગ બંધથી પ્રશાઙ્કી કરવત વડે,
સાક્ષાત્ મોક્ષ પમાંતું અનુભૂતિસ્વરૂપ પુરુષને;
છે જ્ઞાન તે ઉત્કૃષ્ટ ને આનંદરસથી યુક્ત છે,
જ્યવંત વર્તે જ્ઞાન પૂરાગ જે અહો ! કૃતકૃત્ય છે. ૧૮૦.

હવે પ્રગટ થનાર સહજ પરમાનંદથી સરસ, કૃતકૃત્ય અને ઉત્કૃષ્ટ આ પૂર્ણજ્ઞાન, અનુભૂતિ વડે નિશ્ચિત આત્માને પ્રશાઙ્કી કરવત (આરા) વડે વિદારણ કરીને, બંધ અને આત્માને બિન્ન-બિન્ન કરીને, આત્માને સાક્ષાત્ મોક્ષ પ્રાપ્ત કરાવતું જ્યવંત વર્તે છે.

૧. પ્રવચનરત્નાકર (હિન્દી), ભાગ ૮, પાનું ૩૧૨

અહીં તે પૂર્ણજ્ઞાનનું સમરણ કરવામાં આવ્યું છે; જે સહજ પરમાનંદથી સરસ છે, કરવા યોગ્ય બધું કરી લેવાથી ફૂટકૃત્ય છે અને સર્વશ્રેષ્ઠ છે તથા જેણે એ આત્માને સાક્ષાત્ મોક્ષની પ્રાપ્તિ કરવી છે, જેણે અનુભૂતિમાં પ્રાપ્ત એવા આત્મા અને બંધને બિન્ન-બિન્ન કરીને આત્માનુભૂતિ પ્રાપ્ત કરી હતી.

આ પ્રમાણે આ મંગળાચરણના કળણમાં એમ પણ કહી દીધું છે કે આત્મા અને બંધની વર્ચ્યે બેદ જાળનાર આત્માનુભવી પુરુષ જ પોતામાં જમીને-રમણ કરીને પૂર્ણજ્ઞાન પ્રાપ્ત કરે છે; બધા કર્મોથી મુક્ત થાય છે, મુક્તિને પ્રાપ્ત કરે છે.

આ કળણનો ભાવ પૂજય ગુરુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે -

“જેવી રીતે કરવત (આરી) વડે લાકડીને ચીરીને બે ટુકડા કરવામાં આવે છે અથવા કુહાડી વડે લાકડાના સાંધા પર ધા કરવાથી લાકડાને ફાડીને તેના બે ભાગ અલગ-અલગ કરવામાં આવે છે, તેવી જ રીતે જ્ઞાની પુરુષ પ્રજ્ઞાદ્ધી કરવત અથવા કુહાડી વડે આત્મા અને રાગાદિ બંધને અલગ-અલગ કરી નાખે છે. બંધ અર્થાત્ રાગ-વ્યવહાર ભાવ અને આત્મા અર્થાત્ નિશ્ચય શુદ્ધ વસ્તુ - બન્ને બિન્ન-બિન્ન વસ્તુઓ છે. તેમને પોતાના જ્ઞાનમાં પ્રજ્ઞાદ્ધી છીણીથી બિન્ન જાળવા-માનવા તેનું નામ જ ધર્મ છે.

પુરુષાર્થસિદ્ધયુપાયમાં તો તેને જ પુરુષ કહ્યો છે, જે પોતાના જ્ઞાનાનંદસ્વભાવનું સેવન કરે છે. અહીં આત્માને જ પુરુષ સંજ્ઞાથી અભિહિત કરવામાં આવ્યો છે. જે તેને જાણો-ઓળખે, તેમાં જ જમૈ-રમે તે જ પુરુષ છે, બાકી બધા તો નસુંસક છે.

જેટલા પણ રાગાદિ વિકલ્પ છે, તેમનાથી ભગવાન આત્માને બિન્ન જાળીને તથા રાગનું લક્ષ્ય છોડીને, અંદર જે જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા

બિરાજમાન છે, તેમાં જુકવાથી, તેની તરફ દળવાથી જે અનુભૂતિ થાય છે, તે અનુભૂતિથી જ આત્માનો નિશ્ચય થાય છે, આત્મા પ્રાપ્ત થાય છે. રાગ અને વ્યવહારથી આત્મા પ્રાપ્ત થતો નથી. જે રાગથી આત્માને ભિન્ન કરવાનો છે, તેના વડે જ આત્માની પ્રાપ્તિ કેવી રીતે સંભવ છે ?^૧

તે જ્ઞાન આત્માને મોક્ષ પ્રાપ્ત કરાવતું થકું પોતાના સંપૂર્ણ સ્વરૂપ કેવળજ્ઞાનને પ્રગટ કરીને સદા જ્યવંત વર્તે છે.

આ પ્રમાણે અહીં જ્ઞાનની સર્વોત્કૃષ્ટપે જે મહિમા પ્રગટ કરી છે, તે જ મંગળવચન છે.^૨

આ કળશ મોક્ષાધિકારના મંગળાચરણઝ્રૂપ હોવાથી અહીં સમ્યગ્જ્ઞાન જ્યોતિને મુક્તિ પ્રાપ્ત કરનાર બતાવીને એનું મહત્વ બતાવ્યું છે, એનું સ્મરણ કર્યું છે.

નાટક સમયસારમાં આ કળશનો ભાવાનુભાદ આ પ્રમાણે કરવામાં આવ્યો છે.

(સવૈયા ઇકતીસા)

ભેદગ્યાન આરા સૌં દુફારા કરે ગ્યાની જીવ,

આતમ કરમ ધારા ભિન્ન-ભિન્ન ચરચૈ ।

અનુભૂતિ અભ્યાસ લહે પરમ ધરમ ગહૈ,

કરમ ભરમ કૌ ખજાની ખોલિ ખરચૈ ॥

યૌ હી મોખ મુખ ધાવૈ કેવલ નિકટ આવૈ,

પૂરન સમાધિ લહે પરમ કૌ પરચૈ ।

ભયૌ નિરદૌર યાહિ કરનૌ ન કછુ ઔર,

એસૌ વિશ્વનાથ તાહિ બનારસી અરચૈ ॥

૧. પ્રવચનરત્નાકર (હિંદી), ભાગ ૮, પાનું ૩૧૦

૨. પ્રવચનરત્નાકર (હિંદી), ભાગ ૮, પાનું ૩૧૧

જ્ઞાની જીવ બેદજ્ઞાનકૃપી આરા વડે આત્મા અર્થાત્ જ્ઞાનધારા અને કર્મધારાના બે ફાદરિયા કરીને, ભિન્ન-ભિન્ન કરીને આત્માના અનુભવનો અભ્યાસ કરે છે. પરમ ધર્મને ગ્રહણ કરે છે, કર્મોદયથી ઉત્પન્ન કર્મના ઘનનાને દિલ ખોલીને ખર્ચી નાખે છે. તાત્પર્ય એમ છે કે આ આત્માનુભવની પ્રક્રિયા વડે જ કર્મોની નિર્જરા થાય છે.

આ પ્રમાણે નિર્જરા કરતો થકો તે જ્ઞાની જીવ મોક્ષ તરફ ઝડપથી પ્રયાણ કરે છે, કેવળજ્ઞાન તેની અતિ નજીક આવી જય છે અને પૂર્ણ સમાધિને પ્રાપ્ત કરીને તે પરમતત્ત્વમાં વિલીન થઈ જય છે. આ પ્રમાણે તે નિશ્ચિંત થઈ જય છે. તાત્પર્ય એમ છે કે તેની દોષધામ સમાપ્ત થઈ જય છે, તેનું સંસારપરિષ્ટમણ સમાપ્ત થઈ જય છે, તે ફૃતકૃત્ય થઈ જય છે, તેને હવે કંઈ પણ કરવાનું બાકી રહેતું નથી. એવા સંપૂર્ણ વિશ્વને જાણનાર વિશ્વનાથ ભગવાન આત્માનું બનારસીદાસણ પૂજન કરે છે, તેઓ એને નમસ્કાર કરે છે.

આ પ્રમાણે આ મંગળાચયરણના કળશમાં પૂર્ણજ્ઞાનથી પરિપૂર્ણ જ્ઞાન જ્યોતિનું સ્મરણ કરવામાં આવ્યું છે, તેને નમસ્કાર કરવામાં આવ્યા છે.



સમયસાર ગાથા ૨૮૮ થી ૨૯૦

મંગળાચરણ બાદ હવે મોક્ષાધિકારની મૂળ ગાથાઓ આરંભ કરે
છે.

જહ ણામ કો વિ પુરિસો બંધણયમ્હિ ચિરકાલપદિબદ્ધો ।
તિવ્વં મંદસહાવં કાલં ચ વિયાણદે તસ્સ ॥૨૮૮॥

જઇ ણ વિ કુણદિ ચ્છેદં ણ મુચ્ચદે તેણ બંધણવસો સં ।
કાલેણ ઉ બહુગેણ વિ ણ સો ણરો પાવદિ વિમોક્ષબં ॥૨૮૯॥
ઇય કમ્મબંધણાણં પદેસઠિઝપયડિમેવમણુભાગં ।
જાણંતો વિ ણ મુચ્ચદિ મુચ્ચદિ સો ચેવ જદિ સુદ્ધો ॥૨૯૦॥

(હરિગીત)

જ્યમ પુરૂષ કો બંધન ભહીં પ્રતિબદ્ધ જે ચિરકાળનો,
તે તીવ્ર-મંદ સ્વભાવ તેમજ કાળ જાગે બંધનૌ. ૨૮૮.

પાગ જો કરે નહિ છેદ તો ન મુકાય, બંધન વશ રહે,
ને કાળ બહુથે જાય તોપાગ મુક્ત તે નર નહિ બને; ૨૮૯.

ત્યમ કર્મબંધનનાં પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગને
જાગે છતાં ન મુકાય જીવ, જે શુદ્ધ તો જ મુકાય છે. ૨૯૦.¹

૧. સમયસાર (ગુજરાતી) પાનું ૪૨૫

જે પ્રમાણે લાંબા સમયથી બંધનમાં બંધાયેલો કોઈ પુરુષ તે બંધનના તીવ્ર મંદસ્વભાવને, તેની કાળ અવધિને તો જણે છે, પરંતુ જે તે બંધનને તોડતો નથી તો તે તેનાથી મુક્ત થતો નથી અને બંધનમાં રહેતો થકો તે પુરુષ લાંબા કાળ સુધી પણ બંધનથી છૂટવાન્નું મુક્તિને પ્રાપ્ત કરતો નથી.

તેજ પ્રમાણે આ આત્મા કર્મબંધનોનાં પ્રકૃતિ, પ્રદેશ સ્થિતિ અને અનુભાગને જાણવા છતાં પણ કર્મબંધનથી છૂટતો નથી, પરંતુ જે રાગાદિને દૂર કરીને તે સ્વયં શુદ્ધ થાય છે તો કર્મબંધનથી છૂટી જાય છે.

તાત્પર્ય એમ છે કે કોઈ પણ વ્યક્તિ બંધનને જાણવા માત્રથી બંધનમુક્ત થતો નથી; બંધનોથી મુક્ત થવા માટે આત્માને જાણવો-ઓળખવો પડે છે અને આત્મામાં જ જલમીને-રમણ કરીને રાગાદ ભાવોને દૂર કરવા પડે છે. એમ કરવાથી જ મુક્તિની પ્રાપ્તિ થાય છે.

આ ગાથાઓનો ભાવ આચાર્ય અમૃતચંદ્રદેવ આત્મભ્યાતિમાં અત્યંત સંક્ષેપમાં આ પ્રમાણે સ્પષ્ટ કરે છે:-

“આત્મા અને બંધને અલગ-અલગ કરી દેવા તે મોક્ષ છે. કોઈ કહે છે કે બંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર જ મોક્ષનું કારણ છે; પરંતુ એ વાત બરાબર નથી. કર્મથી બંધાયેલા જીવને બંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર બંધનથી મુક્ત થવાનું કારણ નથી; કારણ કે જે રીતે બેડી આદિથી બંધાયેલા જીવને બંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર બંધનથી મુક્ત થવાનું કારણ નથી; તે જ પ્રમાણે કર્મથી બંધાયેલા જીવને કર્મબંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર કર્મબંધનથી મુક્ત થવાનું કારણ નથી.

આ કથનથી તેમનું ખંડન થઈ ગયું, જે કર્મબંધના વિસ્તૃત જ્ઞાનથી જ સંતુષ્ટ છે.”

કરણાનુયોગના શાસ્ત્રોમાં કર્મબંધનની પ્રક્રિયાનું વિસ્તારથી નિરૂપણ છે. તેનું અધ્યયન કરીને જે લોકો એમ સમજે છે કે અમારા કર્મબંધનો

કપાઈ જશે; કારણ કે અમે તો બધું જાણીએ છીએ કે કયું કર્મ ક્યારે બંધાય છે, કેમ બંધાય છે ?

એવા લોકોને અહીં કહેવાઈ રહ્યું છે કે બંધનના સ્વરૂપને જાણવા માત્રથી બંધનો કપાતા નથી.

આ રીતે એમ સુનિશ્ચિત થયું કે જે કર્મશાસ્ત્રોનું અધ્યયન કરીને સંતુષ્ટ છે અને એમ માની રહ્યા છે કે અમે મોટા ધર્માત્મા છીએ અને અમારા કર્મબંધન તો અમારા આ કર્મશાસ્ત્રોના અધ્યયન-મનન વડે જ કપાઈ જશે; તેઓ મોટા ભ્રમમાં છે; કારણ કે બંધનના શાનમાત્રથી બંધન કપાતા નથી.

આ વાતને આચાર્ય જ્યસેન હળવણ વધુ સ્પષ્ટતાથી વ્યક્ત કરે છે. તેઓ કહે છે :-

“શાનાવરણાદિ મૂળોત્તર પ્રકૃતિઓના ભેદવાળા કર્મબંધનોનાં પ્રેરેશ, પ્રકૃતિ, સ્થિતિ અને અનુભાગને જાણતો થકો પણ જીવ કર્મબંધનોથી મુક્ત થતો નથી; પરંતુ જ્યારે મિથ્યાત્ત્વ અને રાગાદિથી રહિત થાય છે, ત્યારે અનંત શાનાદિગુણાત્મક પરમાત્મસ્વરૂપમાં સ્થિત થઈને સર્વ કર્મબંધનોથી મુક્ત થાય છે અથવા પાઠાત્તર એમ પણ છે કે જ્યારે તે કર્મબંધનોને છેદે છે ત્યારે મુક્ત થાય છે.

આ વ્યાખ્યાનથી એ લોકોનું ખંડન થઈ ગયું, જે લોકો કર્મશાસ્ત્રોમાં કથિત પ્રકૃતિ આદિ બંધના શાનથી જ સંતુષ્ટ છે.

કેમ ?

કારણ કે સ્વરૂપની ઉપલબ્ધિકૃપ વીતરાગચરિત્રથી રહિત લોકોને બંધના શાનમાત્રથી સ્વર્ગાર્દિસુખનાં નિમિત્તભૂત પુણ્ય તો બંધાય છે, પણ મુક્તિની પ્રાપ્તિ થતી નથી.

આ વ્યાખ્યાનથી કર્મબંધના નિરૂપક શાસ્ત્રોના અધ્યયન-મનનમાં જ સંતુષ્ટ લોકોનું નિરાકરણ થઈ ગયું.”

આ ગાથાના ભાવને પૂજય ગુરુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે : -

“સિદ્ધશિલા પર લટકવાનું નામ મોક્ષ નથી. મોક્ષ એટલે જ્ઞાનાનંદસ્વરૂપી ભગવાન આત્મા જ્યારે દુઃખની દશાથી બિન્ન થઈને પોતાના આનંદરસકંદરસ્વરૂપ નિજ આત્મામાં રહે છે તો તે જ દશા મોક્ષ છે. પર્યાયમાં પરમ આનંદનો લાભ થવાનું નામ જ મોક્ષ છે - એમ નિયમસારમાં કહ્યું છે. પૂર્ણ ચૈતન્યધન પ્રલુબ આત્માની સમ્યગુદર્શનરૂપ પ્રતીતિ કરવી - કેવળજ્ઞાનરૂપ પૂર્ણ ઉપલબ્ધ કરવી - બસ એનું જ નામ મોક્ષ છે.

બીજી રીતે કહીએ તો ભગવાન આત્માની પર્યાયમાં અનાદિથી જે વિકારનો સંબંધ છે, તે જ બંધ છે અને તે જ સંસાર છે. જ્યારે તે કર્મ વિકારથી મુક્ત થઈને આત્મા પૂર્ણ અબંધ થઈ જય છે, ત્યારે પૂર્ણ જ્ઞાન અને આનંદની દશા પ્રગટ થાય છે. તે જ અવસ્થાનું નામ મોક્ષ છે.”

જ્યારે જીવ રાગ અને આત્માને બિન્ન બિન્ન જાણે, રાગથી બિન્ન શુદ્ધ આત્માનો અનુભવ કરે; ત્યારે ધર્મ થાય છે અને ત્યારે બંધથી છૂટે છે. માત્ર બંધના પ્રપંચ એટલે બેદ-પ્રભેદોને જાણવાથી ધર્મ થતો નથી, મોક્ષ થતો નથી. કર્મ પ્રક્રિયાને જાણીને તેનાથી બેદજ્ઞાન કરીને આત્મામાં જમવા-રમવાથી જ મોક્ષની પ્રાપ્તિ સંભવ છે અને તે જ ધર્મ છે.^૧

કર્મ તો વિધિપૂર્વક છેદવાથી જ છેદાય છે, નાખ થાય છે. અંદર આત્મામાં શુદ્ધ દર્શિ કરીને એમાં જ રમણતા કરીએ તો કર્મ નાખ થાય છે. પ્રક્ષા વડે રાગને આત્માથી બિન્ન કરી સ્વરૂપનો અનુભવ કરીએ તો કર્મ નાખ થાય છે. શુદ્ધનો અનુભવ કરવાથી શુદ્ધતા થાય છે. બંધના સ્વરૂપના વિકલ્પમાત્રથી બંધ કર્યારેય નાખ પામતો નથી.^૨

આ પ્રમાણે આ ગાથાઓમાં એમ જ બતાવવામાં આવ્યું છે કે કર્મબંધના બેદ-પ્રભેદોને જાણવામાત્રથી કર્મબંધનનો નાશ થતો નથી, મુક્તિની પ્રાપ્તિ થતી નથી.

૧. પ્રવચનરત્નાકર (હિન્દી), ભાગ C, પાનું ૩૧૫

૨. પ્રવચનરત્નાકર (હિન્દી), ભાગ C, પાનું ૩૧૬

૩. પ્રવચનરત્નાકર (હિન્દી), ભાગ C, પાનું ૩૧૬

જુઓ, અહીં આચાર્યદીપ કર્મશાસ્ત્રના વિસ્તારમાં જવાને પ્રપંચમાં પડવાનું કહી રહ્યા છે. તાત્પર્ય એ છે કે આવશ્યકતાનુસાર પ્રયોજનભૂત જાણકારીનો નિષેધ નથી; છતાંપણ તેમાં જ ઉલ્લઝીને રહેવું અને એમ માનવું કે એ મુક્તિનું સાધન છે, અમને તેનાથી જ મુક્તિની પ્રાપ્તિ થઈ જશે; એ જરા પણ યોગ્ય નથી.



શ્રી શ્વામનગોટ્ઠી

ધર્મનો મહિમા અતિ માર્મિક ઢંગથી કવિવર ભૂધરદાસજીએ નીચેની પંક્તિમાં વ્યક્ત કર્યો છે.

જ્ઞાયે સુર તરુ દેય સુખ, ચિન્તન ચિન્તા રૈન;
બિન જ્ઞાયે બિન ચિન્તયે, ધર્મ સકલ સુખ હૈન.

કલ્પવૃક્ષ સંકલ્પ કરવાથી એટલે કે માંગવાથી અને ચિંતામણિ રતન ચિંતવન કરવાથી ફળ આપે છે; પરંતુ ધર્મથી માંગયા કે ચિંતાબ્યા વિના ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે.

એક તરફ દીનતાપૂર્વક માંગવાથી તુચ્છ ભોગ-સામગ્રી આપવાવાળા કલ્પવૃક્ષ કર્યાં અને બીજુ તરફ અદ્ભૂત અતીન્દ્રિય આનંદ હેવાવાળો ધર્મ કર્યાં ! એ પ્રમાણે ચિન્તા કરવાથી ચિન્તિત મનોરથ પુરા કરનાર ચિન્તામણિ રતન કર્યાં અને ચિન્તાબ્યા વિના જ અચિન્ત્ય આનંદ આપનાર ધર્મ કર્યાં !

ભલુભોળું જગત ભલે કલ્પવૃક્ષ અને ચિન્તામણિ રતનના ગુણ ગાતા હોય, એની તુલના-સરખામણિ ધર્મથી કરતા હોય પણ ધર્મની સરખામણીમાં એનું સ્થાન કર્યાં ? અનન્ત સુખ-શાન્તિ હેવાવાળા ધર્મની સાથે કલ્પવૃક્ષ કે ચિન્તામણિ રતનની તુલના થઈ શકે નહિ.

(ડૉ. હુકમચંદજી ભારિલ લિખિત ભારત ભાવના-એક અનુશીલનમાંથી)

સમયસાર ગાથા ૨૬૧-૨૬૩

જે વાત વિગત ગાથાઓમાં કહેવામાં આવી છે, હવે તે જ વાતને આગામી ગાથાઓમાં તર્ક સહિત સિદ્ધ કરે છે.

ગાથાઓ મૂળથી આ પ્રમાણે છે.

જહ બંધે ચિંતંતો બંધણબદ્ધો ણ પાવદિ વિમોક્ખં ।

તહ બંધે ચિંતંતો જીવો વિ ણ પાવદિ વિમોક્ખં ॥૨૯૧॥

જહ બંધે છેત્તુણ ય બંધણબદ્ધો દુ પાવદિ વિમોક્ખં ।

તહ બંધે છેત્તુણ ય જીવો સંપાવદિ વિમોક્ખં ॥૨૯૨॥

બંધાણં ચ સહાવં વિયાળિદું અપ્પણો સહાવં ચ ।

બંધેસુ જો વિરજ્જદિ સો કમ્મવિમોક્ખણં કુણદિ ॥૨૯૩॥

(હરિગીત)

બંધન મહીં જે બદ્ધ તે નહિ બંધચિંતાથી ધૂટે,
ન્યમ જીવ પાગ બંધો તાણી ચિંતા કર્યાથી નવ ધૂટે. ૨૭૧.

બંધન મહીં જે બદ્ધ તે નર બંધછેદનથી ધૂટે,
ન્યમ જીવ પાગ બંધો તાણુ છેદન કરી મુજિત લહે. ૨૭૨.

બંધો તાણો જાગી સ્વભાવ, સ્વભાવ જાગી આત્મનો,
જે બંધ માંહી વિરક્ત થાયે, કર્મમોક્ષ કરે અહો ! ૨૭૩.¹

જે પ્રમાણે બંધનોથી બંધાયેલો પુરુષ બંધનોનો વિચાર કરવાથી બંધનોથી મુક્ત થતો નથી; તે જે પ્રમાણે જીવ પણ બંધનો વિચાર કરવાથી મુક્તિને પ્રાપ્ત કરતો નથી.

જે પ્રમાણે બંધનબદ્ધપુરુષ બંધનોને છેદીને મુક્ત થાય છે; તે જે પ્રમાણે જીવ પણ બંધનોને છેદીને મુક્તિ પ્રાપ્ત કરે છે.

બંધના સ્વભાવને અને આત્માના સ્વભાવને જ્ઞાણીને જે જીવ બંધ પ્રત્યે વિરક્ત થાય છે; તે કર્મથી મુક્ત થાય છે.

આ ગાથાઓનો ભાવ આત્મભ્યાતિમાં આ પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવ્યો છે : -

“અન્ય કોઈ લોકો એમ કહે છે કે બંધસંબંધી વિચારશૃંખલા જ મોક્ષનું કારણ છે; પરંતુ તે પણ ઠીક નથી. કર્મથી બંધાયેલા જીવોને બંધસંબંધી વિચારશૃંખલા પણ મોક્ષનું કારણ નથી; કારણ કે જે પ્રમાણે બેડી આદિથી બંધાયેલા પુરુષને ઉક્ત બંધન સંબંધી વિચારશૃંખલા બંધથી છૂટવાનું કારણ (ઉપાય) નથી; તે જે પ્રમાણે કર્મથી બંધાયેલા પુરુષને કર્મબંધસંબંધી વિચારશૃંખલા કર્મબંધથી મુક્તિનું કારણ (ઉપાય) નથી.

આ કથનથી કર્મસંબંધી વિચારશૃંખલાડ્રાપ વિશુદ્ધ (શુભ) ભાવડ્રાપ ધર્મધ્યાનથી જેમની બુદ્ધિ અંધ છે; તેમને સમજાવ્યું છે.

કર્મથી બંધાયેલા જીવને બંધનો છેદ જ મોક્ષનું કારણ છે; કારણ કે જે પ્રમાણે બેડી આદિથી બંધાયેલા પુરુષને બંધનનો છેદ જ બંધનથી છૂટવાનો ઉપાય છે; તે જે પ્રમાણે કર્મથી બંધાયેલા જીવને કર્મબંધનનો છેદ જ કર્મબંધનથી છૂટવાનો ઉપાય છે.

આ કથનથી પૂર્વકથિત બંધના સ્વરૂપના જ્ઞાનમાત્રથી જ સંતુષ્ટ અને બંધનો વિચાર કરનાર - આ બંનેને આત્મા અને બંધના દ્વિધાકરણના વ્યાપારમાં લગાવવામાં આવે છે.

જે નિર્વિકાર ચૈતન્યચમત્કારમાત્ર આત્મસ્વભાવને અને તે આત્માને

વિઝૃત કરનાર બંધના સ્વભાવને જાહીને બંધથી વિરક્ત થાય છે; તે જ સમસ્ત કર્મોથી મુક્ત થાય છે.

આ કથનથી એવો નિયમ (સુનિશ્ચિત) કરવામાં આવે છે કે આત્મા અને બંધનનું દ્વિધાકરણ (પૃથિકરણ) જ મોક્ષનું કારણ છે.”

અહીં ધ્યાન આપવા યોગ્ય વાત એ છે કે અહીં આચાર્ય અમૃતચંદ્ર કર્મબંધસંબંધી વિચારશુંખલારૂપ ધર્મધ્યાનથી મુક્તિ માનનારાઓને અંધબુદ્ધિ કહી રહ્યા છે. બંધ અને આત્માની વચ્ચે કરવામાં આવેલ બેદવિજ્ઞાનને મુક્તિનું કારણ બતાવતાં તેઓ અહીં બંધનો વિચાર કરનાર અને બંધના શાનમાત્રથી સંતુષ્ટ લોકોને આત્મા અને બંધના દ્વિધાકરણમાં લગાવવા માગે છે. આ કારણે નિર્ખર્ષ વાક્યમાં તેઓ સાફ્-સાફ્ કહે છે કે એ બંનેને આત્મા અને બંધના દ્વિધાકરણમાં લગાવવામાં આવી રહ્યા છે; કારણ કે એ સુનિશ્ચિત છે કે આત્મા અને બંધનું દ્વિધાકરણ જ મુક્તિનું કારણ છે.

આ સંબંધમાં પૂજ્ય ગુરુદેવનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે :-

“વિશુદ્ધ ધર્મધ્યાનનો અર્થ છે શુભભાવ, કે જે પુણ્યબંધનું કારણ છે. તેને જ આગમમાં અપાયવિચય ધર્મધ્યાન કહ્યું છે. ‘ધર્મધ્યાન’ શબ્દ જરા અટપટો લાગે છે, પરંતુ અહીં આ નામ વ્યવહાર ધર્મધ્યાનના અર્થમાં વપરાયું છે. નિયમસારમાં આવ્યું છે કે નિશ્ચય ધર્મધ્યાન અને વ્યવહાર ધર્મધ્યાન - બન્ને બિન્ન-બિન્ન છે. શુદ્ધ આત્માના આશ્રયથી જે શુદ્ધતા પ્રગટ થાય છે, તે નિશ્ચય ધર્મધ્યાન છે તથા કર્મ આદિની ચર્ચા અને વિચારધારારૂપ પરના લક્ષ્યથી જે શુભભાવ થાય છે, તે વ્યવહાર ધર્મધ્યાન છે. વર્તમાનમાં લોકોમાં અધિકાંશ આ વાત ચાલે છે કે શુભભાવથી ધર્મ થાય છે, પરંતુ ભાઈ ! શુભભાવ નિશ્ચયથી તો આર્તધ્યાનરૂપ ભાવ છે - તે ધર્મધ્યાન થાય પણ કેવી રીતે ? જુઓને ! અહીં સ્પષ્ટ કહ્યું છે કે ‘વિશુદ્ધ ધર્મધ્યાનથી જેની બુદ્ધિ અંધ છે....’ શુભભાવથી ધર્મ માનનારાઓ, શુભભાવ વડે બંધનથી છૂટવાનું માનનારાઓ અંધ છે - એમ કહ્યું છે.

અરે ભાઈ ! જુઓ, જે શુભભાવમાં પૂર્ણપણે તલ્લીન થઈ ગયા

છે, તે જીવોને એ ખબર નથી કે અતીન્દ્રિય જ્ઞાન અને આનંદના પિંડસ્વરૂપ ચૈતન્ય મહાપ્રભુ આપણે પોતે છીએ. તેઓ અંધબુદ્ધિ છે ને ?^૧

આહી તો એમ કહી રહ્યા છે. કે જે પોતાના અનંત શક્તિરૂપ ભગવાન આત્માનો આશ્રય ન લેતાં સ્વાધ્યાયના માધ્યમથી કર્મના બંધ, ઉદ્ધય, સત્તા આદિની શુભભાવરૂપ ચર્ચામાત્રથી સંતુષ્ટ છે, તે અંધબુદ્ધિ છે; કારણ કે તે ફક્ત શુભભાવને જ જુએ છે; પરંતુ શુભભાવોથી બિજ્ઞ પોતાના ભગવાન આત્માને દેખતો નથી.^૨

કર્મોથી ધૂટવાને મોક્ષ કહેવું તે નિમિત્તસાપેક્ષ કથન છે અને વિકારથી ધૂટવાને મોક્ષ કહેવું તે અશુદ્ધ ઉપાદાન સાપેક્ષ કથન છે તથા શુદ્ધ ઉપાદાનની અપેક્ષાએ કહીએ તો અબદ્ધસ્પૃષ્ટ આત્માનો અનુભવ કરનારાઓને મોક્ષ થાય છે - એમ કહેવામાં આવે છે. શુદ્ધ આત્માનો આશ્રય લેવાથી વિકાર ઉત્પન્ન જ થતો નથી. બસ, તેને જ વિકારનો છેદ કહેવામાં આવે છે.^૩

રાગને રાગમાં રહેવા હો અને જ્ઞાનોપ્યોગને અંદર જ્ઞાનસ્વભાવી આત્મામાં જોડી હો તો રાગ અને આત્મા બિજ્ઞ થઈ જય છે. બસ એ જ ધર્મ છે. અને ધર્મ કરવાની વિધિ પણ એકમાત્ર એ જ છે. બાકીની ધાર્મિક કિયાઓ બધી તેના જ સાધનભૂત છે; તેથી વ્યવહારથી તે સાધનોને પણ ધર્મ કહેવામાં આવે છે.^૪

જુઓ, આપો દિવસ ધંધા-વ્યાપાર, સ્ત્રી-પુત્ર-કુંદુંબનું ભરણ-પોષણ તથા ભોગ-ઉપભોગમાં લાગ્યા રહેવું - તે પાપનો વ્યાપાર છે તથા દયા-દાન, ભક્તિ-પૂજન અને બંધ-મોક્ષ આદિના વિચારોમાં અટકી રહેવું

૧. પ્રવચનરત્નાકર (હિંદી), ભાગ ૮, પાનું ૩૧૯

૨. પ્રવચનરત્નાકર (હિંદી), ભાગ ૮, પાનું ૩૨૦

૩. પ્રવચનરત્નાકર (હિંદી), ભાગ ૮, પાનું ૩૨૨

૪. પ્રવચનરત્નાકર (હિંદી), ભાગ ૮, પાનું ૩૨૩

- તે બધો પુણ્યનો વ્યાપાર છે અને પુણ્ય-પાપથી બિજ્ઞ અંદર બિરાળ રહેલ શુદ્ધચૈતન્યમાં જોડાવું તે ભેદજાનનો વ્યાપાર છે, ધર્મનો વ્યાપાર છે.

આત્માને રાગથી બિજ્ઞ કરવાનો આ વ્યાપાર જ ધર્મ છે. અરે ભાઈ! અનાદિથી જ્ઞાનને રાગમાં જોડી રાખ્યું છે, ત્યાંથી તોડીને જ્ઞાનને આત્મામાં જોડવું તે જ ધર્મનું પ્રથમ સોપાન છે.¹

અહો ! આત્માનો સ્વભાવ એવો આશ્ર્યકારક છે કે પરમાં તે કંઈ ફેસ્કર કરતો નથી અને સૂક્ષ્મથી સૂક્ષ્મ સમસ્ત પરપદાર્થો સહિત લોકાલોકને જાણે છે. ચૈતન્યચમત્કારમાત્ર કહીને એમ કહેવામાં આવ્યું છે કે આત્મા માત્ર જ્ઞાયકસ્વભાવી છે. પરના અથવા રાગના ભાવ પણ આત્માની ચીજ નથી - એ ભાવ પણ શરીરની માફક આત્માથી અન્ય છે.

આવા આત્મસ્વભાવને તથા વિકાર કરનાર બંધસ્વભાવને - બજેને જાણીને જે બંધથી વિરામ લઈ લે છે અર્થાત् રાગાદિભાવથી વિરક્ત થઈ જય છે; તે જ સર્વ કર્મથી છૂટે છે. વ્યવહારરત્નત્રયનો રાગ પણ બંધસ્વભાવ જ છે; તેથી તેનાથી પણ જે વિરક્ત થાય છે, તે સર્વકર્મથી છૂટે છે, મુક્તિને પ્રાપ્ત કરે છે.

રાગાદિ વિકારથી આત્માને બિજ્ઞ કરવો એ જ મોક્ષનું કારણ છે - આવો નિયમ આ કથનથી સિદ્ધ થાય છે. રાગાદિથી બિજ્ઞ આત્માની પ્રતીતિ કરવી તે સમ્યગ્દર્શન, રાગાદિથી બિજ્ઞ આત્માનું જ્ઞાન તે સમ્યગ્જ્ઞાન અને રાગાદિથી બિજ્ઞ આત્માનું આચરણ કરવું તે સમ્યક્યારિત છે. આ પ્રમાણે રાગથી, વિકારથી આત્માને બિજ્ઞ કરવો - અનુભવવો તે મોક્ષનું કારણ છે.

આ સિદ્ધાંત ફિલિત થતાં તે વાત જ ક્યાં રહે છે કે વ્યવહારરત્નત્રયથી નિશ્ચયમોક્ષમાર્ગ થાય છે ? અહીં તો એમ કહી રહ્યા છે કે વ્યવહારરત્નત્રયના શુભરાગથી આત્માને બિજ્ઞ અનુભવવો એ મોક્ષનું કારણ છે.²

1. પ્રવચનરત્નાકર (હિન્દી), ભાગ C, પાનું ૩૨૩

2. પ્રવચનરત્નાકર (હિન્દી), ભાગ C, પાનું ૩૨૫

પૂજ્ય ગુરુદેવના ઉકિત કથનમાં ધર્મધ્યાનને નિશ્ચય અને વ્યવહારના બેદ્ધી બે પ્રકારે બતાવવામાં આવ્યું છે અને કર્મબંધનના ચિંતનને વ્યવહાર ધર્મધ્યાન કહેવામાં આવ્યું છે. તેની જ પુષ્ટિ આ જ ગાથાઓના તાત્પર્યવૃત્તિમાં પ્રાપ્ત આચાર્ય જ્યસેનના ભાવાર્થથી પણ થાય છે; જે આ પ્રમાણે છે :-

“સમસ્ત શુભાશુભ બાધ્ય દ્રવ્યોના અવલંબન વગર ચિદાનંદસ્વરૂપ એક આત્માના અવલંબન વડે ઉત્પન્ન વીતરાગ ધર્મશુક્લધ્યાનથી રહિત જીવ બંધ પ્રપંચરચનાના ચિંતનરૂપ સરાગ ધર્મધ્યાનરૂપ શુભોપયોગ દ્વારા સ્વરૂપિત સુખના કારણરૂપ પુણ્યબંધને તો પ્રાપ્ત કરે છે; પરંતુ મોક્ષને પ્રાપ્ત થતો નથી - એવો ભાવાર્થ છે.”

આ પ્રકરણનો ભાવાર્થ લખતાં મુનિશ્રી વીરસાગરજી મહારાજ લખે છે :-

“જે કોઈ એવું માને છે કે ‘શાસ્ત્રનું પઠન-પાठન, કર્મબંધનનો ઉદ્ય, બંધ, ઉદ્દીરણા આદિ અને પ્રકૃતિબંધ, સ્થિતિબંધ આદિની ચિંતા-ચર્ચા-મનન-ચિંતન-ચિંતવન વગેરે કરીને તથા બહિરંગ કિયા કરવાથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું અને મોક્ષમાર્ગ શરૂ થયો’ તેમના પ્રતિ સંબોધન કરતાં શ્રી આચાર્યદીવ કહે છે કે બંધનું ચિંતન કરવાથી શુભોપયોગ થાય છે. તે ચિંતન બાધ્યદ્રવ્યનું આવલંબન લઈને થાય છે, તેનાથી વિકલ્પ જ થાય છે, તે નિર્વિકલ્પ સમાધિ (સ્વાનુભૂતિ-શુદ્ધોપયોગ) નથી; તેથી મોક્ષમાર્ગ શરૂ થતો નથી. આ બંધનનો વિકલ્પ કરતાં રહેવાથી સમ્યગ્દર્શન-સ્વાનુભવ પ્રાપ્ત થતો નથી. એટલે કે સ્વાનુભવ કરવાથી જ ચતુર્થાદિ ગુણસ્થાન પ્રગટ થાય છે. સ્વાનુભવથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. સ્વાનુભવના સમયે પોતાના સ્વભાવશુદ્ધ પરિપૂર્ણ, સ્વતંત્ર, ચિદાનંદમય આત્માનું અવલંબન હોવાથી ત્યાં શુભાશુભભાવ નથી; તેથી કર્મબંધના સંવરપૂર્વક નિર્જરા થાય છે - કર્મબંધ છૂટે છે.”

ઉકિત સંપૂર્ણ કથનથી આ વાત અત્યંત સ્પષ્ટ છે કે કર્મબંધ પ્રક્રિયાના જ્ઞાન અને ચિંતન મનનથી કર્મબંધનો અભાવ થતો નથી; કારણ

કે એ બધું શુભભાવકૃપ છે અને શુભભાવોથી પુણ્ય બંધ થાય છે, બંધનો અભાવ થતો નથી, સંવર-નિર્જરા થતા નથી, મોક્ષ થતો નથી.

પ્રશ્ન :- જે રીતે બોજનના જ્ઞાનથી અથવા બોજનની ચર્ચાથી પેટ ભરાતું નથી, પરંતુ બોજન ખાવાથી પેટ ભરાય છે; તે જ રીતે બંધના જ્ઞાન અને બંધની ચર્ચાથી કર્મો કપાતા નથી, પરંતુ કર્મ કાપવાથી કર્મ કપાય છે. - એ વાત તો ઢીક, પરંતુ મૂળ વાત તો એ છે કે કર્મ કાપવા માટે શું કરવું જોઈએ ?

કર્મો કાપવા માટે ભગવાનની ભક્તિ, પૂજા-પાઠ, વ્રત-ઉપવાસ, દ્યા-દાન અને કઠોર તપસ્યા પણ કરવી પડશે ને ?

ઉત્તર :- અરે ભાઈ ! આ બધા તો શુભભાવ અને ૪૪ શરીરની કિયકૃપ કિયકલાપ છે; કર્મબંધનો અભાવ તેમનાથી થતો નથી. કર્મબંધનો અભાવ અર્થાત् મુક્તિની પ્રાપ્તિ તો નિજતમાના અનુભવથી થાય છે. આ વાત આચાર્ય અમૃતચંદ્ર અને આચાર્ય જ્યસેનના કથનોથી બરાબર સિદ્ધ થઈ ગઈ છે.

ધ્યાન રાખવા યોગ્ય વાત એ છે કે અહીં ‘બંધનું જ્ઞાન અને બંધના વિચારથી મુક્તિની પ્રાપ્તિ થતી નથી’ - આમ કહીને આચાર્યદિવ આપણને કોઈ પણ કિયકાંડ અથવા શુભભાવમાં ઉત્ત્રાવવા માગતા નથી; પરંતુ તેમનાથી વિરક્ત થઈને આત્માનુભવ તરફ લઈ જવા માગે છે, બેદ-વિજ્ઞાનની ભાવનાને પ્રબળ કરવાની પ્રેરણા આપવા માગે છે.

અહીં એક આ વાત પણ વિશેષ ધ્યાન આપવા યોગ્ય છે; તે એમ છે કે ૨૬૨મી ગાથામાં જ્યાં આત્મઘ્યાતિમાં ‘જહ બંધે છેત્તૂણ’ પદ છે, ત્યાં જ તાત્પર્યવૃત્તિમાં ‘જહ બંધે મુત્તૂણ’ પદ જેવા મળે છે.

લાગે છે કે આચાર્ય જ્યસેનની સામે પાઠાંતર રૂપે છેત્તૂણ, મુત્તૂણ અને મિત્તૂણ ત્રણ રૂપ ઉપલબ્ધ હતા; કારણ કે તેમણે તાત્પર્યવૃત્તિમાં આ પદનો અર્થ કરતાં છિત્વા, મિત્વા અને મુક્ત્વા - એ પ્રમાણે ત્રણ અર્થ

કર્યા છે. ઉદાહરણમાં પણ રસ્સીથી બંધાયેલો, સાંકળથી બંધાયેલો અને લકડાની બેડીથી બંધાયેલો - એવા તરફ પ્રકારના પુરુષ લીધા છે.

તેમનું મુળ કથન આ પ્રમાણે છે :-

“જે રીતે બંધનથી બંધાયેલો કોઈ પુરુષ રસ્સીના બંધનને, સાંકળના બંધનને, લકડાની બેડીના બંધનને - કોઈ પણ પ્રકારના બંધનને, કોઈને છેદીને, કોઈને બેદીને અને કોઈને છોડીને (ખોલીને) પોતાના વિજ્ઞાન અને પુરુષાર્થના બળ વડે બંધનથી મુક્ત થાય છે; તે જ પ્રકારે જીવ પણ વીતરાગી નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાનઙ્ઘી શસ્ત્રથી બંધને છેદીને - બે ટ્રકડા કરીને, બેદીને-વિદારીને, છોડીને-છોડાવીને-ખોલીને નિજશુદ્ધાત્માની ઉપલબ્ધિઙ્ઘ્ય મોકને પ્રાપ્ત કરે છે.”

આ ગાથાની ટીકામાં આચાર્ય જ્યસેન એક એવા વિષય પર પ્રકાશ પાથરે છે, જે આત્માર્થી મુમુક્ષુ ભાઈઓ માટે અત્યંત ઉપયોગી છે. તે આ પ્રમાણે છે :-

“અહીં શિષ્ય કહે છે કે પ્રકૃત ગ્રંથમાં જે નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાન કહ્યું છે, તે ઘટિત થતું નથી; કારણ કે જે પ્રમાણે જૈનમતમાં સત્તાવલોકનઙ્ઘ્ય ચક્ષુદર્શન આદિ દર્શન નિર્વિકલ્પ કહ્યું છે, પરંતુ તે નિર્વિકલ્પ પણ વિકલ્પનો જરનક થાય છે. જૈનમતમાં તો ‘જ્ઞાન વિકલ્પનો ઉત્પાદક હોય છે’ - એમ નથી; પરંતુ જ્ઞાન સ્વરૂપથી જ સવિકલ્પ અને સ્વપરપ્રકાશક છે.

હવે એનું સમાધાન કરે છે. ખરેખર વાત એમ છે કે જૈનમતમાં જ્ઞાનને કથંચિત્ સવિકલ્પ અને કથંચિત નિર્વિકલ્પ કહ્યું છે.

તે આ પ્રમાણે છે - જે રીતે વિષયાનંદિંઘ્ય સરાગ-સ્વસંવેદનજ્ઞાન સરાગ સંવિતિવિકલ્પઙ્ઘ્યે સવિકલ્પ જ છે; તો પણ શેષ અનિચ્છિત સૂક્ષ્મ વિકલ્પનો સદ્ભાવ હોવા છતાં પણ તેમની મુખ્યતા ન હોવાથી નિર્વિકલ્પ પણ કહેવાય છે.

તે જ પ્રમાણે સ્વશુદ્ધાત્મની સંવિતિઙ્ઘ્ય વીતરાગ સ્વસંવેદનજ્ઞાન પણ સ્વસંવિતિઙ્ઘ્ય એક આકારવાળું હોવાથી સવિકલ્પ હોવા છતાં પણ તથા શેષ અનિચ્છિત સૂક્ષ્મ બાધ્ય વિકલ્પનો સદ્ભાવ હોવા છતાં પણ, તેમની મુખ્યતા ન હોવાથી શુદ્ધાત્મની અનુભૂતિને નિર્વિકલ્પ પણ કહે છે.

ઈહામતિજ્ઞાનપૂર્વક અથવા બુદ્ધિપૂર્વક સ્વસંવિતિના આકારઢપ અંતર્મુખ પ્રતિભાસ હોવા છતાં પણ તે જ સમયે અનિચ્છિત સૂક્ષ્મ બાહ્ય વિકલ્પ પણ હોય છે; તે જ કારણે સ્વપરપ્રકાશ સિદ્ધ થાય છે.

આ પ્રમાણે નિર્વિકલ્પ અને સવિકલ્પ જ્ઞાનનું તથા સ્વપરપ્રકાશક જ્ઞાનનું આ કથન અત્યંત સ્પષ્ટ છે. જે એનું વ્યાપ્ત્યાન આગમ, અધ્યાત્મ અને તર્કશાસ્ત્રના અનુસારે કરવામાં આવે તો બહુ જ વિસ્તાર થઈ જાય. અહીં અધ્યાત્મશાસ્ત્ર હોવાથી એનું કથન વિસ્તારથી કરવું ઉચિત નથી.”

આચાર્ય જયસેનના ઉકિત કથનથી આ વાત અત્યંત સ્પષ્ટ થઈ જાય છે કે આત્માનુભૂતિના કાળમાં આત્મા મુખ્ય અને ગૌણકૃપે સ્વ અને પર - બંનેને જ જાણે છે તથા જ્ઞાનનો સ્વભાવ જ વિકલ્પાત્મક હોવાથી અનુભવના કાળમાં પણ તે સવિકલ્પ જ રહે છે; કારણ કે તેની આત્મસંવિત્તિ તો સાકાર (સવિકલ્પ) છે જ; અનિચ્છિત સૂક્ષ્મ બાહ્યવિકલ્પ પણ રહે જ છે; તેમને ગૌણ કરીને જ આત્માનુભવને નિર્વિકલ્પ કહેવામાં આવે છે.

આ પ્રમાણે આત્માનુભવ કથંચિત્ત સવિકલ્પ અને કથંચિત્ત નિર્વિકલ્પ હોય છે. તેમાં પણ સવિકલ્પતાનું વજન વધારે છે; કારણ કે તે વસ્તુસ્થિતિના આધાર પર છે, જ્ઞાનના સવિકલ્પ (સાકાર) સ્વભાવના આધાર પર છે અને નિર્વિકલ્પતાનું વજન અપેક્ષાએ ઓછું છે; કારણ કે તે વિકલ્પોને ગૌણ કરીને કહેવામાં આવ્યું છે.

સૌથી મોટી વાત તો એ છે કે આચાર્યદ્વારા સ્વાનુભૂતિને સવિકલ્પ સિદ્ધ કરવામાં તેના સ્વપરપ્રકાશકપણાને હેતુકૃપે પ્રસ્તુત કરે છે અને કહે છે કે જે એમ નહીં માનીએ તો અનુભવના કાળમાં જ્ઞાન સ્વપરપ્રકાશક નહીં રહે. લાગે છે કે આચાર્યદ્વારા જ્ઞાનનું સ્વપરપ્રકાશક ન રહેવું કોઈ પણ સ્થિતિમાં સ્વીકાર્ય નથી. તેથી તેઓ આવો તર્ક પ્રસ્તુત કરે છે.

આ સંદર્ભમાં જે લોકો ભર્મિત છે; તેમણે આ પ્રકરણનું ઊંડાણથી અધ્યયન કરવું જોઈએ.

પ્રશ્ન :- અનુભૂતિને તો નિર્વિકલ્પ જ કહેવામાં આવે છે. અત્યાર સુધી તો એમ જ સાંભળતા આવ્યા છીએ; પરંતુ અહીં તેને કથંચિતું સવિકલ્પ તથા કથંચિતું નિર્વિકલ્પ કહેવામાં આવી રહી છે. ચાલો, તેને પણ માની લઈએ; પણ એ કેમ માની શકાય કે સવિકલ્પતાનું વજન વધારે છે ?

ઉત્તર :- કૃપા કરીને આચાર્ય જ્યસેનના કથનને જીણવટથી જુઓ. આચાર્ય જ્યસેન તો અત્યંત સ્પષ્ટ શબ્દોમાં લખે છે કે બૌદ્ધમતમાં જ્ઞાનને નિર્વિકલ્પ કહે છે; પણ તે નિર્વિકલ્પજ્ઞાન પણ વિકલ્પનું ઉત્પાદક છે; પરંતુ જૈનમતમાં તો જ્ઞાનને વિકલ્પનું ઉત્પાદક ન કહેતાં સ્વરૂપથી જ સવિકલ્પ અને સ્વપરપ્રકાશક કહું છે.

તાત્પર્ય એમ છે કે વિકલ્પાત્મકતા અને સ્વપરપ્રકાશકપણું જ્ઞાનનો સ્વભાવ છે, તેનું સ્વરૂપ છે; વિભાવ અથવા વિકાર નથી.

આગળ આચાર્ય જ્યસેન અત્યંત સ્પષ્ટ શબ્દોમાં લખે છે કે સ્વશુદ્ધાત્મસંવિતિક્રિપ વીતરાગ સ્વસંવેદનજ્ઞાન સ્વસંવિતિક્રિપ એક આકારવાળું હોવાથી સવિકલ્પ હોવા છતાં પણ અને શેષ અનિષ્ઠિત સૂક્ષ્મ બાધ્ય વિકલ્પનો સદ્ધભાવ હોવા છતાં પણ; તેમને ગૌણ કરીને જ અનુભૂતિને નિર્વિકલ્પ કહી છે.

ધ્યાન રહે કે અહીં સ્વસંવેદનજ્ઞાનને બે કારણોથી સવિકલ્પ કહેવામાં આવ્યું છે. એક તો તે પોતે સ્વભાવથી જ સાકાર હોવાથી સવિકલ્પ છે અને બીજું સ્વસંવિતિકાળમાં સૂક્ષ્મ બાધ્યવિકલ્પોનો સદ્ધભાવ રહે છે; તે કારણે પણ સવિકલ્પ છે. ઉક્ત બંને પ્રકારના વિકલ્પો હોવા છતાં પણ તેમને ગૌણ કરીને અને સ્થૂળ બાધ્યવિકલ્પોનો અભાવ હોવાથી તેમની મુખ્યતા કરીને સ્વસંવેદનજ્ઞાનને નિર્વિકલ્પ કહેવામાં આવે છે. આ પ્રમાણે સવિકલ્પતાનું વજન વધારે છે. સ્વપરપ્રકાશકપણું પણ આત્માનો સ્વભાવ હોવાથી આત્મામાં સદા રહે જ છે. તેથી તે અનુભૂતિકાળમાં પણ રહેશે જ.

ઉક્ત કથનોમાં સંપૂર્ણ વસ્તુસ્થિતિ હૃથ પર રાખેલા આમળાની માફક સ્પષ્ટ છે; છતાં પણ તમને નથી જ્યતી તો અમે શું કરી શકીએ? જે આપે આજ સુધી આ વાત નથી સાંભળી તો તેમાં આચાર્યોનો તો કંઈ દોષ નથી. જે કે આ વાત આગમમાં તો છે જ અને જ્ઞાનીજન પણ જાણે જ છે; છતાં પણ તે આજકાલ ઓછી સાંભળવામાં આવે છે - એ વાત પણ સત્ય જ છે. આજ કારણે પ્રસંગ આવતાં અમે અહીં આપ સૌનું ધ્યાન વિશેષ આકર્ષિત કરી રહ્યા છીએ; જેથી ભવિષ્યમાં એમ કહેવાનો અવસર ન રહે કે અમે તો આ વાત ક્યારેય સાંભળી પણ નથી.

અમારી તો બસ એટલી જ ભલામણ છે કે હવે આપ આ વિષયને એમ જ છોડી ન દો; તેના પર ઉંડાણથી ચિંતન જડુર કરો.



શાબાનગોષ્ಠી

- ધ્યાન-ભાવના -

સર્વ વિકલ્પનો-તર્કનો ત્યાગ કરીને

મનનો

વચ્ચનનો

કાયાનો

ઇદ્રિયનો

આહારનો

નિદ્રાનો

જ્ય કરીને

નિર્વિકલ્પપણે અંતમુખ વૃત્તિ કરી આત્મધ્યાન કરવું. માત્ર અનાબાધ અનુભવ સ્વરૂપમાં લીનતા થવા હેવી. બીજુ ચિંતવના ન કરવી. જે જે તર્કાદિ ઉઠે તે નહિ લંબાવતાં ઉપશમાવી હેવા.

- શ્રીમદ્ રાજચંદ્ર

સમયસાર ગાથા ૨૬૪

વિગત ગાથાઓમાં એમ કહેવામાં આવ્યું છે કે બંધમાંથી મુક્તિનો ઉપાય આત્મા અને બંધની વચ્ચે દ્વિધાકરણ જ છે. તેથી હવે એ પ્રશ્ન ઉઠવો સ્વાભાવિક જ છે કે ઉક્ત દ્વિધાકરણનું સાધન શું છે? આત્મા અને બંધની વચ્ચે આ દ્વિધાકરણ કયા સાધન વડે કરી શકાય? શું દ્વાદા, દાન, વ્રત-શીલ-સંયમ, તપ-ત્યાગ, પૂજા-પાઠ આદિ કિયાઓ અને તત્ત્વબંધી શુભભાવો વડે આ કામ થઈ જશે?

ઉક્ત પ્રશ્નના ઉત્તરમાં જ આ ૨૬૪મી ગાથાનો જન્મ થયો છે. આ જ કારણે આ ગાથાની ઉત્થાનિકામાં આચાર્ય અમૃતચંદ્ર લખે છે કે જે કોઈ એમ કહે કે આત્મા અને બંધનું દ્વિધાકરણ કયા સાધન વડે થાય તો તેનો ઉત્તર આ પ્રમાણે છે.

જીવો બંધો ય તહા છિજ્જાંતિ સલક્ખણેહિં ણિયએહિં ।
પણા છે દણએણ દુ છિણા ણાણત્તમાવણા ॥૨૯૪॥

(હરિગીત)

જીવ બંધ બને, નિયત નિજ નિજ લક્ષાગે છેદાય છે,
પ્રશાધીણી થકી છેદતાં બને જુદા પડી જાય છે. ૨૬૪.^૧

૧. સમયસાર (ગુજરાતી) પાનું ૪૨૮

જીવ તથા બંધ નિયત સ્વલક્ષણો વડે છેદવામાં આવે છે. પ્રજ્ઞાઙ્ગી છીણી વડે છેદવામાં આવતાં તે બિજ્ઞત્વને પ્રાપ્ત થાય છે.

ઉક્ત ગાથામાં એમ જ કહેવામાં આવ્યું છે કે આત્મા અને બંધના દ્વિધાકરણમાં ભગવતી પ્રજ્ઞા જ એકમાત્ર સાધન છે. તાત્પર્ય એ છે કે આ મહાન કાર્યનું સાધન પણ તારી અંદર જ વિદ્યમાન તારી બુદ્ધિ જ છે; બહાર કર્દી જવાનું નથી.

આ ગાથાનો ભાવ આત્મઘ્�યાતિમાં આચાર્ય અમૃતચંદ્ર વિસ્તારથી આ પ્રમાણે સ્પષ્ટ કરે છે -

“આત્મા અને બંધને દ્વિધા કરવાઙ્ગુપ કાર્યનો કર્તા તો આત્મા છે; પણ કરણ કોણ છે - આ વાત પર ગંભીરતાથી વિચાર કરતાં એમ સુનિશ્ચિત થાય છે કે ભગવતી પ્રજ્ઞા જ (જ્ઞાનસ્વરૂપ બુદ્ધિ જ) છેદનાત્મક કરણ છે; કારણ કે નિશ્ચયે કરણ કર્તાથી બિજ્ઞ હોતો નથી. પ્રજ્ઞા વડે આત્મા અને બંધનો છેદ કરતાં તે અવશ્ય જ બિજ્ઞતાને પ્રાપ્ત થાય છે; તેથી એ સુનિશ્ચિત છે કે પ્રજ્ઞા વડે આત્મા અને બંધનું દ્વિધાકરણ થાય છે.

પ્રશ્ના:- આત્મા ચેતક અને બંધ ચેત્ય છે. એ બજે અજ્ઞાનદરશામાં ચેત્ય-ચેતકભાવ વડે અત્યંત નિકટતાને કારણે એક સમાન થઈ રહ્યા છે, એક જેવા જ અનુભવમાં આવી રહ્યા છે અને બેદવિજ્ઞાનના અભાવને કારણે જાણે બંને ચેતક જ હોય - એવો વ્યવહાર કરવામાં આવે છે, તેમને વ્યવહારમાં એકરૂપે જ માનવામાં આવે છે - આવી સ્થિતિમાં તેમને પ્રજ્ઞા દ્વારા કેમ છેદી શકાય ?

ઉત્તરઃ:- આત્મા અને બંધના નિયત સ્વલક્ષણોની સૂક્ષ્મ અંત: સંધિમાં પ્રજ્ઞાઈણીને સાવધાનીથી અફ્ઝાડતાં તેમને છેદી શકાય છે - એમ અમે માનીએ છીએ.

અન્ય સમસ્ત દ્રવ્યોમાં અસાધારણ હોવાને લીધે, અન્ય દ્રવ્યોમાં નથી જળાતું એવું ચૈતન્ય આત્માનું લક્ષણ (સ્વલક્ષણ) છે. તે ચૈતન્ય પ્રવર્ત્તમાન થતું થકું જે જે પર્યાયમાં વ્યાપ્ત થઈને પ્રવર્ત્તે છે અને નિવર્ત્તાનું

થકું જે જે પર્યાયને ગ્રહણ કરીને નિવર્તે છે; તે તે સમસ્ત સહવત્તી અને કમવત્તી પર્યાયો આત્મા છે. આ પ્રમાણે લક્ષિત કરવું (લક્ષણથી ઓળખવું). કારણ કે આત્મા તે એક ચૈતન્યલક્ષણથી જ લક્ષિત છે.

આ પ્રમાણે એમ સુનિશ્ચિત થયું કે સમસ્ત સહવત્તી અને કમવત્તી અનંત પર્યાયો સાથે અવિનાભાવી સંબંધ હોવાથી આત્મા ચિન્માત્ર જ છે - એમ નિર્ણય કરવો જોઈએ. તાત્પર્ય આમ છે કે જે ગુણ-પર્યાયોમાં ચૈતન્યલક્ષણ વ્યાપે છે; તે બધા ગુણ અને પર્યાયો આત્મા જ છે - એમ જાણવું જોઈએ.

બંધનું લક્ષણ આત્મદ્રવ્યથી અસાધારણ - એવા રાગાદિભાવ છે; તે રાગાદિભાવ આત્મદ્રવ્યની સાથે સાધારણપણું (એકત્વદ્વય) ધારણ કરતાં પ્રતિભાસતા નથી, પરંતુ તેઓ સદા ચૈતન્યમંતકારથી લિઙ્ગદ્વયે જ પ્રતિભાસે છે.

અને આ ચૈતન્ય આત્મા પોતાની સમસ્ત પર્યાયોમાં વ્યાપ્ત થઈને જેટલો પ્રતિભાસિત થાય છે, તેટલા રાગાદિક ભાવ પ્રતિભાસતા નથી; કારણ કે જ્યાં રાગાદિક હોતા નથી ત્યાં પણ ચૈતન્યનો આત્મલાભ હોય છે અર્થાત્ આત્મા હોય છે.

અને જે ચૈતન્યની સાથે રાગાદિભાવોની ઉત્પત્તિ ભાસે છે; તે તો ચેત્ય-ચેતકભાવ (જ્ઞાય-જ્ઞાયકભાવ)ની અતિ નિકટતાને કારણે જ ભાસે છે, રાગાદ અને આત્માના એકત્વનું કારણ નથી.

જે રીતે દીપક વડે પ્રકાશવામાં આવતા ઘટાદિક પદાર્થ દીપકના પ્રકાશકપણાને પ્રગટ કરે છે, ઘટાદિપણાને નહીં; તે જ રીતે આત્માના જ્ઞાનમાં જણાતા રાગાદિભાવ આત્માના ચેતકત્વને જ પ્રગટ કરે છે, રાગાદિકત્વને નહીં.

આવું હોવા છતાં પણ આત્માની અને બંધની અત્યંત નિકટતાને કારણે બેદસંભાવનાનો અભાવ હોવાથી અર્થાત્ બેદ નહિ દેખાતો હોવાથી અજ્ઞાનીને અનાદિકાળથી આત્મા અને રાગાદિમાં એકત્વનો વ્યામોહ (ભ્રમ)

છે; કે ને પ્રક્ષા વડે અવશ્ય જ છેદી શકાય છે. તાત્પર્ય એમ છે કે ઉક્ત ઐક્તવના વ્યાખ્યાને આત્મસન્મુખ જ્ઞાનની પર્યાય વડે અવશ્ય જ મટાડી શકાય છે.”

આચાર્ય જ્યસેન ઉક્ત ગાથાની ટીકા અત્યંત સંક્ષેપમાં લખે છે. તેઓ ગાથાના ભાવને માત્ર દોહરાવે જ છે; પરંતુ પ્રજ્ઞાધીણીને શુદ્ધાત્માનુભૂતિ લક્ષણવાળા બેદજ્ઞાનના ઇપમાં પરિલાખિત કરે છે. તેમની દર્શિમાં શુદ્ધાત્માનુભૂતિકૃપ બેદવિજ્ઞાન જ પ્રજ્ઞાધીણી છે, જેનાથી આત્મા અને બંધને બેદી શકાય છે.

આત્મઘ્યાતિ ટીકામાં અહીં જે આત્માને બંધથી બિન્ન જાણવાનો છે, તેને સમસ્ત સહવર્તી પર્યાયો અને કુમવર્તી પર્યાયોથી અભિન્ન બતાવવામાં આવ્યો છે. એ તો આપ જણો જ છો કે સહવર્તી પર્યાયનો આશય ગુણોથી છે. એ પ્રમાણે અહીં ચૈતન્યને અનુસરતા અનંતગુણ અને તેમના નિર્મળ પરિણમનને આત્મા કહેવામાં આવ્યા છે. અને રાગાદિભાવકૃપ વિકારી પરિણમનને બંધકૃપ નિર્દ્દેશવામાં આવ્યા છે. પ્રજ્ઞાધીણી દ્વારા એ બંને વચ્ચે જ બેદજ્ઞાન કરવાનું છે. ધ્યાન રહે કે આ મોક્ષાધિકાર ચાલી રહ્યો છે, બેદવિજ્ઞાનનું પ્રકરણ છે અને ઉત્કૃષ્ટ અધ્યાત્મની ચર્ચા ચાલી રહી છે.

જે લોકો આધ્યાત્મિક ચર્ચામાં સર્વત્ર જ આત્માને સમસ્ત પર્યાયોથી બિન્ન નિર્દ્દેશ કરે છે; તેમણે ઉક્ત પ્રકરણનું ગંભીરતાથી અધ્યયન કરવું જોઈએ અને પ્રતિપાદન કરતી વખતે પણ આ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે પ્રસ્તુત પ્રકરણમાં કઈ અપેક્ષા છે ?

પૂજ્ય ગુરુદેવ અનેક જગાએ સ્પષ્ટકૃપે કહે છે કે અહીં નિર્મળ પર્યાયને શામિલ કરીને વાત કરી રહ્યા છે. આવી સાવધાની અધ્યાત્મના પ્રત્યેક પ્રવક્તાએ રાખવી આવશ્યક છે.

એક વાત બીજી પણ ધ્યાન આપવા જેવી છે કે મુખ્યકૃપે મોહનીય કર્મના ઉદ્દ્યમાં થતા મોહ-રાગ-દ્રેષ્ટ અને સુખ-દુઃખાદિને જ મહિનભાવ

કહે છે અને તે જ બંધમાં શામિલ છે; આત્માના અન્ય સર્વે પરિણામન નહીં; કારણ કે કટિપય ગુણોનું પરિણામન છોડીને શેષ બધા ગુણોનું પરિણામન તો સદા નિર્ભળ જ રહે છે.

પ્રશ્ન:- આત્મઘ્યાતિમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં રાગાદિક હોતા નથી, ત્યાંપણ આત્મા જેવા મળે છે; તેથી રાગાદિક આત્મા નથી.

ઉક્ત સંદર્ભમાં પ્રશ્ન એ છે કે આત્માની એવી કઈ દશા છે કે જ્યાં રાગાદિ દેખાતા નથી ?

તેના ઉત્તરમાં જે એમ કહેવામાં આવે કે સિદ્ધદર્શામાં રાગાદિ જેવામાં આવતા નથી તો અમે કહીશું કે સિદ્ધદર્શામાં તો ભત્તિજ્ઞાનાદિ પણ દેખાતા નથી; પરંતુ તેમને તો આત્માનું લક્ષણ માનવામાં આવ્યું છે. તેવળજ્ઞાન પણ છિદ્રસ્થ અવસ્થામાં હોતું નથી. આ પ્રમાણે તેને પણ આત્માનું લક્ષણ માની ન શકાય.

આ રીતે બધું મેળવીને પ્રશ્ન એમ છે કે જ્યારે ભત્તિજ્ઞાનાદિ આત્મામાં શામિલ થઈ શકે છે તો પછી રાગાદિ કેમ નહીં; કારણ કે ભત્તિજ્ઞાનની માફક જ રાગાદિક પણ આત્માની જ પર્યોયો છે.

ઉત્તર:- અરે ભાઈ ! આત્માનો સ્વભાવ તો જાળવા-દેખવાનો છે, જેને આપણે ચૈતન્ય કહીએ છીએ અને તે જ આત્માનું લક્ષણ છે.

જે આત્માની સાથે સદા રહે, તે જ આત્માનું આત્મભૂત (વાસ્તવિક) લક્ષણ બની શકે છે. સામાન્યદર્શન અને સામાન્યજ્ઞાન આત્માની સાથે સદા રહે છે. તેથી તે સામાન્યદર્શન-જ્ઞાન જ આત્માનું વાસ્તવિક લક્ષણ છે.

ભત્તિજ્ઞાનાદિ જ્ઞાન અને ચક્ષુદર્શનાદિ તો ઉક્ત સામાન્યજ્ઞાન-દર્શનના બેદ-પ્રબેદ છે. જે તેમાંથી કોઈ એક જ્ઞાન અને એક દર્શન પણ રહે તો સામાન્યજ્ઞાન-દર્શન પણ રહે જ. આ પ્રમાણે જ્ઞાન-દર્શન સામાન્યરૂપથી આત્મા સાથે સદા રહે છે; તે કારણે તે આત્માના લક્ષણ છે.

આમ તો 'સામાન્ય' પદનો પ્રયોગ અનેક સ્થાનો પર દ્રવ્ય અને ગુણોના અર્થમાં જ થાય છે; છતાં પણ અહીં આ વાત નથી. અહીં સામાન્યજ્ઞાન અને સામાન્યદર્શન પદોથી એકલા જ્ઞાન અને દર્શન ગુણજ લેવાતા નથી; પરંતુ તેમાં જાળવા-દેખવાડ્રપ પરિણમન પણ શામિલ છે.

વાસ્તવમાં તો અહીં મુખ્યડ્રપે જાળવા-દેખવાડ્રપ પર્યાયના સામાન્યપણાની જ વાત છે. જાળવું સામાન્ય, જેવું સામાન્ય; જાળવું દેખવું સામાન્ય - એમ સામાન્ય જ લેવાનું છે. તાત્પર્ય એમ છે કે કોણે જાણ્યું, શું જાણ્યું, કેમ જાણ્યું, સાચું જાણ્યું કે ખોટું જાણ્યું; કુમતિજ્ઞાનથી જાણ્યું કે સુમતિજ્ઞાનથી જાણ્યું યા કેવળજ્ઞાનથી જાણ્યું આ બધી વાતોની કોઈ અપેક્ષા રાખ્યા વિના માત્ર જાણ્યું - એટલું જ લેવાનું છે; તેનું જ નામ સામાન્યજ્ઞાન છે. કોઈ પણ ડ્રપમાં ભલે, પણ જે જાળવાની છિયા સંપત્ત થઈ છે તો તે જ્ઞાન સામાન્યજ્ઞાન છે અને તે જ આત્માનું લક્ષણ છે, તેનાથી જ ભગવાન આત્મા લક્ષિત થાય છે.

આત્માનું આ જાળવા-દેખવાડ્રપ લક્ષણ નિગોદિયાથી લઈને સિદ્ધ ભગવાન સુધી બધામાં જેવા મળે છે અને આત્માથી અતિરિક્ત પદાર્થોમાં જેવામાં આવતું નથી અને આત્મામાં સદાય રહે જ છે; કારણે તે અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ દોષોથી રહિત તદ્દન નિરાપદ આત્મભૂત લક્ષણ છે.

પ્રશ્ન:- ક્યારેક એવું પણ તો હોઈ શકે કે કર્મોથી આવરિત થઈને આત્મા કંઈ પણ ન જાણે ?

ઉત્તર:- ના ભાઈ ! એવું ક્યારે પણ ન હોઈ શકે; કારણ કે જ્ઞાનનો અંતિમ અંશ સદા નિરાવરણ જ હોય છે, તેના પર કર્મનું આવરણ થતું જ નથી. જે કર્મોવરણથી તે પણ લુપ્ત થઈ જય તો આત્મા અચેતન થઈ જવાની આપત્તિ ઉપસ્થિત થઈ જય. આ કરણાનુયોગથી પુષ્ટ વાત છે.

ગોમટસાર: લુલકાંડની ગાથા ઉઠમાં આ વિષય આવ્યો છે, તેની

સમ્યક્ષાનચંદ્રિકા નામની ટીકામાં પંડિત ટોડરમહલજી લખે છે કે શ્રુતક્ષાનનો
પર્યાય નામનો બેદ નિરાવરણ હોય છે. તેમનું મૂળકથન આ પ્રમાણે છે-

“જે પર્યાયક્ષાન પણ આવરાઈ જય તો ક્ષાનનો અભાવ થઈ જય,
ક્ષાન ગુણનો અભાવ થતાં ગુણી (એવા) જીવદ્રવ્યનો પણ અભાવ થાય,
જે એવું તો થતું નથી; તો પર્યાયક્ષાન નિરાવરણ જ છે.”

આ પ્રમાણે સામાન્યક્ષાન અને સામાન્યદર્શન આત્માના લક્ષણાં
છે અને આ ભગવાન આત્મા તેમનાથી લક્ષિત થાય છે.

રાગાદિભાવ તો આત્માના વિભાવ છે, સ્વભાવ નથી; તેઓ તે
બંધના લક્ષણાં છે; જે બંધથી આત્માને બિજ્ઞ કરવાનો છે; તે આત્માના
લક્ષણ કેવી રીતે બની શકે, તે આત્મામાં શામિલ પણ કેવી રીતે થઈ શકે?

પ્રશ્ન:- આ રીતે તો મિથ્યાક્ષાન પણ આત્માનું લક્ષણ થઈ જશે?

ઉત્તર:- અરે, ભાઈ ! કહ્યું છે ને કે આત્માનું લક્ષણ તો
સામાન્યદર્શન અને સામાન્યક્ષાન છે; જેમાં સમ્યક અને મિથ્યાનો કોઈ
બેદ હોતો નથી, અલ્પતા અને પૂર્ણતાનો પણ કોઈ બેદ હોતો નથી.

સમ્યકૃત્વ અને મિથ્યાત્વ તો શ્રદ્ધાના દોષ છે, ક્ષાનના નહીં,
દર્શનના પણ નહીં. મિથ્યાદર્શન (મિથ્યાશ્રદ્ધા) ને કારણે ક્ષાનને મિથ્યાક્ષાનનું
નામ મળે છે અને દર્શનગુણની પર્યાયોમાં તો મિથ્યા અને સમ્યકનો કોઈ
બેદ હોતો જ નથી. અલ્પતા પણ કોઈ વિકાર નથી.

જાણવું તે તો જાણવું જ છે - ચાહે અલ્પ હોય યા પૂર્ણ, સમ્યક
હોય યા મિથ્યા અને તે સામાન્ય જાણવું જ આત્માનું લક્ષણ છે, જેનાથી
ભગવાન આત્મા લક્ષિત થાય છે.

પ્રશ્ન:- દ્રવ્યસંગ્રહમાં તો આઠ પ્રકારના ક્ષાન અને ચાર પ્રકારના
દર્શનોને જીવના લક્ષણ કહ્યા છે અને તત્ત્વાર્થસૂત્રમાં પણ ઉપયોગને જીવનું
લક્ષણ બતાવીને તેના આઠ અને ચાર બેદ બતાવ્યા છે.

તેમાં ક્ષાનોપયોગના આઠ બેદ આ પ્રમાણે છે -

૧. કુમતિજ્ઞાન, ૨. કુશ્રુતજ્ઞાન, ૩. કુઅવવિજ્ઞાન, ૪. સુમતિજ્ઞાન,
૫. સુશ્રુતજ્ઞાન, ૬. સુઅવવિજ્ઞાન, ૭. મન:પર્યાજ્ઞાન અને ૮. કેવળજ્ઞાન.

દર્શનોપયોગના ચાર બેદ આ પ્રમાણે છે -

૧. ચક્ષુદર્શન, ૨. અચક્ષુદર્શન, ૩. અવવિદર્શન અને ૪. કેવળદર્શન.

આ પ્રમાણે તો બધા કુજ્ઞાન અને સુજ્ઞાન આત્માના લક્ષણ થઈ ગયા.

ઉત્તર:- વાત તો તમે ઠીક જ કહો છો; કારણ કે જે તેમને કોઈ પણ રૂપમાં જીવના લક્ષણમાં શામિલ નહીં કરીશું તો શું મિથ્યાત્વની અવસ્થામાં બધા જીવ પોતાના લક્ષણથી રહિત ન થઈ જય? પરંતુ એવું તો થતું નથી.

પણ ભાઈ! તમે એ વાત પર ધ્યાન કેમ નથી આપતા કે મિથ્યા અને સમ્યક્લાન બેદથી રહિત સામાન્ય જ્ઞાનદર્શન જ જીવનું લક્ષણ છે. આ વાત દ્રવ્યસંગ્રહની પરિભાષામાં પણ સ્પષ્ટુપે કહેવામાં આવી છે, જે આ પ્રમાણે છે -

અઢુ ચદુ ણાણદંસણ સામળણ જીવલક્ખણ ભળિયં ।

વવહારા સુદ્ધણયા સુદ્ધં પુણ દંસણ ણાણ ॥૬॥

ઉક્ત ગાથામાં સમાવિષ્ટ સામાન્યપદ વિશેષ ધ્યાન આપવા યોગ્ય છે. ભેદુપ હોવાથી ઉક્ત લક્ષણને વ્યવહારલક્ષણ કહ્યા અને તેમના જ અભેદુપ સામાન્યજ્ઞાન-દર્શન ચેતનાને નિશ્ચયલક્ષણ કહ્યા છે.

જ્ઞાનના કોઈ પણ એક વિશેષ બેદને જીવનું લક્ષણ માની ન શકાય; પરંતુ તે બધા બેદોમાં જે જાણવું સામાન્ય છે, તે જીવનું લક્ષણ છે.

જેનામાં સમ્યગ્જ્ઞાન અને મિથ્યાજ્ઞાન બધા આવી ગયા એવા ઉક્ત આઠ પ્રકારના જ્ઞાન અને ચાર પ્રકારના દર્શનોમાં જણાઈ આવતું સામાન્ય જ્ઞાન-દર્શન જ આત્માનું વાસ્તવિક લક્ષણ છે, જેને ચૈતન્ય કહે છે અને ઉક્ત ચૈતન્યલક્ષણથી જ ભગવાન આત્મા લક્ષ્ણિત થાય છે અને રાગાદિભાવ બંધનું લક્ષણ છે અને તેનાથી બંધ લક્ષ્ણિત થાય છે.

આત્મા અને રાગની આ જ અંતઃસંવિ છે, જ્યાં પ્રજ્ઞાઈણીનો ઉપયોગ કરવાનો છે જેનાથી આત્મા અને બંધનું દ્વિઘાકરણ થશે.

પ્રશ્ના:- આ વાત તો ઠીકું પણ પ્રજ્ઞાઈણી તો સમ્યગજ્ઞાનને કહે છે ને ? આવી સ્થિતિમાં તે પ્રજ્ઞાઈણી અજ્ઞાની મિથ્યાદાચિની પાસે છે જ ક્યાં કે તે આત્મા અને બંધની વચ્ચે નાખે ?

ઉત્તરઃ- આમ તો બેદવિજ્ઞાન પણ સમ્યગજ્ઞાન જ છે; છતાં પણ અનાદિ મિથ્યાદાચિ જીવ પણ દેશનાલભ્યના માધ્યમથી વળ્ણાદિ અને રાગાદિથી ભિન્ન પોતાના આત્માને સમજીને કરણાલભ્ય તરફ આગળ વધે છે અને આત્માનુભૂતિ પ્રાપ્ત કરીને સમ્યગદાચિ થર્થ જય છે. સમ્યગદર્શનથી પહેલા સંપન્ન આ પ્રક્રિયા પણ એક પ્રકારથી બેદવિજ્ઞાન જ કહેવાય છે; તે જ રીતે આગમ, યુક્તિ અને ગુરુના ઉપદેશથી બંધ અને આત્માની વચ્ચે વિભાજનરેખાને ખેંચનારી બુદ્ધિ પણ એક પ્રકારની પ્રજ્ઞાઈણી જ છે. અસલી કામ તો આ જ પ્રજ્ઞાઈણી કરે છે; કારણ કે સમ્યગજ્ઞાનરૂપ પ્રજ્ઞાઈણી તો ત્યારે જ પ્રગટ થાય છે કે જ્યારે આત્મા અને બંધની વચ્ચે વિભાજનનું કામ થર્થ જય છે; છતાં પણ અસલી પ્રજ્ઞાઈણી તો આત્માનુભૂતિથી સંપત્ત બેદવિજ્ઞાન જ છે, સમ્યગજ્ઞાન જ છે.

એ તો બધા જાણે જ છે કે સમ્યગજ્ઞાન તો સમ્યગદર્શનની સાથે જ થાય છે. પણ એ પણ સત્ય જ છે કે સમ્યગદર્શન અને સમ્યગજ્ઞાનની પ્રાપ્તિનો સંપૂર્ણ પુરુષાર્થ તેની પૂર્વે મિથ્યાત્વની ભૂમિકામાં જ સંપત્ત થાય છે. તેથી એમ વિચારીને નિરાશ નહીં થવું કે અમારી પાસે તો પ્રજ્ઞાઈણી છે જ નહીં. આત્મા અને બંધની વચ્ચેનો બેદ જાણવામાં લાગેલી બુદ્ધિ જ પ્રજ્ઞાઈણી છે, જે આત્મપ્રાપ્તિનું સાધન બને છે અને તે તો આપની પાસે છે જ.

પ્રશ્ના:- અમારી પાસે બુદ્ધિ તો છે, પરંતુ આપે જ તો કહ્યું કે અસલી પ્રજ્ઞાઈણી તો આત્માનુભૂતિ જ છે, સમ્યગજ્ઞાન જ છે અને તે તો અમારી પાસે છે જ નહીં; અમે શું કરીએ ? અમારી સમજમાં કંઈ આવતું નથી.

ઉત્તર:- અરે, ભાઈ ! આ સમસ્યા તમારી એકલાની નથી, બધાની છે. બધા શાનીઓએ એનો સામનો કર્યો છે અને પોતાનું કામ કરી બતાવ્યું છે. જે જીવોએ આજ સુધી આત્માનુભૂતિપૂર્વક સમ્યગ્જ્ઞાનની પ્રાપ્તિ કરી છે; એ બધાની પાસે આત્માનુભૂતિપૂર્વક પ્રજ્ઞાધીણી ક્યાં હતી ? કારણ કે આત્માનુભૂતિક્રિય પ્રજ્ઞાધીણી તો આત્માનુભૂતિ થવાની સાથે જ પ્રગટ થાય છે. સાથે પ્રગટ થવાની વાત પણ ક્યાં છે; કારણ કે તે આત્માનુભૂતિનું નામ જ તો પ્રજ્ઞાધીણી છે.

ઉપલબ્ધ વિવેક બુદ્ધિથી જ તેમણે આત્માને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કર્યો છે અને સફળતા પણ પ્રાપ્ત કરી છે. તેથી હવે તમે પણ પરમાગમના અભ્યાસથી, શાનીઓના સદૃપુદેશથી અને યુક્તિઓના સમ્યક્ પ્રયોગથી બંધથી બિન્ન આત્માને જાણવાનો પુરુષાર્થ કરો, કર્તવ્યવિમૂઢ થવાથી કંઈ પણ થવાનું નથી.

પ્રશ્ન:- આપ બલે કંઈ પણ કહો, પણ મારી સમજમાં તો આ વાત નથી આવતી કે જ્યારે અમારું આ ઉપલબ્ધ જ્ઞાન મિથ્યાજ્ઞાન જ છે તો પછી તેનાથી સાચો નિર્ણય કેવી રીતે થઈ શકે; આખરે એ નિર્ણયની સચ્ચાઈનો આધાર કોણ થશે ?

ઉત્તર:- અરે ભાઈ ! તેની સચ્ચાઈનો આધાર જિનાગમ છે, ગુરુપુરેશ છે અને નિસ્તુષ્ટ યુક્તિઓ છે. ભાઈ ! તારું એમાં શું છે ? આ તો પરમાગમમાં પ્રતિપાદિત પરમસત્ય છે, અરિહંત પરમાત્માની હિવ્યદ્વનિમાં સમાવિષ્ટ વસ્તુસ્વરૂપ છે, જાની ગુરુઓ દ્વારા ઉદ્ઘાટિત રહ્યે છે; તેની પ્રમાણિકતાનો આધાર તે જ અરિહંતદેવ છે, વીતરાગી નિર્ગંથ ગુરુ છે અને વીતરાગતાની પોષક જિનવાળી માતા છે. તારા વર્તમાન ક્ષયોપક્ષમજ્ઞાનમાં તો તે પરમસત્ય તેમના માધ્યમથી માત્ર જાણવામાં આવ્યું છે. તારું જ્ઞાન મિથ્યાક્રિય હોવાથી તેની સચ્ચાઈમાં કોઈ ફરક પડતો નથી.

આખરે આ જ પ્રકારના પ્રાપ્ત જ્ઞાનના આધારથી જ તો આત્માથી જીવ અનુભવ તરફ આગળ વધે છે. ઉક્ત તથ્યને, પરમસત્યને મિથ્યા સમજને કંઈ કરણલભિયમાં પ્રવેશ થોડો થશે. કરણલભિયમાં પ્રવેશને માટે

દેવ-શાસ્ત્ર-ગુરુના આધાર પર ઉક્ત નિર્ણય કરીને, તેમાં અતૃપુરુષ શ્રદ્ધાના બળથી જ આત્મા આત્મસન્ભૂત્ય થાય છે.

તેથી પરમાગમના અભ્યાસના આધાર પર કરવામાં આવેલા નિર્ણયને મિથ્યા સમજુને તેનાથી વિરક્ત ન રહો, પરંતુ તેને યથાર્થ માનીને તે જ દિશામાં આગળ વધો. તમાડું કામ અવશ્ય થશે.

અરે, ભાઈ ! જિનવાણીમાં પણ ટેકેટકાણે તત્ત્વાભ્યાસ કરવાની જ પ્રેરણા આપવામાં આવી છે. કહેવામાં આવ્યું છે -

તાતે જિનવર કથત, તત્ત્વ અભ્યાસ કરીજૈ ।

સંશ્ય વિઘ્રમ મોહ ત્યાગ, આપૌ લખ લીજૈ ॥૧॥

પ્રશ્નઃ:- અમે તો એક બજનમાં વાંચેલું કે મોહનું તાણું લાગ્યું છે તો તું સમકિતની ચાવીથી તેને ખોલી કેમ નથી લેતો ?

ઉત્તરઃ:- પણ ભાઈ ! જ્યાં સુધી મિથ્યાત્વ ગયું નથી, ત્યાંસુધી અમારી પાસે સમ્યકૃત્વ છે જ ક્યાં કે જેનાથી મિથ્યાત્વના તાળાને ખોલીએ. મિથ્યાત્વનું તાણું સદા તૂટે જ છે, ખુલતું નથી; કારણ કે સમ્યકૃત્વ ચાવી તો તે જ તિન્દેરીમાં બંધ છે કે જેમાં આ તાણું લાગેલું છે. ખરેખર વાત તો એ છે કે સમ્યકૃત્વ તો મિથ્યાત્વના નાશનું ફળ છે, કારણ નથી; કારણ કે તે તો મિથ્યાત્વનો નાશ થતાં જ થાય છે.

ભલે સમ્યકૃત્વ ન હોય, પણ આ ભગવાન આત્મા, જેના આશ્રયથી મિથ્યાત્વનો નાશ થાય છે તે તો તારી પાસે જ છે. તારી પાસેની શું વાત છે, તે તો તું પોતે જ છે. તું તેને જો, તું તેને જાણ; કારણ કે તે ભગવાન આત્માને જાણવા-દેખવાની શક્તિ તારામાં હમણાં પણ વિદ્યમાન છે. જ્યારે તે ભગવાન આત્મા જાણવા-દેખવામાં આવશે; ત્યારે આ અસલી પ્રજાઈણી પણ સહજ જ પ્રગટ થઈ જશે. જે છે, તેને તો જેતો નથી અને જે નથી, તેના માટે આકુળિત થાય છે - આ માર્ગ નથી. માર્ગ તો એ જ છે કે આપણે પોતાના ઉપલબ્ધજ્ઞાનને બંધથી બિન્ન ભગવાન આત્માને જાણવામાં લગાવીએ.

અરે ભાઈ ! તારી આ પ્રજ્ઞાધીણી અસલી છે કે વ્યવહારિક - આ વિકલ્પોથી વિરામ લઈને એક વાર અંતરમાં ડોડિયું કરીને તો જે, તારો ભગવાન આત્મા દેખાય છે કે નહીં ? તારી ઇચ્છિના જેરથી જે જ્ઞાનની પર્યાયમાં તે જાળવામાં આવશે, તે જ્ઞાનની પર્યાય જ અસલી પ્રજ્ઞાધીણી બની જશે અને એમ જ કહેવામાં આવશે કે કાર્ય તો આ જ અસલી પ્રજ્ઞાધીણીથી થયું છે.

પ્રશ્નઃ:- આ વાત તો ઢીક જ છે; છતાં પણ સમ્યગ્દર્શન થતાં પહેલા, આત્માનુભૂતિ થતાં પહેલા; કરણલભ્યમાં અને કરણલભ્યમાં પ્રવેશ પહેલા દેશનાલભ્ય પ્રાપ્ત થયા બાદનું આ જ્ઞાન, કે જે સમ્યગ્જ્ઞાની ગુરુના ઉપદેશથી પ્રાપ્ત થયું છે, જિનાગમને વાંચીને થયું છે; તે જ્ઞાન છે તો મિથ્યાજ્ઞાન જ ને ? તેને સમ્યગ્જ્ઞાનનો ન કહી શકાય.

ઉત્તરઃ:- હા, તેને સમ્યગ્જ્ઞાન તો ન કહી શકાય; પરંતુ મિથ્યાજ્ઞાન કહેવું પણ તો ઉચિત પ્રતીત થતું નથી; કારણ કે તેની સચ્ચાઈનો આધાર સમ્યક્ત્વ સન્મુખ મિથ્યાદચિનું જ્ઞાન નથી; પરંતુ સર્વજ્ઞ ભગવાન દ્વારા નિરૂપિત જિનાગમ છે, સમ્યગ્જ્ઞાની ગુરુઓનો ઉપદેશ છે. તમે પોતે જ તો કહી રહ્યા છો કે સમ્યગ્જ્ઞાની ગુરુના ઉપદેશથી થયેલું જ્ઞાન, સર્વજ્ઞકથિત જિનાગમને વાંચીને થયેલું જ્ઞાન, જે તે સર્વજ્ઞની વાણીને અનુસાર છે, જ્ઞાની ગુરુઓના જ્ઞાનને અનુસાર છે; તો પણ તેને મિથ્યા કહેવું શું ઢીક લાગે છે ?

ઉક્ત સંદર્ભમાં તત્ત્વાર્થ શ્લોકવાર્તિકાલંકારમાં સમાવિષ્ટ જૈનન્યાયના દિગ્ગજ આચાર્ય વિધાનાંદિનો અભિપ્રાય પણ જ્ઞાતવ્ય છે.

તત્ત્વાર્થસૂત્રના પ્રથમ અધ્યાયના ત્રીજ સૂત્રના ત્રીજ-ચોથા શ્લોકના વાર્તિકમાં આચાર્ય વિધાનાંદિલું આ વાતની ચર્ચા કરે છે; જે આ પ્રમાણે છે -

“સત્યજ્ઞાનાત્પૂર્વ તદ્વિષયે જ્ઞાનં ન મિથ્યા સત્યજ્ઞાનજનનયોગ્યત્વાત्, નાપિ સત્યં પદાર્થયાથાત્મ્યપરિચ્છેદકત્વાભાવાત्; કિં તહિં ? સત્યેતરજ્ઞાનવિવિક્ત જ્ઞાનસામાન્યં ।૧

સત્યજ્ઞાન અર્થાત् સમ્યગ્જ્ઞાન થતાં પહેલા સમ્યગ્જ્ઞાનનું હોય (ત્રિકાળીધ્વિવ ભગવાન આત્મા) ના વિષયમાં જે જ્ઞાન હતું, તે મિથ્યા તો ન હતું; કારણ કે સત્યજ્ઞાન (સમ્યગ્જ્ઞાન) ને ઉત્પન્ન કરવાની યોગ્યતા તેમાં હતી. તેને સત્યજ્ઞાન (સમ્યગ્જ્ઞાન) પણ કહી ન શકાય; કારણ કે તેમાં પદાર્�ો (ત્રિકાળીધ્વિવ આત્મા અને અન્ય પદાર્થો) ને યથાર્થરૂપે (આત્માનુભૂતિપૂર્વક) જાણવાનો અભાવ છે.

તો પછી તેને શું કહીએ ?

ન તે સત્યજ્ઞાન (સમ્યગ્જ્ઞાન) છે અને ન અસત્યજ્ઞાન (મિથ્યાજ્ઞાન); તે તો સામાન્યજ્ઞાન છે.”

જે લોકોને આ સંદર્ભમાં વિશેષ જાણવાની જિજ્ઞાસા હોય; તે લોકો તત્ત્વાર્થશ્રોકવાર્તિકાતંકારના ઉક્ત પ્રકરણનું ઉંડાણથી અધ્યયન કરે.

પ્રશ્ન:- જ્યારે સારી દુનિયાને બે ભાગમાં વહેંચવાની છે - એ બે ભાગના નામ છે - આત્મા અને બંધ; ત્યારે એમ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે ઉક્ત ભગવતી પ્રક્ષાને આત્મામાં રાખવી કે બંધમાં અર્થાત् સ્વમાં રાખવી કે પરમાં ?

ઉત્તર:- તમે જ બતાવો કે શેમાં રાખવી જોઈએ ? બંધમાં શામિલ કરવું તો સંભવ છે જ નહીં; કારણ કે બંધનું લક્ષણ તો રાગાદિ છે અને આ ભગવતી પ્રક્ષા રાગ-ક્ષેત્ર-રૂપ તો નથી. આત્માનું લક્ષણ ચૈતન્ય છે અને આ પ્રક્ષા તો ચૈતન્યનું જ પરિણમન છે; તેથી આત્મામાં જ રાખવી પડશે. આ જ કારણો અહીં અત્યંત સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે ચૈતન્યમાં વ્યાપ્ત હોવાથી બધા ગુણ-પર્યાયો આત્મા જ છે. આ ભગવતી પ્રક્ષા પણ ચૈતન્યમાં વ્યાપ્ત છે, તેથી આત્મા જ છે.

આત્મઘ્યાતિ ટીકાની શક્તિઆત્માં જ કહ્યું છે કે આત્મા અને બંધનું વિભાજન કરવારૂપ કાર્યનો કર્તા આત્મા જ છે અને ભગવતી પ્રક્ષા જ છેદનાત્મક કરણ છે; કારણ કે નિશ્ચયથી કરણ કર્તાથી જુદો હૃતો નથી. આમ એ સ્પષ્ટ જ છે કે ભગવતી પ્રક્ષા આત્મામાં શામિલ છે, બંધમાં

નહીં. જે એને આત્માથી બિન્ન માનીશું, પર માનીશું તો પછી આ આત્મા આત્માનુભૂતિ પ્રાપ્ત કરવામાં પણ પરાધીન થઈ જશે; જે કદાપિ સ્વીકાર્ય ન હોઈ શકે; કારણ કે પરાધીનતાથી સુખની પ્રાપ્તિ કેમ થઈ શકે ?

કહ્યું પણ છે -

‘પરાધીનને સ્વભાવમાં પણ સુખ નથી.’

તેથી સમસ્ત વિકલ્પોને તોડીને, તમારી પાસે જે પણ બુદ્ધિ-વિવેક છે; તેના વહે બંધથી બિન્ન આત્માને જાણો, પરમાગમના અભ્યાસથી જાણો, ધૂક્તિઓના અવલંબનથી જાણો અને જ્ઞાની ધર્માત્માઓના સહયોગથી તેને જ પ્રાપ્ત કરવામાં લાગી જાઓ.

અધિક શું કહીએ - પોતાની બુદ્ધિને બંધથી બિન્ન પોતાના આત્મા તરફ વાળો. વાળો શું, તેને સહજ જ આત્મામાં જોડાવા હો. આજ એક માર્ગ છે, અન્ય કોઈ માર્ગ નથી.

ઉક્ત ગાથાનો ભાવ પૂજાય ગુરુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે “અહા!
વીતરાગ જૈન પરમેશ્વર એમ કહે છે કે દુઃખની દ્શાનો ભાવ અને
આનંદસ્વરૂપ ભગવાન આત્માને બિન્ન-બિન્ન કરવા હોય તો કર્તા પણ
આત્મા જ છે અને સાધન (કરણ) પણ આત્મા જ છે. રાગથી-દુઃખથી
બિન્ન કરવામાં સ્વરૂપ તરફ ઝૂકેતી જ્ઞાનની વર્તમાનદ્શા સાધન છે. રાગની
સાથે જ્ઞાનની વર્તમાનદ્શાની એકતા હતી, વસ્તુની સાથે નહીં. વસ્તુ તો
ધૂષ છે. તે જ્ઞાનની પર્યાય જ્યાં અંદર ઢોણે ન ઢોણે કે તત્કાળ રાગથી બિન્ન
પોતાનો આનંદનો નાથ પ્રભુ આત્મા ઘ્યાલમાં આવી જય છે. આ પ્રમાણે
આત્માને રાગથી બિન્ન કરવાનું સાધન ભગવતી પ્રજ્ઞા છે, અંતરમાં એકાચ
થયેલી જ્ઞાનની પર્યાય જ છે.

લોકો કહે છે કે ભેદજ્ઞાનનું સાધન વ્યવહાર છે; પરંતુ ભાઈ ! અહીં
તો અત્યંત સ્પષ્ટઝે એમ કહ્યું છે કે ભગવતી પ્રજ્ઞા જ - અંતરમાં એકાચ
થયેલી સ્વાનુભવની દરા જ વિકારથી બિન્ન કરવાનું સાધન છે.¹

૧. પ્રવચનરત્નાકર (હિન્દી), ભાગ C, પાનું ૩૩૦-૩૩૧

અહીં કહે છે કે એકમાત્ર ભગવતી પ્રજ્ઞા જ આત્મા અને વિકારના બેદ્ધાનમાં સમર્થ સાધન છે. જેમ કરવતથી લાકડાના બે ફાડિયા થઈ જય છે; તેવી જ રીતે બેદ્ધાનની બુદ્ધિરૂપ પ્રજ્ઞાઈણી આત્મા અને વિકારને બિન્ન-બિન્ન કરી નાખે છે. અહા ! દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યે ભક્તિ, વિનયનો રાગ અને પંચ મહાવ્રતાદિનો રાગ આદિ જે પણ વ્યવહાર છે, એ બધાથી ભગવાન આત્માને બિન્ન કરવાના સ્વભાવવાળું સાધન એકમાત્ર ભગવતી પ્રજ્ઞા જ છે અને તે પ્રજ્ઞા આત્માથી અબિન્ન છે. આ પ્રમાણે આત્મા તરફ અંતર્મુખ થયેલી જ્ઞાનની પર્યાય-પ્રજ્ઞાઈણી જ કર્તા છે અને તે જ બેદ્ધાનનું એકમાત્ર સાધન છે.¹

ભગવાન આત્મા ચેતક છે અને દ્વા-દાન, વ્રત-ભક્તિ તથા હિંસા-જૂઠ-ચોરી આદિ વિકારી ભાવો ચૈત્ય અર્થાત્ જોય છે. જેકે તે આત્માની પર્યાયમાં જ થાય છે છિતાં પણ વિભાવભાવ હોવાથી તે આત્મા નથી. બંનેમાં અત્યંત નિકટતા છે અર્થાત્ જે સમયે આત્મામાં વિકાર ઉત્પન્ન થાય છે તે જ સમયે તે આત્મામાં તે રાગને જાણનાર જ્ઞાન પણ ઉત્પન્ન થાય છે. જાણનાર ભગવાન આત્મા જ્યારે જાણવાની દર્શારૂપ ઉત્પન્ન થાય છે, તે જ સમયે રાગની ઉત્પત્તિ થાય છે, આ નિકટતા છે. નિશ્ચયથી વિકાર ચૈત્ય છે અર્થાત્ જાણવા યોગ્ય છે અને આત્મા ચેતક છે અને ચેતકમાં બંધભાવ નથી. એવું હોવા છિતાં પણ, બંનેની અતિનિકટતાને કારણે અજ્ઞાની ‘વિકારરૂપ ચૈત્ય જ હું છું’ – એમ માને છે.

જુઓ ! આત્મા અને વિકાર – બંને એક થઈ રહ્યા છે. એવું કહું છે ને ? ખરેખર તે બંને એક નથી, પરંતુ અજ્ઞાનીને એક જેવા જણાઈ રહ્યા છે.

અરે ! અજ્ઞાનીએ અનંતકાળથી આત્મા અને બંધની વર્ચ્યે બેદ્ધાન કર્યું નથી.²

૧. પ્રવચનરત્નાકર (હિંદી), ભાગ ૮, પાનું ૩૩૨

૨. પ્રવચનરત્નાકર (હિંદી), ભાગ ૮, પાનું ૩૩૦-૩૩૪

તે ચૈતન્ય પ્રવર્તતું થકું જે-જે પર્યાયોમાં વ્યાપ્ત થઈને પ્રવર્તે છે, તે-તે સમસ્ત સહવત્તી પર્યાયો (ગુણ) આત્મા છે - એમ લક્ષણથી ઓળખવું. જુઓ, અહીં ગુણોને પર્યાય કહ્યાં છે. દ્રવ્યમાં એટલો બેદ પક્ષો ને ? આ કારણથી ગુણોને પર્યાય કહ્યાં છે. જ્ઞાનગુણની સાથે અન્ય જે-જે અનંત સહવત્તી ગુણો છે, તેમનામાં ચૈતન્ય વ્યાપ્ત થઈને પ્રવર્તે છે. તેથી તે આત્મા જ છે - એમ જાણવું.^૧

સમય-સમયે જે નવીન પર્યાય ક્રમબદ્ધ ઉત્પન્ન થાય છે, તે પર્યાયના ઉત્પાદને ગ્રહણ કરતો, પૂર્વની પર્યાયને છોડતો (નિવર્તતો) અને ગુણકૃપે કાયમ રહેતો થકો એક આત્મા જ છે. સર્વજ્ઞ પરમેશ્વરે જે દ્રવ્ય, ગુણ અને પર્યાયકૃપ આત્માને જેયો - તે જ સર્વજ્ઞની જાણોતી-જેયેતી વાતો છે. આત્મામાં જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય તથા અસ્તિત્વ, વસ્તુત્વ આદિ - આ બધા ગુણો સહવત્તી છે, એક સાથે રહે છે.

ત્રિકાળી ગુણ સ્વભાવોને અહીં સહવત્તી કહ્યા છે. ભગવાન આત્મા આ બધા ગુણોમાં પ્રવર્તે છે, વ્યાપે છે અને જે નવીન-નવીન અવસ્થાઓ ક્રમથી થાય છે, તેમને ક્રમવત્તી કહે છે. ગુણ નવા-નવા થતા નથી. આ પ્રમાણે સહવત્તી ગુણ અને ક્રમવત્તી પર્યાયો - એ બધા આત્મા જ છે - આવા લક્ષણથી એક આત્મા જ લક્ષિત થાય છે.^૨

ચૈતન્યલક્ષણ જે ગુણકૃપે ત્રિકાળ છે, તે તો ચૈતન્ય, ચૈતન્ય, ચૈતન્ય ! આ પ્રમાણે ચૈતન્ય સામાન્યકૃપે ત્રિકાળ ધૂલ છે. તેનાથી આત્માનું ગ્રહણ થતું નથી. પરંતુ તેની જે નવીન પર્યાયો ઉત્પન્ન થાય છે, તેમાં પ્રવર્તિત થતો થકો અને પૂર્વ પર્યાયોથી નિવર્તિત થતો થકો આત્મા તે-તે નિર્મળ પર્યાયોમાં જાણવામાં આવે છે.^૩

આત્મા શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુ છે. ચૈતન્યગુણ તેનું શક્તિકૃપ લક્ષણ

૧. પ્રવચનરત્નાકર (હિન્દી), ભાગ ૮, પાનું ૩૩૭

૨. પ્રવચનરત્નાકર (હિન્દી), ભાગ ૮, પાનું ૩૩૭-૩૩૮

૩. પ્રવચનરત્નાકર (હિન્દી), ભાગ ૮, પાનું ૩૩૮

છે અને જ્ઞાન-દર્શનની પર્યાયો આત્માનું વ્યક્ત લક્ષણ છે. અર્થાત્ક કરતાં આ જે જ્ઞાનગુણસ્વરૂપ છે, તે આત્મા છે - એવું જે જ્ઞાન પ્રગટ થયું તે સમ્યગજ્ઞાન છે. જ્ઞાનસ્વરૂપ આત્મામાં અંતર ફળતી થકી જ્ઞાનની દર્શા જે પોતાને, જ્ઞાનાનંદસ્વરૂપને જાણે છે, અનુભવે છે તે જ્ઞાન છે.^૧

જ્યાં એક ચૈતન્યગુણ છે, ત્યાં બીજુ અનંત શક્તિઓ અને ચારિત્ર, સુખ, વીર્ય, જીવત્વ, કર્તા કર્મ, કરણ આદિ એકરૂપ અવિનાભાવથી છે અને જ્યાં ચૈતન્યની એક સમયની પર્યાય છે, ત્યાં સાથે જ આ અનંતગુણોની પર્યાયો એક અવિનાભાવી છે. અહા ! આવો ભગવાન આત્મા માત્ર જ્ઞાયકસ્વરૂપ ચૈતન્યપ્રકાશથી ભરપૂર ચૈતન્ય સૂર્ય છે. જે આંખોથી દેખાય છે - તે તો જડ સૂર્ય છે. તેને તો પોતાને જ એમ ખબર નથી કે હું પ્રકાશનું બિંબ છું. ચૈતન્ય સૂર્ય તો અનુપમ છે. તેની આ સૂર્ય સાથે ઉપમા કેવી?^૨

જેવી રીતે અગ્નિને જેનાર આંખ અગ્નિરૂપ થતી નથી; તેવી જ રીતે રાગને જાણનાર-જેનાર જ્ઞાન રાગરૂપ થતું નથી. આ પ્રમાણે જ્ઞાન અને રાગ એક દ્વાર્યમય નથી, બિજ્ઞ-બિજ્ઞ જ છે. અનાદિથી બંને એકરૂપ જણાય છે, પણ તે અજ્ઞાનજનિત ભ્રમ છે.^૩

જે રીતે દીપક ધટ-પટાઈને પ્રકાશિત કરે છે - આ તો વ્યવહારનું કથન છે. વાસ્તવિકરૂપે તો દીપક પોતાના સ્વ-પરને પ્રકાશિત કરનાર એક પ્રકાશસ્વભાવને જ પ્રકાશિત કરે છે; કારણ કે દીપક ધટ-પટરૂપ અને ધટ-પટ દીપકરૂપ કયારેય થતા નથી.

તે જ પ્રમાણે આત્મા વડે ચેતનમાં આવનાર રાગાદિ, આત્માના ચેતકપણાને જ જહેર કરે છે, રાગાદિપણાને નહીં. ભગવાન આત્મા શુદ્ધ-એક-જ્ઞાયક-ભાવરૂપ છે, ચેતકસ્વભાવી છે. તે રાગાદિ પુણ્ય-પાપના

૧. પ્રવચનરત્નાકર (હિંદી), ભાગ ૮, પાનું ૩૩૮

૨. પ્રવચનરત્નાકર (હિંદી), ભાગ ૮, પાનું ૩૩૯

૩. પ્રવચનરત્નાકર (હિંદી), ભાગ ૮, પાનું ૩૪૧

ભાવોને જાણવાના કાળમાં વાસ્તવમાં તો પોતાની તે જ્ઞાન પર્યાયને જ જાણે છે, જેમાં તે પુણ્ય-પાપના ભાવ જણાઈ રહ્યા છે. જે આત્મા પુણ્ય-પાપ આદિ ભાવોને જાણે તો આત્મા સ્વયં પુણ્ય-પાપકૃપ થઈ જય; પરંતુ આત્મા કયારેય પુણ્ય-પાપકૃપ થતો નથી.

‘રાગાદિને આત્મા જાણે છે’ - એમ કહેવું તો વ્યવહાર છે. વાસ્તવિકર્ષપે તો જ્ઞાન પોતાના દૈતક્ષપ સ્વ-પરને પ્રકાશિત કરનાર એકમાત્ર પોતાના એક જ્ઞાનસ્વભાવને-ચેતકસ્વભાવને જ પ્રકાશિત કરે છે; કારણ કે જ્ઞાન પુણ્ય-પાપ આદિ ભાવોકૃપ તથા પુણ્ય-પાપ આદિ જ્ઞાનભાવકૃપ કયારેય પરિણમતા નથી. જ્ઞાન તો સહજ જ સ્વ-પરપ્રકાશક સ્વભાવી છે, જે નિરંતર પ્રકાશિત થાય છે. એવું વસ્તુનું સ્વકૃપ જાણીને તેનો અંતરમાં અનુભવ કરવો તે સમકિતનનું કારણ થાય છે.

હવે કહે છે કે આત્મા અને બંધનો લક્ષણબેદ હોવા છતાં પણ અજ્ઞાનીને અનાદિકાળથી આત્મા અને રાગાદિ બંધમાં એકપણાનો ભ્રમ છે. તે ભ્રમ એકમાત્ર પ્રજ્ઞા વડે જ છેદી શકાય છે. જેમ અંધકારને દૂર કરવાનો ઉપાય પ્રકાશ છે, તે જ રીતે ભ્રમ અથવા વ્યાખોહને દૂર કરવાનો ઉપાય પણ એકમાત્ર સમ્યગ્જ્ઞાન જ છે.^૧

હવે અહીં આચાર્યદેવ આ દુઃખોથી ધૂટવાનો ઉપાય બતાવે છે - પર તરફના લક્ષ્યવાળા રાગાદિભાવ બંધ છે અને આત્મા ચૈતન્યલક્ષણ છે. બંનેને લક્ષણબેદથી બિન્ન-બિન્ન જાણીને આત્માનુભવ કરવો ધર્મ છે. આ ધર્મ આનંદકૃપ અને બંધ દુઃખકૃપ છે. આ જ બેદશાનને અહીં પ્રજ્ઞાધીણી કહેલ છે.

પ્રશ્ન:- ચૈતન્યભાવને જ પરમપારિણામિકભાવ કહે છે ને ?

ઉત્તર:- પરમપારિણામિકભાવ છ એ દ્રવ્યોમાં હોય છે; તેથી અહીં ચૈતન્યલક્ષણથી લક્ષ્યિત જ્ઞાયકભાવ કહેવું જ ઉચ્યત છે. અહા ! અનંત

૧. પ્રવચનરત્નાકર (હિન્દી), ભાગ C, પાનું ૩૪૨-૩૪૩

ગુણમંહિત એક શાયકભાવ - ચિન્માત્રભાવ જ આત્મા છે. એવા આત્માના સ્વરૂપમાં વર્તમાન પરિણતિને દાળવી એ જ ધર્મ છે.

લોકમાં જે દ્યાને ધર્મ કહેવામાં આવ્યો છે, તે તો સ્થૂળ વ્યવહારની વાતો છે, જે કહેવા-સાંભળવામાં જ સારી લાગે છે. અહીં તો એમ કહે છે કે - દ્યા તો પરણવોના લક્ષ્યથી થયેલો શુભભાવ છે. આ તો બંધનું લક્ષણ છે, કારણ કે દ્યાથી તો પુણ્યબંધ જ થાય છે ને? તેનાથી ધર્મ થવો એમ માનવું તે તો મિથ્યાત્વ છે.

અરે ભાઈ! તેં પરની દ્યા પાળવાની ચિંતા તો અનંતકાળથી કરી છે, પણ અંદરમાં નિર્મળાનંદનો નાથ જે ચૈતન્ય મહાપ્રભુ બિરાજે છે, એક વાર તેના પર તો દ્યા કર! પરની દ્યા પાળવાના ચક્કરમાં તારી પોતાની હિંસા થઈ રહી છે. તેને પણ તો જે. અહા..... અનંત શક્તિઓનો પિંડ આત્મા ચિન્મૂર્તિ પ્રભુસ્વરૂપ છે. તેને જ્ઞાનપર્યાયમાં જોય બનાવીને તેની પ્રતીતિ કરવી સ્વદ્યા છે અને તે જ સાચો અહિંસા ધર્મ છે.

જે દ્યાને ધર્મનું મૂળ કહ્યું છે, તે આ સ્વદ્યા છે. તેને છોડીને પરમાં રચવું-પચવું ખરેખર 'સ્વ' ની હિંસા છે.¹

ભગવાન આત્મા અંદરમાં ચિન્મૂર્તિ પ્રભુ આનંદ અમૃતનો સાગર છે, તેમાં જે રાગની વૃત્તિ ઉઠ છે તે ઝેર છે. તે ઝેર અને અમૃતની વરચે તીક્ષ્ણ પ્રજ્ઞાધીણી નાખતાં જ બજે બિજ્ઞ-બિજ્ઞ થઈ જય છે. તેનું જ નામ બેદજ્ઞાન છે, સમ્યગ્જ્ઞાન છે, ધર્મ છે. મોક્ષનું મૂળ તે જ બેદજ્ઞાન છે. તેના સિવાય વ્રત-તપ આદિના શેષ બધા વિકલ્પ વ્યર્થ છે.

બેદજ્ઞાનને એક અપેક્ષાએ વિકલ્પ પણ કહે છે; કારણ કે તે બેની વરચે થાય છે ને? જ્યાં સુધી બેનું લક્ષ્ય રહે છે, ત્યાં સુધી સૂક્ષ્મ વિકલ્પ પણ રહે છે, પરંતુ જ્યારે એક શાયકમાં અન્તર્મુખ થાય છે તો બેદજ્ઞાનનું નિર્વિકલ્પ પરિણામન થઈ જય છે.

૧. પ્રથમનરતનાકર (હિંદી), ભાગ C, પાનું ૩૪૪-૩૪૫

અહીં આ ગાથામાં પ્રજ્ઞાધીણી શબ્દથી સ્વાનુભવ જ્ઞાન સમજવું, માત્ર વિકલ્પ ન સમજવો.”^૧

ઉક્ત સંપૂર્ણ ચિંતનનું નિર્જર્ખ આમ છે કે આ ગાથામાં એમ જ કહેવામાં આવ્યું છે કે જીવ અને બંધને તેમના સ્વતંક્ષણોથી જાણીને, તેમની વચ્ચેની અંતઃસંધિને ઓળખીને, બુદ્ધિની તીક્ષ્ણતાથી તેમને બેદીને, છેદીને, બંધથી વિરક્ત થઈને અને તેનાથી બિન્ન પોતાના આત્મામાં અનુરક્ત થઈને, તેમાં જ સમાઈ જાઓ; સુખી થવાનો એકમાત્ર આ ઉપાય છે.

હવે આ જ ભાવને પોષક કળશ કાવ્ય લખે છે; જે આ પ્રમાણે છે -

(સ્રગધરા)

પ્રજ્ઞાછૈત્રી શિતેયં કથમપિ નિપુણીઃ પાતિતા સાવધાનૈઃ,
સૂક્ષ્મેડન્તઃસંધિબન્ધે નિપતતિ રમ્ભસાદાત્મકર્મોભયસ્ય ।
આત્માનં મગ્નમંતઃસ્થિરવિશદલસદ્ગ્લામનિ ચૈતન્યપૂરે,
બન્ધં ચાજ્ઞાનભાવે નિયમિતમભિતઃ કુર્વતી ભિન્નભિન્ની ॥૧૮૧॥

(હરિગીત)

પ્રજ્ઞાદ્વી આ તીક્ષ્ણ છીણી યત્નથી પટકાય જ્યાં,
આત્મા અને કર્મો તણી સંધિ ઝીણી છેદાય ત્યાં;
ચૈતન્યપૂરમાં મગ્ન રહેતો આત્મા નિજ અંતરે,
અજ્ઞાનભાવે નિયત થાતો બંધ - એ છીણી વડે. ૧૮૧.

પોતાના આત્માને પોતાના અંતરંગ તેજમાં સ્થિર કરતી થકી તથા નિર્મળ અને દેદીઘ્યમાન ચૈતન્યપ્રવાહમાં મગ્ન કરતી થકી અને બંધને અજ્ઞાનભાવમાં નાખતી થકી - આ પ્રમાણે આત્મા અને બંધને બિન્ન કરતી થકી, આ પ્રજ્ઞાધીણી પ્રવીણ પુરુષો વડે કોઈ પણ પ્રકારે પ્રયત્નપૂર્વક સાવધાનીથી પટકતાં આત્મા અને કર્મબંધની વચ્ચેની સૂક્ષ્મ અંતરંગ સંધિના બંધમાં અતિશીધ્રતાથી પડે છે.

૧. પ્રવચનરત્નાકર (હિન્ડી), ભાગ ૮, પાનું ૩૪૫

તાત્પર્ય આમ છે કે આ પ્રજાધીણી આત્મા અને બંધને છેદી નાખે છે, બિન્ન-બિન્ન કરી નાખે છે અને ઉપયોગ અંતર્ભુખ થવાથી આત્માનો અનુભવ થઈ જય છે.

આ પ્રજાધીણી બંધને કેવી રીતે છેદે છે - તેનું વિવરણ કરતાં પાડે રાજમલણ કળશાટીકામાં લખે છે -

“તેનું વિવરણ આ પ્રકારે છે કે જે દ્રવ્યકર્મ જ્ઞાનાવરણાદિ પુદ્ગલનો પિંડ છે, તે એક ક્ષેત્રાવગાહકૃપ છે; તો પણ તેની તો જીવથી બિન્નપણાની પ્રતીતિ, વિચાર કરતાં ઉત્પન્ન થાય છે; કારણ કે દ્રવ્યકર્મ પુદ્ગલ પિંડકૃપ છે, જેકે એક ક્ષેત્રાવગાહકૃપ છે; તો પણ બિન્ન-બિન્ન પ્રદેશ છે, અચેતન છે, બંધાય છે, ખોલાય છે - આવો વિચાર કરતાં બિન્નપણાની પ્રતીતિ ઉત્પન્ન થાય છે.

નોકર્મ છે જે શરીર-મન-વચન, એનાથી પણ તે રીતે વિચારતાં બેદ-પ્રતીતિ ઉપને છે.

બાવકર્મ જે મોહ-રાગ-દ્રેષ્ઠકૃપ અશુદ્ધ ચેતનાકૃપ પરિણામ, તે અશુદ્ધ પરિણામ વર્તમાનમાં જીવની સાથે એક પરિણમનકૃપ છે તથા અશુદ્ધ પરિણામની સાથે વર્તમાનમાં જીવ વ્યાખ્ય-વ્યાપકકૃપ પરિણમે છે. આ કારણે તે પરિણામોનો જીવથી બિન્નપણાનો અનુભવ મુશ્કેલ છે. છતાં પણ સૂક્ષ્મ સંધિનો બેદ પાડતાં બિન્ન પ્રતીતિ થાય છે.

તેનો વિચાર આ પ્રમાણે છે કે જેમ સ્ફિટિકમણિ સ્વકૃપથી સ્વચ્છતામાત્ર વસ્તુ છે; લાલ, પીળા, કાળા, લીલાનો સંયોગ પ્રાપ્ત થતાં લાલ, પીળા, કાળા, લીલા - તે કૃપ સ્ફિટિકમણિ જલકે છે, વર્તમાનમાં સ્વકૃપનો વિચાર કરતાં સ્ફિટિકમણિની ભૂમિકા તો સ્વચ્છતામાત્ર છે. તેમાં લાલ, પીળા, કાળાપણું પરસંયોગની ઉપાધિ છે, સ્ફિટિકમણિનો સ્વભાવગુણ નથી.

તે જ પ્રમાણે જીવદ્રવ્યનો સ્વભાવ સ્વચ્છ ચેતનામાત્ર છે. અનાદિ સંતાનકૃપ મોહ-રાગ-દ્રેષ્ઠકૃપ રંજક અશુદ્ધ ચેતનાકૃપ

પરિણામે છે. ઇતાં પણ વર્તમાનમાં સ્વરૂપનો વિચાર કરતાં જીવવસ્તુ ચેતના ભૂમિમાત્ર જ છે; તેમાં મોહ-રાગ-દેખરૂપ રંજકપણું કર્મના ઉદ્ઘની ઉપાધિ છે, વસ્તુનો સ્વભાવગુણ નથી.

તે રીતે વિચાર કરતાં બેદ-બિજ્ઞ પ્રતીતિ ઉત્પન્ન થાય છે, જે અનુભવગોચર છે.”

કળશ ટીકાના ઉકિત કથનનો સાર આમ છે કે દ્રવ્યકર્મ અને નોકર્મથી બિજ્ઞતા તો સહજ ભાસી જય છે; કારણ કે તે તો સ્પષ્ટરૂપે જડ-પુદ્ગાલ છે; પરંતુ ભાવકર્મોથી બિજ્ઞતા ઘ્યાલમાં આવવી મુશ્કેલ છે; કારણ કે તે ચૈતન્યના જ વિકાર છે. આ જ કારણે અહીં પાંડે રાજમલણું ભાવકર્મોથી બિજ્ઞતા બતાવવા માટે સ્ફીટિકમણિનું ઉદાહરણ આપ્યું છે.

ઉકિત કળશ અને કળશટીકાના ભાવને આધાર બનાવીને પંડિત બનારસીદાસજી બે છંદ લખે છે; જે આ પ્રમાણે છે.

(સવૈયા ઇકતીસા)

કાહૂ એક જૈની સાવધાન હૈ પરમ પૈની,
એસી બુદ્ધિ છૈની ઘટપ્રાંહિ ડાર દીની હૈ ।
પૈઠી નોકરમ ભેદિ દરવ કરમ છેદિ,
સુભાડ વિભાઉતા કી સંધિ સોધિ લીની હૈ ॥
તહ્યાં મધ્યપાતી હોય લખી તિન ધારા દોય,
એક મુધામર્ડ એક સુધારસ-ભીની હૈ ।
મુધા સાઁ વિરચિ સુધાસિંધુ મેં મગન ભર્ડી,
એતી સબ ક્રિયા એક સમૈ બીચિ કીની હૈ ॥

(દોહા)

જૈસે છૈની કી, કરૈ એક સાઁ દોર્ડી ।
જડ ચેતન કી ભિજ્ઞતા, ત્યાં સુબુદ્ધિ સાઁ હોર્ડી ॥
કોઈ આત્માથી જૈન વ્યક્તિ જ્યારે અત્યંત તીક્ષ્ણ સુભુદ્ધિરૂપી
છીણીને સાવધાનીપૂર્વક અંતરમાં નાખી દે છે તો તે પ્રજાછીણી અંદર સુધી

પેસીને, નોકર્મને બેદીને, દ્રવ્યકર્મને છેદીને સ્વભાવ અને વિભાવની સંધિને શોધી લે છે.

આ પ્રમાણે તે પ્રજ્ઞાઈણી નોકર્મ, દ્રવ્યકર્મ અને ભાવકર્મ તથા આત્માની વચ્ચેની વિભાજનરેખા જાહીને તેમની વચ્ચે પડીને સંપૂર્ણ સ્થિતિને બે ધારાઓમાં વિભક્ત કરી નાખે છે. તેમાં એક ધારા અજ્ઞાનમય હોય છે અને બીજી ધારા જ્ઞાનસુધારસમય હોય છે.

આમ તે આત્માથી વ્યક્તિ અજ્ઞાનમયધારાથી વિરક્ત થઈને જ્ઞાનસુધારસાગરમાં મળન થઈ જય છે - આ સંપૂર્ણ કિયા તે એક સમયમાત્રમાં જ કરી લે છે. તાત્પર્ય આમ છે કે સંપૂર્ણ કાર્ય એકી સાથે એકસમયમાં જ સંપત્ત થઈ જય છે.

લોદાની છીણી એક ને બે કરી નાખે છે; તે જ રીતે સુખુદ્વિધી જડ અને ચેતનની બિજ્ઞતા થઈ જય છે.

આ પ્રમાણે નાટક સમયસારના આ છંદમાં કળશના ભાવને સંપૂર્ણ રીતે આત્મગત કરી લેવામાં આવ્યો છે.

આ બાદ નાટક સમયસારમાં ચાર એવા છંદ છે કે જેમના ભાવના પોષક કોઈ કળશ આત્મઘ્યાતિમાં નથી. તેથી તેમનો અહીં સમાવેશ કરવામાં આવ્યો નથી છતાં પણ જિજ્ઞાસુ પાઠક મૂળગ્રંથનું અધ્યયન કરીને તેનો લાભ લઈ શકે છે.

આ કળશનો ભાવ પૂજ્ય ગુરુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે -

“જેમાં રાગનું જ્ઞાન છે - એવી વર્તમાનજ્ઞાનની દશા આત્માથી જુદી નથી; પરંતુ રાગ આત્માથી જુદો છે. જેમ દર્પણમાં સિંહનું જે સ્વરૂપ (પ્રતિબિંબ) છે, તે દર્પણસ્વરૂપ જ છે, સિંહ સ્વરૂપ નથી. તે જ રીતે ચૈતન્યમય પ્રભુ આત્મામાં રાગનું જે જ્ઞાન થાય છે, તે જ્ઞાન આત્મસ્વરૂપ જ છે, રાગરૂપ નથી. તેથી રાગને જાણનાર આ જ્ઞાનની દશા અંતરમાં સ્વાભિમુખ થતાં તે રાગથી બિજ્ઞ પડી જય છે અને આત્માનો અનુભવ

કરે છે. ખસ તેનું જ નામ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે. વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરના માર્ગનો અહીંથી પ્રારંભ થાય છે.^૧

અહીં ! ભગવતી પ્રજ્ઞા જ્ઞાનમય ચેતન આત્મા અને બંધને બધી બાજુથી અર્થાત् દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ - ચારે બાજુથી બિજ્ઞ-બિજ્ઞ કરી નાએ છે. બંધના કોઈ પણ અંશને જ્ઞાનમાં મળવા હેતી નથી અને જ્ઞાનના કોઈ પણ અંશને બંધમાં મળવા હેતી નથી. આવી ભગવતી પ્રજ્ઞા - જ્ઞાન ચેતના જ મોકાનો ઉપાય છે.

ભાઈ ! તારા મોકાનું સાધન તારા પોતાની પાસે જ છે. તેને જ્ઞાનયા વિના અજ્ઞાનભાવથી શુભરાગને મોકાનું સાધન માનીને અનાદિકાળથી તે રાગનું જ - બંધનું જ સેવન કર્યું છે; પરંતુ ભાઈ ! રાગથી પાર અંતર્મુખ થયેલી જ્ઞાનચેતનાઙ્ગ્ય નિર્ભળ નિર્વિકલ્પ અનુભૂતિ જ મોકાનું એકમાત્ર સાધન છે.

અહીં ! આ નિર્ભળ સ્વાનુભૂતિની શું વાત ? તેનો મહિમા તો વચ્ચનાતીત છે, વિકલ્પાતીત છે. એટલે રાગથી સાવધાન થઈને ઉપયોગને અંદર સ્વરૂપમાં લઈ જાય.

હું એક જ્ઞાતા-દષ્ટા શુદ્ધ ચિદાનંદ પ્રભુ આત્મા છું. ત્રિકાળી વસ્તુમાં જ 'રૂપ' ને ઓળખીને સ્વાનુભવ કરીને તેમાં જ લીન રહેવું તે જ આત્માને રાગથી બિજ્ઞ કરવું છે. તેનું જ નામ ભગવતી પ્રજ્ઞા છે. તેનાથી જ સર્વ કર્મોનો નાશ થાય છે. સિદ્ધપદ્ધની પ્રાપ્તિ થાય છે.

પ્રભુ ! આ રાગ અને આત્માને આ રીતે બિજ્ઞ કરી લે, તો તારો જન્મ સફળ થઈ જશો. તેનાથી જ તને આત્મલાભ થશો. અંદરમાં અતીન્દ્રિય આનંદ પ્રગટ થશો અને તને પોતાને જ વિશ્વાસ થઈ જશો કે હવે મારો સંસાર અલ્પ રહી ગયો છે.^૩

૧. પ્રવચનરત્નાકર (હિંદી), ભાગ C, પાનું ૩૪૭

૨. પ્રવચનરત્નાકર (હિંદી), ભાગ C, પાનું ૩૪૮

૩. પ્રવચનરત્નાકર (હિંદી), ભાગ C, પાનું ૩૪૬

જુઓ, અહીં પૂજ્ય ગુરુદેવ સ્પષ્ટ લખે છે કે રાગને જાણનાર જ્ઞાનની દર્શા આત્માથી જુદી નથી, આત્મા જ છે; પરંતુ રાગ આત્માથી જુદો છે.

આ પ્રમાણે આ કળશમાં પણ ગાથાના ભાવને સ્પષ્ટ કરતાં એમ જ કહેવામાં આવ્યું છે કે બુદ્ધિયી ધીણીથી આત્મા અને બંધને બિન્ન-બિન્ન જાણી શકાય છે. બિન્ન કરી શકાય છે.

આત્મકલ્યાણનું એકમાત્ર સાચું સાધન આ જ છે; તેથી અન્ય વિકલ્પોથી વિરભીને પોતાની બુદ્ધિને ત્યાં લગાવો. તમારું કલ્યાણ અવશ્ય થશે.



શાનશોષ્ઠી

પ્રશ્ન :- મુનિજ્ઞનો આહારાદિ દાન ગ્રહણ કરે છે તો તેમનામાં પણ દીનપણું કેમ ના ઘેટે ?

ઉત્તર :- જેમ કોઈ રાજભક્ત પુરુષ રાજની આગળ ભેટ ધરે, પરંતુ તેમાં રાજની ઈચ્છા નથી, તેમ આત્મગુણ રસીક જનો આત્મગુણ વિકાસી મુનિજ્ઞનોને તેમના વિના યાચે પણ ભક્ત વિનયાદિ સહભાવપૂર્વક આહારાદિ દાન આપે અને તે મહાપુરુષ લોભ કે આસક્તિ રહિત ગ્રહણ કરે તો તેથી તે દીનપણાને અનુભવતા નથી. અને એવી નિસ્પૃહવૃત્તિ જે મહાપુરુષમાં વર્તે છે તે જ મહાન છે. પરંતુ લોભથી દીનતા સહિત લેવા ઈચ્છે તે જ ખેદભર હીનતાને પ્રાપ્ત થાય. મુનિજ્ઞન યાચનાપૂર્વક દીનતાથી ગ્રહણ કરતા નથી જેથી તેઓ અયાચક, અદીન અને સર્વશ્રેષ્ઠ છે.

સમયસાર ગાથા ૨૮૫ થી ૨૯૭

વિગત ગાથામાં કહેવામાં આવ્યું હતું કે પ્રજાઈણી વડે સ્વલક્ષણોના માધ્યમથી બંધ અને આત્માને છેદી દેવા જોઈએ. હવે આ આગામી ગાથાઓમાં એમ બતાવી રહ્યા છે કે આમ કરવા ઉપરાંત શું કરવું જોઈએ, કેમ કરવું જોઈએ.

ગાથાઓ મૂળથી આ પ્રમાણે છે.

જીવો બંધો ય તહા છિજ્જતિ સલકખણેહિં ણિયએહિં ।

બંધો છે દદબ્વો સુદ્ધા અપ્પા યે ઘેત્તબ્વો ॥૨૯૫॥

કહ સો ધિપ્પદિ અપ્પા પણાએ સો દુ ધિપ્પદે અપ્પા ।

જહ પણાડ વિભત્તો તહ પણાએવ ઘેત્તબ્વો ॥૨૯૬॥

પણાએ ધિત્તબ્વો જો ચેદા સો અહં તુ ણિચ્છયદો ।

અવસેસા જે ભાવો તે મજ્જા પરે ત્તિ ણાયબ્વા ॥૨૯૭॥

જીવ-બંધ જ્યાં છેદાય એ રીત નિયત નિજ નિજ લક્ષણે,

ત્યાં છોડવો એ બંધને, જીવ ગ્રહાગ કરવો શુભ્નને. ૨૯૮.

એ જીવ કેમ ગ્રહાય? જીવ ગ્રહાય છે પ્રજા વડે;

પ્રજાથી જ્યમ જુદો કર્યો, ત્યમ ગ્રહાગ પાણ પ્રજા વડે. ૨૯૯.

પ્રજાથી ગ્રહવો - નિશ્ચયે જે ચેતનારો તે જ હું,

બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર - જાગવું. ૨૯૭.¹

૧. સમયસાર (ગુજરાતી) પાનું ૪૩૩ થી ૪૩૪

આ પ્રમાણે જીવ અને બંધ પોતાના નિયત સ્વ-લક્ષણો દ્વારા છેદી શકાય છે. આમ કરીને બંધને છોડી દેવો જોઈએ અને આત્માને ગ્રહણ કરવો જોઈએ.

તે આત્મા કેવી રીતે ગ્રહણ કરી શકાય ? આવો પ્રશ્ન થતાં કહે છે કે તેને પ્રજ્ઞાથી જ ગ્રહણ કરી શકાય છે. જેવી રીતે પ્રજ્ઞાથી બિન્ન કર્યો; તેવી જ રીતે પ્રજ્ઞાથી ગ્રહણ કરવો જોઈએ.

પ્રજ્ઞાવઠે આ પ્રમાણે ગ્રહણ કરવો જોઈએ કે જે ચેતનારો છે, તે નિશ્ચયથી હું છું. બાકી બધા ભાવો મારાથી બિન્ન જ છે.

આ ગાથાઓનો ભાવ આત્મભ્યાતિમાં આ પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવ્યો છે -

“પ્રથમ તો આત્મા અને બંધને તેમના નિયત સ્વલક્ષણોના વિજ્ઞાન વડે સર્વથા છેદી દેવા જોઈએ, બિન્ન-બિન્ન કરી દેવા જોઈએ અને તે પછી રાગાદિ લક્ષણવાળા સમસ્ત બંધને છોડી દેવા જોઈએ અને ઉપયોગ જેનું લક્ષણ છે એવા શુદ્ધાત્માને ગ્રહણ કરી લેવો જોઈએ; કારણ કે બંધના ત્યાગથી શુદ્ધાત્માનું ગ્રહણ એજ બંધ અને આત્માના દ્વિધાકરણનું મૂળ પ્રયોગન છે.

પ્રશ્ન:- આ શુદ્ધાત્મા શાના વડે ગ્રહણ કરવો જોઈએ ?

ઉત્તર:- પ્રજ્ઞા વડે જ શુદ્ધાત્માને ગ્રહણ કરવો જોઈએ; કારણ કે પ્રમાણે બંધથી બિન્ન કરવામાં એકમાત્ર પ્રજ્ઞા જ કરણ હતી; તે જ પ્રમાણે ગ્રહણ કરવામાં પણ પ્રજ્ઞા જ એકમાત્ર કરણ છે. તેથી જે પ્રમાણે પ્રજ્ઞા વડે વિભક્ત કર્યો; તે જ પ્રમાણે પ્રજ્ઞાથી જ ગ્રહણ પણ કરવો જોઈએ.

નિયત સ્વલક્ષણનું અવલંબન કરનાર પ્રજ્ઞા વડે બિન્ન કરાયેલ ચેતક હું જ છું અને અન્ય લક્ષણોથી લક્ષ્ય વ્યવહારરૂપભાવ ચેતકરૂપી વ્યાપકમાં વ્યાપ્ય ન હોવાથી મારાથી અત્યંત બિન્ન છે.

તેથી હું જ, મારા વડે જ, મારા માટે જ, મારામાંથી જ, મારામાં જ મને જ ગ્રહણ કરું છું.

આત્માની ચેતના જ એક કિયા છે, તેથી હું ગ્રહણ કરું છું અર્થાત् હું ચેતું જ છું, ચેતતો થકો જ ચેતું છું ચેતના વડે જ ચેતું છું. ચેતના માટે જ ચેતું છું. ચેતનમાંથી જ ચેતું છું. ચેતતામાં જ ચેતતાને જ ચેતું છું અથવા નથી ચેતતો; નથી ચેતતો થકો ચેતતો, નથી ચેતતા, નથી ચેતતાને ચેતતો, નથી ચેતતા માટે ચેતતો, નથી ચેતનમાંથી ચેતતો, નથી ચેતતામાં ચેતતો, નથી ચેતતાને ચેતતો; પરંતુ સર્વવિશુદ્ધ ચિન્માત્ર (ચૈતન્યમાત્ર) ભાવ છું.”

આચાર્ય જ્યસેને તાત્પર્યવૃત્તિમાં આ ગાથાઓનો ભાવ આત્મઘ્યાતિને અનુસાર જ વ્યક્ત કર્યો છે.

પૂજય ગુરુદેવ આ ગાથાઓનો ભાવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે -

હવે જે પ્રક્ષા વડે બેદજાન કરીને એકવાર આત્માનુભૂતિ કરી, તે જ પ્રક્ષાના બળથી વારંવાર ઉપયોગને અંતર્મુખ કરીને વારંવાર આત્માને ગ્રહણ કરો. આત્માને ગ્રહણ કરવાનો અન્ય કોઈ ઉપાય જ નથી.^૧

‘પ્રક્ષા અર્થાત् પ્રકૃષ્ટજાન’ જે વર્તમાનજાનની દર્શામાં દ્રવ્યનો, ચૈતન્ય મહાપ્રભુ નિત્યાનંદસ્વરૂપી આત્માનો અનુભવ થાય છે, તેને પ્રક્ષા કહે છે. સ્વાનુભવસ્વરૂપ સ્વસંવેદનજાનની દર્શા પ્રક્ષા છે. તે પ્રક્ષા રાગને નષ્ટ કરનાર છે; તેથી તેને પ્રક્ષાધીણી કહે છે. આવી પ્રક્ષા દ્વારા આત્મસ્વરૂપનો અનુભવ કરતો થકો આત્મા રાગથી બિન્ન થઈ જય છે અર્થાત् એવો અનુભવ કરે છે કે હું તો ચેતના લક્ષણવાળો આત્મા છું. અને મારાથી બિન્ન આ રાગ બંધસ્વરૂપ છે, બંધનું લક્ષણ છે. આ રીતે બન્નેને બિન્ન-બિન્ન જાણે છે. અહા ! જેની સત્તામાં આ ચેતના (જાણવું-દેખવું) છે, તે ચેતક જ હું છું અને શેષ બધા ભાવ પર છે. આ રીતે સ્વાબિમુખ જ્ઞાનની દર્શામાં આત્મા બિન્ન અનુભવમાં આવે છે.

એકસમયની જ્ઞાનની દર્શામાં - પ્રક્ષામાં એવું અદ્ભુત સામર્થ્ય છે કે જે સર્વજસ્વભાવી ભગવાન આત્માના સામર્થ્યને પૂર્ણ જાણી લે છે.^૨

૧. પ્રવચનરત્નાકર ભાગ ૮, પાનું ૩૫૩

૨. પ્રવચનરત્નાકર ભાગ ૮, પાનું ૩૬૧-૩૬૨

પહેલા જે જ્ઞાનની પર્યાય પર તરફ દળતી હતી, તેમાં રાગાદિ પોતાપણે જણાતા હતા. હવે તે પર્યાય વ્યય થઈને ત્રિકાળી શુદ્ધદ્રવ્યના આશ્રયથી જે નવીન પર્યાય ઉત્પન્ન થઈ, તેમાં જે ચેતક છે, તે જ હું છું' એમ જ્ઞાન થયું.^૧

તેથી અભિજ્ઞ છ કારકોથી હું જ, મારા વડે જ, મારા માટે જ, મારામાંથી જ મારામાં જ, મને જ ગ્રહણ કરું છું.

હું જ ગ્રહણ કરું છું - તે કર્તા, હું પોતાને જ ગ્રહણ કરું છું - તે કર્મ મારા વડે જ પોતાને જ ગ્રહણ કરું છું - તે કારણ અથવા સાધન, મારા માટે જ ગ્રહણ કરું છું - તે સંપ્રદાન, મારામાંથી જ ગ્રહણ કરું છું - તે અપાદાન, મારામાં જ ગ્રહણ કરું છું - તે અધિકરણનો આધાર છે આ અભિજ્ઞ ષટ્કારકનું પરિણામન પર્યાયનું પર્યાયમાં છે, ધ્રુવમાં નથી; કારણ કે ધ્રુવ તો ફૂટસ્થ અપરિણામી છે.^૨

આ પ્રમાણે આ ગાથાઓમાં એમ જ કહેવામાં આવ્યું છે કે આત્મા અને બંધને તેમના સ્વલ્પકાળોથી ઓળખીને બંધને છોડીને આત્માને ગ્રહણ કરવો જોઈએ. આત્માને બંધથી બિજ્ઞ જાણવાનું અને ગ્રહણ કરવાનું સંપૂર્ણ કાર્ય પોતાની સ્વયંની બુદ્ધિ-વિવેકથી જ થાય છે; તેમાં અન્ય કોઈ પરનો સહયોગ અથવા કોઈ કિયકાંડની રંચમાત્ર પણ આવશ્યકતા નથી. આજ વાત ને ૨૮૭મી ગાથાની ટીકામાં અભિજ્ઞ ષટ્કારકો પર ઘટાવીને સમજાવેલ છે.

આ ગાથાની ટીકામાં પહેલા તો પરકર્તૃત્વનો નિષેધ કરતાં એમ કહ્યું કે હું પોતે જ ચેતું છું, પોતાને જ ચેતું છું, પોતા વડે જ ચેતું છું, પોતા માટે જ ચેતું છું, પોતામાંથી જ ચેતું છું અને પોતામાં જ ચેતું છું. આ પ્રમાણે અભિજ્ઞ ષટ્કારક સમજાવ્યા.

પછી એમનો પણ નિષેધ કરતાં કહ્યું કે હું તો આ બધા વિકલ્પોથી પાર સર્વવિશુદ્ધ ચિન્માત્રભાવ છું.

૧. પ્રવચનરલનાકર ભાગ C, પાનું ૩૬૨

૨. પ્રવચનરલનાકર ભાગ C, પાનું ૩૬૪-૩૬૫

આમ મોક્ષાધિકારની આ ગાથાઓમાં સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારના જીજ પણ પડી ગયા એ તો સર્વવિદ્ધિ જ છે કે આ અધિકાર પછી સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર જ આવનાર છે.

આમ આ ગાથાઓ આત્માની પૂર્ણ સ્વાધીનતા ધોખિત કરનાર ગાથાઓ છે.

હે આ ભાવોનો પોષક કળશક્તિ લખે છે; જે આ પ્રમાણે છે:-

(શાર્દૂલવિક્રીડિત)

ભિત્તા સર્વમપિ સ્વલ્ક્ષણબલાદ્ભેતું હિ યચ્છક્યતે,
ચિન્મુદ્રાંકિતર્વિભાગમહિમા શુદ્ધશિચદેવાસ્મ્યહમ् ।
ભિદ્યન્તે યદિ કારકાણ યદિ વા ધર્મ ગુણ વા યદિ,
ભિદ્યન્તાં ન ભિદાસ્તિ કાચન વિભૌ ભાવે વિશુદ્ધે ચિતિ ॥૧૮૨॥

(હરિગીત)

નિજ લક્ષ્યાગોના બળ થકી પરભાવ સર્વે ભેદીને,
ચૈતન્ય મહિમાવંત હું અંકિત ચિન્મુદ્રા વડે;
કારક તથા ધર્મો, ગુણોના ભેદ હો તો હોય જો,
ચૈતન્ય શુદ્ધસ્વભાવી વિભુમાં ભેદ તો ના હોય કો'. ૧૮૨.

જે કંઈ પણ ભેદી શકાય તે બધાને સ્વલ્ક્ષણના બળથી ભેદીને, જેનો મહિમા નિર્વિભાવ છે અને જે ચૈતન્યમુદ્રાથી અંકિત છે - એવો શુદ્ધચૈતન્ય જ હું છું. જે કારકોના, ધર્મોના અથવા ગુણોના ભેદ પડે તો બલે જ પડે; પરંતુ સમસ્ત વિભાવોથી રહિત શુદ્ધ સર્વપ્રભુતાસંપત્ત ચૈતન્યસ્વભાવી વિભુ આત્મામાં તો કોઈ પણ ભેદ નથી.

અહીં કારકોમાં કર્તા-કર્માદિ ષટ્કારક, ધર્મોમાં નિત્ય-અનિત્યત્વાદિ ધર્મયુગલ અને ગુણોમાં જ્ઞાન, દર્શન, સુખાદિ ગુણોને લેવા જેર્યાએ.

આ કળશનો ભાવ પૂજ્ય ગુરુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે -

“સમ્યગ્દર્શિનના ધ્યેયરૂપ ચિન્માત્ર શુદ્ધ આત્મામાં કર્તા-કર્મ આદિ કોઈ બેદ નથી. આ પ્રમાણે નિત્ય-અનિત્ય એક-અનેક આદિ અપેક્ષિત ધર્મોના બેદ પણ શુદ્ધવસ્તુમાં નથી. તે જ રીતે જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત ગુણોના બેદ પણ શુદ્ધ અચળ ચૈતન્યભાવમાં નથી. જ્ઞાયકભાવ આત્મામાં એક, નિત્ય, ત્રિકાળી, શાખત, અખંડ એકરૂપ ધ્રુવ સામાન્ય એવા કોઈ બેદ નથી.

જે કે સદ્બૂતબ્યવહારનયથી ઘદકારકના, નિત્ય-અનિત્ય આદિ અપેક્ષિત ધર્મોના તથા જ્ઞાન આદિ ગુણોના અનંત બેદ છે; પરંતુ નિશ્ચયથી શુદ્ધચિન્માત્રભાવમાં કોઈ બેદ નથી. જ્ઞાન.....જ્ઞાન.....જ્ઞાન....એવા જ્ઞાનના પૂરા જ્ઞાનમાત્ર ભૂતાર્થ સ્વભાવમાં કોઈ બેદ નથી.¹

અહીં તો એમ કહી રહ્યા છે કે - પર્યાયમાં જે ઘદકારકોના બેદ ઉભા કર્યા છે, તે પણ અભેદ એકરૂપ વસ્તુમાં સ્વીકૃત નથી.

કારક, ધર્મ અને ગુણબેદ તો માત્ર જ્ઞાન કરવાવા માટે કરવામાં આવ્યા છે. અંતરદાચિના વિષયમાં એવા કોઈ બેદ દેખાતા નથી. દ્રવ્યમાં બેદ છે અવશ્ય, પરંતુ અભેદસ્વભાવ પર દાઢિ જમતાં અર્થાત् નિર્વિકલ્પ અનુભવમાં બેદ દેખાતા જ નથી. આત્મામાં અનંત ગુણ છે, પરંતુ દાઢિ અભેદ આત્માને જ વિષય બનાવે છે; તેથી એમાં બેદ દેખાતા નથી તથા જે કોઈ અભેદને છોડિને બેદોને જુએ તો વિકલ્પ અર્થાત્ રાગ ઉત્પન્ન થયા વિના રહેતો જ નથી. અર્થાત્ બેદદાચિમાં રાગ જ હોય છે ધર્મ નહીં.

જ્ઞાનની એકસમયની પર્યાયમાં છાએ દ્રવ્યોનું જ્ઞાન થાય - જ્ઞાનમાં એવું સામર્થ્ય છે. તથા એવી અનંત પર્યાયોનો પિંડ એક જ્ઞાનગુણ છે. અને જેવો એક જ્ઞાનગુણ છે, આત્મામાં એવા-એવા અનંત ગુણ અને એમની અનંત પર્યાયો છે. એવા અનંત ગુણોનો અભેદ પિંડ એક આત્મદ્રવ્ય છે. એવી પોતાની અભેદ વસ્તુમાં ગુણ-ગુણીનાં બેદ પણ લક્ષ્યમાં લેવા જેવા નથી; કારણ કે તેનાથી રાગ જ થાય છે.

૧. પ્રવચનરત્નાકર ભાગ ૮, પાનું ૩૬૪-૩૬૫

આ પ્રમાણે પ્રક્ષા વહે અર્થात् વર્તમાનજ્ઞાનની દશાડ્રૂપ અનુભવ દ્વારા આત્મા ગૃહણ થાય છે - જણાય છે. તેમાં શુદ્ધાત્મા દ્રવ્ય છે અને અનુભવ પર્યાય છે. જેકે આત્મા જ્ઞાનની પર્યાયમાં આવતો નથી, તથા પર્યાય પણ દ્રવ્યમાં એકમેક થતી નથી. જણે છે પર્યાય જ, કારણકે કામ તો પર્યાયમાં જ થાય છે ને ? ધ્રુવ તો અક્ષિય જ રહે છે.^૧

ઇ કારકોના બેદ, સત्-અસત् આદિ ધર્મોના બેદ તથા જ્ઞાન-દર્શન આદિ ગુણોના બેદ માત્ર જાણવા માટે હો તો ભલે હો; પરંતુ આદર આપવા માટે અથવા આશ્રય કરવા માટે આ કોઈ બેદ નથી. ધર્મની પ્રથમ સીડી સમ્બગ્દર્શન અને તેના વિષયભૂત શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવોમાં આવા કોઈ બેદ નથી. અહીં શુદ્ધ ચૈતન્યમાત્ર કહીને બધા બેદ કાઢી નાખ્યા છે. અહો ! એવો એક શુદ્ધ ચૈતન્યમાત્રભાવ સમ્બગ્દર્શનનો વિષય છે, ધ્યેય છે.

‘આ અબેદ છે’, એવો વિકલ્પ પણ અબેદ આત્મામાં નથી. ‘આ દાખિ અને દાખિનો વિષય’ – વસ્તુમાં આવું દૈત પણ નથી. બસ, દાખિનું શુદ્ધ ચૈતન્ય પર ટકવું – ટક્યા રહેવું જ અબેદદાખિ છે અને તે જ રીતે અબેદ-એક આત્માનું ગૃહણ થાય છે. ‘દ્રવ્ય સામાન્ય અબેદ છે’ એવો વિકલ્પ પણ નહીં, પરંતુ પર્યાય જે દ્રવ્યની તરફ ઝુકી ગઈ – બસ, તેને જ અબેદનો અનુભવ કહેવાય છે. તેનું જ નામ સમકિત અને ધર્મ છે.

કારકબેદ, ધર્મબેદ અને ગુણબેદોને જાણવા અનુપચારિત સદ્ભૂતવ્યવહારનય છે તથા વ્યવહારરત્નત્રયને જાણવો ઉપચારિતસદ્ભૂતવ્યવહારનય છે. શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુનો અનુભવ કરવો શુદ્ધનય છે. આવા શુદ્ધનયથી અબેદદ્રૂપ આત્માને ગૃહણ કરવો જોઈએ.^૨

કવિવર બનારસીદાસણ આ કળશનો ભાવાનુવાદ આ પ્રમાણે કરે છે -

૧. પ્રવચનરત્નાકર ભાગ C, પાનું ૩૬૫

૨. પ્રવચનરત્નાકર (હિન્દી), ભાગ C, પાનું ૩૬૭

(સવૈયા ઇકતીસા)

કોડ અનુભવી જીવ કહૈ મેર અનુભી મૈં,
 લક્ષન વિભેદ ભિન્ન કરમ કો જાલ હૈ ।
 જાને આપા આપુકોઈ જુ આપુકરિ આપુવિષે,
 ઉત્પત્તિ નાસ ધૂવ ધારા અસરાલ હૈ ॥
 સારે વિકલપ મોસોં ન્યારે સરવથા મેરૌ,
 નિહચૈ સુભાવ યહ વિવહાર ચાલ હૈ ।
 મૈં તો સુદ્ધ ચેતન અનંત ચિનમુદ્રા ધારી,
 પ્રભુતા હમારી એકરૂપ તિહું કાલ હૈ ॥

કર્મની જળથી ભિન્ન ભગવાન આત્મા મારા અનુભવમાં આવી ગયો છે અને હું સ્વયંને સ્વયંથી સ્વયંમાં જાણું છું અનુભવ કરું છું. ઉત્પાદ-વ્યથ અને ધૂવ સંબંધી બેદધારા અને તત્ત્વ સંબંધી વિકલ્પ મારાથી ભિન્ન છે. તેમને આત્માના કહેવા તે માત્ર વ્યવહાર છે. નિશ્ચયથી હું તો ચિન્મુદ્રાધારી અનંત ગુણોનો અભેદ પિંડ શુદ્ધ ચૈતનતત્ત્વ છું અને મારી આ પ્રભુતા તો ત્રિકાળ એકરૂપ છે, અખંડ છે.

પ્રશ્ન:- આચાર્ય અમૃતચંદ્રના મૂળ કળશમાં તો ઉત્પાદ-વ્યથ-ધૌબ્ય સંબંધી કોઈ વાત નથી. પણ અહીં બનારસીદાસજીએ ઉત્પાદ-વ્યથ અને ધૌબ્ય સંબંધી પણ વાત કરી છે.

ઉત્તર:- એ તો સર્વવિદ્ધિત જ છે કે નાટક સમયસારમાં સર્વત્ર જ કળશાલીકાનું અનુસરણ કરવામાં આવ્યું છે. કળશમાં સમાગત 'ધર્મ' પદને કળશાલીકામાં ઉત્પાદ-વ્યથ-ધૌબ્ય અને દ્રવ્ય-ગુણ-પર્યાય લેવામાં આવ્યા છે. આજ કારણ છે કે નાટક સમયસારમાં આ છંદમાં પણ તેની ચર્ચા આવી ગઈ છે.

આ પ્રમાણે આ કળશમાં પણ તે જ વાત કહેવામાં આવી છે; જે વિગત ગાથાઓમાં કહેવાઈ હતી.



સમયસાર ગાથા ૨૬૮-૨૭૭

૨૬૭મી ગાથામાં જે વાત સામાન્ય ચેતક સ્વભાવ માટે અથવા સામાન્ય ચેતનાને માટે કહેવામાં આવી હતી; હવે આગામી ગાથાઓમાં આજ વાત શાયકસ્વભાવ અને દર્શકસ્વભાવ અથવા જ્ઞાનચેતના અને દર્શનચેતનાને માટે કહેવામાં આવી રહી છે.

ગાથાઓ મૂળથી આ પ્રમાણે છે -

પણાએ ધિત્તબો જો દઢા સો અહં તુ ણિચ્છયદો ।

અવસેસા જે ભાવા તે મજઝ પરે ત્તિ ણાદવા ॥૨૯૮॥

પણાએ ધિત્તબો જો ણાદા સો અહં તુ ણિચ્છયદો ।

અવસેસા જે ભાવા તો મજઝ પરે ત્તિ ણાદવા ॥૨૯૯॥

પ્રજ્ઞાથી ગ્રહવો - નિશ્ચયે જે દેખનારો તે જ હું,

બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર - જાગવું. ૨૮૮.

પ્રજ્ઞાથી ગ્રહવો - નિશ્ચયે જે જાગનારો તે જ હું,

બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર - જાગવું. ૨૮૯.^૧

પ્રજ્ઞાવડે આમ ગ્રહણ કરવું કે જે દેખનારો છે, તે નિશ્ચયથી હું જ હું; શેષ જે ભાવ છે, તે મારાથી પર છે - આમ જાણવું.

પ્રજ્ઞા વડે આમ ગ્રહણ કરવું કે જે જ્ઞાણનારો છે, તે નિશ્ચયથી હું જ છું; શેષ જે ભાવ છે, તે મારાથી પર છે - આમ જ્ઞાણવું.

આ ગાથાઓનો ભાવ આત્મઘ્યાતિમાં આ પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવ્યો છે.

“ચેતના દર્શન-જ્ઞાનકૃપ બેદોને ઉલ્લંઘતી નહિ હોવાથી, ચેતકપ્રણાની માફક દર્શકપણું અને જ્ઞાતાપણું આત્માનું સ્વતંક્ષણ જ છે. માટે હું દેખનારા આત્માને ગ્રહણ કરું છું.

ગ્રહણ કરું છું એટલે દેખું જ છું. દેખતો થકો જ દેખું છું. દેખતા વડે જ દેખું છું. દેખતા માટે જ દેખું છું. દેખતામાંથી જ દેખું છું. દેખતામાં જ દેખું છું. દેખતાને જ દેખું છું. અથવા નથી દેખતો; નથી દેખતો થકો દેખતો, નથી દેખતા વડે દેખતો, નથી દેખતા માટે દેખતો, નથી દેખતામાંથી દેખતો, નથી દેખતામાં દેખતો, નથી દેખતાને દેખતો; પરંતુ હું સર્વ વિશુદ્ધ દર્શનમાત્ર ભાવ છું.

એ જ રીતે હું જ્ઞાણનારા આત્માને ગ્રહણ કરું છું. ‘ગ્રહણ કરું છું’ એટલે ‘જાણું જ છું’; જાણતો થકો જ જાણું છું. જાણતા વડે જ જાણું છું, જાણતા માટે જ જાણું છું, જાણતામાંથી જ જાણું છું, જાણતામાં જ જાણું છું. જાણતાને જ જાણું છું. અથવા નથી જાણતો; નથી જાણતો થકો જાણતો, નથી જાણતા વડે જાણતો, નથી જાણતા માટે જાણતો, નથી જાણતામાં જાણતો, નથી જાણતાને જાણતો; પરંતુ હું સર્વવિશુદ્ધજ્ઞપ્તિ (જ્ઞાણનક્ષિયા) માત્ર ભાવ છું.”

આ પ્રમાણે દેખનારા આત્માને તથા જ્ઞાણનારા આત્માને કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણકૃપ કારકોના બેદ્યૂર્વક ગ્રહણ કરીને, પછી કારકબેદોનો નિષેધ કરીને આત્માને અર્થાત્ પોતાને દર્શનમાત્ર ભાવકૃપે તેમજ જ્ઞાનમાત્ર ભાવકૃપે અનુભવ કરવો અર્થાત્ અભેદકૃપે અનુભવવો.

આચાર્ય જ્યસેને તાત્પર્યવૃત્તિમાં આ ગાથાઓનો ભાવ સ્પષ્ટ કરતાં આત્મભ્યાતિનું જ અનુકરણ કર્યું છે. આત્મભ્યાતિમાં આવનાર કળશોને પણ તાત્પર્યવૃત્તિમાં ઉદ્ઘાટિત કર્યા છે. અન્ય ડેકાડો આમ બહુ ઓછું થયું છે, પણ આ ગાથાઓની ટીકામાં આમ થયું છે.

આ ગાથાઓનો ભાવ પૂજ્ય ગુરુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે -

“સામાન્યપણે નેને ચેતના કહેવામાં આવે છે, તે જ ચેતના જ્ઞાન અને દર્શનના બેદથી બે પ્રકારની છે. બે સ્વરૂપે છે. ચેતના આત્માનું લક્ષણ છે - એમ કહીને રાગ આત્માથી ભિન્ન છે - એમ સિદ્ધ કરે છે; પરંતુ તે ચેતના દર્શન અને જ્ઞાનરૂપ બેદને તથા આત્માના ગુણસ્વભાવોને ઉલ્લંઘતી નથી. જ્ઞાન અને દર્શન ગુણ અર્થાત् સામાન્યરૂપે ચેતના તો આત્માનો સ્વભાવ છે. ચેતન્યસ્વરૂપી આત્માનો જ્ઞાન જ એક સ્વભાવ છે - એમ નથી, પરંતુ દર્શન અને જ્ઞાન - એ બંને જ આત્માના સ્વભાવ છે. તેથી ચેતનપણાની માફક દર્શન અને જ્ઞાન - બંને જ આત્માના સ્વલક્ષણ છે. અનુભવમાં દર્શન અને જ્ઞાન - બંને આવે છે.”^૧

ચેતકપણાની માફક દર્શકપણું અને જ્ઞાતાપણું આત્માનું જ સ્વલક્ષણ છે. તેથી હું જ્ઞાતાસ્વભાવી આત્માને ગ્રહણ કરું છું. આમ સામાન્ય વાત કરી. હવે ષટકારકના બેદ કરીને વિશેષ સમજાવે છે.^૨

જુઓ, સર્વવિશુદ્ધ અધિકાર આવવાનો છે ને ? આ તેની જ પૂજ્યભૂમિ છે. અહીં કહે છે કે - આ કર્તાં-કર્મ આદિના બેદરૂપ હું નથી. હું તો સર્વવિશુદ્ધ દર્શનમાત્ર ભાવ છું.

આ જ પ્રમાણે હવે જ્ઞાનથી સમજાવે છે - હું જ્ઞાયક અર્થાત् જ્ઞાતા આત્માને ગ્રહણ કરું છું. ‘ગ્રહણ કરું છું’ અર્થાત् જાણું જ છું - આમ સામાન્ય વાત કરી, હવે ષટકારકના બેદ કરીને વિશેષ સમજાવે છે.

^૧ પ્રવચનરત્નાકર ભાગ ૮, પાનું ૩૭૦

^૨ પ્રવચનરત્નાકર ભાગ ૮, પાનું ૩૭૧

આ પ્રમાણે છ કારકના બેદના વિચારો પહેલા અવશ્ય આવે છે, પણ બેદનું લક્ષ્ય કરવાથી વિકલ્પ જ ઉત્પન્ન થાય છે. આ કારણે સમકાળી બેદનું લક્ષ્ય છોડીને અબેદ એક જ્ઞાનમાત્ર વસ્તુ આત્માને જ ગ્રહણ કરે છે.

જુઓ, આ પ્રમાણે છયે કારકોને રદ કરી દીધા અર્થાત્ દાખિમાંથી છોડી દીધા તથા ‘હું તો અબેદ એક સર્વવિશુદ્ધ જ્ઞાનમાત્ર ભાવ છું’ - આવા જ્ઞાનની ડિયાને જ્ઞાનસ્વભાવમાં જોડી દીધો. અહા ! ‘હું તો જ્ઞાયકસ્વભાવમાત્ર છું’ - આવા અબેદ એક આત્માની દાખિ થતાં પર્યાયમાં પણ કેવળ જ્ઞાયકસ્વભાવ જ આવ્યો છે; રાગ અને બેદ આવ્યા નથી. તેનું જ નામ ધર્મ છે, આત્મા નિકાળજ્ઞાયકસ્વભાવ માત્ર છે. એવું જાણતાં થક જ્ઞાનની પર્યાયમાં ભગવાન આત્માને ઉપાદેય કરતાં થક પર્યાયમાં પણ જે જ્ઞાયકસ્વભાવની પરિણાતિ પ્રગટ થાય છે, તે જ સમ્યગુદ્દર્શન અને સમ્યગુજ્ઞાન છે.^૧

આ પ્રમાણે જ્ઞાતા-દાખિસ્વભાવી આત્માને કર્તા-કર્મ-કરણ-સંપ્રદાન-અપાદાન અને અધિકરણકૃપ કારકોના બેદપૂર્વક ગ્રહણ કરીને અર્થાત્ પ્રથમ જ્ઞાનમાં બેદપૂર્વક જાણીને પછી કારકના બેદો દૂર કરીને - બેદનું લક્ષ્ય છોડીને પોતાને શુદ્ધ એક દર્શનમાત્ર ભાવકૃપે, તે જ પ્રમાણે જ્ઞાનમાત્ર ભાવકૃપ વહે જ અનુભવ કરો. આ પ્રમાણે અબેદના અનુભવને સમ્યગુદ્દર્શન અને સમ્યગુજ્ઞાન કહે છે.”^૨

આ પ્રમાણે ૨૬૭ થી ૨૭૮ સુધીની આ ત્રણ ગાથાઓમાં પ્રજ્ઞા વહે આત્માને ગ્રહણ કરવાનું કહેવામાં આવ્યું છે. ‘ગ્રહણ કરવું’ અર્થાત્ કોઈ અન્ય વસ્તુને ગ્રહણ કરવાની અથવા લેવાની નથી; પરંતુ ચેતનાનો અનુભવ કરવો તે જ આત્માનું ગ્રહણ કરવું છે.

પહેલી ગાથામાં સામાન્ય ચેતનાનો અનુભવ કરાવવામાં આવ્યો

^૧ પ્રવચનરત્નાકર ભાગ ૮, પાનું ૩૭૨

^૨ પ્રવચનરત્નાકર ભાગ ૮, પાનું ૩૭૩-૩૭૪

છે. ત્યાં અનુભવ કરનાર, જેનો અનુભવ કરવામાં આવે છે અને જેના વડે અનુભવ કરવામાં આવે છે તે - ઈત્યાદિ કારકભેદૃપથી આત્માને કહીને, અભેદ વિવક્ષામાં કારકભેદનો નિષેધ કરીને, આત્માને એક શુદ્ધચૈતન્યમાત્ર કહેવામાં આવ્યો છે.

આ પછીની બે ગાથાઓમાં દાઢા તથા શાતાનો અનુભવ કરાવ્યો છે; કેમ કે ચેતના સામાન્ય દર્શાન-શાન વિશેખોનું ઉલ્લંઘન કરતી નથી. આ બે ગાથાઓમાં પણ છ કારકરૂપ ભેદનો અનુભવ કરાવીને, તે બાદ અભેદ અનુભવની અપેક્ષાએ કારકભેદને દૂર કરાવીને, શાતા-દાઢા માત્રનો અનુભવ કરાવ્યો છે.

ઉક્ત સંદર્ભમાં પૂજ્ય ગુરુદેવના વિચાર આ પ્રમાણે છે -

“આ ત્રણેય ગાથાઓમાં પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરવાની વાત કહી છે. ‘ગ્રહણ કરવું’ કહેવામાં કોઈ અન્ય વસ્તુને ગ્રહણ કરવાની અથવા લેવાની વાત નથી, ચેતનાનો અનુભવ કરવો તે જ આત્માનું ગ્રહણ કરવું છે. સત્ત દ્રવ્યસ્વભાવ છે, ચિત્ત ગુણસ્વભાવ છે અને અનુભવ કરવો પર્યાયસ્વભાવ છે. આ પ્રમાણે દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણે આવી ગયા.

પરભાવો અને વિકારથી બિજ્ઞતાની વાત પહેલા આવી ગઈ છે. અહીં તો નિર્મળ કારકોના ભેદને જ દૂર કરવાનું કહેવાઈ રહ્યું છે. ચૈતન્યની નિર્મળ પર્યાય કર્તા, નિર્મળ પર્યાય કર્મ, નિર્મળ પર્યાય કરણ ઈત્યાદિ છ કારકોના પરિણમનમાં જે લક્ષ્ય જય છે, તે ભેદૃપ વ્યવહાર છે. આ ભેદ-વ્યવહારનું લક્ષ્ણ છોડીને ચૈતન્યપ્રકાશના પુંજ અભેદ એક શુદ્ધ અંતરતત્ત્વની દર્શિ કરવી તે સમ્યગ્દર્શન છે.

પહેલા છ કારકોનો ભેદ કરીને સમજાવ્યું હતું. તે બાદ ભેદનો નિષેધ કરીને અભેદનો અનુભવ કરાવ્યો; કારણ કે ભેદની દર્શિમાં અભેદનો અનુભવ થતો નથી. આ કારણે ભેદને ગૌણ કરીને અભેદસ્વરૂપ શુદ્ધચૈતન્યમાત્ર વસ્તુની દર્શિ કરાવી.¹

¹ પ્રવચનરત્નાકર ભાગ C, પાનું ૩૭૪

જુઓ, અજ્ઞાની જીવે અનાદિથી રાગ-દ્રેષ-કર્મચેતના અને કર્મકળચેતનાનું જ વેદન કર્યું છે. તેને જડનો સ્વાદ તો ક્યારેય આવતો જ નથી અને સ્વરૂપનો સ્વાદ તેણે ક્યારેય લીધો નથી. કહેવાનું તાત્પર્ય એમ છે કે લાદૂ, બરફી, પેંડા આદિ મિષ્ટાન, ઘન-સંપદા તથા સ્ત્રીનું સુંદર શરીર આદિ જડપદાર્થ તો પરદ્રવ્ય છે. તેથી તેના સ્વાદ આવવાનો તો પ્રશ્ન જ ઉઠતો નથી; કારણ કે એક દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં અત્યંતાભાવ છે. હા, તેના લક્ષ્યથી અજ્ઞાનીને પોતાના રાગાદિનો સ્વાદ આવે છે. તેનાથી તે પરમાં ભલા-બુરાની કલ્પના કર્યા કરે છે. પણ ભાઈ ! આ તો હુઃખનો જ સ્વાદ છે.

અહો ! જે એક ક્ષાળ પણ જ્ઞાનચેતનાનો સ્વાદ લે તો તેના જન્મ-મરાણ જ ટળી જય; પરંતુ અજ્ઞાનીએ એવો પ્રયત્ન ક્યારેય કર્યો નથી.”^૧

૨૬૭મી ગાથામાં ચિત્રસ્વભાવની વાત કહેવામાં આવી હતી અને ૨૬૮-૨૬૯મી ગાથામાં દર્શનસ્વભાવ અને જ્ઞાનસ્વભાવની વાત કહેવામાં આવી છે. દેખવું-જાણવું ચેતનાના જ વિશેષ છે. તેથી ૨૬૭મી ગાથામાં સામાન્ય કથન હતું અને ૨૬૮-૨૬૯મી ગાથામાં વિશેષ કથન છે.

આ પ્રમાણે આ ત્રણ ગાથાઓમાં એમ જ કહ્યું છે કે જ્ઞાનનાર-દેખનાર ચેતનતત્ત્વ છે, તે જ હું છું, શેષ બધા ભાવ મારાથી બિત્ત પરપદાર્થ છે. આ રીતે જાણીને પ્રજ્ઞાઈણીથી જ્ઞાનનાર-દેખનાર આત્માને ગ્રહણ કરવો જોઈએ.

હું આ જ અર્થને પોષતો કળશરૂપ કાવ્ય કહે છે, જે આ પ્રમાણે છે.

(શાર્ડુલવિક્રીડિત)

અદ્વૈતાપિ હિ ચેતા જગતિ ચેદ્ હગ્નપ્રિસ્લં ત્યજેત् ।
તત્સામાન્યવિશેષરૂપવિરહાત્સાઽસ્તિત્વમેવ ત્યજેત् ।

^૧ પ્રવચનરત્નાકર (હિંદી), ભાગ C, પાનું ૩૭૬

તત્યાગે જડતા ચિતોડપિ ભવતિ વ્યાપ્યો વિના વ્યાપકા-
દાત્મા ચાન્તમુપૈતિ તેન નિયતં હરજ્ઞપિરૂપાસ્તુ ચિત્ર ॥૧૮૩॥

(હરિગીત)

છે ચેતના અદેત તોપાગુ જ્ઞાનદર્શન જે તજે,
સામાન્ય તેમ વિશેષ ત્યજતાં ત્યાગથે અસ્તિત્વને;
અસ્તિત્વ નિજનું છોડવાથી જડ થશે આત્મા અને,
વ્યાપક વિના એ વ્યાપ્ત આત્મા પામથે જ વિનાશને;
બે દોપ આવા માન્ય નથી જિનવર તાગુા ઉપદેશમાં,
માટે નિયમથી ચેતના હો જ્ઞાનદર્શનઃપમાં. ૧૮૩

જે કે નિશ્ચયથી તો જગતમાં ચેતના અદૈત જ છે; છતાં પણ જે
તે પોતાના દર્શન-જ્ઞાનઃપને છોડી હે તો સામાન્ય-વિશેષઃપના વિરહ
(અભાવ) થી તે ચેતના પોતાના અસ્તિત્વને જ છોડી દેશે. તાત્પર્ય આ
છે કે જ્ઞાન-દર્શનના અભાવમાં ચેતનાનું અસ્તિત્વ જ નહીં રહે.

આ પ્રમાણે ચેતના પોતાનું અસ્તિત્વ છોડી હે તો ચેતન આત્મા
જડ થઈ જશે અને વ્યાપક ચેતના વિના વ્યાપ્ત આત્મા નભ થઈ જશે.
તેથી એમાં જ ભલું છે કે ચેતના નિયમથી દર્શન-જ્ઞાનઃપ જ હોય.

આ કળશનો ભાવ સ્પષ્ટ કરતાં પંહિત જ્યયંદળ છાબડા ભાવાર્થમાં
લખે છે -

“સમસ્ત વસ્તુઓ સામાન્યવિશેષાત્મક છે. તેથી તેમને પ્રતિભાસતી
ચેતના પણ સામાન્યપ્રતિભાસઃપ (દર્શનઃપ). અને વિશેષપ્રતિભાસઃપ
(જ્ઞાનઃપ) હોવી જોઈએ. જે ચેતના પોતાના દર્શનજ્ઞાનઃપને છોડી હે તો
ચેતનાનો જ અભાવ થતાં કાં તો ચેતન આત્માને (પોતાના ચેતનાગુણનો
અભાવ થતાં) જડત્વ આવી જશે અથવા તો વ્યાપકના અભાવથી વ્યાપ્ત

૧ પ્રવચનરત્નાકર ભાગ ૮, પાનું ૩૬૫

૧ પ્રવચનરત્નાકર (હિંદી), ભાગ ૮, પાનું ૩૬૭

એવા આત્માનો અભાવ થઈ જશે. (ચેતના આત્માની સર્વ અવસ્થાઓમાં વ્યાપ્ત હોવાથી વ્યાપક છે અને આત્મા ચેતન હોવાથી ચેતનાનું વ્યાપ્ત છે. તેથી ચેતનાનો અભાવ થતાં આત્માનો પણ અભાવ થઈ જશે) તેથી ચેતનાને દર્શનજ્ઞાનરૂપ જ માનવી જોઈએ.

અહીં તાત્પર્ય આમ છે કે - સાંખ્યમતાવલંબી આદિ કેટલાક જગ્ઞા સામાન્ય ચેતનાને જ માનીને એકાંત કથન કરે છે, તેમનો નિષેધ કરવા માટે અહીં એમ બતાવવામાં આવ્યું છે કે વસ્તુનું સ્વરૂપ સામાન્યવિશેષરૂપ છે; તેથી ચેતનાને સામાન્યવિશેષરૂપ અંગીકાર કરવી જોઈએ."

નેકે દર્શનજ્ઞાનરૂપ ચેતના એક જ છે; છતાં પણ જોવારૂપ દર્શન અને જાણવારૂપ શાન - આ પ્રમાણે જોવા અને જાણવાના રૂપમાં ચેતના બે પ્રકારે પરિલક્ષિત થાય છે.

સામાન્ય અવલોકનને દર્શન કરે છે અને વિશેષ જાણવાને શાન કરે છે. એ તો સર્વવિદ્ધિત જ છે કે પ્રત્યેક વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે. સામાન્ય વિશેષ વિશેષાત્મક જૈયવસ્તુને વિષય બનાવનાર ચેતનાનું પણ સામાન્યગ્રાહી દર્શન અને વિશેષગ્રાહી જ્ઞાનના રૂપમાં બે પ્રકારે હોવું સ્વાભાવિક જ છે.

આ પ્રમાણે આ અદ્વૈત ચેતના જ દર્શન અને જ્ઞાનના બેદથી બે પ્રકારની છે. આ જ વાતને આ કળશમાં સયુક્તિ સિદ્ધ કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે આ અદ્વૈત ચેતના જો દેખવા અને જાણવારૂપ બેપણાને છોડી હેતુ તો સામાન્ય અને વિશેષનો અભાવ થઈ જવાથી પોતાના અસ્તિત્વને જ છોડી હેતુ. જ્યારે ચેતનાનું જ અસ્તિત્વ નહીં રહેશે તો પછી ચેતનાના અભાવમાં ચેતનદ્રવ્ય જરૂર થઈ જશે. જરૂર જ નહીં, પરંતુ તેનું અસ્તિત્વ જ સમાપ્ત થઈ જશે; કારણ કે ચેતના વગરનો ચેતન કેવો? તેથી ભલું એમાં જ છે કે આપણે ચેતનાને દર્શનજ્ઞાનરૂપ જ સ્વીકાર કરીએ.

આ વાતને પૂજ્ય ગુરુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે. "સ્વભાવથી ચેતના એક હોવા છતાં પણ જાતા-દાખાપણું પણ એનું સ્વરૂપ છે. જો

તે શાતા-દઘાપણું છોડી હે તો ચેતનાનો અભાવ થઈ જશે અને ચેતના વગર ચેતન જીવદ્રવ્ય જડ થઈ જશે.

પહેલા બોલમાં આત્માના જડ થવાનો દોષ દર્શાવ્યો હતો અને હવે બીજ બોલમાં આત્માના નષ્ટ થવાનો દોષ બતાવી રહ્યા છે. જે વ્યાપક ચેતના જ ન રહે તો વ્યાપ્ય આત્માનો નાશ થવાનો પણ પ્રસંગ પ્રાપ્ત થશે.

આ પ્રમાણે ચેતનાને બે રૂપ ન માનતાં બે દોષ ઉત્પત્ત થાય છે.^૧

ચેતનાને દર્શનશાનસ્વરૂપ જ માનવી. જેવું વસ્તુનું સ્વરૂપ સામાન્ય-વિશેષરૂપ છે, તે જ પ્રકારે વસ્તુને દેખવા-જાણવારૂપ ચેતના પણ સામાન્ય દર્શનસ્વરૂપ અને વિશેષ જ્ઞાનસ્વરૂપ છે. એવા પોતાના શાતાદઘા સ્વભાવને જાણીને એમાં જ એકાગ્રપણે લીન થઈને રહેવું - એનું જ નામ ધર્મ છે.^૨

કવિવર બનારસીદાસજી આ કળશનો ભાવાનુવાદ બે છંદોમાં આ પ્રમાણે કરે છે.

(સવૈયા ઇકતીસા)

નિરાકાર ચેતના કહાવૈ દરસન ગુન,

સાકાર ચેતના સુદૃઢ જ્ઞાન ગુનસાર હૈ ।

ચેતના અદ્વૈત દોઊ ચેતન દરબ માંહિ,

સામાન્ય વિશેષ સત્તા હી કૌ વિસતાર હૈ ॥

કોऊ કહૈ ચેતના ચિહ્ન નાંહી આત્મા મૈં,

ચેતના કે નાસ હોત ત્રિવિધ વિકાર હૈ ।

લક્ષન કૌ નાસ સત્તા નાસ મૂલ વસ્તુ નાસ,

તાર્તે જીવ દરબ કૌ ચેતના આધાર હૈ ॥

(દોહા)

ચેતન લક્ષન આત્મા, આત્મ સત્તા માંહિ ।

સત્તાપરિમિત વસ્તુ હૈ, ભેદ તિહું મૈં નાંહિ ॥

^૧ પ્રવયનરત્નાકર ભાગ ૮, પાનું ૩૭૮

^૨ પ્રવયનરત્નાકર ભાગ ૮, પાનું ૩૮૦

દર્શનગુણને નિરાકાર ચેતના કહે છે અને શાન ગુણને સાકાર ચેતના કહે છે. આ બંને જ ચેતનાઓ ચેતનદ્રવ્યમાં અદ્વૈતકૃપે રહે છે. સામાન્ય અને વિશેષ એક સત્તાનો જ વિસ્તાર છે.

કોઈ કહે છે કે આત્મામાં ચેતનાનું ચિહ્ન નથી. તેમને કહીએ છીએ કે ચેતનાનો નાશ માનતાં, ચેતનાનો અભાવ માનતાં ત્રણ પ્રકારનાં દોષ (આપત્તિ) આવશે. ચેતના જીવનું લક્ષણ છે; તેથી ચેતનાનો અભાવ માનતાં, સૌથી પહેલા તો લક્ષણનો નાશ થઈ જશે; બીજું સત્તાનો નાશ થઈ જશે અને ત્રીજું મૂળ વસ્તુનો જ નાશ થઈ જશે. તેથી જીવદ્રવ્યનો આધાર તો ચેતના જ છે.

આત્માની સત્તા છે અને આત્માનું લક્ષણ ચૈતન્ય છે. પ્રત્યેક વસ્તુ પોતાની સત્તામાં સીમિત છે. આ પ્રમાણે ચેતના, આત્મા અને સત્તા - આ ત્રણેમાં કોઈ બેદ નથી, ત્રણે એક જ છે. તાત્પર્ય એમ છે કે ચૈતન્યલક્ષણથી લક્ષિત આત્મા સત્તાસ્વરૂપ વસ્તુ છે.

આ પ્રમાણે આ કળશમાં એમ જ કહેવામાં આવ્યું છે કે સામાન્યવિશેષાત્મક આત્મવસ્તુનું લક્ષણ દર્શન-શાન ચેતના છે. નિરાકાર દર્શનનું સાકારંજાન સૂત્રના અનુસાર સામાન્યગ્રાહી દર્શન નિરાકાર હોય છે, નિર્વિકલ્પ હોય છે અને વિશેષગ્રાહી શાન સાકાર હોય છે, સવિકલ્પ હોય છે. આત્માને દર્શન-શાનકૃપ ચેતનારહિત માનતાં અનેક આપત્તિઓ ઉભી થાય છે. તેથી દર્શન-શાન ચેતનાને જીવનું લક્ષણ સ્વીકાર કરવું જ અભીષ્ટ છે.

આ પછી નાટક સમયસારમાં ત્રણ છંદ બીજા પણ આવે છે, જેમાં આત્માનું જ વિવેચન છે; પરંતુ આ પ્રકારના કોઈ છંદ આત્મઘ્યાતિમાં સમાગત છંદોમાં નથી. તેથી તે અહીં આપવામાં આવતા નથી.

હવે આગામી ગાથાની સૂચનિકાકૃપ કળશકાવ્ય લખે છે; જે આ પ્રમાણે છે -

(ઇન્દ્રબ્રજા)

એકશિચતશિચન્મય એવ ભાવો, ભાવા: પરે યે કિલ તે પરેષામ્ર ।
 ગ્રાહ્યસ્તતશિચન્મય એવ ભાવો, ભાવા: પરે સર્વત એવ હેયા: ॥૧૮૪॥
 (હરિગીત)

ચૈતન્યનો બસ એક ચિન્મય ભાવ છે સાચો અને,
 બાકી બધાં જે ભાવ તે સૌ ભાવ પરના છે ખરે;
 બસ માત્ર ચિન્મયભાવ તેથી ગ્રહણ કરવા યોગ્ય છે,
 ભાવો અનેરા સર્વરીને છોડવાને યોગ્ય છે. ૧૮૪
 ચૈતન આત્માનો તો એક ચિન્મયભાવ જ છે. અન્ય જે ભાવ છે,
 તે આત્માના નથી, તે અન્યના જ ભાવ છે. તેથી એક ચિન્મયભાવ ગ્રહણ
 કરવા યોગ્ય છે, શેષ બધા ભાવ સંપૂર્ણ રીતે હેય છે. આ કળશનો
 ભાવાનુવાદ નાટક સમયસારમાં આ પ્રમાણે કરવામાં આવ્યો છે.

(અડિલ્લ)

જાકે ચેતન ભાવ, ચિદાનન્દ સોડું હૈ ।

ઔર ભાવ જો ધરૈ, સૌ ઔરી કોડું હૈ ॥
 જો ચિનમંડિત ભાડ, ઉપાદે જાનર્ને ।

ત્યાગ જોગ પરભાવ, પરાયે માનર્ને ॥૨૫॥

જેના ચૈતનભાવ છે, તે જ ચિદાનંદ આત્મા છે. ચૈતનભાવોથી
 લિન્ન ભાવોને ધારણ કરનાર પદાર્થ આત્મા નથી, અન્ય જ છે. જે ભાવ
 ચૈતન્યભાવથી મંડિત છે, તે ઉપાદેય છે; શેષ બધા પરભાવ પર માનીને
 ત્યાગવા યોગ્ય છે.

આ કળશનો ભાવ પૂજ્ય ગુરુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે -

“એક ચિન્મયભાવ સિવાય સર્વ ભાવો પરભાવ છે. જે ભાવથી
 તીર્થકર નામકર્મનો બંધ પડે છે, તે ભાવ પણ પરભાવ છે. તે પણ જીવભાવ
 નથી. જ્યારે આવી વસ્તુસ્થિતિ છે તો શુભભાવકૃપ પરભાવથી આત્મામાં
 ધર્મની પ્રાપ્તિ કેમ થઈ શકે ?”

અનેદ એક ચિન્મય આત્મામાં એકાગ્રતા કરવી જ હુઃખ્યી મુક્તિનો ઉપાય છે. વચ્ચે વ્યવહાર આવે અવશ્ય છે, પણ તે કોઈ ઉપાય નથી, તે તો બંધનું જ કારણ છે. તેથી ચિન્મયભાવ જ ગ્રહણ કરવા યોગ્ય છે. બીજ બધા સર્વથા છોડવા યોગ્ય છે.”

આ સરળ-સુભોધ કળશમાં એક જ વાત કહેવામાં આવી છે કે આત્મા તો ચૈતન્યમાત્ર જ છે; અને જે ભાવ તે આત્માથી બિજ્ઞ છે, તે આત્મા નથી; તેથી આત્મકલ્યાણ માટે ચૈતન્યલક્ષણથી લક્ષિત આત્મા જ ઉપાદેય છે, શેષ બધા ભાવ હેય છે. આ જ વાત આગામી ગાથામાં પણ કહેવામાં આવી છે.



શાબ્દોચ્છી

પ્રશ્ન :- દીનતામાં તે વળી એવું શું પાપ છે ? તેમાં નથી હિંસા કે નથી ચોરી આદિ.

ઉત્તર :- ત્યાં લોલ કથાયની એટલી બધી તીવ્રતા છે કે જેથી અન્ય કથાયો તેને નિર્બણ કરવા પડે છે, લોક લજ્જા મૂકવી પડે છે, ધર્માદિ સહ અનુષ્ઠાનને પણ તે ગણતો નથી. કવચિત કરે છે તો અંતરેગમાં તે લોલ હેતુને ઊભો રાખીને કરે છે. વધારે શું કહીએ, પોતાના પૂજ્ય અને વડીલાદિ માનનીય પુરુષોનું પણ અપમાન કરી-કરાવીને પણ પોતાના ઈચ્છિત પ્રયોજનને સાધવા પ્રયત્ન કરે છે. લોભાદિને અર્થે વિવેક કે હિતાહિત હેયોપાદેયને ભૂલી ચૈતન્ય જેવા ચૈતન્યને જડવત્ત બનાવી મૂકે છે; અને એ જ મહા પાપ છે.

સમયસાર ગાથા ૩૦૦

કો ણામ ભળિજ્જ બુહો ણાદું સવ્વે પરાડાએ ભાવે ।
મજઝમિં તિ ય વયં જાણંતો અપ્પયં સુદ્ધં ॥૩૦૦॥

સૌ ભાવ ને પરકીય જાગે, શુદ્ધ જાગે આત્મને,
તે કોણ જ્ઞાની ‘માદું આ’ એવું વચ્ચે બોલે ખરે ? ૩૦૦.¹

પોતાના શુદ્ધ આત્માને જ્ઞાનનાર અને સર્વ પરભાવોથી પર જ્ઞાનનાર
એવો કોણ જ્ઞાની હશે કે ને એમ કહેશો કે આ પરપદાર્થ મારા છે ? તાત્પર્ય
એમ છે કે કોઈ પણ સમજદાર વ્યક્તિ એમ નથી કહેતી કે પરપદાર્થ મારા
છે તો પછી આત્મજ્ઞાની વ્યક્તિ આવી વાત કેમ કહી શકે ?

આત્મપ્રયાતિમાં આ ગાથાનો ભાવ આ પ્રમાણે રૂપદ્ધ કરવામાં
આવ્યો છે -

“ને પુરુષ પરના અને આત્માના નિયત સ્વલ્પણોના વિભાગમાં
પડનારી પ્રક્ષા વડે જ્ઞાની થાય છે, તે ખરેખર એક ચિન્માત્ર ભાવને પોતાનો
જ્ઞાણ છે અને બાકીના સર્વ ભાવોને પારકા જ્ઞાણ છે. આવું જ્ઞાનતો થકો
તે પુરુષ પરભાવોને ‘આ મારા છે’ એમ કેમ કહે ? કારણ કે પરને અને
પોતાને નિશ્ચયથી સ્વસ્વામિસંબંધનો અસંભવ છે માટે સર્વથા ચિહ્નભાવ
જ (એક) ગ્રહણ કરવા યોગ્ય છે, શેષ સમસ્ત ભાવ છોડવા યોગ્ય છે
- એવો સિદ્ધાંત છે.

¹ સમયસાર (ગુજરાતી), પાનું ૩૦૦

આ ગાથાનો અને દીકાનો ભાવ પૂજ્ય ગુરુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે -

“આત્માનો સ્વભાવ ચેતના છે અને રાગ બિન્ન છે, પર છે; આ પ્રમાણે બંનેની વચ્ચે સંધિ છે. તે બંનેની વચ્ચે પ્રક્ષાણીણી પટકતાં ‘સ્વ’નું જ્ઞાન થાય છે તથા નાસ્તિપણે રાગ મારી વસ્તુ નથી. એવું જ્ઞાન થઈ જાય છે. તેનું જ નામ બેદવિજ્ઞાન છે, ધર્મ છે. ભાઈ ! ધર્મ કરનારને પ્રથમ આ બેદવિજ્ઞાન કરવું જરૂરી છે, ત્યારે તે ધર્મી જ્ઞાની થાય છે.”

જેણે રાગથી બિન્ન શુદ્ધ ચેતના માત્ર ભગવાન આત્માનો અનુભવ કર્યો, તે જ્ઞાની વ્યવહારના રાગને પોતાનો કેમ માની શકે ? કારણ કે પર અને નિજની સાથે નિશ્ચયથી સ્વ-સ્વામી સંબંધ અસંભવ છે. શુદ્ધ ચેતનાસ્વભાવ ‘સ્વ’ અને સ્વયંનો આત્મા તેનો ‘સ્વામી’ - આવો સ્વ-સ્વામીસંબંધ છે. પર રાગ ‘સ્વ’ અને આત્મા ‘સ્વામી’ - આવો સંબંધ નથી. તો પછી જ્ઞાની તે રાગને પોતાનો કેમ માને ? પરભાવનો સ્વામી ‘પર’ છે, આત્મા તેનો સ્વામી નથી.

સમયસાર પરિશિષ્ટમાં ૪૭ શક્તિઓનું વર્ણન કર્યું છે. તેમાં અંતિમ સ્વ-સ્વામી સંબંધ શક્તિ છે. જે શક્તિને કારણે પોતાના દ્રવ્ય-ગુણ અને નિર્મળપર્યાય પોતાનું ‘સ્વ’ છે. અને સ્વયં આત્મા તેનો ‘સ્વામી’ છે, એવી ‘સ્વ-સ્વામીસંબંધ’ શક્તિ છે. પર-વિકાર પોતાનું સ્વ અને સ્વયં વિકારનો સ્વામી - એવો સ્વ-સ્વામી સંબંધ નથી. આત્મા વિકારનો સ્વામી બને - એવી તેનામાં કોઈ શક્તિ છે જ નહીં.”^૧

આ ગાથામાં કોઈ વિશેષ વાત કહી નથી. માત્ર આટલું જ કહ્યું છે કે પરપદાર્થોને આત્માથી સંપૂર્ણ બિન્ન જાણનાર જ્ઞાની પુરુષ આવું કેમ કહી શકે કે પરપદાર્થ મારા છે ? લૌકિક સજ્જન પુરુષ પણ પરધનને પોતાનું નથી કહેતા તો પછી લોકોત્તર પુરુષ આ પ્રકારની વાત કેવી રીતે કરે ?

૧ પ્રવચનરત્નાકર (હિન્દી), ભાગ ૮, પાનું ૩૮૩

૨ પ્રવચનરત્નાકર (હિન્દી), ભાગ ૮, પાનું ૩૮૬

અહીં આત્મા અને રાગાદિમાં સ્વસ્વામી સંબંધના અભાવના આધારે આ વાત સિંદ્ર કરવામાં આવી છે. સ્વ-સ્વામીસંબંધનો નિષેધ તો જીવાળવાધિકારમાં વિસ્તારથી થઈ ચૂક્યો છે. તેથી અહીં તેના પર વિશેષ ચર્ચાની આવશ્યકતા નથી.

હવે આ જ વાતને દફ્તા પ્રદાન કરતાં આગામી કળશ લખે છે; જે આ પ્રમાણે છે -

(શાર્ડૂલવિક્રીડિત)

સિદ્ધાંતોऽયમુદાત્તચિત્તચરિતૈર્મોક્ષાર્થિભિ� સેવ્યતાં
શુદ્ધં ચિન્મયમેકમેવ પરમં જ્યોતિઃ સદૈવાસ્પ્રયહમ् ।
એતે યે તુ સમુલ્લસંતિ વિવિધા ભાવાઃ પૃથગ્લક્ષણા -
સ્લેઝં નાસ્મિ યતોऽત્ર તે મમ પરદ્રવ્યં સમગ્રા અપિ ॥૧૮૫॥

(હરિગીત)

મોક્ષાથીઓ ઉદાત્ત આ સિદ્ધાંતનું સેવન કરો -
'હું શુદ્ધ ચિન્મય પરમજ્યોતિ એક છું જ સદા અહો !
આ વિવિધ ભાવો જે પ્રગટનાં બિજી લક્ષણ જેહનાં,
તે હું નથી, પરદ્રવ્ય સૌ તે ભાવ્ય મારાથી બધાં.' ૧૮૫.

જેમનું ચિત્ત અને ચારિત્ર ઉદાર છે એવા મોક્ષાથીઓ વડે આ સિદ્ધાંતનું સેવન થવું જોઈએ કે હું તો સદાય એક શુદ્ધ ચૈતન્યમ્ય પરમજ્યોતિ છું અને મારાથી પૃથ્વી લક્ષણવાળા વિવિધ પ્રકારના જે ભાવ પ્રગટ થાય છે; તે હું નથી; કારણ કે તે બધા મારા માટે પરદ્રવ્ય છે.

આ કળશનો ભાવાનુવાદ નાટક સમયસારમાં આ પ્રમાણે કર્યો છે.

(સવૈયા તેર્ઝસા)

ચેતન મળિત અંગ અખંડિત, સુદ્ધ પવિત્ર પદારથ મેરી ।
રાગ વિરોધ વિમોહ દસા, સમુઝી ભ્રમ નાટક પુદ્ગલ કેરૈ ॥

ભોગ સંયોગ વિયોગ બિથા, અવલોકિ કહે યહ કર્મજ ઘેરો ।
હૈ જિન્હ કૌ અનુભૂ ઇહ ભાઁતિ, સદા તિન કૌં પરમારથ નેરો ॥

જે વ્યક્તિ એમ સમજે છે કે મારો આત્મા તો ચૈતન્યથી મંહિત
છે, સંપૂર્ણ રીતે અખંહિત છે, શુદ્ધ છે, પવિત્ર છે અને પરમ પદ્ધાર્થ છે;
રાગ-દ્રેષ-મોહની દશા ભ્રમ છે અને પુદ્ગળનું નાટક છે. આ ભોગ, સંયોગ
અને વિયોગની વ્યથા - આ બધા કર્મોદ્યના પરિણામ છે, કર્મજન્ય છે;
એમાં માઝું કંઈ પણ નથી, જે વ્યક્તિ આ પ્રકારનો અનુભવ કરે છે, પરમાર્થ
સદાય તેમની નિકટ છે. તાત્પર્ય આમ છે કે તેઓ શીદ્ર જ મુક્તિપદ્ધને
પ્રાપ્ત કરશે.

ઉક્ત કળશમાં એક જ વાત કહેવામાં આવી છે કે જે મોક્ષાર્થી
છે, મુમુક્ષુ છે, જેમને દુઃખોથી મુક્ત થવાની આકાંક્ષા છે; તેમને આ મહાન
સિદ્ધાંત પર પોતાની શ્રદ્ધા દદ કરવી જોઈએ અને તેને અનુસાર આચરણ
પણ કરવું જોઈએ.

પ્રશ્ન:- જે મહાન સિદ્ધાંત પર ચાલવાની વાત કહેવાઈ રહી છે,
તે મહાન સિદ્ધાંત આખરે છે શું ?

ઉત્તર:- બીજું કંઈ નહીં, બસ એમ જ છે કે હું તો એક શુદ્ધ
ચૈતન્યમય પરમજ્યોતિ છું. આ મોહ-રાગ-દ્રેષના ભાવો જે કે મારામાં જ
ઉત્પન્ન થાય છે, પણ તે ભાવ મારાથી બિજ્ઞ જ છે. તે મારા નથી, હું
તે ઢ્રે નથી, તેમનો કર્તા-ધર્તા પણ હું નથી.

આ પ્રકારની માન્યતા જ મહાન સિદ્ધાંત છે, જેના પર ચાલવાની
પ્રેરણા અહીં આપવામાં આવી રહી છે.

કવિવર બનારસીદાસજીએ ઉક્ત છંદની પહેલા એક છંદ લખ્યો છે;
જેમાં મોક્ષાર્થીનું સ્વરૂપ સ્પષ્ટ કરવાનો સફળ પ્રયાસ કર્યો છે. મોક્ષાર્થીનું
સ્વરૂપ સ્પષ્ટ કરતો તે છંદ આ પ્રમાણે છે -

(સવૈયા ઇકતીસા)

જિન્હ કેં સુમતિ જાગી ભોગ સૌં ભયે વિરાગે,
પરસંગ ત્યાગ જે પુરુષ ત્રિભુવન મેં ।
રાગાદિક ભાવનિ સૌં જિનિકી રહનિ ન્યારી,
કબહું મગન હૈ ન રહેં ધામ ધન મેં ॥
જે સદૈવ આપકોં વિચારેં સરવાંગ સુદ્ધ,
જિન્હ કે વિકલતા ન વ્યાપૈ કહું મન મેં ।
તેડી મોખ મારગ કે સાધક કહાવેં જીવ,
ભાવૈ રહૌ મંદિર મેં ભાવૈ રહૌ વન મેં ॥

ત્રણ લોકમાં જે પુરુષોની સુમતિ જગૃત થઈ ગઈ છે, જે પુરુષ વૈરાગી થઈ ગયા છે અને પરસંગ (પરિગ્રહ)ના ત્યાગી થઈ ગયા છે, રાગાદિભાવોથી પોતાને સદા લિઙ્ગ માને છે અને તેમનાથી દૂર રહેવામાં પ્રયાસરત રહે છે તથા ધન-સંપત્તિ અને ધર-મકાનમાં ક્યારે પણ ભગ્ન થતા નથી, જે પોતાને સદાય સર્વાંગ શુદ્ધ વિચારે છે, જેમના મનમાં ક્યારે પણ વિકળતા વ્યાપતી નથી; તે પુરુષ બલે ધરમાં રહે કે વનમાં રહે; તાત્પર્ય એમ છે કે બલે ધરવાસી ગૃહસ્થ હોય કે પછી વનવાસી સાધુ હોય; તે પુરુષ જ મોક્ષમાર્ગના સાધન મોક્ષાથી કહેવાય છે.

ઉક્ત સંદર્ભમાં પૂજ્ય ગુરુદેવના વિચાર પણ જાણવા જેવા છે; જે આ પ્રમાણે છે -

“કળશમાં પહેલો શબ્દ ‘મોક્ષાથી’ આવ્યો છે. મોક્ષાથી કહે કે ધર્મ કહે કે જ્ઞાની કહે - ત્રણ એકાર્થક છે. અનંત સુખમય મોક્ષનો આંશિક અનુભવ જેમને થયો છે, તે મોક્ષાથી છે. કળશટીકામાં મોક્ષાથીનો અર્થ એમ કર્યો છે કે સકળ કર્મોના ક્ષયથી ઉત્પત્ત અતીન્દ્રિય સુખનો જેમણે ઉપાદેયરૂપ અનુભવ કર્યો છે - એવો જીવ. અતીન્દ્રિય આનંદનો અંશ જેમના સ્વાદમાં આવ્યો છે તથા જે પૂર્ણ આનંદનો અર્થી છે, તે મોક્ષાથી છે.

નિયમસારમાં પૂર્ણ અતીન્દ્રિય આનંદના આત્મલાભને મોક્ષ કહ્યો છે તથા એવા મોક્ષનો જે અર્થી, તે મોક્ષાથી છે. પૂર્ણ આનંદરૂપ મોક્ષના

કારણકૃપ માર્ગમાં જે સ્થિત છે, તે મોક્ષમાર્ગી જ મોક્ષાર્થી છે. બીજી રીતે કહીએ તો મોક્ષ જેમનું પ્રયોગન છે અને જે મોક્ષને માટે જ નિરંતર પ્રયત્નશીલ છે તે સમ્યગ્દાચિ ધર્માત્મા છે.

અનંતદુઃખની દરા સંસાર છે, તેનાથી વિપરિત અનંત આનંદની દરા મોક્ષ છે તથા જેમાં કિંચિત્ આનંદની દરા અને કિંચિત્ દુઃખની દરા છે - તે સાધક મોક્ષાર્થી છે.

‘મોક્ષાર્થી’ ને જ પરિભાષિત કરતાં કહે છે કે જેમાં શાન અને આનંદનો પૂર્ણ સ્વભાવ વિઘ્નમાન છે, તે ભગવાન આત્માની જેમને દર્શિ થઈ છે, તેનું જ જેને શાન થયું છે અને અંદરમાં રમણતાકૃપ આચરણ પ્રગટ થયું છે, તે મોક્ષાર્થી છે. એવા મોક્ષાર્થીના ચિત્તનું ચારિત્ ઉદાત્ત છે અર્થાત્ તેના શાનનું આચરણ ઉદાર છે, ઉચ્ચ છે, ઉજ્જવળ છે. ક્ષાળ-ક્ષાળમાં તેના આનંદની રમણતા વૃદ્ધિગત થતી રહે છે.^૧

ભગવાન આત્મા શુદ્ધ ચેતનાસ્વકૃપ છે. તેની અંદર એકાગ્ર થઈને તેમાં જ રમયું, રહેવું એ જ શાનનું આચરણ છે.^૨

મોક્ષાર્થી-ધર્મી પોતાને એવી રીતે અનુભવે છે કે ખરેખર તો હું એકડૃપ જ છું અને આ ભૂમિકાનુસાર બિજ્ઞ લક્ષણવાળા અનેક પ્રકારના શુભાશુભ ભાવ, જે વર્તમાન પર્યાયમાં પ્રગટ થતા રહે છે, હું તે સ્વકૃપ નથી; તે ભાવો મારાથી બિજ્ઞ જ છે.^૩

જે ભાવથી તીર્થકર નામકરનો બંધ થાય છે, એવી ખોડખકારણ ભાવનાઓ પણ મારા માટે પરદ્રવ્ય છે - એમ કહે છે. અજીવ કર્મપ્રકૃતિ તો પર છે જ; પરંતુ વ્યવહાર રત્નત્રયનો જે વિકલ્પ ઉત્પન્ન થાય છે, તે પણ મારા માટે અજીવ-પરચીજ છે - એમ કહે છે.^૪

આ પ્રમાણે આ કળશમાં એમ જ કહેવામાં આવ્યું છે કે મોહ-

૧ પ્રવચનરત્નાકર (હિન્દી), ભાગ ૮, પાનું ૩૮૮-૩૮૯

૨ પ્રવચનરત્નાકર (હિન્દી), ભાગ ૮, પાનું ૩૮૯

૩ પ્રવચનરત્નાકર (હિન્દી), ભાગ ૮, પાનું ૩૯૧

૪ પ્રવચનરત્નાકર (હિન્દી), ભાગ ૮, પાનું ૩૯૨

રાગ-દ્રેષ્ટ ભાવોથી બિજ્ઞ શાનાનંદસ્વભાવી નિજ ભગવાન આત્મામાં
પોતાપણું સ્થાપિત કરવું તે જ ધર્મ છે અને તે અનુસારનું આચરણ જ
ધર્માચરણ છે.

હવે આગામી ગાથાની સૂચના આપતું કળશ કાવ્ય લખે છે જે આ
પ્રમાણે છે.

(અનુષ્ઠાન)

પરદ્રવ્યગ્રહં કુર્વન् બધ્યેતૈવાપરાધવાન् ।
બધ્યેતાનપરાધો ન સ્વદ્રવ્યે સંવૃતો યતિ: ॥૧૮૬॥

(હરિશીત)

કરીને ગ્રહાગ પરદ્રવ્યનું, જે ના ગ્રહે નિજદ્રવ્યને,
તે આત્મા અપરાધી છે, તેથી જ તે બંધાય છે;
સંતુષ્ટ નિજદ્રવ્યે રહે જે, ના ગ્રહે પરદ્રવ્યને,
છે નિરપરાધી તે યતિ, તેથી ન તે બંધાય છે. ૧૮૬

પરદ્રવ્યને ગ્રહણ કરનાર અપરાધી હોવાથી બંધનને પ્રાપ્ત થાય છે
અને સ્વદ્રવ્યમાં સંવૃત યતિ નિરપરાધી હોવાથી બંધને પ્રાપ્ત થતો નથી.

જે પ્રમાણે લોકમાં જે વ્યક્તિ પરધનાદિને ગ્રહણ કરે છે, તેને
અપરાધી માનવામાં આવે છે અને બંધનને પ્રાપ્ત થાય છે; તે જ પ્રમાણે
આ અલૌકિક માર્ગમાં પણ જે આત્મા પરભાવોનો સ્વામી તથા કર્તા-ભોક્તા
બને છે, તે અપરાધી હોવાથી કર્મબંધનને પ્રાપ્ત થાય છે અને જે સ્વદ્રવ્યમાં
જ સમેટીને રહે છે, પોતાના ઉપયોગને પોતાના આત્મામાં જ લગાડે છે,
પોતાના આત્માને જ પોતાનો જાણો. માને છે અને પોતામાં જ જમે-રમે
છે, તે નિરપરાધી હોવાથી બંધનોથી મુક્ત થઈ જય છે.

આ કળશનો ભાવાનુવાદ નાટક સમયસારમાં કવિવર બનારસીદાસ
આ પ્રમાણે કરે છે.

(વોહા)

જો પુમાન પરધન હરૈ, સો અપરાધી અગ્ય ।

જો અપનૌ ધન વ્યૌહરૈ, સો ધનપતિ સરવગ્ય ॥

પરકી સંગતિ જૌ રચૈ, બંધ બઢાવૈ સોઈ ।

જો નિજ સત્તા મેં મગન, સહજ મુક્ત સો હોઈ ॥

જે પ્રમાણે જે પુરુષ પરધનનું હરણ કરે છે, તે અજ્ઞાની જીવ અપરાધી છે; પરંતુ જે પુરુષ પોતાના ધનનો જ ઉપયોગ કરે છે; બધું જાણનાર તે ધનપતિ છે.

તે જ પ્રમાણે પરની સંગતિમાં રચેલા-પરચેલા લોકો બંધનને વધારે છે અને જે વ્યક્તિ પોતાના અસ્તિત્વમાં જ ભગ્ન રહે છે; તેમને સહજભાવે જ મુક્તિની પ્રાપ્તિ થઈ જય છે.

આ પ્રમાણે આ કળશમાં એમ જ કહેવામાં આવ્યું છે કે પરદ્રવ્યોમાં એકત્વ-મભત્વ, કર્તૃત્વ-ભોક્તૃત્વ રાખનારા કર્મબંધનને પ્રાપ્ત થાય છે અને પોતાના આત્મામાં જ એકત્વ-મભત્વ, કર્તૃત્વ-ભોક્તૃત્વ રાખનાર જીવ કર્મબંધનોથી મુક્ત થઈ જય છે.

આ છંદો બાદ નાટક સમયસારમાં પાંચ છંદ એવા આવે છે, જેમાં સત્તાના સ્વરૂપને સ્પષ્ટ કરેલ છે. પરંતુ ઉક્ત ભાવને પોષતા કોઈ પણ છંદ આત્મઘ્યાતિમાં નથી. આ કારણે તે અહીં આપવામાં આવતા નથી.



સમયસાર ગાથા ૩૦૧-૩૦૩

થેયાદી અવરાહે જો કુબ્વદિ સો ઉ સંકિદો ભમડી ।
મા બજ્જોર્જં કેણ ચોરી ત્તિ જણમ્નિ વિયરંતો ॥૩૦૧॥

જો ણ કુણદિ અવરાહ સો ણિસ્સંકો દુ જણવદિ ભમદિ ।
ણ વિ તસ્સ બજ્જિદું જે ચિંતા ઉપ્પજ્જદિ કયાડી ॥૩૦૨॥

એવમ્નિ સાવરાહો બજ્જામિ અહં તુ સંકિદો ચેદા ।
જડ પુણ ણિરાવરાહો ણિસ્સંકોહં ણ બજ્જામિ ॥૩૦૩॥

અપરાધ ચૌર્યાદિક કરે જે પુરુષ તે શંકિત ફરે,
કે લોકમાં ફરતાં રખે કો ચોર જાણી બાંધથે; ૩૦૧.

અપરાધ જે કરતો નથી, નિઃશંક લોક વિષે ફરે,
'બંધાઉ હું' એવી કદી ચિંતા ન થાયે તેહને. ૩૦૨.

ત્યમ આતમા અપરાધી 'હું બંધાઉ' એમ સંશુદ્ધ છે,
ને નિરપરાધી જીવ 'નહિ બંધાઉ' એમ નિઃશંક છે. ૩૦૩.¹

જે પુરુષ ચોરી આદિ અપરાધ કરે છે, તે 'કોઈ મને ચોર સમજીને
પકડી ન લે' - આ પ્રમાણે શંકિત થતો થકો લોકમાં ફરે છે.

જે પુરુષ અપરાધ નથી કરતો, તે લોકમાં નિશંક ફરે છે; કારણ
કે તેને બંધાવાની ચિંતા કયારેય ઉત્પન્ન થતી નથી.

¹ પ્રવચનરત્નાકર (ગુજરાતી), પાનું ૪૪૨-૪૪૩

તે જ પ્રમાણે અપરાધી આત્મા 'હું અપરાધી છું, તેથી હું બંધાઈશ' - આ પ્રમાણે શંકિત થાય છે અને જે તે નિરપરાધ હોય તો 'હું બંધાઈશ નહીં' - આ પ્રમાણે નિશંક હોય છે.

ઉક્ત ગાથાઓનો ભાવ આત્મભ્યાતિમાં આ પ્રમાણે વ્યક્ત કરવામાં આવ્યો છે.

"જેમ આ જગતમાં જે પુરુષ પરદ્રવ્યના ગ્રહણકૃપ અપરાધને કરે છે, તેને બંધની શંકા થાય છે અને જે આ પ્રકારનો અપરાધ કરતો નથી, તેને બંધની શંકા પણ થતી નથી; તે જ પ્રમાણે આ આત્મા પણ અશુદ્ધ વર્તતો થકો પરદ્રવ્યના ગ્રહણકૃપ અપરાધ કરે છે તો તેને બંધની શંકા થાય છે તથા જે આત્મા શુદ્ધ વર્તતો થકો ઉક્ત પ્રકારના અપરાધને નથી કરતો, તેને બંધની શંકા થતી નથી - એવો નિયમ છે તેથી સમસ્ત પરકીય ભાવોના સર્વથા પરિહાર દ્વારા શુદ્ધ આત્માને ગ્રહણ કરવો જોઈએ; કારણ કે તેમ કરતાં જ નિરપરાધતા થાય છે."

ઉક્ત ગાથાના ભાવને પૂજ્ય ગુરુદેવ આ પ્રમાણે રજુ કરે છે -

"જે કોઈ પણ જીવ પોતાના શુદ્ધ જ્ઞાતા-દાયા સ્વભાવને છોડીને પુણ્યપરિણામમાં (બ્યવહારમાં) પોતાપણે વર્તે છે, તે અપરાધી છે અને તેને પોતાને શંકા થાય છે કે હું બંધાઉં છું, આવી શંકાવાળો સ્વયં બંધનમાં પડે જ છે.

પરંતુ જે શુદ્ધ પ્રવર્તન કરતો થકો અપરાધ કરતો નથી, તેને બંધનની શંકા જ થતી નથી. 'હું તો જ્ઞાનાનંદ સ્વભાવી પ્રભુ એક શુદ્ધ ચિન્માત્ર આત્મા છું' - જે એવી અનુભવકૃપ વર્તમાનદશામાં વર્તે છે, તે અપરાધી નથી. આવા આત્માને બંધનની શંકા થતી નથી - આવો નિયમ છે.¹

જેટલા પણ દ્વાયા, દાન, વ્રત, ભક્તિ આદિના શુભ વિકલ્પ ઉઠ છે, તે બધા પરદ્રવ્ય છે, પરભાવ છે, તે આત્માનો સ્વભાવ નથી. 'તે

¹ પ્રવચનરત્નાકર (હિન્દી), ભાગ C, પાનું ૩૮૮

સર્વ પરભાવોનો સર્વથા પરિહાર કરીને' આ વાક્યમાં સર્વ અને સર્વથા - એમ બે શબ્દો આવ્યા છે. તેનો અર્થ આમ છે કે સમસ્ત શુભાશુભ પરભાવોનું સર્વથા લક્ષ્ય છોડીને નિર્બિકલ્પ શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી આત્માને જાળવો, અનુભવ કરવો તથા તેમાં જ દર્શિ લગાવીને સ્થિર થવું. તે જ શુદ્ધ આત્માનું ગ્રહણ છે અને તે જ નિરપરાધ દરા છે.

સર્વ શુભાશુભ રાગનું પણ લક્ષ્ય છોડીને પોતાના એક શુદ્ધ ચૈતન્યભાવને ગ્રહણ કરવાથી નિરપરાધ થવાય છે. આ છે નિરપરાધ થવાની રીત."

ઉક્ત ગાથાઓમાં એમ જ કહેવામાં આવ્યું છે કે જે પ્રમાણે લોકમાં અપરાધ કરનાર નિરંતર સશંક રહે છે, તેને આવી શંકા નિરંતર બની જ રહે છે કે તું પકડાઈ ન જઈ. આ જ કારણે તે બંધનને પ્રાપ્ત થાય છે. તે જ રીતે આત્માની આરાધનાથી રહિત લોકો પુણ્ય-પાપકૃપ ભાવોમાં પરિણામતા રહે છે અને નિરંતર સશંક રહેતાં થકાં બંધનને પ્રાપ્ત થાય છે.

જે પ્રમાણે લોકમાં નિરપરાધી નિરંતર નિશંક રહેતો થકો બંધનને પ્રાપ્ત થતો નથી; તે જ પ્રમાણે આત્માર્થી ભાઈ પણ નિરંતર નિશંક રહે છે અને બંધનને પ્રાપ્ત થતા નથી.

તેથી નિરપરાધી રહેવા માટે પરભાવોનાં પરિત્યાગ દ્વારા આત્માને ગ્રહણ કરવો જોઈએ, આત્માની આરાધના કરવી જોઈએ.



સમયસાર ગાથા ૩૦૪-૩૦૫

વિગત ગાથાઓમાં કહ્યું હતું કે અપરાધી બંધાય છે અને નિરપરાધી ધૂટે છે. તેથી હવે આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે અપરાધ શું છે ?

આ પ્રશ્નનો ઉત્તર જ આ ૩૦૪-૩૦૫ ગાથાઓમાં છે; જે આ પ્રમાણે છે.

સંસિદ્ધિરાધસિદ્ધં સાધિયમારાવિય ચ એયઢં ।

અવગદરાધો જો ખલુ ચેદા સો હોદિ અવરાધો ॥૩૦૪॥

જો પુણ ણિરાવરાધો ચેદા ણિસ્સંકિઓ ઉ સો હોડે ।

આરાહણાઇ ણિચ્ચં બદ્દેઝ અહં તિ જાણંતો ॥૩૦૫॥

સંસિદ્ધિ, સિદ્ધિ, રાધ, આરાધિત, સાધિત-એક છે,

એ રાધથી જે રહિત છે તે આત્મા અપરાધ છે; ૩૦૪.

વળી આત્મા જ નિરપરાધી તે નિઃશંકિત હોય છે,

વર્તે સદા આરાધનાથી, જાગુતો ‘હું’ આત્મને. ૩૦૫.¹

સંસિદ્ધિ, રાધ, સિદ્ધ સાધિત અને આરાધિત - આ એકાર્થવાચી છે. જે આત્મા ‘અપગતરાધ’ છે અર્થાત् રાધથી રહિત છે; તે આત્મા

અપરાધ છે. અને જે આત્મા નિરપરાધ છે, તે નિઃશંક હોય છે. શુદ્ધ આત્મા તે જ હું છું - આમ જણતો થકો સદા આરાધનાથી વર્તે છે.

આ ગાથાઓનો ભાવ આત્મઘ્યાતિમાં આ પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવ્યો છે.

“પરદ્રવ્યના પરિહિત વડે શુદ્ધ આત્માની સિદ્ધિ અથવા સાધન તે રાધ છે અને જે આત્મા ‘અપગતરાધ’ અર્થાત્ રાધ રહિત હોય તે આત્મા અપરાધ છે. અથવા જે ભાવ રાધરહિત હોય તે ભાવ અપરાધ છે. તે અપરાધ સહિત વર્તતો આત્મા સાપરાધ છે.

તે આત્મા, પરદ્રવ્યના ગ્રહણના સદ્ધભાવ વડે શુદ્ધ આત્માની સિદ્ધિના અભાવને લીધે બંધની શંકા થતી હોઈને સ્વયં અશુદ્ધ હોવાથી અનારાધક જ છે, અને જે આત્મા નિરપરાધ છે તે સમગ્ર પરદ્રવ્યના પરિહિત વડે શુદ્ધ આત્માની સિદ્ધિના સદ્ધભાવને લીધે બંધની શંકા નહિ થતી હોવાથી ‘ઉપયોગ લક્ષણાવાળો શુદ્ધાત્મા જ હું છું’ એમ નિશ્ચય કરતો થકો શુદ્ધાત્માની સિદ્ધિનું આરાધનાથી સદા વર્તે છે; તેથી તે આરાધક જ છે.”

ઉક્ત ગાથાઓના ભાવને અત્યંત સરળ-સુભોધ શબ્દોમાં પંડિત જ્યયંદજી છાબડા ભાવાર્થમાં આ પ્રમાણે સ્પષ્ટ કરે છે -

“સંસિદ્ધિ, રાધ, સિદ્ધિ, સાધિત અને આરાધિત - આ શબ્દોનો એક જ અર્થ છે, અહીં શુદ્ધ આત્માની સિદ્ધિ અથવા સાધનનું નામ ‘રાધ’ છે. જેને તે રાધ નથી તે આત્મા સાપરાધ છે અને જેને તે રાધ છે તે આત્મા નિરપરાધ છે. જે સાપરાધ છે, તેને બંધનની શંકા થાય છે; તેથી તે સ્વયં અશુદ્ધ હોવાથી અનારાધક છે અને જે નિરપરાધ છે, તે નિઃશંક થતો થકો પોતાના ઉપયોગમાં લીન થાય છે; તેથી તેને બંધની શંકા થતી નથી, તેથી ‘જે શુદ્ધ આત્મા છે તે જ હું છું’ એવા નિશ્ચયપૂર્વક વર્તતો થકો સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપના એક ભાવનું નિશ્ચય આરાધનાનો આરાધક જ છે.”

આચાર્ય જ્યસેનની તાત્પર્યવૃત્તિમાં ૩૦૫મી ગાથા છે જ નહીં. અત્યાર સુધી એવી તો અનેક ગાથાઓ આવી છે જે તાત્પર્યવૃત્તિમાં હતી પણ આત્મભ્યાતિમાં નથી પણ આ પહેલો અવસર છે કે જ્યારે એવું જેવામાં આવ્યું કે આત્મભ્યાતિમાં પ્રાપ્ત ગાથા તાત્પર્યવૃત્તિમાં નથી.

૩૦૪મી ગાથાનો અર્થ કરતી વખતે આચાર્ય જ્યસેન લખે છે કે નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈને નિજશુદ્ધાત્માની આરાધના કરવી જ રાધ છે.

આ જ વાતને પૂજને ગુરુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે -

“ભાઈ ! પર તરફના લક્ષ્યવાળા બધા ભાવ, ચાહે તે હિંસાદિ પાપભાવ હો અથવા અહિંસાદિ પુણ્યભાવ હો - તે સર્વભાવ અપરાધ છે. તે ભાવ બંધસાધક છે. જે તે ભાવોનું સેવન કરે છે, તે બંધનું જ સેવન કરે છે અને તેના સંસારની જ સિદ્ધિ અને વૃદ્ધિ થાય છે. એવું યથાર્થ જાણીને જે સમસ્ત પરભાવોથી વિમુખ થઈને આત્માની સન્મુખ થાય છે, ભગવાન આત્માના નિર્મળ જ્ઞાન, શ્રદ્ધાન અને અંતરરમણતારૂપ ચારિત્ર પ્રગટ કરે છે, તેને આત્માની સિદ્ધિ થાય છે; આત્મા પ્રાપ્ત થાય છે. આવા શુદ્ધાત્માની સિદ્ધિ જ મોક્ષનું સાધન છે.”^૧

આ પ્રમાણે અંતર્દ્ધિવંતને આત્માની સિદ્ધિ થઈ જય છે. તે જ સાધકભાવ છે અને તે જ રાધ છે.^૨

જુઓ પહેલા એમ કહેતા આવ્યા છે કે જે આત્મા રાધરહિત છે, તે અપરાધ છે અને હવે અહીં એમ કહું છે કે જે ભાવ રાધસહિત છે, તે અપરાધ છે. અહીં આત્મા અને ભાવને એકાર્થવાચી લીધા છે.

જે ભાવોથી શુદ્ધ આત્માનું સેવન થતું ન હોય તે સર્વ રાગાદિભાવ અપરાધ છે અને જેનો ભાવ અપરાધ છે, તે આત્મા અપરાધ છે.^૩

૧ પ્રવચનરત્નાકર (હિન્દી), ભાગ ૮, પાનું ૪૦૨-૪૦૩

૨ પ્રવચનરત્નાકર (હિન્દી), ભાગ ૮, પાનું ૪૦૩

૩ પ્રવચનરત્નાકર (હિન્દી), ભાગ ૮, પાનું ૪૦૪

જે જીવ રાગની આરાધના કરે છે, તે સાપરાધ છે અને તેને આત્માની સિદ્ધિનો અભાવ છે.^૧

જેની દર્શિના વિષયમાં પોતાનો પૂર્ણ પરમેશ્વર પ્રભુ આત્મા વર્તે છે, તે જીવ આરાધક છે. તેને જ આત્માનું સેવન કરનાર સાધક કહેવાય છે. હું શુદ્ધોપયોગમય જ છું - જેને અંતરંગમાં આવું દદ શ્રદ્ધાન થયું છે, તે સદાય આરાધક છે.^૨

જુઓ ! જે સાપરાધ છે તેને બંધની શંકા થાય છે. તેથી તે સ્વયં અશુદ્ધ છે. આ કારણે તે અનારાધક છે.

જે નિરપરાધ છે, તે નિઃશંક છે. તે પોતાના ઉપયોગમાં લીન થાય છે. ધર્મી પોતાના જ્ઞાન-દર્શિનમય આત્મામાં લીન છે.^૩

આ પ્રમાણે આ ગાથાઓમાં એમ જ કહેવામાં આવ્યું છે કે આત્માની સાધના જ રાધ છે અને જે આત્મા ઉક્ત સાધનાથી રહિત છે, તે આત્મા સ્વયં અપરાધ છે. તાત્પર્ય એમ છે કે આત્માની સાધનાથી રહિત ભાવ અપરાધ છે અને તે અપરાધસહિત હોવાથી આત્મા અપરાધી છે. આત્મા અપરાધી છે; તેથી એક પ્રકારે આત્મા જ અપરાધ છે.

હવે આ જ ભાવનો પોષક કળશ કાવ્ય લખે છે -

(માલિની)

અનવરતમનંતબધ્યતે સાપરાધ;

સૃષ્ટાતિ નિરપરાધો બન્ધનં નૈવ જાતુ ।

નિયતમયમશુદ્ધં સ્વં ભજનસાપરાધો;

ભવતિ નિરપરાધ: સાધુ શુદ્ધાત્મસેવી ॥૧૮૭॥

૧ પ્રવચનરત્નાકર (હિંદી), ભાગ ૮, પાનું ૪૦૫

૨ પ્રવચનરત્નાકર (હિંદી), ભાગ ૮, પાનું ૪૦૬

૩ પ્રવચનરત્નાકર (હિંદી), ભાગ ૮, પાનું ૪૦૮

(હરિગીત)

અપરાધસહ આત્મા અનંતા કર્મથી બંધાય છે,
ને નિરપરાધી આત્માને બંધ કદી ના થાય છે;
નિજને અશુદ્ધ જ સેવનારો નિયમથી અપરાધી છે,
જે સેવતો શુદ્ધાત્મને તે નિરપરાધી હોય છે. ૧૮૭

અપરાધી આત્મા અનંત પૌરુણાલિક કર્મથી બંધનને પ્રાપ્ત થાય છે અને નિરપરાધી આત્મા બંધનને કયારે સ્પર્શ પણ કરતો નથી. અજ્ઞાની આત્મા તો નિયમથી સ્વયંને અશુદ્ધ જાણતો થકો, અશુદ્ધ માનતો થકો અને અશુદ્ધ ભાવક્ષપે પરિણામતો થકો સદા અપરાધી જ છે; પરંતુ નિરપરાધી આત્મા તો સદા શુદ્ધાત્માનું સેવન કરનારો જ હોય છે.

નાટક સમયસારમાં અપરાધી અને નિરપરાધીને આ પ્રમાણે
પરિભાષિત કરવામાં આવ્યા છે -

(દોહા)

જાકે ઘટ સમતા નહીં, મમતા મગન સદીવ ।
રમતા રામ ન જાનઈ, સો અપરાધી જીવ ॥
અપરાધી મિથ્યામતી, નિરદૈ હિરદૈ અંધ ।
પર કોઈ માને આત્મા, કરૈ કરમ કો બંધ ॥
જિનકે મિથ્યામતિ નહીં, ગ્યાનકલા ઘટ માંહિ ।
પરચૈ આત્મરામ સોઈ તે અપરાધી નાંહિ ॥

જેના હદ્યમાં સમતાભાવ નથી, જે સદાય ભમતામાં ભગ્ન રહે છે
અને અંદરમાં રમણ કરનાર આત્મારામને જાણતો નથી; તે આત્મા અપરાધી
છે.

જેના હદ્યની આંખો (અંતરંગદાઢિ) ફૂટી ગઈ છે - એવો નિર્દ્દ્યી
મિથ્યાદાઢિ અપરાધી છે. પરને પોતાના માનનાર તે અપરાધી મિથ્યાદાઢિ
આત્મા કર્મોને બાંધે છે.

જેની ભિથ્યામતિ નષ્ટ થઈ ગઈ છે, જેના હદ્યમાં જ્ઞાનકળા જગૃત થઈ ગઈ અને જેનો આત્મારામ સાથે પરિચય થઈ ગયો છે, જે આત્માને ઓળખે છે; તે અપરાધી નથી.

ઉક્ત કળશનો ભાવ પૂજ્ય ગુરુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે -

“સાપરાધ અર્થાત્ શુદ્ધ એક નિત્યાનંદ - ચિદાનંદ પ્રભુ આત્માને છોડીને જે પુણ્ય-પાપના ભાવોને પોતાના માને છે અને તેનાથી પોતાનો લાભ માને છે - એવો આત્મા અનંત-અનંત પુદ્ગલ પરમાણુમય કર્મોથી બંધાય છે. જે વસ્તુ પોતાની નથી, તેને પોતાની માનવી ચોરી છે, અપરાધ છે. એવું કામ કરનાર નિયમથી બંધનમાં પડે છે.

નિરપરાધ અર્થાત્ જેણે રાગરહિત પોતાના જ્ઞાનાનંદ આત્માની દર્જી કરી છે, તેમાં જ જે રમે છે; તે નિરપરાધ છે, તેને ક્યારેય બંધન થતું નથી.

જુઓ, દ્યા-દાન-પૂજન-ભક્તિ આદિ શુભરાગનું સેવન પણ અશુભરાગની માફક જ અશુદ્ધનું સેવન છે. આ પ્રમાણે પોતાને અશુદ્ધ સેવતો થકો આત્મા સાપરાધી છે.^૧

તથા જે આત્મા પુણ્ય-પાપથી રહિત, શુદ્ધ, એક, ચૈતન્ય ઉપયોગમય, પૂર્ણજ્ઞાન, પૂર્ણઆનંદ આદિ અનંત શક્તિઓથી ભરેલો છે, સદ્ગુરૂ એકત્વ, ભૂતાર્થ, શુદ્ધ ચિદ્યન આત્માને સમીચીતતાથી જણીને તેની સેવા કરે છે; તે નિરપરાધી છે; તેને બંધ થતો નથી.^૨

આ પ્રમાણે આ કળશામાં માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે પરમાં એકત્વ-મમત્વ ધારણ કરનાર અપરાધી આત્મા નિરંતર બંધનને પ્રાપ્ત થાય છે અને શુદ્ધાત્મસેવી આત્મા અર્થાત્ પોતાના આત્મામાં જ એકત્વ-મમત્વ ધારણ કરીને તેમાં જ જલમનાર-રમણ કરનાર આત્મા કર્મબંધનને પ્રાપ્ત થતો નથી. તેથી શુદ્ધાત્માનું સેવન નિરંતર કરવું જોઈએ, કેમકે નિરપરાધી થવાનો આ જ એકમાત્ર ઉપાય છે.

૫

^૧ પ્રવચનરત્નાકર (હિન્દી), ભાગ ૮, પાનું ૪૧૦

^૨ પ્રવચનરત્નાકર (હિન્દી), ભાગ ૮, પાનું ૪૧૦

સમયસાર ગાથા ૩૦૬-૩૦૭

આ ૩૦૬ અને ૩૦૮મી ગાથાઓની ઉત્થાનિકા આત્મઘ્યાતિમાં વિસ્તારથી આપવામાં આવી છે; જે આ પ્રમાણે છે -

“અહીં શંકાકર શંકા કરે છે કે આપ શુદ્ધાત્માની ઉપાસનાથી નિરપરાધ થવાની વાત કરી રહ્યા છો; પણ પ્રક્રષ્ટ એ છે કે શુદ્ધ આત્માની ઉપાસનાનો પ્રયાસ કરવાની શું આવશ્યકતા છે; કારણ કે આત્મા નિરપરાધ તો પ્રતિક્ષમણ આદિથી જ થાય છે.

આ તો સર્વવિદિત જ છે કે અપરાધીના અપ્રતિક્ષમણ આદિ વિષકુંભ છે; કારણ કે તે અપરાધને દૂર કરનાર નથી અને તેથી પ્રતિક્ષમણાદિને અમૃતકુંભ કહેવામાં આવ્યા છે; કારણ કે તે અપરાધને દૂર કરનાર છે.

બ્યવહારનું કથન કરનાર આચાર સૂત્રમાં પણ કહ્યું છે -

અપ્પડિકમણમપડિસરણં અપ્પડિહારો અધારણા ચેવ ।

અળિયત્તી ય અળિંદાગરહાસોહી ય વિસકુમ્ભો ॥

પડિકમણં પડિસરણં પડિહારો ધારણા ણિયત્તી ય ।

ણિંદા ગરહા સોહી અઙ્ગવિહો અમયકુમ્ભો દુ ॥

અપ્રતિક્ષમણ, અપ્રતિસરણ, અપરિહાર, અધારણા, અનિવૃત્તિ અનિંદા, અગહ્ય અને અશુદ્ધિ - આ આઠ પ્રકારના વિષકુંભ છે. પ્રતિક્ષમણ, પ્રતિસરણ, પરિહાર, ધારણા, નિવૃત્તિ, નિંદા, ગહ્ય અને શુદ્ધિ - આ આઠ પ્રકારના અમૃતકુંભ છે.”

આ ગાથાઓની ઉત્થાનિકામાં આ જ પ્રકારનો ભાવ તાત્પર્યવૃત્તિ ટીકામાં આચાર્ય જ્યાસેને પણ વ્યક્ત કર્યો છે. એટલે સુધી કે આચારસૂત્રની જે ગાથાઓ આત્મઘ્યાતિમાં ઉદ્ઘૃત કરવામાં આવી છે, તે જ ગાથાઓ તાત્પર્યવૃત્તિમાં પણ ઉદ્ઘૃત કરવામાં આવી છે.

પ્રશ્ન તે વ્યવહારવાદિઓનો છે, જે એવું માનીને સંતુષ્ટ છે કે નિપરાધી બનવાનો ઉપાય તો પ્રતિક્રમણાદિ જ છે. તેમનું કહેવું એમ છે કે અપરાધનો પ્રાયશ્ક્રિત કરી લેતાં તે અપરાધના દોષથી મુક્ત થવાય છે અને તેથી પ્રતિક્રમણાદિ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં અપરાધના દોષથી મુક્ત થવા માટે શુદ્ધોપયોગની શું આવશ્યકતા છે?

ઉક્ત ઉત્થાનિકાનો ભાવ ખોલતાં પૂજ્ય ગુરુદેવ લખે છે કે -

“અહીં વ્યવહારનું અવલંબન લેનાર પ્રશ્ન કરે છે કે શુદ્ધ આત્માની ઉપાસનાનો પ્રયાસ કરવાનું શું કામ છે? શુદ્ધાત્માની ઉપાસનાનો શ્રમ શા માટે કરવો-જ્યારે પ્રતિક્રમણ આદિથી જ તો આત્મા નિરપરાધ થાય છે? સાપરાધનું જે અપ્રતિક્રમણ છે, તે અપરાધ દૂર કરનાર ન હોવાથી વિષકુંભ છે અને પ્રતિક્રમણાદિ અપરાધને દૂર કરનાર હોઈને અમૃતકુંભ છે.

શુભરાગ વહે અશુભભાવથી પાછા ફરવું, પાપથી ધૂટવું અમૃત છે - એમ શાસ્ત્રમાં કહ્યું છે. આ પ્રમાણે જ્યારે શુભભાવથી આત્મા નિરપરાધ થાય છે તો પછી શુદ્ધાત્માની આરાધનાથી શો લાભ? - એવી અજ્ઞાનીની દલીલ છે; પણ એ તેનો કુતર્ક છે.”

શિષ્યના આ જ અભિપ્રાયના સમાધાનમાં આચાર્યાદિવે નિશ્ચયની પ્રધાનતાથી આગાતી ગાથા કહી છે.”

શાસ્ત્રોમાં વ્યવહારપ્રતિક્રમણાદિની જે ચર્ચા છે; તેને જ આધાર બનાવીને શિષ્યે આ પ્રશ્ન કર્યો છે; જેનો ઉત્તર નિશ્ચયપ્રતિક્રમણાદિનું સ્વર્ગપ બતાવનાર નીચેની ગાથાઓમાં કરવામાં આવ્યો છે.

૧ પ્રવચનરત્નાકર (હિંદી), ભાગ C, પાનું ૪૧૨

૨ સમયસાર (ગુજરાતી), પાનું ૪૪૮

પડિકમણં પડિસરણં પરિહારો ધારણા ણિયત્તી ય ।
ણિંદા ગરહા સોહી અઢવિહો હોદિ વિસકુંભો ॥૩૦૬॥

અપ્પડિકમણમપ્પડિસરણં અપ્પરિહારો અધારણા ચેવ ।
અણિયત્તી ય અણિંદાગરહાસોહી અમયકુંભો ॥૩૦૭॥

પ્રતિકમણ ને પ્રતિસરણ, વળી પરિહારણ, નિવૃત્તિ ધારણા,
વળી શુદ્ધિ, નિંદા, ગર્હણા - એ અષ્ટવિધ વિષકુંભ છે. ૩૦૬.

આગપ્રતિકમણ, આગપ્રતિસરણ, આગપરિહારણ, આગધારણા,
અનિવૃત્તિ, આગર્હા, અનિંદા, અશુદ્ધિ - અમૃતકુંભ છે. ૩૦૭.¹

પ્રતિકમણ, પ્રતિસરણ, પરિહાર, ધારણા, નિવૃત્તિ, નિંદા, ગર્હ અને
શુદ્ધિ - આ આઠ પ્રકારના વિષકુંભ છે; કારણ કે તેમાં કર્તૃત્વબુદ્ધિ સંબંધિત
છે.

અપ્રતિકમણ, અપ્રતિસરણ, અપરિહાર, અધારણા, અનિવૃત્તિ,
અનિંદા, અગર્હ અને અશુદ્ધિ - આ આઠ પ્રકારના અમૃતકુંભ છે; કારણ
કે તેમાં કર્તૃત્વબુદ્ધિનો નિષેધ છે.

ધ્યાન રહે કે અહીં પ્રતિકમણ આદિને વિષકુંભ (ઝેરનો ઘડો) અને
અપ્રતિકમણ આદિને અમૃતકુંભ (અમૃતનો ઘડો) કહ્યો છે; જ્યારે ઉત્થાનિકામાં
ઉદ્ઘૃત ગાથાઓમાં પ્રતિકમણાદિને અમૃતકુંભ અને અપ્રતિકમણાદિને વિષકુંભ
કહેવામાં આવ્યા છે.

બંને કથન પરસ્પર તદ્દન વિર્દ્ધ પ્રતીત થાય છે. જેમને
આચારશાસ્ત્રોમાં અમૃતકુંભ કહ્યા છે તેમને જ અહીં વિષકુંભ કહેવામાં આવી
રહ્યા છે અને જેમને ત્યાં વિષકુંભ કહ્યા છે, તેમને જ અહીં અમૃતકુંભ
બતાવવામાં આવી રહ્યા છે.

ખરેખર વાત આમ છે કે આચારશાસ્ત્રોમાં સમાગત ઉક્ત કથન

વ્યવહાર કથન છે અને અહીં જે કથન કરવામાં આવી રહ્યું છે તે નિશ્ચય કથન છે.

આમ શા માટે છે ? આ શંકાનું સમાધન નિશ્ચય-વ્યવહારની સંવિને સમજ્યા વિના સંબંધ નથી.

આ ગાથાઓનો ભાવ આત્મભ્યાતિમાં આચાર્ય અમૃતચંદ્ર આ પ્રમાણે ખોલે છે -

“સૌથી પહેલી વાત તો એ છે કે અજાનીજનોમાં જેવામાં આવતા અપ્રતિકમણાદિ તો શુદ્ધાત્માની સિદ્ધિના અભાવદ્વાપ સ્વભાવવાળા હોઈને સ્વયમેવ જ અપરાધસ્વર્દ્ધપ છે; તેથી તે (અજાનીના અપ્રતિકમણાદિ) તો વિષ્ફુંબ જ છે; તેમનો વિચાર કરવાનું શું પ્રયોજન છે ? તાત્પર્ય આમ છે કે અહીં અજાનીના અપ્રતિકમણાદિને અમૃતકુંબ કહેવામાં આવતા નથી; કારણ કે તે તો સ્પષ્ટર્દ્વાપથી વિષ્ફુંબ જ છે, હેય જ છે, ત્યાગવા યોગ્ય જ છે, બંધના જ કારણ છે.

જે દ્રવ્યર્દ્વપ પ્રતિકમણાદિ છે, તે સંપૂર્ણ અપરાધર્દ્વપી વિષના દોષને ક્રમશ: ઓછા કરવામાં સમર્થ હોવાથી વ્યવહાર - આચાર સૂત્રના કથનાનુસાર અમૃતકુંબર્દ્વપ હોવા છતાં પણ પ્રતિકમણ અને અપ્રતિકમણ - આ બંનેમાં વિલક્ષણ એવી અપ્રતિકમણાદિર્દ્વપ ત્રીજી ભૂમિકાને નહીં જેનાર પુરુષોને તે દ્રવ્યપ્રતિકમણાદિ પોતાનું કાર્ય કરવામાં અસમર્થ હોઈને તેમ જ વિપક્ષ (બંધ)નું કાર્ય કરનાર હોઈને વિષ્ફુંબ જ છે.

અપ્રતિકમણાદિર્દ્વપ ત્રીજી ભૂમિકા સ્વયં શુદ્ધાત્માની સિદ્ધિર્દ્વપ હોવાના કારણે સમસ્ત અપરાધર્દ્વપી વિષના દોષોને સર્વથા નાચ કરનારી હોવાથી સ્વયં સાક્ષાત અમૃતકુંબ છે.

આ પ્રમાણે આ ત્રીજી ભૂમિ વ્યવહારથી દ્રવ્યપ્રતિકમણાદિને પણ અમૃતકુંબત્વ સાધે છે. એ ત્રીજી ભૂમિથી જ આત્મા નિરપરાધ થાય છે.

તે ત્રીજી ભૂમિના અભાવમાં દ્રવ્યપ્રતિક્ષમણાદિ પણ અપરાધ જ છે; તેથી આમ સિદ્ધ થાય છે કે ત્રીજી ભૂમિથી જ નિરપરાધત્વ છે. તેની પ્રાપ્તિ માટે જ દ્રવ્યપ્રતિક્ષમણાદિ છે.

ઉક્ત વસ્તુસ્થિતિના સંદર્ભમાં એવું નહીં માનવું જોઈએ કે આ શાસ્ત્ર (સમયસાર) દ્રવ્યપ્રતિક્ષમણાદિને છોડવે છે.

જે એમ નથી તો પછી આ શાસ્ત્ર શું કહે છે ? આ શાસ્ત્રનું કહેવું તો આમ છે કે અહીં દ્રવ્યપ્રતિક્ષમણાદિને છોડવાની વાત કહેવામાં આવી રહી નથી; પરંતુ એમ કહેવાઈ રહ્યું છે કે આ દ્રવ્યપ્રતિક્ષમણાદિથી અતિરિક્ત પણ આ પ્રતિક્ષમણાદિ અને અપ્રતિક્ષમણાદિથી અગોચર અન્ય અપ્રતિક્ષમણાદિ છે; જે શુદ્ધાત્માની સિદ્ધિઃપ અતિદુષ્કર કંઈક કરાવે છે. આ જ ગ્રંથમાં આગળ કહેશે -

કર્મ જ પુણ્યકયં સુહાસુહમણેયવિત્થરવિસેસં ।

તત્તો ણિયત્તદે અપ્યયં તુ જો સો પદિક્કમણં ॥૩૮૩॥

અનેક પ્રકારના વિસ્તારવાળા પૂર્વકૃત શુભાશુભ કર્મોથી જે પોતાના આત્માને નિવૃત્ત કરાવે છે; તે આત્મા સ્વયં પ્રતિક્ષમણ છે.”

આચાર્ય જ્યયસેને તાત્પર્યવૃત્તિમાં આ ગાથાઓનો અર્થ કરતી વખતે પર્યાપ્ત પ્રકાર પાથર્યો છે. એક તો તેમણે પ્રતિક્ષમણ, પ્રતિસરણ આદિ આઠે પ્રકારની વ્યાખ્યા કરી છે કે જે અત્યંત આવશ્યક હતું; કારણ કે આ આઠેના સ્વરૂપના સંબંધમાં જ જે પૂરતી જણકારી ન હોય તો તેમના સંબંધમાં કરેલી ટિપ્પણીઓનું ભાવભાસન પણ નહીં થાય. બીજું કિંચ વિશેષ: કહીને જ્ઞાની અને અજ્ઞાનીના પ્રતિક્ષમણો વિસ્તારથી સમજાવ્યા છે. તેમના પ્રતિપાદનનો ભાવ આ પ્રમાણે છે.

- “(૧) કરેલા દોષોનું નિરાકરણ કરવું પ્રતિક્રમાગું છે.
- (૨) સમ્યક્ત્વાદિ ગુણોની પ્રેરણા કરવી અથવા તેમાં પ્રવૃત્તિ કરવી તે પ્રતિસરાગ છે.
- (૩) ભિથ્યાત્વ અને રાગાદિ દોષોનું નિવારણ કરવું પ્રતિહરાગ છે.
- (૪) પંચનમસ્કાર આદિ મંત્રો અને પ્રતિમા (જિનબિંબ) આદિ બાહ્યદ્રવ્યોના અવલંબનથી ચિત્તને સ્થિર કરવું તે ધારાગું છે.
- (૫) બાહ્ય વિષય-કખાયાદિમાં ઈહાગત (ઈચ્છાયુક્ત) ચિત્તનું નિવર્ત્તન (નિવારણ) કરવું નિવૃત્તિ છે.
- (૬) પોતાની જ સાક્ષીથી દોષોને પ્રગટ કરવા તે નિંદા છે.
- (૭) ગુરુની સાક્ષીએ દોષોને પ્રગટ કરવા તે ગર્હા છે.
- (૮) કોઈ પણ પ્રકારનો દોષ થઈ જતાં પ્રાયશ્વિત લઈને તેનું શોધન કરવું તે શુદ્ધિ છે.

ઉક્ત આડ પ્રકારનો શુભોપયોગ જે કે ભિથ્યાત્વાદિ વિષય-કખાય પરિણતિક્રિય અશુભોપયોગની અપેક્ષા સવિકલ્પ સરાગચારિત્રની અવસ્થામાં અમૃતકુંભ છે; તો પણ રાગ-દ્રેષ્ટ-મોહ, ઘ્યાતિ-લાભ-પૂળ, દ્રષ્ટ-શ્રુત-અનુભૂત બોગોની આકંક્ષાક્રિય નિદાનબંધ આદિ સર્વે પરદ્રવ્યોના આલંબનવાળા વિભાવપરિણામોથી શૂન્ય (રહિત), ચિદાનંદ સ્વભાવથી વિશુદ્ધ આત્માના આલંબનથી ભરિત (ભરેલી) અવસ્થાવાળી, નિર્વિકલ્પ શુદ્ધોપયોગ લક્ષણવાળી તથા અપરિક્રમણ ઈત્યાદિ ગાથામાં કથિત ક્રમાનુસાર જ્ઞાનીજનોએ આશ્રય લીધેલ નિશ્ચય-અપ્રતિક્રમણાદિક્રિય જે તૃતીયભૂમિ છે, તેની અપેક્ષા વીતરાગચારિત્રમાં સ્થિતજ્ઞનો માટે તો ઉક્ત પ્રતિક્રમણાદિ આડ પ્રકારનો શુભોપયોગ વિષકુંભ જ છે - આ અર્થ છે.

કંઈક વિશેષ છે, જે આ પ્રમાણે છે - અપ્રતિક્રમણ બે પ્રકારનું છે - જ્ઞાનીઓને આશ્રિત અપ્રતિક્રમણ અને અજ્ઞાનીઓને આશ્રિત અપ્રતિક્રમણ.

તેમાં અજાનિજનાશ્રિત અપ્રતિક્રમણ તો વિષય-કખાયની પરિણતિઝ્રૂપ જ હોય છે; પરંતુ જાનિજનાશ્રિત અપ્રતિક્રમણ શુદ્ધાત્માના સમ્યક શ્રદ્ધાન, જ્ઞાન અને અનુઝ્ઞાન (આચરણ) સ્વરૂપ નિગુપ્તિમય (સ્વાનુભૂતિમય) હોય છે.

તે જાનિજનાશ્રિત અપ્રતિક્રમણ સરાગચારિત્ર લક્ષણવાળા શુભોપ્યોગની અપેક્ષા જે કે અપ્રતિક્રમણ કહેવામાં આવે છે; તો પણ વીતરાગચારિત્રની અપેક્ષા તે અપ્રતિક્રમણ ખરેખર નિશ્ચયપ્રતિક્રમણ જ છે.

જે કોઈ કહે કે તે અપ્રતિક્રમણ નિશ્ચયપ્રતિક્રમણ કઈ રીતે છે ?

તો તેમને કહે છે કે સમસ્ત શુભાશુભ આશ્રવરૂપ દોષોના નિરાકરણરૂપ હોવાથી તે અપ્રતિક્રમણ નિશ્ચયપ્રતિક્રમણ જ છે. તેથી એ નિશ્ચિત થઈ ગયું કે તે સ્વાનુભવરૂપ અપ્રતિક્રમણ જ નિશ્ચયપ્રતિક્રમણ છે.

જે કે વ્યવહાર પ્રતિક્રમણની અપેક્ષાએ તેને અપ્રતિક્રમણ જ કહેવાયું; છતાં પણ જાનીજનોના મોકષનું કારણ બને છે.

શુદ્ધાત્માને ઉપાદેય માનીને નિશ્ચયપ્રતિક્રમણના સાધકભાવના રૂપમાં વિષય-કખાયથી બચવા માટે જે વ્યવહાર પ્રતિક્રમણ કરવામાં આવે છે તો તે વ્યવહાર પ્રતિક્રમણ પરંપરા મોકષનું કારણ કહેવાય છે; અન્યથા માત્ર સ્વર્ગાર્દિકસુખના નિમિત્તભૂત પુરુષનું જ કારણ છે.

અને જે અજાનીઓથી સંબંધિત અપ્રતિક્રમણ છે, તે તો ભિથ્યાત્મ અને વિષય-કખાયની પરિણતિઝ્રૂપ હોવાથી નરકાદિ દુઃખનું જ કારણ છે.

આ પ્રમાણે પ્રતિક્રમણાદિ આઠ વિકલ્પોરૂપ શુભોપ્યોગ જે કે સવિકલ્પ અવસ્થામાં અમૃતકુંભ હોય છે; છતાં પણ સુખ-દુઃખાદિમાં સમતાભાવ રાખવારૂપ - પરમોપેક્ષારૂપ સંયમની અપેક્ષા વિષકુંભ જ છે.”

આ ગાથાઓ અને દીકાનો ભાવ પૂજ્ય ગુરુદેવ આ પ્રમાણે રજુ કરે છે -

“અજ્ઞાની જીવોને જે મિથ્યાત્ત્વ અને રાગ-દ્રેષ્ટ આદિ અપ્રતિક્રમણના ભાવ છે, તે શુદ્ધ આત્માની સિદ્ધિના અભાવસ્વભાવકૃપ છે અને તે પોતે જ અપરાધસ્વકૃપ છે તેથી તે ભાવ વિષકુંભ જ છે. તે ભાવોનો વિચાર કરવાનું પ્રયોજન જ શું છે ? અર્થાત્ તે ભાવ તો પહેલેથી જ ત્યાગવા યોગ્ય છે.”^૧

જેણે અંતરમાં પોતાનો આત્મા અતીન્દ્રિય જ્ઞાન અને આનંદસ્વકૃપ અનુભવ્યો છે - તેવા ધર્મી પુરુષને સવાર-સાંજ દ્વિષ્પ્રતિક્રમણાદિકૃપ શુભભાવ આવે છે. તે અપરાધકૃપી ઝેણા દોષને ઘટાડવામાં સમર્થ છે. તે કારણે કહું છે કે ધર્મિના પ્રતિક્રમણાદિ શુભભાવ વ્યવહારથી અમૃતકુંભ છે.

જુઓ ! ધર્મિને આ દ્વિષ્પ્રતિક્રમણાદિના શુભભાવ રાગાદિ દોષોને ઘટાડવામાં તો સમર્થ છે, પણ અભાવ કરવામાં નહીં. રાગાદિનો અભાવ તો એક શુદ્ધ જ્ઞાનાનંદસ્વકૃપ આત્માનો આશ્રય લેતાં થાય છે, પણ જેમને અંતરમાં શુદ્ધ એક જ્ઞાતા-દાયારસ્વભાવી અમૃતસ્વભાવ આત્માનું ભાન થયું છે, તેમને જે નિંદા, ગર્હા આદિ શુભરાગકૃપ વ્યવહાર પ્રતિક્રમણનો ભાવ આવે છે, તેનાથી અશુભભાવ ઘટે છે - તે અપેક્ષાએ શુભરાગને વ્યવહારથી શાસ્ત્રોમાં અમૃતકુંભ કહ્યો છે. જેમને આત્મજ્ઞાન થયું નથી, તેમનો શુભભાવ તો માત્ર વિષકુંભ જ છે.^૨

મિથ્યાદિને અશુભ અને શુભભાવોકૃપ અપ્રતિક્રમણ અને પ્રતિક્રમણની સિવાય એક ત્રીજી શુદ્ધ ભાવકૃપ અપ્રતિક્રમણની ખબર હોતી નથી. ‘શુભાશુભ રહિત ત્રીજી ભૂમિકા કઈ છે ? તેનો બોધ મિથ્યાદિ જીવોને હોતો નથી.’^૩

૧ પ્રવચનરત્નાકર (હિંદી), ભાગ ૮, પાનું ૪૨૦

૨ પ્રવચનરત્નાકર (હિંદી), ભાગ ૮, પાનું ૪૨૦-૪૨૧

૩ પ્રવચનરત્નાકર (હિંદી), ભાગ ૮, પાનું ૪૨૧

કરેલા દોષોનું નિરાકરણ કરવું, સમકિત આદિ ગુણોની પ્રેરણા કરવી, મિથ્યાત્વાદિનું નિવારણ કરવું, પંચનમસ્કાર આહિનો ભાવ અર્થાત્ પ્રતિમા આદિનું આલંબન, બાહ્યવિષયોમાંથી ચિત્તને હટાવવું, આત્મસાક્ષીપણે દોષોને પ્રગટ કરવા, ગુરુની સાક્ષીથી દોષોને પ્રગટ કરવા, દોષ ઉત્પન્ન થતાં પ્રાયશ્ક્રિત લઈને વિશુદ્ધિ કરવી - એ આઠ પ્રકારના શુભભાવ છે. મિથ્યાદાચિને આ આઠ શુભભાવ વિષકુંભ છે; કારણ કે મિથ્યાદાચિના આ ભાવોમાં દોષ નાશ કરવાનું બિલ્કુલ પણ સામર્થ્ય નથી.

જે જીવ ત્રીજી ભૂમિકાના અપ્રતિક્રમણ સહિત છે, તેમને જે શુભભાવ આવે છે, તે દોષ ઘટાડવામાં સમર્થ હોય છે.

જ્યારે પરમાનંદમય ભગવાન આત્માની દાચિ થઈ જય છે, ત્યારે તેને શુદ્ધાત્માની સિદ્ધિ થતાં ત્રીજી ભૂમિકા પ્રગટ થાય છે. આ ત્રીજી ભૂમિકા સર્વ દોષોનો નાશ કરવામાં સમર્થ હોય છે. તેથી તે અમૃતકુંભ છે. તેની સાથેના વ્યવહારપ્રતિક્રમણને પણ અમૃતકુંભ કહેવામાં આવ્યો છે.

આવી ત્રીજી ભૂમિકાવાળા ધર્મી પુરુષને જે દ્રવ્યપ્રતિક્રમણાદિ હોય છે, તેમને વ્યવહારથી અમૃતકુંભપણું પ્રાપ્ત થાય છે. ખરેખર તો ત્રીજી ભૂમિકાવાળાને દ્રવ્યપ્રતિક્રમણ પણ અમૃતકુંભ નથી; પરંતુ સાક્ષાત્ અમૃતકુંભનો સહચારી છે. આ કારણે તેને અમૃતકુંભ ઉપચારથી કહેવાય છે.^૧

આ શાસ્ત્રમાં શુભને છોડીને અશુભમાં જવાની તો વાત જ નથી. શાસ્ત્રના કથનનો અભિપ્રાય દ્રવ્યપ્રતિક્રમણ આદિ છોડાવવાનો નથી; પરંતુ તેમાં જ જે અનાદિથી અટકેલા છે, માત્ર તે અટક છોડાવવાનો ઉદ્દેશ છે. પ્રતિક્રમણ, સામાયિક, ભક્તિ, વ્રત, તપ, પૂજન આદિના શુભરાગમાં જેઓ અટકેલા છે અને તેમાં જ ધર્મ માનીને બેઠા છે; તેમને સાચું માર્ગદર્શન આપીને નિશ્ચયપૂર્વક વ્યવહાર કરાવવાનો ઉદ્દેશ છે.

^૧ પ્રવચનરત્નાકર (હિંદી), ભાગ C, પાનું ૪૨૨

પુણ્યભાવને છોડીને પાપમાં પ્રવર્તનની વાત કોઈ પણ શાસ્ત્ર કેમ કહી શકે? શાસ્ત્રમાં તો સદાચ પાપની માફક પુણ્યને પણ છોડીને પરમપવિત્ર શુદ્ધાત્માના અનુભવની વાત જ કહેવામાં આવે છે; કારણ કે આત્માનો અનુભવ જ નિરપરાધપણું છે.

અહીં દ્રવ્યપ્રતિકમણ છોડાવતા નથી; પરંતુ જેઓ શુભરાગમાં સંતુષ્ટ થઈને રહી જય છે, તેમને ત્યાંથી છોડાવીને અંદર ધ્રુવધામમાં - ચૈતન્યધામમાં લઈ જય છે.”^૧

આ ગાથાઓનું તાત્પર્ય એક પંક્તિમાં ક્ષુલ્લક મનોહરલાલજ વણી આ પ્રમાણે વ્યકૃત કરે છે -

“વિકલ્પરત રહેવું વિષ્ણુંભ છે અને સ્વભાવરત રહેવું અમૃતકુંભ છે.”^૨

જે કે આચાર્ય કુંદુંદેવની મૂળ ગાથાઓ, આચાર્ય અમૃતચંદ્રદેવની આત્મઘ્�યાતિ ટીકા, આચાર્ય જ્યસેનની તાત્પર્યવૃત્તિ ટીકા અને અધ્યાત્મિકસત્પુરુષ પૂજય શ્રી કાનલ્સવામીનું સ્પષ્ટીકરણ વાંચી લીધા બાદ સમજદાર માટે કંઈ પણ અજાણ રહેતું નથી; છતાં પણ સામાન્ય બુદ્ધિવાળા આત્માથી બંધુઓના લક્ષ્યથી ઉક્ત ચિંતકોના જ અભિપ્રાયને સરલ-સુભોધ ભાષામાં સ્પષ્ટ કરે છે.

પ્રતિકમણ શબ્દનો અર્થ થાય છે પાછા ફરવું. આત્મસ્વભાવની તરફ પાછા ફરવું તે જ વાસ્તવિક પ્રતિકમણ છે. કષાયપાહુડમાં પ્રતિકમણ અને પ્રત્યાખ્યાનનો અંતર સ્પષ્ટ કરતાં લઘ્યું છે -

“પચ્ચક્ખાણપડિકકમણાં કો ભેઓ । ઉચ્ચદે, સર્ગગટિઠયદોસાણ દવ્વ-ખેત-કાલ-ભાવવિસયાણ પરિચ્ચાઓ પચ્ચક્ખાણ ણામ । પચ્ચક્ખાણાદો અપચ્ચક્ખાણ ગંતૂણ પુણોપચ્ચક્ખાણસસાગમણ પડિકકમણાં ।”^૩

૧ પ્રવચનરસ્તનાકર (હિંદી), ભાગ ૮, પાનું ૪૨૩

૨ સમયસાર: સપ્તદશાંગી ટીકા, પાનું ૫૨૧

૩ કષાયપાહુડ પુસ્તક ૧, પ્રકરણ ૧, પાનું ૧૧૫

પ્રશ્ન:- પ્રત્યાખ્યાન અને પ્રતિક્રમણમાં શો ફરક છે ?

ઉત્તર:- દ્વય, ક્ષેત્ર, કાળ અને ભાવના નિમિત્તથી લાગેલા દોષોનો પરિત્યાગ કરવો તે પ્રત્યાખ્યાન છે અને પ્રત્યાખ્યાનમાંથી અપ્રત્યાખ્યાન થતાં ફરીથી પ્રત્યાખ્યાન કરવું તે પ્રતિક્રમણ છે.”

પ્રતિક્રમણની ઉક્ત વ્યાખ્યાથી પણ એ જ સ્પષ્ટ થાય છે કે પહેલી વાર પરનો ત્યાગ કરીને આત્મામાં આવી ગયા - આ નિશ્ચય પ્રત્યાખ્યાન થયું; પછી કમનેરીને કારણે આત્માથી ચ્યુત થઈને પરમાં જતાં ફરીથી પુરુષાર્થપૂર્વક શુદ્ધોપ્યોગ પ્રાપ્ત કરવો અર્થાત् આત્મામાં ફરી આવી જવું તે નિશ્ચયપ્રતિક્રમણ છે. આ પ્રમાણે નિશ્ચયપ્રત્યાખ્યાન પણ શુદ્ધોપ્યોગકૃપ જ છે અને નિશ્ચયપ્રતિક્રમણ પણ શુદ્ધોપ્યોગકૃપ જ છે.

વ્યવહારપ્રતિક્રમણમાં લાગેલા દોષોનો ગુરુની સમક્ષ અથવા પોતાની જ સાક્ષીથી પ્રાયશ્વિત કરવામાં આવે છે.

આહીં એમ કહેવાઈ રહ્યું છે કે ભૂલ કરીને પણ પ્રાયશ્વિત ન કરવું વ્યવહાર-અપ્રતિક્રમણ છે અને તે વિષકુંભ છે તથા ભૂલ થયા બાદ પ્રાયશ્વિત કરીને તેને સુધારી લેવી વ્યવહારપ્રતિક્રમણ છે અને તે અમૃતકુંભ છે. આચારશાસ્ત્રોનું આ કથન વ્યવહારનયનું કથન છે, જે ઉચિત જ છે.

આમ કહીને પણ અહીં આ વાત તરફ વિશેષ ધ્યાન આકર્ષિત કરવામાં આવી રહ્યું છે કે ભૂલ કરીને પ્રાયશ્વિત કરવું કે ન કરવું - આ બંનેથી પર એક એવી પણ સ્થિતિ છે કે જે બંનેથી જુદી છે; તે ત્રીજી સ્થિતિ છે, ભૂલ કરવી જ નહીં, અપરાધ કરવો જ નહીં.

શુદ્ધોપ્યોગ એક એવી સ્થિતિ છે કે જ્યાં શુભાશુભભાવકૃપ અપરાધ થતો જ નથી. જ્યારે અપરાધ થતો જ નથી તો પછી પ્રાયશ્વિતની પણ કોઈ આવશ્યકતા રહેતી નથી. તેથી તેને અપ્રતિક્રમણ કહે છે; પણ આ અપ્રતિક્રમણ તે સ્થિતિ નથી કે જ્યાં અપરાધ થવા છતાં પણ પ્રાયશ્વિત લેવામાં આવતું નથી; કારણ કે તે તો પાપકૃપ જ છે અને આ અપ્રતિક્રમણ તો પુણ્ય-પાપથી

પાર પરમધર્મઙું છે. તેથી આ અપ્રતિકમણ જ ખરેખર નિશ્ચયપ્રતિકમણ છે અને મુક્તિનું વાસ્તવિક કારણ હોવાથી ધર્મમય જ છે.

આ ભોળા જગતને આ ત્રીજા નિશ્ચયપ્રતિકમણની ખર્બર જ નથી.

અરે ભાઈ ! અહીં તો એમ કહેવામાં આવી રહ્યું છે કે ભૂલ કરવી, પ્રાયશ્વિત કરવો; ફરીથી ભૂલ કરવી અને ફરી પ્રાયશ્વિત કરવો - આવા ગજસ્નાનથી શો લાભ છે ? ભૂલ કરીને પણ પ્રાયશ્વિત ન કરવો એ તો મહાપાપ છે. એવું અપ્રતિકમણ તો સર્વથા હેય જ છે; પરંતુ વારંવાર ભૂલ કરીને વારંવાર પ્રાયશ્વિત કરવાથી કંઈ લાભ નથી. અહીં તો એમ કહેવામાં આવી રહ્યું છે કે આવી ભૂલ કરવી જ નહીં કે પ્રાયશ્વિત કરવો પડે - તે જ સૌથી શ્રેષ્ઠ વાત છે, જેને અહીં અપ્રતિકમણ અથવા નિશ્ચયપ્રતિકમણ કહેવામાં આવી રહ્યું છે. શુદ્ધોપયોગકૃપદશા જ એવી દશા છે કે જેમાં પુણ્યપાપકૃપનો અભાવ હોવાથી કોઈ ભૂલ થતી જ નથી - તે જ પરમ ઉપાદેય છે.

આવા પરમ ઉપાદેય નિશ્ચયપ્રતિકમણ અથવા અપ્રતિકમણને જાણનારા જ્ઞાની ધર્મત્તમા પણ કદાચ ચ્યુત થઈ જય, શુભાશુભભાવમાં આવી જય તો પ્રયાસ કરીને આત્મામાં પાછા કરવું તે જ પ્રતિકમણ છે. આવા નિશ્ચયપ્રતિકમણવાળા માટે પ્રાયશ્વિત કરવાઙું બાધ્યપ્રતિકમણ જ વ્યવહારપ્રતિકમણ છે.

આ પ્રમાણે આ સુનિશ્ચિત જ છે કે જ્ઞાનીઓને જ શુદ્ધોપયોગકૃપ નિશ્ચયપ્રતિકમણ અને શુભોપયોગકૃપ વ્યવહારપ્રતિકમણ હોય છે.

જ્ઞાનીઓને ન તો સાચું વ્યવહારપ્રતિકમણ હોય છે અને ન તો શુદ્ધોપયોગકૃપ નિશ્ચયપ્રતિકમણ.

જે અપ્રતિકમણને અહીં અમૃતકુંભ કહ્યો છે, તે શુદ્ધોપયોગકૃપ નિશ્ચયપ્રતિકમણ જ છે અને જે પ્રતિકમણને વિષકુંભ કહ્યો છે, તે શુભભાવકૃપ છે. શુભભાવકૃપ પ્રતિકમણને વિષકુંભ કહેવાનું કારણ એ છે

કે તે આત્માની પ્રાપ્તિ કરાવવામાં સમર્થ નથી, પુણ્યબંધનું કારણ છે, બંધના અભાવનું કારણ નથી.

એક બીજુ વાત પણ ધ્યાન રાખવા યોગ્ય છે કે પ્રતિક્રમણ કરવાનું જે શુભભાવને આચારશાસ્ત્રોમાં અમૃતરૂભ કહ્યો છે, તે પ્રતિક્રમણનું શુભભાવ તે શાનીઓનો જ છે કે, જેઓ શુદ્ધોપયોગનું નિશ્ચયપ્રતિક્રમણને પ્રાપ્ત થઈ ચૂક્યા છે.

હવે આ જ ભાવનો પોષક કળશક્તિ લખે છે, જે આ પ્રમાણે છે -

અતો હતા: પ્રમાદિનો ગતા: સુખાસીનતાં
પ્રલીનં ચાપલમુન્મુલિતમાલંબનમ् ।
આત્મન્યેવાલાનિતં ચ ચિત્તમા
સંપૂર્ણ વિજ્ઞાનઘનોપલબ્ધે: ॥૧૮૮॥

(હસ્તિગીત)

પરમાદી જીવને 'હત' કર્યાં છે આમ જિનવરકથનમાં,
ચાપલનો કરીને પ્રલય, ઉન્મુલિત આલંબન કર્યા;
વિજ્ઞાનઘન આત્માતાણી પ્રાપ્તિ ન થાયે જ્યાં લગી,
આત્માંપી સંભે જ બાંધ્યું ચિત્તને છે ત્યાં લગી. ૧૮૮

આ કથનથી સુખાસીન (સુખથી બેઠેલા) પ્રમાદી જીવોને મોક્ષની પ્રાપ્તિ થતી નથી - આમ કહેવામાં આવ્યું છે અને ચપળતાનો પણ નિષેધ કરવામાં આવ્યો છે. તાત્પર્ય આમ છે કે નિશ્ચળ પ્રમાદીઓ અને ચંચળ કિયાકાંડીઓ - બનેને જ મુક્તિની પ્રાપ્તિ થતી નથી. અહીં એ સ્પષ્ટ કરી દીધ્યું છે; બધા આલંબનોને ઉન્મુલિત કરી દીધા છે, ઉખાડીને ફેંકી દીધા છે.

તાત્પર્ય એ છે કે દ્રવ્યપ્રતિક્રમણાદિને નિશ્ચયથી બંધનું કારણ બતાવીને તેનો નિષેધ કરી દીધો છે.

આચાર્યદેવ કહે છે કે જ્યાં સુધી સંપૂર્ણ વિજ્ઞાનઘન આત્માની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી અમે ચિત્તને આત્માઙ્ગી સ્તંભથી જ બાંધી રાખ્યું છે.

આ પ્રમાણે આ કળશમાં એમ જ કહેવામાં આવ્યું છે કે વ્યવહારના વિકલ્પોમાં ઉલાં નહીં; જ્યાં સુધી આત્માની પ્રાપ્તિ ન થઈ જય ત્યાં સુધી પોતાના ચિત્તને કિયાકંડમાં ન ઉલાંવો, પ્રમાદી પણ ન બનો; સંપૂર્ણ સામર્થ્યથી આત્માની જ સંમુખ રહો.

ઉક્ત કળશનો ભાવ પૂજ્ય ગુરુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે -

“અહીં નિશ્ચયનયથી પ્રતિકમણાદિને વિષકુંભ કહ્યો અને અપ્રતિકમણાદિને અમૃતકુંભ કહ્યો; તેથી જે કોઈ વિપરીત સમજુને પ્રતિકમણાદિને છોડીને પ્રમાદી થઈ જય તો તેને સમજવવા માટે આ કળશ કહ્યો છે.

આત્મજ્ઞાન શૂન્ય દાન-પુણ્ય, ભક્તિ, પૂજા, પંચપરમેષ્ઠીનું સમરણ આદિ શુભરાગની કિયાઓ ચાપલ્ય છે, ચપળતા છે - એમ આચાર્ય અમૃતચંદ્ર કહે છે. અહા ! પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો અનુભવ કર્યા વગર જે માત્ર પુણ્યની કિયાઓ કરવામાં પડ્યો છે, તે બધું ચાપલ્ય છે. તેમની એ બધી કિયાઓ મોક્ષમાર્ગ માનવામાં આવી નથી. તે બધી કિયાઓ બંધમાર્ગની જ કિયાઓ છે.

સ્વરૂપ્યના આલંબન સિવાય જે પણ પરદ્રવ્યનું આલંબન છે, જાનીએ એ બધાને ઉપેકી ફેંકી હીથું છે. સમ્યગુદ્ધિનાં જે દ્રવ્ય પ્રતિકમણાદિ છે, તે બધાને નિશ્ચયથી બંધનું કરાણ જાણીને હેય માન્યા છે. પરદ્રવ્ય, ચાહે તે પરમેષ્ઠી હો કે શાસ્ત્ર, તેમનું આલંબન લેવાને અહીં પ્રમાદ કહ્યો છે અને પ્રમાદ હેય છે. એક વીતરાગભાવ સિવાય પાપની નિંદા, ચિત્તને પાપથી હટાવવું આદિ બધી રાગની કિયાઓ પ્રમાદ છે અને તેમાં પરદ્રવ્યનું આલંબન છે.^૧

^૧ પ્રવચનરત્નાકર (હિન્દી), ભાગ ૮, પાનું ૪૨૭

ખરેખર વાત આમ છે કે વીતરાગ પરમાત્માના આલંબનથી પણ રાગ જ થાય છે. પંચાસ્તિકાયમાં આવે છે કે અરિહંતની પ્રત્યે થયેલો રાગ પણ મોક્ષનું કારણ નથી.

પંચાસ્તિકાય ગાથા ૧૬૮માં કહ્યું છે કે થોડો રાગ પણ દોષપરંપરાનું કારણ છે. અરિહંતાદિની ભક્તિ રાગપરિણામ વગર થતી નથી અને રાગપરિણામ થતાં આત્મા બુદ્ધિનો પ્રસાર કર્યા વિના રહી શકતો નથી. બુદ્ધિપ્રસાર અર્થાત् ચિત્તની ચંચળતા, મન શુભાશુભભાવોમાં જોડાવું, પરદ્રવ્યનું આલંબન થતાં જ વિચારતરંગો ઉડવા માંડે છે. આ પ્રમાણે પરદ્રવ્યનું આલંબન જેમનું મૂળ છે - એવો અલપરાગ પણ દોષની સંતતિનું મૂળ છે. ભાઈ ! વીતરાગતાનો માર્ગ તો વીતરાગતાથી જ પ્રગટ થાય છે.

ચૈતન્યસ્વરૂપી આત્મા એક વીતરાગ સ્વભાવથી ભરેલું તત્ત્વ છે. તેના આલંબન વગર જેટલું પરદ્રવ્યનું આલંબન થશે, તેટલો રાગ જ ઉત્પન્ન થશે અને આ પરંપરા પણ દોષની પરંપરાનું મૂળ છે. જ્ઞાનીને આવા ભાવ અવશ્ય આવે છે; પરંતુ તેમને તે બંધના કારણ જ જાણે છે.^૧

કળશાલીકામાં કહ્યું છે કે બુદ્ધિપૂર્વક જ્ઞાન કરતાં જેટલું વાંચવું, વિચારવું, ચિંતન કરવું, સમરણ કરવું વગેરે થાય છે; તે મોક્ષનું કારણ નથી - એમ જાણીને શુભભાવને હેઠ કહ્યો છે.^૨

જ્યાં સુધી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી; ત્યાં સુધી મેં પોતાના ચિત્તને નિકાળી ધૂવની સાથે જ જોડી દીધું છે પોતાના જ્ઞાનોપયોગને મહાવતાદિમાં જોડવાની વાત ન કહીને આચાર્ય નિકાળી ધૂવ સાથે જ આત્માને જોડવાનું કહી રહ્યા છે; કારણ કે તે જ એકમાત્ર મોક્ષનું કારણ છે.^૩

૧ પ્રવચનરત્નાકર (હિન્દી), ભાગ ૮, પાનું ૪૨૮

૨ પ્રવચનરત્નાકર (હિન્દી), ભાગ ૮, પાનું ૪૨૯

૩ પ્રવચનરત્નાકર (હિન્દી), ભાગ ૮, પાનું ૪૩૦

ઉક્ત સંપૂર્ણ કથનનો આશય એ છે કે આત્માથીને ન તો સમસ્ત ક્ષિયકાંડ છોડીને પ્રમાદી બની જવું જોઈએ અને ન તો ક્ષિયકાંડમાં જ લાગી જવું જોઈએ. જે અપરાધ થયો છે તો પ્રતિક્રમણાદિ કિયા અને તત્ત્વસંબંધી શુભભાવને અમૃતકુંભ જાળીને તે અપરાધનું પરિમાર્જન કરવું જોઈએ; પરંતુ શુભક્રિયાઓ અને શુભવિકલ્પોમાં જ લાગ્યા રહીને આ બહુ મોંધેરા માનવજીવનને આમ જ ગુમાવી દેવો ન જોઈએ.

ભૂમિકાનુસાર યથાયોગ્ય પ્રતિક્રમણાદિ તો થશે જ, તો પણ તેમાં ઉપાદેય બુદ્ધિ ન થવી જોઈએ. કારણ કે ઉપાદેય તો એકમાત્ર આ શુદ્ધોપયોગકૃપ અપ્રતિક્રમણ જ છે, જેને નિશ્ચયપ્રતિક્રમણ પણ કહે છે.

વિગત ગાથાઓમાં પ્રતિક્રમણાદિને વિષકુંભ અને અપ્રતિક્રમણાદિને અમૃતકુંભ કહ્યા છે. ઉક્ત કથનનું મર્મ ન સમજુને કોઈ વ્યક્તિ પ્રતિક્રમણાદિને છોડીને પ્રમાદી ન બની જય - આ ભાવનાથી આગામી કળશમાં સાવધાન કરતાં આચાર્ય અમૃતચંદ્ર લખે છે -

(વસંતતિલકા)

યત્ર પ્રતિક્રમણમેવ વિષ પ્રણીતં

તત્ત્વાપ્રતિક્રમણમેવ સુધા કુતઃસ્વાત् ।

તત્કિં પ્રમાદ્યતિ જનઃ પ્રપતનધોડધ:

કિં નોર્ધ્વમૂર્ધ્વમધિરોહતિ નિષ્પ્રમાદ: ॥૧૮૧॥

(હરિગીત)

જ્યાં પ્રતિક્રમણને વિષ ભાષ્યું હોય આગમકથનમાં,
ત્યાં અપ્રતિક્રમણ ન હોય અમૃત એ જ જિનવરવચનમાં;
તો અધઃગતિ કરતાં જનો પરમાદમાં કાં રાયતા?
ને નિષ્પ્રમાદી થઈ નહીં કાં ઉર્ધ્વગતિ આરોહતા ? ૧૮૫

જ્યાં પ્રતિક્રમણને વિષ ભાષ્યું હોય આગમકથનમાં, ત્યાં
અપ્રતિક્રમણ અમૃત ક્યાંથી થઈ શકે, કેવી રીતે થઈ શકે ? તાત્પર્ય એમ

છે કે પ્રમાદદશકૃપ અપ્રતિકમળ અમૃત નથી. આશ્રૂણી વાત તો એ છે કે આવી સ્થિતિ હોવા છતાં પણ લોકો નીચે-નીચે પડીને પ્રમાદી કેમ થાય છે; નિષ્પ્રમાદી થઈને ઉપર-ઉપર કેમ નથી ચઢતા ?

ઉક્ત કળશના ભાવને પંડિત જ્યયચંદ્ર છાબડા ભાવાર્થમાં આ પ્રમાણે સ્પષ્ટ કરે છે -

“અજ્ઞાનાવસ્થામાં જે અપ્રતિકમળાદિ થાય છે, તેમની તો વાત જ શું ? પરંતુ અહીં તો, શુભવૃત્તિકૃપ દ્રવ્યપ્રતિકમળાદિનો પક્ષ છોડાવવા માટે તેમને (દ્રવ્યપ્રતિકમળાદિને) નિશ્ચયનયની પ્રધાનતાથી વિષકુંભ કહ્યા છે; કારણ કે તે કર્મબંધના જ કારણ છે અને પ્રતિકમળ-અપ્રતિકમળાદિથી રહિત આવી ત્રીજી ભૂમિ, કે જે શુદ્ધ આત્મસ્વકૃપ છે તથા પ્રતિકમળાદિથી રહિત હોવાથી અપ્રતિકમળાદિકૃપ છે, તેને અમૃતકુંભ કહ્યો છે અર્થાત् ત્યાંના અપ્રતિકમળાદિને અમૃતકુંભ કહ્યા છે. ત્રીજી ભૂમિ પર ચડાવવા માટે આચાર્યદ્વારા આપ્યો છે.

પ્રતિકમળાદિને વિષકુંભ કહેવાની વાત સાંભળીને જે લોકો ઉલ્ટા પ્રમાદી બને છે, તેમના સંબંધમાં આચાર્ય કહે છે કે ‘આ લોકો નીચે જ નીચે કેમ પડે છે ?’ જ્યાં પ્રતિકમળને વિષકુંભ કહ્યો છે, ત્યાં તેના નિષેધકૃપ અપ્રતિકમળ જ અમૃતકુંભ થઈ શકે છે, અજ્ઞાનીનું અપ્રતિકમળ નહીં.

તેથી જે અપ્રતિકમળાદિ અમૃતકુંભ કહ્યા છે, તે અજ્ઞાનીના અપ્રતિકમળાદિ નહીં જાણવા જોઈએ; પરંતુ ત્રીજી ભૂમિના શુદ્ધ આત્મામય જાણવા જોઈએ.”

ઉક્ત કળશનો અર્થ કરતાં પાંડે રાજમલલુ પઠન-પાઠન, સ્મરણ, ચિંતવન, સ્તુતિ, વંદના ઈત્યાદિ ક્ષિયકૃપ વિકલ્પોને પ્રતિકમળ કહે છે. તાત્પર્ય આમ છે કે રાજમલલુ સાહેબે ઉક્ત ભાવોને પ્રતિકમળાદિમાં સમાવી દીધા છે. તેમનો આશય એમ છે કે ઉક્ત વિકલ્પોના કાળમાં તથા ઉક્ત વિકલ્પોને કારણે આત્માનુભવ થતો નથી; આ કારણથી તેમને અહીં વિષકુંભ કહ્યા છે.

આ શુભભાવઙ્ગપ વિકલ્પોને તોડીને આત્માનુભવમાં જવું અસલી પ્રતિક્રમણ છે અથવા નિશ્ચયપ્રતિક્રમણ છે અને તે અમૃતહુંબ છે, ઉપાદેય છે. શુદ્ધોપથોગર્ઘપ અપ્રતિક્રમણને જાણ્યા વગર ઉક્ત શુભોપથોગર્ઘપ પ્રતિક્રમણને છોડીને અશુભભાવઙ્ગપ અપ્રતિક્રમણમાં ચાલ્યા જવું એ તો મહાવિષ્ણુંબ છે, અત્યંત હેય છે. આ કળશમાં એ જ કહેવામાં આવ્યું છે.

કળશાટીકાના ભાવને આત્મસાધ કરતાં પંડિત બનારસીદાસજી નાટક સમયસારમાં લખે છે -

(દોહા)

નંદન બંદન થુતિકરન, શ્રવન ચિંતબન જાપ ।

પઢન પઢાવન ઉપદિસન, બહુવિધિ ક્રિયા-કલાપ ॥

સુદ્ધાતમ અનુભવ જહાઁ, સુભાચાર તહાઁ નાંહિ ।

કરમ કરમ મારગ વિર્ણે, સિવમારગ સિવમાંહિ ॥

(ચૌપાઈ)

ઇહિવિધિ વસ્તુવ્યવસ્થા જૈસી । કહી જિનંદ કહી મેં તૈસી ।

જે પ્રમાદ સંજુત મુનિરાજા । તિનકે સુભાચાર સૌં કાજા ॥

જહાઁ પ્રમાદ દસા નહિ વ્યાપૈ । તહાઁ અવલંબ આપનૈ આપૈ ।

તા કારન પ્રમાદ ઉત્પાતી । પ્રગટ મોખ મારગ કૌ ધાતી ॥

જે પ્રમાદ સંજુગત ગુસાંઈ । ઉઠહિં ગિરહિં ગિંદુક કી નાંઈ ।

જે પ્રમાદ તજિ ઉદ્ધત હોઁ હોઁ । તિન કૌં મોખ નિકટ દ્રિગ સૌં હોઁ ॥

ઘટ મેં હૈ પ્રમાદ જબ તાઈ । તરાધીન પ્રાની તબ તાઈ ।

જબ પ્રમાદ કી પ્રભુતા નાસૈ । તબ પ્રધાન અનભૌ પરગાસૈ ॥

(દોહા)

તા કારણ જગપંથ ઇત, ઉત સિવમારગ જોર ।

પરમાદી જગ કૌં ધૂકૈ, અપરમાદિ શિવ ઓર ॥

જિનવાળાનો મર્મ જાળીને, ગુરુનાં વચન સાંભળીને; આનંદિત થવું, નમસ્કાર કરવો, સ્તુતિ કરવી, સાંભળવું, ચિંતવન કરવું, જ્ઞપ જ્ઞપવો, ભણવું-ભણાવવું, ઉપદેશ આપવો આદિ બધા કિયાકલાપ અને તત્ત્વસંબંધી શુભભાવ પ્રતિક્રમણાદિ જ છે.

જ્યાં શુદ્ધાત્માનો અનુભવ છે, ત્યાં ઉકા પ્રતિક્રમણાદિપ શુભાચાર નથી; કારણ કે કર્મ કર્મના માર્ગમાં છે અને મુક્તિનો માર્ગ મુક્તિમાં છે. તાત્પર્ય એ છે કે શુભક્ષિયાદિપ કર્મ બંધનું કારણ છે અને આત્માનુભવ મુક્તિનું કારણ છે.

આ પ્રમાણે વસ્તુવ્યવસ્થાનું સ્વરૂપ જિનેન્દ્ર ભગવાને જેમ કહ્યું છે; તેના જ અનુસાર મેં અહીં કહ્યું છે, પોતાની તરફથી કંઈ કહ્યું નથી.

ખરેખર વાત તો એમ છે કે જે મુનિરાજ પ્રમાદથી સંયુક્ત છે, તેમને તો શુભ આચરણથી જ પ્રયોજન છે. જ્યાં પ્રમાદની દશા વ્યાપ્ત થતી નથી, ત્યાં એકમાત્ર પોતાના આત્માનું જ અવલંબન રહે છે. તેથી એ અત્યંત સ્પષ્ટ છે કે પ્રમાદની ઉત્પત્તિ મુક્તિમાર્ગનો ઘાત કરનારી જ છે.

જે સાધુજન પ્રમત્તદશામાં છે, છિઠ્ઠા ગુણસ્થાનમાં છે; તે દડાની માફક ચેત છે અને પડે છે અને જે પ્રમાદને છોડીને પુરુષાર્થપૂર્વક આગળ વધે છે, તેમની મુક્તિ અત્યંત નિકટ જ સમજે. તાત્પર્ય આમ છે કે અપ્રમતાદિ ગુણસ્થાનોમાં વિચરનાર મુનિરાજ શીધુ મુક્તિને પ્રાપ્ત કરે છે.

અધિક શું કહીએ, જ્યાં સુધી ઘટમાં પ્રમાદ છે, ત્યાં સુધી આ પ્રાણી પરાધીન છે અને જ્યાં પ્રમાદનો પ્રભાવ નાખ થઈ જય છે, ત્યાં સર્વે ધર્મોમાં પ્રધાન આત્માનુભવનો પ્રકાશ થાય છે.

આ જ કારણે પ્રમાદ સંસારનો પંથ છે અને અપ્રમાદ શિવપંથ છે. પ્રમાદી સંસાર તરફ જય છે અને અપ્રમાદી મુક્તિની તરફ.

આ કળશનો ભાવ પૂજ્ય ગુરુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે -

“હવે આચાર્ય કહે છે કે જ્યારે અમે શુભને અર્થાત् મંદક્ષાયને ઝેર કહ્યો તો અશુભ અર્થાત् તીવ્ર ક્ષાય તો પોતે જ મહાજેર સિદ્ધ થઈ ગયો. જ્યારે વસ્તુસ્થિતિ આમ છે તો પછી જગતજનો નીચે-નીચે પડીને પ્રમાદી કેમ થાય છે? નિષ્પ્રમાદી થઈને ઉપર-ઉપર ચઢવાનો પુરુષાર્થ કેમ કરતા નથી? શુભભાવને છોડીને જ્યાં સચ્ચિદાનંદ પ્રભુ આત્માની અંદર છે, તેને બેઠીને તેમાં જ લીન થઈ જા.

શુભને છોડીને પ્રમાદી થઈને જે તું અશુભમાં જાય છે તો તે તો તારી સ્વચંદતા છે. તેથી શુભને છોડીને નિષ્પ્રમાદી થઈને સ્વકૃપના આશ્રયમાં જ અને તેમાં જ લીન થઈ જા. શુભભાવને હેય બતાવવાનું એકમાત્ર આ જ પ્રયોજન છે.^૧

આહ! શાનીને શુભ ન આવે - તેમ પણ થતું નથી અને શુભને ધર્મ માને - તેમ પણ થતું નથી, આ કારણે તેમને ત્રીજી ભૂમિમાં પહોંચાડવાનો ઉધ્યમ કરાવવામાં આવે છે. શાસ્ત્રમાં જ્યાં શુભનો અધિકાર હોય, ત્યાં બિનમંદિર બનાવો, પ્રતિમા બિરાજમાન કરાવો, સ્વાધ્યાય કરો, તપ કરો, વ્રત કરો, દાન આપો ઈત્યાદિ બધી જાતના કથન આવે છે; પરંતુ આ કથન તો ધર્માની ભૂમિકાનું જ્ઞાન કરાવવા માટે કરવામાં આવ્યું છે. તેથી શુભભાવ ધર્મ થઈ જતો નથી.

જુઓ, આ અપ્રતિક્ષમણાદિના બે પ્રકાર કહેવામાં આવ્યા છે -

૧. મિથ્યાત્મ સહિત અજ્ઞાનીને જે શુભશુભ ભાવ થાય છે, તે ભાવ અપ્રતિક્ષમણાદિઃપ છે.
૨. શુભભાવોને પણ છોડીને શુદ્ધમાં જવું - આ ભાવ જ્ઞાનીના અપ્રતિક્ષમણાદિઃપ છે. આ ભાવ આત્મસ્વરૂપ છે, અબંધ છે, અમૃતકુંભ છે.

૧ પ્રથમનરત્નાકર ભાગ ૮, પાનું ૪૩૧-૪૩૨

૨ પ્રથમનરત્નાકર ભાગ ૮, પાનું ૪૩૨

તથા જ્ઞાનીને નિશ્ચયસહિત જે શુભભાવ આવે છે, તેમને વ્યવહાર પ્રતિકમણાદિ કહે છે. નિશ્ચયથી તેમને અહીં વિષકુંભ કહ્યા છે; કારણ કે તે બંધના જ કારણ છે.

અજ્ઞાનીના નિશ્ચય અને વ્યવહાર - બંનેમાં એક પણ પ્રતિકમણ નથી. ત્રીજી ભૂમિકા જે શુદ્ધ આત્મસ્વરૂપ છે, તે પ્રતિકમણારહિત હોવાથી અપ્રતિકમણસ્વરૂપ છે. તે અમૃતકુંભ છે.^૧

પ્રતિકમણાદિને જે શાસ્ત્રમાં વિષકુંભ કહ્યા - તે સાંભળીને જે કોઈ સ્વચ્છાંદ થઈને પાપરૂપ પરિણામન કરે તો તે અવિવેકી છે. અરે ભાઈ! આચાર્ય તો શુભનો પણ ત્યાગ કરાવીને શુદ્ધમાં જવાનું કહી રહ્યા છે. પોતાના ચિદાનંદસ્વરૂપ આત્મામાં જવા માટે, શુદ્ધ આત્માનો આશ્રય લેવાનું કહી રહ્યા છે.^૨

ઉક્ત સંપૂર્ણ કથનનો સાર એ છે કે જે અશુભભાવરૂપ અપ્રતિકમણ છે, પાપપ્રવૃત્તિ કરીને પશ્ચાત્તાપ પણ ન કરવારૂપ જે વૃત્તિ છે; તે તો મહાઝેર છે અને સર્વથા ત્યાજ્ય છે.

પ્રમાણવશ થનાર અપરાધો પ્રતિ પશ્ચાત્પના ભાવ થવારૂપ ને પ્રતિકમણાદિ છે; તે પાપની અપેક્ષા વ્યવહારથી અમૃતકુંભ છે, કથંચિત્ કરવા યોગ્ય છે.

શુભાશુભભાવથી રહિત શુદ્ધોપયોગરૂપ ને નિશ્ચયપ્રતિકમણ અથવા અપ્રતિકમણાદિ છે, તે સાક્ષાત્ અમૃતકુંભ છે, સર્વથા ગ્રહણ કરવા યોગ્ય છે; મુક્તિનું સાક્ષાત્ કારણ છે.

હવે આ જ ભાવનું પોખરા આગામી કળશમાં પણ કરે છે; ને આ પ્રમાણે છે -

૧ પ્રવચનરત્નાકર (હિંદી), ભાગ C, પાનું ૪૩૧-૪૩૩-૪૩૪

૨ પ્રવચનરત્નાકર (હિંદી), ભાગ C, પાનું ૪૩૪

(પૃથ્વી)

પ્રમાદકલિત: કથં ભવતિ શુદ્ધભાવોઽલસ:
 કષાયભરગૌરવાદલસતા પ્રમાદો યત: ।
 અત: સ્વરસનિર્ભરે નિયમિત: સ્વભાવે ભવન
 મુનિ: પરમશુદ્ધતાં વ્રજતિ મુચ્યતે વાડચિરાત् ॥૧૧૦॥

(હસ્તિગીત)

કૃપાયના બહુ ભારથી આળસપાગું જ પ્રમાદ છે,
 પરમાદસહ એ ભાવ તેથી શુદ્ધભાવ ન હોય છે;
 નિજરસસભર નિજભાવમાં નિશ્ચળ થઈ તેથી મુનિ,
 પામી પરમ વિશુદ્ધતાને ધૂટતો સહુ બંધથી. ૧૯૦.

કૃપાયોના ભારથી ભારે આળસનો ભાવ શુદ્ધભાવકૃપ અપ્રતિકમણ
 અથવા નિશ્ચય પ્રતિકમણ કેવી રીતે થઈ શકે? તેથી નિજરસથી પરિપૂર્ણ
 સ્વભાવમાં નિશ્ચળ થનાર મુનિજન પરમશુદ્ધતાને પ્રાપ્ત કરે છે અથવા
 અલ્પકાળમાં જ મુક્ત થઈ જય છે.

આ કળશનો અર્થ કરતાં પાંડે રાજમલણ કળશટીકાભાં અલસ:
 નો અર્થ અનુભવમાં શિથિલ અને પ્રમાયફલિત: નો અર્થ વિવિધ પ્રકારના
 વિકલ્પોથી સંયુક્ત કરે છે તથા મુનિ નો અર્થ સમ્યગ્દાષ્ટિ જીવ કરે છે.

આ કળશનો ભાવ કળશટીકાના આધારે બનારસીદાસજુ ત્રણ
 દોહાભાં આ પ્રમાણે વ્યક્ત કરે છે.

(દોહા)

જે પરમાદી આલસી, જિન્હુંકેં વિકલપ ભૂરિ ।
 હોર્ડ સિથલ અનુભૂતિ વિષે, તિન્હકોં સિવપથ દૂરિ ॥
 જે પરમાદી આલસી, તે અભિમાની જીવ ।
 જે અવિકલપી અનુભવી, તે સમરસી સદીવ ॥
 જે અવિકલપી અનુભવી, સુદ્ધ ચેતના યુક્ત ।
 તે મુનિવર લઘુકાલ મૈં, હૌંહિ કરમ સૌં મુક્ત ॥

જે જીવ પ્રમાણી છે, આળસુ છે; જેને અનંત વિકલ્પ છે અને જે આત્માનુભવમાં શિથિલ છે; તેમના માટે મુક્તિનો માર્ગ દૂર જ છે.

જે પ્રમાણી છે, આળસુ છે; તે જીવ અભિમાની છે અને જે નિર્વિકલ્પ અનુભવી છે; તે જીવ સમરસી છે, સમતારસનું પાન કરનાર છે.

જે મુનિવર નિર્વિકલ્પ છે, અનુભવી છે, શુદ્ધજ્ઞાનચેતનાયુક્ત છે; તે મુનિવર અલ્પકાળમાં જ કર્મથી મુક્ત થઈ જશે.

નાટક સમયસારમાં આ છંદો પણી બીજા પણ ત્રણ છંદ છે, જેમાં જ્ઞાની અને અજ્ઞાની જીવોની પરિણાતિનું વિવેચન છે; પણ આ પ્રકારના ભાવવાળા કોઈ કળશ આત્મભ્યાતિમાં નથી. તેથી તે અહીં આપવામાં આવી રહ્યા નથી. વિશેષ જિજ્ઞાસા રાખનાર મહાનુભાવો નાટક સમયસારમાંથી તેમનું અધ્યયન કરો.

ઉક્ત કળશનો ભાવ પૂજ્ય ગુરુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે -

“જેમ ધાસથી ભરેલી ગાડીમાં ભાર હોય છે, તેમ આત્મામાં શુભાશુભ કષાયોનો ભાર છે. કષાયનો ભાર સ્વયં પોતામાં આળસ છે પ્રમાદ છે, કારણ કે કષાયના કારણે સ્વરૂપમાં સાવધાની રહેતી નથી, સ્થિરતા થઈ શકતી નથી - આ બધો તો પ્રમાદ છે.

ભાઈ ! ધંધા-વ્યાપારમાં ઉત્સાહિત રહેવું તે તો પ્રમાદ છે જ, મંદિર બનાવવામાં, પ્રતિમા પદ્ધરાવવામાં, સમાજની, રાજ્યની સેવામાં તત્પર રહેવામાં પણ પ્રમાદ છે અને આ બધા લોકો કષાયના ભારથી દ્વારા છે, તેથી પ્રમાણી છે. આ બધો રાગ છે ને ? તેથી પ્રમાદ છે. પ્રમાદના પંદર ભેદોમાં આ બધા આવી જય છે. ચાર કષાયો, પાંચ ઈંદ્રિયોના વિષય અને ચાર વિકથા તથા નિદ્રા અને પ્રણય - આ પ્રમાદના પંદર ભેદ છે. આવા પ્રમાદસહિત ભાવ શુદ્ધભાવ કેવી રીતે થઈ શકે ?^૧

૧ સમયસાર (હિંદી), ભાગ ૮, પાનું ૪૩૫

૨ સમયસાર (હિંદી), ભાગ ૮, પાનું ૪૩૫-૪૩૬

ભગવાન આત્મા શુદ્ધ ચૈન્યરસથી ભરેલો છે. જે તેના આશ્રયમાં ન જતાં અશુભની પ્રવૃત્તિમાં હર્ષિત થઈને કણ વ્યતીત કરે છે, તે પાપી છે. પ્રમાદથી ભરપૂર છે. તેમને શુભભાવ કેમ થાય? પણ અહીં તો વિરોધ વાત એ છે કે શુભભાવોમાં પણ જે ઉત્સાહિત છે, તે પણ પ્રમાદી છે. પાંચ મહાવતના રાગને અને અષાવીસ મૂળગુણોના રાગને પ્રમાદ કહે છે. છઠા ગુણસ્થાનવર્તી મુનિ પ્રમત્ત છે.^૧

જે શુભને પણ છોડીને પોતાના શાનાનંદસ્વરૂપમાં લીન થઈને શુદ્ધતાને પ્રાપ્ત કરે છે, તે અપ્રમાદી છે. તે સિવાય સ્વભાવમાંથી પરિણામોનું નીચે પડી જવું તે પ્રમાદ છે.^૨

આ રીતે આ કળશમાં વિગત કળશની વાતને પુષ્ટ કરતાં માત્ર એ જ કહેવામાં આવ્યું છે કે શુભાશુભ કષાયભાવના ભારથી બોણિત આળસનો ભાવ જ પ્રમાદ છે અને આ પ્રમાદની અવસ્થામાં શુદ્ધોપયોગરૂપ અપ્રતિકમણના ધારક મુનિરાજ જ મુક્તિને પ્રાપ્ત કરે છે.

એ તો આપ જણો જ છો કે મોક્ષાધિકાર સમાપ્ત થઈ ગયો છે. મોક્ષાધિકારના અંતમાં નિશ્ચય-વ્યવહાર પ્રતિકમણાદિ અને અપ્રતિકમણાદિ સંબંધી જે ગાથાઓ આવી હતી, તે ગાથાઓની વિષયવસ્તુના આધારે ૧૮૮ થી ૧૯૦ સુધીના ત્રણ કળશ કહ્યા, જેમાં ઉક્ત પ્રતિકમણ-અપ્રતિકમણની જ ચર્ચા છે.

હવે મોક્ષાધિકારની સમાપ્તિ ઉપર બે કળશ કહે છે; જેમાં પહેલા કળશમાં મોક્ષ થવાનો અનુક્રમ બતાવતાં અને બીજી કળશમાં ધીર-વીર શાનજ્યોતિનું સ્મરણ કરતાં અંતનું મંગળ કરે છે.

મોક્ષ થવાનો અનુક્રમ બતાવનાર પહેલો કળશ આ પ્રમાણે છે -

૧ સમયસાર (હિંદી), ભાગ ૮, પાનું ૪૩૬

(શારૂલવિક્રીડિત)

ત્વક્ત્વાડશુદ્ધિવિધાયિ તત્કિલ પરદ્રવ્યં સમગ્રં સ્વયં
સ્વદ્રવ્યે રતિમેતિ ય: સ નિયતં સર્વાપિરાધચ્યુતઃ ।
બંધધવં સમુપેત્ય નિત્યમુદિતઃ સ્વજ્યોતિરચ્છોચ્છલ-
ચ્ચૈતન્યામૃતપૂર્પૂર્ણમહિમા શુદ્ધો ભવન્મુચ્યતે ॥૧૯૧॥

(હરિગીત)

જે છોડીને પરદ્રવ્ય સૌ, નિજદ્રવ્યમાં લીન થાય છે,
ધૂટે સહુ અપરાધથી, નહીં બંધ તેને થાય છે;
ચૈતન્ય-અમૃતથી ભરેલો ઉદિત મહિમાવંત ને
થઈ શુદ્ધ પૂરાગ આતમા તે કર્મથી મુક્તિ લહે. ૧૫૧.

ખરેખર જે પુરુષ અશુદ્ધતા કરનાર સમસ્ત પરદ્રવ્યોને છોડીને
સ્વયંમાં રતિ કરે છે, સ્વયંમાં લીન થાય છે; તે પુરુષ નિયમથી સર્વ
અપરાધોથી રહિત થતો થકો બંધના નાશને પ્રાપ્ત થઈને નિત્ય ઉદિત પોતાની
જ્યોતિથી નિર્મળ ને ઉછળતો થકો ચૈતન્યરૂપી અમૃતના પ્રવાહ દ્વારા,
પૂર્ણિતાને પ્રાપ્ત મહિમાવંત શુદ્ધ થતો થકો કર્મથી મુક્ત થાય છે.

આ કળશનો ભાવ સ્પષ્ટ કરતાં પંહિત જ્યયંદળ છાબડા ભાવાર્થમાં
લખે છે -

“જે પુરુષ, પહેલા સમસ્ત પરદ્રવ્યોનો ત્યાગ કરીને નિજદ્રવ્યમાં
(આત્મસ્વકૃપમાં) લીન થાય છે; તે પુરુષ સમસ્ત રાગાદિક અપરાધો રહિત
થઈને આગામી બંધનો નાશ કરે છે અને નિત્યઉદ્યર્થપ કેવળજ્ઞાનને પ્રાપ્ત
કરીને શુદ્ધ થઈને, સમસ્ત કર્મોનો નાશ કરીને, મોક્ષને પ્રાપ્ત કરે છે. આ
મોક્ષ થવાનો અનુકૂળ છે.”

સમ્યગદાષ્ટ જીવ મુક્તિને કર્દી રીતે પ્રાપ્ત કરે છે - તે બતાવનાર
આ કળશનો ભાવાનુવાદ કવિવર બનારસીદાસલુ આ પ્રમાણે કરે છે -

(चौપाई)

જે સમકિતી જીવ સમચેતી, તિનકી કથા કહોં તુમસેતી ।
જહાં પ્રમાદ ક્રિયા નહિ કોઈ, નિરવિકલ્પ અનુભૌ પદ સોઈ ॥

પરિગ્રહ ત્યાગ જોગ થિર તીનાં, કરમ બંધ નહિ હોય નવીનાં ।
જહાં ન રાગ દોષ રસ મોહે, પ્રગટ મોખ મારગ મુખ સોહે ॥

પૂર્બ બંધ ઉદય નહિ વ્યાપૈ, જહાં ન ભેદ પુત્ર અરુ પાપૈ ।
દરબ ભાવ ગુન નિરમલ ધારા, બોધ વિધાન વિવિધ વિસ્તારા ॥

જિન્હ કી સહજ અવસ્થા એસી, તિન્હ કે હિરદૈ દુવિધા કેસી ।
જે મુનિ છપક શ્રેણી ચઢિ ધારે, તે કેવલિ ભગવાન કહારે ॥

(દોહા)

ઇહિ વિધિ જે પૂરન ભયે, અષ્ટકરમ બન દાહિ ।
તિન્હ કી મહિમા જો લખૈ, નમૈ બનારસિ તાહિ ॥

હે ભવ્યજીવો ! સમભાવ ધારણ કરનાર જે સમ્યગદાષ્ટ જીવ છે;
હું તેમની કથા તમને કહું છું. તાત્પર્ય આ છે કે તેમના દ્વારા મુક્તિ પ્રાપ્ત
કરવાનો કમ કેવો હોય છે - આ વાત હું તમને કહું છું.

જ્યાં શુભાશુભભાવઙ્ઘ્રે પ્રમાદ ક્રિયા થતી નથી, તે નિર્વિકલ્પ
અનુભવવાળો પદ, નિશ્ચયપ્રતિક્રિમણ અથવા અપ્રતિક્રિમણાની દશા ૯
અનુભવી સમ્યગદાષ્ટઓનું વાસ્તવિક પદ છે.

જેમને ભૂમિકાનુસાર અંતરંગ-બહિરંગ પરિગ્રહનો ત્યાગ કરીને
મન-વચન-કાય - આ તરણે યોગને સ્થિર કર્યા છે; તેમને નવીન કર્મોનો
બંધ થતો નથી. જેમને ભૂમિકા અનુસાર મોહ-રાગ-દેખ થતા નથી; તેઓ
સ્પષ્ટઙ્ઘ્રે અંતર્મુખી મોક્ષમાર્ગમાં શોભાયમાન થઈ રહ્યા છે.

જેમને પહેલા બાંધેલા કર્મોનો ઉદ્ય વ્યાપ્તો નથી, પ્રભાવિત કરતો
નથી અને જેની દાખિમાં પુણ્ય અને પાપમાં કંઈ બેદ રહ્યો નથી - બંને

એક સમાન જ હેય ભાસિત થાય છે; જે દ્રવ્ય અને ભાવ - બંને ઝપમાં, બહિરંગ અને અંતરંગ - બંને ઝપમાં નિર્મળ થઈ ગયા છે, નિર્વિકાર થઈ ગયા છે અને જેમના જ્ઞાનની ધારા અવિરલ થઈ ગઈ છે, જેમના જ્ઞાનનો વિસ્તાર વિવિધત્તે થઈ ગયો છે, જેમની અવસ્થા સહજ જ એવી થઈ ગઈ છે; તેમના હૃદયમાં કોઈ પણ પ્રકારની દુવિધા કેવી રીતે રહી શકે ?

અરે ભાઈ ! જે સમ્યગદાષ્ટ મુનિરાજ ક્ષપકશ્રેષ્ઠી ચડીને વેગથી આગળ વધી રહ્યા છે, તે અલ્પકાળમાં કેવળજ્ઞાની થઈ જશે અને કેવળી ભગવાન કહેવાશે.

આ પ્રમાણે આઠ કર્મોને બાળીને પૂર્ણતાને પ્રાપ્ત થઈ ગયા છે; જે વ્યક્તિ તેમની મહિમાને જાણે છે, તે મહાન છે અને હું બનારસીદાસ તેમને નમસ્કાર કરું છું.

આ પ્રમાણે આ છંદોમાં બનારસીદાસજીએ ચોથા ગુણસ્થાનથી માંડીને સિદ્ધ થવા સુધીનું પુરું વર્ણન કરી દીધું છે.

આ જ સંદર્ભમાં બનારસીદાસજીએ એક છંદમાં એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે કયા કર્મના નાશથી ક્યો ગુણ પ્રગટ થાય છે. તે આ પ્રમાણે છે.

(સવૈયા ઇકતીસા)

ગ્યાનાવરની કે ગર્યે જાનિયૈ જુ હૈ સુ સબ,

દર્સનાવરન કે ગરૈ તૈં સબ દેખિયે ।

વેદની કરમ કે ગરૈ તૈં નિરાબાધ સુખ,

મોહની કે ગર્યે સુદ્ધ ચારિત વિસેખિયૈ ॥

આઉકર્મ ગરૈ અવગાહના અટલ હોડ,

નામકર્મ ગરૈ તૈં અમૂરતીક પેખિયૈ ।

અગુરુ અલઘુરૂપ હોત ગોત્રકર્મ ગરૈ,

અંતરાય ગરૈ તૈં અનંત બલ લેખિયૈ ॥

જ્ઞાનાવરણી કર્મ જતાં સર્વ પદાર્થને જાળનાર ક્ષાયિકજ્ઞાન (ક્વણજ્ઞાન) પ્રગટ થાય છે. અને દર્શનાવરણી કર્મના જવાથી બધાને જેનાર ક્ષાયિકદર્શન (ક્વણદર્શન) પ્રગટ થાય છે. વેદનીય કર્મના જવાથી નિરાબાધ સુખ પ્રગટ થાય છે. અને મોહનીય કર્મના જવાથી શુદ્ધચારિત્ર પ્રગટ થાય છે. આ જ પ્રકરે આયુકર્મના જવાથી અટલ અવગાહન, નામકર્મના જવાથી અમૂર્તિકપણું, ગોત્રકર્મ જવાથી અગુરુલઘૃત્વપણું અને અંતરાય કર્મ જતાં અનંતવીર્ય (અનંતબળ) પ્રગટ થાય છે.

આ કળશાનો ભાવ પૂજય ગુરુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે.

“પુણ્ય-પાપના પરિણામ અશુદ્ધતા છે, વિષકુંભ છે, અપરાધ છે. જેને વીતરાગધર્મ પ્રગટ કરવો હોય, તેને આ બધા વિકલ્પો છોડવા પડશે અને શુદ્ધતા પ્રાપ્ત કરવી પડશે. જ્યારે પરદ્રવ્યનું લક્ષ્ય છોડીને સ્વદ્રવ્યમાં લીન થાય છે, ત્યારે શુદ્ધતા પ્રગટ થાય છે. તેમાં ખરેખર કોઈ રાગની, પુણ્યની અથવા વિકલ્પની અપેક્ષા નથી. આત્મા સ્વયં શુદ્ધ જ્ઞાનાનંદમૂર્તિ છે. તે જ્યારે પોતાના દ્રવ્યમાં સ્વયં લીન થાય ત્યારે શુદ્ધતા પ્રગટ થઈ જય છે.

જ્ઞાનાનંદસ્વરૂપ સ્વદ્રવ્યના સિવાય જેટલા પણ પરદ્રવ્ય છે, તે ભલે તીર્થકર હો, તેમની વાણી હો, સમવસરણ હો, બિનમંહિર હો કે બિનપ્રતિમા હો; બધા પરદ્રવ્ય શુભરાગરૂપ અશુદ્ધતાના નિભિત કારણ છે.^૧

ભલે સ્ત્રી-પુત્ર પરિવાર હો કે દેવ-શાસ્ત્ર-ગુરુ હો, તે બધા પરદ્રવ્ય અશુદ્ધતાના નિભિત કારણ છે. તે પરદ્રવ્યો તરફનો જુકાવ છોડીને જ્યારે જીવ સ્વદ્રવ્યમાં સ્વયં લીન થાય છે, ત્યારે મુક્તિ પ્રાપ્ત થાય છે.^૨

જેટલું સ્વદ્રવ્યને છોડીને પરદ્રવ્યનું આત્મબન લઈશું, તેટલો જ રાગ થશે અને તે રાગ અપરાધ છે. વીતરાગદેવ એમ નથી કહેતા કે તું અમારી

૧ પ્રવચનરત્નાકર (હિન્ડી), ભાગ C, પાનું ૪૩૮

૨ પ્રવચનરત્નાકર (હિન્ડી), ભાગ C, પાનું ૪૩૯

ભક્તિ કર ! તેનાથી તારું કલ્યાણ થઈ જશે. ઉલ્લું ભગવાન તો એ ઘોષણા કરે છે કે અમારી ભક્તિ, સ્તુતિ, વંદના આદિ કરવાનો જે તને રાગ આવે છે, તે બધો અપરાધ છે, અશુદ્ધતા છે. તે કોઈ મહિમાવાળી વસ્તુ નથી.

આચાર્ય કહે છે કે ભાઈ ! તું સ્વકૃપમાં અંદર જી. ત્યાં તારી અંદર ચૈતન્યકૃપી અમૃતનો પ્રવાહ નિકાળ વહી રહ્યો છે. આ પુણ્ય-પાપના ભાવ તો એરનો પ્રવાહ છે.

હે ભાઈ ! તું ચિદાનંદધન ચૈતન્યકૃપી અમૃતથી ભરપૂર છે. તેનો સ્વ-સંવેદનમાં અનુભવ કરીને, જાણીને તેમાં જ મગ્ન થઈ જી, સ્થિર થઈ જી, કારણ કે શુદ્ધ ચૈતન્યના ધ્રુવપ્રવાહમાં મગ્ન થવાથી આત્મા શુદ્ધ થઈને કર્માથી છૂટી જય છે અને શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે.^૧

સર્વપ્રથમ મિથ્યાત્વથી, તે પછી અવતથી અને પછી અસ્થિરતાથી મુક્ત થઈ જી. આ મુક્ત થવાનો કમ છે.

ભાઈ ! તારું જેવું સ્વ-સ્વકૃપ છે, તેવું જ્ઞાન અને શ્રદ્ધાન કર. તેનું જ્ઞાન-શ્રદ્ધાન થતાં તેમાં સ્થિરતા થશે અને અંતઃસ્થિરતા પૂર્ણ થતાં મોક્ષ થશે. અંતઃસ્થિરતા જ ચારિત્ર છે. સ્વકૃપ સ્થિરતા થતાં અશુદ્ધતાનો નાશ થતાં જ શુદ્ધોપયોગની જમાવટ થાય છે. તે જ ખેખર મુનિદશા છે; જેનું અંતિમ ફળ મોક્ષ છે.^૨

આ પ્રમાણે આ કળશમાં મુક્તિના માર્ગ પર સંક્ષેપમાં સંપૂર્ણ પ્રકાશ પાથર્યો છે; મોક્ષાધિકારનો સંક્ષિપ્ત સાર બતાવી દીધો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સમસ્ત પરદ્રવ્યોને ત્યાગીને સ્વમાં લીન થનાર સમ્યગ્દાઢિ મુનિરાજ સર્વ અપરાધોથી રહિત થતાં પૂર્ણજ્ઞાન અને અતીન્દ્રિય આનંદને પ્રાપ્ત કરીને સંસારથી મુક્ત થઈ જય છે.

હવે મોક્ષાધિકારના અંતમાં અંતમંગલકૃપ કળશ કહે છે; જે આ પ્રમાણે છે -

૧ પ્રવચનરત્નાકર (હિન્ડી), ભાગ ૮, પાનું ૪૩૮-૪૪૦

૨ પ્રવચનરત્નાકર (હિન્ડી), ભાગ ૮, પાનું ૪૪૦-૪૪૧

(મન્દક્રાન્તા)

બંધચ્છે દાતકલય દતુલં મોક્ષમક્ષયમેત-
 નિત્યોદ્યોતસ્કુટિતસહજાવસ્થમેકાંતશુદ્ધમ् ।
 એક રક રસ્વરસ ભરતો ડત્યં તગં ભીરધીરં
 પૂર્ણ જ્ઞાન જ્વલિતમચલે સ્વસ્ય લીન મહિનિ ॥૧૧૨॥

(હરિગીત)

જે કર્મબંધનછેદથી અનુભવતું અક્ષય મોક્ષને,
 ઉદ્યોત નિત્ય સહજ રહે એવી અવસ્થા જેહને;
 બહુ શુદ્ધ એકાકાર ને અતિ ધીર ને ગંભીર જે,
 તે પૂર્ણ જ્ઞાન પ્રગટ થઈ, નિજ અચળ મહિમામાં રહે. ૧૪૨

નિત્ય-ઉદ્યોતમય સહજ અવસ્થાથી સ્કુરાયમાન, સંપૂર્ણ રીતે શુદ્ધ
 અને એકાકાર, નિજરસની અતિશયતાથી અત્યંત ધીર-ગંભીર, પૂર્ણજ્ઞાન
 કર્મબંધના છેદથી અતુલ અક્ષય મોક્ષનો અનુભવ કરતો થકો સહજ જ
 પ્રકાશિત થઈ ગયો અને સ્વયંની અચળ મહિમામાં લીન થઈ ગયો.

આ કળશનો ભાવ ભાવાર્થમાં પંડિત જ્યયચંદ્ર છાબડા આ પ્રમાણે
 સ્પષ્ટ કરે છે -

“કર્મનો નાશ કરીને મોક્ષનો અનુભવ કરતો થકો, પોતાની
 સ્વાભાવિક અવસ્થારૂપ, અત્યંત શુદ્ધ, સમસ્ત શૈયાકારોને ગૌણ કરતો થકો,
 અત્યંત ગંભીર (જેની સીમા નથી એવો) અને ધીર (આકૃણતા રહિત) -
 આવું પૂર્ણજ્ઞાન પ્રગટ દેહીભ્યમાન થતું થકું, પોતાની મહિમામાં લીન થઈ
 ગયું.”

આ કળશનો ભાવાનુવાદ કવિવર બનારસીદાસજી નાટક સમયસારમાં
 આ પ્રમાણે કરે છે.

(છપ્પય)

ખ્યાત સુદ્ધ અંકૂર, ગયૌ મિથ્યાત મૂર નસિ ।
 ક્રમ ક્રમ હોત ઉદોત, સહજ જિમ સુકલ પક્ષ સસિ ॥

કેવળ રૂપ પ્રકાસિ, ભાસિ સુખ રાસિ ધરમ ધુવ ।

કરિ પૂરન થિતિ આડ, ત્યાગ ગત લાભ પરમ હુવ ॥

ઇહ વિધિ અનન્ય પ્રભુતા ધરત, પ્રગટિ બુંદિ સાગર થયો ।
અવિચલ અખંડ અનભય અખય, જી દરબ જગ મંહિ જયો ॥

શુદ્ધતાનો અંકુર પ્રગટ થયો, મિથ્યાત્વ જડમૂળથી નષ્ટ થઈ ગયું,
શુક્લપથના ચંદ્રમાની સમાન ક્રમે-ક્રમે સહજભાવથી જ્ઞાનઝીપી ચંદ્રમાનો
ઉધોત થવા માંડયો અને કેવળજ્ઞાનકૃપ પૂર્ણમાસીને પ્રાપ્ત થઈ ગયો, જેમાં
અનંત સુખ અને ધ્રુવ ધર્મ ભાસિત થવા માંડયા. અંતમાં આયુક્ભર્ની સ્થિતિને
પૂર્ણ કરીને દેહને ત્યાગીને પરમલાભને પ્રાપ્ત થયો અર્થાત્ સિદ્ધદશાને પ્રાપ્ત
થયો.

આ પ્રમાણે આ આત્મા કદીય પ્રાપ્ત ન થયેતી પ્રભુતાને પ્રાપ્ત થઈ
ગયો, અનુભવદશાને પ્રાપ્ત થઈ ગયો, બિંદુમાંથી સિંધુ થઈ ગયો, અલ્પજ્ઞાનથી
પૂર્ણજ્ઞાનને પ્રાપ્ત થઈ ગયો; આ પ્રમાણે આ જીવદ્રવ્ય અવિચળ, અક્ષય,
અભય અને અખંડ પદ્ધને પ્રાપ્ત થઈ જયવંત વર્તે છે.

પૂજ્ય ગુરુદેવ આ કળશના ભાવને આ પ્રમાણે સ્પષ્ટ કરે છે.

“આ મોક્ષ અધિકારનો અંતિમ કળશ છે. અહીં કહે છે કે
કર્મબંધનના છેદ્યી મોક્ષ થાય છે અર્થાત્ શુદ્ધચિદાનંદ આત્માનું જ્ઞાન, શ્રદ્ધાન
અને તેમાં લીનતા વહે રાગાદિ વિકારનો સર્વથા નાશ થતાં સર્વે કર્મો છેદાઈ
જીવાથી અતુલ અક્ષય કેવળજ્ઞાનમય મોકદશા પ્રગટ થઈ જય છે. તે મોકાની
દશા સહજ-સ્વાભાવિક અને નિત્ય ઉધોતકૃપ છે. જે કેવળદર્શન અને
કેવળજ્ઞાન અંતરમાં નિકાળ શાંતિસ્વકૃપ હતું, તે વર્તમાનમાં વ્યક્ત થઈ જય
છે.”

જુઓ ! સંસારદશામાં અલ્પજ્ઞાનદશામાં જ્ઞાનની દશા એકાકાર-
એકકૃપ ન હતી, અનેકકૃપ હતી, તે પરમાત્મદશામાં સર્વજ્ઞતા પ્રગટ થતાં

^૧ પ્રવચનરત્નાકર (હિન્દી), ભાગ C, પાનું ૪૪૨

એકાકાર પ્રગટ થઈ ગઈ. એકાકાર અર્થાત્ એક જ્ઞાનગમ્ય સ્વરૂપે પરિણાત થઈ ગઈ. રાગાદિનો સર્વથા નાશ થતાં જ્ઞાનની દશા એકાકાર-એકરૂપે પ્રગટ થઈ ગઈ.

સિદ્ધદશા નિજરસથી, ચૈતન્યરસની અતિશયતાથી અત્યંત ગંભીર છે. છિદ્રસ્થ વડે તેની ગંભીરતાનો ઘ્યાલ આવવો મુશ્કેલ છે. ભગવાન આત્માનું પૂર્ણજ્ઞાન સમુદ્રની માફક અતિ ગંભીર છે, અથાગ છે તથા તે કેવળજ્ઞાન ધીર છે અર્થાત્ શાખત છે તથા જ્વલિત અર્થાત્ રત્નજ્યોતિની સમાન શાખત પ્રકાશમાન છે.

જેવી રીતે દિવાસળી (માચીશ) માં શક્તિરૂપે અજિન છે અને ઘસતાં જ - ૨૨૭ લાગતાં જ પ્રગટ થઈ જય છે; તેવી જ રીતે આત્મામાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય વિકાળ શક્તિરૂપે વિદ્યમાન છે, તેમાં અંતરથી એકાગ્રતા કરતાં અંતરમાં અનુભવ કરતાં તે જ્ઞાન જ્યોતિર્ભવ થઈને કેવળજ્ઞાનરૂપે પર્યાયમાં પ્રગટ થઈ જય છે. જેવું અંતરમાં સામર્થ્ય છે, તેવું જ પર્યાયમાં પ્રગટ થઈ જય છે.^૧

આ રીતે આ કળશમાં અંતમંગળના ડ્રેપમાં સમ્યગ્જ્ઞાન-જ્યોતિનું સ્મરણ કરવામાં આવ્યું છે કે જે સ્વયંમાં સમાઈને વિકાળીધ્વિવ નિજ ભગવાન આત્માનો આશ્રય કરી કેવળજ્ઞાનરૂપે પરિણામિત થઈ ગઈ છે. જ્ઞાનજ્યોતિનું કેવળજ્ઞાનરૂપે પરિણામિત થવું તે જ મોક્ષ છે. આ રીતે અહીં મોક્ષાધિકાર સમાપ્ત થાય છે.

આત્મગ્યાતિના મોક્ષાધિકારનું અંતિમ વાક્ય છે - ઇતિ મોક્ષો નિષ્કાન્તः । તાત્પર્ય છે કે આ પ્રમાણે મોક્ષ પણ રંગભૂમિથી બહાર નીકળી ગયો. મોક્ષ પણ તો એક સ્વાંગ છે, આત્મવસ્તુનું મૂળ સ્વરૂપ નથી. મોક્ષ પણ એક પર્યાયનું નામ છે, તે પણ આત્માનો દ્રવ્યસ્વભાવ નથી. તેથી અહીં તેને પણ સ્વાંગ કહ્યો છે.

^૧ પ્રવચનરત્નાકર (હિન્દી), ભાગ C, પાનું ૪૪૩

અન્ય અધિકારોની માફક આ અધિકારના અંતમાં પણ પંહિત જ્યયંદળ છાબડા સંપૂર્ણ અધિકારની વિષયવસ્તુને સમેતતાં એક છંદ લખે છે; જે આ પ્રમાણે છે -

(સવૈયા તેર્ઝસા)

જ્યોં નર કોऊ પરયો દૃઢબંધન બંધસ્વરૂપ લખૈ દુખકારી,
ચિંત કરૈ નિતી કેમ કટે યહ તૌઝ છિદૈ નહિ નૈક ટિકારી ।

છેદન કું ગહિ આયુધ ધાય ચલાય નિશંક કરૈ દુય ધારી,
યોં બુધ બુદ્ધિ ધસાય દુધા કરિ કર્મ રુ આતમ આપ ગહારી ॥

જે રીતે કોઈ મનુષ્ય મજબૂત બંધનમાં પડ્યો હોય અને તે બંધનના દુઃખમય સ્વરૂપને સારી રીતે જાણતો હોય, તેનું ચિંતન કરતો હોય, એમ વિચાર પણ કરતો હોય કે આ કઈ રીતે કપાશે ? - આમ કરતાં પણ બંધન તો કપાતું નથી; કારણ કે બંધનને કાપવા માટે તેને જાણવું અને તેનું જ ચિંતન કરવું પર્યાપ્ત નથી; કારણ કે બંધન તો કાપવાથી જ કપાય છે. તેથી બંધનને છેદવા માટે જ્યારે તે આયુધ (હથિયાર) લઈને તે બંધન પર નિશંક થઈને ચલાવે છે તો તે બંધન તૂટી જય છે.

તે જ રીતે જ્ઞાની જ્વલ બુદ્ધિના પ્રયોગથી આત્મા અને કર્મને અલગ-
અલગ કરીને આત્માને ગ્રહણ કરી લે છે.

આ વાત મોક્ષાધિકારની આરંભિક ગાથાઓમાં આવી છે; તેમને જ અહીં છાબડાજુએ પદ્ધતિપે પ્રસ્તુત કરી દીધી છે.

આમ અહીં મોક્ષાધિકાર સમાપ્ત થાય છે.



અને એવી વિષયો હોય કે આ રૂપે કે કે જીવન માટે જીવન
એવી વિષયો હોય કે કે જીવન માટે જીવન

સર્વવિશુદ્ધજ્ઞાનાધિકાર

સર્વવિશુદ્ધજ્ઞાનાધિકાર સર્વવિશુદ્ધજ્ઞાનાધિકાર

સર્વવિશુદ્ધજ્ઞાનાધિકાર સર્વવિશુદ્ધજ્ઞાનાધિકાર

અત્યાર સુધી જીવાળવાધિકારથી માંડીને સંવરાધિકાર સુધી ભગવાન આત્માને પરપદાથો અને વિકારીભાવોથી બિન્ન બતાવીને અનેકપ્રકારે બેદવિજ્ઞાન કરાવવામાં આવ્યું છે. તથા નિર્જરાધિકારમાં બેદવિજ્ઞાનસંપત્ત આત્માનુભવી સમ્યગુદ્ધિતોને ભૂમિકાનુસાર બોગ અને સંયોગોનો યોગ હોવા છતાંપણ બંધ નથી થતો, પરંતુ નિર્જરા થાય છે - એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. બંધાધિકારમાં બંધનાં કારણો પર અને મોક્ષાધિકારમાં મુક્તિનાં ઉપાય પર પ્રકાર પાથરવામાં આવ્યો છે.

હવે આ સર્વવિશુદ્ધજ્ઞાનાધિકારમાં ભગવાન આત્માના અકર્તા-અભોક્તા સર્વવિશુદ્ધજ્ઞાનાધિકારમાં ભગવાન આત્માના અકર્તા-અભોક્તા સર્વવિશુદ્ધજ્ઞાનમય સ્વરૂપને સ્પષ્ટ કરાવી રહ્યા છે.

અન્ય અધિકારોની માફક આ અધિકારનો આરંભ પણ આત્મભ્યાતિ ટીકામાં “અથ પ્રવિશતિ સર્વવિશુદ્ધજ્ઞાનમ् - હવે સર્વવિશુદ્ધજ્ઞાન પ્રવેશ કરે છે.” આ વાક્યથી જ થાય છે. તાત્પર્ય આમ છે કે રંગભૂમિમાં જીવ-અજીવ, કર્તા-કર્મ, પુરુષ-પાપ, આશ્રવ, સંવર, નિર્જરા બંધ અને મોક્ષ - આ આઠ સ્વાંગ આવ્યા અને પોતાનું નૃત્ય બતાવીને, પોતાનું સ્વરૂપ બતાવીને ચાલ્યા ગયા. આપ્રમાણે સર્વ સ્વાંગોનાં ચાલ્યા જતાં હવે એકાકાર

સર્વવિશુદ્ધજ્ઞાન પ્રવેશ કરે છે. ઉક્ત આઠ તો સ્વાંગ હતા, પણ આ સર્વવિશુદ્ધજ્ઞાન સ્વાંગ નથી, આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે.

આત્મભ્યાતિમાં સર્વપ્રથમ મંગલાચરણના રૂપમાં જ્ઞાનપુંજ આત્માનું સમરણ કરે છે. મંગલાચરણનો છંદ મૂળમાં આ પ્રમાણે છે -

(મન્દક્રાન્તા)

નીત્વા સમ્યક્ પ્રલયમખિલાન् કરૃભોકત્રાદિભાવાન्

દૂરીભૂતઃ પ્રતિપદમયં બંધમોક્ષપ્રકલૃપ્તે: ।

શુદ્ધ: શુદ્ધ: સ્વરસવિસરાપૂર્ણપુણ્યાચલાર્ચિ-

ષંકોત્કીર્ણપ્રકટમહિમા સ્ફૂર્જતિ જ્ઞાનપુંજ ॥૧૧૩॥

(હસ્તિત)

કર્તાદિ સર્વે ભાવનો કરીને પ્રલય સમ્યક રીતે,

જે શુદ્ધ આત્મા બંધ-મોક્ષથી દૂર વર્તે પ્રતિપદે;

પાવન અચળ છે તેજ જેનું સ્વરસથી પૂરાગ અહો !

ઉત્કૃષ્ટ મહિમાવંત આત્મા જ્ઞાનપુંજ પ્રગટ થયો. ૧૮૩

કર્તૃત્વ-ભોકતૃત્વ આદિ સમસ્ત વિકારીભાવોનો સારી રીતે પ્રલય (અભાવ) કરીને, પેઢ પેઢ બંધ-મોક્ષની ર્થનાથી દૂર રહેતો થકો, ટંકોતીર્ણ પ્રગટ મહિમાવાળો આ પરમશુદ્ધ જ્ઞાનપુંજ આત્મા નિજરસના વિસ્તારથી પરિપૂર્ણ પવિત્ર અચલ તેજથી સુરાયમાન થઈ રહ્યો છે.

મૂળ છંદમાં ‘શુદ્ધ’ શબ્દનો પ્રયોગ બે વાર થયો છે, તેનો આશય એ છે કે આત્મા દ્રવ્યકર્મ અને ભાવકર્મ - બંનેથી રહિત છે.

નાટક સમયસારમાં આ છંદનો ભાવાનુવાદ કવિત્ર બનારસીદાસજીએ આ પ્રમાણે કર્યો છે -

(सर्वैया इकतीसा)

कर्मनि कौ करता है भोगनि कौ भोगता है,

जाकी प्रभुता मैं ऐसौ कथन अहित है ।

जामें एक इंद्री आदि पंचधा कथन नांहि,

सदा निरदोष बंध मोख साँ रहित है ॥

ग्यान कौ समूह ग्यानगम्य है सुभाव जाकौ,

लोकव्यापी लोकातीत लोक मैं महित है ।

सुद्धबंससुद्धचेतना कै रस अंस भरचौ,

ऐसौ हंस परम पुनीतता सहित है ॥

(दोहा)

जो निहचै निरमल सदा, आदि मध्य अरु अंत ।

सौ चिद्रूप बनारसी, जगत मांहि जयवंत ॥

परमपवित्र भगवान आत्मानि प्रभुतामां - 'आत्मा कर्मोनो कर्ता
छे भोगोनो भोक्ता छे' - आवुं कथन करवुं पाण अहितनी वात छे, उचित
नथी; जे भगवान आत्मामां ऐकेन्द्रिय आदि पांच भेद करवा पाण संभव
नथी; जे सदाय निर्दोष छे अने बंध-भोक्त्वी पाण रहित छे; जेनो स्वभाव
शानगम्य छे अने जे शाननो पुंज छे; लोकव्यापी थईने लोकातीत छे अने
लोकमां सौथी भहान छे; परमपवित्रता सहित - आवा शुद्धवंशवाणा आ
आत्मानो अंशोअंश चेतनाना रसथी भर्यो छे.

निश्चयनयथी जे आत्मा आदि, मध्य अने अंतमां सदाय निर्भण
छे, कविवर बनारसीदासल क्ले छे के ते भगवान आत्मा जगतमां सदाय
जयवंत रहो.

આનાથી પૂર્વના અધિકારોમાં મંગળાચરણના રૂપોમાં જે જ્ઞાનજ્યોતિનું સમરણ કરવામાં આવી રહ્યું છે, તેમને કેવળજ્ઞાનજ્યોતિ અથવા સમ્જજ્ઞાનજ્યોતિ રૂપે જેવામાં આવી રહી છે; પરંતુ સર્વવિશુદ્ધશાનનો અધિકાર હોવાથી અહીં આ જ્ઞાનજ્યોતિની જગાએ બંધ-મોક્ષથી રહિત જ્ઞાનપુંજ આત્માનું સમરણ કરવામાં આવ્યું છે.

ઉક્ત સંદર્ભમાં પંડિત શ્રી જ્યયચંદ્રલ છાબડાનો ભાવાર્થ પણ દર્શાવ્ય છે, જે આ પ્રમાણે છે -

“જ્ઞાનસ્વરૂપ આત્મા જે શુદ્ધનયનો વિષય છે, તે કર્તૃત્વ-ભોક્તૃત્વ ભાવોથી રહિત છે, બંધ-મોક્ષની રચનાથી રહિત છે, પરદ્રવ્ય અને પરદ્રવ્યનાં સમસ્ત ભાવોથી રહિત હોવાથી શુદ્ધ છે, નિજરસના પ્રવાહથી પૂર્ણ દેદીઘ્યમાન જ્યોતિરૂપ છે અને ટંકોતીર્ણ મહિમામય છે. આવો જ્ઞાનપુંજ આત્મા પ્રગટ થાય છે.”

આ કળશનો ભાવ સ્પષ્ટ કરતાં પૂજ્ય ગુરુદેવ કહે છે - “તે ચૈતન્યભાવસ્વરૂપ વસ્તુની અંદર પ્રત્યેક પર્યાય બંધ-મોક્ષની રચનાથી રહિત છે, ત્રિકાળી ધ્યાય દ્રવ્યસ્વરૂપ આત્મા બંધ-મોક્ષની રચનાથી દૂર જ વર્તે છે. ચૈતન્ય ભગવાન આત્મા બંધ અને મોક્ષ બંને દરશાઓની રચનાથી રહિત છે.

ભિથ્યાત્વનું પહેલું ગુણસ્થાન હોય અથવા અયોગી કેવળીનું ચૌદમું ગુણસ્થાન હોય, નરકદશા હોય કે તિર્યાય, મનુષ્યદશા હોય; ભગવાન આત્મા પ્રત્યેક પર્યાયની રચનાથી રહિત છે. આત્મા તો એકલું ચૈતન્ય દ્રવ્ય છે, સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ પર્યાયથી ત્રિકાળ ભિન્ન છે.”

આ પ્રમાણે પ્રત્યેક પર્યાયમાં પર્યાયથી બિન્ન ચૈતન્યરસનો પુંજ પ્રભુ આત્મા ગુણસ્થાન આદિના ભેદોથી બિન્ન જ છે અને તે સ્વભાવના આશ્રયથી જ પ્રગટ થાય છે.^૧

એક કળશમાં જ આચાર્યદ્વારા કેટલું તત્ત્વ (રસ) ભરી દીધું છે. કહે છે કે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યથી પૂર્ણ દેવીભ્યમાન જ્યોતિર્ઝપે નિજરસથી ભરેલો ન્રિકાળ ધ્રુવ-ધ્રુવ પ્રવાહઙ્ગપ છે.

અરે ! પોતાની વસ્તુ કેટલી મહિમાવંત છે, કેટલી કલ્યાણકારી છે; તેની ખબર ન હોવાથી આ અજ્ઞાની લુલ અનંતકકાળથી સંસારમાં ભ્રમણ કરી રહ્યો છે. અનંત વાર તો તે મનુષ્ય પણ થયો, છતાં પણ તેણે પોતાના નિજ વૈભવસંપત્તિ સ્વરૂપને જાણવાની-ઓળખવાની પરવાહ પણ કરી નહીં, ગરજ પણ કરી નહીં. ધર્મના નામે વ્રત, તપ, ભક્તિ-પૂજન આદિ કિયાઓ કરીને પોતાને ધર્માત્મા માનતો રહ્યો. પણ સાચેસાચ તો ધર્મની તો હજ શરૂઆત પણ નથી થઈ. પોતાને જાણ્યા વગર ધર્મ થાય પણ કયાથી ? જે આ બધી કિયાઓ કખાયોની મંદ્રતાવાળી હોય તો પુણ્યબંધ અવશ્ય થાય છે; પરંતુ આ શુભભાવ સ્વરૂપ બાહ્ય કિયાઓથી ધર્મ તો કિંચિત્ પણ થાય નહીં.

અહીં કહે છે કે સત્યદાનન્યમય જ્ઞાનપુંજ પ્રભુ આત્મા આવા પુણ્યના ભાવોથી બિન્ન વસ્તુ છે અને તે સ્વાનુભવથી પ્રગટ થાય છે.^૨

આ રીતે આ કળશમાં શુદ્ધનયના વિષયભૂત ન્રિકાળધ્રુવ ભગવાન આત્માનું સ્મરણ કરતાં થકા તેના પ્રતિ ઝચિ પ્રદર્શિત કરવામાં આવી છે, બહુમાન પ્રગટ કરવામાં આવ્યું છે.

૧ તે જ, પાનું ૪

૨ પ્રવચનરત્નાકર ભાગ ૮, પાનું ૫

હવે આગામી ગાથાઓનું સુચક કળશ કાવ્ય લખે છે; જે આ પ્રમાણે
છે -

(અનુષ્ઠાન)

કર્તૃત્વં ન સ્વભાવોऽસ્ય ચિતો વેદયિતૃત્વવત् ।

અજ્ઞાનાદેવ કર્તાયં તદભાવાકારકા: ॥૧૧૪॥

(હરિગીત)

કર્તાપાણું આ ચિત્સ્વરૂપ આત્મા તાગો ન સ્વભાવ છે,
ભોક્તાપાણું જ્યમ ચિત્સ્વરૂપ આત્મા તાગો ન સ્વભાવ છે;
અજ્ઞાનના કારણ થકી આત્મા બને કર્તા અને
અજ્ઞાનનો જ અભાવ કરીને અકરતા આત્મા બને. ૧૮૪

જે રીતે પરને અથવા રાગાદિને કરવાં તે આત્માનો સ્વભાવ નથી;
તે જ રીતે પરને અથવા રાગાદિને ભોગવવા તે પણ આત્માનો સ્વભાવ નથી.
અજ્ઞાનભાવને કારણે જ આત્મા કર્તા બને છે, અજ્ઞાનના અભાવમાં તે
અકારક જ છે.

ઉક્ત કળશનો ભાવાનુવાદ કવિવર બનારસીદાસજી આ પ્રમાણે કરે
છે.

(ચौપાઈ)

જીવ કરમ કરતા નહિ એસેં, રસ ભોગતા સુભાવ ન તૈસેં ।

મિથ્યામતિ સર્એ કરતા હોડી, ગણે અગ્યાન અકરતા સોડી ॥

જીવ ન તો કર્મનો કર્તા છે અને ન તો કર્મરસનો ભોક્તાપણ છે.
મિથ્યાબુદ્ધિને લીધે જ જીવ કર્મનો કર્તા બને છે અને મિથ્યાબુદ્ધિ (અજ્ઞાન)
જતાં અકર્તા બની જય છે.

આ પ્રમાણે આ કળશમાં એમ જ કહેવાઈ રહ્યું છે કે આ ભગવાન
આત્મા સ્વભાવથી તો કર્મનો કર્તા-ભોક્તા નથી જ; પરંતુ અજ્ઞાનને લીધે

તેનો કર્તા-ભોક્તા બને છે અર્થાત્ તેમનો કર્તા-ભોક્તા પોતાને માને છે;
અજ્ઞાન ચાલી જતાં તેનું તેમ માનવાનું પણ સમાપ્ત થઈ જય છે.

આ પ્રકરણને આગામી ડાયાઓમાં વિસ્તારથી સપદ કરવામાં આવશે. તેથી અહીં વધુ કંઈ લખવાની આવશ્યકતા નથી.



શાનગોષ્ઠી

પ્રશ્ન :- દસ પ્રકારનાં કલ્પવૃક્ષો કયા ?

સમાધાન :- દસ પ્રકારનાં કલ્પવૃક્ષોનું આ પ્રમાણે વર્ણન
કરવામાં આવ્યું છે :-

- (૧) ગૃહાંગ - નાના પ્રકારના ઉત્તમોત્તમ ગૃહ દેવાવાળા છે.
- (૨) ભાજનાંગ - નાના પ્રકારના ઉત્તમોત્તમ પાત્ર દેવાવાળા છે.
- (૩) ભોજનાંગ - નાના પ્રકારના ઉત્તમોત્તમ ભોજન દેવાવાળા છે.
- (૪) પાનાંગ (મધ્યાંગ) - નાના પ્રકારના ઉત્તમોત્તમ મધુરરસ દેવાવાળા છે.
- (૫) વસ્ત્રાંગ - નાના પ્રકારના ઉત્તમોત્તમ વસ્ત્ર દેવાવાળા છે.
- (૬) ભૂષણાંગ - નાના પ્રકારના ઉત્તમોત્તમ રત્નાદિ આભૂષણ દેવાવાળા છે.
- (૭) માલ્યાંગ (કુસુમાંગ) - નાના પ્રકારના ઉત્તમોત્તમ સુગંધ પુષ્પ માળાઓ દેવાવાળા છે.
- (૮) દીપાંગ - ચન્દ્રમા સમાન શીતળ પ્રકાર દેવાવાળા છે.
- (૯) જ્યોતિરાંગ - સૂર્ય સમાન પ્રકાર દેવાવાળા છે.
- (૧૦) તૂર્યાંગ - નાના પ્રકારના ઉત્તમોત્તમ ભેરી આદિ વાજાઓ દેવાવાળા છે.

સમયસાર ગાથા ૩૦૮ થી ૩૧૧

આચાર્ય જ્યસેનના ચિત્તમાં મોક્ષાધિકાર અને સર્વવિશુદ્ધજ્ઞાનાધિકારના વિભાગીકરણના સંબંધમાં કંઈક વિકલ્પ હતો. જે કે તેઓ આત્મભ્યાતિની જેમ ગાથા ૩૦૭ પર જ મોક્ષાધિકારને સમાપ્ત માની લે છે અને ‘મોક્ષો નિષ્ક્રાન્તઃ । અથ પ્રવિશતિ સર્વવિશુદ્ધજ્ઞાનમ्’ પણ લખી નાખે છે; છતાં પણ ૩૨૦ સુધીની ગાથાઓને તેઓ મોક્ષાધિકારની ચૂલિકા કહે છે તથા ૩૨૦ મી. ગાથા પછી લખે છે - મોક્ષાધિકારસંબંધિની ચૂલિકા સમાપ્તા । અથવા દ્વિતીયવ્યારબ્યેનાત્ર મોક્ષાધિકાર: સમાપ્તઃ ।

આ પ્રમાણે તેઓ મોક્ષાધિકારને ત્યાં સમાપ્ત માને છે. તેમની એ વિશેષતા છે કે આચાર્ય અમૃતયંદ્રના મતને સ્વીકારવા છતાં પણ પોતાના વૈકલ્પિક મતને પણ સચિન્ય સ્પષ્ટ કરી દે છે.

આમ આપણે જાણીએ છીએ કે આગામી ૩૦૮ થી ૩૨૦ સુધીની ગાથાઓ મોક્ષાધિકારની ચૂલિકાડિપ સર્વવિશુદ્ધજ્ઞાનાધિકારની આરંભિક ગાથાઓ છે.

આરંભની ચાર ગાથાઓમાં આત્માના અકર્તૃત્વસ્વભાવને સ્પષ્ટ કરવામાં આવ્યો છે. જેવી રીતે આત્મભ્યાતિ ટીકામાં કહેવામાં આવ્યું છે- “અથાત્મનોઽકર્તૃત્વં દૃષ્ટાંત પુરસ્સર - ભારવ્યાતિ - હવે આત્માનું અકર્તૃત્વ દૃષ્ટાંતપૂર્વક સમજાવે છે.”

આમ આપણે જોઈએ છીએ કે આ ગાથાઓમાં આત્માના અકર્તાસ્વભાવને સિદ્ધ કરવામાં આવ્યો છે.

ઉક્ત વાતને સ્પષ્ટ કરતાં આ ગાથાઓની આત્મઘ્યાતિ દીકામાં પર્યાયોને કમનિયમિત કહેવામાં આવી છે; જેના આધારથી પૂજ્ય ગુરુદેવશ્રી કાનલુસ્વામીએ કુમબદ્વપર્યાયના સ્વરૂપને પ્રસ્તુત કર્યું છે. ગુરુદેવની આ કાંતિકારી શોધથી, એક મહાન સત્યનું ઉદ્ઘાટન તો થયું જ, સાથે સમાજને આંદોલિત પણ કરી દીધો.

લાખો લોકોનાં જીવનને પ્રભાવિત કરનાર આ મહાન સિદ્ધાંતે માઝે જીવન પણ આંદોલિત કર્યું અને મારા જીવનને બદલનાર, આધ્યાત્મિક વળાંક આપનાર આ જ સિદ્ધાંત છે. આ વાતનું વિવેચન મેં મારી અન્ય કૃતિ કુમબદ્વપર્યાયની શરૂઆતમાં ‘પોતાની વાત’માં કર્યું છે.

તેના ઉંડાણમાં જવા માટે વિશેષ અધ્યયન અને ગંભીર ચિંતનની આવશ્યકતા છે. આ સિદ્ધાંતની વિશેષ જાણકારી માટે પૂજ્ય ગુરુદેવની કૃતિ જ્ઞાનસ્વભાવ અને જ્ઞેયસ્વભાવ તથા મારી કૃતિ કુમબદ્વપર્યાયનું અધ્યયન કરવું જોઈએ.

આ ગાથાઓનો ભાવ સ્પષ્ટ કરતાં ગુરુદેવે જે કંઈ વિશેષ સ્પષ્ટીકરણ કર્યું છે, તેનો સારાંશ આ પ્રમાણે છે -

“અહીં જે ‘કમનિયમિત’ શબ્દ છે, તેનાથી કમ તો સિદ્ધ છેજ, સાથે જ કમથી નિયમિત-એ પણ સ્પષ્ટ છે. ‘કમનિયમિત’ શબ્દ એમ બતાવે છે કે દ્રવ્યની આ સમયે થવા યોગ્ય પર્યાય જ થશે - એવું નિશ્ચિત છે.”^૧

તાત્પર્ય આમ છે કે જીવમાં જે પર્યાયો જે સમયમાં થવાની હોય છે, તે પોતાના સ્વ-અવસરમાં જ પ્રગટ થાય છે. વર્તમાનમાં જે પર્યાય

^૧ પ્રવચનરત્નાકર ભાગ ૮, પાનું ૧૧

પ્રગટ થાય છે, તે જ પર્યાયની ઉત્પત્તિનો કાળ છે. તે પર્યાયને તે જ જન્મકષણ છે. પ્રત્યેક સમયમાં ઉત્પત્ત થનારી બધી પર્યાયો પોતાના જન્મકષણે જ થાય છે. જે કે વાત સૂક્ષ્મ છે, પણ સર્વજાહેવ દ્વારા જાણેલી દેખેલી અને કહેલી વાત છે.¹

પ્રશ્નઃ- એક બાજુથી એમ કહેવામાં આવે છે કે જીવ તો પોતાની પર્યાયોનો પણ કર્તા નથી અને અહીં એમ કહેવાઈ રહ્યું છે કે જીવનાં પરિણામ જીવ જ છે. આ બંને વાતો એક સાથે કેમ સંબંધી શકે?

ઉત્તરઃ- હા, સંભવી શકે. સમયસાર ગાથા ૩૨૦માં પણ આમ જ કહ્યું છે કે પર્યાયોનો કર્તા જીવ નથી. પર્યાયો પોતાના કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને આધિકરણકૃપ ખદ્કારકોના પરિણામનથી સ્વયં પોતાની મેળે પોતાના સ્વકાળમાં ઉત્પન્ન થાય છે. ચિકાળી દ્રવ્યસ્વભાવની સિક્કિ કરવી છે ને? તેથી ત્યાં કહ્યું છે કે દ્રવ્ય પર્યાયનો કર્તા નથી. આત્માનો અક્ષિય એકરૂપ દ્રવ્યસ્વભાવ છે.

તથા અહીં એમ બતાવવું પ્રયોજનભૂત છે કે કોઈપણ પરદ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યની પર્યાયોનો કર્તા નથી; તેથી અહીં દ્રવ્ય અને પર્યાયને અબેદ કરીને વાત કરી છે કે 'જીવ કમબદ્ધકૃપ પોતાના પરિણામોથી ઉત્પન્ન થતો થકો જીવ જ છે, અણવ નથી જીવની પર્યાયો જીવસ્વકૃપ જ છે' આવી જ વસ્તુસ્થિતિ છે.

ભાઈ! કથનમાં જ્યાં જે અપેક્ષા હોય તેને યથાર્થ - તે જ અપેક્ષાથી સમજવી જોઈએ. આજકાલ આ વિષયમાં અમુક લોકોએ કંઈ વિચાર્યા વગર જ ગઢબદ કરી નાખી છે. તેમનું કહેવું છે કે કમબદ્ધપર્યાય માનવાથી પુરુષાર્થનો લોપ થઈ જશે; કારણ કે જે બધું જ નિયત હોય તો જીવને કરવાનું શું રહી જય છે?

તેમને કહીએ છીએ કે ભાઈ! વસ્તુવ્યવસ્થા તો નિયત અને

¹ પ્રવચનરત્નાકર ભાગ ૬, પાનું ૬૪

સ્વાધીન જ છે. તું આ વસ્તુવ્યવસ્થામાં ફેરફાર કરવાની ચેષ્ટાને પુરુષાર્થ કહે છે; પરંતુ તે પુરુષાર્થ નથી. આ તો તમારો મિથ્યા વિકલ્પ છે. વાસ્તવમાં તો દ્રવ્યની પર્યાય પોતાના સ્વકાળમાં, પરના કર્તાપણા વગર સ્વતંત્ર સ્વાધીનપણે ક્રમબદ્ધપે પોતાની મેળે જ ઉત્પન્ન થાય છે. જેણે આવી શ્રદ્ધા કરી, તે જ સાચો પુરુષાર્થી છે, કારણ કે એવું માનનાર પરથી નિવૃત્ત થઈ સ્વસન્મુખ થાય છે. વાસ્તવમાં સ્વસન્મુખ થવું અને સ્વમાં સ્થિત રહેવું જ સમ્યક પુરુષાર્થ છે.^૧

જેમ સોનાનું કંકણ આદિ પર્યાયોની સાથે તાદાત્મ્ય છે; તેમ બધા દ્રવ્યો પોતપોતાનાં પરિણામોની સાથે તાદાત્મ્ય છે. પોતાના પરિણામોથી ઉત્પન્ન થતા થકા દ્રવ્યના તે પરિણામોનો અન્ય કોઈ કર્તા નથી, તે દ્રવ્ય પોતે જ છે.^૨

અહીં કહે છે કે પોતાના પરિણામોથી ઉત્પન્ન થતા જીવનો અજીવની સાથે કાર્ય-કારણ ભાવ સિદ્ધ થતો નથી.

જડ શરીરમાં જે શરીર, મન, વાણીનું કાર્ય થાય છે, હાથ-પગ હાલે છે, વાણી બોલે છે, આંખોના પલકારા થાય છે, આ બધું જડનું સ્વતંત્ર પરિણામન છે, તેમને જીવ કરતો નથી; કારણ કે બધા જડ-ચેતન દ્રવ્યોને ઓકબીજની સાથે ઉત્પાદ્ય-ઉત્પાદક ભાવનો અભાવ છે.^૩

જુઓ, એક જીવને બીજી કોઈ મરતા જીવની દ્વારા પાળવાનો અથવા રક્ષા કરવાનો ભાવ આવ્યો; તે જ સમયે તે જીવની રક્ષા થઈ ગઈ અર્થાત् તે મરણાસત્ત્ર જીવ બચી ગયો. અહીં કાર્ય-કારણની શોધ કરીએ તો અન્ય જીવની રક્ષા થવી અર્થાત् તેનું જીવિત રહેવું - તે કાર્ય છે, તે કાર્યનો કર્તા કોણ? દ્વારા પાળનાર જીવ કે જે જીવિત રહ્યો તેની ઉપાદાનગત યોગ્યતા?

૧ પ્રવચનરત્નાકર ભાગ ૬, પાનું ૧૬, ૧૭

૨ તે જ, પાનું ૨૫

૩ પ્રવચનરત્નાકર ભાગ ૬, પાનું ૨૫

અહીં આચાર્ય કહે છે કે આ કાર્યનો કર્તા રક્ષા કરવાના ભાવવાળો જીવ નથી, એક જીવના દ્વારાબાળના કારણે બીજે જીવ બચે - એવું ત્રણ કાળમાં પણ સંભવ નથી.^૧

હવે આગળ કહે છે કે તેમનામાં કાર્ય-કારણભાવ સિદ્ધ ન થતાં અજીવ અને જીવનું કર્તાકર્મપણું પણ સિદ્ધ થતું નથી. તેથી શરીરની હળન-ચળન ઇપ કિયાનો કર્તા જીવને માનવો તે યોગ્ય નથી. જેવી રીતે આંખો પરને માત્ર જુઓ જ છે; કોઈનું કંઈ કરતી નથી; તે જ પ્રમાણે જીવ પરને માત્ર જાણી શકે છે, પરનું કંઈ પણ કાર્ય કરી શકતો નથી, કરતો જ નથી. આ વાત વિસ્તારથી ૩૨૦મી ગાથામાં આવનાર છે.

તેથી અજીવને જીવનું કર્મપણું સિદ્ધ થતું નથી. જ્ઞાનાબરણાદિ કર્મોનો જે બંધ થાય છે, તે જીવનું કાર્ય નથી. અરે ! આ પુણ્ય અને પાપના ભાવ, દ્વા-દ્વા-પ્રત આદિના જે વિકલ્પ થાય છે તે ઘરેખર જીવના છે જ નહીં. તેથી તે જીવના કેમ સિદ્ધ થઈ શકે ? કારણ કે વિકારી પરિણામોમાં ચૈતન્યનો અભાવ છે. નિશ્ચયથી તે વિકારી પરિણામ અઙ્ગી અને અચેતન છે.^૨

ભાઈ ! આમ તો સિદ્ધ જ છે કે સંપૂર્ણ બ્રહ્માંડમાં, સારા જગતમાં અનંત પદાર્�ોની પ્રત્યેક પર્યાય પોતાના કમબદ્ધાનુસાર જ થાય છે. તેમાં અન્ય દ્રવ્ય, ગુણ અથવા પર્યાયની કાંઈ પણ અપેક્ષા નથી.

અન્ય વસ્તુ છે જ નહીં, એમ પણ વાત નથી; વસ્તુ છે; પરંતુ વસ્તુને કાર્યક્રમે પરિણામાવામાં અન્ય વસ્તુની બિલ્કુલ અપેક્ષા નથી.^૩

અહા ! આવું અન્ય દ્રવ્યથી નિરપેક્ષ કર્તા-કર્મનું સ્વરૂપ હોવાથી જીવ અને અજીવનું કર્તા-કર્મપણું સિદ્ધ થતું નથી.^૩

૧ તે જ, પાનું ૨૬

૨ પ્રવચનરત્નાકર ભાગ ૮, પાનું ૩૧-૩૨

૩ પ્રવચનરત્નાકર ભાગ ૮, પાનું ૧૩૩

તાત્પર્ય આમ છે કે અજીવમાં જે કાર્ય થાય છે, તેનો કર્તા જીવ નથી; જીવમાં જે કાર્ય થાય છે, તેનો કર્તા અજીવ હોતો નથી. પ્રત્યેક દ્રવ્યના કાર્યમાં અન્ય દ્રવ્યની અપેક્ષા હોતી નથી. પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય પોતાના સ્વકાળમાં પરદ્રવ્યથી સર્વથા નિરપેક્ષ પ્રગટ થાય છે.¹

દ્રવ્યમાં ગુણો સહવર્તી હોય છે, અનંતગુણ દ્રવ્યમાં એકી સાથે રહે છે. પર્યાયો પણ પ્રવાહદ્વારે એક પછી એક પોતાના ક્રમમાં પ્રગટ થાય છે. ધ્યાન રાખો, એક પછી એક થવા છતાં આઠલું વિશેષ છે કે જે સમયે જે પર્યાય થવાની હોય તે નિશ્ચિત છે, તે સમયે તે જ પર્યાય પ્રગટ થાય છે. દ્રવ્યમાં પર્યાયની આવી પ્રવાહધારા ક્રમનિયમિત ચાલે છે. જે પ્રમાણે ડાબા પગ પછી જમણો અને જમણા પછી ડાબો પગ ચાલે છે. પંચાધ્યાયીમાં તેને ક્રમપદ કહે છે.

કાતિકિયાનુપ્રેક્ષામાં દ્રવ્યની જે સમયે જે પર્યાય પ્રગટ થાય છે, તેને તેની કાળલભિદ્ય કહી છે. છયે દ્રવ્યોમાં કાળલભિદ્ય છે - આમ ત્યાં કહ્યું છે.

પ્રવચનસારની ગાથા ૧૦૨માં આ જ વાતને પોત-પોતાની પર્યાયોની જ-મક્ષણ કહી છે.

અહીં એમ બતાવવું છે કે આત્મા પરદ્રવ્યોથી ભિન્ન પોતાના પરિણામોનો કર્તા છે અને પરનો અકર્તા છે.

અહીં એમ વાત નહીં લેતા કે પર્યાયનો કર્તા પર્યાય છે; પર્યાયનો કર્તા દ્રવ્ય નથી. જેકે આ વાત પંચાસ્તિકાયની ફરમી ગાથામાં કરી છે. ત્યાં એમ કહ્યું છે કે પર્યાયનો કર્તા દ્રવ્ય નથી, પરંતુ પર્યાય જ પર્યાયની કર્તા છે, પર્યાય જ કર્મ છે, કરણ છે. પર્યાયનું સંપ્રદાન, અપાદાન અને અધિકરણ પણ સ્વયં પર્યાય છે. આ પ્રમાણે પર્યાય સ્વયં જ પોતાના ઘટકારકોથી પરિણામે છે; પરંતુ અહીં વાત જ જુદી છે. અહીં તો એમ

કહ્યું છે કે પોતાના પરિણામોથી ઉપજતું દ્રવ્ય સ્વયં જ તેનામાં તન્મય છે, અન્ય દ્રવ્યમાં નહીં. તેથી દ્રવ્ય સ્વયં પોતાના પરિણામોનો કર્તા છે, અન્ય દ્રવ્ય તેનો કર્તા નથી.

જીવદ્રવ્યની જ્ઞાનગુણની એક સમયની પર્યાય (કેવળજ્ઞાન) છયે દ્રવ્યોને જાણો છે, સ્વદ્રવ્યને પણ જાણો છે. પરંતુ તે કેવળજ્ઞાન પર્યાય જેવી રીતે સ્વદ્રવ્યમાં તદ્દુપ છે, તેવી અન્ય દ્રવ્યમાં તદ્દુપ નથી. તે કેવળજ્ઞાનની પર્યાય છયે દ્રવ્યોની સાથે એક-મેક નથી. છયે દ્રવ્ય તે પર્યાયમાં પ્રવેશતા નથી. તેથી છ દ્રવ્યોનો કર્તા જ્ઞાન નથી; આત્મા નથી. આત્મા તો પોતાના જ્ઞાન પરિણામોનો કર્તા છે, પરદ્રવ્યનો કર્તા નથી.

આહ ! પ્રત્યેક દ્રવ્ય, પ્રત્યેક આત્મા અને પ્રત્યેક પરમાણુ પોતાના ક્રમનિયમિત ઉપજતા પરિણામોમાં તે સમયે તદ્દુપ છે અને પરથી પૃથક છે. જીવના પરિણામમાં જીવ તદ્દુપ છે તથા અજીવથી પૃથક છે અને અજીવના પરિણામોમાં અજીવ તદ્દુપ છે, તે જીવથી પૃથક છે.

આ પ્રમાણે જીવ પોતાના પરિણામોનો કર્તા છે અને અજીવનો અકર્તા છે. તેવી જ રીતે જગતના અનંત દ્રવ્ય અનંતપણાથી ત્રણે કાળ રહે છે. ભાઈ ! જીવ પોતાના પરિણામને અને અન્યદ્રવ્યના પરિણામને પણ કરે - આવું પદાર્થોનું સ્વરૂપ નથી. તે કારણે જીવ પરનો અકર્તા જ રહે છે.^૧

આ પ્રમાણે આ ગાથાઓમાં ભગવાન આત્માને અકર્તા સિદ્ધ કરવામાં આવ્યો છે.

ઉક્ત કથન અનુસર આત્મા અકર્તા સિદ્ધ થવા છતાં પણ તેને બંધ થાય છે - એ બધો અજ્ઞાનનો મહિમા છે. -

હવે આ આશયનો કળશ આચાર્યદીવ આત્મપ્રાતિમાં લખે છે, જે આ પ્રમાણે છે.

^૧ પ્રવચનરત્નાકર ભાગ ૮, પાનું ૩૪, ૩૫

(शिखरिणी)

अकर्ता जीवोऽयं स्थित इति विशुद्धः स्वरसतः
स्फूरच्चिज्ज्योतिर्भिर्श्छुरितभुवनाभोग भवनः ।
तथाप्यस्यासौ स्याद्यदिह किल बंधः प्रकृतिभिः
स खल्वज्ञानस्य स्फुरित महिमा कोऽपि गहनः ॥११५॥

(हठिणीत)

विशुद्ध છે નિજરસથી, જેનો લોકવ્યાપી સ્વભાવ છે,
યૈતન્યજ્યોતિ જીવ આ રીત અકર्ता પરનો કરે
તોપાગ થતો જે બંધ તેને, વિવિધ કર્માથી અરે,
તે તો સ્કૂરે છે ગહન કો અજ્ઞાનનો મહિમા ખરે ! १८५

જેના જ્ઞાનસ્વભાવમાં લોકનો સમસ્ત વિસ્તાર વ્યાપી જય છે,
નિજરસથી વિશુદ્ધ એવો આ જીવ અકર्ता જ સિદ્ધ છે; છતાં પણ તેને
આ જગતમાં કર્મની પ્રકૃતિઓની સાથે બંધ થાય છે. ખરેખર આ બધો
અજ્ઞાનનો ગૂઢ મહિમા છે.

આચાર્યિંદ્ર અહીં બતાવી રહ્યા છે કે ભગવાન આત્મા અકર्तા જ
છે છતાં પણ તેને અજ્ઞાન અવસ્થામાં બંધ થાય છે. તાત્પર્ય છે કે બંધનું
મૂળ કારણ અજ્ઞાન છે.

આ કળશનો ભાવાનુવાદ કવિવર ભનારસીદાસજી નાટક સમયસારમાં
આ પ્રમાણે કરે છે -

(સવૈયા ઇકતીસા)

નિહચૈ નિહારત સુભાવ યાહિ આત્મા કૌ,
આત્મીક ધરમ પરમ પરકાસના ।
અતીત અનાગત બરતમાન કાલ જાકૌ,
કેવલ સ્વરૂપ ગુણ લોકાલોક ભાસના ॥

સોઈ જીવ સંસાર અવસ્થા માંહિ કરમ કૌ,
 કરતા સૌ દીસૈ લીએં ભરમ ઉપાસના ।
 યહે મહા મોહ કૌ પસાર યહે મિથ્યાચાર,
 યહે ભો વિકાર યહ વિવહાર વાસના ॥

નિશ્ચયનયથી જેતાં આ આત્માનો સ્વભાવ સ્વ-પરપ્રકાશક છે અને આ લોકાલોકના બધા દ્રવ્ય, તેમના ગુણો અને તે દ્રવ્ય-ગુણોની ભૂત, ભવિષ્ય અને વર્તમાનની બધી પર્યાયો તેમાં પ્રતિભાસિત થાય છે. આ જીવ સંસારાચવસ્થામાં કર્મોને કરતો દેખાય છે. આ બધો ભ્રમ છે, મોહનો પ્રસાર છે, મિથ્યાચાર છે, ભવનો વિકાર છે અને વ્યવહારની વાસના છે. વ્યવહારનયનું કથન છે. વ્યવહારનયના વિષયભૂત આત્માનો અશુદ્ધસ્વભાવ છે.

આ કળશનો ભાવ પૂજ્ય ગુરુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે. “જુઓ, આ આત્મા સ્વભાવથી અકર્તા હોવા છતાં કર્તા કેવી રીતે થઈ જય છે? - આ વાત ચાલી રહી છે. અહીં કહ્યું છે કે આત્મા નિજરસથી અર્થત્ સ્વભાવથી રાગરહિત છે, નિર્મળ છે. આવી સ્કુરાયમાન થતી નિર્મળ ચૈતન્યન્યોતિથી આ આત્માનો વિસ્તાર સમસ્ત લોકમાં વ્યાપી જય છે. ભગવાન આત્મા ત્રણ લોક અને ત્રણ કાળમાં જેટલા પણ અનંતાનંત દ્રવ્ય-ગુણ-પર્યાય છે, એ બધાને ક્ષાણભરમાં જાણવાની શક્તિવાળો સર્વજસ્વભાવી તો છે; પરંતુ લોકાલોકની કોઈ વસ્તુમાં જરા પણ ફેરફાર કરી શકે એવી યોગ્યતા આત્મામાં નથી. તાત્પર્ય એ છે કે ભગવાન આત્મા અકર્તાસ્વભાવી છે.¹

આ રીતે જીવ પરદ્રવ્યનો તથા પરભાવોનો અકર્તા સિદ્ધ થાય છે છતાં પણ આ જગતમાં આત્માને કર્મપદ્ધતિ સાથે બંધ થાય છે - તે કોઈ અશાનની ગાઢ મહિમા છે.

¹ પ્રવચનરત્નાકર (હિન્ડી) ભાગ ૮, પાનું ૩૮

સર્વજ્ઞસ્વભાવી હોવા છતાં પણ નિજ-સ્વભાવના ભાન વગર અન્તં ભૂતકાળથી તેણે દ્યા-દાન-પ્રતાણિનાં રાગને પોતાની ચીજ માની. તેને લાભપ્રદ માન્યા, તેને પોતાનું કર્તવ્ય માન્યું. બસ આ જ તેનું અજ્ઞાન છે. આ અજ્ઞાનથી જ બંધ થાય છે. તેનાથી વિપરીત શાતા-દાટાડૃપ જ્ઞાનભાવ અબંધડૃપ છે.

બસ અહીં એ જ સિદ્ધ કરવામાં આવ્યું છે કે આ અજ્ઞાનભાવ જ બંધ છે.

ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યનો પૂજ નિકાળ એક શાતા-દાટાસ્વભાવી વસ્તુ છે. તેને દાચિમાં પોતાડૃપ સ્વીકાર કરવો તે જ્ઞાનભાવ છે અને તે આત્મજ્ઞાન અબંધડૃપ છે.

આહ ! પોતાની આવી નિકાળ વિદ્યમાન વસ્તુને ન માનીને સ્વીકાર ન કરીને તેને અન્યથા માની લેવી તે આત્મધાત છે. તે ભાવહિંસા છે. તેનાથી જ જીવને બંધ થાય છે, કે જે ચાર ગતિમાં રખડવાનું કારણ છે.””

આ પ્રમાણે આ કળશમાં એમ જ કહેવામાં આવ્યું છે કે બંધનું કારણ એકમાત્ર અજ્ઞાનભાવ જ છે.



શાનગોઠી

પ્રશ્ન :- ભોગભૂમિમાં તિર્યચ ક્યો જીવ થાય છે ?

સમાધાન :- તિલોયપણિતિમાં આમ કદ્યું છે - ‘જે પાપી જિનલિંગને ગ્રહણ કરીને સંયમ તથા સમ્યકત્વ ભાવને છોડી દે છે અને પશ્ચાત્ માયામાં પ્રવૃત્ત થઈને ચરિત્રને નષ્ટ કરે છે. તથા જે કોઈ મૂર્ખ મનુષ્ય કુલિંગિઓને નાના પ્રકારનાં દાન દેય છે યા તેના વેશને ધારણ કરે છે, તે ભોગભૂમિમાં તિર્યચ થાય છે.

સમયસાર ગાથા ૩૧૨-૩૧૩

ચેદા દુ પયડીઅડુ ઉપ્પજ્જડ વિણસ્સડ િ ।
 પયડી વિ ચેયયડું ઉપ્પજ્જડ વિણસ્સડ ॥૩૧૨॥

એવ બંધો ઉ દોણહં પિ અણોણણપ્પચ્ચયા હવે ।
 અધ્યણો પયડીએ ય સંસારો તેણ જાયદે ॥૩૧૩॥

(હરિગીત)

પાણ જીવ પ્રકૃતિના નિમિત્તે ઉપજે વિણસે અરે !
 ને પ્રકૃતિ પાણ જીવના નિમિત્ત ઉપજે વિણસે; ૩૧૨
 અન્યોન્યના નિમિત્ત એ રીત બંધ બેઉ તાણો બને
 -આત્મા અને પ્રકૃતિ તાણો, સંસાર તેથી થાય છે. ૩૧૩

ચેતન આત્મા પ્રકૃતિના નિમિત્તથી ઉત્પન્ન થાય છે અને નષ્ટ
 થાય છે. તેવી જ રીતે પ્રકૃતિ પણ ચેતન આત્માના નિમિત્તે ઉત્પન્ન થાય
 છે અને નષ્ટ થાય છે. આ રીતે પરસ્પર નિમિત્તથી આત્મા અને પ્રકૃતિ
 બંન્ધને બંધ થાય છે અને તેનાથી સંસાર થાય છે.

આ ગાથાઓનો ભાવ આત્મભ્યાતિમાં આ પ્રમાણે સ્પષ્ટ કરવામાં
 આવ્યો છે.

“આ આત્માને અનાદિથી જ પોતાનાં અને પરનાં નિશ્ચિત લક્ષણોનું જ્ઞાન ન હોવાથી સ્વ અને પરના એકત્વનો અભ્યાસ કરવાથી કર્તા થયો થકો પ્રકૃતિના નિભિતે ઉત્પત્તિ-વિનાશ પામે છે; પ્રકૃતિ પણ આત્માના નિભિતે ઉત્પત્તિ-વિનાશ પામે છે.

એ રીતે-ને કે તે આત્મા અને પ્રકૃતિને કર્તા-કર્મ ભાવનો અભાવ હોવા છતાં પણ પરસ્પર નિભિત્ત-નૈભિત્તિકભાવથી બંનેને બંધ જોવામાં આવે છે. તેનાથી જ સંસાર છે અને તેનાથી આત્મા અને પ્રકૃતિને કર્તા-કર્મનો વ્યવહાર છે.”

આચાર્ય જ્યસેન તાત્પર્યવૃત્તિમાં આ ગાથાઓનો અર્થ કરતાં એ વાતનો વિશેષ ઉલ્લેખ કરે છે કે સ્વસ્થભાવથી ચ્યુત થતો થકો આત્મા કર્મોદ્યને નિભિત્ત બનાવીને વિભાવભાવઢપે પરિણામે છે. તેઓ સ્વસ્થભાવથી ચ્યુત થવા પર વિશેષ બળ આવે છે. તાત્પર્ય આમ છે કે આત્મા સ્વસ્થભાવથી ચ્યુત થતાં પોતાના અપરાધથી જ વિકારઢપે પરિણામે છે, કર્મોથી બંધાય છે; કોઈ પરપદાર્થના કારણે નહીં, નિભિત્તના કારણે નહીં.

આ ગાથાઓનો ભાવ પૂજ્ય ગુરુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે.

“જુઓ, અહીં પ્રથમ ચાર ગાથાઓમાં જીવનું અકર્તાપણું સિદ્ધ કર્યું છે. હવે પ્રશ્ન ઉઠ છે કે આ જીવ રાગાદિનો કર્તા કેવી રીતે બને છે?

ઉત્તરમાં કહી રહ્યા છે કે જ્યારે જીવ સ્વભાવનું આતંબન છોડીને કર્મપ્રકૃતિઓને આધીન થઈ પરિણામે છે, ત્યારે તે વિકારભાવોનો કર્તા થઈને ઉત્પન્ન-વિનષ્ટ થાય છે.

અહા ! શુદ્ધ ઉપાદાન વગર પરવસ્તુઓને આધીન થઈ જેઓ અશુદ્ધ ઉપાદાનઢપે પરિણામે છે, તેઓ અશુદ્ધતાના, રાગાદિ અજ્ઞાનમયભાવોના કર્તા બને છે.

જગતજન દ્વા-દાન-પ્રત-ભક્તિ-પૂજા-યાત્રા આદિ શુભરાગના પરિણમનથી ધર્મ થવો માને છે; પરંતુ તે એમની મિથ્યા માન્યતા છે; કારણ કે આવી માન્યતા તો રાગ સાથેના એકત્વના અધ્યાસવાળી છે. અહા ! સ્વભાવની રૂપી અને સ્વભાવ તરફનો ઝુકાવ ન હોવાથી અજાની જીવ કર્મોદ્દ્ય પ્રતિ ઝુકાવ કરીને વિકારઢ્યે પરિણમે છે અને તે વિકારનો કર્તા બને છે. પણ રાગનો કર્તા બને - તેવો જીવનો સ્વભાવ નથી. છતાં પણ જીવ રાગ સાથેની એકત્વબુદ્ધિના કારણે પોતામાં થયેલ દીર્ઘ સંસારના કારણભૂત રાગનો કર્તા બને છે.

જુઓ, અહીં કહે છે કે અજાની વિકારીભાવોનો કર્તા થયો થકો કર્મપ્રકૃતિના નિમિત્તે જન્મ-મરણને પ્રાપ્ત થાય છે. તાત્પર્ય આમ છે કે અજાની જીવ સ્વયં પરનો અથવા વિકારનો કર્તા બનીને સ્વયં વિકારભાવથી ઉત્પન્ન-વિનષ્ટ થાય છે અને કર્મ પ્રકૃતિઓનો ઉદ્દ્ય તેમાં નિમિત્તમાત્ર જ છે. કર્મપ્રકૃતિ જીવમાં વિકાર કરાવતી નથી જીવ સ્વયં જ કર્મપ્રકૃતિને ઉદ્યાધીન થઈને વિકારઢ્યે પરિણમે છે વિકારઢ્યથી ઉત્પન્ન-વિનષ્ટ થવું અજાનીજીવનું પોતાનું કાર્ય છે. તેમનો કર્તા સ્વયં અજાની છે, તેને વિકારઢ્યે ઉત્પન્ન-વિનષ્ટ થવામાં કર્મપ્રકૃતિઓનું કોઈ કાર્ય નથી. તે તો માત્ર નિમિત્તઢ્યે ઉપસ્થિત રહે છે.

હવે કહે છે કે કર્મપ્રકૃતિઓનો આત્માની સાથે માત્ર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, કર્તા-કર્મ સંબંધ નથી.

પહેલા એમ કહ્યું હતું કે ‘અજાની જીવ રાગનો કર્તા થઈને કર્મપ્રકૃતિના નિમિત્તથી ઉત્પત્તિ-વિનાશને પ્રાપ્ત થાય છે. હવે કહે છે કે ‘જડકર્મની પ્રકૃતિઓ પણ આત્માના રાગ આદિ પરિણામોના નિમિત્તથી ઉત્પન્ન-વિનષ્ટ થાય છે ?

પ્રકૃતિઓનો જે નવીન બંધ થાય છે, તેમાં આત્માના વિકારી પરિણામ નિમિત્તમાત્ર થાય છે. તે વિકારી પરિણામ પ્રકૃતિબંધના કર્તા થતા નથી. જીવના વિકારી પરિણામ તે કર્તા અને જડકર્મનો બંધ તે કર્મ - એવો

કર્તા-કર્મ સંબંધ જીવ અને જડકર્મોની સા�ે ત્રણે કાળેમાં ક્યારેય સંભવ નથી. જડકર્મપ્રકૃતિઓ પોતાની પર્યાયગત યોગ્યતાથી બંધાય છે, તેમાં આત્માના વિકારી પરિણામ નિમિત્તમાત્ર થાય છે જેવી રીતે જીવના વિકારી પરિણામ પોતાની તત્ત્વમયની યોગ્યતાથી થાય છે અને તેમાં પૂર્વબદ્ધ કર્મોનો ઉદ્ય નિમિત્તમાત્ર હોય છે; તેવી જ રીતે નવીન કર્મપ્રકૃતિઓ બંધાવામાં જીવના વિકારી પરિણામ નિમિત્ત હોય છે. એક બીજેમાં કર્તા-કર્મ ભાવ નથી, માત્ર નિમિત્ત નૈમિત્તિક ભાવ છે.^૧

આ પ્રમાણે આત્મા અને કર્મપ્રકૃતિ બંનેમાં પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક ભાવથી બંધ જેવામાં આવે છે; પરંતુ ત્યાં બંનેમાં કર્તાકર્મભાવનો અભાવ છે. જ્યારે આત્મા પોતાના ક્રમબદ્ધપરિણામોથી પરિણામતો થકો વિકારીભાવકુપે ઉત્પન્ન થાય છે, ત્યારે તેમાં કર્મોદ્ય નિમિત્ત છે તથા જ્યારે કર્મપ્રકૃતિ પોતાના ક્રમબદ્ધપરિણામોથી પરિણામિત થતી થકી બંધભાવે ઉત્પન્ન થાય છે ત્યારે આત્માના વિકારીભાવ તેમાં નિમિત્ત થાય છે. બસ આવા પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક ભાવથી બંનેને બંધ થાય છે. ભાઈ ! જે પણ કાર્ય ઉત્પન્ન થાય છે, તેમાં બીજી વસ્તુ અવશ્ય નિમિત્ત હોય છે; પરંતુ નિમિત્તથી કાર્ય થતું નથી.^૨

પૂર્વબદ્ધ જડ કર્મપ્રકૃતિના ઉદ્યના નિમિત્તથી થયેલ આત્માનો વિકારીભાવ ભાવબંધ છે અને જડ કર્મપ્રકૃતિઓનું બંધાવું તે દ્રવ્યબંધ છે. તેમનામાં પરસ્પર નિમિત્ત-નૈમિત્તક સંબંધ તો છે પરંતુ કર્તા-કર્મ સંબંધી નથી.^૩

લોકોને અજ્ઞાન અને મિથ્યાત્વને લીધે પરની સાથે કર્તા-કર્મનો અધ્યાસ (ભ્રમ) થઈ રહ્યો છે. તે જ સંસાર પરિભ્રમણનું મૂળ કારણ છે.”^૪

ઉક્ત સંપૂર્ણ કથનનું તાત્પર્ય આમ છે કે આત્મા અને કર્મપ્રકૃતિઓનો જે બંધ થાય છે; તેમાં આત્મા કર્તા અને કર્મપ્રકૃતિઓનો બંધ તે કર્મ એવું

^૧ પ્રવચનરત્નાકર ભાગ ૬, પાનું ૪૫-૪૬

^૨ પ્રવચનરત્નાકર ભાગ ૬, પાનું ૪૬-૪૭

^૩ પ્રવચનરત્નાકર ભાગ ૬, પાનું ૪૮

નથી. આ વાત વ્યવહારથી ભલે કહેવામાં આવે, પણ નિશ્ચયથી આ વાત સાચી નથી. આ પ્રમાણે અહીં એમ કહેવામાં આવ્યું છે કે આત્મા અને જ્ઞાનાવરણાદિ કર્મોની પ્રકૃતિઓ વચ્ચે પરમાર્થથી કર્તા-કર્મભાવનો અભાવ છે છતાં પણ જે બંધ થાય છે તેનું કારણ પરસ્પરમાં રહેનાર નિમિત્ત-નૈમિત્તિક ભાવ છે; સંસાર તેનાથી જ થાય છે. તેથી જ વ્યવહારથી તેમની વચ્ચે કર્તા-કર્મભાવ કહેવામાં આવે છે.

આ વાતને ભાવાર્થમાં પંડિત જ્યયંદળ છાખડા આ પ્રમાણે સ્પષ્ટ કરે છે -

“આત્મા અને જ્ઞાનાવરણાદિ કર્મોની પ્રકૃતિઓ વચ્ચે પરમાર્થથી કર્તા-કર્મભાવનો અભાવ છે; છતાં પણ પરસ્પર નિમિત્ત-નૈમિત્તિકભાવને લીધે બંધ થાય છે, તેથી સંસાર છે અને તેથી જ કર્તા-કર્મપણાનો વ્યવહાર છે.”

આ પ્રમાણે આ ગાથાઓમાં એમ જ કહેવામાં આવ્યું છે કે નિશ્ચયથી તો આત્મા અને કર્મમાં કર્તા-કર્મ ભાવનો અભાવ છે; છતાં પણ પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક ભાવોથી બંનેને બંધ થાય છે અને તે જ કારણે આત્મા અને કર્મમાં કર્તા અને કર્મનો વ્યવહાર પ્રચલિત છે.



ગ્રાનગોઠી

પ્રશ્ન :- સોળ ભાવનાઓ કઈ કઈ ?

સમાધાન :- તીર્થકર પ્રકૃતિના બંધમાં કારણ આ સોળ ભાવનાઓ આગમમાં કહેવામાં આવી છે. (૧) દર્શન વિશુદ્ધિ (૨) વિનયસમૃપત્તા (૩) શીલ વ્રતેષ્વનતિચાર (૪) અભિક્ષણજ્ઞાનોપયોગ (૫) સંવેગ (૬) શક્તિતસ્ત્યાગ (૭) શક્તિતસ્તાપ (૮) સાધુસમાધિ (૯) વૈયાવૃત્યકરણ (૧૦) અર્હત્ર-ભક્તિ (૧૧) આચાર્યભક્તિ (૧૨) બહુશ્રુતભક્તિ (૧૩) પ્રવચનભક્તિ (૧૪) આવશ્યક પરિહાણ (૧૫) માર્ગ પ્રભાવના (૧૬) પ્રવચનવત્સલત્વ. આ સોળ પ્રકારની શ્રેષ્ઠ ભાવનાઓ દ્વારા શ્રેષ્ઠપદ તીર્થકરત્વની પ્રાપ્તિ થાય છે.

સમયસાર ગાથા ૩૧૪-૩૧૫

હવે આ ૩૧૪-૩૧૫ ગાથાઓમાં કહે છે કે જ્યાં સુધી આ આત્મા કર્મપ્રકૃતિઓના નિમિત્તથી ઉપજવું-વિલસવું છોડતો નથી, ત્યાં સુધી અજ્ઞાની રહે છે, મિથ્યાદાષિ રહે છે, અસંયમી રહે છે.

જા એસ પયડીઅઙ્ગ ચેદા ણેવ વિમુંચએ ।
અયાણાં હવે તાવ મિચ્છાદિઢી અસંજાઓ ॥૩૧૪॥

જદા વિમુંચએ ચેદા કર્મફલમણંતયં ।
તદા વિમુજ્ઞો હવદિ જાણાં પાસાં મુણી ॥૩૧૫॥

(હશિગીત)

ઉત્પાદ-વ્યય પ્રકૃતિનિમિત્તે જ્યાં લગી નહિ પરિતને,
અજ્ઞાની મિથ્યાત્વી, અસંયત ત્યાં લગી આ જીવ રહે; ૩૧૪
આ આત્મા જ્યારે કરેમનું ફળ અનંતું પરિતને,
જ્ઞાયક તથા દર્શક નથા મુનિ તેણ કર્મવિમુક્ત છે. ૩૧૫

જ્યાંસુધી આ આત્મા પ્રકૃતિના નિમિત્તથી ઉપજવું-વિલસવું છોડતો નથી ત્યાંસુધી તે અજ્ઞાની છે, અસંયત છે.

જ્યારે આ આત્મા અનંત કર્મફળને છોડે છે; ત્યારે તે જ્ઞાયક છે,
જ્ઞાની છે, દર્શક છે, મુનિ છે અને વિમુક્ત છે અર્થાત્ બંધથી રહિત છે.

આત્મઘ્યાતિમાં આ ગાથાઓનો અર્થ આ પ્રમાણે કર્યો છે.

“સ્વ અને પરનાં બિજ્ઞ-બિજ્ઞ નિશ્ચિત સ્વલક્ષણોનું જ્ઞાન (બેદજ્ઞાન) ન હોવાથી, જ્યાંસુધી આ આત્મા બંધના નિમિત્તભૂત પ્રકૃતિસ્વભાવને છોડતો નથી; ત્યાંસુધી સ્વ-પરના એકત્વજ્ઞાનથી અજ્ઞાયક (અજ્ઞાની) છે, સ્વ-પરના એકત્વદર્શનથી (એકત્વકૃપ શ્રદ્ધાનથી) મિથ્યાદાચિ છે અને સ્વપરના એકત્વ પરિણતિથી અસંયત છે અને ત્યાંસુધી જ પરના અને પોતાના એકત્વનો અધ્યાસ કરવાથી કર્તા છે.

જ્યારે આ જ આત્મા સ્વ અને પરના બિજ્ઞ-બિજ્ઞ નિશ્ચિત સ્વલક્ષણોના જ્ઞાનને (બેદજ્ઞાનને) લીધે, પ્રકૃતિના સ્વભાવને-કે જે પોતાને બંધનું નિમિત્ત છે તેને-છોડે છે, ત્યારે સ્વ-પરના વિભાગજ્ઞાનથી (બેદજ્ઞાનથી) જ્ઞાયક છે, સ્વ-પરના વિભાગદર્શનથી (બેદજ્ઞાનથી) દર્શક છે અને સ્વ-પરની વિભાગપરિણતિથી (બેદપરિણતિથી) સંયત છે; અને ત્યારે જ પરના અને પોતાના એકત્વનો અધ્યાસ નહિ કરવાથી અકર્તા છે.”

ઉક્ત ગાથાઓ અને ટીકાનાં ભાવને સ્પષ્ટ કરતાં ભાવાર્થમાં પંડિત જ્યયચંદ્ર છાબડા લખે છે -

“જ્યાં સુધી આ આત્મા સ્વ-પરના લક્ષણને જ્ઞાનતો નથી, ત્યાંસુધી તે બેદજ્ઞાનના અભાવને લીધે કર્મપ્રકૃતિનાં ઉદ્ઘયને પોતાનો સમજુને પરિણામે છે; આમ મિથ્યાદાચિ, અજ્ઞાની, અસંયમી થઈને, કર્તા થઈને કર્મનો બંધ કરે છે અને જ્યારે આત્માને બેદજ્ઞાન થાય છે, ત્યારે તે કર્તા થતો નથી; તેથી કર્મનો બંધ કરતો નથી, જ્ઞાતા-દાષ્ટકૃપે પરિણામે છે.”

આચાર્ય જ્યયસેન તાત્પર્યવૃત્તિમાં ઉક્ત ગાથાઓનો અર્થ આત્મઘ્યાતિના અનુસારે કરતાં પણ અંતમાં નયવિભાગને આ પ્રમાણે સ્પષ્ટ કરે છે -

“આ રીતે જે કે આ આત્મા શુદ્ધનિશ્ચયનયથી કર્તા નથી; તો પણ

અનાદિકાળીન કર્મબંધને વશ થઈ મિથ્યાત્વ અને રાગાદ્વિપ અજ્ઞાનભાવથી કર્મને બાંધે છે. આ પ્રમાણે અજ્ઞાનનું સામર્થ્ય બતાવવા માટે લખેલી બીજ સ્થળની ચાર ગાથાઓ સમાપ્ત થઈ.”

ઉક્ત પ્રકરણનું સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવ આ પ્રમાણે કરે છે.

“સંસારી જીવને અનાદિથી જ સ્વ-પરના નિશ્ચિત સ્વ-લક્ષણોનું જ્ઞાન નથી. આ રીતે અનાદિથી જ તે નિમિત્તાધીન રહ્યો છે. સ્વાધીનતા પ્રગટ થઈ જ નથી. આવી સ્થિતિમાં કર્મપ્રકૃતિઓને ઉદ્ઘાધીન થઈને તેને જે ભાવ થાય છે, તે નવીન કર્મબંધનું કારણ બને છે. જ્યાંસુધી જીવ કર્મપ્રકૃતિઓની આધીનતા નહીં છોડે, ત્યાં સુધી તે સ્વ-પરના એકત્વના કારણે અજ્ઞાની રહે છે.

તથા સ્વ-પરનું બેદજ્ઞાન ન હોવાથી જ્યાં સુધી તે પ્રકૃતિસ્વભાવને છોડતો નથી, ત્યાંસુધી સ્વ-પરના એકત્વદર્શનથી-એકપણાની શ્રદ્ધાથી મિથ્યાદાચિ છે.

તાત્પર્ય આ છે કે ભગવાન આત્મા શુદ્ધ એક જ્ઞાનાંદ્રસ્વભાવી પ્રભુ નિત્ય છે અને શુભાશુભ વિકલ્પોની જે વિકૃત વૃત્તિઓ ઉઠ છે; તે બધો કર્મપ્રકૃતિનો સ્વભાવ છે. જ્યાં સુધી જીવ આ બંધના નિમિત્તભૂત કર્મપ્રકૃતિના સ્વભાવોને છોડતો નથી ત્યાંસુધી સ્વ-પરના એકત્વના શ્રદ્ધાનથી મિથ્યાદાચિ છે.¹

તથા તે અજ્ઞાની જીવ સ્વ-પરની એકત્વ પરિણતિથી અસંયત છે અર્થાત્ રાગની સાથે એકમેક થઈને પ્રવર્તતવાને લીધે અસંયત છે. તે પ્રતી નથી, સંયમી નથી, સમક્રિતી પણ નથી. સમ્યગ્દર્શન વગર જ્યાં સુધી એકલી રાગમય પરિણતિ છે, ત્યાંસુધી જીવ અસંયત છે.

આ રીતે આ પ્રકરણમાં ત્રણ વાતો આવી.

- (૧) જ્યાં સુધી સ્વ-પરનું જ્ઞાન નથી, ત્યાંસુધી અજ્ઞાની છે.
- (૨) સ્વ પરના એકત્વ શ્રદ્ધાનથી જીવ મિથ્યાદાચિ છે.
- (૩) સ્વપરિણાતિને છોડીને પુણ્ય-પાપની પરિણાતિકૃપ પરિણામવાને કારણે અસંયત છે.^૧

હવે કહે છે કે 'ત્યાં સુધી જ તે સ્વ અને પરના એકત્વના અભ્યાસથી કર્તા છે.'

અહા ! ભગવાન આત્માનો તો એક જ્ઞાતા-દાખા સ્વભાવ છે; પરંતુ અજ્ઞાનીને સ્વ-પરના એકત્વનો અધ્યાસ થઈ ગયો છે. રાગને પોતાનો સ્વભાવ માનવાની અજ્ઞાનીને આદત પડી ગઈ છે. જ્યાં સુધી તેને આવો અધ્યાસ રહેશે, ત્યાં સુધી તેને પરનું કર્તૃત્વ રહેશે જ.^૨

સ્વ-પરના એકત્વકૃપ અભ્યાસને કારણે જીવને આવા અકથનીય દુઃખ ભોગવવા પડ્યા છે. જ્યાં સુધી તેને સ્વ-પરના એકત્વકૃપ અધ્યાસ છે, ત્યાંસુધી જીવ રાગને પોતાનો માનીને પરદ્રવ્યોનો અને રાગનો કર્તા બની રહે છે, આ જ એના જન્મમરણકૃપ દુઃખનું બીજ છે.

ઉપર્યુક્ત શાયક, દર્શક અને સંયતના ત્રણ બોલથી એમ સિદ્ધ કરે છે કે જીવ રાગનો અકર્તા છે. 'કર્મપ્રકૃતિના ઉદ્ઘથી થતો ભાવકર્મનો સ્વભાવ રાગકૃપ હોવાથી દુઃખસ્વકૃપ છે. એક સમયની કૃત્રિમ ઉપાધિ છે. તેનાથી વિપરીત હું તો પરમાનંદમય શુદ્ધ ચૈતન્યસ્વકૃપ ત્રિકાળ નિકૃપાધિક તત્ત્વ છું.'

આ પ્રમાણે આત્મા અને રાગ બંનેના બિત્ત બિત્ત લક્ષણોનું જ્ઞાન થતાં ભેદજ્ઞાન થાય છે. આવું ભેદજ્ઞાન થતાં જીવ પ્રકૃતિજન્ય વિભાવભાવોને છોડી દે છે અને સ્વપરના ભેદવિજ્ઞાનથી શાયક થઈ જય છે.

૧ પ્રવચનરત્નાકર ભાગ ૬, પાનું ૫૩

૨ પ્રવચનરત્નાકર ભાગ ૬, પાનું ૫૪-૫૫

આ પુણ્ય-પાપના ભાવ કર્મોદ્યના નિમિત્તથી ઉત્પન્ન થયા છે; આ કારણથી તે પ્રકૃતિનો સ્વભાવ છે, આત્માનો નહીં. આવું બેદજ્ઞાન જેને અંતરમાં થયું, તે પ્રકૃતિના સ્વભાવને છોડી હે છે અને ત્યારે તે સ્વ-પરના વિભાગથી જ્ઞાની થાય છે.^૧

આ પ્રમાણે ઉપર્યુક્ત જ્ઞાયક, દર્શક સંયત એમ ત્રણ બોલનું સ્પષ્ટીકરણ થયું.

જુઓ, જ્યાં સુધી સ્વ-પરના એકત્વનો અધ્યાસ હતો, ત્યાં સુધી જીવ અજ્ઞાની અને કર્તા હતો, પરંતુ સ્વ-પરના એકત્વનો અધ્યાસ દૂર થતાં તે જ્ઞાની બનીને અકર્તા થઈ જય છે. ચોથા ગુણસ્થાને આત્માનું ભાન થઈને જ્યાં સમ્યગ્દર્શન થયું, ત્યાં જ તે રાગનો અકર્તા થઈ જય છે. બલે રાગ વિધમાન રહે, તો પણ તે તેનો અકર્તા અર્થાત્ જ્ઞાતા જ છે. બસ આનું જ નામ ધર્મ અને મોક્ષમાર્ગ છે.

જુઓ, આત્માનું લક્ષણ જ્ઞાન છે અને કર્મ પ્રકૃતિઓનું લક્ષણ રાગ છે, બંધ છે. રાગ શુભ હો કે અશુભ, બંને પ્રકારનો રાગ કર્મપ્રકૃતિનો સ્વભાવ છે, જીવનો નહીં. જીવનો તો એક જ્ઞાનસ્વભાવ છે. આ રીતે જ્યાં સુધી બંનેને બિજ્ઞ બિજ્ઞ નહીં જણે, ત્યાં સુધી જીવને બેદજ્ઞાનનો અભાવ છે અને ત્યાં સુધી તે કર્મપ્રકૃતિના ઉદ્યને પોતાનો સમજુને પરિણામે છે.

આ રીતે બેદજ્ઞાનના અભાવમાં જીવ પ્રકૃતિના સ્વભાવે રાગાદ્વિપ પરિણામે છે, પુણ્ય-પાપકુપે પરિણામે છે તથા આ જ કારણથી મિથ્યાદાચિ, અજ્ઞાની અને અસંયમી થતો થકો કર્તા થઈને કર્મનો બંધ કરે છે.

પ્રશ્ન:- જ્ઞાનીને પણ રાગ થતો જોઈએ છીએ ને ? તો પછી તેને પણ મિથ્યાદાચિ, અજ્ઞાની અને અસંયમી કેમ ન કહ્યો ?

ઉત્તર:- હા, જ્ઞાનીને પણ રાગ થાય છે; પરંતુ તે પોતાની જ્ઞાન પરિણતિથી બિજ્ઞ થઈ ગયો છે. જ્ઞાની તે રાગાદ્વિને પોતાનાથી બિજ્ઞપણે

^૧ પ્રવચનરત્નાકર (હિંદી) ભાગ ૮, પાનું ૫૫-૫૬

જાણે છે. જેમ કે ઘઉંમાં કાંકર ઘઉંથી જુદા છે છતાં અજાની બંનેને એકમેક કરીને જુચે છે. પ્રકૃતિના સ્વભાવને પોતાનો સ્વભાવ સમજુને પરિણામે છે. આ કારણથી તે મિથ્યાદાષ્ટિ, અજાની અને અસંયમી થઈને કર્તાબુદ્ધિથી કર્મબંધ કરે છે.”

ઉક્ત સંપૂર્ણ કથનનો આશાય આ છે કે મિથ્યાત્ત્વ, અજાન અને અસંયમ - આ ત્રણેનું એકમાત્ર કારણ સ્વ અને પરમાં એકત્વનો અધ્યાસ છે. સ્વ અને પરમાં બેદવિજ્ઞાન ન હોવાથી આત્મા પરનો કર્તા બને છે બધી રીતે જેતાં આ આત્માના બંધનનું કારણ પણ સ્વ-પરના એકત્વનો અધ્યાસ જ છે.

જ્યારે આ આત્મા બેદવિજ્ઞાનના બળથી આ એકત્વબુદ્ધિને તોડી નાખે છે, પરના કર્તૃત્વ-ભોકૃત્વને છોડી હે છે ત્યારે જ્ઞાની થઈ જય છે, સમ્યગ્દાષ્ટિ થઈ જય છે અને કાળાંતરે સંયમી પણ થઈ જય છે, આખરે કર્મબંધનોથી મુક્ત થઈ જય છે.

અત્યાર સુધી કર્તૃત્વના સંબંધમાં જે વાત થઈ છે, તે પરનું કર્તૃત્વ છોડવાના સંબંધમાં કહેવામાં આવી; હવે તે જ વાત આગામી ગાથાઓ અને કળશમાં ભોકૃત્વના સંબંધમાં, ભોકૃત્વ છોડવાના સંબંધમાં પણ કહે છે.

આગામી ગાથાઓની ઉત્થાનિકાઙ્ક્ષપ કળશ મૂળથી આ પ્રમાણે છે.

(અનુષ્ટષ્ટ)

ભોકૃત્વં ન સ્વભાવોऽસ્ય સ્મृતઃ: કર્તૃત્વવच્ચિતઃ ।

અજ્ઞાનાદેવ ભોક્તાયં તદભાવાદવેદકઃ ॥૧૧૬॥

(હરિગીત)

ભોક્તાપણું આ ચિત્સ્વરૂપ આત્મા તારું ન સ્વભાવ છે,
કર્તાપણું જ્યમ ચિત્સ્વરૂપ આત્મા તારું ન સ્વભાવ છે.
અજ્ઞાનના કારાગ થકી આત્મા બને ભોક્તા અને
અજ્ઞાનનો જ અભાવ કરીને અભોક્તા આત્મા બને. ૧૮૬

કર્તૃત્વની જેમ ભોક્તૃત્વ પણ આ ચૈતન્ય આત્માનો સ્વભાવ નથી.
આ આત્મા અજ્ઞાનને લીધે જ ભોક્તા બને છે. અજ્ઞાનના અભાવમાં તે
ભોક્તા રહેતો નથી.

આ કળશનો ભાવાનુવાદ કવિવર બનારસીદાસજી નાટક સમયસારમાં
આ પ્રમાણે કરે છે.

(ચौપાઈ)

યથા જીવ કરતા ન કહાવૈ, તથા ભોગતા નામ ન પાવૈ ।

હૈ ભોગી મિથ્યામતિ માંહિ, ગયૈ મિથ્યાત ભોગતા નાંહ્યો ॥

જે રીતે જીવ કર્મનો કર્તા નથી; તે રીતે ભોક્તાપણ નથી. જ્યાં
સુધી મિથ્યામતિ છે, અજ્ઞાન છે; ત્યાંસુધી જીવ ભોગી છે, મિથ્યાત્વ જતાં
જીવ કર્મનો ભોક્તા રહેતો નથી.

આ કળશનો ભાવ પૂજ્ય ગુરુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે.

“જેમ શુભાશુભ રાગનું કર્તવ્ય ભગવાન આત્માનો સ્વભાવ નથી;
તેમ તે ભાંવોનું ભોક્તૃત્વ પણ આત્માનો સ્વભાવ નથી.

જુઓ, સમકિતી ચક્કવતીને દદ હન્જર રાણીઓ અને છ ખંડનું રાજ્ય
અને ભોગોપભોગની વિભૂતિ હોય છે તથા તેને રાજ્ય અને તેની ભોગોપભોગ
સામગ્રીનો રાગ પણ હોય છે; છતાં તે રાગના ભોક્તાપણાનું જે વેદન છે
તે માંડું સ્વરૂપ નથી - એમ માને છે.

જ્યાંસુધી જીવને રાગ અને જ્ઞાનનું બેદજાન નથી ત્યાંસુધી

અજ્ઞાનથી જ તે ભોક્તા છે. જ્યારે રાગ અને આત્માનું પરસ્પર બેદ્શાન થઈ જય છે, ત્યારથી તેને રાગ અને હર્ષ-વિખાદના ભાવોનું ભોક્તૃત્વ છૂટી જય છે.

લોકોને બહારથી જોતાં એમ લાગે છે કે તે ભોગોને ભોગવે છે; પરંતુ વાસ્તવમાં જ્ઞાની રાગ અને હર્ષ-શોકાદિનાં ભાવોને ભોગવતો નથી. હવે તેને કર્તૃત્વની માફક ભોક્તૃત્વનો અભિપ્રાય પણ છૂટી ગયો છે. હવે તેને કર્તૃત્વ અને ભોક્તૃત્વ વગેરે બધા ભાવો જેર જેવા લાગે છે.

અહા ! હવે જ્યારે જ્ઞાનીને દ્રવ્યનિદ્રિયો, ભાવેનિદ્રિયો અને ઈન્દ્રિયોના વિષયોથી અધિક પોતાનો જ્ઞાનસ્વભાવ પોતાપણે પ્રતિભાસિત થવા લાગ્યો છે તો હવે તે રાગ અને હર્ષ-શોકાદિના ભાવોને કેવી રીતે ભોગવી શકે? આનંદના બંદાર જ્ઞાનાનંદસ્વભાવી નિજ પરમાત્મદ્રવ્ય સાથે જેણે સ્નેહ કર્યો છે, તે વિષયાદિમાં રતિ કેમ કરી શકે ?”

આવી રીતે આપણે જોઈએ છીએ કે આ કળશમાં એમ જ કહેવામાં આવ્યું છે કે જેવી રીતે આત્મા પરનો કર્તા નથી; તેવી રીતે તેમનો ભોક્તા પણ નથી.

આ કળશ ૧૯૪મા કળશનું પ્રતિક્રિય જ છે. તે કળશમાં કહ્યું હતું કે જે પ્રમાણે આત્મા પરનો ભોક્તા નથી તેવી રીતે કર્તાં પણ નથી અને અહીં કહ્યું છે કે જે રીતે કર્તાં નથી, તેવી જ રીતે ભોક્તા પણ નથી.

તે કળશ પરના કર્તૃત્વનો નિષેધ કરતી ગાથાઓની ઉત્થાનિકર્ણ્ય કળશ હતો અને આ કળશ પરનાં ભોક્તૃત્વનો નિષેધ કરતી ગાથાઓની ઉત્થાનિકર્ણ્ય કળશ છે.



સમયસાર ગાથા ૩૧૬

અળણાણી કર્મફળં પયડિસહાવછિદો દુ વેદેદિ ।
ણાણી પુણ કર્મફળં જાણદિ ઉદિંદં ણ વેદેદિ ॥૩૧૬॥

(હસ્તિગીત)

અજ્ઞાની વેદે કર્મફળ પ્રકૃતિસ્વભાવે સ્થિત રહી,
ને જ્ઞાની તો જાગે ઉદ્યગત કર્મફળ વેદે નહીં. ૩૧૬

અજ્ઞાની પ્રકૃતિના સ્વભાવમાં સ્થિત રહેતો થકો કર્મફળને વેદે છે.
ભોગવે છે અને જ્ઞાની તો ઉદ્યગત આવેલા કર્મફળને માત્ર જણે છે, ભોગવતો
નથી.

આ ગાથાનો ભાવ આત્મઘ્યાતિમાં આ પ્રમાણે સ્પષ્ટ કરવામાં
આવ્યો છે.

“અજ્ઞાની શુદ્ધ આત્માના જ્ઞાનના અભાવને લીધે સ્વ-પરના
એકત્વજ્ઞાનથી, સ્વપરના એકત્વદર્શનથી અને સ્વ-પરની એકત્વ પરિણતિથી
પ્રકૃતિના સ્વભાવમાં સ્થિત હોવાથી પ્રકૃતિના સ્વભાવને પણ ‘હું’ પણે
અનુભવતો થકો (અર્થાત् પ્રકૃતિના સ્વભાવને પણ ‘આ હું છું’ એમ
અનુભવતો થકો) કર્મફળને ભોગવે છે અને જ્ઞાની તો શુદ્ધ આત્માના જ્ઞાનના
સદ્ભાવને લીધે સ્વપરના વિભાગજ્ઞાનથી, સ્વપરના વિભાગદર્શનથી અને
સ્વપરની વિભાગપરિણતિથી પ્રકૃતિના સ્વભાવથી નિવર્ત્તલો હોવાથી શુદ્ધ

આત્માના સ્વભાવને જ 'હું' પણે 'અનુભવતો થકો ઉદિત કર્મફળને, તેના શૈયમાત્રપણાને લીધે માત્ર જાણે જ છે, પરંતુ તેને 'હું' પણે અનુભવવાવું અશક્ય હોવાથી તેને ભોગવતો નથી.''

ઉક્ત કથનનો આશાય સ્પષ્ટ કરતાં ભાવાર્થમાં પંડિત જ્યયચંદ્રલુએ છાખડા લઈ છે -

"અજાનીને તો શુદ્ધ આત્માનું જ્ઞાન નથી; તેથી જે કર્મઉદ્યમાં આવે છે તેને જ તે નિજરૂપ જાણીને ભોગવે છે અને જાનીને શુદ્ધ આત્માનો અનુભવ થઈ ગયો છે. તેથી તે પ્રકૃતિના ઉદ્યમને પોતાનો સ્વભાવ નહિ જાણતો થકો તેનો માત્ર જ્ઞાતા જ રહે છે; ભોક્તા થતો નથી."

આચાર્ય જ્યયસેન આ ગાથાનો અર્થ કરતાં બેદવિજ્ઞાનને અભેદરત્નત્રયના રૂપમાં પરિભાષિત કરે છે અને ભોગવવાનો અર્થ તન્મય થઈને ભોગવવાનું એમ કરે છે. તેમણે કરેલો અર્થ મૂળથી આ પ્રમાણે છે.

"વિશુદ્ધજ્ઞાનદર્શિનસ્વભાવરૂપ આત્મતત્ત્વનું સમ્યક્શાદ્ધાન, જ્ઞાન અને અનુઝાનરૂપ અભેદરત્નત્રયસ્વરૂપ બેદજ્ઞાનના અભાવથી અજાની જીવ ઉદ્યાગત કર્મપ્રકૃતિસ્વરૂપ સુખ-દુઃખમાં સ્થિત થઈને હર્ષ-વિષાદ સાથે તન્મય થઈને કર્મફળનો અનુભવ કરે છે અને સમ્યગ્જ્ઞાની જીવ તન્મય થઈને પણ પૂર્વોક્ત બેદજ્ઞાનના સદ્ભાવથી વીતરાગસહજ પરમાનંદરૂપ સુખરસના આસ્વાદથી પરમસમતાભાવે પરિણામતો, ઉદ્યમાં આવેલા કર્મફળને વસ્તુસ્વરૂપે જાણે જ છે. હર્ષ-વિષાદમાં તન્મય થઈને ભોગવતો નથી."

ઉક્ત ગાથાના ભાવને સ્પષ્ટ કરતાં પૂજ્ય ગુરુદેવ કહે છે -

"ભગવાન આત્મા કેવળ આનંદનું દળ છે. પોતાના આવા ધ્રુવસ્વરૂપની પિણાણ ન હોવાથી અજાનીને અનાદિથી સ્વરૂપનું અજ્ઞાન છે. તેથી અજ્ઞાનવશ રાગને પોતાનું સ્વરૂપ માનતો થકો, પોતાના અને પરના એકત્વ જ્ઞાનથી, સ્વ-પરની એકત્વ પરિણાતિથી કર્મપ્રકૃતિના સ્વભાવમાં રચ્યો-પચ્યો રહે છે.

ભાઈ ! આ પુણ્ય-પાપનાં પણ જે ભાવ થાય છે તે કર્મપ્રકૃતિનો સ્વભાવ છે. અહા ! અજ્ઞાની કર્મપ્રકૃતિના સ્વભાવમાં રચ્યો-પચ્યો પ્રકૃતિના સ્વભાવને જ પોતાપણે અનુભવ કરતો થકો કર્મમળનું જ વેદન કરે છે, તેને જ ભોગવે છે.^૧

હવે કહે છે કે જ્ઞાની અર્થાત् બેદવિજ્ઞાની, આત્માનુભવી જેને અતીન્દ્રિય આનંદસ્વરૂપી આત્માનું આસ્વાધન થઈ રહ્યું છે; તે પોતાના આત્માને જ્ઞાનસ્વભાવથી અભિજ્ઞ અને પરથી બિજ્ઞ અનુભવે છે.^૨

અહીં પ્રક્ષ થાય છે કે જ્ઞાનીને હર્ષ-શોકનું વેદન બિલ્કુલ થતું નથી -

ઉત્તર : જ્ઞાનીને હર્ષ-શોકનું બિલ્કુલ વેદન થતું નથી - એમ નથી, એને કિંચિત્ હર્ષ-શોકનું વેદન છે, પરંતુ તેને અંતરંગમાં સ્વભાવની અધિકતા છે, મુખ્યતા છે. તેથી તે સ્વભાવને મુખ્ય અને રાગના વેદનને ગૌણ માનીને રાગના વેદનમાં તન્મય થતો નથી. તેને કિંચિત્ રાગનું પરિણમન છે; જેટલું પરિણમન છે, એટલું વેદન પણ છે; પરંતુ તેને વ્યવહાર માનીને અસત્યાર્થ કહીને 'તેને વેદન જ નથી' - એમ કહી દીધું છે. જ્ઞાની કર્મફળરૂપ હર્ષ-શોકને અને આત્મસ્વભાવને - આમ બંનેને નહીં, પરંતુ એકલા આત્મસ્વભાવને જ પોતાપણે અથવા નિજરૂપે અનુભવ કરે છે.

- અહીં આ સિદ્ધ કરવું છે.

પ્રવચનસારમાં ૪૭ નયનો અધિકાર અંતિમ છે. ત્યાં જ્ઞાનીને કર્તાન્ય અને ભોક્તાન્ય છે એમ કહે છે. ત્યાં કહ્યું છે કે 'આત્મદ્વય કર્તૃન્યથી રંગારાની માફક રાગાદિ પરિણામોનો કર્તા છે અને ભોક્તૃન્યથી હિતકારી-અહિતકારી અજ્ઞાને ખાનાર રોગીની માફક સુખ-દુ:ખને ભોગવનાર છે.'

૧ પ્રવચનરસ્તાકર ભાગ ૬, પાનું ૬૧

૨ તે જ, પાનું ૬૨

અહા ! જાની જેટલા વ્યવહાર રત્નત્રયસ્વકૃપ મહાવતાદિના વિકલ્પકૃપે પરિણામે છે, તેટલા પરિણામોનો તે કર્તાનયથી કર્તા છે. તેવી જ રીતે જેટલો હર્ષભાવ આવી જય છે તેટલા પરિણામોનો તે ભોક્તાનયથી ભોક્તા છે. ‘આ પરિણામ કરવા અને ભોગવવા લાયક છે’ – આવી કર્તૃત્વબુદ્ધિ અને સુખબુદ્ધિ જાનીને હોતી નથી. વર્તમાન અસ્થિરતાથી કરવાના અને ભોગવવાના પરિણામ થાય છે, તેથી તેને કર્તા અને ભોક્તા કહે છે.

અહીં આ વાત નથી. અહીં તો એમ કહ્યું છે કે જાની ઉદ્દિત કર્મફળને માત્ર જાણે જ છે, તેમાં ‘હું’ પણાનો અનુભવ અશક્ય હોવાથી તેમને વેદતો નથી. અહાહા ! જાની હર્ષ-શોકના પરિણામોનો ભોક્તા નથી; કારણ કે તેને હર્ષ-શોકના પરિણામોમાં ‘હું’ પણું અનુભવવું અશક્ય છે અર્થાત् શૈયમાત્ર હોવાથી જાની ક્યારે પણ તેમાં પોતાપણાનો અનુભવ કરી શકતો નથી.^૧

પરનો એક જ્યાદા પદાર્થોનો ભોગ જાની અથવા અજાની કોઈને પણ હોતો નથી. હા, અજાની કર્મોદ્યના નિભિતે ઉત્પન્ન થયેલા પોતાના વિકારને ભોગવે છે અને જાનીના અંતરમાં બેદશાન થઈ ગયું છે, તેની અંતર્દેચ્છિમાં સ્વભાવ-વિભાવ તથા સ્વ-પરિણાતિ અને પર-પરિણાતિનો વિભાગ પડી ગયો છે. આ કારણથી તે નિરાકૃત આનંદને સ્વપણે વેદે છે અને કર્મપ્રકૃતિના ઉદ્ઘથી ઉત્પન્ન થયેલા વિકારી સ્વભાવને છોડી દે છે અર્થાત् તે વિકારને સ્વપણે અનુભવતો નથી.

આ રીતે જાની કર્મફળનો જાતા-દાધ્યા રહે છે. ભોક્તા થતો નથી.^૨

આ પ્રમાણે આ ગાથામાં એક જ કહ્યું છે કે અજાની કર્મફળનો ભોક્તા બને છે; પરંતુ જાની કર્મફળનો ભોક્તા ક્યારેય નથી.

૧ પ્રવચનરત્નાકર ભાગ ૮, પાનું ૬૨-૬૩

૨ પ્રવચનરત્નાકર ભાગ ૮, પાનું ૬૫

આ ભાવની પુછ્ટિ નીચેના કળશમાં કરવામાં આવી છે.

(શાર્ડુલવિક્રીડિત)

અજ્ઞાની પ્રકૃતિસ્વભાવનિરતો નિત્યં ભવેદ્વૈદકો ।
 જ્ઞાની તુ પ્રકૃતિસ્વભાવવિરતો નો જાતુચિદ્વૈદકઃ ।
 ઇત્યેવં નિયમં નિરૂપ્ય નિપુણેજ્ઞાનિતા ત્યજ્યતાં ।
 શુદ્ધૈકાત્મમયે મહસ્યચલિતૈરસેવ્યતાં જ્ઞાનિતા ॥૧૧૭॥

(હરિગીત)

પ્રકૃતિસ્વભાવે રક્ત અજ્ઞાની સદા વેદક બને,
 પ્રકૃતિસ્વભાવવિરક્ત જ્ઞાની, નહિ કદા વેદક બને;
 આ નિયમ જાગ્રી નિપુણ પુરુષો છોડીને અજ્ઞાનને,
 નિજ આત્મમાં નિશ્ચળ થઈને સેવજે બસ જ્ઞાનને. ૧૭૭

પ્રકૃતિના સ્વભાવમાં લીન હોવાથી અજ્ઞાની સદા વેદક છે અને
 પ્રકૃતિના સ્વભાવથી વિરક્ત હોવાથી જ્ઞાની કદાપિ વેદક નથી. હે નિપુણપુરુષો!
 આ નિયમનો વિચાર કરીને અજ્ઞાનભાવને છોડી દો અને આ શુદ્ધતેજભ્ય
 આત્મમાં નિશ્ચળ થઈને જ્ઞાનભાવનું સેવન કરો.

આ કળશનો ભાવાનુવાદ કવિવર બનારસીદાસજી નાટક સમયસારમાં
 આ પ્રમાણે કરે છે.

(સવૈયા ઇકતીસા)

જગવાસી અગ્યાની ત્રિકાલ પરજાઇબુદ્ધી,
 સો તૌ વિષે ભોગનિ કૌ ભોગતા કહાયૌ હૈ ।
 સમકિતી જીવ જોગ ભોગ સૌં ઉદાસી તાર્તી,
 સહજ અભોગતા ગરંથનિ મૈં ગાયૌ હૈ ॥
 યાહી ભાંતિ વસ્તુ કી વ્યવસ્થા અવધારિ બુધ,
 પરભાડ ત્યાગિ અપની સુભાડ આયૌ હૈ ।
 નિરવિકલપ નિરૂપાધિ આત્મ અરાધિ,
 સાધિ જોગ જુગતિ સમાધિ મૈં સમાયૌ હૈ ॥

ત્રિકાળપર્યાયબુદ્ધિવાળા જગતવાસી અજ્ઞાની જીવ તો વિષયભોગોનાં ભોક્તા કહેવાય છે અને વિષયભોગોથી ઉદાસ સમ્યગદચ્છિ જ્ઞાની ભોગોથી ઉદાસીનતાને કારણે શાસ્ત્રોમાં સહજ જ અભોક્તા કહેવામાં આવ્યા છે. આ પ્રકારની વસ્તુવ્યવસ્થાનો અને વસ્તુસ્વરૂપનો નિર્ણય કરીને જ્ઞાની જીવ પરભાવોનો ત્યાગ કરીને પોતાના સ્વભાવમાં આવી જય છે અને નિર્ણયાધિ આત્માની નિર્વિકલ્પ આરાધના કરીને, યોગોને સાધીને સમાધિમાં સમાઈ જય છે.

આ કળશનો ભાવ સ્પષ્ટ કરતાં પૂજ્ય ગુરુદેવ કહે છે - “પુણ્ય-પાપ આદિ શુભાશુભભાવ આત્માનો સ્વભાવ નથી, પરંતુ જડપ્રકૃતિનો સ્વભાવ છે. હ્યા, દાન, વ્રત ભક્તિ આદિના ભાવ કર્મપ્રકૃતિના સ્વભાવ છે. અજ્ઞાની આ પ્રકૃતિના ઉદ્ઘના નિમિત્તથી થયેલા ભાવોને પોતાનો સ્વભાવ જાણે છે, તેથી તે તેમનો વેદક છે, ભોક્તા છે. જ્યારે કે ધર્મ જીવને સ્વ પરનું બેદવિજ્ઞાન થઈ ગયું છે. તે જાણે છે કે હું પરમ આનંદમય શુદ્ધ જ્ઞાયકતત્વ છું અને આ પુણ્ય-પાપના ભાવ મારાથી લિઙ્ગ આસ્રવતત્વ છે. આ પ્રમાણે બંનેમાં બેદવિજ્ઞાન થવાથી ધર્મ જીવ કર્મપ્રકૃતિના સ્વભાવથી વિરામ લઈ લે છે. તેને વિકારનું વેદન હોતું નથી. જેકે તેને વ્રત, તપ, ભક્તિ, યાત્રા આદિના ભાવો આવે છે; પરંતુ અંતરમાં તે તેનાથી વિરક્ત છે, ઉદાસીન છે. આ કારણે તે વિકારનો ભોક્તા પણ નથી.”

ક્યાંક ક્યાંક એવું કથન પણ મળે છે કે જ્ઞાનીને આનંદધારા અને રાગધારા બંને એક સાથે વર્તે છે. એક જ સમયમાં આનંદ અને દુઃખનું વેદન એકી સાથે થાય છે; પરંતુ અહીં તે વાત નથી. અહીં તો દુઃખના વેદનને ગૌણ કરીને તેને વ્યવહાર માનીને, અસત્યાર્થ જાણીને હઠાવી દીધો છે. તેથી અહીં કહ્યું છે કે જ્ઞાની પ્રકૃતિના સ્વભાવનો વેદક નથી.

‘જ્ઞાનીને સર્વથા દુઃખનું વેદન હોતું જ નથી’ જે એમ કોઈ કહે

તો તેનું આમ કહેવું પણ સાચું નથી. જુઓ, છઠા ગુણસ્થાનવર્તી ભાવલિંગી મુનિવરોને અંદરમાં અતીન્દ્રિય આનંદનું પ્રચુર સ્વ-સંવેદન હોય છે, છતાંપણ જેટલો અલ્ય રાગ છે તેથલું દુઃખનું વેદન પણ છે; પરંતુ અહીં તો દાખિની અપેક્ષા વાત છે. દાખિની પ્રધાનતામાં દુઃખનું વેદન નથી - એમ કહ્યું છે. ભાઈ ! અપેક્ષા સમજ્યા વગર જે કોઈ એકાંતથી ખેંચે તો તે જિનાગમનો માર્ગ નથી.^૧

જુઓ, અહીં વસ્તુને છોડવાની વાત કહી નથી; કારણ કે પરના ગ્રહણ ત્યાગ તો આત્મામાં વિકાણ છે જ નહીં. અહીં તો જે રાગને અજ્ઞાનીએ પોતાનો માની અજ્ઞાનપણાનું પોષણ કર્યું છે, તે અજ્ઞાનને છોડીને રાગમાં પોતાપણાનું વેદનને છોડીને એક શુદ્ધ આત્મભય તેજમાં નિશ્ચળ થઈને જ્ઞાનભાવનું સેવન કરો, નિરાકૃત આનંદનો અનુભવ કરો - એમ કહ્યું છે.^૨

આ રીતે આ કળશમાં પરને ભોગવવાના ભાવરૂપ અજ્ઞાનપણાને છોડીને સહજ શાતા-દાખાભાવરૂપ જ્ઞાનભાવને અપનાવવાની પ્રેરણા આપવામાં આવી છે.

૩૧૬મી ગાથા બાદ તાત્પર્યવૃત્તિમાં એક ગાથા આવે છે, જે આત્મભ્યાતિમાં ૩૦૫મી ગાથાના રૂપે પહેલા આવી ગયેલ છે અને તેનું અનુશીલન યથાસ્થાને જરૂર જ ગયું છે. તેથી અહીં તેના સંબંધમાં કંઈ પણ લખવું આવશ્યક નથી.



૧ પ્રવચનરળાકર ભાગ ૮, પાનું ૬૬

૨ તે જ, પાનું ૬૭

સમયસાર ગાથા ૩૧૭-૩૧૮

હવે આગામી ગાથાઓમાં એમ સુનિશ્ચિત કરે છે કે અજ્ઞાની વિષયબોગોનો ભોક્તા છે અને જ્ઞાની ભોક્તા નથી, અભોક્તા જ છે.

ગાથાઓ મૂળમાં આ પ્રમાણે છે.

ણ મુયદિ પયડિમભવો સુદ્રુ વિ અજ્ઞાઇદૂણ સત્થાણિ ।

ગુડદુદ્ધં પિ પિબંતા ણ પણયા ણિવિસા હોંતિ ॥૩૧૭॥

ણિવૈયસમાવણો ણાણી કમ્માફલં વિયાણેદિ ।

મહુરં કડુંયં બહુવિહમવેયાઓ તેણ સો હોડ ॥૩૧૮॥

(હરિગીત)

મુરીતે ભાગીને શાસ્ત્ર પણ પ્રકૃતિ અભય નહીં તને,

સાકરસહિત ક્ષીરપાનથી પણ સર્પ નહિ નિર્વિષ બને. ૩૧૭

નિર્વેદને પામેલ જ્ઞાની કર્મફળને જાગતો

કડવા મધુર બહુવિધને, તેથી અવેદક છે અહો ! ૩૧૮

જે પ્રમાણે ગોળથી મિશ્રિત મીઠા દૂધને પીતો થકો પણ સાપ નિર્વિષ થતો નથી; તેવી જ રીતે શાસ્ત્રોનું સારી રીતે અધ્યયન કરીને પણ અભય જીવ પ્રકૃતિસ્વભાવને છોડતો નથી.

પરંતુ અનેક પકારનાં મીઠા-કડવા કર્મફળોને જાળવાને કારણે નિર્વેદ (વૈરાગ્ય)ને પ્રાપ્ત જ્ઞાની તેનો અવેદક જ છે.

આ ગાથાઓનો અર્થ આત્મભ્યાતિમાં આ પ્રમાણે કરવામાં આવ્યો છે -

“જે રીતે આ જગતમાં સાપ પોતાની મેળે તે વિષભાવને છોડતો જ નથી; પરંતુ વિષભાવને મટાડવામાં સમર્થ એવા સાકરસહિત દૂધના પાનથી પણ છોડતો નથી. તેમ અભવ્ય જીવપણ પ્રકૃતિસ્વભાવને પોતાની મેળે છોડતો નથી અને પ્રકૃતિસ્વભાવને છોડાવવામાં સમર્થ એવા દ્રવ્યશ્રુતના જ્ઞાનથી પણ પ્રકૃતિસ્વભાવને છોડતો નથી. કારણ કે તેને સદાય ભાવશ્રુતજ્ઞાનસ્વરૂપ શુદ્ધાત્મજ્ઞાનના અભાવને લીધે અજ્ઞાનીપણું છે. આથી આવો નિયમ છે કે અજ્ઞાની પ્રકૃતિસ્વભાવમાં સ્થિર હોવાથી વેદક જ છે, કર્માને ભોગવે જ છે.

જેમા સમસ્ત બેદ નિરસ્ત થઈ ગયા છે એવા અભેદ ભાવશ્રુતજ્ઞાનરૂપ શુદ્ધાત્મજ્ઞાનના સદ્ભાવને કારણે જ્ઞાની તો પરથી અત્યંત વિરક્ત હોવાથી પ્રકૃતિના સ્વભાવને પોતાની મેળે છોડી હે છે; આ કારણથી ઉદ્યાગત મધુર કે અમધુર કર્મફળને જ્ઞાતાપણાને કારણે ભાગ જાણે જ છે; પરંતુ જ્ઞાન હોવા છતાં પરદ્રવ્યને પોતાપણે અનુભવ કરવાની અયોગ્યતા હોવાથી તે કર્મફળને વેદતો નથી, ભોગવતો નથી. તેથી જ્ઞાની પ્રકૃતિસ્વભાવથી વિરક્ત હોવાથી અવેદક જ છે, અભોક્તા જ છે.”

આચાર્ય જ્યસેન તાત્પર્યવૃત્તિમાં આ ગાથાઓનો અર્થ આત્મભ્યાતિની જેમ જ કરે છે. સાથે એ પણ સ્પષ્ટ કરી હે છે કે સંસાર, શરીર અને ભોગોથી વિરક્તિ જ નિર્વેદ છે અને આત્માનુભવી જ્ઞાની નિર્વેદ સંપન્ન હોય છે.

અંતમાં નિર્ઝર્ખ કાઢતાં લખે છે કે આ પ્રમાણે શુદ્ધનિશ્ચયનયથી સમ્યગ્જ્ઞાની જીવ શુભાશુભકર્મફળનો ભોક્તા નથી.

આ વાતને પૂજય ગુરુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે - “જુઓ, જેમ સાપ સાકરસહિત મીંથું દૂધ પીને પણ વિષભાવને છોડતો નથી તેમ અભિવ્યક્તિ અગિયાર અંગ અને નવપૂર્વનું શાન થઈ જય તો પણ મિથ્યાત્વાદિ ભાવોને છોડતો નથી; કારણ કે તેને સદાય ભાવશ્રુતજ્ઞાનસ્વરૂપ શુદ્ધાત્મજ્ઞાનના અભાવને કારણે અજ્ઞાનપણું છે.”^૧

અહીં અભિવ્યક્તિ તો દર્ખાત કહ્યું છે. ભવ્યલાવ પણ અનેક શાસ્ત્રો (દ્રવ્યશ્રુત)નો અભ્યાસી થઈને પણ જ્યાંસુધી નિર્મળ ભાવશ્રુતજ્ઞાન પ્રગટ કરતો નથી ત્યાંસુધી અજ્ઞાનપણાને લીધે ભોક્તા જ છે.^૨

પૂર્ણાનંદનો નાથ નિર્વિકલ્પ અચિંત્ય પરમ પદાર્થ ભગવાન આત્મા ભાવશ્રુતજ્ઞાનમાં સ્વજ્ઞેયપણાથી જ્ઞાત થાય છે. આવા અખંડ આત્માને જાણનાર ભાવશ્રુતજ્ઞાનનો જ્ઞાનીને સહભાવ હોવાથી તે પરથી અથવા રાગાદિભાવોથી સર્વથા વિરક્ત છે. આ રીતે પરથી અત્યંત વિરક્ત હોવાથી જ્ઞાની કર્મોદ્યના સ્વભાવને અર્થાત્ હર્ષ-શોક રતિ-અરતિ આદિ ભાવોને પોતાની મેળે છોડી દે છે.^૩

અંતરમાં ભગવાન આત્મા અમૃતનો સાગર છે. તેમાં જે સ્વભાવથી વિપરીત રાગાદિભાવ થાય છે તે બધું ઝેર છે, દુઃખ છે. અજ્ઞાની જીવ શુભભાસુભભાવોમાં અટકીને નિરંતર આ જેરનો સ્વાદ વેદે છે, જ્યારે ધર્મી જીવ ઉદ્ઘયમાં આવતા અમધુર અથવા મધુર ફળને જ્ઞાતાપણાને લીધે માત્ર નહોં જ છે. શુભભાવોમાં હર્ષ થવો તે મધુર સ્વાદ છે. અરેખર તો આ મધુર સ્વાદ પણ ઝેરનો જ સ્વાદ છે અને અશુભભાવોમાં જે હિંસા, જૂઠ, ચોરી વિષય-વાસના, કામ-કોધાદિ ભાવ થાય છે, તે બધા અમધુર-કડવા

૧ પ્રવચનરત્નાકર ભાગ ૮, પાનું ૬૮

૨ પ્રવચનરત્નાકર ભાગ ૮, પાનું ૬૯

૩ તે ૭, પાનું ૭૦

સ્વાદ છે; પરંતુ ધર્મી જીવ તો તે બજેનો જાતા-દષ્ટા જ છે, વેદક નથી; કારણ કે શુદ્ધ આત્માનું જ્ઞાન થતાં દ્રવ્યને 'હું' પણે અનુભવ કરવાની યોગ્યતા છે. તેથી જ્ઞાની કર્મપ્રકૃતિના સ્વભાવથી વિરક્ત હોવાથી અવેદક જ છે. હર્ષ-શોક અને સુખ-દુःખના ભાવોનો જાતા જ છે. વેદક નથી.^૧

જ્ઞાની પોતાની મેળે તો કર્મપ્રકૃતિના સ્વભાવને ભોગવતો નથી અને ઉદ્ઘયની બળનેરીથી પરવશ થતો પોતાની નિર્બણતાથી ભોગવે છે તો પરમાર્થથી તે તેનો ભોક્તા કહેવાતો નથી. તેથી જ્ઞાની અભોક્તા જ છે.^૨"

આ પ્રમાને આ ગાથાઓમાં આમ જ કહેવામાં આવ્યું છે કે જે રીતે સાપ ન તો પોતાની મેળે વિષને છોડે છે અને ન તો મીઠું દૂધ પીવડાવતાં પણ છોડે છે; તે જ રીતે અજ્ઞાની ન તો પોતાની મેળે મિથ્યાત્મ રાગાદ્ધિકૃપ કર્મપ્રકૃતિના સ્વભાવને છોડે છે અને ન તો શાસ્ત્રોનું અધ્યયન કર્યા બાદ છોડે છે. તાત્પર્ય આમ છે કે મિથ્યાદાચિ જીવોને શાસ્ત્રાધ્યયનથી પણ કોઈ વિશેષ લાભ થતો નથી કારણ કે તેમને ભાવશુદ્ધજ્ઞાનનો અભાવ છે. આ કારણે તે કર્મફળનાં ભોક્તા છે; પરંતુ આત્માનુભવકૃપ ભાવશુદ્ધજ્ઞાનના સહભાવને લીધે જ્ઞાનીજન કર્મફળનાં માત્ર જાતા જ છે, કર્તા-ભોક્તા નથી.

હવે આ જ ભાવનું પોષક કળશ કાવ્ય લખે છે. જે આ પ્રમાણે છે.

(વસન્તતિલકા)

જ્ઞાની કરોતિ ન ન વેદયતે ચ કર્મ

જાનાતિ કેવલમયં કિલ તત્સ્વભાવમ् ।

જાનન્પરં કરણવેદનયોરભાવા-

ચુદ્ધસ્વભાવનિયત: સ હિ મુક્ત એવ ॥૧૧૮॥

૧ પ્રવચનરત્નાકર ભાગ ૮, પાનું ૭૪-૭૫

૨ તે જ, પાનું ૭૫

(હસ્તિગીત)

જાની ન કર્માને કરે વળી ભોગવે નહિ તેહને,
બસ જાની કેવળ જાગતો એ વિવિધ કર્મસ્વભાવને;
આ રીત કેવળ જાગતો, નહિ વેદતો-કરતો અને
છે અચળ શુદ્ધ સ્વભાવમાં, તે જાની છે મુક્ત જ ખરે ! ૧૮૮

જાની લુલ કર્મને ન તો કરે છે અને ન તો ભોગવે છે. આ પ્રમાણે
કરવાના અને ભોગવવાના અભાવને કારણે તથા ભાત્ર જાણવાને કારણે શુદ્ધ
સ્વભાવમાં નિશ્ચળ રહેતો થકો તે જાની ખરેખર મુક્ત જ છે.

આ કળશાનો ભાવાનુષાદ કવિવર બનારસીદાસજી એ બે છંદોમાં
આ પ્રમાણે કર્યો છે; જે આ પ્રમાણે છે -

(સવૈયા ઇકતીસા)

ચિનમુદ્રાધારી ધ્રુવ ધર્મ અધિકારી ગુન,
રતન ભંડારી અપહારી કર્મ રોગ કૌ ।
પ્યારી પંડિતન કોઈ હુસ્યારી મોખ મારગ મૈં,
ન્યારી પુદ્ગલ સોઈ ઉજ્યારી ઉપયોગ કૌ ॥
જાનૈ નિજ પર તત્ત રહે જગ મૈં વિરત્ત,
ગહૈ ન મમત્ત મન વચ કાય જોગ કૌ ।
તા કારન ગ્યાની ગ્યાનાવરનાદિ કરમ કૌ,
કરતા ન હોઇ ભોગતા ન હોઇ ભોગ કૌ ॥

(દોહા)

નિરભિલાષ કરની કારૈ, ભોગ અરુચિ ઘટ માંહિ ।
તાતેં સાધક સિદ્ધસમ, કરતા ભુગતા નાંહિ ॥

ચૈતન્યમુદ્રાનો ધારી, ધ્રુવકર્મનો અધિકારી, ગુણકૃપી રત્નોનો
ભંડારી, કર્મકૃપી રોગનું અપહરણ કરનાર, પંડિતોને ખ્યારો, મુક્તિમારો
ચાલવામાં હોશિયાર પરપુદ્ગલોથી બિન્ન, જ્ઞાન-દર્શનકૃપ ઉપયોગથી પ્રકાશિત

જાનીજીવ નિજ-પર તત્ત્વનો જાણકાર હોવાથી, સંસારથી વિરક્ત હોવાથી, મન-વચ્ચન-કાયા સાથે ભમત્વ રાખતો ન હોવાથી જ્ઞાનાવરણાદિ કર્મોનો કર્તા થતો નથી અને ન તો ભોગોનો ભોક્તા બને છે.

અભિલાષા વિના કાર્ય કરતો હોવાથી અને અંતરમાં ભોગોની અર્દચિ હોવાને કારણે તે સાધક જીવ સિદ્ધોની સમાન કર્મોનો કર્તા-ભોક્તા નથી. તેથી તે સિદ્ધ સમાન જ છે.

અહીં એક પ્રશ્ન થઈ શકે કે મૂળ કળશમાં તો એમ જ કહ્યું છે કે “સ હિ મુક્ત એવ - તે મુક્ત જ છે” તથા આપે પદ્યાનુવાદમાં પણ મુક્ત હૈ એમ જ લઘ્યું છે; પરંતુ બનારસીદાસજીએ મુક્ત ન લખતાં સિદ્ધસમ લઘ્યું છે - તેનું કારણ શું છે ?

અરે ભાઈ ! અમે આ વાત કેટલીય વાર કહી ચૂક્યા છીએ કે બનારસીદાસજીએ લગભગ સર્વત્ર જ પાંડે રાજમલજીની કળશાટીકાનું અનુકરણ કર્યું છે. અહીં પણ આમ જ થયું છે; કારણ કે કળશ ટીકામાં મુક્ત એવ નો અર્થ સિદ્ધસમ જ કર્યો છે.

એક બીજી વાત પણ ધ્યાન આપવા યોગ્ય છે કે આ કળશના અર્થમાં કર્મ શબ્દનો અર્થ પાંડે રાજમલજીએ રાગાદિ અશુદ્ધ પરિણામ અને સુખ-દુ:ખ આદિ કર્યો છે અને કહ્યું છે કે જ્ઞાની રાગાદિનો કર્તા નથી અને સાંસારિક સુખ દુ:ખ આદિનો પણ ભોક્તા નથી; જ્યારે બનારસીદાસજી કહે છે કે જ્ઞાનાવરણાદિ કર્મોનો કર્તા નથી ભોગોનો ભોક્તા નથી. પાંડે રાજમલજીએ જીવના અશુદ્ધ પરિણામોના કર્તૃત્વ અને સુખ-દુ:ખાદિ ભાવોનાં ભોક્તૃત્વનો નિષેધ કર્યો છે તો બનારસીદાસજીએ જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મોના કર્તૃત્વનો અને ભોગસામણી (નોકર્મ)ના ભોક્તૃત્વનો નિષેધ કર્યો છે. જ્યારે પંડિત જ્યયચંદ્રજી છાબડાએ જ્ઞાની જીવ કર્મનો કર્તા-ભોક્તા નથી - આટલું કહીને જ કામ ચલાવી લીધું છે. વસ્તુત: વાત આમ છે કે જ્ઞાની જીવ ન તો દ્રવ્યકર્મોનો કર્તા છે અને ન તો ભાવકર્મોનો; આ પ્રમાણે ન

તો રાગાદિનો ભોક્તા છે અને ન તો ભોગસામગ્રીનો તે તો આ બધાનો સહજ જ્ઞાતા-દાટા જ છે.

આ કળશનો ભાવ પૂજ્ય ગુરુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે - “જીવ અનાદિથી કર્મોનો કર્તા થઈને દુઃખના માર્ગમાં ભટકી રહ્યો છે. હવે તેણે સ્વાનુભવ કરીને સુખનો માર્ગ અપનાવ્યો છે. હવે તે જ્ઞાની થઈને કર્મોનો કર્તા-ભોક્તા રહ્યો નથી. હવે તેને આનંદસ્વરૂપ નિજ આત્મદ્રવ્યનું ભાન થયું છે. તેથી તે હવે દુઃખના ભાવને વેદતો નથી. જે કંઈ રાગનો ભાવ છે, તેને તે માત્ર જાણો જ છે. વેદતો નથી. કર્મના સ્વભાવને અને પુણ્ય-પાપ આદિ ભાવને ઘર્મી પુરુષ કેવળ જાણો જ છે, તેમને કરતો કે ભોગવતો નથી. જ્ઞાનીને દ્વા, દાન, ભક્તિ, પૂજા આદિના ભાવ અવશ્ય આવે છે; પરંતુ તે તેમનો કર્તા-ભોક્તા થતો નથી. ઘર્મી અતીન્દ્રિય આનંદમાં રત છે અને રાગથી વિરક્ત છે. તેથી રાગ સાથે એક થયા વગર જે અત્યરાગ થાય છે, તેને કેવળ જાણો જ છે.”^૧

આવો ઘર્મી પુરુષ શુભસ્વભાવમાં નિશ્ચળ રહેતો વસ્તુત: મુક્ત જ છે. જેણે સ્વભાવમાં એકત્વ કર્યું છે તે વસ્તુત: મુક્ત જ છે.

જુઓ, આચાર્ય કહે છે કે ભગવાન આત્મા જ્ઞાનનો સાગર છે, જેમને એ જ્ઞાનસ્વભાવી આત્માનો અનુભવ થયો છે, તે જ્ઞાની છે. તે જ્ઞાની પુરુષ એમ જાણો છે કે ‘હું તો ચેતનામાત્ર સ્વભાવથી ભરેલો ભગવાન છું. કર્મચેતનાથી રહિત છું. પુણ્ય-પાપ આદિ ભાવો માઝે સ્વરૂપ નથી; કારણે કે રાગમાં માઝે એકત્વ નથી. બસ આ જ કારણે જ્ઞાની રાગનો અકર્તા છે.’^૨

જ્ઞાની કર્મફળ ચેતનારહિત હોવાથી સ્વયં અવેદક જ છે. વિકાસ અર્થात હર્ષ-શોક અને સુખ-દુઃખનું ચેતવાપણું જ કર્મફળ ચેતના છે. વિકારી પરિણામના ફળનું વેદન જ કર્મફળચેતના છે. ઘર્મી જીવ કર્મફળ ચેતનાથી રહિત છે. તેથી તે અવેદક છે. અહા ! નિજધરમાં એકલો જ્ઞાન અને આનંદ

^૧ પ્રવચનરત્નાકર ભાગ ૮, પાનું ૭૬

^૨ પ્રવચનરત્નાકર ભાગ ૮, પાનું ૭૭

ભર્યો છે. જ્ઞાની તેનું વેદન કરનાર છે. નિરાકૃત આનંદના વેદનમાં પડેલો જ્ઞાની વિકારકૃપ એરનો સ્વાદ કેમ લઈ શકે ? શા માટે લે ? આમ કર્મફળચેતનારહિત હોવાથી જ્ઞાની તેનો અભોક્તા જ છે. દ્વા, દાન, ભક્તિ આદિના ભાવ જ્ઞાનીને થાય છે; પરંતુ તે તેમનો ભોક્તા નથી.

આમ જ્ઞાની કર્મોનો કર્તાપણ નથી અને ભોક્તા પણ નથી.^૧

જ્ઞાનચેતનામય હોવાથી જ્ઞાની માત્ર જ્ઞાતા જ છે; તેથી શુભાશુભ કર્મબંધનને અને કર્મના ફળને કેવળ જાણે જ છે.

સારાંશ રૂપે જેઈએ તો ઉપર્યુક્ત કથનમાં મુખ્ય રીતે ત્રણ વાતો કહેવામાં આવી છે -

૧ જ્ઞાની કર્મચેતનારહિત હોવાથી અકર્તા છે, રાગાદિનો કર્તા નથી.

૨ જ્ઞાની કર્મફળચેતનારહિત હોવાથી અવેદક છે, કર્મફળનો-
સુખ્દૃષ્ટાદિનો ભોક્તા નથી.

૩ જ્ઞાની જ્ઞાનચેતનામય હોવાથી કેવળ જ્ઞાતા જ છે, શુભાશુભ કર્મો
અને કર્મફળોને કેવળ જાણે જ છે.

આમ જ્ઞાની-ધર્મી પુરુષ સાક્ષીપણાથી માત્ર જ્ઞાતા-દાખા જ રહે
છે.^૨

આ પ્રમાણે આ કળાશમાં એમ જ કહેવામાં આવ્યું છે કે જ્ઞાની
કર્મચેતના અને કર્મફળ ચેતનાથી રહિત હોવાથી કર્મો નો કર્તા અને તેમના
ફળનો ભોક્તા નથી. પરંતુ જ્ઞાનચેતના સંપત્ત્ર હોવાને લીધે બધાનો સહજ
જ્ઞાતા-દાખા જ છે.

હવે આ જ વાતને ગાથાઓ દ્વારા દફ કરે છે.



૧ તે જ, પાનું ૮૮

૨ પ્રવચનરત્નાકર ભાગ ૬, પાનું ૮૮

સમયસાર ગાથા ૩૧૬-૩૨૦

જે વાત આગળના કળશમાં કહેવામાં આવી હતી, હવે તે જે તને
આ ૩૧૬-૩૨૦ ગાથાઓમાં કહે છે, જે આ પ્રમાણે છે.

ણ વિ કુબ્બિ ણ વિ વેચિ ણાણી કમ્માંડ બહુપયારાં ।

જાણિ પુણ કમ્મફલં બંધં પુણં ચ પાવં ચ ॥૩૧૧॥

દિઢી જહેવ ણાણ અકારયં તહ અવેદયં ચેવ ।

જાણિ ય બનધમોક્ખં કમ્મુદયં ણિજ્જરં ચેવ ॥૩૨૦॥

(હરિગીત)

કરતો નથી, નથી વેદતો શાની કરમ બહુવિધને,

બસ જાગતો એ બંધ તેમજ કર્મફળ શુભ-અશુભને ૩૧૮

જ્યમ નેત્ર તેમજ શાન નથી કારક, નથી વેદક અરે !

જાગેજ કર્મોદ્ય, નિરજરા, બંધ તેમજ મોક્ષને. ૩૨૦

શાની બહુ પ્રકારનાં કર્મોને કરતો પણ નથી, વેદતો પણ નથી;
પરંતુ પુણ્ય અને પાપકૃપ કર્મબંધને તથા કર્મફળને માત્ર જાણે છે.

જેમ નેત્ર દશ્ય પદાર્થોને દેખે જ છે, તેમને કરતું-ભોગવતું નથી;
તેમ શાન અકારક તથા અવેદક જ છે, અને બંધ, મોક્ષ, કર્મોદ્ય તથા
નિર્જરાને જાણે જ છે.

તાત્પર્ય આમ છે કે નેત્રની જેમ શાન પણ પરનો કર્તા-ભોક્તા
નથી, માત્ર શાતા જ છે.

ઉક્ત ગાથાઓનો અર્થ આત્મભ્યાતિમાં આ પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવ્યો છે -

“જાની કર્મચેતના રહિત હોવાને લીધે પોતે અકર્તા હોવાથી, અને કર્મફળ ચેતના રહિત હોવાને લીધે પોતે અભોક્તા છે; તેથી તે ન તો કર્મોને કરે છે અને ન તો ભોગવે છે; પરંતુ જ્ઞાન-ચેતનામય હોવાથી શુભ અથવા અશુભ કર્મબંધને તથા શુભ અથવા અશુભ કર્મફળને માત્ર જાણેજ છે.

જેવી રીતે આ જગતમાં દાચિ (નેત્ર) દશ્ય પદાર્થોથી અત્યંત બિન્ન છે અને તે જ કારણે તે દશ્ય પદાર્થોને કરવામાં અને ભોગવવામાં સંપૂર્ણ અસમર્થ છે. આવી રીતે દાચિ (નેત્ર) દશ્ય પદાર્થોને ન તો કરે છે અને ન તો ભોગવે છે.

જે એમ ન માનીએ તો જેવી રીતે અજિન સળગાવવાવાળો પુરુષ અજિનને સળગાવે છે અને લોઢાનો ગોળો અજિનની ઉષણતાને ભોગવે છે; તેવી જ રીતે દાચિ અર્થાત् નેત્ર વડે અજિન સળગવી જોઈએ અને એની ઉષણતાનો અનુભવ પણ થવો જોઈએ, વેદન થવું જોઈએ; પણ એવું થતું નથી. પરંતુ અજિનને જેનાર આંખ તેને માત્ર હેખે જ છે, બાળતી નથી અને ઉષણતાને અનુભવ પણ કરતી નથી.

તેવી જ રીતે જ્ઞાન પણ જૈયપદાર્થોથી અત્યંત બિન્ન છે અને તે જ કારણે તે જૈયપદાર્થોને કરવામાં અને ભોગવવામાં સંપૂર્ણ અસમર્થ છે. આ કારણે તે જ્ઞાન જૈય પદાર્થોનો કર્તા-ભોક્તા નથી; પરંતુ જૈયોને જાણવાના સ્વભાવવાળો હોવાથી તે જ્ઞાન જૈયકૃપ કર્મબંધ, કર્મદ્ય, નિર્જરા અને મોક્ષને માત્ર જાણે જ છે; તેમનો કર્તા-ભોક્તા નથી.

આચાર્ય જ્યસેન આ ઉઠમી ગાથાની વ્યાખ્યા કરતી વખતે જ્ઞાનીની સાથે નિર્વિકલ્પસમાવિમાં સ્થિત વિશેષજાનો પ્રયોગ કરે છે અને ન ભોગવવાનો અર્થ તન્મય થઈને ન ભોગવવું એમ કરે છે. તથા તે સર્વત્ર નથીનો પ્રયોગ તો કરે જ છે. અહીં પણ લખે છે કે નિશ્ચયનયથી કર્મોને ન તો કરે છે અને ન તો તન્મય થઈને ભોગવે છે.

૩૨૦મી ગાથાની ટીકામાં તેઓ લખે છે કે કેવળ દષ્ટ જ નહીં પરંતુ ક્ષાપિકજ્ઞાન પણ નિશ્ચયનયથી કર્મનો અકારક અને અવેદક જ છે. અંતમાં નિર્જર્ખર્દ્દે લખે છે કે સર્વવિશુદ્ધપરમપારિણામિકભાવગ્રાહક શુદ્ધોપાદાનભૂત શુદ્ધદ્વયાર્થિકનયથી જીવ કર્તૃત્વ-બોક્તૃત્વ, બંધ-મોક્ષાદિ કારણપરિણામોથી રહિત છે. અહીં એમજ સૂચવવામાં આવ્યું છે.

ધ્યાન આપવા જેવી વાત એ છે કે આત્મપ્રાતિમાં સંધૂષણ શબ્દનો પ્રયોગ છે. જેનો અર્થ થાય છે સળગવું, પ્રજ્વલિત થવું. તેનું સ્પષ્ટીકરણ કરતાં આચાર્ય જ્યસેન લખે છે -

વસ્તુ સંધુક્ષણં પુરુષવત्, જેનો અર્થ થાય છે અન્નિ પ્રજ્વલિત કરનારો પુરુષ.

આ જ વાતને ધ્યાનમાં રાખીને અહીં સળગાવનાર પુરુષ એ શબ્દનો પ્રયોગ કર્યો છે.

પૂર્ણ ગુરુદૈવ આ ગાથાઓનો ભાવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે -

“હિંસા, જીર્ણ ચોરી વિષયવાસના આદિ અશુભ રાગ તથા દ્વાય, દીન, વ્રત, ભક્તિ આદિ શુભરાગનું જે કર્તૃત્વ છે તે કર્મચેતના છે. જ્ઞાની આ કર્મચેતનાથી રહિત હોય છે, તેથી તે અકર્તા છે.”

વિકાર અર્થાત્ હર્ષ-શોકનું જે વેદન થાય છે, તે કર્મફળચેતના છે. વિકારી પરિણામોના ફળનું વેદન કરનાર કર્મફળચેતના છે. ધર્મ (સમકિતી) જીવ કર્મફળ ચેતનાથી રહિત હોય છે. તેથી તે અવેદક છે.^૧

આમ કર્મફળચેતનાથી રહિત હોવાથી જ્ઞાની અભોક્તા જ છે

ચિહ્નબહ્સંખ્ય ભગવાન આત્માનો એક જ્ઞાતા-દ્વારા સ્વભાવ્ય છે. સ્વ અને પરને જાળવાનો સ્વભાવ છે. જ્ઞાની માત્ર જ્ઞાનચેતનામય હોવાને લીધે સ્વ-પરનો જ્ઞાતા જ છે.^૨

૧ પ્રવચન રત્નાકર ભાગ ૮, પાનું ૭૮-૮૦

૨ તે જ, પાનું ૮૦

૩ તે જ, પાનું ૮૦

ભગવાન આત્માનો તો જ્ઞાનસ્વભાવ જ છે. રાગાદિ અને શરીરાદિ પરને કરવાનો અને બોગવવાનો સ્વભાવ આત્માનો નથી. જેવી રીતે નેત્ર અજિનને જુએ છે; પરંતુ તેડુપ પરિણામતું નથી, સ્વયં ઉષળતાડુપ થતા લોઢાના ગોળાની માફક આંખ ઉષળ થતી નથી.

આવી રીતે આત્મા, જેનો એક માત્ર જ્ઞાયકસ્વભાવ છે, તે પુણ્ય અને પાપના ભાવોને કરતો નથી, વેદતો પણ નથી; કારણ કે પર અને રાગનું કર્તા-ભોક્તાપણું જ્ઞાનસ્વભાવને છે જ નહીં.^૧

જુઓ, અહીં શુદ્ધદુપે પરિણામેલા જીવની વાત છે. અહીં શુદ્ધજ્ઞાનને ગુણદુપે ગ્રહણ કર્યું છે અને શુદ્ધજ્ઞાનદુપે પરિણાત જીવને દ્રવ્યસ્વરૂપે ગ્રહણ કરેલ છે. હું એક શુદ્ધ જ્ઞાનસ્વભાવી આત્મા છું - જેને પોતાના અંતરમાં આવું શુદ્ધ જ્ઞાનમય પરિણામન થયું તે જીવ શુદ્ધ ઉપાદાનદુપથી દ્વારા, દાન, વ્રત આદિ રાગદુપ ભાવોનો કર્તા નથી અને તેમને વેદતો પણ નથી. કારણ કે આત્માનું શુદ્ધ ઉપાદાન તો શુદ્ધ અને ચૈતન્યમય જ છે.

અહીં મુખ્યથી બે વાતો કહેવામાં આવી છે.

- ૧ ત્રિકાળી જ્ઞાનગુણ દ્વારા, દાન, આદિ રાગને (વિકલ્પને) કરતો નથી અને વેદતો પણ નથી.^૨
- ૨ આવી જ રીતે શુદ્ધજ્ઞાન પરિણાત જીવ પણ રાગને કરતો અને વેદતો નથી.^૩

‘દિદ્ધી ખયં પિ ણાણ’ એટલે કે માત્ર દર્શિ જ નહીં, પરંતુ ક્ષાયિકજ્ઞાન પણ - નિશ્ચયથી કર્મોનો અકારક અને અવેદક છે. જેમ નેત્ર પરને કરતા અને બોગવતા નથી, પરંતુ માત્ર જાળો જ છે; તેમ ક્ષાયિકજ્ઞાન અને જ્ઞાન પરિણાત જીવ પણ દ્વારા-દાન આદિ વિકલ્પોને કરતો નથી અને વેદતો પણ નથી.

૧ પ્રવચન રત્નાકર ભાગ ૮, પાનું ૮૪

૨ પ્રવચન રત્નાકર ભાગ ૮, પાનું ૮૪-૮૫

જુઓ પહેલા બે બોલમાં દ્રવ્યદ્રાષ્ટિ પર જેર આપ્યું છે. હવે અહીં ક્ષાયિકજ્ઞાનની વાત કરે છે. જેવું શક્તિપણે સર્વજ્ઞપણું પ્રગટ થયું તે ક્ષાયિકજ્ઞાન છે. તે ક્ષાયિકજ્ઞાન પણ નિશ્ચયથી રાગનો અકારક અને અવેદ્ધ છે. અહા ! સર્વજ્ઞ પરમાત્માને જે યોગનું કંપન થાય છે તેના પણ સર્વજ્ઞ પરમાત્મા અકારક અને અવેદ્ધ છે.^૧

આપ્રમાણે ક્ષાયિકજ્ઞાનની વાત કરી. હવે ફરી શુદ્ધજ્ઞાન પરિણત સાધક જીવની વાત કરે છે. તે અંગે પૂછે છે કે જે હજુ સિદ્ધ તો થયા નથી, કેવળજ્ઞાન પણ જેમને હજુ થયું નથી - એવા શુદ્ધજ્ઞાન પરિણત સાધક જીવ તો પર અને પર્યાયમાં કંઈક તો કરતા હશે ?

ઉત્તર:- સાધક જીવની વર્તમાન અવસ્થામાં જે રાગાદિ થાય છે, તેમને તે માત્ર જાણો જ છે, કરતા કંઈપણ નથી.^૨

અહીં તો એમ કહી રહ્યા છે કે જીવની અવસ્થામાં ડિંચિત્ રાગ વિઘમાન છે - એવો શુદ્ધજ્ઞાન પરિણત ધર્મી જીવ પણ રાગનો અને પરનો અકર્તા અને અવેદ્ધક (અભોક્તા) છે. પ્રભુ ! શક્તિરૂપે તો આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ ત્રિકાળી છે. આવા આત્માનો આશ્રય થતાં જેને પર્યાયમાં જ્ઞાન અને આનંદની રચના કરવાનું વીર્ય જણૂત થયું તથા અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો સ્વાદ આવ્યો - એવો ધર્મી સાધક જીવ, બંધ અને મોક્ષ-બંનેને માત્ર જાણો જ છે, તેનો કર્તા નથી.^૩

જ્ઞાનમૂર્તિ પ્રભુ ભગવાન આત્મા ચૈતન્ય ચક્ષુ છે. જેમ આંખ દર્શય પદાર્થોને જેતાં થકાં દર્શય પદાર્થમાં પ્રવેશતી નથી; તેમ ચૈતન્યચક્ષુ પ્રભુ આત્મા પરને જાણતો થકો પરમાં પ્રવેશતો નથી. પરથી બિજ્ઞ રહીને પરને માત્ર જાણો જ છે. આ જ બધા તત્ત્વજ્ઞાનનો નિયોડ છે.^૪

૧ પ્રવચન રત્નાકર ભાગ ૮, પાનું ૮૬

૨ પ્રવચન રત્નાકર ભાગ ૮, પાનું ૮૦

૩ પ્રવચન રત્નાકર ભાગ ૮, પાનું ૮૨

૪ પ્રવચન રત્નાકર ભાગ ૮, પાનું ૧૫૦

અહીં પણ એમ જ કહી રહ્યા છે કે ચોથા ગુણસ્થાનમાં સમકિતી ધર્માત્માને તેના કર્મોના નિભિતથી જે જે શુભાશુભભાવ આવે છે, તેમનો તે અકારક અને અવેદક છે, તે તેમને બિન્ન રહીને માત્ર જાણો જ છે. જ્યારે મિથ્યાદિ કર્મદયમાં અને શુભાશુભભાવોમાં એકરૂપ-તદ્દૂપ થઈને તેમનો કર્તા અને ભોક્તા બની રહે છે.

જાની જેવી રીતે કર્મદયને જાણો છે, તેવી જ રીતે સવિપાક અવિપાક નિર્જરાને પણ કરતો નથી, પણ માત્ર જાણો જ છે. આત્મા એકલો જ્ઞાન અને આનંદસ્વરૂપ છે.

અહા ! જેમને આવું બેદજ્ઞાન છે, અંતરમાં એવું ભાન છે, તે જ્ઞાતા-દ્ધા છે.^૧

આ આત્મા એક રજકણથી માંડીને સારી દુનિયાને જાણો છે; પરંતુ જાણવાના સંબંધ માત્રથી તેને પરનો તથા રાગને કરવાનો અને વેદવાનો સંબંધ થઈ જય - એમ વસ્તુ નથી. જ્ઞાનસ્વભાવી વસ્તુ બહુ જ સૂક્ષમ છે. લોકો તો એને સંયોગ અને રાગના સંબંધમય માને છે, પણ અહીં કહે છે કે રાગ અને પરથી બિન્ન શુદ્ધ જ્ઞાનતત્ત્વ કેવળ જ્ઞાનમાત્ર સ્વભાવવાળો છે. તેથી તે કર્મના બંધને માત્ર જાણો જ છે.^૨

જુચો શાસ્ત્રમાં આવે છે કે ચોથા ગુણસ્થાનમાં આટલી પ્રકૃતિઓ સત્તામાં હોય છે, આટલીનો ઉદ્ય હોય છે અને આટલીની ઉદ્દીરણા થાય છે; પરંતુ ભાઈ ! જે કઈ થાય છે, આત્મા તો તેને માત્ર જાણો જ છે, કરતો નથી. કર્મના ઉદ્યાદિ એવી નજીકની ચીજને પણ માત્ર જાણો જ છે, કરતો નથી, તો પછી પર ચીજને કરે, એ વાત ક્યાં રહી ? બોલવું, ચાલવું, પરને મદદ કરવી, પરથી મદદ લેવી આદિ પરની કિયા કરવી તે આત્માના સ્વરૂપમાં નથી.

૧ પ્રવચન રત્નાકર ભાગ ૮, પાનું ૬૩

૨ તે જ, પાનું ૧૬૦

જુઓ, અહીં ત્રણ વાત આવી.

૧. શુદ્ધજ્ઞાનસ્વરૂપ આત્માનું શુદ્ધજ્ઞાન પુરુષ-પાપાદિ ભાવોનો કર્તા નથી અને બોક્તા પણ નથી.

૨. અહીં શુદ્ધજ્ઞાનપરિણિત જવદ્વિષ્ટ લીધુ છે. પરથી અને રાગથી બિન્ન શુદ્ધજ્ઞાનધન પ્રભુ આત્માનું જેને નિર્મળ શ્રદ્ધાન થયું છે, તે શુદ્ધજ્ઞાનપરિણિત જીવ છે. તે રાગનો કર્તા-બોક્તા નથી. છિંઘસ્થ હોવાથી તેને રાગ આવે છે, પણ એ તે રાગનો અકર્તા અને અવેદક છે.

૩. જેને ક્ષાયિકજ્ઞાન-કેવળજ્ઞાન પ્રગટ થયું છે, જે પૂર્ણ પરમાત્મા છે; તે રાગરહિત પૂર્ણ વીતરાગ છે. તેમની બાધ્ય શરીરની દર્શા નગન જ હોય છે તથા આહાર-પાણી (કવલાહાર) હોતો નથી. તે પણ કર્મોના અકારક અને અવેદક છે.

હવે ફરી સાધક જીવની ચર્ચા કરતાં થકા આચાર્ય કહે છે કે શુદ્ધજ્ઞાનપરિણિત જીવ બંધ-મોક્ષ અને શુભાશુભ કર્મોદ્દયને, સવિપાક-અવિપાક નિર્જરાને અને સકામ-અકામ નિર્જરાને જાણો જ છે. ચોથા, પાંચમા અને છઠા ગુણસ્થાનવર્તી જીવ રાગરૂપ ભાવબંધના તથા રાગના અભાવના અને મોક્ષના પણ જ્ઞાતા જ છે. શુભાશુભભાવોને અને પ્રતિસમય થનારી સવિપાક-અવિપાક નિર્જરા આદિને પણ જાણે છે, તેમના જ્ઞાતા જ રહે છે.^૧

આ ટીકા મહામુનિવર દિગંબર સંત જ્યેસેનાચાર્યની છે. તેઓ મુખ્યપણે તો નિજનંદરસમાં જ લીન રહેતા હતા. તેઓ કહે છે કે પરમપારિણામિકપરમભાવરૂપ જે આ શુદ્ધ દ્રવ્યસ્વભાવ છે, તેને ગ્રહણ કરનાર અથવા જાણનાર શુદ્ધ ઉપાદાનભૂત શુદ્ધદ્રવ્યાર્થિકનયથી જીવ કર્તૃત્વ-

^૧ પ્રવચન રત્નાકર ભાગ ૬, પાનું ૧૬૧

બોકૃતૃત્વથી શૂન્ય છે. શુદ્ધ ઉપાદાન તો ત્રિકાળ અકર્તા-અભોક્તા સ્વભાવી છે જે; પરંતુ તેના લક્ષ્યથી જે વર્તમાનદરશા પ્રગટ થાય છે, તે પણ કર્તા-બોક્તાપણાથી શૂન્ય છે. ત્રિકાળી સ્વભાવના આશ્રયથી ઉત્પન્ન આનંદની દરશાથી પરિણત જીવ પણ શુભાશુભ રાગ અને પરપદાર્થોના કર્તા-બોક્તાપણાથી શૂન્ય છે.^૧

બંધ અને મોક્ષનું કારણ - બંને પર્યાયક્રિપ છે, જીવના અશુદ્ધ પરિણામ બંધનું કારણ છે અને શુદ્ધ પરિણામ મોક્ષનું કારણ છે. પરદ્વય્ય તો બંધ-મોક્ષનું કારણ નથી. શુદ્ધદ્વય્ય પારિણામિકપરમભાવ પણ બંધ-મોક્ષનું કારણ નથી. જે આ ધ્યુવદ્વય્ય બંધનું કારણ હોય તો ત્રિકાળ બંધ જ થયા કરે અને જે મોક્ષનું કારણ હોય તો ત્રિકાળ મોક્ષ થાય. અથવા પારિણામિકભાવ સ્વયં સર્વથા પર્યાયક્રિપ થઈ જય તો પર્યાયની સાથે તે દ્વયનો પણ નાશ થઈ જય. આ પ્રમાણે આ ન્યાય (યુક્તિ)થી સિદ્ધ થયું કે બંધ-મોક્ષના પરિણામ અને તેમના કારણ પર્યાયમાં જ છે, ત્રિકાળી ધ્યુવદ્વય્ય શુદ્ધ એક પરમભાવસ્વક્રિપ વસ્તુ તેનાથી શૂન્ય છે ત્રિકાળી ધ્યુવદ્વય્યમાં બંધ-મોક્ષ નથી. અહો ! આ તો ચમત્કારી ગાથા અને ચમત્કારી દીકા છે.^૨

આ રીતે આ ગાથાઓમાં એમ જ કહેવામાં આવ્યું છે કે સાધકના જ્ઞાનની સાથે કાયદિકજ્ઞાન પણ કર્મબંધ, કર્મોદ્ય, કર્મોની નિર્જરા અને મોક્ષનો કર્તા-બોક્તા નથી, પરંતુ માત્ર તેને જાણો જ છે.

અહીં આચાર્ય જ્યસેન લખે છે કે આ રીતે અહીં મોક્ષાધિકારની ચૂલ્લિકા સમાપ્ત થઈ અથવા દ્વિતીય વ્યાખ્યાનથી મોક્ષાધિકાર સમાપ્ત થયો.

તે બાદ કિંચ વિશેષ લખીને આ જ પ્રકરણને સંબંધિત કોઈ એવી વિશેષ વિષયવસ્તુ પ્રસ્તુત કરે છે; જે અત્યંત મહત્વપૂર્ણ હોવાની સાથે આત્માર્થીઓ માટે અત્યંત ઉપયોગી પણ છે.

^૧ પ્રથમન રત્નાકર ભાગ ૬, પાનું ૮૮

^૨ તે જ, પાનું ૮૮

ઉક્ત પ્રકરણે આધ્યાત્મિકસત્પુરુષ શ્રી કાનલુસ્વામીનું વિશેષ ધ્યાન આકર્ષિત કર્યું અને તેમણે ઉક્ત પ્રકરણ પર વિસ્તારથી અત્યંત ઉપયોગી પ્રવચનો કર્યા, જેમને લોક ઉરોભોગ ગાથા પર થયેલા પ્રવચનોનું જ જાણે છે.

જે કે આ વિષયવસ્તુ ઉરોભોગ ગાથાની ઉપરાંત જ આવી છે; છતાં પણ આ ઉરોભોગ ગાથાની ટીકા નથી; કારણ કે ઉરોભોગ ગાથાની ટીકા સમાપ્ત કરીને અધિકારની સમાપ્તિની ઘોષણા કરવા ઉપરાંત એક પ્રકારથી પરિશિષ્ટના રૂપમાં જ આચાર્ય જયસેને આ સામગ્રી પ્રસ્તુત કરી છે. તેથી આ એક સ્વતંત્ર પ્રકરણ જ છે.

ઉક્ત વિષયવસ્તુનો ભાવાનુવાદ મૂળથી આ પ્રમાણે છે.

“હવે અહીં વિચારે છે કે ઔપશમાદિ પાંચ ભાવોમાં મોક્ષ ક્યા ભાવથી થાય છે.

ઉક્ત પાંચ ભાવોમાં ઔપશમિકભાવ, ક્ષાયોપશમિકભાવ, ક્ષાયિકભાવ અને ઔદ્યિકભાવ - આ ચાર ભાવ તો પર્યાયકૃત જ છે અને શુદ્ધપારિણામિકભાવ દ્રવ્યકૃત છે. પદાર્થ પરસ્પરસામેક્ષ દ્રવ્ય-પર્યાયમય છે.

જીવત્ત્વ, ભવ્યત્વ અને અભબ્યત્વ - આ ત્રણ પારિણામિકભાવોમાં શુદ્ધ જીવત્ત્વશક્તિ લક્ષણવાળો જે શુદ્ધપારિણામિકભાવ છે, તે શુદ્ધ દ્રવ્યાર્થિકનયને આશ્રિત હોવાથી નિરાવરણ છે અને બંધ મોક્ષપર્યાયકૃત પરિણતિથી રહિત છે તથા તેનું નામ શુદ્ધપારિણામિકભાવ છે - એમ જાણવું જોઈએ. તથા દુશ્પ્રાણકૃપ જીવત્ત્વ, ભવ્યત્વ અને અભબ્યત્વ - તેમને અશુદ્ધપારિણામિકભાવ કહે છે; કારણ કે તે પર્યાયાર્થિકનયને આશ્રિત છે.

પ્રેષણ:- આ ત્રણ ભાવ અશુદ્ધ શા માટે છે ?

ઉત્તર:- સંસારી જીવોને શુદ્ધનયથી અને સિદ્ધ જીવોને સર્વથા જ દુશ્પ્રાણકૃપ જીવત્ત્વ, ભવ્યત્વ અને અભબ્યત્વનો લક્ષણ, પારિણામિકભાવનો પ્રચ્છાદક અને યથાસંભવ સમ્યક્ત્વાદિ જીવગુણોનો ધાતક દેશગાતિ અને

સર્વધાતિ નામના મોહાદિ કર્મસામાન્ય હોય છે અને જ્યારે કાલાહિલબ્ધિને
વશ ભવ્યત્વશક્તિની વ્યક્તિ અર્થાત્ પ્રગટતા થાય છે ત્યારે આ જીવ
સહજશુદ્ધપારિણામિકભાવલક્ષણવાળા નિજપરમાત્મદ્રવ્યના સમ્યક્ષર્દ્વાન-
જ્ઞાન-આચરણદ્વારે પર્યાયમાં પરિણમે છે. આ જ પરિણમનને આગમભાષામાં
ઔપશમિક, ક્ષાયોક્ષમિક અથવા ક્ષાયિકભાવ અને અધ્યાત્મની ભાષામાં
શુદ્ધાત્માભિમુખ પરિણામ, શુદ્ધોપયોગ આદિ નામાંતરરોથી અભિહિત કરવામાં
આવે છે.

આ શુદ્ધોપયોગદ્વારે પર્યાય શુદ્ધપારિણામિક-ભાવલક્ષણવાળા
શુદ્ધાત્મદ્રવ્યથી કથંચિત્ બિન્ન છે; કારણ કે તે ભાવનાદ્વારે હોય છે અને
શુદ્ધ પારિણામિકભાવ ભાવનાદ્વારે હોતો નથી. જે તેને એકાંતે
અશુદ્ધપારિણામિકભાવથી અભિન્ન માનીશું તો ભાવનાદ્વારે એક મોક્ષકારકભૂત
અશુદ્ધપારિણામિક ભાવનો મોક્ષ અવસ્થામાં વિનાશ થતાં
શુદ્ધપારિણામિકભાવના વિનાશનો પણ પ્રસંગ પ્રાપ્ત થશે, પરંતુ એમ ક્યારેય
થતું નથી.

તેથી આમ સિદ્ધ થયું કે શુદ્ધપારિણામિકભાવવિષયક ભાવના અર્થાત્
જે ભાવના અથવા ભાવનો વિષય શુદ્ધ પારિણામિકભાવદ્વારે શુદ્ધાત્મા છે,
તે ભાવના ઔપશમિક આદિ ત્રણ ભાવદ્વારે હોય છે, શુદ્ધપારિણામિક ભાવ
મોક્ષનું કારણ થતો નથી અને જે શક્તિદ્વારે મોક્ષ છે, તે તો
શુદ્ધપારિણામિકભાવમાં ફહેલાથી જ વિધમાન છે. અહીં તો વ્યક્તિદ્વારે
અર્થાત્ પર્યાયદ્વારે મોક્ષનો વિચાર કરવામાં આવી રહ્યો છે. સિદ્ધાંતમાં પણ
આમ કહ્યું છે - નિષ્ક્રિય: શુદ્ધપારિણામિક: અર્થાત્ શુદ્ધપારિણામિકભાવ
નિષ્ક્રિય છે. ‘નિષ્ક્રિય’ શબ્દનું તાત્પર્ય એ છે કે શુદ્ધપારિણામિકભાવ
બંધના કારણભૂત રાગાદિ પરિણાતિદ્વારે કિયા અને મોક્ષના કારણભૂત
શુદ્ધભાવનાપરિણાતિદ્વારે કિયાથી તદ્વારે અથવા તન્મય થતો નથી.

તેથી આમ પ્રતીત થાય છે કે શુદ્ધપારિણામિકભાવ ધ્યેયદ્વારે હોય
છે, ધ્યાનદ્વારે હોતો નથી, કારણ કે ધ્યાન વિનશ્વર હોય છે.

યોગીન્દ્રદેવે પણ કહ્યું છે -

હે યોગી ! પરમાર્थદર્શિએ તો આ જીવ ન તો ઉત્પન્ન થાય છે, ન તો મરે છે અને ન તો બંધ-મોક્ષને કરે છે - આમ જિજીન્દ્રદેવ કહે છે.

બીજુ વાત આ છે કે વિવક્ષિત-એકદેશશુદ્ધનિશ્ચયનયને આશ્રિત આ ભાવના નિર્વિકાર સ્વસંવેદનલક્ષણવાળા ક્ષાયોપશાભિકજ્ઞાનકૃપ હોવાથી જો કે એકદેશવ્યક્તિકૃપ હોય છે; છતાંપણ ધ્યાતાપુરુષ એમ જ ભાવના કરે છે કે 'હું તો સકળનિરાવરણ, અખંડ, એક, પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્બર, શુદ્ધપારિણામિક પરમભાવ લક્ષણવાળો નિજપરમાત્મદ્રવ્ય જ છું, ખંડજાનકૃપે નથી.'

ઉપર્યુક્ત બધા વ્યાખ્યાન આગમ અને અધ્યાત્મ (પરમાગમ) - બંને પ્રકારના નયોથી પરસ્પર-સાપેક્ષ અભિપ્રાયના અવિરોધથી સિદ્ધ થાય છે - આમ વિવેકીઓએ સમજવું જોઈએ.

ઉક્ત પ્રકરણનું સ્પષ્ટીકરણ મેં પોતે પરમભાવપ્રકાશક નયચક્માં૧ કર્યું છે; જે આ પ્રમાણે છે.

"(૧૬) પ્રક્ષણ: જ્યારે ભાવના એકદેશવ્યક્તિકૃપ છે તો ધ્યાતાપુરુષ આવી ભાવના કેમ કરે છે કે 'હું સકળનિરાવરણ, અખંડ, એક, પ્રત્યક્ષપ્રતિભાસમય, અવિનશ્બર, શુદ્ધપારિણામિક, પરમભાવલક્ષણવાળો નિજપરમાત્મદ્રવ્ય છું. ખંડજાનકૃપે નથી' આવી ભાવના તો સત્ય નથી?

ઉત્તરઃ:- એમાં શું અસત્ય છે ? કારણ કે ધ્યાતાપુરુષે પોતાનું અહુમ્ભૂ (એકત્વ) પરમશુદ્ધનિશ્ચયનયના વિષયભૂત શુદ્ધાત્મદ્રવ્યમાં જ સ્થાપિત કર્યું છે. આ શુદ્ધાત્મદ્રવ્ય ખંડજાનકૃપે ન હોઈને અખંડ છે, અવિનશ્બર છે, શુદ્ધ છે, સકળ નિરાવરણ, પ્રત્યક્ષપ્રતિભાસમય અને પરમપારિણામિક ભાવલક્ષણવાળો છે. તેથી ધ્યાતાપુરુષની ઉક્ત ભાવના સર્વ પ્રકારે ઉચિત છે, સત્ય છે.

રહી વાત એકદેશવ્યક્તિની, તે એકદેશવ્યક્તિત્વ તો પર્યાયમાં છે, સ્વભાવ તો સદા પરિપૂર્ણ જ છે. સ્વભાવમાં તો અપૂર્ણતાની કલ્પના પણ કરી શકતી નથી.

ધ્યાતાપુરુષના ધ્યાનનો ધ્યેય, શ્રદ્ધાનનો શ્રદ્ધેય (દાખિનો વિષય) અને પરમશુદ્ધનિશ્ચયનયરૂપ જ્ઞાનનો જ્ઞેય તો પર અને પર્યાયોથી બિન્ન નિજ શુદ્ધાત્મક્ષર્ય જ છે, તેના આશ્રયથી જ નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પર્યાય ઉત્પન્ન થાય છે.

આ પ્રમાણે ધ્યેય, શ્રદ્ધેય અને પરમજ્ઞેયરૂપ નિજશુદ્ધાત્મક્ષર્ય જ ઉક્ત ભાવનાનું ભાવ્ય છે અને નિશ્ચયસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જ ઉક્ત ભાવ્યના આશ્રયથી ઉત્પન્ન થનાર ભાવના છે.

(મનુષીઓ) અહીં ‘ભાવના’ શબ્દનો અર્થ કોરી ભાવના નથી. પરંતુ આત્માભિમુખ સ્વસંવેદનરૂપ પરિણામન છે. નિર્વિકાર સ્વસંવેદનરૂપ હોવાથી આ ભાવનાનું જ બીજું નામ નિશ્ચયસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે.

જે કે આ ભાવના પણ પવિત્ર છે, છતાં પણ ધ્યાતાપુરુષ તેમાં એકત્વ સ્થાપતો નથી; કારણ કે તે પવિત્ર તો છે, પણ પૂર્ણપવિત્ર નથી, એકદેશ પવિત્ર છે. અપૂર્ણતાના લક્ષ્યથી પર્યાયમાં પૂર્ણતાની પ્રાપ્તિ થતી નથી. આત્મા તો પરિપૂર્ણ પદાર્થ છે, પવિત્ર પદાર્થ છે, પરિપૂર્ણ પવિત્ર પદાર્થ છે; તો તે અપૂર્ણતામાં, અપવિત્રતામાં અને અપૂર્ણ પવિત્રતામાં અહ્મૃ કેમ સ્થાપી રહે ?

આ જ કારણ છે કે જે કે ભાવના એકદેશ નિર્મળ પર્યાયરૂપ છે, છતાં ધ્યાતાપુરુષ તેમાં એકત્વ સ્થાપતો નથી. ધ્યાતાનું એકત્વ તો તે ત્રિકાળી ધ્રુવ સાથે જ હોય છે, જેના આશ્રયથી ભાવનારૂપ ઉક્ત પર્યાયની ઉત્પત્તિ થાય છે.

(૧૭) પ્રશ્ન:- એક દેશ શુદ્ધનિશ્ચયનયનો વિષય હોવાથી ઉક્ત ભાવના એકદેશવ્યક્તિરૂપ છે અને એકદેશ નિર્મળ અર્થાત્ અપૂર્ણ પવિત્ર હોવાથી ધ્યાતાપુરુષ તેમાં અહ્મૃ સ્થાપતો નથી તો પછી તેણે શુદ્ધનિશ્ચયનયના

વિષયકૃપ ક્ષાયિક પર્યાયમાં અહમ્ સ્થાપિત કરવું જોઈએ; કારણ કે તો પૂર્ણ છે, પવિત્ર છે અને પૂર્ણ પવિત્ર છે ?

ઉત્તર:- ધ્યાતાપુરુષ તેમાં પણ એકત્વ સ્થાપતો નથી કારણ કે તે પણ પર્યાય છે. જે કે તે પૂર્ણ પવિત્ર છે, છતાં પરમપવિત્ર નથી. તે પૂર્ણ પાવન છે, પણ પતિત-પાવન નથી. તે પોતે તો પૂર્ણ પવિત્ર છે, પણ તેના આશ્રયથી પવિત્રતા ઉત્પન્ન થતી નથી. તે પૂર્ણ પવિત્ર થર્ડ છે, હતી નહીં. સ્વભાવ પવિત્ર છે, થયો નથી. જે પવિત્ર થાય છે તેના આશ્રયે પવિત્રતા પ્રગટ થતી નથી. જે સદાય પવિત્ર છે; તેના આશ્રયથી જ પવિત્રતા પ્રગટ થાય છે. તે જ પરમપવિત્ર હોય છે, તે જ પતિત-પાવન હોય છે; જેના આશ્રયે પવિત્રતા પ્રગટ થાય છે, પતિતપણું નાચ થાય છે.

ત્રિકાળી ધ્યુવતત્ત્વ પવિત્ર થયો નથી, તે અનાદિથી પવિત્ર જ છે, તેના આશ્રયથી જ પર્યાયમાં પવિત્રતા, પૂર્ણ પવિત્રતા પ્રગટ થાય છે. તે પરમપદાર્થ જ પરમશુદ્ધનિશ્ચયનો વિષય છે.

પવિત્ર પર્યાય સોનું છે, પારસ નથી. પરમશુદ્ધનિશ્ચયન્યનો વિષય ત્રિકાળી ધ્યુવ પારસ છે, જે સોનું બનાવે છે, જેને અડવા માત્રથી લોઢું સોનું બની જય છે. પારસને અડવાથી લોઢું સોનું બની જય છે. સોનાને અડવાથી લોઢું સોનું બની જતું નથી, પણ પારસના અડવાથી તે સોનું બની જય છે. પવિત્ર પર્યાયના, પૂર્ણ પવિત્ર પર્યાયના આશ્રયથી પણ પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થતી નથી. પર્યાયમાં પવિત્રતા ત્રિકાળી શુદ્ધદ્વયના આશ્રયથી પ્રગટ થાય છે. તેથી ધ્યાતાપુરુષ ભાવના ભાવે છે કે હું તો તે પરમપદાર્થ છું, જેના આશ્રયથી પર્યાયમાં પવિત્રતા પ્રગટ થાય છે. હું પ્રગટ થનાર પવિત્રતા નથી, પરંતુ નિત્ય પ્રગટ પરમપવિત્ર પદાર્થ છું. હું સમ્યગ્દર્શન નથી, હું તો તે છું જેના દર્શનનું નામ સમ્યગ્દર્શન છે. હું સમ્યગ્જ્ઞાન પણ નથી, હું તો તે છું, જેના જ્ઞાનનું નામ સમ્યક્જ્ઞાન છે. હું સમ્યક્ચારિત્ર પણ નથી, હું તો તે છું, જેમાં રમવાનું નામ સમ્યક્ચારિત્ર છે.

ધ્યાતાપુરુષ પોતાનું અહમૃ ધ્યેયમાં સ્થાપે છે; સાધનમાં નહીં, સાધ્યમાં પણ નહીં.

(૧૮) પ્રશ્નાઃ- સાધન, સાધ્ય અને ધ્યેયમાં શું અંતર છે ?

ઉત્તરઃ- પરમશુદ્ધનિશ્ચયનયનો વિષયભૂત આત્મદ્રવ્ય - ત્રિકાળી ધ્રુવતત્ત્વ ધ્યેય છે અને તેના આશ્રયથી ઉત્પન્ન થનાર સમ્યગુર્દર્શન-જ્ઞાન-ચારિત્રકૃપ એકદેશ નિર્મળ પર્યાય મોક્ષમાર્ગ અર્થાત્ સાધન છે તથા તે જ ધ્રુવના પરિપૂર્ણ આશ્રયથી પૂર્ણશુદ્ધપર્યાયનું ઉત્પત્ત થવું મોક્ષ છે; તે મોક્ષ જ સાધ્ય છે.

ત્રિકાળીદ્રવ્ય અર્થાત્ નિજશુદ્ધાત્મતત્ત્વ પરમશુદ્ધનિશ્ચયનયનો વિષય છે. પરમશુદ્ધનિશ્ચયનયના વિષયભૂત નિજશુદ્ધાત્મદ્રવ્યના આશ્રયથી ઉત્પન્ન થનાર સમ્યગુર્દર્શન-જ્ઞાન-ચારિત્રકૃપ એકદેશ નિર્મળ પર્યાયનો ઉદ્દ્ય થલો તે એકદેશ શુદ્ધનિશ્ચયનયનો ઉદ્દ્ય છે. અર્થાત્ મોક્ષકૃપ ક્ષાયિકભાવથી યુક્ત આત્મદ્રવ્ય શુદ્ધનિશ્ચયનયનો વિષય છે.

આ જ વાતને સંક્ષેપમાં આ પ્રમાણે કહી શકાય કે એકદેશશુદ્ધનિશ્ચયનયનો વિષય મોક્ષમાર્ગકૃપ પર્યાયથી પરિણમેલો આત્મા છે. શુદ્ધનિશ્ચયનયનો વિષય મોક્ષકૃપે પરિણમેલો આત્મા છે તથા પરમશુદ્ધ નિશ્ચયનયનો વિષય બંધ-મોક્ષથી રહિત શુદ્ધાત્મા છે. એકદેશ શુદ્ધ નિશ્ચયનયનો વિષય મોક્ષમાર્ગસ્વરૂપ હોવાથી સાધન, શુદ્ધનિશ્ચયનયનો વિષય મોક્ષકૃપ હોવાથી સાધ્ય અને પરમશુદ્ધનિશ્ચયનયનો વિષય બંધ અને મોક્ષ પર્યાયથી પણ રહિત હોવાથી ધ્યેય છે.

ધ્યાતાપુરુષનો અહમૃ આ ધ્યેયમાં જ હોય છે, મોક્ષમાર્ગકૃપ સાધન અથવા મોક્ષકૃપ સાધ્યમાં નથી.

(૧૯) પ્રશ્નાઃ- જ્યારે ધ્યાતાપુરુષ પરમશુદ્ધનિશ્ચયનયના વિષયભૂત ધ્યેયમાં જ અહમૃ સ્થાપિત કરે છે તો શું તે જ એકમાત્ર ઉપાદેય છે ?

ઉત્તરઃ- હા, આશ્રય કરવાની અપેક્ષાથી તો એકમાત્ર પરમ શુદ્ધનિશ્ચયનયનો વિષયભૂત શુદ્ધાત્મા જ ઉપાદેય છે, પરંતુ પ્રગટ કરવાની

અપેક્ષા શુદ્ધનિશ્વયનયનો વિષય મોક્ષ અને એકદેશશુદ્ધ નિશ્વયનયનો વિષય મોક્ષમાર્ગ પણ ઉપાડેય છે. અશુદ્ધનિશ્વયનયના વિષય મોહ-રાગ-દ્રેષાદિ હેય છે.

(૨૦) પ્રશ્ન:- સંક્ષેપમાં ઉક્ત ઉહાપોહનો સાર શું છે ?

ઉત્તર:- ઉક્ત સંપૂર્ણ ઉહાપોહનો સાર માત્ર આટલો જ છે કે જો આ ભવ્યળું પરમશુદ્ધનિશ્વયનયના વિષયભૂત નિજશુદ્ધાત્મદ્રવ્યને જાળીને, પીછાણીને તેમાં જ જમી જય, રમી જય તો અશુદ્ધનિશ્વયનયના વિષયભૂત મોહાદિ વિકારીભાવોનો અભાવ થઈને એકદેશશુદ્ધનિશ્વયનયના વિષયભૂત સમ્યગ્દર્શનાદિઃપ એકદેશ પવિત્રતા પ્રગટ થાય; તથા તેમાં જ જમી રહે, રમી રહે નો કાલાંતરે શુદ્ધનિશ્વયનયની વિષયભૂત પૂર્ણપવિત્ર મોક્ષપર્યાય પ્રગટ થઈ જય અને સ્વભાવથી ત્રિકાળપરમાત્મસ્વરૂપ આ આત્મા પ્રગટ પર્યાયમાં પણ પરમાત્મા બની જય અને અનંતકાળ સુધી અનંત અતીનિદ્રિય આનંદનો ઉપભોગ કરતો રહે.”

ઉક્ત સંપૂર્ણ પ્રકરણ પર પૂર્ણ ગુરુદેવે વિસ્તારથી પ્રકાશ પાથથોડો છે. તેનો સાર આ પ્રમાણે છે.

“જુઓ, પાંચ ભાવોમાં ઉપરામ આદિ ચાર ભાવ પર્યાયકારૂપ છે. તેમાં પ્રથમ ત્રણ નિર્મળ પર્યાયકારૂપ છે, ઔદ્ઘિકભાવ મલિન વિકારકારૂપ છે અને પારિણામિકભાવ ધ્રુવ દ્રવ્યસ્વરૂપ છે. આ પાંચમ ધ્રુવભાવ આત્માનો અહેતુક અફુત્રિમ સહજ સ્વભાવ છે.”^૧

પારિણામિકભાવ આત્માનો ત્રિકાળી સહજ એકરૂપ શાશ્વત સ્વભાવ છે. તે ધ્રુવ દ્રવ્યકારૂપ છે. તેને પરમભાવ કહ્યો છે. અન્ય ચાર ભાવ ક્ષણિક છે, તેથી તેમને પરમભાવ નથી કહ્યા.^૨

આ પાંચભાવોમાં સર્વવિશુદ્ધ પરમપારિણામિકભાવ જે શાશ્વત ધ્રુવ

^૧ પ્રવચન રત્નાકર, ભાગ ૮ પાનું ૧૦૧-૧૦૨

^૨ તે જ, પાનું ૧૦૩

અચળ છે, તે દ્રવ્યદ્રવ્ય છે અને અન્ય ચાર ભાવ પ્રગટ પર્યાયદ્રવ્ય છે. આ પરસ્પર સાપેક્ષ-દ્રવ્ય-પર્યાય બંને રૂપે થઈને સંપૂર્ણ આત્મા છે. દ્રવ્ય નિશ્ચય, પર્યાય વ્યવહાર બંને રૂપે થઈને પ્રમાણ વસ્તુ સત્ત છે.

દ્રવ્ય-પર્યાયદ્રવ્ય સંપૂર્ણ પદાર્થ (આત્મા) પ્રમાણનો વિષય છે. તેમાં પરમપારિણામિકસ્વભાવથી જે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે, તે નિશ્ચયનો વિષય છે તથા વર્તમાન વર્તતી પર્યાય વ્યવહારનો વિષય છે. નિશ્ચય સદૈવ ત્રિકાળી દ્રવ્યનો સ્વીકાર કરે છે અને વ્યવહાર વર્તમાન પર્યાયનો સ્વીકાર કરે છે. નિશ્ચય સહિત વ્યવહારના જ્ઞાનને પ્રમાણજ્ઞાન કહે છે.^૧

આત્મદ્રવ્ય સહજ એક શુદ્ધ પરમપારિણામિક લક્ષણ સહા પરમાત્મસ્વરૂપ ચિન્માત્રવસ્તુ છે. આવા નિજ પરમાત્મદ્રવ્યના સમ્યક્ શ્રદ્ધાન-જ્ઞાન-અનુચરણદ્રવ્ય પર્યાયથી જીવના પરિણમનને ધર્મ અને મોક્ષનો માર્ગ કહ્યો છે.^૨

વર્તમાન જ્ઞાનની પર્યાયમાં ત્રિકાળી દ્રવ્યને જોય બનાવીને ‘આ હું છું’ – આમ પ્રતીતિ કરવાનું નામ અંતઃશ્રદ્ધાન છે, સમ્યગ્દર્શન છે તથા જ્ઞાનની પર્યાયમાં ત્રિકાળી દ્રવ્યને જોય બનાવતી સમયે નિજ પરમાત્મદ્રવ્યનું જે પરિજ્ઞાન થયું, તેનું નામ સમ્યગ્જ્ઞાન છે તથા નિજાતમદ્રવ્યના અનુચરણનું નામ સમ્યક્યારિત છે.^૩

ભગવાન આત્મા ત્રિકાળી પરમસ્વભાવદ્રવ્ય પરમપારિણામિક ભાવેલક્ષણ નિજપરમાત્મદ્રવ્ય છે; તેના શ્રદ્ધાન, જ્ઞાન અને ચારિત્રની જે નિર્મલ દશા પ્રગટ થાય છે, તેને ઉપશમ, ક્ષયોપક્ષમ અને ક્ષાયિક – આ પ્રમાણે ત્રણ ભાવત્રય કહેવામાં આવે છે.^૪

વાસ્તવમાં શુદ્ધપારિણામિક ભાવવિષયક - ભાવનાદ્રવ્ય ઔપશમિક

૧ પ્રવચન રત્નાકર, ભાગ ૮ પાનું ૧૦૩

૨ તે ૯, પાનું ૧૦૮

૩ તે ૯, પાનું ૧૧૨

૪ પ્રવચન રત્નાકર, ભાગ ૮ પાનું ૧૧૨

આદિ ત્રણ ભાવ છે, તે ત્રણે રાગાદિથી રહિત હોવાથી, શુદ્ધ ઉપાદાન કારણભૂત હોવાથી મોક્ષના કારણ છે. ચાહે ઉપશમભાવ હો, ક્ષયોપક્ષમભાવ હો યા ક્ષાયિકભાવ હો - આ ત્રણેય ભાવ રાગના વિકલ્પથી રહિત શુદ્ધ છે. તેથી તેમને મોક્ષમાર્ગઢ્રિપ ભાવત્રય કહેવામાં આવે છે.^૧

જુઓ, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ શુદ્ધાત્માબિમુખ પરિણામ છે, તે પરિણામ રાગથી અને પરથી વિમુખ અને સ્વભાવની સન્મુખતાના પરિણામ છે. તેમને આગમની ભાષામાં ઉપશમ, ક્ષયોપક્ષમ અને ક્ષાયિકભાવ કહે છે. આ શુદ્ધાત્માબિમુખ પરિણામ છે, તેથી તેમને મોક્ષમાર્ગ કહેવામાં આવ્યા છે.

પરમભાવસ્વરૂપ વિકાળી નિજ પરમાત્મદ્રવ્યના સમ્યક શ્રદ્ધાન-જ્ઞાન-અનુચરણઢ્રિપ પરિણામને 'શુદ્ધોપયોગ' કહેવામાં આવે છે. તે શુદ્ધોપયોગ સ્વાબિમુખ પરિણામ છે.^૨

ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ શુદ્ધ ચૈતન્ય અનંતગુણ નિધાન પ્રભુ એક સમયમાં પરિપૂર્ણ છે. આવા શુદ્ધાત્માના સન્મુખ થયેલા પરિણામને શુદ્ધોપયોગ કહે છે, અને તેને જ મોક્ષમાર્ગ કહે છે તથા તેને જ શુદ્ધાત્મભાવના, શુદ્ધરત્નત્રય, વીતરાગતા, સ્વચ્છતા, પવિત્રતા, પ્રભુતા, સામ્યભાવ આદિ કહે છે.^૩

રાગાદિ પુણ્ય-પાપના ભાવ તો વિકાળી શુદ્ધ આત્મદ્રવ્યથી બિન્ન જ છે.^૪

અહીં તો તેનાથી પણ વિશેષ એ વાત કહી રહ્યા છે કે પૂર્ણાનંદમય પરમાનંદમય જે મોક્ષ છે, તેનો ઉપાય કે જે શુદ્ધોપયોગઢ્રિપ મોક્ષમાર્ગ છે,

૧ તે જ, પાનું ૧૧૩

૨ પ્રવચન રત્નાકર, ભાગ ૮ પાનું ૧૧૩-૧૧૪

૩ તે જ, પાનું ૧૧૪

૪ તે જ, પાનું ૧૧૫

તે ભાવ પણ એક સમયની પર્યાયકૃપ છે; તેથી તે ભાવ પણ શુદ્ધાત્મક્રિયથી કથંચિત્ બિન્ન છે.^૧

અપૂર્વ આનંદનો સ્વાદ હેનાર મોક્ષમાર્ગની પર્યાય પણ દ્રવ્યથી કથંચિત્ બિન્ન છે. એટલું જ નહીં, મોક્ષની પર્યાય પણ દ્રવ્યથી કથંચિત્ બિન્ન છે.^૨

ભગવાન આત્મા શુદ્ધપારિણામિકભાવ લક્ષણ વસ્તુ પૂર્ણ એક ચૈતન્યમય છે, તે ત્રિકાળભાવકૃપ છે, ભાવનાકૃપ નથી; જ્યારે તેના આશ્રયથી જે મોક્ષનો માર્ગ પ્રગટ થયો છે, તે ભાવનાકૃપ છે, ત્રિકાળ ભાવકૃપ નથી.

જે અજ્ઞાની મૂઢ લુલ સ્ત્રી-પુત્ર, બાગ-બગીચામાં પોતાનું કર્તૃત્વ અને ભમત્વ સ્થાપીને બેઠો છે, તેનીતો વાત જ શું કરવી ? તે તો મોક્ષમાર્ગથી ધરણા કોષો દૂર છે. અહીં તો એમ કહી રહ્યા છે કે મોક્ષમાર્ગની પર્યાય વર્તમાન ભાવનાકૃપ હોવાથી ત્રિકાળી ધૂલ નિજ પરમાત્મક્રિયથી કથંચિત્ બિન્ન છે. આવો બેદ જેને ભાસ્યો નથી, તે પણ મોક્ષના માર્ગથી દૂર છે.

બાર ભાવનાઓ જે કહેવામાં આવી છે, તેમાં પ્રથમ તો આ બધી ભાવનાઓ વિકલ્પકૃપ હોય છે, પછી તેમનો વ્યય થઈને નિર્વિકલ્પ પર્યાય થાય છે. આ નિર્મણ નિર્વિકલ્પ પર્યાય જે અંદરમાં પ્રગટ થઈ, તે ભાવનાકૃપ છે અને ત્રિકાળી એકકૃપ પરમાત્મક્રિયભાવકૃપ છે. શુદ્ધપારિણામિકભાવ ત્રિકાળી સ્વભાવ પરમાનંદમય પ્રભુ ભાવનાકૃપ નથી. તેના આશ્રયથી પ્રગટ થયેલી મોક્ષના કારણકૃપ દશા ભાવનાકૃપ છે.^૩

જુઓ ભાઈ ! મોક્ષમાર્ગમાં ક્ષાયિકાદિ ભાવકૃપ જે નિર્મણ પર્યાયો થઈ, તે પર્યાયો ત્રિકાળી દ્રવ્યથી સર્વથા અભિન્ન નથી. જે સર્વથા અભિન્ન

૧ પ્રવચનરત્નાકર (હિંદી) ભાગ ૬, પાનું ૧૧૭

૨ પ્રવચનરત્નાકર (હિંદી) ભાગ ૬, પાનું ૧૧૮

૩ પ્રવચનરત્નાકર ભાગ ૬, પાનું ૧૧૮

- એક હો તો દ્રવ્ય અને પર્યાય - એવા બે ઘરોની સિદ્ધિ જ નહીં થાય તથા એક (પર્યાય)નો વ્યય થતાં સંપૂર્ણ દ્રવ્યનો જ નાશ થઈ જશે.

જુઓ, પૂર્ણ શુદ્ધ જ્ઞાન અને આનંદની પ્રાપ્તિકૃપ મોક્ષની પર્યાય પ્રગટ થતાં મોક્ષમાર્ગની ભાવનાકૃપ પર્યાયનો વ્યય થાય છે. તે સમયે સંપૂર્ણ આત્મદ્રવ્યનો નાશ થઈ જતો નથી; કારણ કે તે પર્યાય દ્રવ્યની સાથે સર્વથા અભિન્ન નથી, કથંચિત લિખ્ન છે.^૧

‘પંચાસ્તિકાય’ ગ્રંથમાં તો એમ કહ્યું છે કે પર્યાયરહિત દ્રવ્ય નથી અને દ્રવ્યરહિત પર્યાય નથી. એક બાજુ સંપૂર્ણ દ્રવ્ય એટલે દ્રવ્ય-પર્યાયકૃપ વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ કરવું છે અને બીજુ બાજુ અનાદિકાળથી પર્યાયમૂળ જીવને દ્રવ્ય અને પર્યાયનું પરસ્પર બેદ્ધજ્ઞાન કરાવવું છે. તેથી પર્યાયદાચિ છોડાવવા માટે કહ્યું છે કે પર્યાય નિકાળી દ્રવ્યથી કથંચિત્ લિખ્ન છે. જે બંને સર્વથા એકમેક હોય તો પર્યાયનો નાશ થતાં દ્રવ્યનો પણ નાશ થઈ જય; પરંતુ તેમ થતું નથી. તેથી તે ભાવનાકૃપ પર્યાય નિકાળી ભાવથી કથંચિત લિખ્ન છે.^૨

જે કે વાત સૂક્ષ્મ છે; પણ સમજવી અત્યંત જરૂરી છે. તેને સમજયા વિના જ આપણે અનાદિકાળથી દુઃખી છીએ. ભલે ને અત્યારે આપણે પશુ-પક્ષી અને નારકીઓની અપેક્ષા સુખી છીએ; પરંતુ કણાભરમાં આ હેઠ ધૂટીને પશુ-પક્ષીઓ, કિડા-મકોડાની યોનિમાં જઈને જન્મ લઈ શકીએ છીએ ને? આપણને ખબર જ નથી કે અત્યાર સુધી આપણી શું શું હુદ્દશા થઈ છે અને જે આવા જ હાલ રહ્યા તો પછી ચોરાશીના ચક્કરમાં જ પડવાના છીએ. તેથી હે ભાઈ! આ સારા અવસરમાં સ્વકૃપની સમજ કરી લે. નહીં તો કાગડા, કબૂતર, કુતરા અને ન જણે કઈ કઈ યોનિઓમાં જન્મીને સંસાર સાગરમાં ખોવાઈ જઈશ.^૩

જુઓ, આત્મામાં એક પર્યાય અંશ છે, અજ્ઞાન નાશ થઈને જ્ઞાન

૧ પ્રવચનરત્નાકર ભાગ ૬, પાનું ૧૧૮

૨ પ્રવચનરત્નાકર ભાગ ૬, પાનું ૧૨૧-૧૨૨

૩ તે જ, પાનું ૧૨૫

થવું, અશુદ્ધતાનો અભાવ થઈને શુદ્ધતા થવી ઈત્યાદિ નવીન-નવીન કાર્ય પર્યાયમાં જ થાય છે. આવી સ્થિતિમાં જે પર્યાયનું અસ્તિત્વ નહીં માનીએ તો દ્રવ્યમાં નવું કાર્ય તો કંઈ થશે જ નહીં એટલે કે તેને પોતાના અજાનના કારણે સંસારદ્ધશાનો ક્યારેય અભાવ નહીં થાય. જે કોઈ ફક્ત પર્યાયની સાથે જ જેથા કરે અને દ્રવ્યના શુદ્ધસ્વભાવની તરફ લક્ષ ન કરે તો તેની અશુદ્ધતા નાખ પામીને શુદ્ધતા પ્રગટ થશે નહીં. પર્યાયમાં શુદ્ધતા તો ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના આશ્રયે જ થાય છે. દ્રવ્યસ્વભાવમાં અતભુખ-એકાગ્ર થયા વગર પર્યાયની શુદ્ધતા થતી નથી. જે એકાંતથી પર્યાયને જ વસ્તુ માની લઈએ તો પર્યાયનો વ્યય થતાં જ વસ્તુનો નાશ, અભાવ થઈ જય છે; પરંતુ વસ્તુનું સ્વરૂપ એવું નથી અને પર્યાયને ન માનતાં, વસ્તુને એકાંતે નિત્ય ફૂટસ્થ માનતાં, પર્યાયના પલદ્યા વગર નવું કાર્ય થવું સંભવ નથી. આમ વસ્તુમાં દ્રવ્ય-પર્યાય - એવા બંને અંશ એક સાથે જ રહે છે અને તે બંનેમાં કથંચિત્ ભિન્નતા છે - એવો સ્વાદવાદ મત છે.

જુઓ, પરદ્રવ્ય તો આત્માથી સર્વથા ભિન્ન છે. આ શરીર મન-વચન-કાયા આદિ તો આત્માથી સર્વથા જુદા છે. અહીં તો આમ કહે છે કે પોતામાં પણ જે દ્રવ્ય અને પર્યાયોના અંશ છે, તે પણ પરસ્પર કથંચિત્ ભિન્ન છે. અહો ! આ તો બેદજાનની ચરમ સીમારૂપ સર્વોત્કૃષ્ણ વાત છે.^૧

શુદ્ધ આત્મદ્રવ્ય ત્રિકાળ ભાવરૂપ છે અને તેનું અવલંબન લઈને પ્રગટ થયેલી શુદ્ધ પરિણતિ ભાવનારૂપ છે. બંને જ શુદ્ધ છે, પવિત્ર છે. ત્રિકાળી ધ્રુવ આત્મામાં તો રાગ છે જ નહીં, તેનાથી જોડાયેલી પરિણતિમાં પણ રાગ નથી. શુદ્ધાત્માની એવી ભાવના કે જેમાં શુદ્ધ ચૈતન્ય ભાવનું ભવન થયું છે.^૨

જુઓ, આ સંસ્કૃત ટીકા નવસો વર્ષ પહેલાં શ્રી જ્યસેનાચાર્યદે રચી છે. તેમાં એવી ચોખ્ખી વાત કરી છે કે ત્રણ ભાવરૂપ શુદ્ધભાવના સમસ્ત રાગાદિ રહિત હોવાના કારણે શુદ્ધ-ઉપાદાન કારણભૂત હોવાથી મોક્ષનું કારણ

૧ પ્રવચનરત્નાકર ભાગ ૮, પાનું ૧૨૬-૧૨૭

૨ પ્રવચનરત્નાકર ભાગ ૮, પાનું ૧૨૭

છે. ભાઈ ! ચોથા ગુણસ્થાનમાં જે નિર્મળ સમ્બંધર્ણિન-જ્ઞાન-ચારિત્રના પરિણામ પ્રગટ થયા છે, તે રાગાદિ રહિત પરિણામ છે.

અહીં કહે છે - આ ભાવના જે ત્રણ ભાવઙ્ગપ છે, તે સમસ્ત રાગાદિ રહિત હોવાને લીધે, શુદ્ધ-ઉપાદાન કારણભૂત હોવાથી મોક્ષનું કારણ છે. અહીં પર્યાયઙ્ગ શુદ્ધ-ઉપાદાનની વાત છે. ત્રિકાળી શુદ્ધ ઉપાદાન જે શુદ્ધ-દ્રવ્યાર્થિકનયનો વિષય છે, તેની વાત તો પહેલા આવી ગઈ છે. અહીં પર્યાયના શુદ્ધ ઉપાદાનની વાત છે.^૧

સમ્બંધર્ણિન-જ્ઞાન-ચારિત્રઙ્ગપ નિર્મળ પર્યાયનો વિષય ત્રિકાળી દ્રવ્ય છે. વર્તમાન ભાવનઙ્ગપ જે નિર્મળ પર્યાય છે, તે શુદ્ધ ત્રિકાળીને અવલંબે છે. ધર્મની દશા અને મોક્ષની દશા શુદ્ધ પારિણામિકભાવસ્વઙ્ગપ ત્રિકાળી (દ્રવ્ય)નું અવલંબન કરે છે, તે રાગનું અવલંબન કરતી નથી તથા વર્તમાન પર્યાયનું પણ અવલંબન કરતી નથી. નિર્મળ પર્યાયનો વિષય પર્યાય નથી. સમ્બંધર્ણિની પર્યાય ત્રિકાળી દ્રવ્યને અવલંબતી થકી પોતાના ઘટકારકથી સ્વતંત્રપણે પ્રગટ થાય છે. આ અનુપમ અમૃત છે. ભાઈ ! આચાર્યદ્વિયે આ પંચમકાળમાં આ અમૃત વરસાવ્યું છે.

જુઓ, નિયમસારમાં આચાર્યદ્વિયે આમ કહ્યું છે કે ઉપશમ, ક્ષયોપક્ષમ અને ક્ષાયિકભાવ જે નિર્મળ વીતરાળી ધર્મની પર્યાય છે, તેને અમે પરદ્રવ્ય કહીએ છીએ. અહાણ ! તે પરભાવ છે, પરદ્રવ્ય છે તેથી હેય છે - એવું ત્યાં કહ્યું છે. વ્યવહારતનત્ત્વનો રાગ તો હેય છે ૪, પણ શુદ્ધ આત્મદ્રવ્યની દાચિ થતાં જેમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે, તે મોક્ષમાર્ગની નિર્મળ પર્યાય પણ ત્રિકાળી દ્રવ્યની દાચિએ પરભાવ છે, પરદ્રવ્ય છે અને તેથી હેય છે અર્થાત્ આ નિર્મળ પર્યાય પણ અવલંબન યોગ્ય નથી. જેમ રાગ આશ્રયને યોગ્ય નથી, તેમ નિર્મળ પર્યાય પણ આશ્રયને યોગ્ય નથી.^૨

૧ પ્રવચનરત્નાકર ભાગ ૬, પાનું ૧૩૨

૨ પ્રવચનરત્નાકર ભાગ ૬, પાનું ૧૩૫

સમકાળીને સ્વ-આશ્રયથી જેટલી શુદ્ધ-ઉપાદાનકૃપ પરિણાતિ થઈ છે, તેટલું મોક્ષનું કારણ છે. ધ્યાવભાવકૃપ, અક્ષિય ત્રિકાળી શુદ્ધ-દ્રવ્ય મોક્ષનું કારણ થતો નથી તથા શુદ્ધદ્રવ્યથી વિમુખ વર્તતા ભાવ પણ મોક્ષનું કારણ થતા નથી, શુદ્ધ દ્રવ્યની સન્મુખ થઈ વર્તતા નિર્મણભાવ મોક્ષનું કારણ થાય છે. આ પ્રમાણે અહીં પર્યાયમાં કારણ-કાર્યપણું કહ્યું છે. આમ તો તે-તે સમયની પર્યાય પોતપોતાના સમયમાં શુદ્ધદ્રવ્યનું અવલંબન કરીને સ્વયં પૂર્ણ શુદ્ધક્રૈપ્રગટ થાય છે. તે પૂર્વ પર્યાયમાંથી આવતી નથી. પણ પૂર્વમાં એટલી શુદ્ધિપૂર્વક જ પૂર્ણ શુદ્ધતા થાય છે, તેથી તેમાં કારણ-કાર્યપણું કહ્યું અને તેનાથી વિરુદ્ધ ભાવોનો નિષેધ કર્યો છે. આ પ્રમાણે ક્યા ભાવથી મોક્ષ સાધવામાં આવે છે - તે બતાવ્યું છે.^૧

શુદ્ધ-પારિણામિક - શુદ્ધચેતના માત્ર વસ્તુ પર દાખિ પડવાથી જે નિર્મણ પરિણામન થાય છે, તે મોક્ષનું કારણ છે; પરંતુ શુદ્ધ પારિણામિક વસ્તુ મોક્ષનું કારણ નથી; કારણ કે તે ઉત્પાદ-વ્યય રહિત નિર્જિય ચીજ છે. તેમાં બંધમાર્ગ અને મોક્ષમાર્ગની કિયાઓ થતી નથી, તે આવી નિર્જિય ચીજ છે.^૨

જુઓ, ત્રિકાળી શુદ્ધપારિણામિકભાવ નિર્જિય છે. તે શુદ્ધ પારિણામિકભાવ જેવી રીતે બંધના કારણભૂત (રાગાદિ પરિણાતિ) કિયાકૃપ થતો નથી, તેવી જ રીતે મોક્ષના કારણભૂત નિર્મણ, નિર્વિકાર શુદ્ધભાવના પરિણાતિ કિયાકૃપ પણ થતો નથી. તેથી તે નિર્જિય છે. અહાહા ! સમ્યગ્દર્શનનો વિષય જે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે, તે સમ્યગ્દર્શનની કિયાકૃપ થતો નથી. ભાઈ ! આ તો ત્રિલોકનાથ જૈન વીતરાગી પરમેશ્વરની દિવ્યધ્વનિમાં આવેલું અમૃત છે ! અહો ! સમયસાર, પ્રવચનસાર ઈત્યાદિ દ્વારા આચાર્યદ્વારે અમૃત વરસાવ્યું છે.^૩

૧ તે જ, પાનું ૧૩૮

૨ પ્રવચનરત્નાકર ભાગ ૬, પાનું ૧૩૮

૩ પ્રવચનરત્નાકર ભાગ ૬, પાનું ૧૪૩

અહીં તો પહેલા કહેવાઈ ગયું છે કે શુદ્ધ-ઉપાદાનભૂત શુદ્ધદ્રવ્યાર્થિકનયથી જીવ કર્તૃત્વ-ભોક્તૃત્વના તથા બંધ-મોક્ષના કારણ અને પરિણામથી શૂન્ય છે. બંધ અને બંધનું કારણ, મોક્ષ અને મોક્ષનું કારણ - આ ચારેથ ચીજે ત્રિકાળી શુદ્ધદ્રવ્યમાં નથી.¹

વાસ્તવમાં તો પર તરફ દળેલી જ્ઞાનની પર્યાયમાં પણ જ્ઞાયક જ જ્ઞાણવામાં આવી રહ્યો છે. આ વાત આચાર્યદ્વિને ૧૭મી-૧૮મી ગાથામાં કહી છે. જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વ-પરપ્રકાશક છે, તેથી વર્તમાન જ્ઞાનપર્યાયમાં ત્રિકાળી પરમપારિણામિકભાવકૃત્ય વસ્તુ જ્ઞાણવામાં આવે છે. અજ્ઞાનીના જ્ઞાનમાં પણ ત્રિકાળી દ્વારા જ્ઞાણવામાં આવે છે, પણ તેની નજર તેના પર નથી. ધ્રુવની દર્શિ કરવાને બદલે તે પોતાની નજર પર્યાય પર, રાગ પર, નિમિત્ત પર અને બહારના પદાર્થો પર રાખે છે. તેથી તેને અંદરનું ચૈતન્ય નિધાન દેખાતું નથી.

અનંત શક્તિસ્વકૃત્ય આત્માનો અનુભવ કરતાં અનંત શક્તિઓનો એક અંશ પર્યાયમાં પ્રગટ થાય છે. સમ્યગ્રહંસના ઇપમાં શ્રદ્ધાનો અંશ પ્રગટ થાય છે, બાવશ્રુતજ્ઞાનના ઇપમાં જ્ઞાનનો અંશ પ્રગટ થાય છે. ચારિત્રનો અંશ પ્રગટ થાય છે, વીર્યનો અંશ પ્રગટ થાય છે, સ્વચ્છતા અને પ્રભુતાનો અંશ પણ પર્યાયમાં વ્યક્ત થાય છે. તે બધી નિર્મળ પર્યાયો ધ્યાતા પુરુષના ધ્યાયનું ધ્યેય નથી. ધ્યાતા પુરુષ તે પ્રગટ પર્યાયોને જાણે જરૂર છે, પણ તે પર્યાયોનું ધ્યાન કરતો નથી. તે પર્યાયોનો ધ્યાતા નથી.

અનંત-અનંત શક્તિઓનો પિંડ પ્રભુ આત્મા સકળ નિરાવરણ છે અને તે અનંત ગુણોથી ભરેલો હોવા છતાં પણ ગુણભેદથી રહિત અખંડ એક છે; ખંડકૃત નથી, ભેદકૃત નથી; તે પર્યાયના ભેદથી પણ ભેદકૃત થતો નથી - આવો અભેદ એક છે તથા સ્વસંવેદનજ્ઞાનમાં પ્રત્યક્ષ જાણી

¹ પ્રથમનરત્નાકર ભાગ ૮, પાનું ૧૫૪

શકાય એવો પ્રત્યક્ષ પ્રતિભાસમય છે. આત્મા સ્વભાવથી જ પ્રત્યક્ષ પ્રતિભાસમય છે.

પર્યાયની અપેક્ષાએ કેવળજ્ઞાનાદિને પરમભાવ કહેવાય છે, પૂર્ણ દૃશાને પરમભાવ કહે છે પરંતુ દ્રવ્યસ્વભાવની અપેક્ષાથી તો વિકાળ એકસ્વરૂપ શુદ્ધ-પારિણામિકભાવ જ પરમભાવ છે. છઠી ગાથામાં જેને એક જ્ઞાયકભાવ કહ્યો તે જ પરમભાવ છે. આવો પરમભાવસ્વરૂપ અખંડ એક જ્ઞાયકભાવ જેનો ભાવ છે, તે નિજ પરમાત્મદ્રવ્ય હું છું - આમ ધર્માત્મા ધ્યાવે છે. ધર્માત્મા પોતાને અરહંતાદિ સર્વજ્ઞ પરમાત્મારૂપે ધ્યાવતો નથી, તે તો પોતાના જ વિકાળી આત્માને “હું પરમાત્મદ્રવ્ય છું” એમ ધ્યાવે છે અર્થાત્ અનુભવ કરે છે. પ્રગટ્રૂપ સર્વજ્ઞ પરમાત્મા તો પરદ્રવ્ય છે, તેમને ધ્યાવતાં તો રાગ થાય છે.

જુઓ, ભગવાનના કહેલા શાસ્ત્રો આગમ અને અધ્યાત્મના શાસ્ત્ર છે. ભગવાન દ્વારા કહેલા દ્રવ્યોનું જેમાં નિરૂપણ છે તેમને આગમ કહે છે. અનંત આત્મા છે, અનંતાનંત પુરુષલદ્રવ્ય છે, એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય, એક આકાશ અને અસંખ્યાત કાળાણુ - આ પ્રમાણે જાતિથી છ દ્રવ્ય છે અને સંખ્યાથી અનંત છે. જેમાં આ બધાનું નિરૂપણ હોય; તે આગમ છે તથા જેમાં શુદ્ધ નિશ્ચયસ્વરૂપ આત્મદ્રવ્ય અને તેની નિર્મળ પર્યાયોનું નિરૂપણ હોય, તે અધ્યાત્મશાસ્ત્ર છે. આચાર્ય કહે છે - અહીં આ બંનેનું સાપેક્ષ કથન કર્યું છે.

નયદ્વયના અભિપ્રાયના અવિરોધપૂર્વક જ અહીં કહેવામાં આવ્યું છે. તેથી આ કથન સિદ્ધ છે, નિર્બધ છે - આમ વિવેકીઓએ જાણવું જોઈએ.

જેને વિવેક નથી, તે ભલે જેવું ગમે તેવું માને; પણ વિવેકી પુરુષોએ તો તેને પ્રમાણરૂપ જાણીને જેમ ભવનો નાશ કરનારી શુદ્ધાત્મભાવના પ્રગટ

થાય તેમ પ્રવર્તનું; કારણ કે આવી ભાવના દ્વારા જ ભવનો નાશ થઈને સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે.”

ઉક્ત સંપૂર્ણ કથનનો સાર આ છે કે ઔપરામિકાદિ પાંચ ભાવોમાં દ્રબ્ધકૃપ પરમપારિણામિકભાવ ન તો બંધનું કારણ છે અને ન તો મોકાનું; કારણ કે તે બંધ-મોકાના પરિણામોથી રહિત નિર્જિય તત્ત્વ છે. ઉક્ત પરમપારિણામિકભાવના આશ્રયથી ઉત્પન્ન થનારા ઔપરામિકાદિભાવ જ મુક્તિના કારણ છે અને તેની ઉપેક્ષાપૂર્વક પરના આશ્રયથી ઉત્પન્ન થનારા ઔદ્યિકભાવ બંધનું કારણ છે. તાત્પર્ય આમ છે કે ઉક્ત પરમપારિણામિકભાવમાં પોતાપણું સ્થાપિત કરનારી શ્રદ્ધાગુણની પર્યાય સમ્યગ્દર્શન, તેને જ નિજ જ્ઞાનનારી જ્ઞાનની પર્યાય સમ્યગ્જ્ઞાન અને તેમાં જ જમીને રમનાર ચારિત્રગુણની ધ્યાનકૃપ સમ્યક્ષચારિત્ર પર્યાય જ મુક્તિનું કારણ છે તથા તેનાથી લિત્ર પરપદાર્થોમાં પોતાપણું સ્થાપીને શ્રદ્ધા-જ્ઞાન અને ચારિત્રનું પરિણામન બંધનું કારણ છે.

આવી રીતે મુક્તિના માર્ગમાં શ્રદ્ધેય, ધ્યેય અને પરમજોયકૃપ તો ઉક્ત પરમપારિણામિકભાવ છે અને સાધન સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રકૃપ ઔપરામિક, ક્ષાયિક અને ક્ષાયોપરામિકભાવ છે; નેમને અધ્યાત્મભાષામાં શુદ્ધોપયોગકૃપ પરિણામ કરે છે.

અહીં એક પ્રશ્ન સંભવ છે કે અહીં પરમપારિણામિકભાવકૃપ ત્રિકાળીધૂપ જ્ઞાયકભાવને મોકાનું પણ અકારણ બતાવવામાં આવી રહ્યો છે; જ્યારે અધ્યાત્મશાસ્ત્રોમાં જ અનેક સ્થાનો પર આને જ મોકાનું કારણ પણ બતાવવામાં આવ્યું છે.

અરે ભાઈ ! જ્યાં પરમપારિણામિકભાવકૃપ જ્ઞાયકભાવને મોકાનું કારણ બતાવવામાં આવે છે ત્યાં તે આશ્રયભૂત કારણના રૂપમાં જ અપેક્ષિત હોય છે. તાત્પર્ય આમ છે કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રકૃપ મુક્તિમાર્ગ

ત્રિકાળીધ્વિવ ભગવાન આત્માના આશ્રયથી પ્રગટ થાય છે. ત્રિકાળીધ્વિવ ભગવાન આત્મામાં પોતાપણું સ્થાપિત હોવાનું નામ સમ્યગ્દર્શન, તેને જ પોતાનો માનવાનું નામ સમ્યગ્જ્ઞાન અને તેમાં જ રમવા-જમવાનું નામ સમ્યગ્ચારિત્ર છે. આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષના કારણ છે અને તે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ભગવાન આત્માના આશ્રયથી ઉત્પન્ન થાય છે. આ જ કારણથી પરમ પારિણામિક ભાવકૃપ ભગવાન આત્માને મુક્તિનું કારણ કહેવામાં આવે છે.

પરંતુ અહીં આવી અપેક્ષા નથી. અહીં તો આમ કહેવામાં આવી રહ્યું છે કે પરમપારિણામિકભાવકૃપ ત્રિકાળીધ્વિવ નિર્જિય હોવાથી ન તો કોઈનું કાર્ય છે અને ન તો કોઈનું કારણ. ૪૭ શક્તિઓમાં અકાર્યકારણશક્તિ નામની એક શક્તિ છે. જેનો આશય જ આ છે કે ભગવાન આત્મા ન તો કોઈનું કાર્ય છે અને ન તો કોઈનું કારણ.

ખરેખર વાત આમ છે કે પરના આશ્રયથી ઉત્પન્ન થનાડું શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રગુણનું મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રકૃપ વિકારી પરિણામન જ બંધનું કારણ છે. તે જ ગુણોનું પરમપારિણામિકભાવકૃપ સ્વના આશ્રયથી ઉત્પન્ન થનાડું સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રકૃપ નિર્મણ પરિણામન મોક્ષનું કારણ છે.

ઉક્ત વસ્તુસ્થિતિના સંરંભમાં જ્યારે આશ્રયભૂત દ્રવ્યની મુખ્યતાથી વાત કરીએ તો એક જ્ઞાયકભાવકૃપ પરમપારિણામિકભાવને મોક્ષનું કારણ કહે છે અને જ્યારે તેના આશ્રયથી ઉત્પન્ન થયેલી પર્યાયની અપેક્ષા વાત કરીએ તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રકૃપ ઔપરામિક, જ્ઞાયોપક્ષમિક અને ક્ષાયિકભાવોને મોક્ષનું કારણ કહેવામાં આવે છે.

આપ્રમાણે બંને કથન સાપેક્ષ છે, પરમસત્ય છે; સાપેક્ષ પરમસત્ય છે.

અહીં એક બીજુ વાત પણ વિશેષ ધ્યાન હેવા યોગ્ય પ્રતીત થાય છે કે આચાર્ય જ્યસેન અહીંથી માંડીને આગામી ગાથાઓને સમયસાર

ચૂલિકાના રૂપમાં જુએ છે. આ વાતનો ઉલ્લેખ તેઓ તાત્પર્યવૃત્તિમાં સ્પષ્ટત્તે કરે છે અને સાથે ચૂલિકા શબ્દનો અર્થ પણ સ્પષ્ટ કરે છે. તેઓ અધિકારનું નામ પણ સમયસાર ચૂલિકા જ રાખે છે અને અન્ય અધિકારોની ભાફક આ સમયસાર ચૂલિકા અધિકારની ૮૬ ગાથાઓવાળી સમુદ્દ્રાય પાતનિકા પણ વિસ્તારથી લખે છે. તેમનું કથન મૂળથી આ પ્રમાણે છે.

“અત: પરं જીવાદિનવાધિકારેષુ જીવસ્ય કર્તૃત્વભોકૃત્વાદિસ્વરૂપં
યથાસ્થાનં નિશ્ચય-વ્યવહારવિભાગેન સામાન્યેન યત્પૂર્વ સૂચિતં, તસ્યैવ
વિશેષવિવરણાર્થ ‘લોકસ્સ કુણદિ વિહણુ’ ઇત્યાદિ ગાથામાદિં કૃત્વા
પાઠક્રમેણ ષડધિકનવતિગાથાપર્યત ચૂલિકાવ્યાખ્યાનં કરોતિ ।

ચૂલિકાશબ્દસ્યાર્થ: કથયતે । તથાહિ - વિશેષવ્યાખ્યાનં,
ઉક્તાનુક્તવ્યાખ્યાનં ઉક્તાનુક્તસંકીર્ણવ્યાખ્યાનં ચેતિ ત્રિધા
ચૂલિકાશબ્દસ્યાર્થો જ્ઞાતવ્ય: ।

આનાથી પહેલા જીવાદિન નવ અધિકારોમાં કર્તૃત્વ-ભોકૃત્વાદિ સ્વરૂપનું
યથાસ્થાન નિશ્ચય-વ્યવહાર નયના વિભાગ દ્વારા જે વિવેચન કરવામાં આવ્યું
છે; હવે તેનું જ વિશેષ વિવરણ આપવા માટે ‘લોકસ્સ કુણદિ વિહણુ’
ઈત્યાદિ ગાથાથી આરંભ કરીને ૮૬ ગાથાઓમાં ચૂલિકાનું વ્યાખ્યાન કરે છે.

હવે ચૂલિકા શબ્દનો અર્થ કરે છે - વિશેષ વ્યાખ્યાન,
ઉક્તાનુક્તવ્યાખ્યાન અને ઉક્તાનુક્ત સંકીર્ણ વ્યાખ્યાન - આ પ્રમાણે ત્રણ
પ્રકારે વ્યાખ્યાન કરવું એમ ચૂલિકા શબ્દનો અર્થ જાણવો જોઈએ.”

આગામી ગાથાઓમાં જે પ્રકારની વિષયવસ્તુ આવે છે, તે અનુસાર
આ પ્રકરણને ચૂલિકા કહેવું તે કંઈ અનુચિત પણ પ્રતીત થતું નથી; કારણ
કે ચૂલિકામાં જેનું વિવેચન થઈ ગયું હોય તે જ વાતને વિશેષ વિસ્તારથી
કહેવામાં આવે છે. સાથે કોઈ વાતો એવી પણ હોય છે કે જેનું પહેલા વિવેચન

થયેલ નથી, પણ વિષયની સ્પષ્ટતા માટે તેમનું કથન અપેક્ષિત હોય છે.
આ પ્રમાણે ચૂલિકામાં મિશ્રિત વ્યાખ્યાન હોય છે.

ખરેખર વાત આમ છે કે વિષયવસ્તુના પ્રતિપાદનના ક્રમમાં જે વાતો
કહેવી સંભવ નથી અથવા આવશ્યક વિસ્તારથી કહેવી સંભવ થતી નથી;
તે વાતોને લેખક ચૂલિકામાં સ્પષ્ટ કરે છે.

આચાર્ય અમૃતયંદ્ર જેને સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર નામ આપે છે, તેને
જ આચાર્ય જ્યસેન સમયસાર ચૂલિકા કહે છે. આટલો ફરક જરૂર છે કે
આ સમયસાર ચૂલિકા અહીંથી આરંભ થાય છે જ્યારે આત્મજ્ઞાતિનો
સર્વવિશુદ્ધ જ્ઞાનાધિકાર ૧૨ ગાથા પહેલા આરંભ થઈ જાય છે.

હવે આગામી ગાથાઓની સૂચના દેનારું કળશ કાવ્ય લખે છે; જે
આ પ્રમાણે છે.

(અનુષ્ઠાન)

યे તુ કર્તારમાત્માનं પશ્યંતિ તમસા તતા: ।
સામાન્યજનવત્તેષાં ન મોક્ષોऽપિ મુમુક્ષતામ् ॥૧૧૧॥

(હરિગીત)

અજ્ઞાનઅધ્યથી જેહ કર્તા આત્માને માનતો,
મોક્ષચ્છુ તે લૌકિક જન સમ મોક્ષ ના કહી પામતો. ૧૮૮

જેઓ અજ્ઞાનાધંકારથી આચછાદિત થયા થકા આત્માને કર્તા માને છે;
તેઓ ભલે ને મોક્ષના ઈચ્છુક હોય; છતાં પણ લૌકિકજનોની માફક તેમને
પણ મુક્તિની પ્રાપ્તિ થતી નથી.

જે કે આ કળશનો અર્થ એકદમ સહજ, સરળ અને સામાન્ય જ
છે કે મોક્ષની ઈચ્છા રખનારા લોકો પણ જે સામાન્ય લૌકિકજનોની માફક
આત્માને પરનો કર્તા-ધર્તા માને છે તો તેમને પણ લૌકિકજનોની સમાન
જ મુક્તિની પ્રાપ્તિ ન થાય. છતાં પાંડે રાજમલણાચે કળશ ટીકામાં કંઈક
વિશેષ સ્પષ્ટીકરણ કર્યું છે, જે ધ્યાન દેવા યોગ્ય છે.

એક તો તેઓ અહીં મુસુક્ષુતા પદનું સ્પષ્ટીકરણ કરતાં કહે છે કે જે જૈનમતાશ્રિત છે, બહુ ભાગેલા છે, દ્વયદ્વિયકૃપ ચારિત્ર પાળે છે અને મોક્ષના અભિલાષી છે, તે મુમુક્ષુ છે બીજી આત્માનં કર્તારં પશ્યન્તિ નો અર્થે જીવદ્વયને શાનાવરણાદિ કર્મો અને રાગાદિ ભાવોનો કર્તા માને છે - આમ કરે છે.

અંતમાં ભાવાર્થમાં સ્પષ્ટ કરે છે કે તેઓ મિથ્યાદાદિ છે જેઓ જીવનો સ્વભાવ કર્તાર્પણ માને છે; કારણ કે કર્તાર્પણું જીવનો સ્વભાવ નથી. વિભાવકૃપ અશુદ્ધ પરિણાતિ છે; તે પણ પરના સંયોગથી છે, વિનાશિક છે.

પાંઠે રાજમલજીના ઉક્ત કથનનો આશય માત્ર આટલો જ છે કે જિનાગમમાં જે વ્યવહારન્યોથી ઉક્ત ભાવોનો કર્તા-ભોક્તા આત્માને કહ્યો છે; અહીં તેમના નિષેધની વાત નથી. અહીં તો એમ કહેવામાં આવી રહ્યું છે કે પરમશુદ્ધનિશ્વયનયની અપેક્ષા અથવા સ્વભાવની અપેક્ષા ભગવાન આત્મા પરનો, કર્મોનો અને રાગાદિ ભાવોનો કર્તા-ભોક્તા નથી.

પાંઠે રાજમલજીના ભાવોનું અનુસરણ કરતાં કવિબર બનારસીદાસજી ઉક્ત છંદનો ભાવાનુવાદ આપ્રમાણે કરે છે -

(કવિત્ત)

જ્યોંહિય અંધવિકલ મિથ્યા ધરમૃષા સકલ વિકલપ ઉપજાવત ।
ગહિ હકંત પક્ષ આત્મ કૌ કરતા માનિ અધોમુખ ધાવત ॥
ત્યોં જિનમતી દરબચારિત્રી કર કરની કરતાર કહાવત ।
વાંછિત મુકતિ તથાપિ મૂઢમતિ વિન સમકિત ભવ પાર ન પાવત ॥

જેવી રીતે હદ્યથી આંધળા અન્યમતી મિથ્યાદાદિ જીવ મિથ્યાત્વને કારણે દુઃખી થાય છે અને અનેક પ્રકારના જુઠા વિકલ્પો ઉત્પન્ન કરે છે; એકાંતપક્ષને ગ્રહણ કરીને આત્માને પરપદાર્થોનો કર્તા માનીને અધ્ય:- પતનને પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે દ્વયચારિત્રી અર્થાત્ વ્યવહારચારિત્રને ધારણા કરનારા જૈનમતીઓ પણ અનેક પ્રકારની કિયાઓ કરીને પોતાને ઉક્ત કિયાઓનો કર્તા માને છે. તેઓ

મુક્તિની કામના કરે છે; છતાં પણ તે મૂઢમતીઓ, સમ્યગ્દર્શિન ન હોવાથી સંસારસમુદ્રનો ડિનારો પ્રાપ્ત કરી શકતા નથી.

ઉક્ત કથનનો પણ આ જ આશય છે કે જેવી રીતે એક દ્રવ્યને બીજી દ્રવ્યનો કર્તા-ધર્તા માનનારા અન્યમતી મિથ્યાદાદિ જીવ સંસારસમુદ્રથી પાર થતા નથી; તેવી જ રીતે પોતાને પરના કર્તા માનનારા જૈનમતી પણ કેટલાય કઠોર ક્રિયાકાંડ કેમ ન કરે, સંસારસમુદ્રથી પાર થતા નથી; કારણ કે બંનેને પરમાં કર્તૃત્વબુદ્ધિ એક સમાન જ છે.

આ રીતે આ કળશમાં એમ જ કહેવામાં આવ્યું છે કે જે જૈની જૈનસાધુ અથવા મુમુક્ષુ થઈને પણ પોતાને પરનો કર્તા માને છે; તેમને સામાન્ય લૌકિકજનોની માફક જ મુક્તિથી પ્રાપ્તિ નહીં થાય.

અહીં પરના કર્તૃત્વની માન્યતાવાળા જૈન શ્રમણોને લૌકિકજનો જેવા બતાવીને તેમને વિશેષ સાવધાન કર્યા છે અને પરકર્તૃત્વ સંબંધી માન્યતા છોડવાની પ્રબળ પ્રેરણા આપી છે.



શાલગોટી

પ્રશ્ન :- જિન માતાએ જેખેલ સોળ સ્વર્ણ ક્ર્યા ?

સમાધાન :- જિન માતાનાં સોળ સ્વર્ણ - (૧) ગર્ભના કરવાવાળા સફેદ હાથીને જેથો (૨) સફેદ બણણ ને જેથો (૩) સિંહને જેથો (૪) બાજુએથી બે હાથી કળશાલિષેક કરી રહ્યા હોય એવી લક્ષ્મીને જેઈ (૫) લટકતી ફૂલોની બે માળાઓ જેઈ (૬) ચાંદનીયુક્ત પૂર્ણ ચન્દ્રમાને જેથો (૭) ઉદ્ય થતા સૂર્યને જેથો (૮) સરોવરમાં કીડા કરવાવાળા બે મીન જેથા (૯) કમલાચાહિત સુવર્ણિમય બે પૂર્ણકળશ જેથા (૧૦) પદ્મ સરોવર જેથું (૧૧) ઉન્મત્ત લહરયુક્ત સમુદ્ર જેથો (૧૨) રત્નજહિત સિંહાસન જેથું (૧૩) રત્નમણિ જહિત દેવવિમાન જેથું (૧૪) નાગેન્દ્રભવન જેથું (૧૫) પ્રકાશમાન રત્નરાશિ જેઈ (૧૬) ધૂમરહિત પ્રભર અગ્નિજ્વાળા જેઈ.

સમયસાર ગાથા ૩૨૧-૩૨૩

આ ગાથાઓની ઉત્થાનિકાંપ ૧૮૮માં કળશમાં જે વાત કહેવામાં આવી હતી તે જ વાત હવે આ ગાથાઓમાં કહે છે. ગાથાઓ મૂળમાં આ પ્રમાણે છે.

લોયસ્ય કુણદિ વિણ્હૂ સુરણારયતિરિયમાણુસે સત્તે ।

સમણાણં પિ અપ્પા જદિ કુવ્વદિ છબ્બિહે કાએ ॥૩૨૧॥

લોયસમણાણમેયં સિદ્ધંતં જડ ણ દીસદિ વિસેસો ।

લોયસ્ય કુવડ વિણ્હૂ સમણાણ વિ અપ્પાઓ કુણદિ ॥૩૨૨॥

એવં ણ કો વિ મોક્ખો દીસદિ લોયસમણાણં દોષહિ ।

ણિચ્ચં કુવંતાણં સદેવમણુયાસુરે લોએ ॥૩૨૩॥

(હરિગીત)

જ્યમ લોક માને 'દેવ નારક આદિ જ્વ વિષગુ કરે',

ત્યમ શ્રમાગ પાગ માને કદી 'આત્મા કરે પદકાયને', ૩૨૧

તો લોક-મુનિ સિદ્ધાંત એક જ, ભેટ તેમાં નવ દીસે,

વિષગુ કરે જ્યમ લોકમતમાં, શ્રમાગમત આત્મા કરે; ૩૨૨

એ રીત લોક-મુનિ ઉભયનો મોક્ષ કોઈ નહીં દીસે,

-જે દેવ મનુજ, અસુરના ત્રાગ લોકને નિન્ય કરે. ૩૨૩

લૌકિકજ્ઞનોના મતમાં દેવ, નારકી, તિર્યંચ અને મનુષ્યરૂપ પ્રાણીઓને વિષળુ કરે છે અને જે શ્રમણોના મતમાં પણ છકાયના જીવોને આત્મા કરતો હોય તો પછી લૌકિકજ્ઞનો અને શ્રમણોનો સિદ્ધાંત એક જ થઈ ગયો; કારણ કે એ બંનેની માન્યતામાં અમને કોઈ પણ અંતર દેખાતું નથી. આ પ્રમાણે બંનેની કર્તૃત્વ સંબંધી માન્યતા એક જેવી જ થઈ.

આ પ્રમાણે દેવ, મનુષ્ય અને અસુરલોકને સદા કરતા થકા આવા આ લોક અને શ્રમણ-બંનેનો જ મોક્ષ દેખાતો નથી.

તાત્પર્ય આમ છે કે જે શ્રમણ પોતાને છકાયના જીવોની રક્ષા કરનારો માને છે; તેમની માન્યતા વિષળુને જગતની રક્ષા કરનાર માનનારની જેવી જ છે; આ કારણે લૌકિકજ્ઞનોની જેમ તેમને પણ મુક્તિની પ્રાપ્તિ નહીં થાય.

ઉક્ત ગાથાઓનો સાર આત્મપ્રાતિમાં અત્યંત સરળ શબ્દોમાં અતિ સંક્ષેપથી આ પ્રમાણે કરવામાં આવ્યો છે.

“જેઓ આત્માને કર્તા જ દેખે છે - માને છે, તેઓ લોકોત્તર હોય તોપણ લૌકિકતાને અતિક્રમતા નથી; કારણ કે લૌકિક જ્ઞનોના મતમાં પરમાત્મા વિષળુ દેવનારકાદિ કાર્યો કરે છે અને લોકોત્તર મુનિઓના મતમાં પોતાનો આત્મા તે કાર્ય કરે છે - આ પ્રમાણે બંનેમાં આ સિદ્ધાંતની સમાનતા છે. માટે આત્માના નિત્ય કર્તાપણાની તેમની માન્યતાને લીધે લૌકિકજ્ઞનોની માફક લોકોત્તર પુરુષોનો (મુનિઓનો) પણ મોક્ષ થતો નથી.”

આ જ વાતને પંડિત જયચંદ્ર છાબડા ભાવાર્થમાં આ પ્રમાણે સ્પષ્ટ કરે છે.

“જેઓ આત્માને કર્તા માને છે, તેઓ ભલે ને મુનિ થઈ ગયા હોય; છતાં પણ તેઓ લૌકિકજ્ઞનો જેવા જ છે; કારણ કે લોકો ઈશ્વરને કર્તા માને છે અને તે શ્રમણોએ આત્માને કર્તા માન્યો - આ પ્રમાણે બંનેની

માન્યતાઓ સમાન જ થઈ. તેથી જેમ લૌકિકજનોને મોક્ષ થતો નથી; તેવી રીતે તે મુનિઓને પણ મુક્તિ નથી. જે કર્તા થશે, તે કાર્યના ફળને પણ અવશ્ય ભોગવશે અને જે ફળ ભોગવશે તેને મુક્તિ કેવી ?”

આ ગાથાઓનો અર્થ તાત્પર્યવૃત્તિમાં પણ આ જ પ્રમાણે કરવામાં આવ્યો છે. હા, એ વાત અવશ્ય છે કે આચાર્ય જ્યસેન ટીકાના અંતમાં કિંચના રૂપમાં કર્તૃત્વ શબ્દનો અર્થ સ્પષ્ટ કરતાં લખે છે કે રાગ-દ્રેષ્ણ-મોહર્ણપ પરિણમનને જ કર્તૃત્વ કહે છે. રાગ-દ્રેષ્ણ-મોહર્ણપ પરિણમન થતાં શુદ્ધસ્વભાવરૂપ આત્મતત્ત્વના સમ્યક્ષ્રદ્ધાન, શાન અને અનુચ્ચરણરૂપ નિશ્ચય રન્ત્રયાત્મક મોક્ષમાર્ગથી ચ્યુત થઈ જય છે અને તે જ કરણે મોક્ષ થતો નથી.

તાત્પર્યવૃત્તિના ઉક્ત સંપૂર્ણ કથનનું તાત્પર્ય આ જ છે કે આત્માને પરનો, શાનાવરણાદિ કર્મોનો અને મોહ-રાગ-દ્રેષ્ણરૂપ ભાવકર્મોનો કર્તા માનતાં પરમાં એકત્વબુદ્ધિરૂપ મોહ અને રાગ-દ્રેષ્ણરૂપ પરિણમન થતું જ રહે છે. તે જ કરણે પોતાના આત્મામાં એકત્વબુદ્ધિરૂપ નિશ્ચય સમ્યક્ષ્રદ્ધાન, નિજ આત્માને નિજ જાણવારૂપ સમ્યગ્જ્ઞાન અને નિજ આત્મામાં રમવારૂપ સમ્યક્યારિત થતું નથી; અર્થાત્ નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટ થતો નથી. તેથી મોક્ષ પણ થતો નથી.

આ ભધાનો સાર આ છે કે પરમાં કર્તૃત્વબુદ્ધિ જ વાસ્તવિક કર્તૃત્વ છે અને તે જ આત્માનું મોહરૂપ પરિણમન છે.

હવે તે જ ભાવનું પોષક કાવ્ય લખે છે, જે આ પ્રમાણે છે.

(અનુષ્ટુપ)

નાસ્તિ સર્વોऽપિ સંબંધ પરદ્રવ્યાત્મતત્ત્વયો: ।
કર્તૃકર્મત્વસંબંધાભાવે તત્કર્તૃતા કુતા: ॥૨૦૦॥

(હરિગીત)

આત્મા અને પરદ્રવ્ય વચ્ચે ના કંઈ સંબંધ છે,
તેથી નથી કર્તાકરમસંબંધ બત્તે દ્રવ્યને;
કર્તાકરમસંબંધ જો નહીં આત્મા-પરદ્રવ્યને,
પરદ્રવ્યનું કર્તાપણું કાં હોય આત્મતત્ત્વને ? ૨૦૦

પરદ્રવ્ય અને આત્મતત્ત્વને કાંઈ પણ સંબંધ નથી. આ પ્રમાણે
આત્માનો પરદ્રવ્ય સાથે કર્તૃત્વ-કર્મત્વ સંબંધનો અભાવ હોવાથી આત્મા
પરદ્રવ્યનો કર્તા કેવી રીતે થઈ શકે ?

આ કળશનો ભાવાનુબાદ કવિવર બનારસીદાસજી બે છંદોમાં કરે છે
ને આ પ્રમાણે છે -

(ચौપાઇ)

ચેતન અંક જીવ લખિ લીન્હા । પુદ્ગલ કર્મ અચેતન ચીન્હા ॥
બાસી એક ખેત કે દોડ । જદપિ તથાપિ મિલેં નહિં કોડ ॥

(દોહા)

નિજ નિજ ભાવ ક્રિયાસહિત, વ્યાપક વ્યાપિ ન કોડ ।
કર્તા પુદ્ગલ કરમ કાં, જીવ કહાઁ સાઁ હોડ ॥

જીવ ચૈતન્ય ચિહ્નવાળાં દેખાઈ આવે છે અને પુદ્ગલકર્મ અચેતન
રૂપમાં ઓળખાય છે. જે કે બંને એક જ ક્ષેત્રના વાસી છે; છતાં પણ
બંને ક્યારેય ભળતા નથી.

બંને દ્રવ્ય પોતપોતાના ગુણ-પર્યાયોમાં જ રહે છે; કોઈ પણ એક-
બીજામાં વ્યાપતું નથી, બંનેમાં વ્યાપ્ય-વ્યાપકભાવ નથી. આવી સ્થિતિમાં
જીવ પુદ્ગલ કર્મનો કર્તા કેવી રીતે થઈ શકે ?

પૂજ્ય ગુરુદેવ પાછલી ગાથાઓ અને આ કળશના સંદર્ભમાં કંઈ પણ

વિશેષ કહેતા નથી. તેઓ આ કળશ પર પણ અતિસંક્ષેપમાં જ પ્રકાશ પાથરે છે. તેઓ જે કંઈ પણ કહે છે તેનો સાર આ પ્રમાણે છે.

“જો કે આ કળશની ભાષા સીધી-સાદી છે; પરંતુ ભાવ બહુ ગંભીર છે. કહે છે કે પરદ્રવ્ય અને આત્મતત્ત્વનો કોઈ પણ સંબંધ નથી. પ્રત્યેક દ્રવ્ય પોતપોતાના સ્વરૂપનો જ કર્તા છે, તેથી એકબીજાનું કોઈ કંઈ કરી શકતું નથી. આંગનો પલકારો થવો એ પણ આત્માનું કાર્ય નથી. એક દ્રવ્ય અન્ય દ્રવ્યનો કર્તા તો નથી જ, સાથે જ એકનો બીજ પર પ્રભાવ પણ પડતો નથી.”

આમ આ કળશમાં એમ જ કહેવામાં આવ્યું છે કે આત્મા અને પરદ્રવ્યોની વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. આવી સ્થિતિમાં જ્યારે કર્તા-કર્મસંબંધ પણ નથી તો પછી આત્મા કર્મોનો કર્તા કેવી રીતે થઈ શકે?



શાનગોઢઠી

તીર્થકરને સહજ પ્રાપ્ત જન્મ કાપના દસ અતિશય ગુગુ

- | | |
|---|--|
| (૧) સૌર્ય | - અત્યંત સુંદર શરીર હોવું. |
| (૨) સૌરભ | - અત્યંત સુગંધિત શરીર હોવું. |
| (૩) નિઃસ્વેદત્વ | - પરસેવારહિત શરીર હોવું. |
| (૪) નિર્મલત્વ | - મળ, મૂત્રરહિત નિર્મળ શરીર હોવું. |
| (૫) પ્રિયહિત વાદિત્વ | - મધુર હિત-મિત પ્રિયવચન બોલવા. |
| (૬) અપ્રભિત વીર્યતા | - અનંતબ્લ-વીર્ય હોવું. |
| (૭) ક્ષીર ગૌર ઇધિરત્વ | - દૂધસમાન ઘવલ ઇધિર હોવું. |
| (૮) સૌલક્ષણ્ય | - શરીર પર ૧૦૦૮ ઉત્તમ લક્ષણોનું ધારણ કરવું. |
| (૯) સમચતુરસંસ્થાન | - ઉત્તમ આકારાનું શરીર હોવું. |
| (૧૦) વજવૃષભનારાચ સંહનન - વજમય શરીર હોવું. | |

समयसार गाथा ३२४-३२७

ववहरभासिदेव दु परदब्वं मम भण्टि अविदित्था ।

जाणंति णिच्छएण दु ण य मह परमगाणुमित्तमवि किंचि ॥३२४॥

जह को वि णरो जंपदि अम्हं गामविसयणयररडं ।

ण य होंति जस्स ताणि दु भण्दि य मोहेण सो अप्पा ॥३२५॥

मेव मिच्छदिङ्गी णाणी णीसंसयं हवदि एसो ।

जो परदब्वं मम इदि जाणंतो अप्पयं कुणदि ॥३२६॥

तम्हा ण मे त्ति णच्चा दोणह वि एदाण कत्तविवसायं ।

परदब्वे जाणंतो जाणेज्जो दिङ्गिरहिदाणं ॥३२७॥

(हसिगीत)

व्यवहारभूढ अतत्त्वविद् परद्रव्यने ‘माँ’ कहे,
‘परमाणुमात्र न माँ’ शानी आणता निश्चय १३. ३२४

ज्यम पुरुष कोई कहे ‘अमाँ गाम, पुरने देश छे’,
पाण ते नथी तेनां अरे ! ज्ञव मोहथी ‘मारां’ कहे; ३२५

ओवी ज रीत जे शानी पाण ‘मुज’ आणतो परद्रव्यने,
निज३५ करे परद्रव्यने, ते ज३२ भिथ्यात्वी बने, ३२६

तेथी ‘न माँ’ आणी ज्ञव, परद्रव्यमां आ उभयनी
कर्तृत्वभुल्लि आणतो, आणे सुदण्टिरहितनी. ३२७

વસ્તુસ્વરૂપને ન જાણનારો પુરુષ વ્યવહારકથનને જ પરમાર્થરૂપે ગ્રહણ કરીને એમ કહે છે કે પરદ્રવ્ય માઝું છે; પરંતુ જ્ઞાનીજન નિશ્ચયથી એમ જાણે છે કે પરમાણુમાત્ર પરપરાર્થ મારો નથી.

જેવી રીતે કોઈ મનુષ્ય આમ કહે કે અમારું ગામ, અમારો દેશ, અમારું નગર અને અમારું રાજ્ય છે; પરંતુ તે તેના નથી. તે મોહથી જ એવું કહે છે કે તે મારાં છે.

તેવી જ રીતે જે કોઈ જ્ઞાની પણ પરદ્રવ્યને નિજરૂપ માને છે, જાણે છે તો એમ જાણતો તે નિઃસંદેહ મિથ્યાદાચિ છે.

તેથી પરદ્રવ્ય મારું નથી - એમ જાણીને તત્ત્વજ્ઞાનીજન લોક અને શ્રમણ - બંનેના પરદ્રવ્યમાં કર્તૃત્વના વ્યવસાયને સમ્યગ્દર્શનરહિત પુરુષોનો જ વ્યવસાય જાણે છે.

આ ગાથાઓનો ભાવ આત્મખ્યાતિમાં આ પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવ્યો છે.

“વ્યવહારવિમૂઢ અજ્ઞાનીજન જ પરદ્રવ્યના સંદર્ભમાં એવું માને છે કે ‘આ મારું છે’ જ્ઞાનીઓ તો નિશ્ચયપ્રતિબુદ્ધ (નિશ્ચયના જાણનારા) હોવાથી પરદ્રવ્યના સંદર્ભમાં એવું જ માને છે કે ‘આ મારું નથી.’

જેમ આ જગતમાં કોઈ વ્યવહારવિમૂઢ એવો પારકા ગામમાં રહેનારો માણસ એમ કહે કે ‘આ ગામ મારું છે’ તો તેની તે માન્યતા મિથ્યા જ છે, તે તત્ત્વસંબંધી મિથ્યાદાચિ જ છે; તેવી જ રીતે જે કોઈ જ્ઞાની પણ કોઈ પણ પ્રકારે વ્યવહાર વિમૂઢ થઈને પરદ્રવ્યને ‘આ મારું છે’ એમ દેખે, જાણે, માને તો તે સમયે તે પણ નિઃસંશયપણે પરદ્રવ્યને પોતરૂપ કરતો થકો મિથ્યાદાચિ જ થાય છે.

તેથી તત્ત્વજ્ઞાની પુરુષ ‘સમસ્ત પરદ્રવ્ય મારાં નથી’ - એમ જાણીને તે નિશ્ચિતરૂપે જાણે છે કે લોક અને શ્રમણ બંનેનો જ પરદ્રવ્યમાં કર્તૃત્વનો વ્યવસાય, તેમની સમ્યગ્દર્શન રહિતતાને કારણે જ છે.”

ઉક્ત ગાથાઓનો ભાવ પૂજ્ય ગુરુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે -

“જુઓ, પોતાની શુદ્ધ ચૈતન્યવસ્તુથી અજાણ અજાની વ્યવહારવિમૂઢ હોય છે. તેઓ સ્ત્રી-પુત્ર-પરિવાર, ધન-દોલત આદિ પરદ્રવ્યોને ‘આ મારાં છે - આમ માને છે. જે કે વ્યવહારમાં એમને જ્ઞાની પણ પોતાનાં કહે છે; પરંતુ અજાની તેમને નિશ્ચયથી એમ જ માની લે છે કે ‘પરદ્રવ્ય મારાં છે’ અજાનીને સ્વદ્રવ્ય-પરદ્રવ્ય, સ્વસત્તા-પરસત્તા સંબંધી કોઈ વિવેક નથી, બેદવિજ્ઞાન નથી.

જ્ઞાની તેનાથી વિપરીત છે. ભલે વ્યવહારથી તે કંઈ પણ કહેતો હોય; પરંતુ નિશ્ચયથી જે પોતાનું એક શુદ્ધ ચૈતન્યતત્ત્વ છે, ચિદાનંદમય જ્ઞાતા-દ્વારાસ્વભાવી આત્મા છે; તેને જ પોતાનો માને છે. તે માને છે કે ‘હું તો એક ઉપયોગકૃપ ચિન્મૂર્તિ આત્મા છું.’ તે પરદ્રવ્યના એક કણમાત્રને, ૨૪કણને પણ પોતાના માનતો નથી.^૧

‘મારા દેવ, મારા ગુરુ, મારા શાસ્ત્ર, મારો કુટુંબ-પરિવાર’ આમ કહેવું તે તો વ્યવહાર છે; પરંતુ તેમ માનવું તે મિથ્યાદર્શન જ છે. જ્ઞાની કોઈ પણ પરદ્રવ્યને પોતાનું માનતો નથી.^૨

લૌકિકજ્ઞન (ઇશ્વરવાહી) એમ માને છે કે જગતનો કર્તા ઇશ્વર છે. જે જૈનશ્રમણ પણ એવું માને કે ‘પરદ્રવ્યનો કર્તા હું છું’ તો આ રીતે તો પરદ્રવ્યમાં કર્તૃત્વનો વ્યવસાય બનેનો સમાન જ લાગે છે અને એવું માનનારા લોકોને તો તત્પરજ્ઞાનીજન તથા નિલોકીનાથ સર્વજ્ઞદેવ આમ જ ફરમાવે છે કે - તે બધા મિથ્યાદર્શિ જ છે, કે જે પરદ્રવ્યને કર્તા માને છે. ‘હું પરની હાનિ અથવા લાભ કરી શકું છું - આમ માનનારા નિયમથી મિથ્યાદર્શિ જ છે.^૩

૧ પ્રવચન રત્નાકર ભાગ ૮, પાનું ૧૭૫

૨ તે જ, પાનું ૧૭૬

૩ પ્રવચન રત્નાકર ભાગ ૮, પાનું ૧૭૬-૧૭૭

વસ્તુસ્વકૃપથી અજાણ અજાની જીવ વ્યવહારમાં જ વિમોહિત થઈ રહ્યો છે. તેથી તે એવું માને છે કે આ પરદ્રવ્ય, શુભવિકલ્પ અને બેદ મારા છે. તેવી જ રીતે પરદ્રવ્યોને, પરભાવોને હું કરું છું - એમ માને છે. તે સંદર્ભમાં અહીં કહે છે કે આવું માનનારા ભલે લૌકિકજ્ઞન હોય અથવા મુનિજ્ઞન હોય; તે બધા મિથ્યાદાદિ જ છે.”

અહીં એક પ્રશ્ન તે પણ સંભવે છે કે કોઈ વ્યક્તિ શાની થઈને પણ એવું કેમ માની શકે કે પરદ્રવ્ય માઝું છે અને હું તેનો કર્તા-ધર્તા છું ? આમ માનનાર તો અજાની જ હોય છે; છતાં પણ અહીં આમ શા માટે લખ્યું છે કે જે કોઈ શાની પણ એમ માને કે પરદ્રવ્ય માઝું છે તો તે મિથ્યાદાદિ છે ? આશ્વર્યની વાત તો એ છે કે આ વાત મૂળ ગાથામાં પણ વિદ્યમાન છે.

આ પ્રકારનો પ્રશ્ન આચાર્ય અમૃતચંદ્રના ચિત્તમાં પણ ઉત્પન્ન થયો હતો. તે જ કારણે તેઓ આત્મભ્યાતિ ટીકામાં કથાંચિત શબ્દનો ઉપયોગ કરે છે અને આચાર્ય જ્યસેન તો તાત્પર્યવૃત્તિ ટીકામાં પોતે જ આ પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત કરીને તેનો જવાબ આપે છે; જે મૂળથી આ પ્રમાણે છે.

“જ્ઞાની ભૂત્વા વ્યવહારેણ પરદ્રવ્યમાત્મીયં વદન્ સન્ કથમજ્ઞાની ભવતીતિ ચેત्?”

વ્યવહારો હિ મ્લેચ્છાનાં મ્લેચ્છભાષેવ પ્રાથમિકજનસંબોધનાર્થ કાલ એવાનુસર્તબ્ય: । પ્રાથમિકજનપ્રતિબોધનકાલં વિહાય કતકફલવદાત્મ શુદ્ધિકારકાત् શુદ્ધનયાચ્ચુતો ભૂત્વા યદિ પરદ્રવ્યમાત્મીયં કરોતિ તદા મિથ્યાદાદિર્ભવતિ ।

પ્રશ્ન:- શાની થઈને વ્યવહારથી પરદ્રવ્યને નિજસ્વકૃપ કહેનાર અજાની કેમ થાય છે ?

ઉત્તર:- જે રીતે પ્રાથમિકજલ્લવોને સંબોધન કરવા માટે તે સમયમાં જ

૧ પ્રવચન રનાકર ભાગ ૬, પાનું ૧૭૭

વ્યવહારનયનું અનુસરણ કરવું જોઈએ. પરંતુ જે પ્રાથમિકજીવોના પ્રતિબોધનકાળને છોડીને અન્ય સમયે પણ જે કોઈ જ્ઞાની જીવ કટકફળની જેમ આત્માને શુદ્ધ કરનારા શુદ્ધનયથી ચ્યુત થઈને જે પરદ્રવ્યને પોતાડ્રવ્ય માને છે તો તે જ સમયે તે મિથ્યાદાદિ થઈ જય છે.”

ઉક્ત સંપૂર્ણ કથનનું તાત્પર્ય આમ છે કે જે કોઈ કહેવાતો જ્ઞાની વ્યવહારનયના કથનનો સહારો લઈને પરમાં એકત્વબુદ્ધિ કરે છે તો તે મિથ્યાદાદિ જ છે.

હવે આ ગાથાઓના ભાવને સ્પષ્ટ કરતો કળશ લખે છે, જે આ પ્રમાણે છે.

(વસન્તતિલકા)

એકસ્ય વસ્તુ ન ઇહાન્યતરેણ સાર્થ
સંબંધ એવ સકલોડપિ યતો નિષિદ્ધ: ।
તત્કર્તૃકર્મઘટનાસ્તિ ન વસ્તુભેદ
પશ્યન્ત્વકર્તૃ મુનયશ્વ જનાશ્વ તત્ત્વમ् ॥૨૦૧॥

(હસ્તિલ)

આ લોકમાં કો દ્રવ્ય સાથે અન્ય કોઈ દ્રવ્યનો નિષેધ છે સંબંધ સઘળો સદા સર્વ પ્રકારનો; નહીં હોય કર્તાકર્મઘટના તેથી વસ્તુભેદ જે દેખો અકર્તા તત્ત્વને હે મુનિજીજનો ! લૌકિકજીજનો ! ૨૦૧

આ લોકમાં એક વસ્તુનો અન્ય વસ્તુ સાથે સર્વે પ્રકારના સંબંધોનો નિષેધ કરવામાં આવ્યો છે; તેથી જ્યાં વસ્તુભેદ છે ત્યાં કર્તાકર્મપણું ઘટિત થતું નથી. આ પ્રમાણે હે મુનિજીજનો અને લૌકિકજીજનો ! તમે તત્ત્વને અકર્તા જ જુઓ ! તાત્પર્ય આમ છે કે આ ભગવાન આત્મા પરનો અકર્તા જ છે - એવું જણો.

કવિવર બનારસીદાસજી આ કળશનો ભાવાનુવાદ બે છંદોમાં કરે છે;
જે આ પ્રમાણે છે -

(સવૈયા ઇકતીસા)

જીવ અરુ પુદ્ગલ કરમ રહેં એક ખેત,

જદપિ તથાપિ સત્તા ન્યારી ન્યારી કહી હૈ ।

લક્ષન સ્વરૂપ ગુન પરજૈ પ્રકૃતિ ભેદ,

દુહું મેં અનાદિ હી કી દુવિધા હૈ રહી હૈ ॥

એતે પર ભિન્નતા ન ભાસે જીવ કરમ કી,

જૌ લોં મિથ્યાભાવ તૌ લોં આંધિ બાऊ બહી હૈ ।

ગ્યાન કે ઉદોત હોત ઐસી સૂધી દ્રિષ્ટિ ભર્ઝ,

જીવ કર્મપિણ્ડ કૌ અકરતાર સહી હૈ ॥

(દોહા)

એક વસ્તુ જૈસી જુ હૈ, તાર્સોં મિલે ન આન ।

જીવ અકરતા કરમ કૌ, યહ અનુભૌ પરવીન ॥

આમ તો જીવ અને પૌર્ણગલિક કર્મ એક જ સ્થાન પર એક સાથે
રહે છે; છતાં પણ તેમનું અસ્તિત્વ ભિન્ન ભિન્ન જ કહેવામાં આવ્યું છે.
તેમાં અનાદિકાળથી જ લક્ષણ, સ્વરૂપ, ગુણ, પર્યાય અને પ્રકૃતિ સંબંધી
બે પણું પહ્યું છે. આવી સ્થિતિ હોવા છતાં પણ જ્યાંસુધી મિથ્યાભાવની
ઉલ્લી હવા ચાલી રહી છે અર્થાત્ જ્યાં સુધી વિપરીત માન્યતા છે; ત્યાં
સુધી જીવને જીવ અને કર્મોમાં ભિન્નતા ભાસતી નથી; પરંતુ જ્યારે
સમ્યગ્જાનનો ઉદ્ય થાય છે, દાખિ સમ્યક થઈ જય છે તો આ જીવ
કર્મપિણ્ડનો અકર્તા જ ભાસવા માંડે છે, અકર્તા જ થઈ જય છે.

એક વસ્તુ જેવી છે, તેવી જ છે; તેમાં બીજે પદાર્થ મળી શકતો
નથી. જીવ કર્મોનો અકર્તા જ છે - આ વાત અનુભવથી પ્રમાણિત છે.

આ કળશનો ભાવ પૂજ્ય ગુરુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે -

“જુઓ, આ લોકમાં અનંત જીવ, અનંતાનંત પુરુગલ, એક-એક ધર્મ? અધર્મ અને આકાશ તથ અસંખ્યાત કાળાણુ - આ પ્રમાણે જલતિની અપેક્ષા છે તથા સંખ્યાની અપેક્ષા અનંતાનંત દ્રવ્ય છે. તેમાં પ્રત્યેક દ્રવ્યનો અન્ય દ્રવ્યની સાથે બધા પ્રકારનાં સંબંધોનો નિષેધ કરવામાં આવ્યો છે. એક વસ્તુ અન્ય વસ્તુના અભાવ સ્વભાવવાળી જ છે. પ્રત્યેક વસ્તુ અન્ય વસ્તુના અભાવથી જ સ્વતંત્ર ઈકી રહે છે.

લોકો કહે છે કે મને અમુક-અમુક વસ્તુઓ વિના ચાલતું નથી. પૈસા વગર તો એક ક્ષાળ પણ નથી ચાલી શકતું. તેને કહીએ છીએ કે અરે ભાઈ! તને અનંતકાળથી તો આ બધા વગર જ ચાલી રહ્યું છે, જે એમ ન હોત તો અનંત કાળથી આજસુધી અનંત વસ્તુઓ પોતાની બિન્ન બિન્ન સત્તા સાથે રહી શકી જ ન હોત. બધી મળીને એકમેક થઈ ગઈ હોત.

તેથી કહ્યું છે કે જ્યાં બિન્ન-બિન્ન વસ્તુઓ છે, ત્યાં કર્તા-કર્મની ઘટના ઘટિત થતી નથી.

જગતમાં અનંત દ્રવ્ય છે, તેમાં ક્યારેય કોઈ પણ (દ્રવ્ય) વગર કાર્યનું નથી. પ્રતિ સમય તે પોતાનું કાર્ય અર્થાત્ પર્યાયને તો કરે જ છે ને? જ્યારે તે ખાલી કુરસદમાં અથવા નકામો છે જ નહીં, તો બીજાનું કાર્ય કરે કેવી રીતે?

બીજુ વાત, જ્યારે તને કોઈ બીજું દ્રવ્ય સ્પર્શિતું જ નથી, અડતું જ નથી તો તે તાકું કાર્ય, તારી પર્યાયનું પરિણામન કેવી રીતે કરશે?

આત્મા પ્રજ્ઞા બ્રહ્મસ્વરૂપ એક જ્ઞાનમાત્ર વસ્તુ છે, તેને તું રાગનો અને પરનો અકર્તા લે; કારણ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનો અકર્તા જ છે. આ જ શ્રદ્ધાન વાસ્તવિક શ્રદ્ધાન છે. સમકિતીને એવું જ શ્રદ્ધાન હોય છે.^૧

આ રીતે આ કળશમાં એમ જ કહેવામાં આવ્યું છે કે આ લોકની કોઈ પણ વસ્તુનો અન્ય વસ્તુની સાથે કાંઈ પણ સંબંધ નથી; આમ કોઈ

पण व्यक्ति अन्यना कार्योनी कर्ता थती नथी. तेथी आत्माने परनो अकर्ता ज जाणो.

आ पछी आचार्य अभृतचंद्र आगामी गाथाओनुं सुचक कणश काव्य लघे छे जे आ प्रभाषे छे.

(वसन्ततिलका)

ये तु स्वभावनियमं कलयंति नेम -

मज्जानमग्नमहसो बत ते वराकाः ।

कुर्वति कर्म तत एव हि भावकर्म -

कर्ता स्वयं भवति चेतन एव नान्यः ॥२०२॥

(हरिगीत)

वस्तुस्वभावतागो नियम आ जागता ज्ञव जे नथी,
तेओ बिचारानुं गयुं छे तेज अज्ञाने दूबी;
अरेरे ! करे छे कर्मने, तेथी स्वयं चेतन थतो,
कर्ता घरे निजभावकर्म तागो, नहीं परद्रव्य को. २०२

आचार्यदेव घेद व्यक्त करतां कहे छे के अरे ! जे लोको आ
वस्तुस्वभावना नियमने जाणता नथी; तेओ बिचारा अज्ञानमां दूबी कर्मने
करे छे; तेथी भावकर्मोना कर्ता थाय छे. भावकर्मोनो कर्ता चेतन पोते ज
छे, अन्य कोई नथी. तात्पर्य आम छे के अज्ञानावस्थामां अज्ञानी आत्मा
चेतनकर्मोनो कर्ता थाय छे.

आ कणशनो भावानुवाद कविवर बनारसीदासल बे छंदोमां करे छे,
जे आ प्रभाषे छे.

(चौपाई)

जो दुरमती विकल अग्यानी, जिन्हिसुरीति पररीति न जानी ।
माया मगन भरम के भरता, ते जिय भावकरम के करता ॥

(દોહા)

જે મિથ્યામતિ તિમિર સૌં, લગ્બૈ ન જીવ અજીવ ।
 તેઈ ભાવિત કરમ કે, કરતા હોહિં સદીવ ॥
 જે અસુદ્ધ પરનતિ ધરેં, કરેં અહં પરવાંન ।
 તે અસુદ્ધ પરિનામ કે, કરત હોંહિ અજાન ॥

જે જીવ અજ્ઞાની છે, દુર્ભુદ્ધિ છે, દુઃખી છે; જેમને નિજપરિણાતિ અને
 પરપરિણાતિનું જ્ઞાન નથી; જેઓ માયામાં મળું છે, ભ્રમમાં ભૂલેલા છે; તે
 જીવ ભાવકર્મોના કર્તા થાય છે.

જે જીવ મિથ્યામતિરૂપ અંધકારના કારણે જીવ અને અજીવને બિજ્ઞ-
 બિજ્ઞ જાણી શકતા નથી; તે અજ્ઞાની જીવ સદાય ભાવકર્મના કર્તા થાય
 છે.

જે જીવ પરપરાર્થોમાં અહંબુદ્ધિ કરે છે અને અશુદ્ધ પરિણાતિને ધારણા
 કરે છે; તે અજ્ઞાની જીવ અશુદ્ધ પરિણામોના કર્તા થાય છે.

આ કળશનો ભાવ પૂજય ગુરુહેય આ પ્રમાણે સ્વચ્છ કરે છે - “ભગવાન
 આત્મા અંતરંગમાં સ્વયં પૂર્ણ ચૈતન્ય સંપદાથી ભરપૂર છે; પરંતુ પોતાની
 સ્વરૂપ સંપદાના સ્વભાવને જેઓ જાણતા નથી; તેઓ બિચારા છે, રંક છે,
 દ્યાને પાત્ર છે. જુઓ, લોકો જેમને શ્રીમંત માને છે, તેમને અહીં રંક કહ્યા
 છે; કારણ કે તેઓ પોતાની ચૈતન્ય સંપદાને જાણતા-પિછાણતા નથી.

અહા ! જેઓ આત્મસન્મુખ થઈને નિરાકૃત આનંદનો અનુભવ કરતા
 નથી તેઓ ભલે અભજેપતિ હોય કે અહમિન્દૂ હોય, બધા બિખારી જ છે;
 કારણ કે બાહ્ય સંપદા પોતાની હોતી જ નથી અને તેઓ તેને પોતાની માને
 છે; તેથી દીન-દુઃખી જ રહે છે. જે થોડો ધન-વૈભવ માગે, તે નાનો બિખારી
 અને જે અધિક ધન-વૈભવ માગે અથવા ચાહે તે મોટો બિખારી છે; કારણ
 કે સ્વરૂપસંપદાના ભાન વગર લોકોને પરસંપદાની જ આશા છે.

જેઓ આ અધ્યાત્મ અને નાશવાન સંયોગો અને સંયોગી ભાવોને પોતાના માને છે તેઓ નિયમથી વસ્તુસ્વરૂપને ઓળખતા નથી. તેમનું પુરુષાર્થરૂપી તેજ અજ્ઞાનમાં દૂબી ગયું છે, અનંત પરાક્રમ અજ્ઞાનરૂપી અંધકારમાં વિલીન થઈ ગયું છે. આવો બિચારો અજ્ઞાની જીવ રાગનો અને શુભાશુભ કર્મોનો કર્તા બનીને પોતાના અજ્ઞાનનું જ પોષણ કરે છે.

પ્રશ્ન:- ભક્તિ, દ્વારા, દાન, વ્રતાદ્વિપ શુભભાવ જ્ઞાનીને પણ તો હોય છે ને ?

ઉત્તર:- હા, હોય છે; પરંતુ જ્ઞાની તેમને કર્તા થઈને કરતો નથી; તેમનો સ્વામી થતો નથી. જ્યારે અજ્ઞાની એવું માને છે કે રાગ માઢું કર્તાબ્ય છે. બસ, એ કર્તાબુદ્ધિ જ તેનું અજ્ઞાન છે.

આ પ્રમાણે આ કળશમાં એમ જ કહેવામાં આવ્યું છે કે જે વસ્તુસ્વરૂપના આ નિયમને નથી જાણતા કે કોઈ પણ દ્રવ્ય અન્ય કોઈ દ્રવ્યના પરિણામનનો કર્તા-ધર્તા નથી; તે અજ્ઞાની આત્મા સ્વયંને પરનો કર્તા માનવાને લીધે પરને કર્તા માનવાદ્વિપ અજ્ઞાનભાવના કર્તા થાય છે; છતાં તેઓ પરના કર્તા તો થતા નથી; પરંતુ પરને કરવાના ભાવડ્વિપ પોતાના ભાવના, પોતાના અજ્ઞાન ભાવના, પોતાના રાગના કર્તા અવશ્ય થાય છે.

તૃતીય ગાથા ઉપરાંત તાત્પર્યવૃત્તિમાં ચાર ગાથાઓ એવી આવે છે કે જે આત્મભ્યાતિમાં આગળ ૩૪૫-૩૪૮ મિનિયુનિ રૂપમાં વિદ્યમાન છે. તેમની ચર્ચા યથાસ્થાને થશે જ; તેથી તે અંગે અહીં વધુ લખ્યું આવશ્યક નથી.



સમયસાર ગાથા ૩૨૮-૩૩૧

જે વાત પાછળના કળશમાં કહેવામાં આવી હતી, હવે તે જ વાતને
ગાથાઓના માધ્યમથી દર કરે છે. ગાથાઓ મૂળમાં આ પ્રમાણે છે.

મિચ્છત્તં જદિ પયડી મિચ્છાદિઢી કરેદિ અપ્પાણ ।

તમ્હા અચેદણા તે પયડી ણણુ કારગો પત્તો ॥૩૨૮॥

અહવા એસો જીવો પોગલદવ્બસ્સ કુણદિ મિચ્છત્તં ।

તમ્હા પોગલદવ્બં મિચ્છાદિઢી ણ પુણ જીવો ॥૩૨૯॥

અહ જીવો પયડી તહ પોગલદવ્બં કુણંતિ મિચ્છત્તં ।

તમ્હા દેહિં કદં તં દોળણ વિ ભુંજંતિ તસ્સ ફલં ॥૩૩૦॥

અહ ણ પયડી ણ જીવો પોગલદવ્બં કરેદિ મિચ્છત્તં ।

તમ્હા પોગલદવ્બં મિચ્છત્તં તં તુ ણ હુ મિચ્છા ॥૩૩૧॥

(હસ્તિગીત)

જે પ્રકૃતિ મિથ્યાત્વની મિથ્યાત્વી કરતી આત્મને,

તો તો અયેતન પ્રકૃતિ કારક બને તુજ મત વિષે ! ૩૨૮

અથવા કરે જે જીવ પુદ્ગલદ્રવ્યના મિથ્યાત્વને,

તો તો ઠરે મિથ્યાત્વી પુદ્ગલદ્રવ્ય, આત્મા નવ ઠરે ! ૩૨૯

જે જીવ અને પ્રકૃતિ કરે મિથ્યાત્વ પુદ્ગલદ્રવ્યને,

તો ઉભયકૃત જે હોય તેનું ફળ ઉભય પાગ ભોગવે ! ૩૩૦

જે નહિ પ્રકૃતિ, નહિ જીવ કરે મિથ્યાત્વ પુદ્ગલદ્રવ્યને
પુદ્ગલદરવ મિથ્યાત્વ વાગ્કૃત ! - એ શું નહિ મિથ્યા ખરે ? ૩૩૧

મોહનીયકર્મની મિથ્યાત્વ નામની કર્મપ્રકૃતિ આત્માને મિથ્યાદાદિ કરે
છે, બનાવે છે; - જે એમ માનવમાં આવે તો તમારા મતમાં અચેતનપ્રકૃતિ
જીવના મિથ્યાત્વભાવની કરતા થઈ ગઈ. આ કારણે મિથ્યાત્વભાવ પણ
અચેતન સિદ્ધ થશે.

અથવા આ જીવ પુદ્ગલદ્રવ્યઙુપ મિથ્યાત્વને કરે છે - જે એમ
માનવામાં આવે તો પુદ્ગલદ્રવ્ય મિથ્યાદાદિ સિદ્ધ થશે, જીવ નહીં.

અથવા જીવ અને પ્રકૃતિ - બંને મળીને પુદ્ગલદ્રવ્યને મિથ્યાત્વભાવઙુપ
કરે છે - જે એમ માનવામાં આવે તો જે કાર્ય બેઉ વડે કરવામાં આવ્યું,
તેનું ફળ બનેને જ બોગવવું પડશે.

અથવા પુદ્ગલદ્રવ્યને મિથ્યાત્વભાવઙુપ ન તો પ્રકૃતિ કરે છે અને ન
તો જીવ કરે છે અર્થાત્ તેમાંથી કોઈ પણ કરતું નથી - જે એમ માનવામાં
આવે તો પુદ્ગલદ્રવ્ય સ્વભાવથી જ મિથ્યાત્વભાવઙુપ સિદ્ધ થશે. - શું
તે વાસ્તવમાં મિથ્યા નથી ?

તેથી આમ સિદ્ધ થાય છે કે પોતાના મિથ્યાત્વભાવનો કર્તા જીવ પોતે
જ છે.

આ ગાથાઓનો ભાવ આત્મભ્યાતિમાં આ પ્રમાણે સ્પષ્ટ કરવામાં
આવ્યો છે.

"જીવ જ મિથ્યાત્વ આદિ ભાવકર્મનો કર્તા છે; કારણ કે જે
ભાવકર્મને અચેતન પ્રકૃતિનું કાર્ય માનવામાં આવે તો તેમને (ભાવકર્મને)
અચેતનપણાનો પ્રસંગ આવે.

જીવ પોતાના જ મિથ્યાત્વાદિ ભાવકર્મનો કર્તા છે; કારણ કે જે જીવ
પુદ્ગલદ્રવ્યના મિથ્યાત્વાદિ ભાવકર્મનો કર્તા થાય તો પુદ્ગલદ્રવ્યને
ચેતનપણાનો પ્રસંગ આવે.

જીવ અને પ્રકૃતિ - બંને મળીને મિથ્યાત્વાદિ ભાવકર્મોના કર્તા થઈ ન શકે કારણ કે જે બંને કર્તા થાય તો - જીવની માફક અચેતન પ્રકૃતિને પણ તે ભાવકર્મોને બોગવવાનો પ્રસંગ આવી જશે.

અને જે એમ માનવામાં આવે કે જીવ અને પ્રકૃતિ - બંને જ મિથ્યાત્વાદિ ભાવકર્મોના અકર્તા છે તો પણ ઠીક નથી; કારણ કે જે તે બંને જ અકર્તા થાય તો પછી પુદ્ગલદ્રવ્યને સ્વભાવથી જ મિથ્યાત્વાદિ ભાવોનો પ્રસંગ પ્રાપ્ત થાય.

તેથી આમ સિદ્ધ થયું કે જીવ જ પોતાના મિથ્યાત્વાદિ ભાવકર્મોનો કર્તા છે અને તે ભાવકર્મ તેના જ કર્મ છે.”

આ ગાથાઓ અને ટીકાનો ભાવ સ્પષ્ટ કરતાં જ્યયંદળ છાબડા ભાવાર્થમાં લખે છે -

“આ ગાથાઓમાં આમ સિદ્ધ કર્યું છે કે ભાવકર્મનો કર્તા જીવ જ છે. અહીં એમ જ્ઞાણવું જોઈએ કે પરમાર્થથી અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યના ભાવનો કર્તા થતો નથી; તેથી જે ચેતનના ભાવ છે, તેમનો કર્તા ચેતન જ હોઈ શકે.

આ જીવને અજ્ઞાનથી જે મિથ્યાત્વાદિ ભાવકૃપ પરિણામ છે; તે ચેતન છે, જરૂર નથી; અશુદ્ધનિષ્ઠયનયથી તેમને ચિદાભાસ પણ કહેવામાં આવે છે.

આવી રીતે તે પરિણામ ચેતન છે, તેથી તેમનો કર્તા પણ ચેતન જ છે; કારણ કે ચેતનકર્મનો કર્તા ચેતન જ હોય છે - આ પરમાર્થ છે.

અભેદદાચિમાં તો જીવ શુદ્ધચેતનામાત્ર જ છે, કારણ કે જ્યારે તે કર્મોના નિભિતથી પરિણામે છે, ત્યારે તે તે-તે પરિણામોથી ચુક્ત હોય છે અને ત્યારે પરિણામ-પરિણામીની ભેદદાચિમાં પોતાના અજ્ઞાનભાવકૃપ પરિણામોનો કર્તા જીવ જ છે. અભેદદાચિમાં તો કર્તા-કર્મભાવ છે જ નહીં. શુદ્ધચેતનામાત્ર

જીવસ્તુ છે. આ પ્રમાણે યથાર્થપણે સમજવું જોઈએ કે ચેતનકર્મનો કર્તા ચેતન જ છે.”

આચાર્ય જ્યસેનની તાત્પર્યવૃત્તિમાં ઉક્ત ચાર ગાથાઓના સ્થાન પર પાંચ ગાથાઓ છે અને તેમની ઉત્થાનિકા તેઓ આ પ્રમાણે લખે છે.

“જે કે શુદ્ધનિશ્ચયનયથી શુદ્ધ બુદ્ધ એકસ્વભાવ હોવાથી જીવ કર્મોનો અકર્તા છે; છતાં પણ અશુદ્ધનિશ્ચયનયથી રાગાદિભાવકર્મોનો કર્તા જીવ જ છે પુદ્ગાલ જીવના રાગાદિભાવોનો કર્તા નથી. - હવે આમ કહે છે.

અહીં પાંચ ગાથાઓમાંથી પ્રત્યેક ગાથાના પૂર્વદ્વિમાં સાંખ્યમતના અનુયાયી શિષ્યનો જ પૂર્વપક્ષ રાખવામાં આવ્યો છે અને પ્રત્યેક ગાથાના ઉત્તરદ્વિમાં તેનો પરિહાર કરવામાં આવ્યો છે - એમ જાણવું જોઈએ.”

ઉક્ત પાંચ ગાથાઓમાં આત્મભ્યાતિની ઉર્ઘતી ગાથા બાદ તાત્પર્યવૃત્તિમાં આવતી જે ગાથા આત્મભ્યાતિમાં નથી; તે આ પ્રમાણે છે-

સમજ્ઞા જર્દિ પયડિ સમ્માદિઢી કરેદિ અપ્પાણ ।
તહ્ના અચેદણા દે પયડી ણણુ કારગો પત્તો ॥

(હરિગીત)

સમ્યક્તવ નામક પ્રકૃતિ જદ્ગદાઢિ જે જીવને કરે;
જડપ્રકૃતિ તુજ મત વિષે જીવભાવની કર્તા બને. ૨૦૨

મોહનીયકર્મની સમ્યક્તવ નામની કર્મપ્રકૃતિ આત્માને સમ્યગદાઢિ કરે છે, બનાવે છે; જે એમ માનવામાં આવે તો તમારા મતમાં અચેતન પ્રકૃતિ ભાવના સમ્યક્તવભાવની કર્તા થઈ ગઈ.

આ ગાથા પછી જે ગાથા આવી છે, તેમાં એમ કહેવામાં આવ્યું છે કે મોહનીયકર્મની મિથ્યાત્વ નામની કર્મપ્રકૃતિ આત્માને મિથ્યાદાઢિ કરે છે, બનાવે છે - જે એમ માનવામાં આવે તો તમારા મતમાં અચેતન પ્રકૃતિ જીવના મિથ્યાત્વભાવની કર્તા થઈ અને આ ગાથામાં તે જ રીતે એમ કહેવામાં

આવ્યું છે કે મોહનીયકર્મની સમ્યકૃત્વ નામની કર્મપ્રકૃતિ આત્માને સમ્યગદાચિ કરે છે, બનાવે છે - જે એમ માનવામાં આવે તો તમારા મતમાં અચેતનપ્રકૃતિ જીવના સમ્યકૃત્વભાવની કર્તા થઈ ગઈ.

આ રીતે ઉક્ત બંને ગાથાઓ સમ્યકૃત્વ અને મિથ્યાત્વના સંદર્ભમાં લગભગ સમાન જ છે. જે કે મિથ્યાત્વપ્રકૃતિથી મિથ્યાદાચિ કહેવું તો કદાચિત દીક લાગે છે પણ સમ્યકૃત્વપ્રકૃતિથી સમ્યગદાચિ કહેવું તો અટપઢું જ લાગે છે. કારણ કે મિથ્યાત્વ તે શ્રદ્ધાગુણનું વિકારી પરિણામન છે અને સમ્યકૃત્વ શ્રદ્ધાગુણનું નિર્મણ પરિણામન છે; છતાં પણ વધુ વિકલ્પ કરવાની જરૂર નથી; કારણ કે ઉક્ત બંને કથન અહીં પૂર્વપક્ષના ઝપમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે અને બંનેનું જ નિરાકરણ કરવામાં આવ્યું છે. કહેવામાં આવ્યું છે કે ન તો મિથ્યાત્વ નામની કર્મપ્રકૃતિ મિથ્યાત્વની કર્તા છે અને ન તો સમ્યકૃત્વપ્રકૃતિ નામની કર્મપ્રકૃતિ સમ્યકૃત્વની કર્તા છે મિથ્યાત્વ અને સમ્યકૃત્વ - બંને જ ભાવોનો કર્તા વિલિક્ર નથોથી આત્મા જ છે.

ઉક્ત ગાથાઓની તાત્પર્યવૃત્તિ દીકામાં ઉક્ત વિષયવસ્તુની સયુક્તિ ચર્ચા કરતાં અંતમાં જે નિર્જર્ખ આપવામાં આવ્યો છે તે આ પ્રમાણે છે.

“જે કે શુદ્ધનિશ્ચયનયથી જીવ શુદ્ધ જ છે; છતાં પણ પર્યાયાર્થિકનયથી કથંચિત્ પરિણામી હોવાથી અનાદિ કર્મોદયના વશથી સ્ફરિકપાણાણની માફક રાગાદિઝ્રપ ઔપાધિકભાવોને ગ્રહણ કરે છે, તેઝપ પરિણામે છે. જે જીવ એકાંતે અપરિણામી હોય તો પછી ઔપાધિકભાવ ઘટિત જ નહીં થાય.

સ્ફરિકપાણામાં જ્યાપુષ્પની ઉપાધિઝ્રપ પરિણામવાની શક્તિ હોવાથી સ્ફરિકમાં જ્યાપુષ્પના સાન્નિધ્યમાં ઉપાધિ ઉત્પન્ન થાય છે; પરંતુ કાષ્ટદિકમાં તે જ જ્યાપુષ્પના સાન્નિધ્યમાં ઉપાધિ ઉત્પન્ન થતી નથી; કારણ કે કાષ્ટદિકમાં તે ઉપાધિઝ્રપ પરિણામવાની શક્તિ નથી.

આ પ્રમાણે જે દ્રવ્યમિથ્યાત્વપ્રકૃતિ કર્તા બનીને એકાંતે ભાવમિથ્યાત્વને કરતી હોય તો પછી જીવ ભાવમિથ્યાત્વનો કર્તા નહીં થાય અને જ્યારે

ભાવમિથ્યાત્વ નહીં હોય તો કર્મના બંધનનો પણ અભાવ થશે અને કર્મબંધનના અભાવમાં સંસારનો પણ અભાવ સિદ્ધ થશે - આ વાત પ્રત્યક્ષવિદ્ધ છે.”

ઉક્ત સંપૂર્ણ કથનનો સાર આ જ છે કે અનાદિ કર્મદ્યને વશીભૂત જીવમાં કથંચિત્ એવી યોગ્યતા છે કે તે કર્મદ્યથી રાગાદિભાવઙ્ઘે પરિણામે છે.

ઉક્ત સંપૂર્ણ કથનનો અભિપ્રાય પૂ. ગુરુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે -

“હવે અહીં આગમ અને યુક્તિથી સિદ્ધ કરી રહ્યા છે કે ભાવકર્મોનો કર્તા જીવ જ છે, અન્ય કોઈ નથી. ભાઈ ! જે વિકાર થાય છે તે સ્વયં પોતાની ભૂલથી જ થાય છે, પોતાને ભૂલી ગયો - એ જ સૌથી મોટી ભૂલ છે. અંદરમાં સ્વયં ચિદાનંદ ભગવાન શાયકસ્વરૂપ છે. તેને ભૂલીને પોતે જ ષટકરકની પર્યાયમાં મિથ્યાત્વાદિ વિકારીભાવ કરે છે.”^૧

વિકારીભાવોનો કર્તા જીવ પોતે જ છે; કારણ કે જે તે ભાવકર્મ અચેતનપ્રકૃતિનું કાર્ય હોય તો તે ભાવકર્મોને અચેતનપણાનો પ્રસંગ આવશે, પરંતુ વિકારી પરિણામ અચેતન નથી. તે તો ચૈતન્યની જ વિકારીદશા છે.

પ્રશ્ન:- વિકારી પરિણામોને અન્ય ઠેકાણે અચેતન-જડ કહ્યા છે ને?

ઉત્તર:- હા, કહ્યા છે; પરંતુ ત્યાં બીજી અપેક્ષાથી કથન છે. ત્યાં અચેતનપ્રકૃતિના લક્ષ્યથી થવાના કારણે વિકારી ભાવોને અચેતન કહેવામાં આવ્યા છે તથા તે વિકારીભાવ જીવનો સ્વભાવ નથી, તેથી તેમને અચેતન કહીને ત્યાંથી લક્ષ્ય હટાવ્યું છે. અજ્ઞાની જીવ વિકારને પોતાનો સ્વભાવ માને છે ને ? તેને કહીએ છીએ કે વિકારી પરિણામ જડ છે. તે આત્માનો સ્વભાવ કેવી રીતે થઈ શકે ?

^૧ પ્રવચનરત્નાકર ભાગ ૬, પાનું ૧૮૬-૧૮૭

અહીં રાગ-દ્રેષના વિકારી ભાવોને ચેતન કહ્યા છે, તેનું કારણ આ છે કે વિકારી ભાવ જડ પરમાણુરૂપ નથી. પરંતુ તે તો જીવની જ અડ્ઝી વિકૃત દશા છે. ભાવકર્મોને જે અચેતન કર્મપ્રકૃતિ કરે તો તે જડ-અચેતન થઈ જય; પરંતુ એવું નથી. તેથી રાગ-દ્રેષ અને મિથ્યાશ્રદ્ધાન આદિ વિકારી ભાવોનો કર્તા જીવ જ છે - આમ સિદ્ધ થયું.

હવે આનું જ વિશેષ સ્પષ્ટીકરણ કરે છે - પુદ્ગલદ્રવ્યમાં અર્થાત્ કર્મપ્રકૃતિઓમાં જે મિથ્યાત્વાદિ વિકારી પરિણામ થાય અને જે તેમનો કર્તા જીવ હોય તો પુદ્ગલ કર્મપ્રકૃતિઓને ચેતનપણાનો પ્રસંગ પ્રાપ્ત થશે, જડપ્રકૃતિના પરિણામ ચેતનમય થઈ જશે, પરંતુ તેમ તો થતું નથી, તેથી જીવ જ પોતાના મિથ્યાત્વાદિ ભાવકર્મોનો કર્તા છે, પુદ્ગલદ્રવ્યના પરિણામોનો કર્તા નથી - આમ સિદ્ધ થયું.

ઉપર્યુક્ત કથનથી બે વાતો સિદ્ધ થઈ -

૧ પોતાના મિથ્યાત્વાદિ ભાવકર્મોનો કર્તા જીવ જ છે, જડપ્રકૃતિ નહીં.

૨ જીવ પોતાના ભાવકર્મોનો કર્તા છે, પરંતુ જડપ્રકૃતિના પરિણામોનો કર્તા નથી.

હવે કહે છે કે જે રીતે હળદર અને ચૂનો મળવાથી લાલ રંગ થઈ જય છે, તે જ રીતે જીવ અને કર્મ પ્રકૃતિ બંને મળીને જીવના વિકારી ભાવોને કરે છે - એમ માનીએ તો જીવની માફક અચેતનપ્રકૃતિને પણ તે ભાવકર્મોનું ફળ ભોગવાનો પ્રસંગ પ્રાપ્ત થશે, જે સંભવ નથી; કારણ કે ભાવકર્મોનું ફળ તો એકમાત્ર જીવ જ ભોગવે છે. તેથી જીવ અને કર્મપ્રકૃતિઓ - બંને મળીને વિકાર કરે છે - એમ કહેવું/માનવું ઠીક નથી. તેમ માનવાથી બંનેને જ મિથ્યાત્વાદિ ભાવોનો પ્રસંગ પ્રાપ્ત થશે અર્થાત્ મિથ્યાત્વભાવથી પરિણમવું પુદ્ગલનો સ્વભાવ થશે.

તેથી આમ સિદ્ધ થયું કે જીવ પોતાના મિથ્યાત્વાદિ ભાવકર્મોનો કર્તાં છે અને પોતાના ભાવકર્મ જ જીવનું કાર્ય છે.^૧

પ્રશ્ન:- અહીં એક બાજુ વિકારી ભાવોને ચેતનના ભાવ કહ્યા છે, જ્યારે ગાથા ૫૦ થી પપમાં તે જ ભાવોને પુદ્ગળના પરિણામ કહ્યા છે - આ કથન કઈ અપેક્ષાએ છે.

ઉત્તર:- જુઓ, આ જે વિકારી ભાવ છે, તે ચેતનની પર્યાયના અસ્તિત્વમાં થાય છે. તેથી તે ચેતનના ભાવ છે - આમ અહીં કહ્યું છે; પરંતુ તે ચૈતન્યનો સ્વભાવ નથી પરંતુ વિભાવભાવ છે તથા પુદ્ગળના દ્રવ્યકર્મના ઉદ્ઘના સંગે થાય છે. સ્વભાવની દર્શિ થતાં નાશ પામે છે, તેથી તે જીવના નથી. પરંતુ પુદ્ગળના છે - આમ ૫૦ થી પપમી ગાથામાં કહે છે. સ્વભાવની દર્શિ થતાં વિકારનો ભાવ અનુભૂતિથી બિન્ન જ રહી જય છે.

આ પ્રમાણે પોતાને ભૂતીને અજ્ઞાનવશ જે મિથ્યાત્વાદિ વિભાવકૃપ પરિણામ થાય છે, તે ચેતનના ભાવ છે અને તેમનો કર્તાં પણ ચેતન જ છે, અન્ય પુદ્ગળદ્રવ્ય નથી.

એ જ કહે છે - જુઓ, જીવનો જ્ઞાન-દર્શન રૂપ જે ઉપયોગ છે, તેને ચેતન કહે છે, જ્ઞાન-દર્શન સિવાયનાં જે અનંત ગુણ છે, તેમને અચેતન કહ્યા છે; કારણ કે તે ગુણ પોતાને તો જણતા નથી, પરને પણ નથી જણતા. આ રીતે બિન્ન બિન્ન અપેક્ષાઓથી શાસ્ત્રમાં કથન આવે છે. તેમને યથાર્થ જાણવા જોઈએ. અચેતનના પણ જુદા જુદા પ્રકાર છે.

શરીર, મન, વાળી આદિ અચેતન છે. પુણ્ય-પાપ અને મિથ્યાત્વના જે ભાવ જીવને થાય છે, તેમને પણ શુદ્ધ ચૈતન્યની અપેક્ષાએ અચેતન કહ્યા છે.

^૧ પ્રવચનરત્નાકર ભાગ ૬, પાનું ૧૮૭-૧૮૮

જીવના જ્ઞાન-દર્શનકૃપ ઉપયોગની અપેક્ષા અન્ય ગુણોને અચેતન કહ્યા છે; કારણ કે અન્ય ગુણોમાં જાળવા-દેખવાકૃપ ઉપયોગની શક્તિ નથી.

પરંતુ અહીં તે વાત નથી. અહીં બીજી વાત છે. અહીં તો મિથ્યાત્ત્વ અને પુણ્ય-પાપ આદિ વિકારી ભાવ જીવની પર્યાયના અસ્તિત્વમાં થાય છે, તેથી તેમને ચેતન કહ્યા છે અને ચેતન હોવાથી તેમનો કર્તા ચેતન જ છે - આમ સિદ્ધ કર્યું છે.

હવે કહે છે કે અંદરમાં તો વસ્તુ ત્રિકાળ એકકૃપ ચિદ્ગ્રસ છે. તેને અભેદદાચિથી જેતાં તે શુદ્ધ ચેતના ભાત્ર જ છે; પરંતુ જ્યારે તે કર્મના નિમિત્તથી પરિણામિત થાય છે, ત્યારે તે વિકારી પરિણામોથી પુક્ત થાય છે અને ત્યારે પરિણામ-પરિણામીની ભેદદાચિમાં પોતાના અજ્ઞાનભાવકૃપ પરિણામોનો કર્તા જીવ પોતે જ થાય છે. આ પુણ્ય-પાપ આદિ જે વિકારી ભાવ થયા તે પરિણામ અને જીવ પરિણામી - આવી ભેદદાચિમાં પોતાના પુણ્ય-પાપાદિ ભાવોનો કર્તા જીવ જ છે.

અભેદદાચિમાં તો કર્તા-કર્મ ભાવ છે જ નહીં. જીવ વસ્તુ શુદ્ધ ચેતનાભાત્ર જ છે. અભેદદાચિમાં તો રાગાદિ વિકાર છે જ નહીં. જ્યાં ચિહ્નાનંદ ચૈતન્યસ્વરૂપની અભેદદાચિ થઈ, ત્યાં જ કર્તા-કર્મ ભાવનો અભાવ થઈ જય છે.

આ પ્રમાણે યથાર્થ રીતે સમજ લેવું જોઈએ કે ચેતનકર્મનો કર્તા ચેતન જ છે. આવી સ્વતંત્રતાને સ્વીકારીને અન્ય દ્રવ્ય, ગુણ પર્યાયો પરથી દરિદ્ર હત્યાવીને દ્રવ્યદાચિ પ્રગટ કરવી - બસ આ કથનનું આ જ તાત્પર્ય છે. ૧

આમ ઉકાત સંપૂર્ણ કથનનો સાર આ જ છે કે, જે કે આ ભગવાન આત્મા પરમશુદ્ધનિશ્ચયનયથી અકર્તા-અભોકતા જ છે; તોપણ અશુદ્ધનિશ્ચયનયથી આ આત્મા કર્મોદ્યના નિમિત્તાનુસાર થનાર રાગાદિ

ભાવકર્મેર્દ્રિપ જ પરિણમે છે, રાગાદિ ઔપાધિકભાવોનો કર્તા-ભોક્તા પણ થાય છે.

હવે આ જ ભાવનું પોષક કળશ કાવ્ય લખે છે, જે આપ્રમાણે છે.

(શાર્ડુલવિક્રીડિત)

કાર્યત્વાદકૃતં ન કર્મ ન ચ તજીવપ્રકૃત્યોર્દ્વયો-
રજાયા: પ્રકૃતે: સ્વકાર્યફલભુગ્ભાવાનુષ્ઠંગાત્કૃતિઃ ।
નૈકસ્યા: પ્રકૃતેવિચ્ચલસનાજીવોઽસ્ય કર્તા તતો
જીવસ્વૈવ ચ કર્મ તચ્ચિદનુંં જ્ઞાતા ન યત્પુદ્ગલઃ ॥૨૦૩॥

(હરિગીત)

જે કર્મ છે તે કાર્ય છે ને કાર્ય વાગ્કૃત હોય ના,
વળી જીવ-પ્રકૃતિ ઉભયની પણ કૃતિ તે કદી હોય ના;
ભોક્તા બને જરૂર પ્રકૃતિ જે કાર્ય હોય ઉભય તાણું,
ચેતનમયી તે કૃતિપાણ નથી કાર્ય એક જ જરૂર તાણું;
માટે કષ્યો છે જીવને કર્તા જ જીવના કર્મનો,
પણ પુદ્ગલો ક્રયમ હોય કર્તા જે સ્વયં જ્ઞાતા ન હો ? ૨૦૩

ભાવકર્મ કાર્ય છે, તેથી તે અકૃત ન હોઈ શકે, તેનો કર્તા કોઈને કોઈ અવશ્ય હોયનો જોઈએ; કારણ કે કર્તા વગર કાર્ય થતું નથી. તે ભાવકર્મર્દ્રિપ કાર્ય જીવ અને પૌદ્ગલિક પ્રકૃતિ એ બંનેએ મળીને કરેલું કાર્ય પણ હોઈ શકતું નથી; કારણ કે એમ માનતાં ‘જે કર્તા તે ભોક્તા’ - આ નિયમને અનુસારે જરૂરપ્રકૃતિને પણ તેનો ફળ ભોગવાનો પ્રસંગ આવશે. પ્રકૃતિનું અચેતનપણું તો પ્રગટ છે જ અને ભાવકર્મ ચેતન છે તેથી તે ચિહ્નવિલાસર્દ્રિપ ભાવકર્મ એકલી પ્રકૃતિનું પણ કાર્ય હોઈ શકતું નથી. પુદ્ગલ તો જ્ઞાતા નથી; તેથી ચેતનનું અનુસરણ કરનાર ભાવકર્મનો કર્તા ચેતન જીવ જ છે અને તે ભાવકર્મ જીવનું જ કર્મ છે.

આ કળશનો ભાવ સ્પષ્ટ કરવા માટે કવિવર બનારસીદાસજી એ

પ્રશ્નોત્તર શૈલીનો પ્રયોગ કર્યો છે. તેના ભાવને સ્પષ્ટ કરવા માટે તેમણે આઠ દોહા લખ્યા છે. તે આઠ દોહામાંથી શરૂઆતના ત્રણ દોહાઓમાં પ્રશ્ન ઉભા કર્યા છે અને બાકીના પાંચ દોહામાં તેમના ઉત્તર આપ્યા છે. અત્યંત સરળ ભાષા અને સુભોધ શૈલીમાં કરેલું તેમનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે.

(દોહા)

પ્રશ્ન : શિષ્ય કહે પ્રભુ તુમ કહ્યો, દુબિધિ કરમ કૌ રૂપ ।

દરબ કર્મ પુદ્ગલ મર્ઝ, ભાવકર્મ ચિદ્રૂપ ॥

કરતા દરવિત કરમ કૌ, જીવ ન હોડ ત્રિકાલ ।

અબ યહ ભાવિત કરમ તુમ, કહ્યો કૌન કી ચાલ ॥

કરતા યાકૌ કૌન હૈ, કૌન કરૈ ફલ ભોગ ।

કે પુદ્ગલ કે આત્મા, કે દુહું કૌ સંજોગ? ॥

શિષ્ય પ્રશ્ન કરે છે કે હે પ્રભુ ! આપે એમ બતાવ્યું છે કે કર્મ બે પ્રકારનું હોય છે. તેમાં દ્રવ્યકર્મ તો પૌદ્ધગિક છે અને ભાવકર્મ ચૈતન્યકૃપ છે.

આ બંને કર્મોમાં અચેતન દ્રવ્યકર્મોનો કર્તા તો જીવ ત્રણ કાળમાં ક્યારેય થઈ શકતો નથી; તો હવે આપ એ તો બતાવો કે આ ભાવકર્મોનો કર્તા કોણ છે અને તેમનું ફળ પણ કોણ ભોગવે છે ? આ ભાવકર્મોનો કર્તા-ભોક્તા અચેતન પુદ્ગલ છે અથવા ચેતન જીવ છે કે પછી બંનેનો સંયોગ છે અર્થાત् બંને મળીને ભોગવે છે ?

(દોહા)

ઉત્તર : ક્રિયા એક કરતા જુગલ, યોં ન જિનાગમ માંહિ ।

અથવા કરની ઔર કી, ઔર કરૈ યોં નાંહિ ॥

કરૈ ઔર ફલ ભોગવૈ, ઔર બનૈ નહિ એમ ।

જો કરતા સો ભોગતા, યહે જથાવત જેમ ॥

ભાવકરમ કરતવ્યતા, સ્વયંસિદ્ધ નહિ હોડ ।

જો જગ કી કરની કરૈ, જગવાસી જિય સોઈ ॥

જિય કરતા જિય ભોગતા, ભાવકરમ જિયચાલ ।

પુદ્ગલ કરૈ ન ભોગવૈ, દુવિધા મિથ્યાજાલ ॥

તાતેં ભાવિત કરમ કૌં, કરજ મિથ્યાતી જીવ ।

સુખ દુખ આપદ સંપદા, ભુંજૈ સહજ સદીવ ॥

શ્રીગુરુ ઉક્ત પ્રશ્નોનો ઉત્તર આપતાં કહે છે કે આવી વાત તો જિનાગમમાં છે જ નહીં કે એક કિયાના બે કર્તાં હોય અથવા બે દ્રવ્ય મળીને એક કિયા કરે. કોઈ દ્રવ્યની કિયાને અન્ય દ્રવ્ય કરે - તે પણ જિનાગમને સ્વીકાર્ય નથી. તેથી કોઈ કરે અને અન્ય કોઈ તેનું ફળ ભોગવે - આ પણ સંભવ નથી; કારણકે યથાયોગ્ય ને કરે, તે જ ભોગવે; જિનાગમને તો તે જ સ્વીકાર્ય છે.

ભાવકર્મ પણ એક કાર્ય છે અને તે સ્વયંસિદ્ધ તો છે નહીં; તેથી જગતવાસી અજ્ઞાની લુલ જ ભાવકર્મરૂપ જગતના કર્તાં છે.

અધિક શું કહીએ ? ભાવકર્મ લુલની પરિણતિ છે અને લુલ જ તેમનો કર્તાં-ભોક્તા છે; પુદ્ગલ તેમનો કર્તાં-ભોક્તા કદાપિ નથી. પુદ્ગલ અને લુલ-બંને મળીને ભાવકર્મને કરે છે - ભોગવે છે - આ વાત પણ મિથ્યા છે.

તેથી નિર્ઝર્ખ આમ જ છે કે ભાવકર્મનો કર્તાં મિથ્યાદાચિ લુલ જ છે અને તે જ તદ્જન્ય સુખ-દુઃખ અને સંપત્તિ-વિપત્તિને સદાય ભોગવે છે.

આ કળશનો ભાવ પૂજ્ય ગુરુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે -

“આ જે પુણ્ય-પાપ આદિ ભાવકર્મ છે, તે કાર્ય છે. ને કાર્ય થાય છે, તે અકૃત હોતું નથી, કોઈના કર્યા વગર થતું નથી. આ જેઠીને નેમ અન્ય ભતાવલંબી-ઈશ્વરવાદી આદિ તેને ઈશ્વરકૃત માની લે છે; તેવી જ રીતે જૈનદર્શનના અધ્યાત્મથી અણનાણ લોકો આ કાર્યોનો કર્તા જડ કર્મને માની લે છે. આ પ્રમાણે બંને જ મિથ્યા માન્યતાવાળા છે. તેથી અહીં

કહે છે કે જુઓ, આ પુણ્ય-પાપ આદિ વિકારી ભાવ જીવ અને જડ કર્મપ્રકૃતિઓમાંથી કોઈનું પણ કાર્ય નથી, બંનેએ મળીને કરેલું પણ નથી; કારણ કે જે બંને મળીને કરે તો જડપ્રકૃતિને પણ પોતાના કાર્યનું ફળ ભોગવવાનો પ્રસંગ આવશે, પરંતુ તેમ નથી.^૧

અહીં પરમાત્મા બ્રિનેશ્વર કહે છે કે રાગ અજ્ઞાનભાવથી થાય છે, કર્મના કારણે નહીં. રાગને પોતાનો માનનાર પર્યાયબુદ્ધિ જીવ રાગને કરે છે. તે રાગ પોતાથી જ થાય છે, પરથી નહીં.

જેની દાઢિ પોતાના ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વભાવ પર પડી છે - એવો ધર્મી જ્ઞાની જીવ રાગનો કર્તા નથી, અકર્તા જ છે, જ્ઞાતા-દાઢા જ છે.

એક બાજુ જીવને કર્તા કહેવો અને બીજુ બાજુ તેને જ અકર્તા કહેવો - આ બંનેય કથન જુદી-જુદી અપેક્ષાઓથી છે. તેનું જ નામ તો સ્યાદ્વાદ છે. અજ્ઞાનવશ જીવ કર્તા છે અને અજ્ઞાનતા મટતાં જ, જ્ઞાનભાવ પ્રગટ થતાં જ જીવ અકર્તા છે.^૨

આ પ્રકારે આ કળશમાં અનેક પ્રકારની યુક્તિઓ દર્શાઈને એ સિદ્ધ કર્યું છે કે મોહ-રાગ-દ્રેષ્ટ્રૂપ ભાવકર્માનો કર્તા-ભોક્તા અજ્ઞાની આત્મા છે; ન તો જ્ઞાની આત્મા તેમનો કર્તા-ભોક્તા છે અને ન તો પૌર્ણાલિક કર્મ તેને કરે છે.

હવે આગામી ગાથાઓના ભાવનો સૂચક કળશ કાવ્ય લખે છે; જે આ પ્રમાણે છે.

(શાર્વુલવિક્રીદિત)

કર્મેવ પ્રવિતક્ર્ય કર્તૃ હતકૈ: ક્ષિપ્તવાત્મન: કર્તૃતાં
કર્તાત્તૈષ કર્થંચિદિત્યચલિતા કैશિચચ્છુતિ: કોપિતા ।
તેષામુદ્ધતમોહમુદ્રિતધિયાં બોધસ્ય સંશુદ્ધયે
સ્યાદ્વાદપ્રતિબંધલબ્ધવિજયા વસ્તુસ્થિતિ: સ્તૂયતે ॥૨૦૪॥

૧ પ્રવચનરત્નાકર ભાગ ૮, પાનું ૧૯૨

૨ પ્રવચનરત્નાકર ભાગ ૮, પાનું ૧૯૩-૧૯૪

(હસ્તિગીત)

‘છે કર્મ બસ કર્તા’ - વિચારી આત્મધાતક જીવ જે,
આત્મા તારુણ કર્તાપાળાને સર્વથા જ નિષેધીને;
‘આ આત્મા કર્તા કર્થંચિત्’ - એવી અચલિત શુતિને
કોપિત કરે દુર્ભુદ્ધિઓ તે તીવ્રમોહી બની અરે;
વસ્તુસ્થિતિ કહેશે હવે સંશુદ્ધ અર્થે તેમની,
જે સ્યાદવાદ નિયમ વડે નિર્બાધ સિદ્ધિ પામતી. ૨૦૪

કોઈ આત્મધાતી એકાંતવાહી લોકો રાગાદિ વિકારીભાવોનો કર્તા
પૌર્ણાલિકકર્મોને જ માનીને આત્માનું કર્તૃત્વ સર્વથા ઉડાડીને ‘આત્મા
રાગાદિભાવોનો કર્થંચિત્ કર્તા છે’ - આમ કહેનારી શુતિ જીવનવાણીને
કોપિત કરે છે; તીવ્રમોહી મોહિત બુદ્ધિવાળા એ લોકોની બુદ્ધિની સંશુદ્ધિ
માટે આગામી ગાથાઓમાં અનેકાંતમથી વસ્તુસ્થિતિનું વિવેચન કરવામાં
આવે છે.

પાંડે રાજમલણ કળશાટીકામાં આ કળશનો અર્થ કરતી વખતે શુતિ
કોપિતા પદનો અર્થ કરતાં એમ કહે છે કે કેટલાય મિથ્યાદાઢિ જીવોને
આવું સાંભળતાં માત્ર અત્યંત કોધ ઉત્પન્ન થાય છે.

આગામી પ્રકરણની સૂચના દેનાર આ કળશનો ભાવાનુવાદ કવિવર
બનારસીદાસણ બે છંદોમાં આ પ્રમાણે કરે છે -

(સવૈયા ઇકતીસા)

કેઝ મૂઢ વિકલ એકંતપચ્છ ગહેં કહેં,

આત્મા અકરતાર પૂરન પરમ હૈ ।

તિન્હિ સૌં જુ કોઊ કહૈ જીવ કરતા હૈ તાસૌં,

ફેરિ કહેં કરમ કૌ કરતા કરમ હૈ ॥

એસે મિથ્યામગન મિથ્યાતી બ્રહ્માધાતી જીવ,

જિન્હિ કેં હિએ અનાદિ મોહ કૌ ભરમ હૈ ।

તિન્હિ કોં મિથ્યાત દૂર કરવૈ કોં ગુરુ,

સ્યાદવાદ પરવાંન આત્મ ધરમ હૈ ॥

(દોહા)

ચેતન કરતા ભોગતા, મિથ્યા મગન અજાન ।
નહિ કરતા નહિં ભોગતા, નિહચૈ સમ્યકવાન ॥

કોઈ દુઃખી મૂર્ખ લોકો એકાંત પદ્ધને ગ્રહણ કરીને કહે છે કે આત્મા તો પૂર્ણ પરમાત્મા છે અને કર્માનો સર્વથા અકર્તા છે. જે તેમને કોઈ કહે કે જીવ જ કર્માનો કર્તા છે તો તેઓ તેમને કહે છે કે કર્માના કર્તા તો કર્મ જ છે. આ પ્રકારની મિથ્યા માન્યતાઓમાં મળ બ્રહ્મધાતી (આત્મધાતી) મિથ્યાદિઓનું હદ્ય અનાદિથી મોહગ્રસ્ત છે, ભ્રમમાં ભૂલેતા છે. તેમની મિથ્યા માન્યતા દૂર કરવા માટે અહીં ગુરુદેવ કહી રહ્યા છે કે આત્મધર્મ સ્યાદ્વાદૃપ છે. તાત્પર્ય આમ છે કે જૈનદર્શનના અનુસાર આત્મા રાગાદિ ભાવકર્માનો કથંચિત્ કર્તા-ભોક્તા છે; અને ઉક્ત સંદર્ભમાં સ્યાદ્વાદ જ પ્રમાણ છે.

ઉક્ત સ્યાદ્વાદના કથનને અનુસાર મિથ્યાદિ અજ્ઞાની જીવ રાગાદિભાવોના કર્તા-ભોક્તા છે અને સમ્યગ્દિ જીવ નિશ્ચયનયથી રાગાદિભાવોના કર્તા-ભોક્તા છે.

આ કળશનો ભાવ સ્પષ્ટ કરતાં પૂજય ગુરુદેવ કહે છે - “કથંચિત્ કર્તા છે - તેનો અર્થ એ છે કે જ્યાં સુધી અજ્ઞાની છે, ત્યાંસુધી પુણ્ય-પાપ આદિ વિકારીભાવોનો કર્તા જીવ છે, સમ્યગ્દર્શન પ્રગટ થતાં, આત્મજ્ઞાન પ્રગટ થતાં રાગનો અકર્તા છે. તે સ્યાદ્વાદ છે.”^૧

૯૮ શરીરનો અને વાણી આદિ ડિયાઓનો કર્તા તો અજ્ઞાની પણ નથી. પૂજન કરતી વખતે હાથ ફેલાવીને અછ દ્રવ્ય ચડાવે છે અને મુખથી સ્વાહા બોલે છે, પ્રવચન કરે છે. આ બધી જડની ડિયાઓ છે. તેમનો કર્તા તો જીવ અજ્ઞાનભાવથી પણ નથી. માત્ર પર તરફ લક્ષ્ય જતાં જે રાગ થાય છે, તે રાગ પર જેની દિલ્લિ છે - આવો અજ્ઞાની જીવ

^૧ પ્રવચનરત્નાકર ભાગ ૬, પાનું ૧૮૫

અજ્ઞાનભાવથી તે રાગનો કર્તા છે તથા જેની દષ્ટિ રાગથી હઠીને અંદર ચિત્તસ્વભાવ પર જતી રહે છે, તે જ્ઞાની લુલ રાગનો કર્તા નથી.

જુઓ, અન્ય મતવાળા જગતનો કર્તા ઈશ્વરને માને છે, જ્યારે કોઈ જૈનમતવાળો (જૈનાભાસી) રાગનો કર્તા જહકમોને માને છે. તે બંનેથી એક જ જાતની માન્યતાવાળા મિથ્યાદષ્ટિ છે. તેઓ આત્મધાતી છે; કારણ કે વિપરીત માન્યતાથી તેઓ નિરંતર નિજ આત્મદ્રવ્યની હિંસા જ કરે છે. તેમની પર જિનવાણીનો કોપ છે. જિનવાણી આત્માને કથંચિત્ કર્તા કહે છે અને તે અજ્ઞાની એકાંતી આત્માને સર્વથા અકર્તા જ માને છે. તે કારણે જિનવાણીનો તેના પર કોપ છે અર્થાત્ તે જિનવાણીનો વિરાધક છે - આમ આચાર્યદ્વિપ કહે છે.^૧

ભાઈ ! આ કોઈ પક્ષ વિશેષની વાત નથી. આ તો વસ્તુસ્થિતિ છે; જે આગમ અને યુક્તિથી નિર્બાધ સિદ્ધ છે. છતાં પણ જે કોઈ એવું માને કે આત્મા સર્વથા અકર્તા જ છે તો તે મિથ્યામાન્યતાથી ગ્રસ્ત છે. તેની તે મિથ્યામાન્યતાના નિવારણાર્થે હવે આચાર્ય ભગવાન આગળની ગાથાઓમાં વસ્તુસ્થિતિનું દિગ્દર્શન કરે છે.^૨

આગળની તેર ગાથાઓના સૂચક આ કળશ કાવ્યમાં આમ જ કહેવામાં આવ્યું છે કે જૈનદર્શન સ્યાહવાદી દર્શન છે અને તેને અનુસાર અજ્ઞાની આત્મા રાગાદિભાવકૃપ ભાવકમોનો કર્તા છે અને જ્ઞાની આત્મા તેમનો કર્તા-ભોક્તા નથી. આ નય લગાડીને વાત કરતાં એમ પણ કહી શકીએ કે અશુદ્ધનિશ્ચયનયથી આત્મા રાગાદિભાવોનો કર્તા-ભોક્તા છે અને શુદ્ધનિશ્ચયનયથી તેનો કર્તા-ભોક્તા નથી.



^૧ પ્રવચનરણાકર ભાગ ૮, પાનું ૧૯૬

^૨ પ્રવચનરણાકર ભાગ ૮, પાનું ૧૯૭-૧૯૮

समयसार गाथा ३३२-३४४

कम्मेहि दु अणाणी किज्जदि णाणी तहेव कम्मेहिं ।

कम्मेहि सुवाविज्जदि जग्गाविज्जदि तहेव कम्मेहिं ॥३३२॥

कम्मेहि सुहाविज्जदि दुक्खाविज्जदि तहेव कम्मेहिं ।

कम्मेहि य मिच्छतं णिज्जदि णिज्जदि असंजमं चेव ॥३३३॥

कम्मेहि भमाडिज्जदि उइढमहो चावि तिरियलोयं च ।

कम्मेहि चेव किज्जदि सुहासुहं जेत्तियं किंचि ॥३३४॥

जम्हा कम्मं कुब्बदि कम्मं देदि हरदि त्ति जं किंचि ।

तम्हा उ सब्बजीवा अकारगा होंति आवण्णा ॥३३५॥

पुरिसित्थियाहिलासी इत्थीकम्मं च पुरिसमहिलसदि ।

एसा आयरियपरंपरागदा एरिसी दु सुदी ॥३३६॥

तम्हा ण को वि जीवो अबंभचारी दु अम्ह उवदेसे ।

जम्हा कम्मं चेव हि कम्मं अहिलसदि इदि भणिदं ॥३३७॥

जम्हा घादेदि परं परेण घादिज्जदे य सा पयडी ।

एदेणत्थेण किर भण्णदि परघादणामेत्ति ॥३३८॥

तम्हा ण को वि जीवो वघादेओ अथि अम्ह उवदेसे ।

जम्हा कम्मं चेव हि कम्मं घादेदि इवि भणिदं ॥३३९॥

एवं संखुवएसं जे उ परूवेंति एरिसं समणा ।
तेसिं पयडी कुब्बदि अप्पा य अकारगा सब्बे ॥३४०॥

अहवा मण्णसि मज्जं अप्पा अप्पाणमप्पणे कुणदि ।
एसो मिच्छसहावो तुम्हं एयं मुण्ठस्स ॥३४१॥

अप्पा णिच्छोऽसंखेज्जपदेसो देसिदो दु समयम्हि ।
ण वि सो सक्कदि तत्तो हिणो अहिओ य काढुं जे ॥३४२॥

जीवस्स जीवरूवं वित्थरदो जाण लोगमेत्तं खु ।
तत्तो सो किं हीणो अहिओ य कहं कुणदि दब्बं ॥३४३॥

अह जाणगो दु भावो णाणसहावेण अच्छदे त्ति मदं ।
तम्हा ण वि अप्पा अप्पयं तु समयप्पणे कुणदि ॥३४४॥

(हरिगीत)

“कर्मो करे अशानी तेम ज शानी पाणु कर्मो करे,
कर्मो सुवाडे तेम वणी कर्मो जगाडे ज्ञवने; ३३२

कर्मो करे सुखी तेम वणी कर्मो दुखी ज्ञवने करे,
कर्मो करे भिथ्यात्वी तेम असंयमी कर्मो करे; ३३३

कर्मो भमावे उधर्व लोके, अधः ने तिर्थक् विषे,
जे कांઈपाणु शुभ के अशुभ ते सर्वने कर्म ज करे. ३३४

कर्म ज करे छे, कर्म ओ आपे, छवे, सधणुं करे,
तेथी करे छे ओमके आत्मा अकारक सर्व छे. ३३५

वणी ‘पुळकर्म स्त्रीने अने स्त्रीकर्म ईछे पुळने’
ओवी श्रुति आचार्य केरी परंपरा उतरेल छे. ३३६

ओ रीत ‘कर्म ज कर्मने ईछे’ - कहुं छे श्रुतमां,
तेथी न को पाणु ज्ञव अभ्रत्यारी अम उपदेशमां ३३७

વળી જે હાગે પરને, હાગાયે પરથી, તેણ પ્રકૃતિ છે,
એ અર્થમાં પરધાત નામનું નામકર્મ કથાય છે. ૩૩૮

એ રીત ‘કર્મ જ કર્મને હાગતું’ - કહ્યું છે શુતમાં,
તેથી ન કો પાણ જીવ છે હાગનાર અમ ઉપદેશમાં” ૩૩૯

એમ સાંખ્યનો ઉપદેશ આવો, જે શ્રમાગું પ્રડ્યાગું કરે,
તેના મતે પ્રકૃતિ કરે છે, જીવ અકારક સર્વ છે ! ૩૪૦

અથવા તું માને ‘આતમા મારો કરે નિજ આત્મને’,
તો એવું તુજ મંત્ર્ય પાણ મિથ્યા સ્વભાવ જ તુજ ખરે. ૩૪૧

જીવ નિત્ય તેમ વળી અસંખ્યપ્રદેશી દર્શિત સમયમાં,
તેનાથી તેને હીન તેમ અધિક કરવો શક્ય ના. ૩૪૨

વિસ્તારથી જીવરૂપ જીવનું લોકમાત્ર જ છે ખરે,
શું તેથી તે હીન-અધિક બનતો ? કેમ કરતો દ્રવ્યને ? ૩૪૩

માને તું - ‘શાયક ભાવ તો શાનસ્વભાવે સ્થિર રહે’,
તો અમપાગું આત્મા સ્વયં નિજ આત્માને નહિ કરે.’ ૩૪૪

કર્મો જીવને અજ્ઞાની કરે છે તેમ જ કર્મો જીવને જ્ઞાની કરે છે, કર્મો
સુવાડે છે તેમ જ કર્મો જગાડે છે. કર્મો સુખી કરે છે તેમજ કર્મો દુઃખી
કરે છે. કર્મો મિથ્યાત્વ પમાડે છે તેમજ કર્મો જ અસંયમી બનાવે છે.

કર્મો જ જીવને ઉદ્વર્ધલોક, અધોલોક અને તિર્યંચલોકમાં ભમાવે છે.
વધુ શું કહીએ, જે કંઈ પણ શુભ અને અશુભ છે તે બધું કર્મો જ કરે
છે.

આ પ્રમાણે કર્મો જ કરે છે જેથી કર્મો જ આપે છે અને કર્મો જ
હરી લે છે; એમ જે કાંઈપણ કરે છે તે કર્મ જ કરે છે આ રીતે બધા જીવ
સર્વથા અકારક જ સિદ્ધ થાય છે.

પુરુષવેદકર્મ સ્ત્રીનું અભિલાષી છે અને સ્ત્રીવેદકર્મ પુરુષની અભિલાષા કરે છે - એવી આ આચાર્યાની પરંપરાગત શ્રુતિ છે. માટે અમારા ઉપદેશમાં તો કોઈ પણ જીવ અખ્રલચારી નથી. કારણ કે કર્મજ કર્મની અભિલાષા કરે છે - આમ કહ્યું છે.

જે પરને હણે છે અને જે પરથી હણાય છે તે પ્રકૃતિ છે; જેને પરધાતનામકર્મ કહેવામાં આવે છે તેથી અમારા ઉપદેશમાં કોઈ પણ જીવ ઉપધાતક (હણનાર) નથી. કારણ કે કર્મ જ કર્મને હણે છે - આમ કહેવામાં આવ્યું છે.

આવો સાંખ્યમતનો ઉપદેશ જે શ્રમણો (જૈનયુતિઓ) પ્રકૃતે છે, તેમના મતમાં પ્રકૃતિ જ કરે છે અને આત્મા તો સંપૂર્ણ અકારક છે - આમ સિદ્ધ થાય છે.

અથવા જે તું એમ માને કે મારો આત્મા પોતાના દ્રવ્યકુપ આત્માને કરે છે તો તારું એમ માનવું મિથ્યા છે; કારણ કે સિદ્ધાંતમાં આત્માને નિત્ય અને અસંખ્યાતપ્રદેશી બતાવ્યો છે, તે તેનાથી હીન અથવા અધિક થઈ શકતો નથી અને વિસ્તારની અપેક્ષા પણ જીવને જીવકુપ નિશ્ચયની લોકમાત્ર જાણ; તેનાથી શું તે હીન અથવા અધિક થાય છે ? જે નહીં તો પછી તે દ્રવ્યને કેવી રીતે કરે છે ?

અથવા જે જ્ઞાયક ભાવ તો જ્ઞાનસ્વભાવે સ્થિત રહે છે - જે એમ માનવામાં આવે તો તેથી આત્મા પોતાના આત્માને કરતો નથી - આમ સિદ્ધ થશે.

આ પ્રમાણે કર્તૃત્વને સિદ્ધ કરવા માટે વિવક્ષા બદલીને જે વાત કરી છે તે પણ ઘટિત થતી નથી.

ઉક્ત સંપૂર્ણ કથનનું તાત્પર્ય આમ છે કે જે ભાવકર્મનો કર્તા કર્મને જ માનવામાં આવે તો સ્યાદ્વાદ સાથે વિરોધ આવે છે; તેથી આત્માને અજ્ઞાન અવસ્થામાં પોતાના અજ્ઞાનભાવકુપ ભાવકર્મનો કર્તા કથંચિતું સ્વીકારવો તે જ સાચું છે; કારણ કે તેમાં સ્યાદ્વાદનો વિરોધ આવતો નથી.

આ ગાથાઓનો ભાવ આત્મપ્રાતિમાં યુક્તિસહિત આ પ્રમાણે રૂપદ્ધ કરવામાં આવ્યો છે.

“કર્મ જ આત્માને અજ્ઞાની કરે છે; કારણ કે જ્ઞાનાવરણ નામના કર્મના ઉદ્દ્ય વિના અજ્ઞાનની અનુપપત્તિ છે. કર્મ જ આત્માને જ્ઞાની કરે છે; કારણ કે જ્ઞાનાવરણ નામના કર્મના ક્ષયોપશમ વિના તેની અનુપપત્તિ છે. કર્મ જ સુવાડે છે; કારણ કે નિદ્રાવ નામના કર્મના ઉદ્દ્ય વિના તેની અનુપપત્તિ છે. કર્મજ જગાડે છે; કારણ કે નિદ્રા નામના કર્મના ક્ષયોપશમ વગર તેની અનુપપત્તિ છે.

કર્મ જ સુખી કરે છે; કારણ કે શાતાવેદનીય નામના કર્મના ઉદ્દ્ય વિના તેની અનુપપત્તિ છે. કર્મ જ દુઃખી કરે છે; કારણ કે અશાતાવેદનીય નામના કર્મના ઉદ્દ્ય વિના તેની અનુપપત્તિ છે. કર્મ જ મિથ્યાદાચિ કરે છે; કારણ કે મિથ્યાત્વકર્મના ઉદ્દ્ય વિના તેની અનુપપત્તિ છે.

કર્મ જ અસંયમી કરે છે; કારણ કે ચારિત્રમોહ નામના કર્મના ઉદ્દ્ય વિના તેની અનુપપત્તિ છે. કર્મ જ ઉદ્વર્લોકમાં, અધોલોકમાં અને તિર્યગ્લોકમાં ભ્રમણ કરાવે છે; કારણ કે આનુપૂર્વી નામના કર્મના ઉદ્દ્ય વિના તેની અનુપપત્તિ છે. બીજું પણ જે કંઈ જેટલું શુભ-અશુભ છે, તે બધું કર્મ જ કરે છે; કારણ કે પ્રશસ્ત-અપ્રશસ્ત નામના કર્મના ઉદ્દ્ય વિના તેની અનુપપત્તિ છે.

આવી રીતે બધું સ્વતંત્રતાથી કર્મ જ કરે છે, કર્મ જ આવે છે, કર્મ જ હરી લે છે; તેથી અમે એમ નિશ્ચય કરીએ છીએ કે બધા જીવ સદા એકાંતે અકર્તા જ છે અને શ્રુતિ (ભગવાનની વાણી, શાસ્ત્ર) પણ આ જ અર્થને કહે છે, કારણ કે (તે શ્રુતિ) ‘પુરુષવેદ નામનું કર્મ સ્ત્રીની અભિલાષા કરે છે અને સ્ત્રીવેદ નામનું કર્મ પુરુષની અભિલાષા કરે છે’ - આ વાક્યથી કર્મને જ કર્મની અભિલાષાના કર્તૃત્વના સમર્થનથી જીવના અખ્રાત્મયના કર્તૃત્વનો નિષેધ કરે છે તથા ‘જે પરને હણે છે અને જે પર વડે હણાય છે; તે પરધાતકર્મ છે’ - આ વાક્યથી કર્મને જ કર્મના

ધાતનું કર્તૃત્વ હોવાના સમર્થનથી જીવના હણવાના કર્તૃત્વનો નિષેધ કરે છે અને આ પ્રમાણે (અખ્રલ્યાર્થ અને હણવાના કર્તૃત્વના નિષેધથી) જીવનું સર્વથા જ અકર્તૃત્વ બતાવે છે.

આ રીતે આવા સાંઘ્યમતને પોતાની પ્રજ્ઞા (બુદ્ધિ) ના અપરાધથી સૂત્રના અર્થને ન જાણનાર કંઈક શ્રમણાભાસ પ્રદૂપતિ કરે છે; તેમની એકાંતે પ્રકૃતિના કર્તૃત્વની માન્યતાથી સમસ્ત જીવોનું એકાંતે અકર્તૃત્વ આવી જય છે. તેથી 'જીવકર્તા છે' - આવી જે શ્રુતિ છે, તેનો કોપ દૂર કરવાનું અશક્ય થઈ જય છે.

'કર્મ આત્માના પર્યાયકૃપ અજ્ઞાનાદિ સર્વ ભાવોને કરે છે અને આત્મા તો આત્માને જ કરે છે, તેથી જીવ કર્તા છે; આ રીતે શ્રુતિનો કોપ થતો નથી' - આવો જે અભિપ્રાય છે તે પણ મિથ્યા જ છે; કારણ કે જીવ તો દ્રવ્યકૃપે નિત્ય છે, અસંઘ્યાત પ્રદેશી છે અને લોક પરિમાળ છે. તેમાં નિત્યનું કાર્યત્વ બની શકતું નથી; કારણ કે કૃતકર્ત્વ અને નિત્યત્વના એકત્વનો વિરોધ છે.

અવસ્થિત અસંઘ્યપ્રદેશી એક (આત્મા) ને પુહગલસ્કર્ધની જેમ પ્રદેશોના પ્રક્ષેપણ-આકર્ષણ વડે પણ કાર્યત્વ થતું નથી, કારણ કે પ્રદેશોનું પ્રક્ષેપણ અને આકર્ષણ હોય તો તેમના એકત્વનો વ્યાધાત થઈ જશે.

સ્કર્ધ અનેક પરમાણુઓનો બનેલો છે, તેથી તેમાંથી પરમાણુ નીકળી જય છે તથા તેમાં આવે પણ છે; પરંતુ આત્મા નિશ્ચિત અસંઘ્યાત પ્રદેશવાળું એક જ દ્રવ્ય છે, તેથી તે પોતાના પ્રદેશોનો નિકાલ કરી શકતો નથી અને અધિક પ્રદેશોને લઈ પણ શકતો નથી.

અને સકળ લોકરૂપી ધરના વિસ્તારથી પરિમિત જેનો નિશ્ચિત નિજવિસ્તાર-સંગ્રહ છે (અર્થાત્ જેનું લોક જેવં નિશ્ચિત માપ છે) તેના (આત્માના) પ્રદેશોના સંકોચ-વિકાસ દ્વારા પણ કાર્યત્વ થઈ શકતું નથી; કારણ કે પ્રદેશોનો સંકોચ-વિસ્તાર હોવા છતાં, સુકેલા-ભીના ચામડાની

માફક નિશ્ચિત નિજ વિસ્તારને લીધે (આત્માને) હીનાધિક કરી શકતું નથી. આ રીતે આત્માને દ્રવ્યકૃપ આત્માનું કર્તૃત્વ થઈ શકતું નથી.

અને વસ્તુસ્વભાવનો સર્વથા અભાવ અશક્ય હોવાથી જ્ઞાયકભાવ શાનસ્વભાવે જ સહા સ્થિત રહે છે અને એ પ્રમાણે સ્થિત રહેતો થકો, જ્ઞાયકત્વ અને કર્તૃત્વમાં અત્યંત વિરોધ હોવાથી, મિથ્યાત્વાદિ ભાવોનો કર્તા થતો નથી; અને મિથ્યાત્વાદિ ભાવો તો થાય છે; તેથી તેમનો કર્તા કર્મ જ છે.

આવી જે વાસના (અભિપ્રાય-જુકાવ) પ્રગટ કરવામાં આવે છે, તે પણ 'આત્મા આત્માને કરે છે' આવી (પૂર્વોક્ત) માન્યતાનો અતિશયતાપૂર્વક ઘાત કરે છે; કારણ કે સહા જ્ઞાયક માનતાં આત્મા અકર્તા જ સિદ્ધ થયો.

તેથી, જ્ઞાયકભાવ સામાન્ય અપેક્ષાએ શાનસ્વભાવમાં અવસ્થિત હોવા છતાં પણ, કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાત્વાદિ ભાવોને જાણતા સમયે, અનાદિકાળથી જોય અને જ્ઞાનના બેદવિજ્ઞાનથી શૂન્ય હોવાથી, પરને આત્માના ડ્રવ્યમાં જાણતો થકો તે (જ્ઞાયકભાવ) વિશેષ અપેક્ષાથી અજ્ઞાનડ્રવ્ય શાનપરિણામ કરે છે; તેથી તેના કર્તૃત્વનો સ્વીકાર કરવો જોઈએ અર્થાત् એમ સ્વીકારવું જોઈએ કે તે કથંચિત્ કર્તા છે; તે પણ ત્યાં સુધી કે જ્યાંસુધી બેદવિજ્ઞાનના પ્રારંભથી માંડીને જોય અને જ્ઞાનનું બેદવિજ્ઞાન પૂર્ણ થતાં આત્માને જ આત્મકૃપે જાણતો તે (જ્ઞાયકભાવ) વિશેષ અપેક્ષાએ પણ શાનડ્રવ્ય શાનપરિણામે પરિણામતો માત્ર જ્ઞાતૃત્વને લીધે સાક્ષાત્ અકર્તા થઈ જતો નથી."

તાત્પર્યવૃત્તિમાં આચાર્ય જ્યસેન પણ આ ગાથાઓનો આવો જ અર્થ કરે છે; છતાં હિંસાદિના સંદર્ભમાં નયવિભાગપૂર્વક કરેલું તેમનું કથન બહુ માર્મિક છે; જે અહીં વાચકોનાં લાભાર્થે આપવામાં આવી રહ્યું છે.

"કોઈ કહે છે કે જીવથી પ્રાણ બિન્ન કે અભિન્ન ? જે અભિન્ન માનીએ તો જ્યારે જીવનો વિનાશ થતો નથી તો પ્રાણોનો પણ વિનાશ નહીં થાય.

આવી સ્થિતિમાં હિંસા કઈ રીતે સંભવે ? અને જે પ્રાણ જીવથી બિજ્ઞ હોય તો પ્રાણોનો નાશ થતાં પણ જીવનું તો કંઈ બગડતું નથી; તેથી આવી સ્થિતિમાં પણ હિંસા ન થઈ.

તેના ઉત્તરમાં આચાર્યદીવ કહે છે કે તમારું આ કથન બરોબર નથી; કારણકે કાયાદિ પ્રાણોની સાથે જીવનો કથંચિત ભેદ છે અને કથંચિત્ અભેદ.

જે રીતે તપેલા લોઢાના ગોળાથી અજિને તે જ સમયે પૃથક કરી શકતી નથી; તેવી જ રીતે વર્તમાન સમયમાં કાયાદિ પ્રાણોથી જીવને પૃથક કરી શકતો નથી; તેથી વ્યવહારનયથી કાયાદિ પ્રાણો જીવથી અભેદ છે; પરંતુ મૃત્યુસમયે કાયાદિ પ્રાણ જીવની સાથે જતા નથી; તેથી નિશ્ચયનયથી કાયાદિ પ્રાણો સાથે જીવનો ભેદ છે.

જે એકાંતે જીવ અને કાયાદિનો ભેદ સ્વીકારવામાં આવે તો જેવી રીતે બીજાની કાયાને છેદતાં-ભેદતાં પોતાને દુઃખ થતું નથી; તેવી જ રીતે પોતાની કાયાને છિજ્ઞ-બિજ્ઞ કરતાં પણ દુઃખ ન થવું નેઈએ; પરંતુ તેમ નથી; કારણ કે આવું માનતાં પ્રત્યક્ષ વિરોધ આવે છે.

પ્રશ્ન:- આમ હોવા છતાં પણ હિંસા તો વ્યવહારથી જ થાય છે, નિશ્ચયથી તો ન થઈ ?

ઉત્તર:- આપ ટીક કહો છો - આ હિંસા વ્યવહારથી જ થાય છે અને પાપ તથા તેના ફળમાં નરકાદિ ગતિના દુઃખોની પ્રાપ્તિ પણ વ્યવહારથી જ થાય છે - આ વાત અમને સ્વીકાર્ય જ છે.

જે તમને નરકાદિના દુઃખો દીછ હોય તો ખૂબ હિંસા કરો અને તેનાથી જે ડર લાગતો હોય તો વ્યવહારહિંસા છોડી દો.

તેથી એમ નિશ્ચિત છે કે જૈનમતમાં સાંખ્યમતની માફક આત્મા એકાંતે અકર્તા નથી; પરંતુ રાગાદિ વિકલ્પરહિત સ્વાનુભૂતિ લક્ષણવાળા ભેદજાનના કાળમાં કર્મોનો કર્તા નથી, શોષકાળમાં કર્મોનો કર્તા છે.”

ઉક્ત સંપૂર્ણ કથનનું તાત્પર્ય આમ છે કે પરમશુદ્ધનિશ્ચયનયથી આત્મા

બધાય કર્મોનો અકર્તા જ છે; તે છતાંથી અશુદ્ધનિશ્ચયનયથી રાગાદિ ભાવકર્મોનો અને અસદ્ભૂતબ્યવહારનયથી દ્રવ્યકર્મો તથા નોકર્મોનો કર્તા પણ છે.

બ્યવહારનયને સર્વથા અસત્યાર્થ માનનારાઓએ આચાર્ય જ્યસેનના ઉકિત સંકેત પર વિશેષ ધ્યાન આપવું જેઈએ.

આ સર્વે ભાવોને ભાવાર્થમાં પંડિત જ્યયંદળ છાબડા આ પ્રમાણે સ્પષ્ટ કરે છે.

‘કેટલાક જૈનમુનિ પણ સ્યાદ્વાદવાણીને બરોબર રીતે ન સમજુને સર્વથા એકાંતનો અભિપ્રાય રાખે છે અને વિવક્ષા બદલીને એમ કહે છે કે ‘આત્મા તો ભાવકર્મનો અકર્તા જ છે, કર્મપ્રકૃતિનો ઉદ્ય જ ભાવકર્મને કરે છે; અજ્ઞાન, શાન, સૂદું, જગવું, સુખ, દુઃખ મિથ્યાત્વ અસંયમ, ચાર ગતિઓમાં ભ્રમણ - આ બધાને તથા જે પણ કંઈ શુભ-અશુભ ભાવ છે, તે બધાને કર્મ જ કરે છે; જીવ તો અકર્તા છે.

વળી તે મુનિ શાસ્ત્રનો પણ આવો જ અર્થ કરે છે કે વેદના ઉદ્યથી સ્ત્રી-પુરુષને વિકાર થાય છે અને ઉપધાત તથા પરધાત પ્રકૃતિના ઉદ્યથી પેરસ્પર ઘાત થાય છે. આમ જેવી રીતે સાંખ્યમતાવલંબી બધાયને પ્રકૃતિનું જ કાર્ય માને છે અને પુરુષને અકર્તા માને છે; તેવી રીતે પોતાની બુદ્ધિના દોષથી આ મુનિઓને પણ આવી જ એકાંતિક માન્યતા થઈ.

નિનવાણી તો સ્યાદ્વાદ્દ્વાપ છે તેથી સર્વથા એકાંત માનનાર તે મુનિઓ ઉપર નિનવાણીનો અવશ્ય કોપ થાય છે.

નિનવાણીના કોપના ભયથી જે તેઓ વિવક્ષા બદલીને આમ કહે કે ભાવકર્મનો કર્તા કર્મ છે અને પોતાના આત્માનો કર્તા આત્મા છે; આમ અમે આત્માને કથંચિત્ કર્તા કહીએ છીએ, તેથી વાણીનો કોપ થતો નથી; તો તેમનું આ કથન પણ મિથ્યા જ છે.

આત્મા દ્રવ્યથી નિત્ય છે, અસંખ્યાતપ્રદેશી છે, લોકપરિમાણ છે,

તેથી તેમાં તો કઈ નવીન કરવાનું નથી; અને જે ભાવકર્મદ્વપ પર્યાયો છે, તેમનો કર્તા તો તે મુનિઓ કર્મને જ કહે છે. તેથી આત્મા તો અકર્તા જ રહ્યો. તો પછી વાણીનો કોપ કઈ રીતે મટી ગયો? તેથી આત્માના કર્તૃત્વ-અકર્તૃત્વની વિવિષાને યથાર્થ માનવું તે જ સ્યાદ્વાદને યથાર્થ માનવું છે.

આત્માના કર્તૃત્વ-અકર્તૃત્વના સંબંધમાં સત્યાર્થ સ્યાદ્વાદ-પ્રદ્વષણ આ પ્રમાણે છે -

આત્મા સામાન્ય અપેક્ષાએ તો જ્ઞાનસ્વભાવમાં જ સ્થિત છે; પરંતુ મિથ્યાત્વાદિ ભાવોને જાણતી વખતે, અનાદિકાળથી જ્ઞેય અને જ્ઞાનના બેદવિજ્ઞાનના અભાવને લીધે, જ્ઞેયદ્વપ મિથ્યાત્વાદિ ભાવોને આત્માદ્વપે જાણે છે. આ પ્રમાણે વિશેષ અપેક્ષાથી અજ્ઞાનદ્વપ જ્ઞાનપરિણામ કરવાથી કર્તા છે; અને જ્યારે બેદવિજ્ઞાન થતાં આત્માને જ આત્માના દ્વપમાં જાણે છે, ત્યારે વિશેષ અપેક્ષાથી પણ જ્ઞાનદ્વપ જ્ઞાનપરિણામમાં જ પરિણમતો થકો, માત્ર જ્ઞાતા રહેવાથી સાક્ષાત્ અકર્તા છે.”

ઉક્ત ગાથાઓ અને ટીકાના ભાવને પૂજ્ય ગુરુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે.

“જુઓ આ ગાથાઓમાં આમ સિદ્ધ કરી રહ્યા છે કે આત્મા સર્વથા અકર્તા નથી, કથંચિત્ કર્તા પણ છે.”^૧

કર્મને લીધે શુભ-અશુભ ભાવ થાય છે, કર્મને લીધે પરધાત થાય છે અને કર્મને લીધે અખ્રલયર્થ થાય છે - આવી એકાંત પ્રદ્વષણા કરનાર, બધા સૂત્રોના અર્થને ન જાણનારા અજ્ઞાની શ્રમણાભાસી છે. જે કર્મને જ વિકારનો કર્તા માને છે, તે જૈનમતી નથી; પરંતુ સાંખ્યમતી છે ભલે, જડકર્મ નિભિત હો; પરંતુ નિભિતના કારણે જીવમાં વિકાર (કાર્ય) થતું નથી.

અહા! આચાર્ય કહે છે કે એકાંતે કર્મપ્રકૃતિના કર્તૃત્વની માન્યતાથી સમસ્ત જીવોને એકાંતે અકર્તાપણું આવી જશે. આમ થતાં ‘જીવ કર્તા છે’ આ શાસ્ત્રના વચ્ચનની વિરાધના થશે.

^૧ પ્રવચનરત્નાકર ભાગ ૬, પાનું ૨૧૦

‘જીવોને કર્મ જ સંસારમાં પરિભ્રમણ કરાવે છે, કર્મ જ હેરાન કરે છે, કર્મ જ વિકાર કરાવે છે, જીવ તો સર્વથા જ અકર્તા છે’ - આવું માનનાર જિનવાણીનો વિરાધક છે.

પોતાની વાતને સિદ્ધ કરવા માટે અજ્ઞાની તર્ક કરે છે કે મિથ્યાત્વ, રાગ-દ્રેષ્ટ, અજ્ઞાન આદિ જેટલા પર્યાયક્રમ વિકારીભાવ છે, તેમને જહકર્મ કરે છે તથા આત્મા તો આત્માને એક દ્રવ્યક્રમે કરે છે. આ રીતે આત્માનું કર્તાપણું પણ આવી જય છે, તેથી આત્માનું કર્તાપણું અને અકર્તાપણું બંનેની સિદ્ધિ થઈ જય છે. તેથી શુતની વિરાધના નહીં થાય.

તેને આચાર્ય કહે છે કે ભાઈ ! આ તારો અભિપ્રાય મિથ્યા જ છે; કારણ કે વિકાળી આત્મદ્રવ્ય તો નિત્ય ધ્રુવ એકક્રમ છે તેમાં કરવાનું જ શું છે ? આત્મા પોતાના આત્મદ્રવ્યસ્વક્રમમાં શું કરે ?

આત્મા પર્યાયથી અનિત્ય છે, પરંતુ દ્રવ્યક્રમે તો અનાદિ-અનંત નિત્ય છે. અહીં અજ્ઞાનીનું કહેવું આમ છે કે અનિત્ય પર્યાયના કર્તા જહકર્મ છે તથા આત્મા આત્માનો દ્રવ્યક્રમે કર્તા છે; પરંતુ અજ્ઞાનીનું આ કથન મિથ્યા છે; કારણ કે જે વિકાળ નિત્ય છે, તેમાં કરવાનું જ શું છે કે જેને દ્રવ્ય કરે ? નિત્યનો કોઈ કર્તા હોતો નથી. જેમાં પર્યાયક્રમ પલટવું થાય, તેમાં કાર્ય થાય છે; પરંતુ જે નિત્ય (ધ્રુવ) છે, તેમાં કરવા જેવું કંઈ હોતું નથી. નિત્યમાં કાર્ય હોઈ જ ન શકે; કારણ કે કર્તૃત્વ અને નિત્યત્વના એકપણામાં પરસ્પર વિરોધ છે અર્થાત્ જે નિત્ય છે, તેમાં કર્તૃત્વ સંભવ નથી અને જ્યારે અનાદિ, અનંત ધ્રુવ એકક્રમ આત્મવસ્તુ પોતે જ દ્રવ્યપણે નિત્ય છે તો તેમાં કર્તાપણું ક્યાંથી આવ્યું ? કેવી રીતે આવી શકે ? તે તો દ્રવ્યક્રમે અહૃતક જ છે. આત્મદ્રવ્ય કોઈનું કરેલું છે - તેમ માનવું મિથ્યા છે.¹

અજ્ઞાનીની આ દલીલ છે કે જ્ઞાયકભાવ તો વિકાળ જ્ઞાનભાવે જ સ્થિત

¹ પ્રવચનરત્નાકર ભાગ ૬, પાનું ૨૧૭-૨૧૮

છે. જ્ઞાયકભાવ અને કર્તાભાવને પરસ્પર અત્યંત વિડ્વત્તા છે. તેથી જ્ઞાયક મિથ્યાત્વાદિ ભાવો ને કરે - એ સંભવ નથી અને મિથ્યાત્વાદિ વિકાર થાય તો છે જ, તેથી એ સ્પષ્ટ જ છે કે મિથ્યાત્વાદિ ભાવોનો કર્તા કર્મ જ છે ?

તેનું સમાધાન કરતાં આચાર્ય અજ્ઞાનીને કહે છે - ભાઈ, તારી આ જે વાસના છે - મિથ્યા ધારણા છે, તે ધારણા - 'આત્મા આત્માનો કર્તા છે' તારા આ અભિપ્રાયનો નાશ કરે છે, કારણે જે જ્ઞાયકભાવને ત્રિકાળ જ્ઞાયક સ્વભાવમાં સ્થિત માનતાં આત્મા અકર્તા જ રહે છે, કોઈપણ અપેક્ષાએ કર્તા સિદ્ધ થતો નથી.

આ રીતે આત્મા દ્રવ્યથી, ક્ષેત્રથી અને ભાવથી કોઈપણ પ્રકારે કર્તા સિદ્ધ થતો નથી અને કાળથી અર્થાત્ પર્યાયથી તો તે અજ્ઞાની સ્વયં પણ કર્તા માનતો નથી. પર્યાયનો કર્તા તો તે કર્મને બતાવે છે. તેથી શ્રુતિના કોપથી બચવાને માટે આત્માને કથંચિત્ કર્તા બતાવે છે; પરંતુ તેની આ ભધી દલીલો મિથ્યા છે. વાસ્તવમાં પર્યાયદિચ્છ જીવ પોતાની પર્યાયમાં થતા રાગાદિ વિકારનો પોતે જ કર્તા છે અને નિજ જ્ઞાયકભાવની દિચ્છ થતાં જ્ઞાનસ્વભાવ પ્રગટ થવાથી તે રાગનો કર્તા નથી, માત્ર જ્ઞાતા છે. આવી વસ્તુસ્થિતિ છે.¹

જુઓ આત્મા દ્રવ્યથી નિત્ય છે, તેથી આત્મા આત્માને કરે છે - આ માન્યતા સિદ્ધ થતી નથી. આત્મા ક્ષેત્રપણે ત્રિકાળ નિયત છે; તેથી આત્માનું ક્ષેત્ર અપેક્ષાએ કર્તૃત્વ સિદ્ધ થતું નથી અને આત્મા ત્રિકાળ જ્ઞાનભાવે જ સ્થિત છે; તેથી કાળ અપેક્ષાએ પણ કર્તૃત્વ સિદ્ધ થતું નથી.

જ્ઞાયક....જ્ઞાયક....જ્ઞાયક - આવો જે એક જ્ઞાયકભાવ - ધૂબસ્વભાવ - સામાન્ય જ્ઞાનસ્વભાવે આત્મા સ્થિત છે એમાં ફેરફાર નથી. અર્થાત્ જ્ઞાયકસ્વભાવી ભગવાન આત્મા ત્રિકાળદ્રવ્યનું નિત્ય છે, ક્ષેત્રનું અસંખ્યાત પ્રદેશી નિત્ય છે અને ભાવથી સામાન્ય એક જ્ઞાયકભાવપણે

¹ પ્રવચન રત્નાકર ભાગ ૮, પાનું ૨૧૮-૨૧૯

નિત્ય છે. આવો એકદ્વારા નિત્ય રહેનારો જ્ઞાયકભાવ હોવાથી તેમાં કંઈપણ કર્તૃત્વ આવતું નથી.^૧

વિશેષ અપેક્ષાએ અર્થાત् ત્રિકાળી દ્વારા-ગુણ-ક્ષેત્ર તો અકર્તા છે જે, તેમાં તો કર્તાપણું છે જ નહીં, વર્તમાન પર્યાયમાં પણ જ્યાં લુચ અંતર્મુખ થઈને જ્ઞાનસ્વભાવે પરિણામે છે, રાગડ્રષે પરિણામતો નથી; ત્યારે સાક્ષાત્ અકર્તા થઈ જય છે.^૨

‘કર્મના કારણે વિકાર થાય છે, કર્મને કારણે અત્યજાતા થાય છે, કર્મક્ષય થતાં જ જ્ઞાનનો વિકાસ થઈ શકે છે. આમ કર્મ જ બધું કરે છે’ – આ માન્યતા જૈનદર્શનની નથી. આ તો અજ્ઞાનીઓની માન્યતા છે; પરંતુ જૈનદર્શનના વ્યાખ્યાનકારો પણ આ વિષયમાં ક્યાંક ક્યાંક ચૂકી જય છે. જ્યારે તેઓ કરણાનુયોગની વ્યાખ્યા કરે છે તો તેની અપેક્ષા અને કથનશૈલીને ધ્યાનમાં ન રાખતાં સર્વથા આમ જ માની લે છે કે વેદકર્મના ઉદ્ઘથી સ્ત્રી-પુરુષોને વિકાર થાય છે તથા ઉપધાત અને પરધાત કર્મપ્રકૃતિના ઉદ્ઘથી પરસ્પર ધાત થાય છે. આમ જે રીતે સાંખ્યમતી બધું પ્રકૃતિનું જ કાર્ય માને છે અને પુરુષને અકર્તા માને છે; તે જ રીતે પોતાની બુદ્ધિના દોષને લીધે અને કથનની અપેક્ષાથી આગાજણા એવા જૈનદર્શનના વ્યાખ્યાનકારો પણ આવા જ એકાંતને માને છે.

આમ માનનારાઓ પર જિનવાણીનો કોપ કેમ ન થાય ? અવશ્ય થશે જ. જિનવાણીના કોપના ભયથી અર્થાત् જિનવાણીની વિરાધનાથી ભયવા માટે જે તેઓ વિવક્ષા બદલીને એવું કહે કે ભાવકર્મોનો કર્તા કર્મ છે અને પોતાના આત્માનો અર્થાત् સ્વયંનો કર્તા આત્મા છે. આમ તો ‘અમે પણ આત્માને કથંચિત્ કર્તા કહીએ છીએ જેથી અમારી પર જિનવાણીનો કોપ ન થાય’ તેમને કહીએ છીએ કે ‘ભાઈ ! તમણે આ કથન પણ મિથ્યા જ છે.’

^૧ પ્રવચન રત્નાકર ભાગ ૮, પાનું ૨૧૬-૨૨૦

^૨ તે જ, પાનું ૨૨૧

જુઓ ! શાસ્ત્ર વાંચીને જેઓ આવો ઉંધો અર્થ કાઢે છે કે પુરુષને સ્ત્રીની સાથે રમણ કરવાનો જે ભાવ આવે છે તેમ જ સ્ત્રીને પુરુષ સાથે રમણ કરવાનો ભાવ આવે છે તે વેદકર્મનું કાર્ય છે; કારણ કે આત્મા તો અકર્તા છે, નિર્દોષ છે અને વેદકર્મ જ સ્ત્રી-પુરુષને વિકારી બનાવે છે; પરંતુ તે તો સાંઘ્યમત છે.

જિનવાણીને સ્યાદ્વાદ્ર્યપ કહી છે, તો તેમાં સ્યાદ્વાદની અપેક્ષા તો આમ છે કે જીવના વિકારી ભાવોનો અજ્ઞાનદશામાં તો જીવ જ કર્તા છે અને સ્વભાવના લક્ષ્યથી જ્ઞાનભાવ પ્રગટ થતાં તે જીવ વિકારનો કર્તા નથી. આમ જિનવાણી તો સ્યાદ્વાદ્ર્યપ છે; પરંતુ તેમ ન માનતાં આત્માને સર્વથા એકાંતે અકર્તા જ માનનાર જિનવાણીના વિરાધક છે.^૧

ધર્મની દ્યા, દાન, પ્રતાદિનો રાગ થાય છે; પરંતુ તે જ સમયે રાગથી બિન્ન ‘હું જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા છું’ - આવું બેદજ્ઞાન પણ અંતરમાં વર્તે છે. તેથી તે રાગ સાથે એકમેક થતો નથી; પરંતુ રાગને તે મૃથક જ જાણે છે, કેવળ તે રાગનો જ્ઞાતા જ રહે છે. આમ જ્ઞાની જ્ઞાનદ્ર્યપ જ્ઞાનપરિણામે પરિણામતો થકો કેવળ જ્ઞાતા રહેવાથી સાક્ષાત્ અકર્તા છે. બસ આનું જ નામ સમકિત છે, ધર્મ છે.

આમ બેદજ્ઞાન થતાં જ્ઞાની વર્તમાન પર્યાયમાં જ્ઞાનદ્ર્યપ જ્ઞાનપરિણામને જ કરતો થકો કેવળ જ્ઞાતા જ રહેવાથી સાક્ષાત્ અકર્તા છે. તે જ સાચો સ્યાદ્વાદ છે.^૨

આ પ્રમાણે આ ગાથાઓમાં વિસ્તારથી યુક્તિસહિત એમ સિદ્ધ કરવામાં આવ્યું છે કે જૈનદર્શનમાં સાંઘ્યમતની માફક આત્માને સર્વથા અકર્તા માન્યો નથી. જૈનદર્શન સ્યાદ્વાદી દર્શન છે અને તે કહે છે કે આત્મા કર્મોનો કથંચિત् કર્તાપણ છે અને કથંચિત् અકર્તા પણ છે.

૧ પ્રવચન રત્નાકર ભાગ ૮, પાનું ૨૨૫-૨૨૬

૨ પ્રવચન રત્નાકર ભાગ ૮, પાનું ૨૨૭

સાંઘ્યમતીઓની માફક જે જૈન શ્રમણ અથવા શ્રાવક આમ કહે છે કે આત્માને જ્ઞાની-અજ્ઞાની અને સુખી-દુઃખી કર્મજ કરે છે; ત્યાંસુધી કે કર્મજ જગાડે-સુવાડે છે અને ચતુર્ગતિમાં પરિભ્રમણ પણ કર્મજ કરાવે છે; આત્મામાં ઉત્પન્ન થનાર હિંસક અને કુશીલની વૃત્તિનો જવાબદાર પણ કર્મ જ છે; તેમને સમજનવતાં અહીં કહેવામાં આવ્યું છે કે આવો એકાંત જૈનદર્શનને સ્વીકાર નથી; કારણ કે જૈનદર્શન અનેકાંતવાદી દર્શન છે. તેથી એ જ બરોબર છે કે આત્મા ઉક્ત સ્થિતિઓનો કથંચિત્ કર્તા છે અને કથંચિત્ અકર્તા.

તો ત્યાં તે કહે છે કે જૈનદર્શન અનેકાંતવાદી છે - આવ્યું તો અમેપણ માનીએ છીએ; પણ તે અનેકાંત આત્મા સ્વયંનો કર્તા છે અને ઉક્ત કિયાઓનો અકર્તા છે - આ પ્રમાણે છે.

અહીં આચાર્ય કહે છે કે સ્વયંના કર્તાનો શો આશય છે ? જે પર્યાયો (ઉક્ત કિયાઓ) ને છોડી દઈએ તો પછી સ્વયંમાં, આત્મવસ્તુમાં દ્રવ્ય (જ્ઞાયકભાવ) ક્ષેત્ર (પ્રદેશ) અને ભાવ (ગુણ) જ બાકી રહે છે. તે બધા ત્રિકળીદ્ધિવ હોય છે; તેથી તેમાં કંઈ કરી શકતું નથી. આવી સ્થિતિમાં આત્મા સ્વયંનો કર્તા છે - આ વાતનો શો અર્થ રહી જય છે ?

હવે તમેજ કહો કે આત્મા સ્વયંનો કર્તા છે ? - આ કથનનો શો આશય છે ? કાર્ય તો પર્યાયક્રમે જ હોય છે; તેથી આત્મા કર્તા છે - આ વાત પણ પર્યાયોના સંદર્ભમાં જ કહેવામાં આવશે અને આત્મા અકર્તા છે - એ પણ પર્યાયોના સંદર્ભમાં જ કહેવામાં આવશે.

તેથી નિર્જર્ખ આમ જ છે કે આત્મા પોતાના શુદ્ધ-અશુદ્ધ દરેક પરિણામનનો કથંચિત્ કર્તા છે અને કથંચિત્ અકર્તા છે.

હવે આગામી કળશમાં ઉક્ત ગાથાઓનો નિર્જર્ખ પ્રસ્તુત કરતાં આચાર્ય અમૃતચંદ્ર જે માર્ગદર્શન કરે છે, જે નિર્ણય આવે છે; તે આ પ્રમાણે છે.

(શાર્ડુલવિક્રીડિત)

માડકર્તારમારી સ્પૃશન્તુ પુરુષ સાંખ્યા ઇવાપ્યહર્તા:
 કર્તારં કલયંતુ તં કિલ સદા ભેદાવબોધાદધઃ ।
 ઊર્ધ્વમ् તૂદ્વતબોધધામનિયતં પ્રત્યક્ષમેનં સ્વયં
 પશ્યન્તુ ચ્યુતકર્તૃભાવમચલં જ્ઞાતારમેકં પરમ ॥૨૦૫॥

(હરિગીત)

જ્યમ સાંખ્યમતી માને - અકર્તા આત્મા છે સર્વથા,
 એકાંતથી માનો નહીં અનુયાયીઓ અહીંતના;
 છે આત્મા કર્તા નિરંતર બેદજ્ઞાન ન જ્યાં લગી,
 આત્મા ન હો કર્તા કદાપિ બેદજ્ઞાન થયા પણી;
 સ્થિત જ્ઞાનધામમહીં સ્વયં પ્રત્યક્ષ આત્મદ્રવ્યને,
 કર્તૃત્વભાવરહિત દેખો અચળ, જ્ઞાતા તેહને. ૨૦૫

હે આહીતમતના અનુયાયી જૈનીઓ ! તમે પણ સાંખ્યમતિઓની જેમ આત્માને અકર્તા ન માનો; બેદજ્ઞાન થયા પહેલા સદાય રાગાદિભાવોનો કર્તા જ માનો અને બેદજ્ઞાન થયા બાદ તેને સદા અચળ, અકર્તા અર્થાત् જ્ઞાતા જ જુઓ.

ઉક્ત કળશનો ભાવ સ્પષ્ટ કરતાં પંડિત જ્યયચંદ્રલુ છાબડા ભાવાર્થમાં લખે છે -

“સાંખ્યમતાવલંબી પુરુષને સર્વથા એકાંતે અકર્તા, શુદ્ધ ઉદ્દાસીન ચૈતન્યમાત્ર જાણે છે. તેમ માનતાં પુરુષને સંસારના અભાવનો પ્રસંગ આવે છે; અને જે પ્રકૃતિને સંસાર માનવામાં આવે તો તે પણ ઘટિત થતું નથી; કારણ કે પ્રકૃતિ જે જડ છે તેને સુખ-દુःખાદિનું સંવેદન નથી, તો તેને સંસાર કેવો ?

આવા અનેક દોષ એકાંત માન્યતામાં આવે છે. સર્વથા એકાંત વસ્તુનું

સ્વરૂપ જ નથી. તેથી સાંખ્યમતી મિથ્યાદાચિ છે; અને જે જૈન પણ આવું માને તો તે પણ મિથ્યાદાચિ છે.

તેથી આચાર્યદ્વારા ઉપદેશ આપે છે કે સાંખ્યમતિઓની માફક જૈનો આત્માને સર્વથા અકર્તાનું માનો; જ્યાંસુધી સ્વ-પરનું ભેદવિજ્ઞાન ન હોય, ત્યાંસુધી તો તેને રાગાદિનો - પોતાના ચેતનરૂપ ભાવકર્માનો-કર્તાનો અને ભેદવિજ્ઞાન થયા બાદ શુદ્ધ વિજ્ઞાનધન, સમસ્ત કર્તૃત્વભાવથી રહિત, એક જ્ઞાતા જ માનો.

આવી રીતે એક જ આત્મામાં કર્તૃત્વ તથા અકર્તૃત્વ - આવા બંને ભાવ વિવક્ષાવશ સિદ્ધ થાય છે. આવો સ્યાદ્વાદ મત જૈનીઓનો છે, અને વસ્તુસ્વભાવ પણ આવો જ છે, કલ્પના નથી. આ (સ્યાદ્વાદાનુસાર) માનતાં પુરુષને સંસાર-મોક્ષાદિની સિદ્ધિ થાય છે અને સર્વથા એકાંત માનવાથી સર્વ નિશ્ચય-વ્યવહારનો લોપ થાય છે."

આ કળણનો ભાવાનુવાદ કવિભર બનારસીદાસજી આ પ્રમાણે કરે છે.

(સરૈયા ઇકતીસા)

જૈસેં સાંખ્યમતી કહેં અલગ અકરતા હૈ,

સર્વથા પ્રકાર કરતા ન હોડી કબર્હીં ।

તૈસેં જિનમતી ગુરુમુખ એક પક્ષ સુનિ,

યાહિ ભાઁતિ માને સૌ એકંત તજૌ અબર્હીં ॥

જીલોં દુરમતી તૌલોં કરમ કૌ કરતા હૈ,

સુમતી સદા અકરતાર કહ્હૌ સબર્હીં ।

જાકે ઘટિ ગ્યાક સુભાડ જગ્યા જવહી સૌં,

સો તૌ જગજાલ સૌં નિરાલૌ ભયૌ તબર્હીં ॥

જે રીતે સાંખ્યમતિ કહે છે કે આત્મા સર્વથા અકર્તાં છે, કોઈપણ અપેક્ષાએ કર્તાં નથી; તે જ રીતે જે જૈનમતી પણ ગુરુમુખથી એક પક્ષ (નય)ની વાત સાંભળીને સાંખ્યોની માફક આત્માને સર્વથા અકર્તાં માનતા હોય તો તેમને તેમની તે માન્યતાને તત્કાળ છોડી દેવી જોઈએ.

વસ્તુસ્થિતિ આમ છે કે જ્યાં સુધી હુર્ગતિ છે, અજ્ઞાન છે; ત્યાં સુધી આત્મા ભાવકર્મોનો કર્તા છે અને જ્યારે સુમતિ જગૃત થઈ જય છે, સમ્યગ્જ્ઞાન થઈ જય છે; ત્યારે તે સદા તે રાગાદિભાવોનો અકર્તા જ રહે છે - આ વાત બધા જ્ઞાનીઓ કહે છે.

અરે ભાઈ ! જેમના હૃદયમાં શાયકભાવ પ્રગટ થઈ જય છે; ત્યારથી તે જગતજળથી નિરાળો થઈ જય છે. તાત્પર્ય એ છે કે સમ્યગ્જ્ઞાન પ્રગટ થઈ જતાં રાગાદિનો કર્તા-ભોક્તા રહેતો નથી, સહજ જ્ઞાતા-દાષ્ટા થઈ જય છે.

આ કળશનો ભાવ પૂજય ગુરુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે - “જ્યાં સુધી એવું ભાન થયું નથી કે હું વિકારથી બિન્ન નિર્મળ નિર્વિકાર શુદ્ધ ચિદાનંદધનસ્વરૂપ આત્મા છું - ત્યાં સુધી આત્મા પોતાના અજ્ઞાનભાવોનો-રાગાદિભાવોનો કર્તા છે. અને જ્યારે પર્યાયમાં થતા વિભાવનું લક્ષ્ય છોડી અંદર ધ્યાનધામ નિજ ચૈતન્ય ભગવાન સન્મુખ દર્શિ કરે છે તો શીધે જ તે કર્તાપણાના ભાવથી રહિત થઈ જ્ઞાતાસ્વરૂપ થઈ જય છે.”^૧

પ્રશ્ન:- તો શું સમકિતીને કહી રાગ થતો જ નથી ?

ઉત્તર:- ના એમ નથી. સમ્યગ્દર્શન થયા બાદ સમકિતીને રાગ થાય છે, પરંતુ એ રાગનો તે જ્ઞાતા-દાષ્ટા જ રહે છે. સમ્યગ્દર્શન થયા બાદ ઉદ્ઘત જ્ઞાનધામ પ્રભુ આત્મા અકર્તા, અચળ, એક અને પરમજ્ઞાતા જ છે. આત્મા જગતના કોઈ પદાર્થની અવસ્થાનો કર્તા તો નથી, પર્યાયમાં જે કર્તા રાગ થાય છે, જ્ઞાની તેનો પણ કર્તા નથી, કેવળ જ્ઞાતા જ છે. આમ રાગથી હટવું અને સ્વમાં વસવું. બસ આનું નામ જ સંવર અને નિર્જરા છે.^૨

જે કે સમ્યગ્દર્શિને અસ્થિરતા-જનિત થોડો રાગ હોય છે, પરંતુ તેનું સ્વામિત્વ ન હોવાથી એ રાગનો પણ તે કર્તા નથી, જ્ઞાતા જ છે.

૧ પ્રવચનરત્નાકર ભાગ ૮, પાનું ૨૩૦

૨ પ્રવચનરત્નાકર ભાગ ૮, પાનું ૨૩૧

આવી રીતે એક જ આત્મામાં કર્તાપણું અને અકર્તાપણું - બંને ભાવ વિવખાવશ સિદ્ધ થાય છે. અજ્ઞાનપણામાં તો વિકારનો કર્તા અને બેદજ્ઞાન થતાં અકર્તા સિદ્ધ થાય છે. આવો સ્યાદ્વાદ મત જૈનોમાં છે અને વસ્તુસ્વભાવ પણ આવો જ છે.

આમ સ્યાદ્વાદ અનુસાર વસ્તુસ્વરૂપ માનવાથી પુરુષને સંસાર અને મોક્ષ સિદ્ધ થાય છે.

અજ્ઞાનભાવથી વિકારનો કર્તા માનવાથી અજ્ઞાની જીવને સંસારની સિદ્ધ થાય છે અને જ્ઞાનભાવથી અકર્તા હોવાથી કેવળ જ્ઞાતાપણું અને મોક્ષદર્શા સિદ્ધ થાય છે. અજ્ઞાનપણામાં જે જીવને અકર્તા માનીએ અને કર્મને કર્તા માનીએ તો સંસાર અને મોક્ષ - કંઈપણ સિદ્ધ નહીં થાય અને નિશ્ચય-વ્યવહાર પણ સિદ્ધ નહીં થાય. ॥૧॥

આ પ્રમાણે તેર ગાથાઓના સારને સમેટી લેતા આ કળશમાં એમ જ કહેવામાં આવ્યું છે કે અરિહંતના અનુયાયી જૈની ભાઈઓ ! સાંઘ્યોની માફક આત્માને તમે સર્વથા અકર્તા ન માનો. અજ્ઞાન અવસ્થામાં આત્માને રાગાદિભાવોનો કર્તા અને બેદજ્ઞાન થતાં, સમ્યગ્જ્ઞાન થતાં તેને રાગાદિભાવોનો અકર્તા, સહજ જ્ઞાતા-દાયા સ્વીકારો.

ઉકિલ તેર ગાથાઓમાં સાંઘ્યમતની માફક રાગાદિભાવોનો સર્વથા અકર્તા માનનારા જૈનીઓનું અજ્ઞાન દૂર કર્યું અને હવે આગામી ચાર ગાથાઓમાં બૌદ્ધમતની માફક આત્માને ક્ષણિક પર્યાય જેટલો માનનારાઓને સમજલવશે. આત્માને સર્વથા અનિત્ય માનવાથી 'જે કર્તા તે ભોક્તા' વાળી વાત ઘટિત થતી નથી. 'કરે અન્ય અને ભોગવે અન્ય' જેવી સમસ્યા ઉલ્લિ થાય છે. અરે ભાઈ ! કરે કોઈ અને ભોગવે કોઈ બીજું - આ તો સરાસર અન્યાય છે. આવું હોતું પણ નથી અને હોવું ન જ જેઈએ.

આગામી ચાર્ચાથાઓની વિષયવસ્તુની સુચના આપવા માટે આચાર્ય અમૃતચંદ્રદેવે આત્મધ્યાત્મિમાં બે કળશ લખ્યા છે; જે આ પ્રમાણે છે -

(मालिनी)

क्षणिकमिदमिहैकः कल्पयित्वात्मतत्त्वं ।

निजमनसि विधत्ते कर्तृभोक्त्रोर्विभेदम् ।

अपहरति विमोहं तस्य नित्यामृतौर्धैः

स्वयमयमभिविंचश्चिच्छमत्कार एव ॥२०६॥

(अनुष्टुप्)

वृत्तयंशभेदतोऽत्यंतं वृत्तिमन्नाशकल्पनात् ।

अन्यः करोति भुक्तेऽन्य इत्येकांतश्चकास्तु मा ॥२०७॥

(हरिगीत)

आ जगतमां को एक तो कल्पी क्षणिक आ आत्मने,
 मनमां करे छे भेद ऐ कर्ता अने भोक्ता विशे;
 धृत्यताङ्गी अमृत ताणा समूहो वडे अभिसिंधीने
 ते भोडने दूरे अहो, चित्यमत्कार स्वयं करे. २०६

वृत्यंशनो बहु भेद देखी नाश वृत्तिमाननो
 अत्यंत थातो ऐवी भिथ्या कल्पना करीने जनो;
 'कोई करे छे अन्य ने वणी अन्य कोई भोगवे'
 एकांत नहीं ऐवो प्रकाशो वस्तुना धर्मो विषे. २०७

आ जगतमां कोई क्षणिकवादी आत्मतत्पने क्षणिक भानीने पोताना
 मनमां कर्ता अने भोक्तानो भेद करे छे. अर्थात् ऐवुं भाने छे के कर्ता अन्य
 अने भोक्ता अन्य. तेमना भोड (अज्ञान)ने आ चैतन्यचमत्कार आत्मा
 स्वयं ४ नित्यताङ्ग अमृतना समूहथी सींचतो थको दूर करे छे.

वृत्यंशो अर्थात् पर्यायोना लेदथी वृत्तिमान द्रव्य सर्वथा न घ थई ज्य
 छे - आवी कल्पना करीने अन्य कर्ता अने अन्य भोक्ता - आवो ओझांत
 प्रकाशित नहीं करो.

ઉક્ત કળશોનો ભાવ પંડિત જ્યયચંદ્ર છાબડા ભાવાર્થમાં આ પ્રમાણે સ્પષ્ટ કરે છે -

“ક્ષણિકવાદી કર્તા-ભોક્તામાં બેદ માને છે અર્થાત્ તેઓ આમ માને છે કે પહેલી ક્ષણમાં જે આત્મા હતો, તે બીજી ક્ષણમાં નથી.

આચાર્યદિવ કહે છે કે અમે તેમને શું સમજલીએ ? તે ચૈતન્ય જ તેમનું અજ્ઞાન દૂર કરશે કે જે (ચૈતન્ય) અનુભવગોચર નિત્ય છે. પહેલી ક્ષણમાં જે આત્મા હતો તે જ બીજી ક્ષણે કહે છે કે ‘હું જે પહેલા હતો તે જ છું’; આવું સ્મરણપૂર્વકનું પ્રત્યબિજ્ઞાન આત્માની નિત્યતા બતાવે છે.

અહીં બૌદ્ધમતી કહે છે કે ‘જે પ્રથમ ક્ષણમાં હતો, તે જ બીજી ક્ષણમાં છે’ આમ માનવું તે તો અનાદિકાળનો અવિદ્યાનો ભ્રમ છે; આ ભ્રમ દૂર થાય તો તત્ત્વ સિદ્ધ થાય અને સમસ્ત કલેષ મટે.

તેનો ઉત્તર આપતાં કહે છે કે ‘હે બૌદ્ધ ! તું જે આ તર્ક કરે છે, તે સંપૂર્ણ તર્કને કરનારો એક જ આત્મા છે કે અનેક આત્મા છે ? વળી તારા સંપૂર્ણ તર્કને એક જ આત્મા સાંભળે છે - આવું માનીને તું તર્ક કરે છે કે સંપૂર્ણ તર્ક પૂર્ણ થતાં સુધી અનેક આત્મા બદલી જય છે - આવું માનીને તર્ક કરે છે ?

જે અનેક આત્મા બદલી જતા હોય તો તારા સંપૂર્ણ તર્કને કોઈ આત્મા સાંભળતો નથી; તો પછી તર્ક કરવાનું શું પ્રયોગજન છે. ?

આમ અનેક પ્રકારે વિચાર કરતાં તને જગાશે કે આત્માને ક્ષણિક માનીને પ્રત્યબિજ્ઞાનને ભ્રમ કહી દેવું તે પયાર્થ નથી. તેથી આમ સમજવું જોઈએ કે આત્માને એકાંતે નિત્ય અથવા એકાંતે અનિત્ય માનવો તે બંને ભ્રમ છે, વસ્તુસ્વરૂપ નથી; અમે (જૈન) વસ્તુનું સ્વરૂપ કથંચિત્ નિત્યનિત્યાત્મક કહીએ છીએ, તે જ સત્ત્યાર્થ છે.

દ્રવ્યની પર્યાયો પ્રતિક્ષણ નાખ થાય છે. તેથી બૌદ્ધ એમ માને છે

કે 'દ્રવ્ય જ સર્વથા નાશ પામે છે' આવી એકાંત માન્યતા મિથ્યા છે. જે પર્યાયવાન પદાર્થનો જ નાશ થઈ જય તો પર્યાય કોના આશ્રયે થશે? આમ બંનેના નાશનો પ્રસંગ આવતાં શૂન્યનો પ્રસંગ આવે છે."

ઉક્ત કળશોમાંથી ૨૦૬નો ભાવાનુવાદ કવિવર બનારસીદાસજી પ્રશ્નોત્તરના રૂપે અનેક છંદોમાં કરે છે; જે આ પ્રમાણે છે.

(દોહા)

પ્રશ્ન : બૌધ છિનકવાદી, કહૈ, છિનભંગુર તન માંહિ ।

પ્રથમ સમય જો જીવ હૈ, દુતિય સમય સો નાંહિ ॥

તાતેં મેરે મતવિષેં, કરૈ કરમ જો કોડ્ઝ ।

સો ન ભોગવૈ સરવથા, ઔર ભોગતા હોડ્ઝ ॥

ક્ષણિકવાદી બૌદ્ધ કહે છે કે આ ક્ષણભંગુર શરીરમાં જે જીવ પહેલા સમયમાં રહે છે, તે જીવ બીજા સમયમાં રહેતો નથી. તેથી ભારા ભતમાં જે કર્મ કરે છે, તે ભોગવતો નથી, બીજું કોઈ ભોગવે છે - આ વાત સર્વથા સત્ય છે.

(દોહા)

ઉત્તર : યહ એકાંત મિથ્યાત પખ, દૂર કરન કૈ કાજ ।

ચિદ્બિલાસ અવિચલ કથા, ભાવૈ શ્રીજિનરાજ ॥

બાલાપન કાહૂ પુરુષ, દેખ્યા પુર એક કોડ્ઝ ।

તરુન ભાએ ફિરિંકે લખ્યો, કહૈ નગર યહ સોડ્ઝ ॥

જો દુહુપન મૈં એક થૈ, તૌ તિનિ સુમિરન કીય ।

ઔર પુરુષ કૌ અનુભવ્યો, ઔર ન જાતેં જીય ॥

જવ યહ વચન પ્રગટ સુન્યો, સુન્યો જૈનમત સુદ્ધ ।

તવ ઇકાંતવાદી પુરુષ, જૈન ભયો પ્રતિબુદ્ધ ॥

આવા એકાંતવાદીના મિથ્યા પક્ષને દૂર કરવા માટે લિનેન્ડ્ર ભગવાન ચૈતન્ય આત્માની નિત્યતા બતાવનાર વાત કહે છે.

કોઈ પુરુષે બચપણમાં કોઈ નગરને જેથું હતું અને ફરી યુવાનીમાં એ જ નગરને જેતાં તે કહે છે કે આ તે જ નગર છે, જેને મેં બચપણમાં જેથું હતું.

બંને અવસ્થાઓમાં પુરુષ એક જ હતો, એટલે તો તેને આમ સમરણ થયું; કોઈ અન્ય પુરુષના અનુભવને કોઈ અન્ય પુરુષ કેમ વ્યક્ત કરી શકે?

ઉક્ત કથનથી જૈનમતની સચોટતા તે એકાંતવાદીને ધ્યાનમાં આવી ગઈ અને તે પણ પ્રતિબુદ્ધ થઈ ગયો, તેને પણ જૈનમત સ્વીકૃત થઈ ગયો.

બચપણ અને યુવાનીમાં કોઈ નગરને જેઈને પ્રત્યબિજ્ઞાન થવાનું ઉદાહરણ પાડે રાજમલળાએ આત્માની નિત્યતા સમજાવવા માટે કળણ ટીકામાં આપ્યું છે. તેમના જ અનુકરણમાં કવિવર બનારસીદાસલાએ અહીં તે જ ઉદાહરણનો પ્રયોગ કર્યો છે.

કવિવર બનારસીદાસજ ૨૦૭મા કળશનો ભાવાનુવાદ આ પ્રમાણે કરે છે.

(સવૈયા ઇકતીસા)

એક પરજાડ એક સમૈ મૈં વિનસિ જા

દૂઝી પરજાડ દૂઝૈ સમૈ ઉપજતિ હૈ ।

તાકૌ છલ પકરિ કેં બૌધ કહૈ સમૈ સમૈ,

નવૌ જીવ ઉપજૈ પુરાતન કી છતિ હૈ ॥

તાતે માને કરમ કૌ કરતા હૈ ઔર જીવ,

ભોગતા હૈ ઔર વાકે હિએ એસી મતિ હૈ ।

પરજૌ પ્રવાંન કૌં સરવથા દરબ જાનેં,

એસે દુરબુદ્ધિ કૌં અવસિ દુરગતિ હૈ ॥

એક પર્યાય એક સમયમાં નાણ થઈ જથું છે અને બીજી પર્યાય બીજાલ સમયમાં ઉત્પન્ન થાય છે. - તેના આધારે બૌદ્ધ કહે છે કે જીવ પ્રતિસમયે નવો ઉત્પન્ન થાય છે અને જુનો નાણ થઈ જથું છે. તે જ આધારે તેઓ

કહે છે કે કર્માનો કર્તા અન્ય જીવ છે અને કર્માનો ભોક્તા અન્ય જીવ છે. તેમના હૃદયમાં આ વાત જરૂરી ગઈ છે; તેઓ દ્રવ્યને પર્યાયપ્રમાણ જ માને છે, પર્યાય જેટલો માને છે. જેમની આવી દુર્ભુદ્ધિ છે તેઓ અવશ્ય દુર્ગતિને પ્રાપ્ત થશે.

અહીં એક પ્રશ્ન સંબંધે છે કે જે આપને કોઈની વાત ન પસંદ આવે તો ન માનો; પણ કોઈને દુર્ભુદ્ધિ કહેવો, દુર્ગતિમાં જનાર બતાવવો તે તો સારી વાત નથી.

અરે ભાઈ ! અહીં કોઈ વ્યક્તિ પરના દ્રેષ્ણને લીધે તેને દુર્ભુદ્ધિ કહેવામાં આવ્યો નથી, પરંતુ એ તો આ તથયનું ઉદ્ઘાટન છે, જેના કારણે સર્વર્થા કણિક માનનાર દુર્ગતિને પ્રાપ્ત થાય છે.

પ્રશ્ન : એવું કયું તથય છે, એવી કઈ દુર્ભુદ્ધિ છે કે જેના કારણે સર્વર્થા કણિક માનનારો દુર્ગતિને પ્રાપ્ત થાય છે ?

ઉત્તર : તેની માન્યતા અનુસાર પ્રત્યેક આત્મા પ્રતિપળ નાશ પામવાના કારણે તેને આમ માનવું અનિવાર્ય થઈ જય છે કે જે કરે છે, તેને બોગવવું પડતું નથી; કારણકે તે તો કરવાની સાથે પોતે જ નાશ પામી જય છે.

આવી સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ પાપકાર્યો કરતાં કેમ હરે; કારણ કે તેને તેનું ફળ તો મળવાનું નથી. તેવી જ રીતે પુણ્યકાર્યોમાં પણ ઉત્સાહિત કેમ થાય; કારણ કે તેનો લાભ પણ તેને મળવાનો નથી. આ પ્રમાણે તે નિરંતર બોગોમાં જ મસ્ત રહેશે, પાપકાર્યોમાં જ વ્યસ્ત રહેશે, અને તે કારણે દુર્ગતિને પણ પ્રાપ્ત થશે તેની દુર્ગતિગમનની વાત કહીને કવિવર બનારસીદાસજીએ તે જ તથય તરફ આપણું ધ્યાન આકર્ષિત કર્યું છે.

તે બાદ બનારસીદાસજી દુર્ભુદ્ધિનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં બે દોહા અને બે સવૈયા એકતીસા-આમ કુલ ચાર બીજા છંદ પણ લખે છે; જે મૂળથી

અભ્યાસ કરવા યોગ્ય છે. આત્મઘ્યાતિમાં તે પ્રકારના ભાવને પોષતા એવા કોઈ છંદ નથી તેથી અહીં આપવામાં આવતા નથી.

આ કળશોનો ભાવ પૂજય ગુરુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે. “જુઓ, અજાનીને પોતાના વિકાળી સ્વરૂપની ખબર નથી. તે કારણે તે વર્તમાન પર્યાયને જ આત્મા માને છે. ક્ષણ-ક્ષણમાં જે પર્યાય બદલાય છે, તેને જ તે આત્મા માને છે. વર્તમાનમાં જે આત્મા છે તે આગલી ક્ષણમાં રહેતો નથી. પ્રત્યેક ક્ષણે નવીન-નવીન આત્માનો જન્મ માનનારો બૌદ્ધમતી કર્તા-ભોક્તામાં બેદ માને છે. જે લુચ કર્મ કરે છે, તે તેને ભોગવવાના સમયે રહેતો નથી. તેથી કર્તા કોઈ છે અને ભોગવનારો કોઈ બીજે જ છે.

આચાર્ય કહે છે - તેમને કોણ સમજાવે ? નિત્ય અનુભવગોચર ચેતન આત્મા જ તેના ભ્રમને દૂર કરી શકે છે. પ્રતિસમયે પલટતો થકો પણ ચૈતન્ય સ્વાનુભવમાં નિત્ય આવે છે. તે અનુભવ જ તે અજાનને મટાડી શકે છે. અજાનીને વસ્તુના નિત્ય અને અનિત્ય વિભાગની ખબર નથી. તે કારણે ભાંતિ છે. નિરંતર અનુભવમાં આવતો ચૈતન્ય જ તેના આ અજાનને દૂર કરશે.

કાલની વાત આજે યાદ આવે છે ને ? તેથી જ સિદ્ધ છે કે યાદ કરનાર આત્મદ્રવ્ય નિત્ય છે. ભાઈ ! વિકાળી દ્રવ્યની સિદ્ધિ દર્શિ વગર થતી નથી. સ્મરણાપૂર્વક થયેલું પ્રત્યબિજ્ઞાન આત્માની નિત્યતાને સિદ્ધ કરે છે.^૧

પૂર્વે બાળક અવસ્થા હતી, વર્તમાનમાં યુવાની છે અને ભવિષ્યમાં વૃદ્ધાવસ્થા થશે. આ ત્રણે અવસ્થાઓનું જ્ઞાન વિકાળી એક આત્મદ્રવ્યને થાય છે. આ વિકાળી દ્રવ્યની દર્શિ કરતાં સમ્યગુર્દર્શન થાય છે. વિકાળીની દર્શિ કરનાર તો પર્યાય છે, પરંતુ તે દર્શિની પર્યાયનો વિષય વિકાળી નિત્ય પ્રભુ આત્મા છે.^૨

^૧ પ્રવચનરણાકર ભાગ ૬, પાનું ૨૩૬-૨૩૭

^૨ તે જ, પાનું ૨૩૭

અને જે તું એમ કહેશે કે આત્મા તો નષ્ટ થઈ જય છે, પરંતુ તે પોતાના સંસ્કારને છોડી જય છે તો તે પણ યથાર્થ નથી; કારણ કે જે આત્મા નષ્ટ થઈ ગયો તો તેના આધાર વિના સંસ્કાર કેમ અને ક્યાં રહે છે? એક આત્મા જે સંસ્કારને છોડે, તે સંસ્કાર બીજી આત્મામાં પડતા જય, તે કેમ સંબલ છે? આ વાત કંઈ જમતી નથી, ન્યાયસંગત પણ નથી.

બાપ્યુ! તું આત્માને પર્યાયમાત્ર ક્ષણિક માને છે; પરંતુ જૈનમતમાં તો આવી માન્યતાવાળાને પર્યાયમૂઢ કહ્યા છે. એક સમયની દર્શાની પાછળ જે ત્રિકાળી સંપૂર્ણ નિત્યાનંદ-ચિદાનંદ પ્રભુ આત્મા વસી રહ્યો છે, તેની દર્શિ કર્યા વિના જે પર્યાયની રૂચિમાં પડ્યો છે, તે મૂઢ મિથ્યાદર્શિ છે. જે માત્ર વર્તમાનજ્ઞાનની દર્શામાં રૂચિ કરીને રહે છે, તે પર્યાયમૂઢ મિથ્યાદર્શિ છે.^૧

આ પ્રમાણે આત્માને એકાંતે નિત્ય જ કે અનિત્ય જ માનવો તે મિથ્યાભ્રમ છે. અહા! સ્વયં ત્રિકાળી ધૃવ ચિત્તચમત્કારદ્વારા નિત્ય દ્રવ્ય છે અને તેની પલટતી અવસ્થા અનિત્ય પર્યાય છે. તેથી દ્રવ્યસ્વરૂપે નિત્ય અને પર્યાયસ્વરૂપે અનિત્ય આવા કથાંચિત્ત નિત્યાનિત્યાત્મક વસ્તુસ્વરૂપને જાણીને નિત્યની દર્શિ કરીને સમકિતિવંત થવાય.^૨

વૃત્તિ અંશ અર્થાત્ પર્યાયનો બેદ, જેમકે સોનાનો કડો, કુંડળદ્વારા પર્યાયો. તેવી જ રીતે આત્મા એક નિત્ય દ્રવ્ય છે; જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ તેના ગુણ છે; તે ગુણ પણ નિત્ય છે, તેની પલટતી અવસ્થાઓ તે પર્યાયો છે. તેમાં બૌદ્ધમતી એકાંતથી માત્ર પર્યાયોને જ આત્મા કહે છે. અજ્ઞાનીની પણ અનાદિકાળથી પર્યાયો પર જ દર્શિ છે. તેથી બૌદ્ધમતીની માફક એવા જૈનમતી પણ મૂઢ છે, મિથ્યાદર્શિ છે.^૩

જે જીવ વર્તમાન પર્યાયમાં રાગ-ક્રેષ કરે છે, તે જ જીવ ભવિષ્યમાં

^૧ પ્રવચનરત્નાકર ભાગ ૮, પાનું ૨૩૭-૨૩૮

^૨ તે જ, પાનું ૨૩૮

^૩ પ્રવચનરત્નાકર ભાગ ૮, પાનું ૨૩૯

તેનું ફળ ભોગવે છે. પાપના પરિણામ કરનારી એક અવસ્થા છે અને તે પાપનું ફળ ભોગવનારી બીજી અવસ્થા છે; પરંતુ તે બને પર્યાયોમાં વિદ્યમાન દ્રવ્ય (આત્મા) તો તેનો તે જ છે. પર્યાયો બિજ્ઞ-બિજ્ઞ છે; પરંતુ દ્રવ્ય તો એક જ છે. ભાઈ ! વૃત્તિમાન દ્રવ્ય તો વિકાળી નિત્ય છે. તેથી જે આત્મા વર્તમાન પર્યાયમાં પાપ કરે છે; તે જ આત્મા આગામી પર્યાયમાં તેનું ફળ ભોગવે છે.^૧

તાત્પર્ય એ છે કે પર્યાયનો નાશ થતાં આત્મદ્રવ્યનો જ નાશ માનવો તે તો બૌદ્ધમતની મિથ્યા કલ્પના છે; કારણ કે જે અવસ્થાવાન દ્રવ્યનો નાશ થઈ જય તો પછી અવસ્થા કોના આશ્રયે થાય ? ક્ષણેક્ષણે જે નવીન અવસ્થાઓ થાય છે તેમનો આધાર તો નિત્ય દ્રવ્ય જ છે. તેથી આવી માન્યતાથી તો દ્રવ્યના જ નાશનો પ્રસંગ આવશે. શૂન્યતાનો પ્રસંગ આવી જશે. તેથી તેમ માનવું સર્વથા મિથ્યા છે.^૨

આપ્રમાણે આ કળશોમાં એમ જ કહેવામાં આવ્યું છે કે હે જૈનીઓ ! બૌદ્ધોની માફક આત્માને ક્ષણિક, પર્યાય જેટલો જ માનીને અને ‘કરે અન્ય અને ભોગે અન્ય’ ની માન્યતાથી ગ્રસ્ત થઈને સ્વચંદ્તાથી અનર્ગંલ પ્રવર્તન નહીં કરો, અન્યથા ચાર ગતિ અને ચોરાશી લાખ યોનિઓમાં પરિભ્રમણ કરવું પડશે. સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે નિત્ય આત્માનો અનુભવ અથવા આત્માની નિત્યતાનો અનુભવ જ ઉક્ત માન્યતાને સમાપ્ત કરશે. તેથી પ્રત્યબિજ્ઞાનના હેતુભૂત આત્માની નિત્યતાનો નિત્ય અનુભવ કરો.



૧ તે જ, પાનું ૨૪૦

૨ પ્રવચનરત્નાકર ભાગ ૮, પાનું ૨૪૧

સમયસાર ગાથા ૩૪૫-૩૪૮

જે વાત પાછળના બે કળશોમાં કહેવામાં આવી છે, હવે તે જ વાતને આગામી ચાર ગાથાઓમાં કહે છે; જે આ પ્રમાણે છે.

કેહિંચિ દુ પજ્જએહિં વિણસ્સએ ણેવ કેહિંચિ દુ જીવો ।

જમ્હા તમ્હા કુબ્વદ્ધિ સો વા અણણો વ ણેયંતો ॥૩૪૫॥

કેહિંચિ દુ પજ્જએહિં વિણસ્સએ ણેવ કેહિંચિ દુ જીવો ।

જમ્હા તમ્હા વેદદ્વિ સો વા અણણો વ ણેયંતો ॥૩૪૬॥

જો ચેવ કુણદિ સો ચિય ણ વેદએ જસ્સ એસ સિદ્ધંતો ।

સો જીવો ણાદબ્વો મિચ્છાદિઙ્ગી અણારિહદો ॥૩૪૭॥

અણણો કરેદિ અણણો પરિભુંજદિ જસ્સ એસ સિદ્ધંતો ।

સો જીવો ણાદબ્વો મિચ્છાદિઙ્ગી અણારિહદો ॥૩૪૮॥

(હરિગીત)

પર્યાય કંઈકથી વિગુસે જીવ, કંઈકથી નહિ વિગુસે,
તેથી કરે છે તે જ કે બીજો - નહીં એકાંત છે. ૩૪૫

પર્યાય કંઈકથી વિગુસે જીવ, કંઈકથી નહિ વિગુસે,
જીવ તેથી વેદે તે જ કે બીજો - નહીં એકાંત છે. ૩૪૬

જીવ જે કરે તે ભોગવે નહિ - જેહનો સિદ્ધાંત અંત,
તે જીવ મિથ્યાદાષ્ટિ છે, અર્હતના મતનો નથી. ૩૪૭

જીવ જે કરે તે ભોગવે નહિ - જેહનો સિદ્ધાંત અંત,
તે જીવ મિથ્યાદાષ્ટિ છે, અર્હતના મતનો નથી. ૩૪૮

કારણ કે જીવ કેટલીક પર્યાયોથી નાશ પામે છે અને કેટલીક પર્યાયોથી નાશ પામતો નથી, તેથી જે ભોગવે છે, તે જ કરે છે અથવથા બીજે જ કરે છે - એવો એકાંત નથી.

કારણ કે જીવ કેટલીક પર્યાયોથી નાશ પામે છે અને કેટલીક પર્યાયોથી નાશ પામતો નથી, તેથી જે કરે છે, તે જ ભોગવે છે અથવા બીજે જ ભોગવે છે - એવો એકાંત નથી.

જે કરે છે તે ભોગવતો નથી - આવો જેનો સિદ્ધાંત છે; તે જીવ મિથ્યાદાચિ છે અને અરિહંતના મતની બહાર છે, અનાહૃત મતવાળો છે - એમ જાણવું જોઈએ.

બીજે કરે છે અને બીજે ભોગવે છે એવો જેનો સિદ્ધાંત છે; તે જીવ મિથ્યાદાચિ છે અને અરિહંતના મતની બહાર છે. અનાહૃત મતવાળો છે - એમ જાણવું જોઈએ.

ઉક્ત ચાર ગાથાઓનું તાત્પર્ય એ છે કે જે કરે છે; તે જ ભોગવે છે - આવો એકાંત પણ નથી અને જે કરે છે; તે ભોગવતો નથી, - આવો પણ એકાંત નથી. તે જ રીતે જે ભોગવે છે; તે જ કરે છે - આવો એકાંત પણ નથી અને જે ભોગવે છે; તે કરતો નથી, બીજે જ કરે છે - આવો પણ એકાંત નથી.

આ પ્રમાણે આ ગાથાઓમાં ચાર પ્રકારે એકાંતોનો નિષેધ કરીને કર્તા-ભોક્તા સંબંધી અનેકાંતની સ્થાપના કરવામાં આવી છે.

આ ગાથાઓનો ભાવ આત્મભ્યાતિમાં આ પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવ્યો છે.

'જીવ, પ્રતિસમયે થતા અગુરુલઘુગુણના પરિણામ દ્વારા ક્ષાણિક હોવાથી અને અચલિત ચૈતન્યના અન્વયગુણ દ્વારા નિત્ય હોવાથી કેટલીક પર્યાયોથી વિનાશ પામે છે અને કેટલીક પર્યાયોથી વિનાશ પામતો નથી. આ પ્રમાણે જીવ બે સ્વભાવવાળો છે. તેથી જે કરે છે તે જ ભોગવે છે અથવા બીજે જ ભોગવે છે અને જે ભોગવે છે તે જ કરે છે અથવા બીજે જ કરે છે - આવો એકાંત નથી.'

આમ અનેકાંત હોવા છતાં પણ જે પર્યાય તે સમયે છે, તે જ પરમાર્થ વસ્તુ છે; આ પ્રમાણે વસ્તુના અંશમાં પૂર્ણની માન્યતા કરીને શુદ્ધનયના લોભથી ઋજુસૂત્રનયના એકાંતમાં રહીને જે એમ માને છે કે જે કરે છે, તે ભોગવતો નથી; બીજે કરે છે અને બીજે ભોગવે છે; તેને મિથ્યાદચ્છિ જ સમજન્યો જોઈએ; કારળ કે પર્યાયોમાં ક્ષણિકપણું હોવા છતાં પણ પર્યાયી આત્મા અંતરંગમાં નિત્ય જ ભાસિત થાય છે.”

પ્રશ્ન:- પર્યાયો તો પ્રતિસમયે નાખ જ થાય છે. અહીં એમ શા માટે કહેવામાં આવી રહ્યું છે કે કેટલીક પર્યાયોથી નાખ થાય છે અને કેટલીક પર્યાયોથી નાખ થતો નથી ?

ઉત્તર:- અરે ભાઈ ! પર્યાયો બે પ્રકારની હોય છે - (૧) સહભાવી પર્યાય અને (૨) ક્રમભાવી પર્યાય. ગુણોને સહભાવી પર્યાય કહે છે અને તેમાં થનાર પરિણમનને ક્રમભાવી પર્યાય કહે છે. ઉક્ત કથનમાં જે નાખ ન થવાની વાત કહેવામાં આવી છે, તે સહભાવી પર્યાયો અર્થાત् ગુણોના અર્થમાં કહેવામાં આવી છે. તાત્પર્ય આમ છે કે પરિણમનની દચ્છિથી જોઈએ તો દ્રવ્ય પ્રતિસમય નાખ થાય છે અને અનાદિ-અનંત ત્રિકાળી ગુણોની દચ્છિથી જોઈએ તો નાખ થતો નથી.

કેટલીક પર્યાયોથી નાખ થાય છે નો આશય - પર્યાયદચ્છિથી જેતાં નાખ થાય છે - એમ છે.

આચાર્ય જ્યસેન તાત્પર્યવૃત્તિકામાં આ ગાથાઓના ભાવને દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય લગાવીને દેવાદિ પર્યાયો પર ઘાટિત કરીને સ્પષ્ટ કરે છે.

આરંભિક બે ગાથાઓનું શાબ્દિક સ્વરૂપ સ્પષ્ટ કર્યા બાદ કિંચ કરીને તેઓ નિષ્કર્ષને પ્રસ્તુત કરે છે - “દ્રવ્યાર્થિકનયથી જે જીવ મનુષ્યભવમાં શુભાશુભ કર્મ કરે છે, તે જ જીવ સ્વર્ગમાં અથવા નરકમાં તે કર્મોનું ફળ ભોગવે છે અને પર્યાયાર્થિકનયથી તે જ બવની અપેક્ષાએ બાળપણમાં કરેલા

કર્મએનું ફળ યૌવનાદિ અન્ય પર્યાયમાં ભોગવે છે. અતિસંક્ષેપમાં કહીએ તો અર્થાત્ મૂર્હર્ત પછી ભોગવે છે. ભવાંતરની અપેક્ષા મનુષ્યપર્યાયમાં કરેલું કર્મ દેવપર્યાયમાં ભોગવે છે.”

ખરેખર તો વાત આમ છે કે એક જીવ મરીને સ્વર્ગમાં ગયો. તેણે જે પૂજ્યકર્મ અહીં કર્યા હતા, તેમનું ફળ તે સ્વર્ગમાં ભોગવી રહ્યો છે. દ્રવ્યાધિકન્યથી જે જીવ મનુષ્ય હતો, તે જ હવે દેવ છે; તેથી જેણે કર્યું હતું તે જ ભોગવી રહ્યો છે - તે બરાબર જ છે. તે જ વાતને પર્યાયાધિકન્યથી લેઈએ તો મનુષ્ય અને દેવ પર્યાય બિજ્ઞ-બિજ્ઞ હોવાથી, કર્યું છે મનુષ્યે અને ભોગવી રહ્યો છે દેવ; આ પ્રમાણે કર્યું કોઈએ અને ભોગવી રહ્યો છે કોઈ બીજે. તેથી એમ કહેવાય છે કે દ્રવ્યાધિકન્યથી જે કરે છે તે જ ભોગવે છે અને પર્યાયાધિકન્યથી અન્ય કરે છે અને તેને અન્ય કોઈ ભોગવે છે.

આ વિષયને પંડિત જયચંદ્ર છાબડા ભાવાર્થમાં આ પ્રમાણે સ્પષ્ટ કરે છે -

“વस્તુનો સ્વભાવ જિનવાણીમાં દ્રવ્યપર્યાયસ્વરૂપ કહ્યો છે; તેથી સ્યાદ્વાદથી આવો અનેકાંત સિદ્ધ થાય છે કે પર્યાય-અપેક્ષાએ તો વસ્તુ ક્ષણિક છે અને દ્રવ્ય-અપેક્ષાએ નિત્ય છે. જીવ પણ વસ્તુ હોવાથી દ્રવ્યપર્યાયસ્વરૂપ છે. તેથી પર્યાયદિષ્ટાએ જેવામાં આવે તો કાર્ય કરે છે એક પર્યાય અને ભોગવે છે બીજુ પર્યાય. જેમ મનુષ્યપર્યાયે શુભાશુભ કર્મ કર્યા અને તેનું ફળ દેવાદિપર્યાયે ભોગવ્યું. જે દ્રવ્યદિષ્ટથી જેવામાં આવે તો જ કરે છે, તે જ ભોગવે છે; જેમકે મનુષ્યપર્યાયમાં જે જીવદ્રવ્યે શુભાશુભ કર્મ કર્યા, તે જ જીવદ્રવ્યે દેવાદિ પર્યાયમાં પોતે કરેલા કર્મના ફળને ભોગવ્યા.

આ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ અનેકાંતરૂપ સિદ્ધ થવા છતાં પણ, જે જીવ શુદ્ધનયને સમજ્યા વિના શુદ્ધનયના લોભથી વસ્તુના એક અંશને (વર્તમાનકાળમાં વર્તતી પર્યાયને) જ વસ્તુ માનીને અજુસૂત્રનયના વિષયનો

એકાંત પકડીને એમ માને છે કે જે કરે છે, તે જ ભોગવતો નથી - અન્ય ભોગવે છે અને જે ભોગવે છે, તે જ કરતો નથી - અન્ય કરે છે, તે જીવ મિથ્યાદાચિ છે, અરિહંતના મતનો નથી; કારણ કે પર્યાયોનું ક્ષણિકત્વ હોવા છતાં પણ, દ્રવ્યકૃપ ચૈતન્યચમત્કાર તો અનુભવગોચર નિત્ય છે; પ્રત્યબિજ્ઞાનથી જણાય છે કે 'જે હું બાલ્ય અવસ્થામાં હતો, તે જ હું યુવાન અવસ્થામાં હતો અને વૃદ્ધાવસ્થામાં પણ હું તે જ છું.' આ પ્રમાણે જે કથંચિત્ નિત્યકૃપથી અનુભવગોચર છે - સ્વસંવેહનમાં આવે છે અને જેને કિનવાણી પણ એમ જ કહે છે, તેને જે માનતો નથી, તે મિથ્યાદાચિ છે - આમ સમજવું જોઈએ.^૧

આ ગાથાઓનો ભાવ પૂજય ગુરુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે - "પર્યાય અપેક્ષાએ જોઈએ તો કાર્ય કરે એક પર્યાય અને ભોગવે છે અન્ય પર્યાય તથા દ્રવ્ય અપેક્ષાએ જે દ્રવ્ય ભોગવે છે, તે જ કરે છે - આવો અનેકાંત છે.^૨

શુદ્ધનયના લોભથી ઋજુસૂત્રનયના એકાંતમાં રહીને જે એમ માને છે કે જે કરે છે, તે ભોગવતો નથી. કરે છે કોઈ બીજે અને ભોગવે છે કોઈ બીજે જ, તે જીવ મિથ્યાદાચિ જ છે. એક સમયની અવસ્થા જે બીજી સમયમાં રહે તો શુદ્ધનયનો નાશ થઈ જાય. તેમાં કાળની ઉપાધિ લાગતાં જ અશુદ્ધ આવી જાય - આમ માનીને જે એક સમયના અંશમાં જ સંપૂર્ણ વસ્તુ (દ્રવ્ય) માને છે તે જીવ મિથ્યાદાચિ છે.^૩

જે કે કરનારી પર્યાયો અને ભોગવનારી પર્યાયો બિજ્ઞ-બિજ્ઞ છે, અન્ય-અન્ય છે; છતાં પણ દ્રવ્ય તો બંનેનું એક જ છે, દ્રવ્ય તો અન્ય-અન્ય નથી. વર્તમાન પર્યાયમાં જે આત્મદ્રવ્યે રાગ કર્યો, આગામી પર્યાયમાં તે જ આત્મદ્રવ્ય અનું ફળ ભોગવે છે. તેથી 'અન્ય કરે છે અને અન્ય ભોગવે છે' - આવી એકાંત માન્યતા મિથ્યા છે.

૧ પ્રવચનરત્નાકર ભાગ ૬, પાનું ૨૪૬-૨૪૭

૨ પ્રવચનરત્નાકર ભાગ ૬, પાનું ૨૪૭

ભાઈ ! સમ્યગ્દર્શનની પર્યાય ભલે એક સમયની છે, ક્ષણિક છે; પરંતુ તેનો વિષય ત્રિકાળી ધૂવ નિત્યાનંદ પ્રભુ છે. જે આવા નિત્ય ધૂવ ચૈતન્યતત્ત્વને સ્વીકારતો નથી, તેને સમકિત કેવી રીતે થઈ શકે ?

અરે ભાઈ ! તારી અવસ્થામાં ક્ષણે ક્ષણે જે બદલી થાય છે, તે પણ તું નથી. તું તો ત્રિકાળી આનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે. પોતાના આવા સ્વરૂપને દર્શિમાં લે, તેમાં જ લીન થઈ જ, આમ કરવાથી શાંતિ અને આનંદ પ્રગટ થશે, તે જ સદાચરણ છે. અંદરમાં સત્તા-ત્રિકાળી પ્રભુ છે, તે ઝપ આચરણ, તે જ સદાચરણ છે. બાકી તો બધા સંસારના જ હેતુ છે.^૧

એક મોટો રાજ છે, તેણે અધિકારના-સત્તાના નશામાં અનેક ઘોર પાપ કરી નાખ્યા અને તેના ફળમાં મરીને નરકે ગયો; ત્યાં અસીમ દુઃખ બોગવ્યા. તેણે મનુષ્ય પર્યાયના પાપોનું ફળ નરકમાં જઈને બોગવ્યું. તથા કોઈ દ્યાળું તત્ત્વજ્ઞાની પુરુષે દ્યા દાન બકિત આહિના ભાવોથી પુણ્યબંધ કર્યો. તે મરીને સ્વર્ગમાં ગયો, ત્યાં તેણે મનુષ્યપર્યાયમાં કરેલા પુણ્યનું ફળ દેવગતિમાં બોગવ્યું.

આ પ્રમાણે મનુષ્ય પર્યાયમાં કરેલા પુણ્ય-પાપને સ્વર્ગ અને નરકમાં બોગવે છે. આ રીતે પર્યાયદર્શિથી જોઈએ તો કાર્યને કરે એક પર્યાય અને બોગવે બીજી પર્યાય.

પરંતુ દ્રવ્યદર્શિથી જોઈએ તો જે કરે છે તે જ બોગવે છે. મનુષ્યપર્યાયમાં જીવદ્રવ્ય જે શુભ અથવા અશુભ કાર્ય કરે છે તેનું ફળ પણ તે જ જીવ સ્વર્ગ અથવા નરકમાં જઈને સુખ-દુઃખને બોગવે છે. આ રીતે દ્રવ્યની અપેક્ષાએ જે કર્તા છે, તે જ બોક્તા છે. પર્યાય અપેક્ષા અન્ય-અન્ય પર્યાયો કર્તા અને બોક્તા છે - આવો અનેકાંત છે.^૨

પ્રશ્ન:- તે ફળને દ્રવ્ય તો બોગવતું નથી ને ?

૧ પ્રવચનરત્નાકર ભાગ ૬, પાનું ૨૪૮

૨ પ્રવચનરત્નાકર ભાગ ૬, પાનું ૨૪૬-૨૪૮

ઉત્તરઃ- અહીં એ વાત નથી કે દ્રવ્ય કર્તા-ભોક્તા છે કે નહીં. અહીં તો પર્યાયોમાં દ્રવ્ય અન્વયદ્વારા રહે છે - આમ દ્રવ્ય અને પર્યાયને સિદ્ધ કરવા છે. તેથી કહ્યું છે કે પર્યાય અપેક્ષા જે પર્યાય કરે છે તે જ ભોગવતી નથી. તેની પાછળ થનાર અન્ય પર્યાય જ તેને ભોગવે છે. ઇતાં દ્રવ્ય અપેક્ષાથી તો જે કરે છે તેજ ભોગવે છે. અહીં તો એક જ પર્યાયમાં સંપૂર્ણ આત્મા માનનારાને તે પર્યાયથી અધિક આત્મદ્રવ્યનું ભાન કરાવવાની વાત છે. આત્મદ્રવ્ય ત્રિકાળદ્વારા નિત્ય રહેનાડું દ્રવ્ય છે. અહીં પર્યાય જેટલો જ આત્માને માનનારા અશાનીની પર્યાય બુદ્ધિ છોડતીને દ્રવ્યદાષ્ટ કરાવવામાં આવી છે.”

પહેલાં સાંઘ્યોની માફક આત્માને સર્વથા નિત્ય અને સર્વથા અકર્તા માનનારા જૈનોનું નિરાકરણ કરાવવામાં આવ્યું હતું અને હવે આ ગાથાઓમાં બોદ્ધોની માફક આત્માને સર્વથા ક્ષણિક માનીને ‘કરે અન્ય અને ભોગવે અન્ય’ માનનારા જૈનોને સમજાવ્યા છે.

તેથી એમ સિદ્ધ થયું કે આ આત્મા નિત્યાનિત્યામક છે અને નિત્યદ્રવ્યની દાચિથી જેતાં જે કરે છે, તે જ ભોગવે છે અને અનિત્ય પર્યાયની દાચિએ જેતાં કરે છે કોઈ અને ભોગવે છે કોઈ બીજે જ - આવો અનેકાંત છે.

આ પ્રમાણે અહીં નિત્યાનિત્ય અને કર્તા-ભોક્તા સંબંધી અનેકાંત સિદ્ધ કરવામાં આવ્યો છે.

હવે આ જ ભાવનું પોષક કળશ કાબ્ય લખે છે, જે આ પ્રમાણે છે.

(શાર્દૂલવિક્રીડિત)

આત્માનं પરિશુદ્ધપીપ્સુભિરતિવ્યાપ્તિ પ્રપદ્યાન્ધકૈः

કાલોપાધિબલાદશુદ્ધમધિકાં તત્ત્રાપિ મત્વા પરैः ।

ચૈતન્ય ક્ષણિકં પ્રકલ્પ્ય પ્રથુકૈઃ શુદ્ધર્જુસુત્રે રતૈ -

રાત્મા વ્યુજિસ્ત એ હારવદહો નિ:સૂત્રમુક્તેક્ષિભિ: ॥૨૦૮॥

(હસ્તગીત)

કો અંધ બીજા ઈચ્છતા પરિશુદ્ધ આત્માને સદા,
 ‘ઉપાધિ કાળ થકી ગણે આત્મા અશુદ્ધ’ - માનતા;
 અતિવ્યાપ્તિ ઓથી ધારીને રત શુદ્ધ અંજુસૂત્રે થતા,
 કલ્પી ક્ષાળિક ચૈતન્યને નિત્યાત્મા નહિ પામતા;
 જે દોરને દેખે નહીં પાગ માત્ર દેખે મોતીને,
 પામે નહીં તે હારને, પાગ માત્ર મોતી મેળવે ૨૦૮

આત્માને સંપૂર્ણપણે શુદ્ધ ચાહનારા કોઈ બીજાઓએ-અજ્ઞાનીઓએ
 કાળની ઉપાધિના કારણે પણ આત્મામાં અધિક અશુદ્ધ માનીને,
 અતિવ્યાપ્તિને પ્રાપ્ત થઈને, શુદ્ધઅંજુસૂત્રમાં રત રહેતાં થકાં ચૈતન્યને ક્ષાળિક
 કલ્પીને આ આત્માને તે જ રીતે છોડી દીધો કે જે રીતે હારના દોરને
 ન જેતાં, માત્ર મોતીઓને જ જેનારા હારને છોડી હે છે.

જેમ દોરામાં સુવ્યવસ્થિત ક્રમથી રહેલા મોતીઓને જ હાર કહેવામાં
 આવે છે; તેવી જ રીતે નિત્યધૂવાંશમાં ક્રમથી રહેતી અનિત્યપર્યાયોને જ
 દ્રવ્ય કહે છે. આત્મા પણ દ્રવ્ય છે. તેથી તે પણ નિત્ય દ્રવ્ય, ગુણ અને
 અનિત્ય પર્યાયોના સમુદ્દ્રાયકૃપ જ છે. જેવી રીતે દોરાની ઉપેક્ષા કરીને
 મોતીઓ ઉપર દાઢિ કેન્દ્રિત કરનારા હારને પ્રાપ્ત કરી શકતા નથી; તેવી
 જ રીતે નિત્યતાની ઉપેક્ષા કરનારા લોકો પણ ક્ષાળિકપર્યાયોમાં મુગધ થઈને
 આત્મધસ્તુને પ્રાપ્ત કરી શકતા નથી.

કોઈક લોકોનું એમ કહેવું છે કે નિત્યતામાં કાળભેદ પડતાં અશુદ્ધ
 આવી જય છે અને એક ક્ષણાવતી પર્યાયને વસ્તુ માનતાં કાળભેદ પડતો
 નથી; તેથી તે સંપૂર્ણપણે શુદ્ધ હોય છે. શુદ્ધઅંજુસૂત્રનય એક સમયવતી
 પર્યાયને ગ્રહણ કરે છે. તેથી અહીં એમ કહેવામાં આવ્યું છે કે શુદ્ધતાના
 લોભમાં અંજુસૂત્રનયના વિષયને જ વસ્તુ માનીને જે લોકો સંતુષ્ટ છે; તેમને
 તે જ રીતે આત્માની પ્રાપ્તિ નથી કે જે રીતે દોરાની ઉપેક્ષા કરનારા મોતીના
 લોભીઓને હાર મળતો નથી.

આ કળણના ભાવને ભાવાર્થમાં પંડિત જંયચંદ્રલ છાબડા આ પ્રમાણે સ્પષ્ટ કરે છે.

“આત્માને સંપૂર્ણપણે શુદ્ધ માનવાના ઈચ્છુક બૌદ્ધોએ વિચાર કર્યો કે ‘જે આત્માને નિત્ય માનવામાં આવે તો નિત્યમાં કાળની અપેક્ષા હોય છે; તેથી ઉપાધિ લાગી જશે. આમ કાળની ઉપાધિ લાગતાં આત્માને બહુ અશુદ્ધ આવી જશે અને તેને અતિવ્યાપ્તિ દોષ લાગશે.’’

તે દોષના ભયથી તેમણે શુદ્ધાત્મજુસૂત્રનયનો વિષય જે વર્તમાન સમય છે, તેટલો માત્ર (ક્ષણિક જ) આત્માને માન્યો અને તેને (આત્માને) નિત્યાનિત્યસ્વરૂપ ન માન્યો. આમ આત્માને સર્વથા ક્ષણિક માનતાં તેમને નિત્યાનિત્યસ્વરૂપ-દ્રવ્યપર્યાયસ્વરૂપ સત્ત્યાર્થ આત્માની પ્રાપ્તિ ન થઈ; માત્ર ક્ષણિક પર્યાયમાં આત્માની કલ્પના થઈ; પરંતુ તે આત્મા સત્ત્યાર્થ નથી.

મોતીઓના હારમાં, દોરમાં અનેક મોતીઓ પરોવવામાં આવે છે; જે મનુષ્ય તે હાર નામની વસ્તુને મોતીઓ અને દોરા સહિત જેતો નથી - માત્ર મોતીઓને જ જુએ છે, તે પૃથ્વે-પૃથ્વે મોતીઓને જ ગ્રહણ કરે છે, હારને છોડી દે છે; અર્થાત્ તેને હારની પ્રાપ્તિ થતી નથી.

તે જ પ્રમાણે જે જીવ આત્માના એક ચૈતન્યભાવને ગ્રહણ કરતા નથી અને સમયે સમયે વર્તનાપરિણામઝ્રપ ઉપયોગની પ્રવૃત્તિને જોઈને આત્માને અનિત્ય કલ્પીને, અત્યજુસૂત્રનયનો વિષય જે વર્તમાન-સમય માત્ર ક્ષણિકત્વ છે, તેટલો માત્ર જ આત્માને માને છે (અર્થાત્ જે જીવ આત્માના દ્રવ્યપર્યાયસ્વરૂપને માનતા નથી - માત્ર ક્ષણિક પર્યાયઝ્રપ જ માને છે), તે આત્માને છોડી દે છે; અર્થાત્ તેમને આત્માની પ્રાપ્તિ થતી નથી.”

કળણ ટીકાકાર સૂત્રના અર્થ દાખાંતમાં સ્યાદ્વાદ કરે છે. તેઓ કહે છે કે જેમ દોરા વગર મોતીઓ જોડાતા નથી; હાર બનતો નથી; તેવી જ રીતે સ્યાદ્વાદ સૂત્ર વિના એકાંતવાદી આત્માનું સ્વરૂપ જોડાતું નથી, આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી.

ઉકા કથનનો આધાર લઈને બનારસીદાસજીએ બે છંદ બનાવ્યા છે,
ને આ પ્રમાણે છે.

(સવૈયા તેઝસા)

કેર્દ કહેં જીવ ક્ષનભંગુર, કેર્દ કહેં કરમ કરતાર ।
કેર્દ કરમરહિત નિત જંપહિં, નય અનંત નાના પરકાર ॥
જે એકાંત ગહેં તે મૂર્ખ, પંડિત અનેકાંત પખ ધાર ।
જૈસેં ભિન્ન ભિન્ન મુક્તાહલ, ગુનસ્રો ગહત કહાવૈ હાર ॥

(દોહા)

યથા સૂત સંગ્રહ બિના, મુકત માલ નહિ હોડ ।
તથા સ્યાદવાદી બિના, મોખ ન સાધૈ કોડ ॥

કોઈ કહે છે કે જીવ ક્ષનભંગુર છે, કોઈ કહે છે કે કર્માનો કર્તા છે
અને કોઈ તેને કર્મોરહિત બતાવે છે. નય તો અનંત છે અને અનેક પ્રકારના
છે. તે નયોના એકાંતને પકડીને બેસનારા મૂર્ખ છે અને અનેકાંતનો પક્ષ
રાખનારા પંડિત છે. સમજદાર છે, જ્ઞાની છે. જેમ છુટા-છુટા મોતીઓ
જ્યારે દોરામાં ગુંથાઈ જય છે ત્યારે હાર કહેવાય છે; તેમ નિત્ય ગુણ અને
અનિત્ય પર્યાયોનો સમુદ્દર જ દ્રવ્ય છે.

જેવી રીતે, જ્યાંસુધી મોતીઓને બેગા કરતો નથી; ત્યાંસુધી
મોતીઓની માળા બનતી નથી; તેવી જ રીતે સ્યાદવાદ વગર કોઈ પણ
વ્યક્તિ મુક્તિને સાધી શકતી નથી, મુક્તિની પ્રાપ્તિ કરી શકતી નથી.

તે બાદ બનારસીદાસજી પંચસમવાય સંબંધી એક દોહો લખે છે, જેમાં
તેઓ સ્પષ્ટ કરે છે કે મુક્તિમાર્ગની પ્રાપ્તિ તો પંચ સમવાયપૂર્વક જ થાય
છે. તે પછી ઘટદર્શનની માન્યતાને બતાવતાં ત્રણ છંદોમાં જૈનદર્શનની
સ્થાપના કરે છે. અંતમાં લખે છે કે ખોજી જીવે વાદી મરે એસી સાંચી
કહવતિ હૈ । તાત્પર્ય આ છે કે વસ્તુસ્વરૂપની શોધ કરનારા જીવતા રહે
છે, તત્ત્વને પ્રાપ્ત કરી લે છે અને વાદ-વિવાદમાં ઉલ્લંઘનારાઓ મૃત્યુને
પ્રાપ્ત થાય છે, તેમને તત્ત્વની પ્રાપ્તિ થતી નથી.

આમ સંપૂર્ણ પ્રકરણ મૂળથી અભ્યાસ કરવા યોગ્ય છે. આ કળશનો ભાવ પૂજ્ય ગુરુદૈવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે - “જેવી રીતે હારમાં પ્રત્યેક મોતીની સાથે રહેલો દોરો જ સ્થાયી છે; પરંતુ તે દોરાને ન જોતાં ફક્ત મોતીઓને જ જેનાર સંપૂર્ણ હારને છોડી દે છે અર્થાત્ તેને હારની પ્રાપ્તિ થતી નથી. તેવી જ રીતે એક ક્ષાળની પર્યાયને જ આત્મા માનનાર અને શરૂઆતથી અંત સુધી જોડાયેલા દોરાની માફક નિત્ય ધ્રુવ ચૈતન્ય પ્રભુને ન જેનારો અજાનની સંપૂર્ણ આત્માને જ છોડી દે છે અર્થાત્ તેને આત્માની પ્રાપ્તિ થતી નથી. તે મિથ્યાદાચિ જ રહે છે.”

આ પ્રમાણે આ કળશમાં એ જ કહ્યું છે કે આત્માને સર્વથા ક્ષાળિક માનનાર લોકોને આત્માની પ્રાપ્તિ તે જ પ્રમાણે થતી નથી, કે જેમ દોરાની ઉપેક્ષા કરનારાઓ મોતીની માળાથી વંચિત રહે છે.

હવે સર્વ વિકલ્પોથી પાર આત્માના અનુભવની પ્રેરણા આપનાર કળશ કાવ્ય લખે છે; જે આ પ્રમાણે છે -

(શાર્દૂલવિક્રીડિત)

કર્તુર્વેદયિતુશ્च યુક્તિવશતો ભેદોऽસ્ત્વભેદોऽપિ વા
કર્તા વેદયિતા ચ મા ભવતુ વા વસ્ત્વેવ સચિન્ત્યતામ् ।
પ્રોતા સૂત્ર ઇવાત્મનીહ નિપુણૈર્ભેન્તું ન શક્યા ક્વચિ-
ચિચ્ચિન્તામણિમાલિકેયમભિતોऽપ્યેકા ચકાસ્ત્વેવિ ન: ॥૨૦૧॥

(હરિગીત)

યુક્તિવશે હો બેદ કે ના, ભોક્તા-કર્તા તાણો,
વળી બેય તે હો, વા ન હો, બસ વસ્તુને જ અનુભવો;
સૂત્રે પરોવેલી મહિંગમાળા કદી બેદાય ના,
ત્યમ આત્મસૂત્ર સહિત ચેતનમાળ પાગ બેદાય ના;
આત્મારૂપી બસ એક આ માળા જ અમને પ્રાપ્ત હો,
જે સર્વ રીત પ્રકાશને છોડી વિકલ્પ સહુ અહો ! ૨૦૮

કર્તા અને ભોક્તાનો ચુક્તિવરો બેદ હોય કે અબેદ અથવા કર્તા-ભોક્તા - બંને જ ન હોય, જે પણ હોય; તમે તો એક વસ્તુનો જ અનુભવ કરો.

જે પ્રમાણે વ્યક્તિઓએ દોરામાં પરોવેલી મણીની માળાને બેદી શકતી નથી, તે જ પ્રમાણે આત્મામાં પરોવાયેલી ચૈતન્યદ્વારા ચિંતામણિની માળા પણ ક્યારેય કોઈથી બેદી શકતી નથી. આવી આ એક આત્માદ્વારી માળા જ અમને સંપૂર્ણ પ્રકાશમય હો.

તાત્પર્ય છે કે નિત્યત્વ-અનિત્યત્વ આદિ વિકલ્પોનું શામન થઈને અમને આત્માનો નિર્વિકલ્પ અનુભવ હો.

આ કળશની ટીકા કરતાં કળશ ટીકાકાર લખે છે કે અન્ય કરે છે, અન્ય ભોગવે છે - આવો વિકલ્પ અથવા જીવ કર્તા છે, ભોક્તા છે - આવો વિકલ્પ અથવા જીવ કર્તાનથી, ભોક્તાનથી - આવો વિકલ્પ; ઈત્યાદિ અન્યાન્ય વિકલ્પ છે છતાં પણ તેમાંનો કોઈ પણ વિકલ્પ ક્યારેય શુદ્ધસ્વરૂપનો અનુભવ કરાવવામાં સમર્થ નથી.

ભાવાર્થ આ પ્રમાણે છે કે નિર્વિકલ્પ માત્રનો અનુભવ ઉપાદેય છે, અન્ય સમસ્ત વિકલ્પ હેય છે.

ઉક્ત સંપૂર્ણ કથનના આધારે કવિવર બનારસીદાસજીએ ત્રણ છંદ લખ્યા છે; જે આ પ્રમાણે છે -

(સવૈયા ઇકતીસા)

એક મૈં અનેક હૈ અનેક હી મૈં એક હૈ સો,

એક ન અનેક કછુ કહ્યૌ ન પરતુ હૈ ।

કરતા અકરતા હૈ ભોગતા અભોગતા હૈ,

ઉપજૈ ન ઉપજત મૂએં ન મરતુ હૈ ॥

બોલત વિચારત ન બોલતૈ ન વિચારૈ કછુ,

ભેખ કૌં ન ભાજન પૈ ભેખ સૌ ધરતુ હૈ ।

એસૌ પ્રભુ ચેતન અચેતન કી સંગતિ સૌં,

ઉલટ પલટ નટબાજી સી કરતુ હૈ ॥

(દોહા)

નટબાજી વિકલપ દસા, નાંહી અનુભૌ જોગ ।

કેવળ અનુભૌ કરન કૌ, નિરવિકલપ ઉપજોગ ॥

એક જીવસ્તુમાં અનેક પર્યાયો છે અને તે અનેક પર્યાયોમાં એક જીવસ્તુ જ પ્રકાશમાન છે. આ પ્રમાણે એક છે, અનેક છે; ન એક છે ન અનેક છે; શું છે તે કંઈ કહી શકાતું નથી અર્થાત્ વસ્તુ અનિર્વચનીય છે.

તેવી જ રીતે જીવ કર્તા છે, અકર્તા છે, ભોક્તા છે, અભોક્તા છે; ઉપને છે, ઉપજતો નથી; મરે છે, મરતો નથી; બોલે છે, બોલતો નથી; વિચારે છે, વિચારતો નથી; વેશ ધારણ કરે છે વેશ ધારણ કરતો નથી. આવો આ ચેતન ભગવાન આત્મા અચેતનની સંગતિમાં પડીને નટબાળ જેવું કરતો થકો ઉલટ-પલટ થઈ રહ્યો છે.

આ નટબાળ, નટની સમાન ઉલટ-પલટ દશા સવિકલ્પ અવસ્થા છે; તેમાં અનુભવ થતો નથી. અનુભવ તો એકમાત્ર નિર્વિકલ્પ ઉપયોગમાં જ થાય છે.

આ જ વાતને આગળ વધારતાં ત્રીજે છંદ આ પ્રમાણે લખે છે.

(સવૈયા ઇકતીસા)

જैસેં કાહૂ ચતુર સંવારી હૈ મુકત માલ,

માલા કી ક્રિયા મેં નાના ભાંતિ કી વિગ્યાન હૈ ।

ક્રિયા કૌ વિકલપ ન દેખૈ પહિરનવારી,

મોતિન કી સોભા મેં મગન સુખવાન હૈ ॥

તૈસેં ન કરૈ ન ભુંજૈ અથવા કરૈ સો ભુંજૈ,

ઔર કરૈ ઔર ભુંજૈ સબ નય પ્રવાંન હૈ ।

જદપિ તથાપિ વિકલપ વિધિ ત્યાગ જોગ,

નિરવિકલપ અનુભૌ અમૃત પાન હૈ ॥

જેવી રીતે કોઈ ચતુર વ્યક્તિએ મોતીઓની માળા બનાવી. તે માળા

બનાવવામાં તેણે પોતાની હોશિયારીનો ભરપૂર ઉપયોગ કર્યો; પરંતુ પહેનાર મોતીઓની શોભામાં જ મળ રહે છે; બનાવવાની ડિયાના સંબંધમાં કંઈ વિકલ્પ કરતો નથી.

તેવી જ રીતે આત્મા કરે છે, ભોગવે છે; કરતો નથી, ભોગવતો નથી આદિ વાતો નથોના અનુસાર કહેવામાં આવે છે. નિર્ણયના કાળમાં આ બધા વિકલ્પ ચાલે છે; પરંતુ નિર્વિકલ્પ અનુભવના અમૃતપાનના સમયે આ બધા વિકલ્પો ત્યાગવા યોગ્ય છે.

ઉક્ત કણશનો ભાવ પૂજ્ય ગુરુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે. “ભાઈ! વાત કંઈક સૂક્ષ્મ છે. કહે છે કે ‘કર્તા-ભોક્તા બંને ન હોય’ તેનો અર્થ આ છે કે પરમાર્થથી ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ છે; તે રાગને કરે અથવા ભોગવે - આવું તેનું સ્વરૂપ જ નથી. શુદ્ધ ચૈતન્યદ્રવ્યમાં રાગનું કરવું અને ભોગવવું છે જ નહીં. પર્યાય અપેક્ષાથી આત્માને કર્તા-ભોક્તા કહે છે - આ જુદ્દી વાત છે, વાસ્તવમાં આત્માને-શુદ્ધ ચૈતન્યદ્રવ્યને રાગનું કર્તા-ભોક્તાપણું નથી. કોઈ અપેક્ષાથી અથવા યુક્તિથી કર્તા અને ભોક્તાનો ભેદ ભલે હોય કે ન હોય, અથવા બંને ન હોય, આ બધું તો કથનની અપેક્ષાથી છે, મૂળ વસ્તુ તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ અનાદિ-અનંત એકરૂપ છે. તેનો જ અનુભવ કરો. આ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મદ્રવ્યના અનુભવથી જ ધર્મ થાય છે.”^૧

અહા ! કર્તા-ભોક્તાનો વિકલ્પ તે કંઈ પ્રયોજનભૂત વસ્તુ નથી. આ વિકલ્પો તો રાગરૂપ છે, દુઃખરૂપ છે. આચાર્ય આદેશ દઈને કહે છે કે તમે તો એક આત્મવસ્તુનો જ અનુભવ કરો ! જે તમને ધર્મનું જ એકમાત્ર પ્રયોજન છે તો શુદ્ધ ચૈતન્યરૂપ વસ્તુ, જે નિત્ય શાશ્વત છે, તેનો જ અનુભવ કરો. વળી આચાર્ય પોતાના માટે પણ આવી જ ભાવના ભાવે છે કે અમને સંપૂર્ણપણે એક આત્મા જ પ્રકાશમાન હો.

જેવી રીતે દ્યા, દાન, વ્રત, ભક્તિ આદિના વિકલ્પો તો રાગ છે; તેવી

^૧ પ્રવચનરત્નાકર ભાગ ૮, પાનું ૨૫૮

જ રીતે કર્તા-ભોક્તાનો વિકલ્પ પણ રાગ છે તથા રાગ હિંસા છે, આત્માનો ઘાતક છે. તેથી કહે છે કે આત્મા કર્તા-ભોક્તા હોય કે ન હોય - તે વિકલ્પોથી અમને શું કામ ? અમને તો અનંત ગુણ-સ્વભાવરસથી ભરેલો ચૈતન્ય ચિંતામણી આત્માનો જ અનુભવ હો. તે એક જ અમારા માટે પ્રકાશમાન હો; કારણ કે જન્મમરણના અંતનો આ એક જ ઉપાય છે.^૧

અહીં આત્મદ્રવ્યને ચૈતન્ય ચિંતામણી માળા કહી છે. તેના ચૈતન્યસ્વભાવમય ગુણને દોરા સમાન કહ્યો છે, કે જે સ્વયં નિત્ય કાયમ રહીને સંપૂર્ણ દ્રવ્યને પોતામાં પરોવીને રહે છે તથા તે સમસ્ત ગુણને ધારણ કરનાર ગુણી આત્માનો સમસ્ત વિકલ્પ મટાડીને અને અંતર્મુખ થઈને અનુભવ કરવો તે પર્યાપ્ત છે. તે નિર્મળ પર્યાપ્તને મોક્ષ માર્ગ કહ્યો છે.”

આમ આ કળશમાં એ જ કહ્યું છે કે કર્તા-ભોક્તા આદિના સંદર્ભમાં જિનાગમાં અનેક અપેક્ષાઓ આવે છે. વસ્તુસ્થિતિ સમજવા માટે, સમજની સમયે તેનો ભરપૂર ઉપયોગ થાય છે અને થવો પણ જોઈએ; પરંતુ ભગવાન આત્મા તો ઉક્ત સમસ્ત વિકલ્પોથી પાર છે; તેથી અનુભવના કાળમાં બધા વિકલ્પો ઢંકાઈ જય છે, અને તેમ થવું જ જોઈએ. તેથી અમારી ભાવના તો એ જ છે કે અમને તો ઉક્ત બધા વિકલ્પોથી પાર આત્માનો અનુભવ હો.

હવે આગામી ગાથાઓનું સૂચક કળશ કાબ્ય કહે છે; જે આ પ્રમાણે છે-

(રથોદ્વત્તા)

વ્યાવહારિકદૃશીવ કેવળં, કર્તૃ કર્મ ચ વિભિન્નમિષ્યતે ।

નિશ્ચયેન યદિ વસ્તુ ચિંત્યતે, કર્તૃ કર્મ ચ સદૈકમિષ્યતે ॥૨૧૦॥

વ્યવહાર-દાખિથી જ કર્તા-કર્મ બજે ભિજ છે;

નિશ્ચય તાગા વસ્તુ વિચારે કર્મ-કર્તા ઓક છે. ૨૧૦

^૧ પ્રવચનરત્નાકર ભાગ પાનું ૨૫૮

^૨ તે જ, પાનું ૨૬૦

કેવળ વ્યવહારદિથી જ કર્તા અને કર્મ બિજ્ઞ-બિજ્ઞ માનવામાં આવે છે; જે નિશ્ચયનયની દિથી વિચારવામાં આવે તો કર્તા અને કર્મ સદા એક જ માનવામાં આવે છે.

આ કળશનો અર્થ અત્યંત સ્પષ્ટ છે; તેમાં વિશેષ કંઈ કહેવાનું નથી.

કવિવર બનારસીદાસજી તેનો ભાવાનુવાદ આ પ્રમાણે કરે છે -

(દોહા)

દરબ કરમ કરતા અલગ, યહ વિવહાર કહાઉ ।

નિહચૈ જો જૈસૌ દરબ, તૈસૌ તાકૌ ભાઉ ॥

‘દ્રવ્યકર્મનો કર્તા આત્મા છે’ - આમ વ્યવહારનયથી કહેવામાં આવે છે; નિશ્ચયનયથી તો જે દ્રવ્ય જેવું છે, તેનો ભાવ પણ તેવો જ હોય છે, તાત્પર્ય છે કે નિશ્ચયથી તો ચેતનભાવનો કર્તા ચેતન છે અને અચેતનનો કર્તા અચેતન છે.



■ શાનગોઠી ■

શંકા : સયોગ કેવળીની દિવ્યધ્વનિને કેવા પ્રકારે સત્ય અનુભય વચન યોગ કહ્યું છે ?

સમાધાન : કેવળીની દિવ્યધ્વનિ ઉત્પત્તિ થતાં જ અનક્ષરાત્મક રહે છે. તેથી શ્રોતાઓના કર્ષણ પ્રદેશથી સંબંધ થવાના સમય સુધી અનુભય વચન યોગ સિદ્ધ થાય છે. તેના પશ્ચાત્ શ્રોતાઓના ઈષ અર્થોના વિષયમાં સંશય આદિને નિરાકરણ કરવાથી તથા સમૃદ્ધાશન ને ઉત્પત્ત કરવાથી સત્ય વચન યોગનો સહભાવ સિદ્ધ થાય છે. આ પ્રકારે કેવળીને સત્ય અને અનુભય વચન યોગ સિદ્ધ થાય છે. આ કથનથી જ્ઞાત થાય છે કે શ્રોતાઓની સમીપ પહોંચતા પૂર્વ વાણી અનક્ષરાત્મક રહે છે, પશ્ચાત બિજ્ઞ-બિજ્ઞ શ્રોતાઓનો આશ્રય મેળવી તે દિવ્યધ્વનિ અક્ષરરૂપતા ને ધારણ કરે છે. સ્વામી સમંતબદ્ર જિનેન્દ્ર દેવની વાણીને સર્વભાગ સ્વભાવવાળી કહી છે.

સમયસાર ગાથા ૩૪૮-૩૫૫

ને વાત ઉત્થાનિકાના કણશમાં કહેવામાં આવી છે; હવે તે જ વાતને
આ ગાથાઓ દ્વારા વિસ્તારથી સ્પષ્ટ કરે છે.

જહ સિપ્પિઓ દુ કમ્મ કુબ્વદિ ણ ય સો દુ તમ્મઓ હોદિ ।
તહ જીવો વિ ય કમ્મ કુબ્વદિ ણ ય તમ્મઓ હોદિ ॥૩૪૯॥

જહ સિપ્પિઓ દુ કરણેહિં કુબ્વદિ ણ ય સો દુ તમ્મઓ હોદિ।
તહ જીવો વિ ય કરણેહિં કુબ્વદિ ણ ય તમ્મઓ હોદિ ॥૩૫૦॥

જહ સિપ્પિઓ દુ કરણાણિ ગિણહદિ ણ ય સો દુ તમ્મઓ હોદિ।
તહ જીવો કરણાણિ દુ ગિણહદિ ણ ય તમ્મઓ હોદિ ॥૩૫૧॥

જહ સિપ્પિ દુ કમ્મફલં ભુંજદિ ણ સો દુ તમ્મઓ હોદિ ।
તહ જીવો કમ્મફલં ભુંજદિ ણ ય તમ્મઓ હોદિ ॥૩૫૨॥

એવં વવહારસ્સ દુ વત્તવં દરિસણં સમાસેણ ।
સુણ ણિચ્છયસ્સ વયણં પરિણામકદં તુ જં હોદિ ॥૩૫૩॥

જહ સિપ્પિઓ દુ ચેઢું કુબ્વદિ હવદિ ય તહા અણણો સે ।
તહ જીવો વિ ય કમ્મ કુવદિ હવદિ ય અણણો સે ॥૩૫૪॥

જહ ચેઢું કુબ્વંતો દુ સિપ્પિઓ ણિચ્ચદુક્ખિખાઓ હોદિ ।
તત્તો સિયા અણણો તહ ચેઢુંતો દુહી જીવો ॥૩૫૫॥

(હરિગીત)

જ્યમ શિલ્પી કર્મ કરે પરંતુ તે નહીં તન્મય બને,
ત્યમ જીવ પાગ કર્મો કરે પાગ તે નહીં તન્મય બને. ૩૪૮

જ્યમ શિલ્પી કરાગવડે કરે પાગ તે નહીં તન્મય બને,
ત્યમ જીવ કરાગ વડે કરે પાગ તે નહીં તન્મય બને. ૩૪૯

જ્યમ શિલ્પી કરાગ ગ્રહે પરંતુ તે નહીં તન્મય બને,
ત્યમ જીવ પાગ કરાળો ગ્રહે પાગ તે નહીં તન્મય બને. ૩૫૦

શિલ્પી કરાગણ ભોગવે પાગ તે નહીં તન્મય બને,
ત્યમ જીવ કરાગણ ભોગવે પાગ તે નહીં તન્મય બને. ૩૫૧

-એ રીત મત વ્યવહારનો સંક્ષેપથી વક્તવ્ય છે;
સાંભળ વચન નિશ્ચય તાગું પરિગ્રામવિષ્યક જેહ છે. ૩૫૨

શિલ્પી કરે ચેષ્ટા અને તેનાથી તેહ અનન્ય છે,
ત્યમ જીવ કર્મ કરે અને તેનાથી તેહ અનન્ય છે. ૩૫૩

ચેષ્ટા કરંતો શિલ્પી જેમ દુખિત થાય નિરંતરે,
ને દુખથી તેહ અનન્ય ત્યમ જીવ ચેષ્ટમાન દુખી બને. ૩૫૪

જેમ શિલ્પી (કારીગર-સોની) કુંડળ આદિ કાર્ય (કર્મ) કરે છે; પરંતુ
કુંડળાદિ બનાવતી વખતે તે તેમની સાથે તન્મય થતો નથી, તે રૂપ થતો
નથી, તેમ જીવ પણ પુણ્ય-પાપાદિ પુરૂષાલ કર્મોનો કર્તાં છે; પરંતુ તેમની
સાથે તન્મય થતો નથી, તે રૂપ થતો નથી.

જેમ શિલ્પી હથોડા આદિ કરણો (સાધનો)થી કર્મ કરે છે; પરંતુ તે
તેમની સાથે તન્મય થતો નથી; તેમ જીવ મન-વચન-કાયરૂપ કરણોથી
કર્મ કરે છે; પરંતુ તેમની સાથે તન્મય થતો નથી.

જેમ શિલ્પી કરણોને ગ્રહણ કરે છે, પરંતુ તેમની સાથે તન્મય થતો

નથી; તેમ લું કરણોને ગ્રહણ કરે છે, પરંતુ તેમની સાથે તન્મય (કરણમય) થતો નથી.

જેમ શિલ્પી કુંડળ આદિ કર્મના ફળને ભોગવે છે; પરંતુ તે તેમની સાથે તન્મય થતો નથી; તેમ જ લું પણ પુણ્ય-પાપાદિ પુદ્ગલકર્મના ફળને ભોગવે છે; પરંતુ તન્મય (પુદ્ગલપરિણામદ્દ્ધ સુખ-દુઃખાદિમય) થતો નથી.

આમ વ્યવહારનો મત સંક્ષેપમાં દર્શાવ્યો. હવે પરિણામ વિષયક નિશ્ચયનો મત (માન્યતા) સાંભળો.

જેમ શિલ્પી ચેષ્ટાદ્ધ કર્મ કરે છે અને તે તેનાથી અનન્ય છે; તેમ લું પણ પોતાના પરિણામદ્ધ કર્મને કરે છે અને તેનાથી અનન્ય છે.

જેમ શિલ્પી ચેષ્ટાદ્ધ કર્મ કરતો થકો નિત્ય દુઃખી થાય છે; તેમ લું પણ પોતાના પરિણામદ્ધ ચેષ્ટાને કરતો થકો દુઃખી થાય છે (પણ) દુઃખી અનન્ય છે.

આ ગાથાઓનો ભાવ આત્મઘ્�યાતિમાં આ પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવ્યો છે.

“જેવી રીતે શિલ્પી અથર્તી સોની આદિ કારીગર કુંડળ આદિ પરદ્રવ્યપરિણાત્મક (-પરદ્રવ્યના પરિણામસ્વદ્ધ) કર્મને હથોડા આદિ પરદ્રવ્યપરિણાત્મક કરણો વડે કરે છે, હથોડા આદિ પરદ્રવ્યપરિણાત્મક કરણોને ગ્રહણ કરે છે અને કુંડળ આદિ કર્મફળને પરદ્રવ્યાત્મક ગામ (ગામનાં લોક) ભોગવે છે; પરંતુ અનેકદ્રવ્યત્વના કારણે તે શિલ્પી કર્મ, કરણ આદિ બિજ્ઞ હોવાથી તેમનાથી તન્મય (કર્મકરણાદિમય) થતો નથી; તેથી ત્યાં કર્તૃ-કર્મત્વ અને ભોક્તા-ભોક્તૃત્વનો વ્યવહાર માત્ર નિમિત્ત-નૈમિત્તિકભાવથી જ છે.

તેવી જ રીતે આત્મા પણ પુદ્ગલદ્રવ્યપરિણાત્મક પુણ્ય-પાપાદિ કર્મને મન-વચન-કાયદ્ધ પુદ્ગલદ્રવ્યપરિણાત્મક કરણો વડે કરે છે; મન-વચન-કાયદ્ધ પુદ્ગલદ્રવ્યપરિણાત્મક કરણોને ગ્રહણ કરે છે અને પુદ્ગલપરિણાત્મક પુણ્ય-પાપાદિ કર્મને મન-વચન-કાયદ્ધ પુદ્ગલદ્રવ્યપરિણાત્મક કરણો વડે

કરે છે; મન-વચન-કાયકૃપ પુદ્ગલદ્વયપરિણાત્મક કરણોને ગ્રહણ કરે છે અને પુદ્ગલપરિણાત્મક પુણ્ય-પાપાદિ કર્મના સુખ-દુ:ખાદિ ફળને ભોગવે છે; પરંતુ અનેક દ્રવ્યત્વને કારણે તેમનાથી અન્ય હોવાથી તન્મય થતો નથી; પરંતુ ત્યાં કર્તૃ-કર્મત્વ અને ભોક્તા-ભોક્તૃત્વનો વ્યવહાર માત્ર નિમિત્ત-નૈમિત્તિકભાવથી છે.

વળી જેવી રીતે - તે જ શિલ્પી કરવાનો ઈચ્છુક વર્તતો થકો ચેષ્ટકૃપ અર્થાત્ કુંડળાદિ કરવાના પોતાના પરિણામકૃપ અને હસ્ત આદિના વ્યાપારકૃપ જે સ્વપરિણામાત્મક કર્મને કરે છે તથા ચેષ્ટકૃપ દુ:ખસ્વકૃપ કર્મના સ્વપરિણાત્મક ફળને ભોગવે છે અને એકદ્રવ્યત્વને કારણે કર્મ અને કર્મફળથી અન્ય હોવાથી તન્મય (કર્મમય અને કર્મફળમય) છે; તેથી પરિણામ-પરિણામીભાવથી કર્તા-કર્મપણાનો અને ભોક્તા-ભોગપણાનો નિશ્ચય છે.

તેવી જ રીતે આત્મા પણ, કરવાનો ઈચ્છુક વર્તતો થકો, ચેષ્ટકૃપ અર્થાત્ રાગાદિ પરિણામકૃપ અને પ્રદેશોના વ્યાપારકૃપ જે આત્મપરિણાત્મક કર્મને કરે છે, ચેષ્ટકૃપ કર્મનું આત્મપરિણાત્મક દુ:ખકૃપ ફળને ભોગવે છે અને એકદ્રવ્યત્વને કારણે તેમનાથી અન્ય હોવાથી તન્મય છે; તેથી પરિણામ-પરિણામીભાવથી ત્યાં જ કર્તા-કર્મપણાનો અને ભોક્તા-ભોગ સંબંધી નિશ્ચય-વ્યવહારનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે.

આચાર્ય જ્યસેન તાત્પર્યવૃત્તિમાં આ ગાથાઓનો ભાવ આ જ રીતે વ્યક્ત કરતાં નયવિભાગ સ્પષ્ટ કરી હે છે કે વ્યવહારનયથી આત્મા દ્રવ્યકર્માનો કર્તા-ભોક્તા છે અને અશુદ્ધનિશ્ચયનયથી ભાવકર્માનો કર્તા-ભોક્તા છે.

આ ગાથાઓનો ભાવ પૂજય ગુરુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે.

“તાત્પર્ય આ છે કે -

- ૧ અજ્ઞાની જીવ પરમાં હર્ષ-શોકના ભાવ કરે છે અને તેમને ભોગવે છે; પરંતુ પરદ્રવ્યનો અર્થાત્ સ્ત્રી, પુત્ર, ધન, મકાન આદિનો ન તો કર્તા છે અને ન તો ભોક્તા છે.

- ૨ શાની લુખને અંતરંગમાં સ્વભાવનો અર્થાત્ શુદ્ધ એક જ્ઞાયકભાવનો ભાવ થયો છે; તેથી તે સ્વભાવદિષ્ટી રાગાદિભાવોનો કર્તા-ભોક્તા થતો નથી.
- ૩ તો પણ જ્ઞાનીને લેટલું રાગડ્રષ્પ પરિણમન છે, તેટલા પરિણમનની અપેક્ષાએ તેને પણ કર્તાપણું અને ભોક્તાપણું છે. જ્ઞાની સ્વભાવની દિષ્ટાએ રાગનો કર્તા નથી. દુઃખનો ભોક્તા નથી; પરંતુ તેથી કોઈ એકાંત પકડીને એવું માને કે જ્ઞાનીને સર્વથા દુઃખ થતું જ નથી તો એવી વાત નથી. જ્ઞાનીને લેટલો પણ રાગ છે તેટલું તે સમયે દુઃખ છે અને તેટલી માત્રામાં તે તેનો કર્તા અને ભોક્તા પણ છે.

અહીં તો હમણાં અજ્ઞાનીની વાત ચાલે છે કે અજ્ઞાની લુખ સ્વપરિણામાત્મક રાગના પરિણામનો કર્તા છે અને તેના ફળસ્વરૂપ જે હર્ષ-વિષાદ થાય છે તેનો ભોક્તા છે; પરંતુ પરદ્રવ્યનો કર્તા-ભોક્તા અજ્ઞાની પણ નથી.^૧

ભાઈ ! આપું જગત જે માનીને બેંકું છે તે બધાથી આ જુદી વાત છે. સોની જે હાર આદિ ઘરેણાં બનાવે છે, તે ખરેખર સોનીનું કાર્ય નથી. કુંભાર જે ઘડો બનાવે છે, તે ખરેખર કુંભારનું કાર્ય નથી. દરળ જે કપડાં સીવે છે, તે દરળનું કાર્ય નથી. ભાઈ ! સોની, દરળ, કુંભાર આદિ કારીગરો અજ્ઞાનભાવથી પોતાના તે કામ કરવાના રાગ અને વિકલ્પના કર્તા તો છે; પરંતુ પરદ્રવ્યના પરિણામોના કર્તા તો ક્યારેય નથી; કેમકે પરિણામ-પરિણામીથી અભિજ્ઞ હોય છે અને જ્યાં બંને અભિજ્ઞ હોય ત્યાં જ કર્તા-કર્મપણું સંભવ છે.^૨

અહો ! જેમ ચંદ્રમાની ચાંદનીનો ઉજવળ પ્રકાશ છે, તેમ જ ભગવાન આત્માનો પરમશુદ્ધ એક જ્ઞાનપ્રકાશ છે. બસ ‘જાણવું’ આત્માનું કાર્ય છે

૧ પ્રવચનરત્નાકર ભાગ ૬, પાનું ૨૭૦-૨૭૧

૨ પ્રવચનરત્નાકર ભાગ ૬, પાનું ૨૭૨

પરનું કંઈ કરવું અથવા કરવા સંબંધી રાગ કરવો તે પણ આત્માનું કાર્ય નથી. પરનું કાર્ય હું કરું છું અથવા કરી શકું છું - આવી માન્યતા તો મિથ્યાત્વ છે. જીવને રાગનો કર્તા જે કહ્યો છે, તે તો અજ્ઞાની જીવની અપેક્ષાએ કહેવાય છે અહીં પણ કહ્યું છે કે અજ્ઞાનભાવથી જીવ રાગનો કર્તા ભલે હોય; પરંતુ પરના કાર્યનો કર્તા જીવ હોય, એ તો નાણકાળમાં સંભવ જ નથી, સત્ય નથી. ”

આ પ્રમાણે આ ગાથાઓમાં આમ જ કહેવામાં આવ્યું છે કે પરદ્રવ્યોની સાથે તન્મય ન હોવાથી, એકાકાર ન હોવાથી આ આત્મા તેમનો કર્તા-ભોક્તા ભાત્ર વ્યવહારથી જ કહેવાય છે; પરમાર્થથી તે તેમનો કર્તા-ભોક્તા નથી; છતાં પણ તેમને કરવા-ભોગવવાઙ્ચપ પોતાના ભાવોનો, તત્સંબંધી ખોગ અને ઉપયોગનો કર્તા-ભોક્તા અવશ્ય છે.

હવે આ જ ભાવનો પોષક કળશ કાવ્ય લખે છે, જે આ પ્રમાણે છે -

(નરટક)

નનુ પરિણામ એવ કિલ કર્મ વિનિશ્ચયત:
સ ભવતિ નાપરસ્ય પરિણામિન એવ ભવેત् ।
ન ભવતિ કર્તૃશૂન્યમિહ કર્મ ન ચૈકતયા
સ્થિતિરિહ વસ્તુનો ભવતુ કર્તૃ તદેવ તત: ॥૨૧૧॥

હરિણીત

પરિણામ છે તે કર્મ છે નિશ્ચય થડી જ ધરે તથા
પરિણામ આશ્રયભૂત પરિણામી તાગું હોય જ યથા;
નહીં કરમ હો કર્તા વિના, હો વસ્તુ કોઈ ઝૂટસ્થ ના,
નિજ પરિણામનઙ્ચપ કર્મની કર્તા સ્વયં વસ્તુ સદા. ૨૧૧

ખરેખર પરિણામ જ નિશ્ચયથી કર્મ છે અને પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીનું જ હોય છે. અન્યનું નહીં અને કર્મ કર્તા વિના હોતું નથી અને વસ્તુની સ્થિતિ સદા એક જ રહેતી નથી; તેથી વસ્તુ સ્વયં જ પોતાના પરિણામનું કર્મની કર્તા છે.

આ કળશનો અર્થ પાંડે રાજમલલ કળશટીકામાં ઉપલબ્ધ નથી. આવું કેમ થયું તે સંબંધમાં કંઈ પણ કહેવું સંભવ નથી. જો કે પ્રકાશકોએ ઉક્ત છંદનો અર્થ લખ્યો છે; છતાં પણ તે અર્થ પાંડે રાજમલલજૃત નથી.

આપને આ જાણીને આશ્ર્ય થશે કે કવિવર બનારસીદાસલ પાંડે રાજમલલની કળશટીકા પર એટલા નિર્ભર છે કે તેમણે પણ આ છંદનો ભાવાનુવાદ કર્યો નથી તે જ કારણે નાટક સમયસારમાં આ ભાવનો પોષક કોઈ પણ છંદ નથી.

ઉક્ત કળશનો ભાવ પૂજ્ય ગુરુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે.

“અહીં આ કળશમાં એમ કહેવામાં આવી રહ્યું છે કે રાગ-દ્રેષ-મોહના પરિણામ નિશ્ચયથી જીવના કર્મ છે; પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીના જ થાય છે અન્યના નહીં શરીરનું હલન-ચલન ભાષા આદિના પરિણામ નિશ્ચયથી પુન્ગલ પરમાણુઓનું કાર્ય છે. તે જીવનું કાર્ય નથી; કારણ કે જીવને આશ્રયભૂત નથી, જીવથી થયેલું નથી.”^૧

કહે છે કે પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીનું જ હોય છે, અન્યનું નહીં. રાગ-દ્રેષ આદિ જે પરિણામ થાય છે, તે પોતાના આશ્રયભૂત પરિણામી (આત્મદ્રવ્ય) ના જ પરિણામ છે, અન્યના નહીં.^૨

અહીં તો એમ સિદ્ધ કરવું છે કે આત્મામાં પરિણામ આત્માથી જ થાય છે. પરિણામ અર્થાત્ વર્તમાન પર્યાય પરિણામી દ્રવ્યને આશ્રયે જ

^૧ પ્રવચનરત્નાકર ભાગ ૮, પાનું ૨૭૭

^૨ તે જ, પાનું ૨૭૭

થાય છે. પરિણામનો આશ્રય પરિણામી જ છે, અન્ય નહીં. કોઈ પણ પરિણામને કોઈ અન્ય દ્રવ્ય કરતું નથી.

અહો ! અહીં અજ્ઞાનીની આ ભિથ્યા માન્યતા મટાડવા માગે છે કે 'હું પરનું કાર્ય કરી શકું છું, કરું છું.'

હવે કહે છે કે કર્મ કર્તા વગર થતું નથી તથા વસ્તુની સ્થિતિ સદા એકરૂપ રહેતી નથી અર્થાત્ દ્રવ્ય કૂટસ્થ નથી; વસ્તુ દ્રવ્ય-પર્યાયરૂપ હોવાથી સર્વથા નિત્ય હોઈ શકતી નથી. તેથી વસ્તુ સ્વયં જ પોતાના પરિણામરૂપ કર્મની કર્તા છે.

જુઓ, આ કળશમાં પાંચ સિદ્ધાંત ગુંથાયેલા છે -

૧. ખરેખર પરિણામ જ નિશ્ચયથી કર્મ છે.
૨. પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીનું જ હોય છે, અન્યનું નહીં.
૩. કર્મ કર્તા વગર હોતું નથી.
૪. વસ્તુની સ્થિતિ સદા એકરૂપ રહેતી નથી.
૫. વસ્તુ સ્વયં જ પોતાના પરિણામરૂપ કર્મની કર્તા છે. આ નિશ્ચય સિદ્ધાંત છે.

ભાઈ ! આ સિદ્ધાંત 'અહં કરોમિ' ના કર્તૃત્વનો મૂળથી જ નાશ કરી દે છે.

વસ્તુ સહજ જ દ્રવ્ય-પર્યાય સ્વરૂપ છે, તેમાં દ્રવ્ય તો નિત્ય એકરૂપ છે; પરંતુ પર્યાય તો ક્ષણે ક્ષણે બદલાય છે. પ્રત્યેક સમયે એક અવસ્થા બદલીને બીજી થાય છે. આ વસ્તુનો સ્વભાવ છે. વસ્તુની અવસ્થાઓ જે અન્ય-અન્ય થાય છે, વિલક્ષણ થાય છે, તે નિમિત્તોની વિવિધતા અથવા વિચિત્રતાને કારણે થતી નથી, પરંતુ અવસ્થાઓનું તેરૂપ પલટવું વસ્તુનો સહજ સ્વભાવ છે. તે વસ્તુની જ કાર્યભૂત છે. એ વસ્તુ જ તે તે અવસ્થાઓની કર્તા છે.

આ પ્રમાણે આ કળશમાં એમ જ કહેવામાં આવ્યું છે કે વસ્તુની સ્થિતિ સદા એક જ રહેતી નથી તે નિરંતર બદલાયા કરે છે. નિશ્ચયથી પરિણામ પરિણામીનું જ હોય છે અને કર્તા કર્મ વગર હોતું નથી. તેથી પ્રત્યેક વસ્તુ સ્વયં જ પોતાના પરિણામની કર્તા છે.

આ પછી આત્મભ્યાતિમાં આગામી ગાથાઓની વિષયવસ્તુની ઉત્થાનિકાર્ય ત્રણ કાબ્ય લખવામાં આવ્યા છે; જે આ પ્રમાણે છે.

(પૃથ્વી)

બહિરૂઠતિ યદ્યપિ સ્ફુટદનંતશક્તિ: સ્વયં
તથાપ્યપરવસ્તુનો વિશતિ નાન્યવસ્તુન્તરમ् ।
સ્વભાવનિયતં યત: સકલમેવ વસ્ત્વિવધ્યતે
સ્વભાવચલનાકુલ: કિમિહમોહિત: કિલશ્યતે ॥૨૧૨॥

(રથોદ્ધતા)

વસ્તુ ચૈકમિહ નાન્યવસ્તુનો યેન તેન ખલુ વસ્તુ વસ્તુ તત् ।
નિશ્ચતોડયમપરોડપરસ્ય ક: કિં કરોતિ હિ બહિરૂઠન્નપિ ॥૨૧૩॥
યતુ વસ્તુ કુરુતોઽન્યવસ્તુનઃ, કિંચનાપિ પરિણામિન: સ્વયમ् ।
વ્યાવહારિકદૃશીવ તન્મતં, નાન્યદસ્તિ કિમપીહ નિશ્ચયાત् ॥૨૧૪॥

(હરિગીત)

શક્તિ અનંત સ્વયં સ્ફુરિત છે એવી વસ્તુ હોય જે,
તે અન્યવસ્તુની બાધ્યમાં લોટે, પરંતુ નવ ગ્રહે;
નહીં અન્ય વસ્તુમાં બીજી કો' અન્ય વસ્તુ પ્રવેશતી,
નિજ નિજ સ્વભાવે સ્થિત છે વસ્તુ બધી આ જગતની;
મોહિત થઈ તોપાગ જીવો નિજ સ્વરૂપથી ચ્યુત થઈ અને
અતિ આઙુલિત થયા થકા કાં કલેશ પામે છે અરે ! ૨૧૨

(હરિગીત)

આ લોકમાં નહીં એક વસ્તુ અન્ય વસ્તુની અરે,
તેથી જ કોઈ વસ્તુ છે તે, તે જ વસ્તુ છે ખરે;
છે નિશ્ચયે આવું સ્વરૂપ તો લોટતાં પરદ્રવ્યની
બહારે બીજુ કો' દ્રવ્ય, કંઈ તેને કરી શકતું નથી. ૨૧૩

(હરિગીત)

'પરિણમતી જે પોતાથી એવી વસ્તુને પરદ્રવ્ય કો'
કંઈ પાણ કરે છે' - માનવું એ મત ગાણો વ્યવહારનો;
પાણ નિશ્ચયે આ લોકમાં કો' દ્રવ્ય બીજાનું નથી,
તેથી નથી સંબંધ કોઈ વસ્તુને પરદ્રવ્યથી. ૨૧૪

જેની અનંત શક્તિ સ્વયં પ્રકાશમાન છે, આવી વસ્તુ અન્ય વસ્તુની
બહાર લોટે છે; છતાં પણ અન્ય વસ્તુ અન્ય વસ્તુની ભીતર પ્રવેશ કરતી
નથી; કારણ કે બધી વસ્તુઓ પોતપોતાના સ્વભાવમાં નિશ્ચિત છે - એમ
માનવામાં આવે છે આચાર્થિત કહે છે કે આમ હોવા છતાં પણ મોહિત
જીવ પોતાના સ્વભાવથી ચલિત થઈને આકૂળ થતો થકો કલેશ શા માટે
કરે છે ?

તાત્પર્ય છે કે વસ્તુસ્વભાવનો નિયમ તો આમ છે કે એક વસ્તુ બીજી
વસ્તુમાં મળતી નથી; છતાં પણ આ મોહી પ્રાણી પરજ્ઞેયોની સાથે પારમાર્થિક
સંબંધ સ્વીકારીને શા માટે કલેશને પામે છે ? - આ તેના અજ્ઞાનની મહિમા
જણો.

આ લોકમાં એક વસ્તુ અન્ય વસ્તુની નથી; તેથી ખરેખર તો વસ્તુ
વસ્તુ જ છે - આ નિશ્ચય છે. આવું હોવાથી કોઈ અન્ય વસ્તુ અન્ય વસ્તુની
બહાર લોટતી થકી પણ તેનું શું કરી શકે છે ?

સ્વયં પરિણમતી વસ્તુનું અન્ય વસ્તુ કંઈ કરી શકે છે - એમ જે

માનવામાં આવે છે; તે વ્યવહારથી માનવામાં આવે છે; નિશ્ચયથી તો અન્ય વસ્તુનો અન્ય વસ્તુ સાથે કંઈ પણ સંબંધ નથી.

આ કળશોનો ભાવ સ્પષ્ટ કરતાં કળશ ટીકાકાર લખે છે - “જીવનો સ્વભાવ એવો છે કે તે સકળ જ્ઞેયોને જાગે છે. કોઈ અશુદ્ધપાણું ઘટિત થાય છે. તેનું સમાધાન એમ છે કે અશુદ્ધપાણું ઘટિત થતું નથી, જીવસ્તુનો એવો જ સ્વભાવ છે, જે સમસ્ત જ્ઞેયવસ્તુને જાગે છે.

ભાવાર્થ આ પ્રમાણે છે કે જીવદ્વય સમસ્ત જ્ઞેયવસ્તુને જાગે છે - એ તો સ્વભાવ છે; પરંતુ જ્ઞાન જ્ઞેયરૂપ થતું નથી, જ્ઞેયપાણ જ્ઞાનરૂપ પરિણમતું નથી. આવી વસ્તુની મર્યાદા છે.

ભાવાર્થ આ પ્રમાણે છે કે વસ્તુસ્વરૂપની મર્યાદા તો એવી છે કે કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યની સાથે એકરૂપ થતું નથી. તે ઉપરાંત પણ જીવનો સ્વભાવ જ્ઞેય વસ્તુને જાણો - આમ છે તો પણ તેમાં કંઈ ધોખો નથી. જીવદ્વય જ્ઞેયને જાણતું થકું પણ પોતાના સ્વરૂપે છે.

કોઈ આશંકા કરે છે કે જૈન સિદ્ધાંતમાં પણ આમ કલ્યું છે કે જીવ જ્ઞાનાવરણાદિ પુદ્ગલ કર્મને કરે છે, ભોગવે છે. તેનું સમાધાન આમ છે કે તેમ કહેવું જૂઠા વ્યવહારથી છે. દ્રવ્યના સ્વરૂપનો વિચાર કરતાં પરદ્રવ્યનો કર્તા જીવ નથી.”

આ ત્રણ કળશોનો ભાવાનુવાદ કવિવર બનારસીદાસજી આ પ્રમાણે કરે છે.

(સવૈયા ઇકતીસા)

ગ્યાન કૌ સહજ જ્ઞેયકાર રૂપ પરિણવૈ,

યદ્વાપિ તથાપિ ગ્યાન ગ્યાનરૂપ કહ્યો હૈ ।

જ્ઞેય જ્ઞેયરૂપ યોં અનાદિ હી કી મરજાદ,

કાહુ વસ્તુ કાહુ કૌ સુભાવ નહિ ગહ્યો હૈ ॥

એતે પર કોऊ મિથ્યામતી કહૈ જ્ઞેયકાર,

પ્રતિભાસન સાઁ ગ્યાન અસુદ્ધ હૈ રહ્યો હૈ ।

યાહી દુરબુદ્ધિ સૌં વિકલ ભયૌ ડોલત હૈ,
સમુદ્રૈ ન ધરમ યોં ભરમ માંહિ બહ્યો હૈ ॥

(ચૌપાઇ)

સકલ વસ્તુ જગ મેં અસહાઈ । વસ્તુ વસ્તુ સૌં મિલૈ ન કાઈ ।
જીવ વસ્તુ જાનૈ જગ જેતી । સોઝ ભિન્ન રહૈ સબ સેતી ॥

(દોહા)

કરમ કરૈ ફલ ભોગવૈ, જીવ અગ્યાની કોડિ ।
યહ કથની વિવહાર કી, વસ્તુસ્વરૂપ ન હોડિ ॥

જ્ઞાનનો સહજ સ્વભાવ જ્ઞેયાકારદ્દ્યપ પરિણામવાનો છે; છતાં પણ જ્ઞાન જ્ઞાનદ્દ્યપ જ રહે છે અને જ્ઞેય જ્ઞેયદ્દ્યપ જ રહે છે - આવી અનાદિકાત્તીન મર્યાદા છે; કારણ કે કોઈ વસ્તુ કોઈના સ્વભાવને ગ્રહણ કરતી નથી. - આવું હોવા છતાં પણ વૈશેષિકોની માફક કોઈ ભિથ્યાદાદિ જૈની કહે છે કે જ્ઞાનમાં જ્ઞેયાકારોના પ્રતિભાસનથી જ્ઞાન અશુદ્ધ થઈ રહ્યું છે. તે આ અજ્ઞાનના કારણે દુઃખી થઈ રહ્યો છે, સંસારમાં ભ્રમણ કરી રહ્યો છે, ધર્મના ભર્મને સમજતો નથી અને ભ્રમમાં વહી રહ્યો છે.

આ જગતમાં સમસ્ત વસ્તુઓ સંપૂર્ણપણે અસહાય છે, સ્વાધીન છે; કોઈ વસ્તુ કોઈ અન્ય વસ્તુ સાથે મળતી નથી. જગતમાં જેટલી વસ્તુઓ છે; જીવ બલે તેમને જણે છે છતાં પણ એ તે બધાયથી ભિન્ન જ રહે છે.

કોઈ અજ્ઞાની જીવ કર્મ કરે છે અને તે કર્મનું ફળ ભોગવે છે - આ કથન વ્યવહારનયનું છે, વસ્તુસ્વરૂપ આવું નથી.

જે લોકો પરવસ્તુને જણાવું માત્ર અશુદ્ધતા છે, બંધનું કારણ છે - આમ માને છે, તેમને કળશાઠીકા અને નાટક સમયસારના ઉક્ત કથનોનું ઉંડાળાથી મંથન કરવું જોઈએ.

ઉક્ત કળશોનો ભાવ પૂજ્ય ગુરુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે -

“આચાર્ય કહે છે કે પ્રત્યેક વસ્તુ (આત્મા અને પરમાણુ) પોતાપોતાની અનંત શક્તિઓથી પ્રકાશમાન છે. પ્રત્યેક વસ્તુ અન્ય વસ્તુની બહાર-બહાર જ લોટે છે, એક-બીજામાં પ્રવેશતી નથી. દ્રવ્યમાં અથવા વસ્તુમાં જે કે અનંત શક્તિઓ છે; છતાં પણ તેમનામાં એવી એક પણ શક્તિ નથી, જેથી પરવસ્તુમાં પ્રવેશીને તેનું કંઈ કરે અથવા તેમાં કંઈ પણ કરી શકે.^૧

વસ્તુ દ્રવ્ય-પર્યાયકૃપ છે. તેની પર્યાય પોતે જ પોતાની યોગ્યતા અનુસાર બદલીને પ્રતિક્ષણે અન્ય-અન્ય થાય છે. ત્યાં સંયોગી અન્ય વસ્તુ (નિભિત) તે અવસ્થાને વિલક્ષણપણે બદલી શકતી નથી, કારણ કે નિભિતકૃપ અન્ય વસ્તુનો તેની બહાર-બહાર જ લોટે છે. વસ્તુમાં પ્રવેશ કરતી જ નથી. તથા અન્ય-અન્ય અવસ્થાકૃપ પલટવું એ તો વસ્તુનો સહજ સ્વભાવ જ છે. તેને પલટવા માટે અન્ય દ્રવ્યની અપેક્ષા જ નથી.

અહા ! જૈન પરમેશ્વરે કહેલું તત્ત્વ, વસ્તુસ્વકૃપ બહુ જ સુધ્રમ અને ગંભીર છે. પૂર્વગ્રહથી ગ્રસ્ત જીવોની સમજમાં આવવું મુશ્કેલ છે. પણ શું કરીએ ?^૨

વસ્તુસ્વકૃપ તો એવું જ છે કે અન્ય વસ્તુ અન્ય વસ્તુમાં પ્રવેશ કરતી નથી, અજિન પાણીમાં પ્રવેશ કરતી નથી. ખરેખર વાત આમ છે કે પાણીની શીતળ અવસ્થા હોય કે ઉણગ અવસ્થા હોય, બંને અવસ્થાઓમાં પાણીના પરમાણુ જ તે-તેકૃપે પરિણમે છે. બાધ વસ્તુ તો તેમાં નિભિતમાત્ર જ છે, અનુકૂળ માત્ર જ છે અજિનને કારણે પાણી ગરમ થતું જ નથી. પાણીની શીતળ અથવા ઉણગ અવસ્થા તો પાણીના પરમાણુઓની તત્ત્વસમયની સ્વતંત્ર યોગ્યતાથી થાય છે. તે પર્યાયનું તેકૃપ થવું તેની સ્વતંત્ર જન્મક્ષાળ છે.^૩

આ કળશનો ભાવાર્થ આમ છે કે કોઈ એક વસ્તુમાં અન્ય વસ્તુ મળતી

૧ પ્રવચનરત્નાકર ભાગ ૬, પાનું ૨૮૧

૨ પ્રવચનરત્નાકર ભાગ ૬, પાનું ૨૮૧

૩ તે જ, પાનું ૨૮૩

નથી - આવો વસ્તુનો સ્વભાવ છે. જુઓ, જગતમાં અનંત દ્રવ્ય છે, તેઓ પરસ્પર બિજ્ઞ-બિજ્ઞ છે. કોઈ કોઈમાં પ્રવેશતું નથી. એકદ્રવ્ય બીજ દ્રવ્યની બહાર જ લોટે છે. તેથી સ્પષ્ટ છે કે કોઈ એક દ્રવ્ય અન્ય દ્રવ્યનું કાર્ય કરતું નથી. આ મહાસિદ્ધાંત છે.^૧

ભાઈ ! આવું સ્વતંત્ર યથાર્થ વસ્તુસ્વરૂપ માન્યા વગર દાખિ પરથી હૃઠીને દ્રવ્યસ્વભાવ પર કેમ જય અને દાખિ દ્રવ્યસ્વભાવ પર ગયા વિના સમ્યગ્દર્શન કેમ થાય ?^૨

અહીં કહે છે કે કોઈ વસ્તુ બીજ કોઈ અન્ય વસ્તુમાં મળતી નથી - આવો અચલિત નિયમ છે તો પણ મોહી જીવ પરજ્ઞેયોની સાથે મારો પારમાર્થિક સંબંધ છે - આવું માનીને કલેશને પામે છે તો આ તેનું બહુ મોટું અજ્ઞાન છે.^૩

જુઓ વસ્તુ તો વસ્તુ જ છે. એક વસ્તુ બીજ વસ્તુથી અત્યંત બિજ્ઞ છે. આમ હોવાથી એક વસ્તુ બીજ વસ્તુની બહાર-બહાર જ લોટ્ટી રહેવાથી, એક બીજમાં પ્રવેશતી ન હોવાથી તે અન્યનું શું કરી શકે ?^૪

ભાઈ ! 'પર'નું જ્ઞાન થવાના સમયે પણ તે 'પરજ્ઞેય'ના કારણે તે જ્ઞાન થતું નથી. જ્ઞાન તો સ્વયં પોતાના કારણે જ થાય છે, તે જ તેની જન્મક્ષણ છે.

આ કળશનો ભાવાર્થ આ છે કે -

એક આત્મા બીજ આત્મામાં કોઈ પણ પરિવર્તન કરી શકતો નથી.

એક પરમાણુ બીજ પરમાણુને બદલાવી શકતો નથી.

એક પરમાણુ બીજ આત્માને બદલાવી શકતો નથી.

એક આત્મા કોઈ પરમાણુને બદલાવી શકતો નથી.

૧ પ્રવચનરત્નાકર ભાગ ૬, પાનું ૨૮૪

૨ તે જ, પાનું ૨૮૪

૩ તે જ, પાનું ૨૮૫

૪ પ્રવચનરત્નાકર ભાગ ૬, પાનું ૨૮૮

એક વસ્તુ જો બીજી વસ્તુને બદલી દે તો વસ્તુનું વસ્તુપાણું જ રહે નહીં શકે. તેથી આ સિદ્ધાંત અટલ છે કે એક વસ્તુ અન્ય વસ્તુને બદલી શકતી જ નથી. અગિનથી પાણી ગરમ થતું નથી. બાઈ રોટલી બનાવતી નથી. કર્મથી વિકાર થતો નથી. ગુરુથી શિખને શાન થતું નથી. કુંબાર ઘડો બનાવતો નથી.

આ પ્રમાણે જ્યાં એક વસ્તુ અન્ય વસ્તુને પરિણામાવી શકતી નથી, ત્યાં એક વસ્તુ અન્ય વસ્તુનું શું કરી શકે ? કારણ કે નિમિત્ત ઉપાદાનને પલટી જ શકતું નથી.¹

આ આત્મા સ્વયં સ્વરૂપથી જ્ઞાયક છે અને શરીર-મન-વાળી-ઈંડ્રિય-કર્મ-નોકર્મ આદિ જડ પદાર્થ અને અન્ય આત્માઓ જોય છે. તે સર્વ પરદ્રવ્યો અને આત્માને વ્યવહારથી જોય-જ્ઞાયક સંબંધ છે, છતાં પણ તે પરદ્રવ્યોને લીધે આત્મા જ્ઞાયક નથી. પરદ્રવ્ય જ્ઞાયકનું કશું કરતી નથી, જ્ઞાયકને જે-જે પરદ્રવ્યોનું શાન થાય છે તે શાન તે-તે પરદ્રવ્યોને કારણે થતું નથી. પરજોયો આત્માની જ્ઞાનપર્યાયમાં કશું કરતા નથી. જ્ઞાન જોયોને જાણે છે, તે જાણવારૂપ જ્ઞાનનું જ પોતાનું સામર્થ્ય છે. તેમાં જોયોનું કંઈ પણ યોગદાન નથી. ‘જોય છે, તે કારણે જ્ઞાન થયું’ - આમ માનવું મિથ્યા છે. વાત બહુ સુફ્ફ્રમ છે, પણ જાણવા જેવી છે. ‘પર’ ને જાણવાને માટે જ્ઞાનને પર ‘અસ્તિત્વની કોઈ જ આવશ્યકતા નથી; કારણ કે જ્ઞાન જોયોને જાણવા માટે તેમની અપેક્ષા રાખતો નથી. તે પૂર્ણ સ્વાધીન છે, સ્વતંત્ર છે.

બાધુ ! જ્ઞાન જ્ઞાયક આત્માનું પરિણામ છે અને તે જ્ઞાનપરિણામનો કર્તા જ્ઞાયક સ્વયં છે, પરજોય નહીં પરદ્રવ્યોમાં જે જે કાર્યો થાય છે, તે કાર્યોનો કર્તા તત્ત્વસંબંધી પરદ્રવ્ય જ છે, આત્મા તેમનો કર્તા નથી.

આ પ્રમાણે જીવના પરિણામનો કર્તા જીવ છે; પરદ્રવ્ય નથી. સર્વજ્ઞ ભગવાનને જે કેવળજ્ઞાન પ્રગટ થાય છે, તેનો કર્તા કેવળી ભગવાન જ છે. કેવળી ભગવાન સર્વજીવ, સર્વલોક અને સર્વભાવોને એકી સમયે જાણે

¹ પ્રવચનરત્નાકર ભાગ ૮, પાનું ૨૮૮-૨૮૯

છે. તે જાણનાં જ્ઞાન જોયોને કારણે થતું નથી. જ્ઞાન જોયોને યથાસ્થિત જાણે છે; જેવા જોય છે, ઠીક તેવા જ જાણે છે; છતાં પણ એ તે જોયોના લીધે થતું નથી. પરંતુ તે જ્ઞાન સ્વયં પોતાના તત્ત્વસમ્યના સામર્થ્ય (યોગ્યતા)થી જ થયું છે. જ્ઞાનની કેવી ગજબની સ્વતંત્રતા ?

ભગવાન બિજેન્દ્રદેવ ફરમાવે છે કે જ્ઞાનપર્યાયનો કર્તા લુચ છે. જોયોથી જ્ઞાન થતું નથી. આવી રીતે પદાર્થોમાં (સ્વ-પર પદાર્થોમાં) બિજ્ઞતા છે. આણું વસ્તુસ્વરૂપ હોવા છતાં જોયોથી જ્ઞાનનું થવું માનવું - બે દ્રવ્યોમાં એકપણું માનવું - મોટી ભાંતિ છે.

પરજોયો જ્ઞાયકનું કંઈ કરતા નથી અને જ્ઞાયક પણ પરજોયોનું કંઈ કરતો નથી - આમ યથાર્થ જાણવું. આમ યથાર્થ જાણનારાઓનો મોહ સહજ જ કથ થઈ જય છે અને તેમને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ જય છે.^૧

ભાવાર્થ આ છે કે આત્મા ત્રિકાળી વસ્તુ છે, તેનો જ્ઞાનગુણ પણ ત્રિકાળી છે, તે જ્ઞાનની પર્યાય પ્રતિસમ્ય સ્વયં જ થાય છે. ‘ભગવાનની વાણીથી જ્ઞાન થયું’ - આમ કહેવું વ્યવહારનયની દાચિ છે. નિશ્ચયથી તો ભગવાનની વાણીએ આત્માનું કંઈપણ કર્યું નથી.^૨

જુઓ શીતળતાની માફક ઉખણતા પણ પાણીની જ અવસ્થા છે, અનિ તો તેમાં નિભિત માત્ર છે. શીતળ અવસ્થા બદ્લીને વર્તમાનમાં ઉખણ થઈ છે, તે સ્વયં પાણીનું જ પરિણામન છે. અનિએ તેમાં પોતાનું કંઈ ઉમેર્યું નથી. અનિથી પાણી ઉખણ થયું - આમ કહેવું વ્યવહારદાચિનું કથન છે. નિશ્ચયથી અનિએ પાણીનું કંઈપણ કર્યું નથી.

તેવી જ રીતે આત્મામાં જ્ઞાનનું પરિણામન થાય છે, ત્યાં પરજોય નિભિતમાત્ર છે; પરંતુ નિભિત તેમાં કંઈ કરતા નથી.

પોતપોતાના સ્વભાવથી પરિણામતા પદાર્થોને અન્ય કોઈપણ પદાર્થ પરિણામાવી શકતું નથી. જ્ઞાયક પરદ્રવ્યોને જાણે છે - આમ જે કહેવામાં

૧ તે જ, પાનું ૨૮૧

૨ તે જ, પાનું ૨૮૧

આવે છે, તે પણ માત્ર ઉપચારથી કહેવામાં આવે છે. નિશ્ચયથી તો જ્ઞાયક પણ સ્વયં, જ્ઞાન પણ સ્વયં અને જોય પણ સ્વયં જ છે. બાઈ ! પરને જાણવાના સમયે પણ તે પોતાની જ્ઞાનની પર્યાયને જ જાણે છે. જ્ઞાનની પર્યાયના સામર્થ્યથી જ સ્વ અને પર જાણવામાં આવે છે. પરજોયોને કારણે જ્ઞાન ક્યારેય થતું જ નથી. નિશ્ચયથી તો જ્ઞાયક તો બસ જ્ઞાયક જ છે. અર્થાત્ જ્ઞાયક પોતાનાથી જ પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયને જ જાણતો થકો જ્ઞાયક છે.૧”

આ પ્રમાણે આ કળશોમાં એમ જ કહેવામાં આવ્યું છે કે ભલે ને વ્યવહારથી એમ કહેવામાં આવતું હોય કે એક વસ્તુ બીજી વસ્તુને કરે છે - ભોગવે છે; પરંતુ વસ્તુસ્થિતિ આમ છે કે એક વસ્તુ બીજી વસ્તુની અંદર પ્રવેશી શકતી જ નથી, બહાર-બહાર જ લોટે છે. બહાર-બહાર લોટ્ટી થકી વસ્તુ બીજી વસ્તુમાં શું કરી શકે ? તેથી નિશ્ચયનયનું આ કથન પરમસત્ય છે કે કોઈ પણ વસ્તુ અન્ય વસ્તુની કર્તા-બોક્તા નથી.



શાનગોઢી

શંકા :- - ગોમટસારમાં મધ્યરાત્રિએ દિવ્યદ્વનિ ખીરવા પર આ શંકા થઈ શકે છે કે મધ્યરાત્રિએ જીવ નિદ્રાને વશીભૂત રહે છે. તે સમયે દિવ્યદ્વનિના કરવાથી એનો શું ઉપયોગ થાય?

સમાધાન :- સમવશરણમાં ભગવાનના પ્રભામંડળના પ્રભાવથી દિવસ અને રાત્રિનો લેદ નથી રહેતો. સમવશરણમાં જવાવાળાઓને નિદ્રા આદિની પીડાઓ પણ નથી થતી.

શાભયસાર ગાથા ૩૫૬-૩૬૫

જે વાત ઉત્થાનિકાના કળશોમાં કહેવામાં આવી છે; હવે તે જ વાત ગાથાઓમાં વિસ્તારથી કહે છે. ગાથાઓ મૂળમા આ પ્રમાણે છે.

જહ સેડિયા દુ ણ પરસ્સ સેડિયા સેડિયા ય સા હોદિ ।

તહ જાણગો દુ ણ પરસ્સ જાણગો જાણગો સો દુ ॥૩૫૬॥

જહ સેડિયા દુ ણ પરસ્સ સેડિયા સેડિયા ય સા હોદિ ।

તહ પાસગો દુ ણ પરસ્સ પાસગો પાસગો સો દુ ॥૩૫૭॥

જહ સેડિયા દુ ણ પરસ્સ સેડિયા સેડિયા ય સા હોદિ ।

તહ સંજદો દુ ણ પરસ્સ સંજદો સંજદો સો દુ ॥૩૫૮॥

જહ સેડિયા દુ ણ પરસ્સ સેડિયા સેડિયા ય સા હોદિ ।

રહ દંસણ દુ ણ પરસ્સ દંસણ દંસણ તં તુ ॥૩૫૯॥

એવ તુ ણિચ્છયણયસ્સ ભાસિદં ણાણદંસણચરિત્તે ।

સુણ વવહારણયસ્સ ય વત્તબ્વ સે સમાસેણ ॥૩૬૦॥

જહ પરદબ્વ સેડદિ હુ સેડિયા અપ્યણો સહાવેણ ।

તહ પરદબ્વ જાણદિ ણાદા વિ સએણ ભાવેણ ॥૩૬૧॥

જહ પરદબ્વ સેડદિ હુ સેડિયા અપ્યણો સહાવેણ ।

તહ પરદબ્વ પસ્સદિ જીવો વિ સએણ ભાવેણ ॥૩૬૨॥

जह परदब्वं सेडिदि हु सेडिया अप्पणो सहावेण ।
तह परदब्वं विजहदि णादा वि सएण भावेण ॥३६३॥

जह परदब्वं सेडिदि हु सेडिया अप्पणो सहावेण ।
तह परदब्वं सहहदि सम्मदिडी सहावेण ॥३६४॥

एवं ववहारस्स दु विणिच्छओ णाणदंसणचरित्ते ।
भणिदो अणेसु वि पज्जएसु एमेव णादब्वो ॥३६५॥

(हरिगीत)

ज्यम सेटिका नथी पर ताणी, छ सेटिका भस सेटिका,
शायक नथी त्यम पर ताणो, शायक खरे शायक तथा; ३५६

ज्यम सेटिका नथी पर ताणी, छ सेटिका भस सेटिका,
दर्शक नथी त्यम पर ताणो, दर्शक खरे दर्शक तथा; ३५७

ज्यम सेटिका नथी पर ताणी, छ सेटिका भस सेटिका,
संयत नथी त्यम पर ताणो, संयत खरे संयत तथा; ३५८

ज्यम सेटिका नथी पर ताणी, छ सेटिका भस सेटिका,
दर्शन नथी त्यम पर ताणु, दर्शन खरे दर्शन तथा ३५९

ओम ज्ञान-दर्शन-यरितविषयक कथन निश्चयनय ताणु;
सांख्य कथन संक्षेपथी अना विषे व्यवहारनु ३६०

ज्यम निज स्वभावथी सेटिका परद्रव्यने धोणु करे,
शाताय ए रीत आगतो निज भावथी परद्रव्यने; ३६१

ज्यम निज स्वभावथी सेटिका परद्रव्यने धोणु करे,
आत्माय ए रीत देखतो निज भावथी परद्रव्यने; ३६२

ज्यम निज स्वभावथी सेटिका परद्रव्यने धोणु करे,
शाताय ए रीत त्यागतो निज भावथी परद्रव्यने; ३६३

જ્યમ નિજ સ્વભાવથી સેટિકા પરદ્રવ્યને ધોળું કરે,
સુદાણ્ટિ એ રીત શ્રદ્ધતો નિજ ભાવથી પરદ્રવ્યને; ૩૬૪

એમ જ્ઞાન-દર્શન-ચરિતમાં નિર્ગય કહ્યો વ્યવહારનો,
ને અન્ય પર્યાયો વિષે પાણ એ જ રીતે જાગવો. ૩૬૫

જે કે વ્યવહારથી પરદ્રવ્યોને અને આત્માને જોય-જ્ઞાયક સંબંધ છે,
દર્શક સંબંધ છે, ત્યાજ્ય-ત્યાજક સંબંધ છે, તો પણ નિશ્ચયથી તો
વસ્તુસ્થિતિ આ પ્રમાણે છે -

જેમ (સેટિકા) ખડી પરની (-ભીત આદિની) નથી, ખડી તે તો ખડી
જ છે; તેમ જ્ઞાયક (જાણનારો) આત્મા તો જોયણું પરદ્રવ્યોનો નથી, જ્ઞાયક
તો જ્ઞાયક જ છે.

જેમ ખડી પરની નથી, ખડી તો ખડી જ છે; તેમ દર્શક પરનો નથી,
દર્શક તો દર્શક જ છે.

જેમ ખડી પરની નથી ખડી તો ખડી જ છે તેમ સંયત (પરનો ત્યાગ
કરનારો) પરનો નથી સંયત તે તો સંયત જ છે.

જેમ ખડી પરની નથી, ખડી તો ખડી જ છે; તેવી જ રીતે દર્શન
(શ્રદ્ધાન) પરનું નથી, દર્શન તો દર્શન જ છે અર્થાત્ શ્રદ્ધાન તો શ્રદ્ધાન
જ છે.

એ પ્રમાણે જ્ઞાન દર્શન અને ચારિત્ર વિષે નિશ્ચયનયનું કથન છે અને
હવે તે વિષે સંક્ષેપમાં વ્યવહારનયનું કથન સાંભળો.

જેમ ખડી પોતાના સ્વભાવથી દીવાલ આદિ પરદ્રવ્યોને સફેદ કરે છે;
તેમ જ્ઞાતા પણ પોતાના સ્વભાવથી પરદ્રવ્યોને જાણે છે.

જેમ ખડી પોતાના સ્વભાવથી દીવાલ આદિ પરદ્રવ્યોને સફેદ કરે છે;
તેમ જીવ પણ પોતાના સ્વભાવથી પરદ્રવ્યોને હેઠે છે.

જેમ ખડી પોતાના સ્વભાવથી દીવાલ આદિ પરદ્રવ્યોને સફેદ કરે છે
તેમ જ્ઞાતા પણ પોતાના સ્વભાવથી પરદ્રવ્યોને ત્યાગે છે.

જેમ ખડી પોતાના સ્વભાવથી દીવાલ આદિ પરદ્રવ્યોને સફેદ કરે છે; તેમ સમ્યગદાચિ પોતાના સ્વભાવથી પરદ્રવ્યોનું શ્રદ્ધાન કરે છે.

આ પ્રમાણે જ્ઞાન, દર્શાન, ચારિત્ર વિષે વ્યવહારનયનો નિર્ણય કહ્યો; બીજાન પર્યાયો વિષે પણ એ રીતે જ જાણવો.

આ ગાથાઓનો ભાવ આત્મપ્રાણાત્મિં આ પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવ્યો છે.

“સેટિકા અર્થાત્ ખડી શૈત (સફેદ) પદાર્થ છે અને ભીતાં આદિ શૈત્ય (સફેદ કરવા યોગ્ય) પદાર્થ છે હવે શૈત કરનારી ખડી શૈત કરવા યોગ્ય જે ભીતાં આદિ પરદ્રવ્ય તેની છે કે નથી? એમ તે બંનેનો તાત્ત્વિક (પારમાર્થિક) સંબંધ અહીં વિચારવામાં આવે છે.

હવે સૌથી પહેલા એમ વિચારીએ કે જે ખડી ભીતાં આદિ પરદ્રવ્યોની હોય તો શું થાય? જેનું જે હોય તે તે જ હોય. જેમ કે જ્ઞાન આત્માનું હોવાથી જ્ઞાન આત્મા જ છે. આવો તાત્ત્વિક સંબંધ વિદ્યમાન હોવાથી જે ખડી ભીતાં આદિની હોય તો પછી ખડી ભીતાં જ હોય. એમ હોતાં ખડીના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થઈ જય, પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યકૃપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. તેથી એમ સિદ્ધ થયું કે ખડી ભીતાં આદિની નથી.

હવે આગળ વિચારીએ કે ખડી ભીતાં આદિની નથી તો પછી ખડી કોણી છે?

જે એમ કહેવામાં આવે કે તે ખડી તો તે ખડીની જ છે, તો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આ ખડીથી બિજ્ઞ બીજી કઈ ખડી છે કે જેની આ ખડી છે.

તેના ઉત્તરમાં એમ કહેવાઈ રહ્યું છે કે એ ખડીથી બિજ્ઞ અન્ય કોઈ ખડી નથી; પરંતુ તે બે સ્વ-સ્વામીકૃપ અંશ જ છે.

અહીં સ્વ-સ્વામીકૃપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? અર્થાત્ કંઈ

પણ સાધ્ય નથી. આવી સ્થિતિમાં ખડી કોઈની પણ નથી. ખડી તો ખડી જ છે - આ નિશ્ચય છે.

આ તો દાખાંત છે; હવે આ જ વાતને દ્રાષ્ટાન્ત પર ઘટિત કરે છે.

આ જગતમાં ચેતયિતા અર્થાત્ ચેતનારો આત્મા જ્ઞાનગુણથી પરિપૂર્ણ સ્વભાવવાળું દ્રવ્ય છે અને પુદ્ગલાદિ પરદ્રવ્ય વ્યવહારથી તેના જોય છે.

હવે જ્ઞાયક આત્મા પુદ્ગલાદિ જોયોનું છે કે નહીં - આ વાતનો તાત્ત્વિક વિચાર કરવામાં આવે છે.

જે ચેતયિતા આત્મા પુદ્ગલાદિ જોયોનો હોય તો શું હોય - સૌથી પહેલા એનો વિચાર કરે છે. જેનું જે હોય છે, તે તે જ હોય છે. જેમ જ્ઞાન આત્માનું હોવાથી જ્ઞાન આત્મા જ છે - આવો તાત્ત્વિક સંબંધ જીવંત હોવાથી ચેતયિતા આત્મા જે પુદ્ગલાદિનો હોય તો આત્માએ પુદ્ગલાદિઃપ જ થયું જોઈએ અને તેમ થતાં આત્માના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થઈ જશે; પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી; કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યઃપ થવાનો તો પહેલેથી જ નિષેધ થઈ ચૂક્યો છે. આ પ્રમાણે આમ સિદ્ધ થયું કે ચેતયિતા આત્મા પુદ્ગલાદિનો નથી.

હવે આગળ વિચારે છે કે ચેતયિતા આત્મા પુદ્ગલાદિનો નથી તો કોનો છે ?

જે એમ કહેવામાં આવે કે ચેતયિતા ચેતયિતાનો જ છે તો વળી પ્રશ્ન થશે કે ચેતયિતાથી બિજ્ઞ એવો કયો ચેતયિતા છે કે જેનો આ ચેતયિતા છે ?

ચેતયિતાથી બિજ્ઞ બીજે કોઈ ચેતયિતા નથી; પરંતુ તે બંને સ્વ-સ્વામીઃપ અંશ જ છે - જે એમ કહેવામાં આવે તો ફરી આ પ્રશ્ન ઉઠે છે કે અહીં સ્વ-સ્વામીઃપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે ? તાત્પર્ય આમ છે કે કંઈ પણ સાધ્ય નથી. આમ જ્ઞાયક કોઈનો નથી; જ્ઞાયક તો જ્ઞાયક જ છે - આ નિશ્ચય છે.

આ પ્રમાણે આમ બતાવવામાં આવ્યું છે કે આત્મા પરદ્રવ્યને જાણો છે - આ વ્યવહારકથન છે અને આત્મા પોતાને જાણો છે - આ કથનમાં પણ સ્વ-સ્વામી અંશકૃપ વ્યવહાર છે; નિશ્ચય તો આ છે કે જ્ઞાયક જ્ઞાયક જ છે.

જેમ જ્ઞાયક પર ધર્ટિત કરવામાં આવ્યું; તેમ હવે દર્શક પર પણ ધર્ટિત કરવામાં આવે છે.

જેમ ખડી (સેટિકા) શૈત (સફેદ) પદાર્થ છે અને ભીત આદિ શૈત્ય (સફેદ કરાવા યોગ્ય) પદાર્થ છે. હવે શૈત કરનારી ખડી, શૈત કરાવા યોગ્ય ભીત આદિ પરદ્રવ્યોની છે કે નહીં? આમ અહીં તેમના તાત્ત્વિક (પારમાર્થિક) સંબંધની વિચારણા થઈ રહી છે.

હવે સૌથી પહેલા આમ વિચારવામાં આવે છે કે જે ખડી ભીત આદિ પરદ્રવ્યોની હોય તો શું થાય - જેનું જે હોય તે તે જ હોય. જેમ જ્ઞાન આત્માનું હોવાથી જ્ઞાન આત્મા જ છે. આ પ્રકારનો તાત્ત્વિક સંબંધ જીવંત (વિદ્યમાન) હોવાથી ખડી જે ભીત આદિની હોય તો પછી તે ખડી ભીત-આદિની જ હોય (અર્થાત् ખડી ભીત - આદિસ્વકૃપ જ હોવી જોઈએ); એમ હોતાં ખડીના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય; પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી; કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યકૃપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે એ સિદ્ધ થયું કે ખડી ભીત આદિની નથી.

હવે આગળ એમ વિચારે છે કે જે ખડી ભીત આદિની નથી તો પછી ખડી કોણી છે ?

જે એમ કહેવામાં આવે કે ખડી ખડીની જ છે તો પ્રશ્ન ઉપસ્થિત થાય કે આ ખડીથી બિજ્ઞ બીજી કઈ ખડી છે કે જેની આ ખડી છે.

તેના ઉત્તરમાં એમ કહેવામાં આવી રહ્યું છે કે આ ખડીથી બિજ્ઞ અન્ય કોઈ ખડી નથી; પરંતુ તેઓ બચ્ચે સ્વ-સ્વામીકૃપ અંશ જ છે.

અહીં સ્વ-સ્વામીકૃપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે ? અર્થાત्

કંઈપણ સાધ્ય નથી. આવી સ્થિતિમાં ખડી કોઈની પણ નથી, ખડી તો ખડી જ છે - આ નિશ્ચય છે.

આ તો દાખાંત છે; હવે આ જ વાતને દ્રાષ્ટાન્ત પર ઘટિત કરે છે.

આ જગતમાં ચેતયિતા અર્થાત્ ચેતનારો આત્મા દર્શનગુણથી પરિપૂર્ણ સ્વભાવવાળું દ્રવ્ય છે અને પુદ્ગલાદિ પરદ્રવ્ય વ્યવહારથી તેના દશ્ય છે.

હવે દર્શક આત્મા પુદ્ગલાદિ દશ્યોનું છે કે નહીં - આ વાતનો તાત્ત્વિક વિચાર કરવામાં આવે છે.

જે ચેતયિતા આત્મા પુદ્ગલાદિ દશ્યોનું હોય તો શું હોય - સર્વપ્રથમ તેનો વિચાર કરે છે. જેનું જે હોય તે તે જ હોય. જેમ દર્શન આત્માનું હોવાથી દર્શન આત્મા જ છે - આવો તાત્ત્વિક સંબંધ જીવંત હોવાથી ચેતયિતા આત્મા જે પુદ્ગલાદિનો હોય તો આત્માએ પુદ્ગલાદિ (સ્વરૂપ) જ થયું જોઈએ અને તેમ થતાં આત્માના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થઈ જશે, પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી; કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપ હોવાનો નિષેધ તો પહેલેથી જ થઈ ચૂક્યો છે. આ પ્રમાણે આમ સિદ્ધ થયું કે ચેતયિતા આત્મા પુદ્ગલાદિનો નથી તો કોનો છે ?

જે એમ કહેવામાં આવે કે ચેતયિતા તો ચેતયિતા જ છે તો ફરી પ્રશ્ન થાય કે ચેતયિતાથી બિજ્ઞ એવો બીજો કયો ચેતયિતા છે કે જેનો આ ચેતયિતા છે ?

ચેતયિતાથી બિજ્ઞ બીજો કોઈ ચેતયિતા નથી; પરંતુ તે બંને સ્વ-સ્વામીરૂપ અંશ જ છે - જે આમ કહેવામાં આવે તો ફરી પ્રશ્ન થાય કે અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે ? તાત્પર્ય છે કે કંઈપણ સાધ્ય નથી. આ પ્રમાણે દર્શક કોઈનો નથી; દર્શક તો દર્શક જ છે - આ નિશ્ચય છે.

આ પ્રમાણે એમ બતાવવામાં આવ્યું છે કે 'આત્મા પરદ્રવ્યને દેખે છે અથવા શ્રદ્ધા કરે છે' - આ વ્યવહાર કથન છે અને 'આત્મા પોતાને

દેખે છે અને શ્રદ્ધા કરે છે' - આ કથનમાં પણ સ્વ-સ્વામી અંશકૃપ વ્યવહાર છે; નિશ્ચય તો એ છે કે દર્શક દર્શક જ છે.

જે પ્રમાણે જ્ઞાયક અને દર્શક પર ઘટિત કરવામાં આવ્યું, હવે તે જ પ્રમાણે અપોહક (ત્યાજક, ત્યાગ કરનાર) પર પણ ઘટિત કરવામાં આવી રહ્યું છે.

ખડી શેત (સફેદ) પદાર્થ છે અને ભીત આદિ શેત્ય (સફેદ કરાવા યોગ્ય) પદાર્થ છે. હવે શેત કરનાર ખડી શેત કરાવા યોગ્ય ભીત આદિ પરદ્રવ્યોની છે કે નહીં? આ પ્રમાણે અહીં તેમના તાત્ત્વિક (પારમાર્થિક) સંબંધની વિચારણા થઈ રહી છે.

હવે સૌથી પહેલા એમ વિચારવામાં આવે છે કે જે ખડી ભીત આદિ પરદ્રવ્યોની હોય તો શું થાય - જેનું જે હોય તે તે જ હોય. જેમ કે જ્ઞાન આત્માનું હોવાથી જ્ઞાન તે આત્મા જ છે. આ પ્રકારનો તાત્ત્વિક સંબંધ જીવંત (વિધમાન) હોવાથી ખડી જે ભીત આદિની હોય તો પછી ખડી તે ભીત જ હોય - આમ થતાં ખડીના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થઈ જશે; પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી; કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યક્રપે સંક્રમણ થવાનો નિષેધ તો પહેલેથી જ થઈ ચૂક્યો છે. તેથી આમ સિદ્ધ થયું કે ખડી ભીત આદિની નથી.

હવે આગળ વિચારવામાં આવે છે કે ખડી ભીત આદિની નથી તો પછી આ ખડી કોણી છે?

જે એમ કહેવામાં આવે કે આ ખડી તો ખડીની જ છે તો પ્રશ્ન ઉપસ્થિત થશે કે આ ખડીથી જુદી એવી બીજી કઈ ખડી છે કે જેની આ ખડી છે?

તેના ઉત્તરમાં એમ કહેવામાં આવે છે કે આ ખડીથી લિન્ન અન્ય કોઈ ખડી નથી; પરંતુ તે બે સ્વ-સ્વામીકૃપ અંશ જ છે.

અહીં સ્વ-સ્વામીકૃપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? અર્થાત્

કંઈપણ સાધ્ય નથી. આવી સ્થિતિમાં ખડી કોઈની પણ નથી, ખડી તો ખડી જ છે - આ નિશ્ચય છે.

આ તો દાખાંત છે; હવે આ જ વાતને દ્રાષ્ટાન્ત પર ઘટિત કરે છે.

આ જગતમાં ચેતયિતા અર્થાત् ચેતનારો આત્મા અપોહનગુણથી પરિપૂર્ણ સ્વભાવવાળું દ્રવ્ય છે અને પુદ્ગલાદિ પરદ્રવ્ય વ્યવહારથી તેના અપોહાય (ત્યાજ્ય, ત્યાગવાયોગ્ય પદાર્થ) છે.

હવે અપોહક આત્મા પુદ્ગલાદિ અપોહયોનો છે કે નહીં - આ વાતનો તાત્ત્વિક વિચાર કરવામાં આવે છે.

આ ચેતયિતા આત્મા પુદ્ગલાદિ અપોહયો (ત્યાજ્ય ત્યાગવા યોગ્ય પદાર્થ) નો હોય તો શું થાય - એનો સૌથી પહેલા વિચાર કરે છે - જેનું જે હોય તે તે જ હોય. જેમ અપોહન આત્માનું હોવાથી અપોહન આત્મા જ છે - આવો તાત્ત્વિક સંબંધ લુંબિત હોવાથી ચેતયિતા આત્મા જે પુદ્ગલાદિનો હોય તો આત્માએ પુદ્ગલાદિ જ થવું જેઈએ અને તેમ થતાં આત્માના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થઈ જશે; પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી; કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યને થવાનો નિષેધ તો પહેલેથી જ થઈ ચૂક્યો છે. આ પ્રમાણે આમ સિદ્ધ થયું કે ચેતયિતા આત્મા પુદ્ગલાદિનો નથી.

હવે આગળ વિચારે છે કે ચેતયિતા આત્મા પુદ્ગલાદિનો નથી તો કોનો છે ?

જે એમ કહેવામાં આવે કે ચેતયિતા ચેતયિતાનો જ છે તો ફરી પ્રશ્ન થાય છે કે ચેતયિતાથી બિજ્ઞ બીજે કયો ચેતયિતા છે કે જેનો આ ચેતયિતા છે ?

ચેતયિતાથી બિજ્ઞ બીજે કોઈ ચેતયિતા નથી; પરંતુ તે બંને સ્વ-સ્વામીકૃપ અંશ જ છે. જે એમ કહેવામાં આવે તો ફરી પ્રશ્ન થાય છે કે અહીં સ્વ-સ્વામીકૃપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે ? તાત્પર્ય એ છે

કે કંઈપણ સાધ્ય નથી. તેવી રીતે અપોહક (ત્યાજક, ત્યાગ કરનાર) કોઈનો નથી; અપોહક તો અપોહક જ છે - આ નિશ્ચય છે.

આ પ્રમાણે એ બતાવવામાં આવ્યું છે કે 'આત્મા પરદ્રવ્યને ત્યાગે છે' - આ વ્યવહાર કથન છે અને 'આત્મા પોતાને ગ્રહણ કરે છે' - આ કથનમાં પણ સ્વ-સ્વામી અંશકૃપ વ્યવહાર છે; નિશ્ચય તો એ છે કે અપોહક (ત્યાજક, ત્યાગનાર) અપોહક જ છે.

હવે વ્યવહારનું વિવેચન કરવામાં આવે છે - જેમ શૈતગુણથી પરિપૂર્ણ સ્વભાવવાળી આ ખડી ભીત આદિ પરદ્રવ્ય સ્વભાવકૃપ ન પરિણમતી થકી અને ભીત આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમવતી થકી, ભીત આદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના શૈતગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઉપજતી થકી ખડી; ખડી જેને નિમિત્ત છે એવા પોતાના (-ભીત આદિના) સ્વભાવના પરિણામ વડે ઉપજતા ભીત આદિ પરદ્રવ્યને, પોતાના (ખડીના) સ્વભાવથી શૈત કરે છે - એમ વ્યવહાર કહેવામાં આવે છે.

તેવી રીતે શાનગુણથી પરિપૂર્ણ સ્વભાવવાળો ચેતથિતા પણ સ્વયં પુદ્ગલાદિ પરદ્રવ્યોના સ્વભાવકૃપ નહિ પરિણમતો થકો અને પુદ્ગલાદિ પરદ્રવ્યોને પોતાના સ્વભાવે નહિ પરિણમવાતો થકો, પુદ્ગલાદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના શાનગુણથી પરિપૂર્ણ સ્વભાવના પરિણામ વડે ઉપજતો થકો; ચેતથિતા જેને નિમિત્ત છે એવા પોતાના (-પુદ્ગલાદિના) સ્વભાવના પરિણામ વડે ઉપજતા પુદ્ગલાદિ પરદ્રવ્યને, પોતાના (ચેતથિતાના) સ્વભાવથી જાણે છે - એમ વ્યવહાર કરવામાં આવે છે.

જેવી રીતે શાનગુણના સંદર્ભમાં વ્યવહારનું વિવેચન કર્યું, હવે તેવી જ રીતે દર્શનગુણના સંદર્ભમાં પણ વિવેચન કરવામાં આવે છે.

જેવી રીતે શૈતગુણથી ભરેલા સ્વભાવવાળી તે ખડી પોતે ભીત-આદિ પરદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતી થકી અને ભીત-આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમવતી થકી, ભીત-આદિ પરદ્રવ્ય જેને

નિમિત્ત છે એવા પોતાના શેતગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઉપજતી થકી આ ખડી; ખડી જેને નિમિત્ત છે એવા પોતાના (ભીતાંત-આદિના) સ્વભાવના પરિણામ વડે ઉપજતા ભીતાંત-આદિ પરદ્રવ્યને પોતાના (ખડીના) સ્વભાવથી શેત કરે છે - એમ વ્યવહાર કરવામાં આવે છે.

તેવી જ રીતે દર્શનગુણથી પરિપૂર્ણ સ્વભાવવાળો ચેતથિતા પણ પોતે પુદ્ગલાદિ પરદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતો થકો અને પુદ્ગલાદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમાવતો થકો, પુદ્ગલાદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના દર્શનગુણથી પરિપૂર્ણ સ્વભાવના પરિણામ વડે ઉપજતો થકો, ચેતથિતા જેને નિમિત્ત છે એવા પોતાના (-પુદ્ગલાદિના) સ્વભાવના પરિણામ વડે ઉપજતા પુદ્ગલાદિ પરદ્રવ્યને પોતાના (-ચેતથિતાના) સ્વભાવથી હેખે છે અથવા શ્રેષ્ઠ છે - એમ વ્યવહાર કરવામાં આવે છે.

જેવી રીતે જ્ઞાન અને દર્શનગુણના સંદર્ભમાં વ્યવહારનું વિવેચન કર્યું, તેવી જ રીતે હવે ચારિત્રગુણના સંદર્ભમાં પણ વિવેચન કરવામાં આવે છે.

જેવી રીતે શેતગુણથી ભરેલા સ્વભાવવાળી તે ખડી પોતે ભીતાંત-આદિ પરદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતી થકી અને ભીતાંત-આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમાવતી થકી, ભીતાંત-આદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના શેતગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઉપજતી થકી આ ખડી; ખડી જેને નિમિત્ત છે એવા પોતાના (ભીતાંત-આદિના) સ્વભાવના પરિણામ વડે ઉપજતા ભીતાંત-આદિ પરદ્રવ્યને, પોતાના (-ખડીના) સ્વભાવથી શેત કરે છે - એમ વ્યવહાર કરવામાં આવે છે.

તેવી જ રીતે ચારિત્રગુણથી પરિપૂર્ણ સ્વભાવવાળો ચેતથિતા પણ પોતે પુદ્ગલાદિ પરદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતો થકો અને પુદ્ગલાદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમાવતો થકો, પુદ્ગલાદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના ચારિત્રગુણથી પરિપૂર્ણ સ્વભાવના પરિણામ

વડે ઉપજતો થકો, ચેતયિતા જેને નિમિત્ત છે એવા પોતાના (-પુહગલાદિના) સ્વભાવના પરિણામ વડે ઉપજતા પુહગલાદિ પરદ્રવ્યને પોતાના (-ચેતયિતાના) સ્વભાવથી અપોહે (ત્યાગે) છે - એમ વ્યવહાર કરવામાં આવે છે."

ઉક્ત સંપૂર્ણ કથનનો સાર આ છે કે જેવો સંબંધ ભીત પર લગાવેલ ખડીનો ભીત સાથે છે; તેવો જ સંબંધ શાયક ભગવાનનો પરજ્ઞેયોની સાથે છે, દર્શક ભગવાન આત્માનો પરદશ્યોની સાથે છે અને અપોહક (ત્યાજક) ભગવાન આત્માનો અપોહ્ય (ત્યાજય) પરપદાર્થોની સાથે છે.

તાત્પર્ય એ છે કે વ્યવહારથી ભલે ખડી ભીતને સફેદ કરનાર કહેવાય છે, ભીતની કહેવાય છે; છતાં વસ્તુસ્થિતિ એ છે કે ખડી અને ભીત અત્યંત બિન્ન પદાર્થ છે; આમ ખડી ખડીની જ છે અને ભીત ભીતની જ છે. ખડી ખડીની જ છે - એમા પણ શું દમ છે; કેમ કે બે ખડી તો નથી, કે જેથી એમ કહી શકાય કે આ ખડી તે ખડીની છે. એક જ ખડીમાં ખડી તો ખડીની જ છે - આમ કહેવાથી શું લાભ છે; એટલું જ પૂરતું છે કે ખડી તો ખડી જ છે.

તેવી જ રીતે વ્યવહારથી ભલે ને જ્ઞાન પરજ્ઞેયોનો જાણનાર કહેવાય છે, પરજ્ઞેયોનો શાયક કહેવાય છે; જ્ઞેયોનો શાયક - એમ કહેવાય છે; છતાં પણ વસ્તુસ્થિતિ તો એ છે કે શાયક અને પરજ્ઞેય અત્યંત બિન્ન પદાર્થ છે; આ રીતે શાયક શાયકનો છે અને જેથે જેયના છે. શાયક શાયકનો જ છે - એમાં પણ શું દમ છે; કારણ કે બે શાયક તો છે નહીં; કે જેથી એમ કહી શકાય કે આ શાયકનો તે શાયક છે એક જ શાયકમાં શાયક શાયકનો છે - આમ કહેવાથી શું લાભ છે; એટલું જ પર્યાપ્ત છે કે શાયક તો શાયક જ છે.

જે પ્રમાણે શાયક આત્મા વિષે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે; તે જ પ્રમાણે દર્શક આત્મા, શ્રદ્ધનાર આત્મા અને ત્યાગી આત્મા વિષે પણ સમજ લેવું.

આ રીતે અહીં જ્ઞાયક આત્માનો, જોયપદ્ધારોની સાથેનો જોય-જ્ઞાયક સંબંધી વ્યવહાર નિષેધવામાં આવ્યો છે અને જ્ઞાયકનો જ્ઞાયક આવા બેદ-વ્યવહારનો પણ નિષેધ કરવામાં આવ્યો છે તેથી જ્ઞાયક તે જ્ઞાયક - આવા નિશ્ચયનું પ્રતિપાદન કરીને દર્શિને સ્વભાવસન્મુખ કરવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે.

જે કે આચાર્ય જ્યસેન તાત્પર્યવૃત્તિમાં પણ આ ગાથાઓનો અર્થ આત્મપ્રાયાતિ અનુસાર જ કરે છે; છતાં પણ કિંચ કહીને જે વાત લખે છે; તે આ પ્રમાણે છે -

“બીજી વાત એ છે કે જે સર્વજ્ઞ ભગવાન પરદ્રવ્યને વ્યવહારથી જાણે છે તો નિશ્ચયથી તેઓ સર્વજ્ઞ સિદ્ધ નહીં થાય ? જે કોઈ એમ કહે છે તો તેનું નિરાકરણ આ પ્રમાણે છે.

સર્વજ્ઞ ભગવાન પોતાના સુખાદિકને જેવી રીતે તન્મય થઈને જાણે છે; તેવી જ રીતે બહિદ્રવ્ય (પરદ્રવ્ય) ને તન્મય થઈને જાણતા નથી - તેથી તેમનું પરદ્રવ્યને જાણવું વ્યવહાર છે.

જે તે બીજના સુખાદિકને પોતાના સુખાદિકની જેમ તન્મય થઈને જાણતા હોય તો જેવી રીતે પોતાના સુખના સંવેદનમાં સુખી થાય છે; તેવી જ રીતે બીજના સુખ-દુ:ખના સંવેદન કાળમાં પણ સુખી-દુ:ખી થઈ જશે; પરંતુ તેમ તો થતું નથી અર્થાત્ સર્વજ્ઞ ભગવાન બીજના સુખ-દુ:ખને જાણીને પણ સુખી-દુ:ખી થતા નથી.

જે કે પોતાના સુખના સંવેદનની અપેક્ષાએ સર્વજ્ઞનું શાન નિશ્ચય છે અને પરના સુખના સંવેદનની અપેક્ષાએ તેમના શાનને વ્યવહાર કહેવામાં આવે છે; છતાં છન્દસ્થ (અલ્પજ્ઞ) ની અપેક્ષાથી પરના સુખને જાણનાં સર્વજ્ઞનું શાન નિશ્ચય જ છે, વાસ્તવિક જ છે, સાચું જ છે; કાલ્પનિક નથી.

જે આમ છે તો આપ તે બૌદ્ધમતીઓને કેમ દોષ ધો છો, જે સર્વજ્ઞતાના વ્યવહારનો સ્વીકાર કરે છે ?

તેના ઉત્તરમાં કહે છે કે જેવી રીતે નિશ્ચયનયની અપેક્ષા વ્યવહાર અસત્યાર્થ છે; તેવી જ રીતે વ્યવહારનયથી પણ વ્યવહાર અસત્યાર્થ છે - બૌદ્ધ આમ માને છે; પરંતુ જૈનમતમાં ભલે ને નિશ્ચયનયથી વ્યવહાર અસત્યાર્થ હોય; પણ વ્યવહારનયથી તો વ્યવહારપણ સત્યાર્થ જ છે.

જે વ્યવહારનયને લોકવ્યવહારથી પણ સત્ય માનવામાં ન આવે તો તો પછી લોકવ્યવહાર પણ મિથ્યા થઈ જશે અને તેમ થતાં દોષ આવશે..”

ઉક્ત કથનથી આ વાત સ્પષ્ટ થાય છે કે આત્માનું પરને જાગૃતું સર્વથા અસત્યાર્થ છે - આ માન્યતા બૌદ્ધમતની છે, જૈનોની નથી. જે લોકો એવું માને છે કે આત્મા પરને જાગૃતો જ નથી; તેમને આચાર્ય જ્યસેનના ઉક્ત કથન પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ.

આ ગાથાઓના ભાવને પૂજ્ય ગુદુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે.

“આ ૧૦ ગાથાઓમાં સેટિકા અર્થાત् ખડીનું દાખાંત આપીને નિશ્ચયનય અને વ્યવહારનયના માધ્યમથી આત્માના જ્ઞાયકસ્વભાવનું સ્પષ્ટીકરણ કરે છે.”^૧

આચાર્ય સમજાવે છે કે આ જગતમાં ચેતનાંનું અર્થાત્ જાળવા-દેખવાવાળાનું જે આત્મતત્ત્વ છે; તે જ્ઞાનગુણથી ભરેલા સ્વભાવાવાળાનું દ્રવ્ય છે અને શરીર-મન-વાણી આદિ પુરુષાદિ પરદ્રવ્ય વ્યવહારથી તે આત્માના જ્ઞેય છે.

પ્રશ્ન:- પરદ્રવ્યને વ્યવહારથી જે જ્ઞેય કર્યું છે, અહીં વ્યવહારનો શું અર્થ છે ?

ઉત્તર:- ચેતનારો આત્મા તો ચેતન્યકૃપ અર્થાત્ જ્ઞાનકૃપ જ છે અને શરીર આદિ પરદ્રવ્ય પરકૃપ જ છે. જ્ઞાન શરીરાદ્વિપે થતું નથી, જ્ઞાન તો શરીરાદ્વિને સ્પર્શ પણ કરતું નથી. જ્ઞાન જ્ઞાનકૃપે રહીને જ પરજ્ઞેયોને જાણે છે. જ્ઞાન લોકાલોકને જાણે છે, પણ તે જ્ઞાનકૃપે જ રહે છે, લોકાલોક થતું

^૧ પ્રવચનરત્નાકર ભાગ ૮, પાનું ૩૦૭

નથી અને લોકાલોક જ્ઞાનરૂપ થતા નથી. તેથી કહ્યું છે કે પુદ્ગલાદિ પરદ્રવ્ય વ્યવહારથી ચેતપિતાના જોય છે.^૧

આત્મા જ્ઞાન-જ્ઞાન-જ્ઞાનસ્વબાબૃપ પ્રકારશનો પુંજ છે. તેના જ્ઞાનની પરિણતિ જે રીતે પુદ્ગલાદિને જાણે છે, તે જ રીતે રાગને પણ જાણે છે.

પ્રશ્ન:- જ્ઞાનની પરિણતિ રાગને રાગરૂપ થઈને જાણે છે કે જ્ઞાનરૂપ રહીને જ જાણે છે ?

ઉત્તર:- વાત બહુ સુફ્ફ્રમ છે, પણ જાણવા જેવી છે. જ્ઞાન જ્ઞાનરૂપ રહીને જ રાગને જાણે છે. ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે. તેના જ્ઞાનની વર્તમાનદશા પોતાના સ્વકાળમાં પોતાથી જ થાય છે. તે જ્ઞાનની પર્યાય રાગાદિને જાણે છે - એમ કહેવું વ્યવહાર છે. રાગને આત્મા કરે છે - આ વાત તો દૂર જ રહી રાગનું કર્તાપણું માનવું તો મૂઢતા છે, મિથ્યાદાદચિન્ન લક્ષણ છે; અહીં તો એમ કહી રહ્યા છે કે દયા-દાન આદિના રાગને આત્મા જાણે છે - એમ કહેવું પણ વ્યવહાર છે.

બાઈ ! ચૈતન્યતત્ત્વ રાગથી બિન્ન છે, અને જાણવાના કાળમાં તે જ્ઞાનપર્યાય જ્ઞાનરૂપ અથવા ચૈતન્યરૂપ જ રહે છે, રાગરૂપ થતી નથી. જે જાણનારો આત્મા રાગને જાણવાના કાળે રાગરૂપ થઈ જય તો આત્માનો અર્થાત્ સ્વરૂપનો નાશ થઈ જય.^૨

અહીં તો કહે છે કે 'જ્ઞાયકને જાણું છું' - એમ કહેવું પણ વ્યવહાર છે; કારણ કે જ્ઞાયક કહેવું પણ વ્યવહાર છે; કારણ કે જ્ઞાયક અને જોયરૂપ બેદ પડે છે ને ? 'અભેદ તે નિશ્ચય અને બેદ તે વ્યવહાર' આ કથન અનુસાર જ્ઞાયકમાં જ્ઞાયક-જોયનો બેદ કરવો પણ વ્યવહાર છે અને એવા સ્વ-સ્વામી અંશરૂપ વ્યવહારથી આત્માથીને કોઈ લાભ નથી; કારણ કે આવા બેદરૂપ વ્યવહારના લક્ષ્યથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતી નથી. અહીં તો જ્ઞાયક જ છે - આ પરમાર્થ છે અર્થાત્ એક, શુદ્ધ જ્ઞાયકની અંતર્દાચિ થવી ને સમ્યગ્દર્શન છે અને તે જ કર્તવ્ય છે, ધર્મ છે.^૩

૧ પ્રવચન રત્નાકર ભાગ ૮, પાનું ૩૦૮ ૨ પ્રવચન રત્નાકર ભાગ ૮, પાનું ૩૦૮-૩૦૯

૩ પ્રવચન રત્નાકર ભાગ ૮, પાનું ૩૧૦

આ પ્રમાણે અહીં એમ કહ્યું છે કે -

- ૧ ‘આત્મા પરદ્રવ્યને જાણો છે’ - આ વ્યવહારનું કથન છે.
- ૨ ‘આત્મા પોતાને જાણો છે’ - એમ કહેવું તે પણ સ્વ-સ્વામી અંશકૃપ વ્યવહાર છે.
- ૩ ‘જ્ઞાયક જ્ઞાયક જ છે’ - આ નિશ્ચય છે.

આ જગતમાં ચેતથિતા ભગવાન આત્મા જ્ઞાયકની જેમ જ દર્શનગુણ અને શ્રદ્ધાગુણથી પરિપૂર્ણ સ્વભાવથી ભરેલું દ્રવ્ય છે. અહીં દર્શનગુણથી ભરેલ કહીને દેખવાકૃપ અને શ્રદ્ધાકૃપ - બંને ગુણોની વાત કરી છે.

આગળ તો એમ પણ કહેશે કે દેખનારાને દેખવો અને શ્રદ્ધા કરનારની શ્રદ્ધા કરવી - એ પણ વ્યવહારનય છે.

આ પ્રમાણે અહીં એમ કહેવામાં આવ્યું છે કે -

૧. આત્મા પરદ્રવ્યને દેખે છે અથવા શ્રદ્ધાન રે છે - આ વ્યવહારકથન છે.
૨. આત્મા પોતાને જુએ છે અથવા શ્રદ્ધાન રે છે - આમ કહેવામાં પણ સ્વ-સ્વામી અંશકૃપ વ્યવહાર છે.
૩. દર્શક દર્શક જ છે - આ નિશ્ચય છે.

આમ ઉપર્યુક્ત કથનમાં અહીં એમ બતાવ્યું છે કે -

૧. આત્મા પરદ્રવ્યનો અપોહક છે, નિષેધક છે અર્થાત્ પરદ્રવ્યને ત્યાગે છે તે વ્યવહાર કથન છે.
૨. આત્મા જ્ઞાનદર્શનમય પોતાને ગ્રહણ કરે છે - આમ કહેવામાં પણ સ્વ-સ્વામી અંશકૃપ વ્યવહાર છે.
૩. અપોહક અપોહક જ છે - આ નિશ્ચયનું કથન છે.

હવે વ્યવહારનું કથન કરે છે.

જુઓ, શેતગુણથી ભરેલા સ્વભાવવાળી આ ખડી પોતે ભીત આદિ

પરદ્રવ્યના સ્વભાવે પરિણમતી નથી અને આ ખડી ભીત આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવકુપે પરિણમાવતી નથી. ખડી તો ખડી જ છે અને ખડીકુપ જ રહે છે તે પોતે ભીતકુપ થતી નથી અને ભીતને પોતાના શૈતકુપે પણ કરતી નથી.

હા, જ્યારે ખડી પોતાની પર્યાયમાં સફેદકુપે ઉપજે છે ત્યારે પરદ્રવ્યકુપ ભીત તેમાં નિમિત્તકુપે ત્યાં હોય છે.

તે જ પ્રમાણે ચેતપિતા પ્રભુ આત્મા શાનગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. આવો શાનસ્વભાવી આત્મા પુદ્ગલાદિ પરદ્રવ્યના સ્વભાવકુપે પરિણમતો નથી અને આત્મા પુદ્ગલાદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવકુપ, શાનપણે પરિણમાવતું નથી.^૧

અહા ! ભગવાન આત્મા ચૈતન્યમાત્ર વસ્તુ છે અને જાણબું, દેખબું, શ્રદ્ધા કરવી અને નિવર્તનું આદિ તેના પરિણામ છે.^૨

આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે કર્તા-કર્મ અને ભોક્તા-ભોગ્ય સંબંધી વ્યવહારનો નિષેધ તો પહેલા જ કરી દીધેલ; હવે અહીં શાતા-શેય સંબંધી વ્યવહારનો પણ નિષેધ કરીને જ્ઞાયક તે જ્ઞાયક - આવા નિશ્ચયની સ્થાપના કરવામાં આવી રહી છે.

આ બાદ આચાર્ય અમૃતચંદ્ર આત્મઘ્�યાતિમાં ત્રણ કળશ લખે છે; જેમાં બે છંદ ઉક્ત ગાથાઓમાં પ્રચ્છિત ભાવના પોષક છે અને ત્રીજે છંદ આગામી ગાથાઓની સૂચના કરે છે.

ઉક્ત દશ ગાથાઓના ભાવને પોષતા આ બે કળશ આ પ્રમાણે છે.

(શાર્દૂલવિક્રિડિત)

શુદ્ધદ્રવ્યનિરૂપણાર્પિતમતેસ્તત્ત્વં સમુત્પશ્યતો
નैકદ્રવ્યગતં ચકાસ્તિ કિમપિ દ્રવ્યાંતરं જાતુચિત् ।

૧ પ્રવચન રત્નાકર ભાગ ૮, પાનું ૩૧૦

૨ પ્રવચન રત્નાકર ભાગ ૮, પાનું ૩૧૦

ज्ञानं ज्ञेयमवैति यतु तदयं शुद्धस्वभावोदयः
किं द्रव्यांतरचुंबनाकुलधियस्तत्त्वाच्चयवंते जनाः ॥२१५॥

(हरिगीत)

शुद्धात्मना निःपाण महीं करी बुद्धिने स्थापित अने
निजतत्त्वने ज अनुभवे छे, भासतुं ते पुरुषने -
नहीं एक द्रव्य प्रवेशतुं को' अन्य द्रव्य महीं अने
छे शान आगे ज्ञेयने ते ज्ञाननो ज उद्य घरे;
तो 'ज्ञान स्पर्शे अन्यने' - क्यम लोक ऐवुं मानीने,
बहु आकुलित थर्थि स्वरूपथी चलित ज्ञान थाय छे ? २१५

जे नी बुद्धि शुद्ध तत्त्वना निःपणमां लागी छे अने जे ज्ञानी ज्ञव
तत्त्वने सारी रीते जाणे छे, अनुभवी छे; तेने एक द्रव्यनी अंदर भीजुं
कोई अन्य द्रव्य रहे छे - ऐवुं क्यारे पाण भासतुं नथी. जे ज्ञान ज्ञेयने
जाणे छे तो ते तो ज्ञानना शुद्धस्वभावनो उद्य छे. आम होवा छतां पाण
ज्ञान अन्य द्रव्यने स्पर्शे छे एवी मान्यताथी आकुणबुद्धिवाणा कोई लोको
तत्त्व (शुद्धस्वरूप)थी केम अ्युत थाय छे ?

(मन्दक्रान्ता)

शुद्धद्रव्यस्वरसभवनात्किं स्वभावस्य शेष-
मन्यद्रव्यं भवति यदि वा तस्य किं स्यात्स्वभावः ।
ज्योत्स्नारूपं स्नपयति भुवं नैव तस्यास्ति भूमि
ज्ञानं ज्ञेयं कलयति सदा ज्ञेयमस्यास्ति नैव ॥२१६॥

(हरिगीत)

निजरसउपे द्रव्ये परिगमे तेथी कटीये द्रव्य को',
नहीं थाय अन्य स्वभावनुं, न स्वभाव को' परद्रव्यनो;
ज्योत्स्ना भले उज्जवल करे पाण पृथ्वी तेनी थाय ना,
त्यम ज्ञान आगे ज्ञेयने पाण ज्ञेय ज्ञाननुं थाय ना. २१६

શુદ્ધદ્રવ્યનું નિજરસઙ્ગપે પરિણામન થાય છે અર્થાત્ આત્મા જ્ઞાનાદિ સ્વભાવઙ્ગપે પરિણામે છે; તે કારણે શું બીજું કોઈ દ્રવ્ય જ્ઞાનાદિ સ્વભાવનું થઈ શકે અથવા શું જ્ઞાનાદિ સ્વભાવ કોઈ અન્ય દ્રવ્યનો થઈ શકે? નહીં કદાપિ નહીં; કારણ કે પરમાર્થથી તો એક દ્રવ્યનો અન્ય દ્રવ્યની સાથે કોઈ સંબંધ છે જ નહીં.

જે કે ચાંદનીનું રૂપ પૃથ્વીને ઉજાવલ કરે છે, છતાં પણ પૃથ્વી ચાંદનીની થઈ જતી નથી; તેવી જ રીતે ભલે જ્ઞાન જોયને જાણે છે; તો પણ જોય જ્ઞાનનું તો થઈ જતું નથી.

ઉક્ત બંને કળશોનો સાર આ છે કે જ્ઞાનનું સમસ્ત જોયોને જાણવું તે કોઈ અપરાધ નથી; પરંતુ જ્ઞાનના સ્વભાવનો જ ઉદ્દ્દ્ય છે. જેમ ચાંદની પૃથ્વી પર પડતાં પૃથ્વી ચાંદનીની થઈ જતી નથી; તેવી જ રીતે જોયોને જાણવાથી જોય જ્ઞાનના થઈ જતા નથી. તેથી જે પરપરાર્થ પોતાના જ્ઞાનના જોય બનતા હોય તો આકૃણિત થવાની જરૂર નથી; કારણ કે પરને જાણવું પણ જ્ઞાનનું સ્વભાવરૂપ પરિણામન જ છે, વિકાર નથી વિભાવપરિણામન નથી.

ઉક્ત કળશોનો ભાવ સ્પષ્ટ કરતાં કળશાલીકાકાર પાંડે રાજમલજી લખે છે -

“ભાવાર્થ આમ છે કે જેમ અજિનનો દાહક સ્વભાવ છે, સમસ્ત દાહ્ય વસ્તુને બાળે છે. બળતી થકી અજિન પોતાના શુદ્ધસ્વરૂપે છે. અજિનનો આવો જ સ્વભાવ છે. તેવી જ રીતે જીવ જ્ઞાનસ્વરૂપ છે, સમસ્ત જોયોને જાણે છે. જાણતો થકો પોતાના સ્વરૂપે છે - આવો વસ્તુનો સ્વભાવ છે. જોયોને જાગ્રવાથી જીવનું અશુદ્ધપાણું માને છે તે નહીં માન, જીવ શુદ્ધ છે.

ભાવાર્થ આમ છે કે જીવ સમસ્ત જોયોને જાણે છે, જ્ઞાન જ્ઞાનરૂપ છે, જોય વસ્તુ જોયરૂપ છે. કોઈ દ્રવ્ય પોતાના દ્રવ્યત્વને છોડીને અન્ય દ્રવ્યરૂપ

તો થયું નથી. જીવ સમસ્ત જૈયોને જાણો છે, સમસ્ત જૈયોથી ભિન્ન છે - આવો સ્વભાવ સમ્યગદારી જીવ જાણો છે.

ભાવાર્થ આમ છે કે જેમ જ્યોતસ્ના ફેલાય છે, સમસ્ત ભૂમિ શેત થાય છે. તો પણ જ્યોતસ્નાનો અને ભૂમિનો સંબંધ નથી. તેવી જ રીતે જ્ઞાન સમસ્ત જૈયોને જાણો છે, છતાં પણ જ્ઞાનનો જૈયો સાથે સંબંધ નથી. આવો વસ્તુનો સ્વભાવ છે. તેથી જીવનું જ્ઞાન સમસ્ત જૈયોને જાણો તો જાણો; તો પણ જીવ પોતાના સ્વરૂપે છે.”

આ જ તથયને કોઈ કવિએ એક પંક્તિમાં આ પ્રમાણે વ્યક્ત કર્યું છે -

ભૂમિ ન હોત ચાંદની કી જ્યોં ત્યોં નહિં ધની જ્ઞેયકો જ્ઞાની ।

જેવી રીતે ચાંદનીથી પ્રકાશિત માત્ર થવાથી ભૂમિ ચાંદનીની થર્ડ જતી નથી; તેવી જ રીતે જાણવા માત્રથી જ્ઞાની જીવ જૈયોનો સ્વામી થર્ડ જતો નથી.

ઉક્ત બંને કળશોનો ભાવાનુવાદ કવિવર બનારસીદાસજીએ નાટક સમયસારમાં અનેક છંદોથી આ પ્રમાણે કર્યો છે.

(તેઝસા સવૈયા)

જ્ઞેયાકાર ગ્યાન કી પરણતિ, વૈ વહ ગ્યાન જ્ઞેય નહિ હોડ ।

જ્ઞેયરૂપ ષટ દરબ ભિન્ન પદ, ગ્યાનરૂપ આતમ પદ સોડ ॥

જાનૈ ભેદભાત સુ વિચચ્છન, ગુણ લચ્છન સમ્યક્દ્રિગ જોડ ।

મૂરખ કહૈ ગ્યાનમય આકૃતિ, પ્રગટ કલંક લખૈ નહિ કોડ ॥

જે કે જ્ઞાન જૈયો જેવા આકારે પરિણામે છે, જ્ઞેયાકાર થાય છે; છતાં જ્ઞાન જૈયરૂપ થર્ડ જતું નથી; તે જ્ઞાન જ્ઞાનરૂપ જ રહે છે. જૈયરૂપ છયે દ્રવ્ય અલગ છે અને જ્ઞાનરૂપ આત્મા અલગ પદાર્થ છે.

વિચક્ષણ સમ્યગદારી પુરુષ તો ગુણ અને લક્ષણોના આધારે આ

ભિત્તાને ભતી-ભાંતિ જાણે છે; પરંતુ મૂર્ખ લોકો કહે છે કે જ્ઞાયોને જાણવાથી જ્ઞાન અશુદ્ધ થઈ જય છે; પણ તેમની આ સમજાણ બરોબર નથી.

(ચૌપાઈ)

નિરાકાર જો બ્રહ્મ કહાવૈ । સો સાકાર નામ ક્યાં પાવૈ ॥

જ્ઞાયાકાર ગ્યાન જબ તાંડી । પૂરન બ્રહ્મ નાંહિ તબ તાંડી ॥

જ્ઞાયાકાર બ્રહ્મ મલ માનૈ । નાસ કરનકૌ ઉદ્દિમ ઠાનૈ ॥

વસ્તુ સુભાવ મિટૈ નહિ ક્યાં હી । તાતે ખેદ કરેં સઠ યાં હી ॥

કોઈ અજ્ઞાની કહે છે કે જે આત્મા (બ્રહ્મ) નિરાકાર છે, તે સાકાર કેમ થઈ શકે ? તેથી જ્યાં સુધી જ્ઞાન જ્ઞાયાકાર રહે છે, ત્યાંસુધી તે પૂર્ણ બ્રહ્મ અર્થાત् શુદ્ધાત્મા થઈ શકતો નથી.

જ્ઞાયાકારે પરિણભિત આત્માને અશુદ્ધ માનનારા જ્ઞાયોને જાણવાનો નિષેધ કરે છે, જ્ઞાયોને જાણવાનો અભાવ કરવાનો પુરુષાર્થ કરે છે; પરંતુ જ્ઞાયોને જાણવું તે તો જ્ઞાનનો સ્વભાવ છે; તે કેમ મટી શકે ? આમ તે તો કોઈ સ્થિતિમાં મટતું નથી અને મૂર્ખ લોકો નકામા બેદ-ભિત્ત થતા રહે છે.

(દોહા)

મૂડ મરમ જાનેં નહીં, ગહૈ એકંત કુપક્ષ ।

સ્યાદવાદ સરવંગ નૈ, માનૈ દક્ષ પ્રતક્ષ ॥

સુદ્ધ દરબ અનુભ્રી કરૈ, સુદ્ધદ્રિષ્ટિ ઘટમાંહિ ।

તાતે સમકિતવંત નર, સહજ ઉછેદક નાંહિ ॥

મૂર્ખ લોકો આ ભર્મને તો જાણતા નથી અને એકાંતથી જૂઠા પક્ષને ગ્રહણ કરી લે છે; જ્યારે દક્ષ (ચતુર) લોક સર્વનયોને સર્વાંગ જાણીને સ્યાદવાદી થઈ જય છે.

શુદ્ધદ્રિષ્ટિસંપન્ન સમ્યગ્દાચિ લુધ પોતાના અંતરમાં શુદ્ધદ્રવ્યનો અનુભવ કરે છે; તેથી તે જ્ઞાનનો જ્ઞાયોને જાણવાના સહજ સ્વભાવનો ઉચ્છેદ કરતા નથી.

(સવैયા ઇકતીસા)

જૈસેં ચંદકિરનિ પ્રગટિ ભૂમિ સેત કરૈ,
 ભૂમિ સી ન દીસે સદા જોતિ સી રહતિ હૈ ।
 તૈસેં ગ્યાન સકતિ પ્રકાસૈ હેય ઉપાદેય,
 જ્ઞેયાકાર દીસે પૈ ન જ્ઞેય કોં ગહતિ હૈ ॥
 સુદ્ધ વસ્તુ સુદ્ધ પરજાઇરૂપ પરિનવૈ,
 સત્તા પરવાં માહેં ઢાહેં ન ઢહતિ હૈ ।
 સો તૌ ઔરસૂપ કબહું ન હોડી સરવથા,
 નિહચૈ અનાદિ જિનવાની યોં કહતિ હૈ ॥

જેમ ચંદ્રમાના કિરણો ભૂમિને પ્રકાશિત કરતાં છતાં પણ ભૂમિ જેવા દેખાતા નથી, પરંતુ જ્યોતિર્ઝપ જ રહે છે; તેવી જ રીતે શાનશક્તિ હેય-ઉપાદેય જ્ઞેયાકારોને પ્રકાશે છે, પણ જ્ઞેયોને ગ્રહણ કરતી નથી અર્થાત્ જ્ઞેયોર્ઝપ થઈ જતી નથી; તેમનાથી બિન્ન જ રહે છે.

શુદ્ધ આત્મવસ્તુ શુદ્ધપર્યાયર્ઝપે પરિણમે છે અને નિજ સત્તાપ્રમાણ જ રહે છે; તે કોઈ પણ રૂપે ઢળતી નથી, વિચલિત થતી નથી; તે અન્યરૂપ ક્યારેય થતી નથી આ નિશ્ચયની વાત અનાદિકાલીન જિનવાણીમાં કહેવામાં આવી છે.

આ કળશોનો ભાવ પૂજ્ય ગુરુદેવ આ પ્રમાણે રૂપદ્ધ કરે છે - “અહીં કહે છે કે આત્મા ઉત્પાદ-વ્યય-ધૌવ્યમય ત્રિસત્તવસ્વરૂપ છે. તેમાં ઉત્પાદ-વ્યયરૂપ પર્યાયો છે અને ત્રિકાળી એકરૂપ ધ્યુવદ્રવ્ય છે. ત્રિકાળી એકરૂપ ધ્યુવ દ્રવ્ય નિશ્ચયનયનો વિષય છે; કારણ કે તે પણ અંશ છે ને ? એક સમયની પર્યાય પણ અંશ છે અને ત્રિકાળી ધ્યુવ દ્રવ્યપણ અંશ છે; પરંતુ તે ધ્યુવદ્રવ્ય પણ દાખિભાં સ્થાપિત કરવા માટે પોતામાં પૂર્ણ છે, શુદ્ધ એકરૂપ છે અહા ! આવા ત્રિકાળી શુદ્ધ, ચૈતન્ય સામાન્ય, ધ્યુવ એક જ્ઞાયકલાવરૂપ દ્રવ્યને જેણે દાખિભાં સ્થાપિત કર્યું તે સમ્યગદાખિ છે.

અંદરમાં વસ્તુ અનંત-અનંત ગુણસ્વરૂપ શુદ્ધ ચૈતન્ય ચમત્કાર છે. તેના અનુભવમાં જે પોતાની બુદ્ધિને સ્થાપિને શુદ્ધતત્ત્વનો અનુભવ કરે છે; તે

સમ્યગદિપિ પુરુષને એક દ્રવ્યની અંદર કોઈ પણ અન્ય દ્રવ્ય રહેલું ભાસિત થતું નથી. આ તો ચોથા ગુણસ્થાનની વાત છે. પાંચમા ગુણસ્થાનવાળા શાવકની અને છઠા-સાતમા ગુણસ્થાનવાળા મુનિરાજેની દરાં તો કંઈક અલૌકિક જ હોય છે.^૧

આ શરીર, મન, વાળી, પંચપરમેષ્ઠી ભગવંત અને પુરુષ-પાપના ભાવ આદિ પરજોય છે; તેમને જે જ્ઞાન જાણો છે; તે તો જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદ્ઘય છે. જ્ઞાનનો સ્વ-પર પ્રકાશક સ્વભાવ છે ને! વળી તે સ્વ-પરપ્રકાશકપણું પર્યાયમાં પ્રગટ થતાં તે જ્ઞાન જોયોને જાણો છે; પરંતુ તેનો અર્થ એવો નથી કે ને જ્ઞાન જોયોથી થયું છે. જોયોને પ્રકાશતી પોતાની જે જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ, તે જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદ્ઘય છે અર્થાત્ તે જ્ઞાનના સ્વભાવ-સામર્થ્યથી પ્રગટ થઈ છે.^૨

જ્ઞાન જોયોને જાણો છે; પરંતુ તે જ્ઞાન તે જોયોને સ્પર્શતું નથી. છતાંપણ અજ્ઞાની જીવ આવી મિથ્યા-માન્યતાથી આકૃલિત થાય છે કે 'જોયોને લીધે જ્ઞાન થાય છે.' - આ રીતે જોયોમાં અટકવાથી પોતાના નિજચિદાનંદભય શુદ્ધ આત્માને છોડી દે છે.^૩

ભાઈ ! જ્ઞાન પરને જાણો છે; પરંતુ પરનો સ્પર્શ કરતું નથી અર્થાત્ પરક્રમ થઈ જતું નથી અને જ્ઞાન પરને જાણો છે; પરંતુ પરજોય જ્ઞાનમાં પ્રવિષ્ટ થતાં નથી અર્થાત્ પરજોયોને લીધે જ્ઞાન થતું નથી, આત્મામાં જોયકૃત અશુદ્ધતા આવતી નથી.^૪

જ્ઞાનમાં આ જે કર્મ, નોકર્મ આદિ પરદ્રવ્યો પ્રતિભાસતા થકા પ્રતીત થાય છે, તે તો જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે. તેમાં પરદ્રવ્યનું કોઈ કાર્ય નથી. રાગાદિ પુરુષ-પાપના ભાવ તથા કર્મ, નોકર્મ આદિ જે જ્ઞાનમાં જણાય છે, તે તો જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે.

૧ તે જ, પાનું ૩૧૨

૨ તે જ, પાનું ૩૧૩

૩ પ્રવચન રત્નાકર ભાગ ૬, પાનું ૩૧૭

૪ તે જ, પાનું ૩૨૭

જ્ઞાનાંદસ્વકૃપી ભગવાન આત્માનું અંતરમાં લક્ષ્ય કરતાં જે જ્ઞાન પ્રગટ થયું. તે જ્ઞાન રાગાદિને અને શરીર-મન-વાણી આદિને જાણે છે; પરંતુ તે જ્ઞાન જૈયોને સ્પર્શિતું નથી. જ્ઞાનસ્વકૃપી પ્રભુ સ્વયં જ્ઞાનમાં રહીને જૈયોને જાણે છે; પણ જ્ઞાન જૈયોમાં જતું નથી અને જૈય જ્ઞાનમાં પ્રવેશતા નથી.^૧

હવે કહે છે કે લોકો જ્ઞાનમાં પરદ્રવ્યોનો પ્રતિભાસ જોઈને - એવું માને છે કે પરને લીધે જ્ઞાન થાય છે, તેઓ અજ્ઞાની છે. દેવ-શાસ્ત્ર-ગુરુ પણ પરદ્રવ્ય છે. તેથી તેમને લીધે જ્ઞાન થવું માનવું પણ અજ્ઞાન છે. જે કે જ્ઞાન થવાના કાળમાં તેઓ બાહ્યનિમિત્ત છે; પરંતુ તેઓ જ્ઞાનોત્પત્તિમાં વાસ્તવિક કારણ નથી.^૨

આચાર્ય કરુણા કરીને કહે છે કે એરેરે ! આ જગત પરજ્ઞેયોની સાથે પરમાર્થ સંબંધ માનીને પરાધીન થઈને શુદ્ધ તત્ત્વથી ભ્રષ્ટ થઈને કયાં ભટકી રહ્યો છે ?^૩

આત્માનું જ્ઞાન નિજરસથી પ્રગટ થાય છે અને પોતાના સામર્થ્યથી પરજ્ઞેયોને જાણે છે. તેને પરજ્ઞેયોની અને કોઈપણ બાહ્ય નિમિતોની અપેક્ષા નથી. પરમાર્થથી એક દ્રવ્યનો અન્ય દ્રવ્યની સાથે સંબંધ નથી.^૪

જેમ ચાંદની પૃથ્વીને ઉજાજવલ કરે છે તો પણ પૃથ્વી ચાંદનીકૃપ થઈ જતી નથી અને ચાંદની પણ પૃથ્વીકૃપ થતી નથી; તે જ રીતે જ્ઞાન જૈયોને સહા જાણે છે, તો પણ જ્ઞાન જૈયકૃપ થતું નથી અને જૈયપણ જ્ઞાનકૃપ થતા નથી. ભાઈ ! પ્રત્યેક પદાર્થ બિજ્ઞ-બિજ્ઞ છે. બિજ્ઞ-બિજ્ઞ તત્ત્વોને મેળવીને એક માનવા તે મિથ્યા છે.”^૫

આ પ્રમાણે આ કળશોમાં એ જ કહેવામાં આવ્યું છે કે સ્વ અને પર બધાને જાણવું તે આત્માનો સ્વભાવ છે. વિભાવ નથી. પરજ્ઞેયોને

૧ પ્રવચનરત્નાકર ભાગ ૬, પાનું ૩૩૪-૩૩૫

૨ પ્રવચનરત્નાકર ભાગ ૬, પાનું ૩૩૫

૩ તે જ, પાનું ૩૩૭

૪ તે જ, પાનું ૩૩૭

૫ પ્રવચનરત્નાકર ભાગ ૬, પાનું ૩૩૮

જણવાથી ન તો જ્ઞાન જૈયડુપ થાય છે અને ન તો જૈય જ્ઞાનડુપ થાય છે; બંને સંપૂર્ણ અસંપૂર્કત જ રહે છે તેથી પરને જણતાં અપરાધબોધ થવાની રંઘમાત્ર પણ આવશ્યકતા નથી.

હવે આગળની ગાથાઓની સૂચના આપનાર કળશકાલ્ય લખે છે; જે આ પ્રમાણે છે.

(મન્દક્રાન્તા)

રાગદ્વેષદ્વયમુદ્યતે તાવદેતન્ન યાવત्
 જ્ઞાનં જ્ઞાનં ભવતિ ન પુનર્બોધ્યતાં યાતિ બોધ્યમ् ।
 જ્ઞાનં જ્ઞાનં ભવતું તદિદં ન્યકૃતાજ્ઞાનભાવં
 ભાવાભાવી ભવતિ તિરયન્ યેન પૂર્ણસ્વભાવઃ ॥૨૧૭॥

(હરિગીત)

અજ્ઞાનભાવ દૂરે કરી આ જ્ઞાન જ્ઞાનડુપે થજો,
 અટકાવી ભાવ-અભાવને પૂરાણ સ્વભાવ પ્રગટ થજો. ૨૧૭

જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનડુપ ન થઈ જય અને જૈય જૈયડુપ ન થઈ જય;
 ત્યાંસુધી જ રાગ-દ્રેષ ઉત્પન્ન થાય છે. તેથી આ જ્ઞાન અજ્ઞાનભાવને દૂર
 કરીને જ્ઞાનડુપ હો કે જેથી ભાવ-અભાવ (રાગ-દ્રેષ) ને રોકતો થકો
 પૂર્ણસ્વભાવ પ્રગટ થઈ જય.

આ કળશનો ભાવાનુબાદ કવિવર પંડિત બનારસીદાસજી નાટક
 સમયસારમાં આ પ્રમાણે કરે છે.

(સવૈયા તેઝસા)

રાગ વિરોધ ઉદૈ જબલોં તબલોં, યહ જીવ મૃષા મગ ધાવૈ ।
 ગ્યાન જગ્યો જબ ચેતન કૌ તબ, કર્મ દસા પરરૂપ કહાવૈ ॥
 કર્મ વિલેછિ કરૈ અનુભૌ તહાં, મોહ મિથ્યાત પ્રવેસ ન પાવૈ ।
 મોહ ગયે ઉપજૈ સુખ કેવલ, સિદ્ધ થયૌ જગમાંહિ ન આવૈ ॥

અજ્ઞાનને લીધે જ્યાં સુધી રાગ-દ્રેષ રહે છે; ત્યાં સુધી આ લુલ ખોટા
 રસ્તા પર ચાલે છે અને જ્યારે આત્મજ્ઞાન થઈ જય છે ત્યારે કર્મોભા પર

બુદ્ધિ થઈ જય છે. કર્માનો અભાવ કરીને જ્યારે જીવ આત્માનુભવ કરે છે; ત્યારે મોહ પ્રવેશતો નથી. મોહનો સંપૂર્ણ અભાવ થઈ જતાં, અનંતસુખ પ્રગટ થઈ જય છે અને સિદ્ધપદને પ્રાપ્ત કરીને આત્મા સદાય ત્યાં જ રહે છે. ફરીથી સંસારમાં પાછો આવતો નથી.

ઉક્ત કળશનો ભાવ પૂજ્ય ગુરુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે -

“આહો ! બધાને જાણવા અને દેખવાકૃપ તારો શાતા-દાજા સ્વભાવ છે. કોઈ પણ પરદ્રવ્યને પોતાના માનવાનો તારો સ્વભાવ નથી. જલે તે વ્યવહારરત્નત્રયનો વિકલ્પ હોય કે દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાનો રાગ હોય - આ બધા પરભાવ છે, પરજ્ઞેય છે; તેમાં જ્ઞાની સ્વામિત્વબુદ્ધિ કરતો નથી. જ્ઞાનીના જ્ઞાનથી રાગ બિજ્ઞ જ હોય છે. તેમના જ્ઞાનમાં રાગનો પ્રવેશ જ નથી. જ્ઞાન પોતામાં રહીને રાગને જાણો છે.

ભગવાન આત્મા ત્રિકાળ શાશ્વત એક જ્ઞાનસ્વરૂપી વસ્તુ છે. તેને ભૂલીને જ્યાંસુધી જીવ દેહાદિને અને રાગ-દ્રેષ્ટ આદિને પોતાના માને છે, ત્યાંસુધી તેને અજ્ઞાનભાવ છે અને જ્યાં સુધી અજ્ઞાનભાવ છે, ત્યાં સુધી રાગ-દ્રેષ્ટ ઉત્પન્ન થાય છે અને સંસાર ઉભો રહે છે. આચાર્ય કહે છે કે અજ્ઞાનભાવને દૂર કરીને જ્ઞાન-જ્ઞાનકૃપ હો અને જ્ઞેય જ્ઞેયકૃપ જ રહો - જેથી ભાવ-અભાવને અર્થાત્ રાગ-દ્રેષ્ટકૃપ ઉત્પાદ-વ્યયને રોકીને પૂર્ણસ્વભાવ પ્રગટ થઈ જય છે.

ભાઈ ! રાગ કેટલો પણ સૂક્ષ્મ કેમ ન હો; પરંતુ જ્યાંસુધી તેમાં ભમત્વ છે અને તેને હિતકર માનવાની બુદ્ધિ છે; ત્યાંસુધી અજ્ઞાનભાવ જ છે અને ત્યાંસુધી જીવમાં રાગ-દ્રેષ્ટનો દ્વંદ્વ પ્રગટ થતો જ રહે છે. તેથી વિપરીત જેને પોતાની શુદ્ધ ચૈતન્ય સત્તાનું અંતરમાં ભાન થઈ ગયું છે - એવા સમકિતી ઘર્મિપુર્ખોને અજ્ઞાનભાવ દૂર થઈ જય છે અને પછી તેને અજ્ઞાનમય રાગ-દ્રેષ્ટની ઉત્પત્તિ નથી. તે દેહાદિ પરજ્ઞેયોને પરકૃપ જાણીને નિજસ્વભાવમાં સ્થિર થતો જય છે. આવી રીતે જ્ઞાનસ્વભાવમાં વિરોષ-વિરોષ રમણતા

કરતો થકો તે પૂર્ણ સ્વભાવને અર્થાત् કેવળજ્ઞાનસ્વભાવને પ્રાપ્ત કરી લે છે. અહો ધર્માજીવની આવી અચિંત્ય અલૌકિક ભાવના હોય છે.^૧

ભાઈ ! તાત્પર્ય આ છે કે આત્મા નિત્ય જ્ઞાનસ્વરૂપી વસ્તુ છે અને રાગાદિ જ્ઞાનમાં માત્ર જ્ઞાણવા લાયક પરક્ષેય છે, જ્યાંસુધી જ્ઞાન જ્ઞાનરૂપ થઈ જતું નથી અને શૈય જોયરૂપ રહેતા નથી, ત્યાં સુધી રાગ-દ્રેષ ઉત્પન્ન થાય છે. અહીં મિથ્યાત્વ સંબંધી રાગ-દ્રેષની વાત છે; તેથી કહે છે કે કે પોતાના અજ્ઞાનભાવને દૂર કરીને જ્ઞાનરૂપ જ થઈ જાઓ.

મારો સ્વભાવ તો નિકાળ જ્ઞાણરૂપ જ છે જ્યારે આવું જ્ઞાન જ્ઞાનરૂપ થાય છે, ત્યારે ધર્મ પુરુષને રાગ-દ્રેષ ઉત્પન્ન થતા જ નથી. આ પ્રમાણે રાગ-દ્રેષ મટી જય છે અને સ્વરૂપની એકાગ્રતા દ્વારા જ્ઞાન પૂર્ણ સ્વભાવને પ્રાપ્ત થઈ જય છે.

નેકે ધર્મ-જ્ઞાનીને અસ્થિરતા સંબંધી કંઈક રાગ હોય છે; પરંતુ તેનો તે જ્ઞાતા જ રહે છે અને કબે-કબે જ્ઞાનસ્વભાવની એકાગ્રતાનો પુરુષાર્થ કરીને તેનો પણ અભાવ કરીને પૂર્ણ સ્વભાવને પ્રાપ્ત થઈ જય છે.^૨

આ પ્રમાણે આ કળશમાં એમ જ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી જ્ઞાન અને શૈયોનું અંતર ઘ્યાલમાં આવતું નથી અર્થાત् શૈયોને જ્ઞાતા થકા પણ જ્ઞાન જોયરૂપ થતું નથી અને શૈય જ્ઞાનરૂપ થતા નથી - આ વાત ઘ્યાલમાં આવતી નથી; ત્યાંસુધી અજ્ઞાનભાવ રહે છે અને જ્યાંસુધી અજ્ઞાનભાવ રહે છે; ત્યાંસુધી રાગ-દ્રેષ ઉત્પન્ન થતા જ રહે છે. તેથી શૈયોને જ્ઞાતાં થકાં પણ જ્ઞાનની શૈયોથી બિજ્ઞતા જ્ઞાણવી બહુ જરૂરી છે. આ બિજ્ઞતા જ્ઞાણી લેતાં રાગ-દ્રેષનો અભાવ થઈ જય છે અને એક દિવસ રાગ-દ્રેષનો સંપૂર્ણ અભાવ થઈને કેવળજ્ઞાન થઈ જય છે.



૧ પ્રવચન રત્નાકર ભાગ ૬, પાનું ૩૪૫-૩૪૬

૨ પ્રવચન રત્નાકર ભાગ ૬, પાનું ૩૪૬-૩૪૭

समयसार गाथा ३६६-३७१

दंसणणाणचरित्तं किंचि वि णत्थि दु अचेदणे विसए ।

तम्हा किं घादयदे चेदयिदा तेसु विसएसु ॥३६६॥

दंसणणाणचरित्तं किंचि वि णत्थि दु अचेदणे कम्मे ।

तम्हा किं घादयदे चेदयिदा तम्हि कम्मम्हि ॥३६७॥

दंसणणाणचरित्तं किंचि वि णत्थि दु अचेदणे काए ।

तम्हा किं घादयदे चेदयिदा तेसु काएसु ॥३६८॥

णाणस्स दंसणस्स य भणिदो घादो तहा चरित्तस्य ।

ण वि तहिं पोगलदब्बस्य को वि घादो दु णिद्दिठो ॥३६९॥

जीवस्स जे गुणा केइ णत्थि खलु ते परेसु दब्बेसु ।

तम्हा सम्मादिटिठस्स णत्थि रागो दु विसएसु ॥३७०॥

रागो दोसो मोहो जीवस्सेव य अणण्णपरिणामा ।

एदेण कारणेण दु सदादिसु णत्थि रागादी ॥३७१॥

(हरिगीत)

यारित्र-दर्शन-शान जरीये नहि अयेतन विष्यमां,

ते कारागे आ आतमा शुं हारुी शके ते विष्यमां ? ३६६

यारित्र-दर्शन-शान जरीये नहि अयेतन कर्ममां,

ते कारागे आ आतमा शुं हारुी शके ते कर्ममां ? ३६७

ચારિત્ર-દર્શન-જ્ઞાન જરીયે નહિ અચેતન કાયમાં,
તે કારાણે આ આત્મા શું હાગી થકે તે કાયમાં ? ૩૬૮

છે જ્ઞાનનો, દર્શન તાગો, ઉપધાત ભાષ્યો ચરિતનો,
ત્યાં કાઈ પાગુ ભાષ્યો નથી ઉપધાત પુદ્ગલદ્રવ્યનો. ૩૬૯

જે ગુગુ જીવ તાગા, ખરે તે કોઈ નહિ પરદ્રવ્યમાં,
તે કારાણે વિષયો પ્રતિ સુદાદિ જીવને રાગ ના. ૩૭૦

વળી રાગ, દેખ, વિમોહ તો જીવના અનન્ય પરિણામ છે,
તે કારાણે શબ્દાદિ વિષયોમાં નહીં રાગાદિ છે. ૩૭૧

દર્શન, જ્ઞાન અને ચારિત્ર અચેતન વિષયમાં જરા પણ નથી; તેથી
આત્મા તે વિષયોમાં શું હણે ?

તેવી જ રીતે દર્શન, જ્ઞાન અને ચારિત્ર અચેતન કર્મમાં જરા પણ
નથી; તેથી આત્મા તે કર્મમાં શું હણે ?

તેવી જ રીતે દર્શન, જ્ઞાન અને ચારિત્ર અચેતન કાયમાં જરા પણ
નથી; તેથી આત્મા તે કાયાઓમાં શું હણે ?

જ્યાં દર્શન, જ્ઞાન અને ચારિત્રનો ધાત કહ્યો છે; ત્યાં પુદ્ગલદ્રવ્યનો
જરા પણ ધાત નથી. તાત્પર્ય આ છે કે દર્શન, જ્ઞાન અને ચારિત્રનો ધાત
થતાં પુદ્ગલદ્રવ્યનો ધાત થતો નથી.

આ રીતે જે કોઈ જીવના ગુણો છે, તે ખરેખર પરદ્રવ્યોમાં નથી. તેથી
સમ્યગદાદિને વિષયો પ્રત્યે રાગ હોતો નથી.

વળી રાગ-દેખ-મોહ જીવના જ અનન્ય પરિણામ છે; તેથી રાગાદિક
શબ્દાદિ વિષયોમાં નથી.

તાત્પર્ય છે કે રાગ-દેખ-મોહાદિભાવ ન તો સમ્યગદાદિ આત્મામાં છે
અને ન તો જડ વિષયોમાં છે; તે અજ્ઞાનદશામાં રહેલા જીવના પરિણામ
છે.

આ ગાથાઓનો ભાવ આત્મપ્ર્યાતિમાં આ પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવ્યો છે.

“જે જેમાં હોય છે તે તેનો ઘાત થતાં નખ થાય જ છે અર્થાત્ આધારનો ઘાત થતાં આધેયનો ઘાત થાય જ છે. જેમ દીવાનો ઘાત થતાં પ્રકાશ નખ થઈ જય છે.

તેવી જ રીતે જેમાં જે હોય છે તે તેનો ઘાત થતાં અવશ્ય નાશ પામે છે અર્થાત્ આધેયનો ઘાત થતાં આધારનો ઘાત થાય જ છે. જેમ પ્રકાશનો ઘાત થતાં દીવાનો ઘાત થઈ જય છે.

જે જેમાં ન હોય તે તેનો ઘાત થતાં નાશ પામતું નથી. જેવી રીતે ઘડાનો નાશ થતાં ઘટપ્રદીપ (ઘડામાં રાખેલો દીવો) નાશ પામતો નથી.

તેવી જ રીતે જેમાં જે ન હોય તે તેનો ઘાત થતાં નાશ પામતું નથી. જેમ ઘટપ્રદીપનો નાશ થતાં ઘડાનો નાશ થતો નથી.

તે જ ન્યાયથી આત્માના ઘર્મો-દર્શન, જ્ઞાન અને ચારિત્ર પુરુષગલદ્રવ્યનો ઘાત થવા છતાં પણ હણાતા નથી અને દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઘાત થવા છતાં પણ પુરુષગલદ્રવ્યનો નાશ થતો નથી.

માટે આ રીતે એ સિદ્ધ થાય છે કે દર્શન-જ્ઞાન-ચારિત્ર પુરુષગલદ્રવ્યમાં નથી; કારણ કે, જે એમ ન હોય તો દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઘાત થતાં પુરુષગલદ્રવ્યનો ઘાત અને પુરુષગલદ્રવ્યનો ઘાત થતાં દર્શન-જ્ઞાન-ચારિત્રનો અવશ્ય ઘાત થવો નેઈએ.

આવી સ્થિતિ હોવાથી એ તદ્દન સ્પષ્ટ છે કે જીવના જેટલા ગુણો છે; તે બધા પરદ્રવ્યોમાં નથી; કારણ કે જે એમ ન હોય તો અહીં પણ જીવના ગુણોનો ઘાત થતાં પુરુષગલદ્રવ્યનો ઘાત અને પુરુષગલદ્રવ્યનો ઘાત થતાં જીવના ગુણોનો ઘાત અનિવાર્ય થાય; પરંતુ તેમ થતું નથી. તેથી એમ સિદ્ધ થયું કે જીવનો કોઈ ગુણ પુરુષગલદ્રવ્યમાં નથી.

પ્રશ્નઃ- જે એમ છે તો સમ્યગદાચિને વિષયોમાં રાગ કેમ થાય છે?

ઉત્તરઃ- કોઈ કારણે થતો નથી.

પ્રશ્નઃ- જે આમ છે તો રાગની ખાણ કઈ છે ?

તાત્પર્ય છે કે રાગની ઉત્પત્તિ કયાંથી થાય છે, રાગની ઉત્પત્તિનું સ્થાન કેયું છે ?

ઉત્તરઃ- રાગ-દ્રેષ-મોહ જીવના જ અજ્ઞાનમય પરિણામ છે; તે રાગ-દ્રેષ-મોહ વિષયોમાં નથી; કારણ કે વિષય તો પરદ્રવ્ય છે અને તે સમ્યગદાચિના પણ નથી; કારણ કે તેને અજ્ઞાનનો અભાવ છે. આ રીતે તે રાગ-દ્રેષ-મોહના પરિણામ વિષયોમાં ન હોવાથી અને સમ્યગદાચિને પણ ન હોવાથી છે જ નહીં.”

પ્રશ્નઃ- મોહ-રાગ-દ્રેષ છે જ નહીં - તેનું શું તાત્પર્ય છે ?

ઉત્તરઃ- પંડિત જ્યયચંદ્રા છાબડા ભાવાર્થની અંતિમ પંક્તિઓમાં નથવિભાગ સહિત આ વાતનું આ પ્રમાણે સ્પષ્ટીકરણ કરે છે.

“આ પ્રમાણે મોહ-રાગ-દ્રેષ ન તો પુદ્ગલદ્રવ્યમાં છે અને ન તો સમ્યગદાચિને થાય છે; તેથી શુદ્ધદાચિથી જેતાં તે છે જ નહીં અને પર્યાયદાચિથી જેતાં તે જીવની અજ્ઞાનદશામાં છે.”

ઉક્ત સંદર્ભમાં બૃહદ્દ્રવ્યસંગ્રહની ગાથા ૪૮ની ટીકાનો નીચેનો અંશ જાણવા જેવો છે.

“અત્રાહ શિષ્ય: રાગદ્વેષાદય: કિં કર્મજનિતા: કિં જીવજનિતા: ઇતિ ? તત્ત્વોત્તરમ्: સ્ત્રીપુરુષસંયોગોત્પત્રપુત્ર ઇવ સુધાહરિદ્રાસંયોગોત્પત્રવર્ણવિશેષ ઇવોભય સંયોગજનિતા ઇતિ । પણ્ચાન્નયવિવક્ષાવશેન વિવક્ષિતૈકદેશશુદ્ધનિશ્ચયેન કર્મજનિતા ભયને । તથૈવાશુદ્ધનિશ્ચયેન જીવજનિતા ઇતિ । સ ચાશુદ્ધનિશ્ચય: શુદ્ધનિશ્ચયાપેક્ષયા વ્યવહાર એવ ।

અથ મતમ् : સાક્ષાચ્છુદ્ધનિશ્ચયનયેન કસ્યેતિ પૃચ્છામો વયમ् ।

તત્ત્વોત્તરમ् : સાક્ષાચ્છુદ્ધનિશ્વયનયેન સ્ત્રીપુરુષસંયોગરહિતપુત્રસ્વેચ્છા, સુધાહરિદ્રાસંયોગરહિતરંગવિશેષસ્વેચ્છા તેષામુત્પત્તિરેવ નાસ્તિ કથમુત્તરં પ્રયચ્છામ ઇતિ।

અહીં શિષ્ય પૂછે છે કે રાગ-દ્રેષ આદિ કર્મજ્ઞનિત છે કે જીવજ્ઞનિત?

તેનો ઉત્તર આ છે કે સ્ત્રી અને પુરુષ બંનેના સંયોગથી ઉત્પત્તન થયેલા પુત્રની માફક તથા ચૂના અને હળદરના મિશ્રણથી ઉત્પત્તન થયેલા વિશેષ વાર્ણની માફક રાગ-દ્રેષ વગેરે જીવ અને કર્મ - આ બંનેના સંયોગજ્ઞનિત છે.

નયવિવક્ષા અનુસાર વિવક્ષિત એકદેશશુદ્ધનિશ્વયનયથી રાગ-દ્રેષ કર્મજ્ઞનિત કહેવાય છે અને અશુદ્ધનિશ્વયનયથી જીવજ્ઞનિત કહેવાય છે આ અશુદ્ધનિશ્વયનય શુદ્ધનિશ્વયની અપેક્ષાએ વ્યવહાર જ છે.

પ્રશ્નઃ- સાક્ષાત્ શુદ્ધનિશ્વયનયથી રાગ-દ્રેષ કોના છે - એમ અમે પૂછીએ છીએ ?

ઉત્તરઃ- સાક્ષાત્ શુદ્ધનિશ્વયનયથી સ્ત્રી અને પુરુષના સંયોગથી રહિત પુત્રની માફક અને ચૂના અને હળદરના સંયોગરહિત રંગવિશેષની માફક તેમની (રાગ-દ્રેષની) ઉત્પત્તિ છે જ નહીં તો શું ઉત્તર આપીએ ?"

આ ગાથાઓના ભાવને પૂજ્ય ગુરુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે.

"જુઓ, આ ગાથાઓમાં આમ કહેવાઈ રહ્યું છે કે જ્ઞાન અને જ્ઞેય તથન જુદાજુદા છે. આત્માના દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ કોઈપણ ગુણ પરદ્રવ્યોમાં નથી. - આમ જ્ઞાનતાં સમ્યગુદ્ધિને વિષયો પ્રત્યે રાગ થતો નથી અને જડદ્રવ્યોમાં પણ રાગ-દ્રેષ આદિ નથી. તે તો માત્ર અજ્ઞાનદર્શામાં વર્તતા જીવના પરિણામ છે.

જુઓ ! આધારનો નાશ થતાં જ આધેયનો નાશ થઈ જ જય છે કારણ કે દીવો આધાર છે અને પ્રકાશ તેનું આધેય છે. તેથી જે દીવાનો નાશ થાય તો આધેયકૃપ પ્રકાશનો નાશ થઈ જ જય છે.

હવે કહે છે કે જેમ ઘડો ફોડી દેતાં પણ ઘડાની અંદર રાખેલા દીવાનો નાશ થતો નથી અને અંદર રાખેલા દીવાનો નાશ થતાં (બુઝાઈ જતાં) ઘડાનો પણ નાશ થતો નથી, કારણ કે પરમાર્थથી દીવા અને ઘડામાં આધાર-આધેય સંબંધ નથી, ઘડામાં તો ઘડાના જ ગુણ છે અને દીવામાં દીવાના જ ગુણ છે. ઘડો અને દીવો બંને બિન્ન-બિન્ન વસ્તુઓ છે. બંનેની વચ્ચે વાસ્તવિક આધાર-આધેય સંબંધ નથી.

જુઓ, અહીં બે વાત કહી છે -

૧. દીવાનો નાશ થતાં પ્રકાશનો નાશ થાય છે અને પ્રકાશનો નાશ થતાં દીવાનો નાશ થઈ જય છે.
૨. ઘડાનો નાશ થતાં અંદર રહેલા દીવાનો નાશ થતો નથી અને અંદર રાખેલા દીવાનો નાશ થતાં ઘડાનો નાશ થતો નથી.

હવે આ જ દષ્ટાંથી આ સિદ્ધાંત સમજલે છે કે પુરુષલદ્રવ્યનો નાશ થતાં આત્માના દર્શન-જ્ઞાન-ચારિત્ર ગુણનો નાશ થતો નથી અને દર્શન-જ્ઞાન-ચારિત્ર ગુણનો ઘાત થતાં પુરુષલદ્રવ્યનો ઘાત થતો નથી. આમ દર્શન-જ્ઞાન-ચારિત્ર પુરુષલદ્રવ્યમાં નથી - આમ ફલિત થઈ ગયું.

જુઓ, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર આત્માના ધર્મ છે. ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ સદા જ્ઞાનસ્વરૂપી છે. તેની અંતદાઢિ થઈને પ્રતીતિ થવી સમ્યગ્દર્શન છે. તેનું જ જ્ઞાન સમ્યગ્જ્ઞાન છે અને તેમાં જ રમણતા સમ્યક્ચારિત્ર છે. આમ આત્માના આશ્રયે પ્રગટ થયેલા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર આત્માની નિર્મળ વીતરાગી પર્યાયો છે.

હવે કહે છે કે શરીરનો નાશ થઈ જય અથવા શરીર જીર્ણ થઈ જય અને વાળીના બોલ પણ મંદ થઈ જય, આદિ જડની કિયાઓ થતાં આત્માના દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઘાત થતો નથી; કારણ કે શરીર બિન્ન વસ્તુ છે અને આત્માના દર્શન-જ્ઞાન-ચારિત્ર બિન્ન વસ્તુઓ છે. બંનેમાં આધાર-આધેય સંબંધ નથી.

શરીરની પ્રવૃત્તિ બરાબર થઈ રહી હોય, પાંચ મહાવત, ત્રણ ગુપ્તિ, સમિતિ આદિ બધી વ્યવહારની કિયાઓ યથાવત્ થઈ રહી હોય છતાં પણ અંદરમાં રાગમાં ઈજ્જબુદ્ધિ અને મમત્વબુદ્ધિ હોય તો - આવું શાલ્ય હોવાથી આત્માના દર્શન-શાન-ચારિત્રનો ધાત થઈ જય છે.

અહીં એમ સિદ્ધ કરવું છે કે પાંચ ઈદ્રિયના વિષય પરપદાર્થ છે, દેવ-શાસ્ત્ર-ગુરુ પણ પરપદાર્થ છે અને પરપદાર્થોમાં રાગ-ક્રેષ નથી અને પોતાના સ્વભાવમાં પણ રાગ-ક્રેષ નથી; પરંતુ જીવ પોતાના સ્વભાવનો ધાત તો પોતાના અજ્ઞાનનથી કરે છે. રાગ-ક્રેષ અજ્ઞાનદશામાં વર્તતા જીવના પરિણામ છે.^૧

જુઓ, શરીરની કિયા ન કરી શકે તો પણ પોતાના દર્શન-શાન-ચારિત્રય ધર્મ બરાબર ટકી રહે છે, અહીં શરીરાદિની કિયાડ્ય પુદ્ગાળનો ધાત તો થયો; પણ તેના કારણે પોતાના ધર્મનો ધાત ન થયો. તેનાથી વિપરીત શારીરિક કિયાઓ બહારમાં યથાવત્ ચાલતી રહે, છતાંપણ આ બાધ્ય કિયાઓથી આત્મલાભ અથવા ધર્મ થવું માને તો ધર્મનો જ ધાત થઈ જય છે; કારણ કે અજ્ઞાની વિપરીત દાઢિવાળા જીવની પોતાની ઉલ્લી માન્યતાને કારણે ધર્મનો ધાત થઈ જય છે. બહારની પ્રવૃત્તિ ન દેખાય તોપણ આનંદના નાથ પ્રભુ આત્માની સ્વ-સન્મુખ પ્રવૃત્તિ, શાન અને રમણતા વર્તતી હોય તો તેને પોતાના ધર્મનો ધાત થતો નથી. તેથી એ જ્ઞાન થયું કે વ્રત, તપ, ભક્તિ આદિના વિકલ્પ આત્માના ધર્મ નથી.

અહીં એક તરફ તો ભગવાન આત્મારામ પોતે અને બીજુ બાજુ આખું ગામ અર્થાત્ શરીર-મન-વાળી, ઈદ્રિય, શુભાશુભ રાગાદિભાવ - એ બધા પરદ્રવ્ય છે. આ પરદ્રવ્યોમાં આત્માનો સ્વભાવ નથી. તેથી પરનો ધાત થતાં પોતાના સ્વભાવનો, જ્ઞાનાદિ ગુણોનો ધાત થતો નથી. અહો ! આ તો જૈનપરમેશ્વરે કહેલું કોઈ અચિંત્ય-અતૌકિક તત્ત્વ આચાર્યદે જાહેર કર્યું છે.

અહીં ! જીવોને જે રાગ-દ્રેષ-મોહાદિ ભાવ ઉત્પન્ન થાય છે, તે પોતાના શુદ્ધ આનંદકંદ પ્રભુ, આત્માના જ્ઞાનના અભાવથી અર્થાત્ પોતાના અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. રાગ-દ્રેષ-મોહ પરદ્રવ્યથી ઉત્પન્ન થતા નથી અને પોતાના સ્વદ્રવ્યથી પણ ઉત્પન્ન થતા નથી; કારણ કે પરદ્રવ્ય પોતાના સ્વભાવથી બિના છે. પોતાનો સ્વભાવ પરદ્રવ્યમાં નથી અને પોતાનું સ્વદ્રવ્ય તો સદાય શુદ્ધ ચૈતન્યમય વીતરાગભાવમય છે.

અહીં એમ સિદ્ધ કરવું છે કે પરદ્રવ્યમાં પોતાનો રાગ-દ્રેષ-મોહ નથી અને પરદ્રવ્યથી તે ઉત્પન્ન થાય - એવું પણ નથી; પરંતુ પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપના ભાનના અભાવમાં અજ્ઞાનથી રાગ-દ્રેષ-મોહના ભાવ ઉત્પન્ન થાય છે.^૧

અહીં તો એક બાજુ આત્મા અને બીજુ બાજુ સાડે જગત - એવા બે વિભાગ કરી દીધા છે. સ્પષ્ટ કહ્યું છે કે આત્માના ગુણ પરદ્રવ્યોમાં નથી; તેથી પરદ્રવ્યથી ઉપયોગ હટાવીને આત્મામાં જ પોતાની દાઢિ કેન્દ્રિત કર. સ્વદ્રવ્યના લક્ષ્યથી પરિણમતાં તને નિર્મલ રત્નત્રયની પ્રાપ્તિ થશે.^૨

ખરેખર ન તો સ્વદ્રવ્યથી કે ન તો પરદ્રવ્યથી; પરંતુ પરથી અને રાગથી લાભ માનવારૂપ પોતાના અજ્ઞાનને લીધે રાગ-દ્રેષ ઉત્પન્ન થાય છે.^૩

ભાઈ ! પરદ્રવ્યમાં રાગ-દ્રેષ નથી; પરમાં આત્માના ગુણ પણ નથી, અવગુણ પણ નથી; પરંતુ શુદ્ધ ચિદાનંદ-ચૈતન્ય ચમત્કાર નિજ આત્માને ભૂતીને જે વિકારને પોતાનું 'સ્વ' માને છે, તે જ મહાવિપરીતતા અને અજ્ઞાન છે અને તે જ અજ્ઞાનથી રાગ-દ્રેષ ઉત્પન્ન થાય છે.^૪

જુઓ, વીતરાગમૂર્તિ આનંદધન પ્રભુ આત્માને શુદ્ધ દ્રવ્યદાઢિથી

૧ પ્રથમનરત્નાકર ભાગ ૬, પાનું ૩૫૫

૨ તે જ, પાનું ૩૫૫

૩ તે જ, પાનું ૩૫૬

૪ પ્રથમનરત્નાકર ભાગ ૬, પાનું ૩૫૭-૩૫૮

જેનારને રાગ-દ્રેષ-મોહ થતા જ નથી; કારણ કે તેને અજ્ઞાન નથી. તેથી વિપરીત, જેની દાખિ પર્યાય પર છે, તે પર્યાયદાખિવાળા જીવને રાગ-દ્રેષ-મોહ ઉત્પન્ન થાય છે. ભલે ને બહારમાં મહાવતાદિનું પાલન કરતા હોય; પરંતુ જે તે વ્રતાદિથી પોતાને આત્મલાભ-ધર્મલાભ માને તો તે પર્યાયદાખિવાળા મૂઢ મિથ્યાદાખિ જ છે. તેમને અજ્ઞાનને લીધે રાગ-દ્રેષ-મોહ અવશ્ય થાય જ છે. તેથી પર્યાયબુદ્ધિ છોડીને દ્રવ્યદાખિ કરો. આ જ તમારા હિતનો ઉપાય છે.”^૧

આ પ્રમાણે આ ગાથાઓમાં એમ જ કહ્યું છે કે જેમ દિપક અને દિપઘટ (જેમાં દિપક રાખ્યો છે - એવો ઘડો) બિજ્ઞ-બિજ્ઞ પરાર્થ છે; તેવી જ રીતે શરીર, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ અને પંચનિધ્યોની ઉપભોગ્ય સામગ્રી આદિ પરપરાર્થ અને ભગવાન આત્મા બિજ્ઞ-બિજ્ઞ પરાર્થ છે.

જેમ દિપઘટનો નાશ થતાં પણ દિપકનો નાશ થતો નથી અને દિપકનો નાશ થતાં દિપઘટનો નાશ થતો નથી; તેવી જ રીતે દેહાદિ પરદ્રવ્યોનો નાશ થતાં આત્માના દર્શન-જ્ઞાન-ચારિત્ર નાશ થતાં નથી અને આત્માના દર્શન-જ્ઞાન-ચારિત્રનો નાશ થતાં દેહાદિ સંયોગ નાશ થતાં નથી. તેથી તેમની બિજ્ઞતા સહજ જ સિદ્ધ છે.

પરદ્રવ્યોની બિજ્ઞતા સિદ્ધ થતાં એ પણ સહજસિદ્ધ છે કે મોહ-રાગ-દ્રેષના પરિણામ પરને લીધે થતા નથી, પર દ્વારા થતા નથી. બીજુ વાત આ છે કે આત્માનો સ્વભાવ ન હોવાથી આત્માના આશ્રયથી તેમની ઉત્પત્તિ સંભવ નથી તેથી આપરે આપણો એ જ નિર્જર્ખ પર પહોંચીએ છીએ કે આ મોહ-રાગ-દ્રેષની ઉત્પત્તિ આત્માના અજ્ઞાનથી આત્મામાં જ થાય છે અને તેમનો અભાવ પણ આત્માના આશ્રયથી જ થાય છે. તેથી એક માત્ર આત્માનો આશ્રય લેવો એ જ ઉપાય છે - તે જ કારણથી આત્માના આશ્રયથી ઉત્પન્ન સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને મુક્તિનો માર્ગ કહેવામાં આવ્યો છે.

^૧ પ્રવચનરત્નાકર ભાગ ૮, પાનું ૩૪૮

હવે આ જ ભાવને પોષનું કળશ કાવ્ય લખે છે; જે આ પ્રમાણે છે.
(મંદક્રાન્તા)

રાગદ્રેષાવિહ હિ ભવતિ જ્ઞાનમજ્ઞાનભાવાત्
તૌ વસ્તુત્વપ્રણિહિતદ્વા દૃશ્યમાનૌ ન કિંचિત् ।
સમ્યગ્ઘટિઃ ક્ષપયતુ તત્સત્ત્વહઘ્ટયા સ્ફુટં તૌ
જ્ઞાનજ્યોતિર્જર્વલતિ સહજં યેન પૂર્ણાચલાર્ચિઃ ॥૨૧૮॥

(હરિગીત)

અજ્ઞાનભાવથી રાગ-દ્રેષ્ટપે પરિણમે જ્ઞાન આ,
પાગ દ્વયદ્વિથી દેખતાં, તે રાગ-દ્રેષ્ટ કંઈ જ ના;
સદ્ગટિ થઈ કર રાગક્ષય તું તત્ત્વની દ્વારા વડે,
તો પૂર્ણ અચળ પ્રકાશ સહ એ જ્ઞાનજ્યોતિ પ્રગટ થશે. ૨૧૮

આ જગતમાં જ્ઞાન જ અજ્ઞાનભાવથી રાગ-દ્રેષ્ટ-મોહર્ઝપ પરિણમે છે.
વસ્તુત્વમાં એકાગ્ર દાખિથી જેતાં તે રાગ-દ્રેષ્ટ-મોહ કંઈ પણ નથી; તેથી
હે સમ્યગ્ઘટિ લખો ! તેમનો સંપૂર્ણપણે ક્ષય કરો કે જેથી પૂર્ણ અચળ
પ્રકાશમય જ્ઞાનજ્યોતિ પ્રકાશિત થાય.

આ કળશનો ભાવાનુવાદ કવિવર બનારસીદાસજીએ નાટક સમયસારમાં
આ પ્રમાણે કર્યો છે -

(છપ્પય)

જીવ કરમ સંજોગ સહજ મિથ્યાતરૂપ ધર ।
રાગ દોષ પરનતિ પ્રભાવ જાનૈ ન આપા પર ॥
તમ મિથ્યાત મિટિ ગયૌ હુવો સમકિત ઉદોત સસિ ।
રાગ દોષ કછુ વસ્તુ નાંઝ છિન માંહિ ગયે નસિ ॥
અનુભૌ અભ્યાસ સુખ રાસિ રમિ, ભયૌ નિપુન તારન તરન ।
પૂરન પ્રકાસ નિહચલ નિરખિ, બાનારસિ વંદત ચરન ॥

આ લખ કર્મોના સંયોગથી સહજ રીતે જ મિથ્યાત્વભાવ ધારણ કરીને
રાગ-દ્રેષ્ટ પરિણતિના પ્રભાવથી સ્વ અને પરને તેમના સાચા રૂપે જણી

શકતો નથી, તેમની વચ્ચે સીમારેખા દોરી શકતો નથી; પરંતુ જ્યારે સમૃદ્ધદર્શનરૂપ ચંદ્રમાનો ઉદ્ઘય થાય છે ત્યારે મિથ્યાત્વનો અંધકાર નાશ પામે છે અને રાગ-દ્રેષ ક્ષણભરમાં નાખ થઈ જય છે, જાણો કે તેવી કોઈ વસ્તુ જ નથી.

આત્માનુભવના અભ્યાસથી સુખની રાશિમાં રમીને આ ચતુર આત્મા તરણાતારણ બની જય છે, પૂર્ણ પ્રકાશમય નિશ્ચળ થઈ જય છે; તેને જોઈને કવિવર બનારસીદાસ કહે છે કે હું એવા શાની ધર્માત્માઓના ચરણોની વંદના કરું છું.

ઉક્ત કળશનો ભાવ પૂજ્ય ગુરુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે -

“આત્મા પોતાના જ અજ્ઞાનભાવથી રાગ-દ્રેષરૂપ થાય છે. જેમને પોતાની ચૈતન્યસત્તા અને એક જ્ઞાયકભાવ, ધ્યાવભાવ, એક સામાન્યભાવ, નિત્યભાવ, પંચમ-પારિણામિકભાવનું ભાન નથી; તે જીવ અજ્ઞાનભાવથી પુણ્ય અને પાપ તથા રાગ અને દ્રેષભાવે પરિણમે છે. પોતે પોતાના સ્વભાવથી રાગ-દ્રેષરૂપ પરિણમતો નથી. કર્માદિતી લીધે પણ રાગ-દ્રેષરૂપ પરિણમતો નથી; પરંતુ પોતાના વસ્તુસ્વરૂપનું યથાર્થ ભાન ન હોવાને કારણો રાગ-દ્રેષરૂપ પરિણમે છે.”^૧

પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ભાન ન હોવાને કારણો અનાદિથી અજ્ઞાન છે, બસ તે જ રાગ-દ્રેષનો હેતુ છે. અહા ! હું કોણ છું, મારું સ્વરૂપ શું છે અને મારું કર્તવ્ય શું છે ? ઈત્યાદિનું ભાન ન હોવાથી અજ્ઞાનવશ આ જીવને રાગ-દ્રેષ ઉત્પન્ન થાય છે.

અહીં મિથ્યાત્વ સંબંધી રાગ-દ્રેષને જ રાગ-દ્રેષ માન્યા છે. સમકિત થયા બાદ જે રાગાદિ થાય છે, તેમને અહીં રાગ જ માનવામાં આવ્યા નથી.”^૨

૧ પ્રવચનરત્નાકર ભાગ ૮, પાનું ૩૫૭-૩૫૮

૨ પ્રવચનરત્નાકર ભાગ ૮, પાનું ૩૫૮

આ પ્રમાણે આ કળશમાં એમ જ કહેવામાં આવ્યું છે કે અજ્ઞાનભાવજ રાગ-દ્રેષ્ણની ખાણ છે. પોતાના અજ્ઞાનભાવથી જ આ આત્મા પોતે રાગ-દ્રેષ્ણ પરિણામદ્દિપ પરિણમે છે. જ્યારે વસ્તુના મૂળસ્વરૂપની દર્શિથી વિચારીએ તો એ જ સ્પષ્ટ થાય છે કે આત્મસ્વભાવમાં તો રાગ-દ્રેષ્ણ મોહ છે જ નહીં. જે કે વર્તમાન પર્યાયમાં આ રાગ-દ્રેષ્ણના ભાવોની સત્તા છે; ઇતાં તેમને પણ જ્ઞાનીજન, સમ્યગદર્શિ ધર્માત્મા તત્ત્વદર્શિના બળથી ક્ષય કરીને પોતે પોતાના સહજસ્વભાવને પ્રાપ્ત કરી લે છે.

હવે આગામી ગાથાના ભાવનું સૂચક કળશ કાવ્ય લખે છે; જે આ પ્રમાણે છે -

(શાલિની)

રાગદ્રેષ્ણોત્પાદકं તત્ત્વદર્શયા નાન્યદ્રવ્યં વીક્ષયતે કિંચનાપિ ।
સર્વદ્રવ્યોત્પત્તિરન્તશ્વકાસ્તિ વ્યક્તાત્યંતં સ્વસ્વભાવેનયસ્માત् ॥૨૧૧॥

(હરિગીત)

તત્ત્વદર્શિથી દેખતાં ન જરાય એવું દીસતું
'કો' દ્રવ્ય ઉત્પાદક બને આ જીવના રાગાદિનું;
આ જગતમાં સહૃદ્યની ઉત્પત્તિ નિજ નિજ ભાવથી,
અતિ પ્રગટ એવી અંતરંગે જ્ઞાનજ્યોતિ પ્રકાશતી. ૨૧૮

તત્ત્વદર્શિથી જેવામાં આવે તો રાગ-દ્રેષ્ણને ઉત્પન્ન કરનાર અન્ય દ્રવ્ય કોઈ પણ દેખાતું નથી; કારણ કે સર્વદ્રવ્યોની ઉત્પત્તિ પોતાના સ્વભાવથી જ થતી થકી અંતરંગમાં અત્યંત સ્પષ્ટ પ્રકાશિત થાય છે.

આ કળશના ભાવને સ્પષ્ટ કરતાં કળશ દીકકાર પાંડે રાજમલજી કળશ દીકામાં લખે છે -

- “ભાવાર્થ આ છે કે કોઈ એવું માને કે જીવનો સ્વભાવ રાગ-દ્રેષ્ણપે પરિણામવાનો નથી, પરદ્રવ્ય જ્ઞાનાવરણાધિકર્મ તથા શરીર અને ભોગસામગ્રી બલાત્કારથી (જબરજસ્તીથી) જીવને રાગ-દ્રેષ્ણપે પરિણામાયે છે; તો તેવું

તો નથી, જીવની વિભાવ પરિણામ શક્તિ જીવમાં છે; તેથી મિથ્યાત્વના ભ્રમકૃપે પરિણામતો થકો રાગ-દ્રેષ્ટ્રપ, જીવદ્વયો પરિણામે છે, પરદ્વયનો કંઈ સહારો નથી.

આઠ કર્મડ્રપ અથવા શરીર-મન-વચન નોકર્મડ્રપ અથવા બાળ ભોગસામગ્રી ઈત્યાદિડ્રપ છે એ બધા પરદ્વય; તેઓ દ્રવ્યના સ્વરૂપને સાચી દાખિથી જેતાં અશુદ્ધ ચેતનાડ્રપ જે રાગ-દ્રેષ્ટ પરિણામ; તેમને ઉત્પન્ન કરવામાં સમર્થ જણાતા નથી.”

આ કળશ અને કળશ લીકાના ભાવને આધાર બનાવીને કવિવર બનારસીદાસજી આ કળશની વિષયવસ્તુને શિષ્ય-ગુરુના પ્રશ્નોત્તર ડ્રપમાં આ પ્રમાણે પ્રસ્તુત કરે છે.

(સવૈવા ઇકતીસા)

કોઊ સિદ્ધ કહૈ સ્વામી રાગ દોષ પરિનામ,
 તાકૌ મૂલ પ્રેરક કહુહ તુમ કૌન હૈ ।
 પુગલ કરમ જોગ કિધોં ઇંદ્રિનિ કોં ભોગ,
 કિધોં ધન કિધોં પરિજન કિધોં ભૌન હૈ ॥
 ગુરુ કહૈ છહોં દર્વ અપને અપને રૂપ,
 સબનિ કૌ સદા અસહાઈ પરિનીન હૈ ।
 કોઊ દરબ કાહૂ કૌ ન પ્રેરક કદાચિત તાતેં,
 રાગ દોષ મોહ મૃષા મદિરા અચીન હૈ ॥

કોઈ શિષ્ય પોતાના ગુરુને કહે છે કે હે સ્વામી ! કૃપાથી આપ એ બતાવો કે રાગ-દ્રેષ્ટભાવોનો મૂળ પ્રેરક કોણ છે ? પૌર્ણગલિક કર્મ છે યા મન-વચન-કાયડ્રપ યોગ છે યા પંચેન્દ્રિયોના વિષયબોગ છે યા ધનસંપત્તિ છે યા કુંદુંબીજન યા મકાન છે ?

ગુરુજી ઉત્તર દેતાં કહે છે કે અરે ભાઈ ! છયે દ્રવ્યોમાં બધા દ્રવ્યોનું પરિણામન સદાય પરની સહાયતા વગર પોતે જ પોતાના જ કારણે થાય

છે; કોઈ પણ પરદ્રવ્ય કોઈ દ્રવ્યનો પ્રેરક ક્યારેય થતો નથી; તેથી તું એમ જ સમજ કે આ મોહ-રાગ-દ્રેષ્ટ ભાવોનું કારણ મોહ (મિથ્યાત્વદ્વય) મહિરાનું પીવું જ છે.

તાત્પર્ય એ છે કે આ જીવ પોતે જ મિથ્યા માન્યતાને લીધે મોહ-રાગ-દ્રેષ્ટદ્વયે પરિણામે છે; તેમાં અન્ય કોઈ પરદ્રવ્યનો દોષ નથી.

આ કળશનો ભાવ પૂજ્ય ગુરુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે - “આચાર્ય કહે છે કે જરા વિચાર તો કર ! તત્વદાખિથી જેતાં કર્મ વગેરે રાગ-દ્રેષ્ટને ઉત્પન્ન કરનાર જણાતા નથી. જે કે પરદ્રવ્યદ્વય કર્મ વગેરે નિભિત હોય છે; પરંતુ રાગ-દ્રેષ્ટની ઉત્પત્તિનું મૂળ કારણ તો પોતાનું અશુદ્ધ ઉપાદાન જ છે. કર્મનું તે કંઈ પણ કાર્ય નથી.”^૧

સ્ત્રી પ્રત્યે જે રાગ થાય છે; તેમાં સ્ત્રી બિલ્કુલ કારણ નથી. ગાળને લીધે જરા પણ / ક્યારેય કોઇ ઉત્પન્ન થતો નથી. ભાઈ ! પરદ્રવ્ય પરદ્રવ્યમાં છે અને જડકર્મનો ઉદ્ય જડકર્મમાં છે. તેથી કર્મને લીધે વિકાર થતો જ નથી. આ અફર સિદ્ધાંત છે.^૨

પંચાસ્તિકાય ગાથા દરમાં કહું છે કે વિકાર પોતાના પદકારકોથી પોતાની પર્યાયમાં થાય છે, તેમાં પરકારકોની જરા પાગ અપેક્ષા નથી. પર્યાયમાં જે મિથ્યાત્વનો ભાવ થાય છે, તેમાં દર્શનમોહનીય કર્મનો ઉદ્ય કારાગું નથી. પર્યાયમાં જે કોધાદિ ભાવ થાય છે, તેમાં ચારિત્રમોહનો ઉદ્ય કારાગું નથી; કેમ કે સર્વદ્રવ્યોની પર્યાયોની ઉત્પત્તિ પોતપોતાના સ્વભાવથી જ થાય છે.^૩

ભાવાર્થ એ છે કે કોઇ-માન-માયા-લોભ તથા હિંસા, જૂં આદિ જે પણ જીવના પરિણામ છે, તે બધા જીવના જ પરિણામ છે. તે કર્મના પરિણામ નથી; કારણ કે કર્મથી ઉત્પન્ન થયા નથી. કોઈ અન્ય દ્રવ્ય આત્મામાં રાગાદિની ઉત્પત્તિ કરી શકતું જ નથી; કારણ કે સર્વદ્રવ્યોની

૧ પ્રવચનરત્નાકર ભાગ ૬, પાનું ૩૫૮-૩૬૦

૨ પ્રવચનરત્નાકર ભાગ ૬, પાનું ૩૬૦

૩ તે જ, પાનું ૩૬૦-૩૬૧

ઉત્પત્તિ પોતપોતાના સ્વભાવથી જ થાય છે. જે આવો સાચો નિર્ણય અહીં અત્યારે નહીં કરીશ તો ક્યાં અને ક્યારે કરીશ ?

જુઓ, અહીં રાગ-ક્રેષાહિ વિકારને ચૈતન્યના પરિણામ કહ્યા; કારણ કે તેઓ ચૈતનની પર્યાયમાં થાય છે. બીજું, જ્યાં શુદ્ધસ્વભાવને સિદ્ધ કરવાની વાત હોય અને ધૂવસ્વભાવનો આશ્રય કરાવવાનું પ્રયોજન હોય - ત્યાં તેને પુદ્ગલના પરિણામ કહેવામાં આવે છે.

જ્યાં જે વિવક્ષા હોય; તેને યથાર્થ સમજવી જોઈએ, જેને ધૂવસ્વભાવની દર્શિ થઈ હોય, તે સ્વયં વ્યાપક અર્થાત્ કારણ અને નિર્મળપર્યાય વ્યાપ્ય અર્થાત્ કાર્ય છે, વિકાર તેનું વ્યાપ્ય અથવા કારણ નથી, બસ; આ અપેક્ષાથી વિકારને પુદ્ગલના પરિણામ કહ્યા છે તથા અહીં રાગ-ક્રેષાહિ વિકારીભાવ જીવની દર્શામાં થવાથી તેમને જીવના પરિણામ કહ્યા છે; કારણ કે તે જડમાં થતા નથી. જડ દ્રવ્ય તેમને ઉત્પન્ન કરાવતું નથી; કારણ કે અન્ય દ્રવ્યમાં અન્ય દ્રવ્યની ગુણ-પર્યાયો વડે ઉત્પત્તિ થતી નથી. તેથી જ્યાં જે અપેક્ષાથી કથન હોય તેને તેવી રીતે સમજવું જોઈએ. ૧

આ પ્રમાણે આ કળશમાં એમ જ કહેવામાં આવ્યું છે કે પ્રત્યેક દ્રવ્યનું પરિણામન તેના પોતાના સ્વભાવથી જ થાય છે; અન્ય દ્રવ્યોને કારણે નહીં. આત્મા પણ એક દ્રવ્ય છે; તેથી તેનું પરિણામન પણ તેના વડે જ થવું ઈષ્ટ છે. મોહ-રાગ-ક્રેષ્ટપ પરિણામન પણ આત્માનું જ પરિણામન છે; તેથી તેપણ તેના વડે જ થવું ઈષ્ટ છે. તેથી જ અહીં એમ કહેવામાં આવ્યું છે કે આત્મા પોતે જ પોતાના અજ્ઞાનભાવને લીધે અજ્ઞાન અવસ્થામાં મોહ-રાગ-ક્રેષ્ટપ પરિણામે છે; કોઈ અન્યને કારણે નહીં.

ખુદ પોતાના રાગ-ક્રેષ-મોહનું કારણ પરમાં શોધવું તે અજ્ઞાનજ છે.



સમયસાર ગાથા ૩૭૨

જે વાત અગાઉ કળશમાં કહી છે, હવે તે જ વાતને મૂળ ગાથામાં સ્પષ્ટ કરે છે; જે આ પ્રકારે છે -

અણદવિએણ અણદવિયસ્સ ણો કીરએ ગુણુપ્પાઓ ।

તમ્હા દુ સવ્વદવ્વા ઉધ્યજંતે સહાવેણ ॥૩૭૨॥

કો દ્રવ્ય બીજા દ્રવ્યને ઉત્પાદ નહિ ગુણનો કરે,
તેથી બધાંયે દ્રવ્ય નિજ સ્વભાવથી ઉપજે ખરે. ૩૭૨

અન્ય દ્રવ્યથી અન્યદ્રવ્ય ગુણોની ઉત્પત્તિ થઈ સકતી નથી એથી
એ સિદ્ધાંત નક્કી થાય છે કે બધા જ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી ઉત્પન્ન
થાય છે.

આ ગાથાની દીકામાં આચાર્ય અમૃતચંદ્ર વિષયવસ્તુને ઉદ્ઘારણ
સાથે સ્પષ્ટ કરે છે, જે આ પ્રમાણે છે.

અને એવી આશાંકા પણ નહિ કરવી જોઈએ કે પરદ્રવ્ય જીવને
રાગાદિદ્વય પરિણામાવે છે; કેમકે અન્ય દ્રવ્યમાં અન્યદ્રવ્યના ગુણોને ઉત્પન્ન
કરવાની અયોગ્યતા છે; કેમકે સર્વ દ્રવ્યોના સ્વભાવથી જ ઉત્પાદ હોય છે.

હવે આ જ વાતને દ્રષ્ટાંતથી સમજાવે છે -

અહિં એક પ્રશ્ન સંભવે છે કે ઘડાના ભાવદ્વયથી ઉત્પન્ન થતી મારી
કુંભારના સ્વભાવથી ઉત્પન્ન થાય છે કે મારીના સ્વભાવથી ?

ને એમ કહેવામાં આવે કે કુંભારના સ્વભાવથી મારી ઘડકૃપે ઉત્પન્ન થાય છે તો એ ઘડો કુંભારદ્વપ પુરુષના શરીરના આકરે થવો જોઈએ, જે કુંભાર ઘડો બનાવવાના અહંકારથી ભરેલો છે અને જેના હાથ ઘડો બનાવવાનું કાર્ય કરી રહ્યા છે; પરંતુ એમ તો થતું નથી, તે ઘડો પુરુષાકાર તો થતો નથી કેમકે અન્ય દ્રવ્યના સ્વભાવથી કોઈ અન્ય દ્રવ્યના પરિણામની ઉત્પત્તિ થતી દેખાતી નથી.

ને એમ હોય તોપછી મારી કુંભારના સ્વભાવને ન સ્પર્શતી પોતાના સ્વભાવથી જ ઘડકૃપ ભાવથી ઉત્પન્ન થાય છે, કુંભાર ઘડાનો કરનાર નથી જ. આ વાત દ્રાષ્ટાંત પર ઘટાવી, હવે આ જ વાતને દ્રાષ્ટાંત પર ઘટિત કરે છે.

અહિં એક પ્રશ્ન સંભવે છે કે પોતાના પરિણામકૃપ પર્યાયથી ઉત્પન્ન થતાં બધા દ્રવ્યો નિમિત્તભૂત અન્ય દ્રવ્યોના સ્વભાવથી ઉત્પન્ન થાય છે કે પોતાના સ્વભાવથી ?

ને એમ કહેવામાં આવે કે નિમિત્તભૂત અન્ય દ્રવ્યોના સ્વભાવથી બધા દ્રવ્ય ઉત્પન્ન થાય છે તો તેમના પરિણામોને નિમિત્તભૂત અન્ય દ્રવ્યોના આકારના હોવા જોઈએ. પણ એમ તો થતું નથી, દ્રવ્યોના પરિણામ નિમિત્તભૂત અન્ય દ્રવ્યના આકારના હોતા નથી, કેમકે અન્ય દ્રવ્યના સ્વભાવથી બીજા કોઈ દ્રવ્યના પરિણામને ઉત્પન્ન થતાં જેવામાં આવતાં નથી.

ને એમ છે તો પછી બધા દ્રવ્યો નિમિત્તભૂત અન્ય દ્રવ્યોના સ્વભાવથી ઉત્પન્ન થતાં નથી; પરંતુ પોતાના સ્વભાવથી જ ઉત્પન્ન થાય છે - એમ જ નક્કી થયું; કેમકે પ્રત્યેક દ્રવ્યના પરિણામ પોતાના સ્વભાવથી જ ઉત્પન્ન થતાં જેવામાં આવે છે.

તેથી એમ નક્કી થયું કે સર્વ દ્રવ્ય પોતાના સ્વભાવને ઉલ્લંઘતા નથી તેથી બધા જ દ્રવ્ય નિમિત્તભૂત અન્ય દ્રવ્યના સ્વભાવને સ્પર્શ ન કરતા પોતાના સ્વભાવથી જ પોતાના પરિણામથી પર્યાયકૃપ ઉત્પન્ન થાય

છે. નિભિત્તભૂત અન્ય દ્રવ્ય તેના પરિણામોના ઉત્પાદક છે જ નહિ. તેથી આચાર્યદૈવ છેલ્લે કહે છે કે અમે જીવમાં ઉત્પન્ન થતાં રાગાદિભાવોના ઉત્પાદક પરદ્રવ્યોને જેતાં જ નથી, માનતા જ નથી, જાણતા જ નથી તો પછી તે પરદ્રવ્યો પર કોઈ કેમ કરીએ ?

ઉપરની તે ગાથા અને તેની ટીકાનો ભાવ ખોલતા જ્યયંદળ છાબડા ભાવાર્થમાં લખે છે “આત્મામાં રાગાદિ ઉત્પન્ન થાય છે તે પોતાના જ અશુદ્ધ પરિણામ છે” જે નિશ્ચયનયથી વિચાર કરવામાં આવે તો અન્ય દ્રવ્ય રાગાદિને ઉત્પન્ન કરવાવાળા નથી, અન્ય દ્રવ્ય તેના નિભિત્ત માત્ર છે; કેમકે અન્ય દ્રવ્યના ગુણપર્યાય અન્યદ્રવ્ય ઉત્પન્ન કરતાં નથી - એ નિયમ છે. જે એમ માને છે - એવું એકાંત ગ્રહણ કરે છે કે “પરદ્રવ્ય જ મને રાગાદિ ઉત્પન્ન કરાવે છે ” તે નયવિભાગને સમજતો નથી, તે ભિથ્યાદ્રાઘિ છે. આ રાગાદિક જીવના સત્ત્વમાં ઉત્પન્ન થાય છે, પરદ્રવ્ય તો નિભિત્ત માત્ર છે - એવું માનવું તે સમ્યગ્જ્ઞાન છે.

એટલા માટે આચાર્યદૈવ કહે છે કે - આપણે રાગ-દ્રેષ્ણની ઉત્પત્તિમાં અન્ય દ્રવ્ય પર કોઈ કેમ કરીએ ? રાગ-દ્રેષ્ણનું ઉત્પન્ન થવું એ તો આપણો પોતાનો જ અપરાધ છે.

આ ગાથાની ટીકામાં આચાર્ય જ્યયસેન એ સ્પષ્ટ કરે છે કે કાર્ય ઉપાદાન કારણની જેમ સમાન જ હોય છે, નિભિત્તની સમાન નહિ. તેનું કથન મૂલતઃ આ પ્રમાણે છે -

“કુંભારાદિ બહિરંગ નિભિત્તભૂત અન્ય દ્રવ્ય દ્વારા ઉપાદાનકૃપ માટીના અચેતન ગુણનો નાશ થઈ શકે નહિ; કેમકે ચેતનના ચેતનગુણનો અચેતન દ્વારા અને અચેતનના અચેતનગુણનો ચેતન દ્વારા નાશ કરી શકાય નહિ; એથી માટી આદિ બધા દ્રવ્ય જે ઘટપટાદિકૃપમાં ઉત્પન્ન થાય છે તે સર્વ પોતાના ઉપાદાનકારણથી જ માટીકૃપ રહીને જ ઉત્પન્ન થાય છે; કુંભારાદિ બહિરંગ નિભિત્તકૃપ નહિ; કારણ કે ઉપાદાનકારણના સહ્યભાવમાં જ કાર્ય થાય છે એવો અટલ સિદ્ધાંત છે.

આનાથી એ સિદ્ધ થાય છે કે જે કે અજાનીના રાગાદિ પંચન્દ્રિયના વિષયક શબ્દાદિ બહિત્પૂર્વક ઉત્પન્ન થાય છે તથાપિ તે રાગાદિ ચેતનમાત્ર જીવસ્વરૂપ જ છે, શબ્દાદિદ્રૂપ અચેતન નહિ - એ ભાવાર્થ છે.”

આ ગાથાનો ભાવ પૂરુષેવશ્રી આ પ્રકારે સ્પષ્ટ કરે છે^૧ -

“જીવની પર્યાયમાં જે રાગ-દ્રેષ્ટ, પુણ્ય-પાપ તથા કામ-કોદ્ધ, વિષયવાસના આદિના પરિણામ થાય છે તે બધા પરદ્રવ્યથી નથી થતાં તેથી એવી શંકા જ ન કરવી કે વિકાર પરદ્રવ્યના કારણે થાય છે; કર્મથી થાય છે.

ભગવાન ! તૂ કોણ છે ? તને તેની પણ ખખર નથી ! અરે ! ન તો તું પરદ્રવ્યમાં કંઈ કરી શકે છે અને ન તો પરદ્રવ્ય તારામાં કંઈ કરી શકે છે; કેમકે આવી યોગ્યતા જ કોઈ દ્રવ્યમાં નથી કે જે પરમાં કંઈ કરી શકે. એટલે કે કોઈપણ પરદ્રવ્યનું કાર્ય હું કરી શકું છું અને પરદ્રવ્ય માઝે કાર્ય કરે છે કરી શકે છે - એમ માનવું તે મિથ્યા છે; પરંતુ આવું ભ્રમઝ્ઞ અજ્ઞાન સંસારી જીવોને અનાદિથી છે.

કેટલાક લોકો આ મિથ્યાશ્રદ્ધાનને દર્શનમોહનીય કર્મના ઉદ્ઘથી થયા માને છે; પરંતુ ભાઈ ! આ માન્યતા પણ જુઠી છે; કારણ કે મોહકર્મનો ઉદ્ઘ તો નિમિત્ત માત્ર છે અને કર્મોદ્ઘયથી રાગ-દ્રેષ્ટપ વિભાવ ભાવ થાય નહિ. છતાંપણ જે કર્મોદ્ઘયક નિમિત્તથી કખાયાદિ થવાનું માને છે; તેમની આ માન્યતા સર્વથા મિથ્યા છે.

ખરેખર જીવમાં જે ભ્રમઝ્ઞ ભાવ થાય છે, મિથ્યાત્વાદિ ભાવ થાય છે તે બધા સ્વયં તે સમયની તેવી યોગ્યતાથી જ થાય છે, કર્મોદ્ઘયથી નહિ.

^૨ જુવો ! આત્મમાં આવું સામર્થ્ય તથા યોગ્યતા તો છે કે તે ત્રણકાળ-ત્રણલોકની સર્વ વાતોને એક સાથ જાળે; પરંતુ પર પદાર્થોમાં કાંઈ કરી શકે - એવું સામર્થ્ય જીવમાં નથી. આ શરીરને ચલાવવું, હાથ-પગ હલાવવા અથવા બહારની ધનાદિ સામગ્રીનો સંગ્રહ કરવાની યોગ્યતા

^૧ હિંદી પ્રવચન રત્નાકર ભાગ ૮ પાના ૩૬૫/૩૬૬

^૨ હિંદી પ્રવચનરત્નાકર ભાગ ૮ પાના ૩૬૬

જીવમાં નથી. છતાંપણ જે એવું માને છે કે હું શરીરને ચલાવી શકું છું, હાથ-પગ હલાવી શકું છું. ઘનાદિ કમાઈ શકું છું અને કુટુંબપરીવારનું ભરણ-પોષણ કરી શકું છું; તો તે જુઠો છે, મિથ્યાદ્રાષ્ટિ છે. અહા ! પરમાણુ જડ છે અને તે જડ પરમાણુનું કાર્ય જડથી જ થાય છે, આત્માથી નહિ તથા રાગ-દ્રેષ આદિ જીવના પરિણામ છે અને તે સ્વયં જીવથી જ થાય છે, પરદ્રવ્યથી નહિ.

આ આંખોની પાંપણ જે ઉંચી-નીચી થાય છે, તે પણ જીવ નથી કરતો; કારણકે પાંપણ અલગ દ્રવ્ય છે અને જીવ અલગ દ્રવ્ય છે. ભાઈ ! આત્મા એક તણખલાના બે ટુકડા ન કરી શકે, એવું જ વસ્તુનું સ્વરૂપ છે. અહા ! ભગવાન સર્વજાહેવે અનંત દ્રવ્ય જોયા છે, અનંત જીવ, અનંતાનંત પુદ્ગલ, એક એક ધર્મ, અધર્મ, આકાશ અને અસંખ્યાત કાલાણુ - આ રીતે અનંત દ્રવ્ય જોયા છે તથા તેમાં કોઈ એક દ્રવ્ય કોઈપણ બીજા દ્રવ્યનું કંઈપણ કરી શકતું નથી; કેમકે કોઈ એક દ્રવ્ય દ્વારા બીજા કોઈ દ્રવ્યના ગુણોનો ઉત્પાદ કરવાની અયોગ્યતા છે. એવી ભગવાન સર્વજાહેવે પોતાની દિવ્ય ધ્વનિ દ્વારા વસ્તુની સ્વતંત્રતાની ઘોષણા કરી છે.^૧

અહા ! આચાર્યદેવે સંકેપમાં આવો મહાસિદ્ધાંત ભતાવી દીઘો છે કે પરદ્રવ્યનો સહિયોગ કરવા માટે દરેક દ્રવ્ય અપંગ છે. કોઈપણ અન્ય દ્રવ્યનો સહિયોગ કરવા અસમર્થ છે. એવી કોઈપણ દ્રવ્યમાં યોગ્યતા જ નથી કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે.^૨

ભાઈ ! આ મહાસિદ્ધાંત છે કે પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વભાવથી જ પોતપોતાની સ્વકાળમાં થવા યોગ્ય પર્યાયકૃપે પરિણામિત થતા રહે છે. એવીજ દ્રવ્યની પર્યાયગત યોગ્યતા છે. આમાં પરદ્રવ્યનું કાંઈપણ કર્તૃત્વ નથી.^૩

કેવળી ભગવાનના કેવળ જ્ઞાનમાં જગતના સર્વ અનંતાનંત પદાર્થ

૧ હિંદી પ્ર. રત્નાકર ભાગ ૮ પાના ૩૬૭

૨ હિંદી પ્ર. રત્નાકર ૮ પા. ૩૬૮

૩ હિંદી પ્ર. રત્નાકર ૮ પા. ૩૭૦

સ્વતંત્ર સ્વસહાય પરિણમતા જેવામાં આવ્યા છે. દેરક દ્રવ્ય પોતાની પર્યાયથી સ્વયં સ્વતંત્ર જ પરિણમે છે. અહો ! દ્રવ્યમાં ગુણ તો ત્રિકાળ નિત્ય સ્વસહાય જ છે; તેની એક એક સમયની પર્યાય પણ સ્વસહાય જ છે.

દ્રવ્યના સ્વભાવથી જ સ્વતંત્ર ઉત્પન્ન થાય છે, બીજા દ્રવ્યોથી નહિ. ભાઈ ! આ મહાસિદ્ધાંત આચાર્યદ્વારા આ ગાથામાં સિદ્ધ કર્યો છે. અહો ! આ સરસ અને અલૌકિક ગાથા છે.

જેનું પરમ સૌભાગ્ય હોય છે તેને એવો આ ભવનો અભાવ કરવાવાળો મહાસિદ્ધાંત કાનમાં પડે છે. આવા સિદ્ધાંતોને સમજવા માટે પણ મહાપુરુષાર્થ લેઈએ.^૧

અજાની લુલ પાસે ને લુવનભરની કમાઈથી દસ-વીસ લાખની મુડી થઈ ગઈ હોય તો કમાયાનું અભિમાન કરે છે અને આખી બિંદગી પરિગ્રહાનાંદી રૈદ્રધ્યાન કરે છે. પરંતુ ભાઈ ! આ તો લુવન હારી જવાની વાત છે.^૨

આ પ્રકારે આ ગાથામાં એ જ કહેવામાં આવ્યુ છે કે જે પ્રકારે ઘડો પોતાની ઉપાદાનકૃપ માટીનું જ કાર્ય છે અને માટી રૂપ જ છે તેને બનાવવાના વિકલ્પથી પરિણમિત કુંભારકૃપ નહિ, નિમિત્તકૃપ નહિ; એ જ પ્રકારે રાગાદિભાવ પણ પોતાના ઉપાદાનકૃપ ચેતન આત્માનું જ કાર્ય છે, ચેતનકૃપ જ છે; પરકૃપ નહિ, અચેતનકૃપ નહિ, અચેતન કર્મકૃપ નહિ; નિમિત્તકૃપ નહિ.

આ પ્રકારે જ્યારે આવો નિર્ણય પાકો થઈ જય છે ત્યાર પછી નિમિત્તકૃપ પરદ્રવ્યો ઉપર કોષ કરવાનું કોઈ કારણ બાકી રહેતું નથી. તેથી નિર્ધારણ રૂપમાં આચાર્યદ્વારા કહે છે કે જ્યારે કોઈ પરદ્રવ્ય આપણા સુખ-દુઃખ અને રાગદ્રોષના કારણ દેખાતા જ નથી તો પછી આપણે એ પરદ્રવ્યો પર કોષ શા માટે કરીએ ?

૧ હિંદી પ્રવચન રત્નાકર ભાગ ૮ પાના ૩૭૩

૨ હિંદી પ્રવચન રત્નાકર ભાગ ૮ પાના ૩૭૫

તાત્પર્ય એ છે કે આપણે આપણા સુખ-દુःখના કારણ પરમાં ન શોધતા પોતામાં જ શોધીએ; પોતાને જ જણો-માને પોતામાં જ સમાઈ જય - એ જ માર્ગ છે.

હવે ગાથા અને ટીકાના ભાવને પોષ્ટ તથા આગામી ગાથાઓની ઉત્થાનિકાઢ્ય બે કળણ કાવ્ય લખે છે; જે આ પ્રમાણે છે -

(માલિની)

યदિહ ભવતિ રાગદ્વેષદોષપ્રસૂતિ:
કતરદપિ પરેણાં દૂષણ નાસ્તિ તત્ત્ર |
સ્વયમયમપરાધી તત્ત્ર સર્પત્યબોધા
ભવતુ વિદિતમસ્તંયાત્વબોધોડસ્મિ બોધ: ॥૨૨૦॥

(રથોદ્વાતા)

રાગજન્મનિ નિમિત્તતાં પર- દ્રવ્યમેવ કલયંતિ યે તુ તે ।
ઉત્તરંતિ ન હિ મોહવાહિની શુદ્ધબોધવિધુરાંધબુદ્ધય: ॥૨૨૧॥

(રોલા)

રાગ-દેખ પૈદા હોતે હેં ઈસ આત્મ મેં ।
ઉસમેં પરદ્રવ્યોં કા કોઈ દોષ નહીં હે ।
યહ અજ્ઞાની અપરાધી હે ઈનકા કન્ના ।
યહ અબોધ હો નાણ કિ મૈં તો સ્વયં જ્ઞાન હું ॥૨૨૦॥

અરે રાગ કી ઉત્પત્તિ મેં પરદ્રવ્યોં કો ।
એકમાત્ર કારણ બતાતો જે અજ્ઞાની ॥
શુદ્ધબોધ સે વિરહિત વે અંધે જન જગ મેં ।
અરે કબી ભી મોહનદી સે પાર ન હોંએ ॥૨૨૧॥

આ આત્મામાં જે રાગ-દ્વેષઢ્ય દીષોની ઉત્પત્તિ થાય છે, તેમાં પરદ્રવ્યોનો કોઈ દોષ નથી; તેમાં મૂળ અપરાધી તો અજ્ઞાન જ છે. એવું જાણવાથી જ્યારે અજ્ઞાનનો નારા થઈ જય ત્યારે પદ્ધી હું તો જ્ઞાન જ છું.

જે લોકો રાગની ઉત્પત્તિમાં પરદ્રવ્યને જ મૂળ કારણ માને છે એટલે કે પરદ્રવ્યના નિમિત્તથી જ રાગ ઉત્પન્ન થાય છે - એમ માને છે; શુદ્ધ જ્ઞાનથી રહિત તેવા અંધબુદ્ધિ લોકો મોહનહીને પાર કરી શકતા નથી.

આ કળશોના ભાવને ભાવાર્થમાં પંહિત જ્યયચંદ્રલુ છાબડા આ પ્રકારે સ્પષ્ટ કરે છે.

“અજ્ઞાની લુલ પરદ્રવ્યથી રાગ-દ્રેષ્ણની ઉત્પત્તિ થતી માનીને પર દ્રવ્ય પર કોપ કરે છે કે ‘આ પર દ્રવ્ય મને રાગ-દ્રેષ્ણ ઉત્પન્ન કરાવે છે, તેને દૂર કરું’ - આવા અજ્ઞાની લુલને સમજવા માટે આચાર્યદિવ ઉપદેશ આપે છે કે રાગદ્રેષ્ણની ઉત્પત્તિ અજ્ઞાનથી આત્મામાં જ થાય છે અને તે આત્માના જ અશુદ્ધ પરિણામ છે. એટલા માટે આ અજ્ઞાનનો નાશ કરો, સમ્યગ્જ્ઞાન પ્રગટ કરો, આત્મા જ્ઞાનસ્વરૂપ છે - તેવો અનુભવ કરો; પરદ્રવ્યને રાગ-દ્રેષ્ણ ઉત્પન્ન કરવાવાળા માનીને તેના પર કોપ ન કરો.

શુદ્ધનયનો વિષય આત્મા અનંત શક્તિવંત, ચૈતન્ય ચમત્કાર માત્ર, નિત્ય, અલેદ એક છે. તે પોતાના જ અપરાધથી રાગ-દ્રેષ્ણરૂપ પરિણામિત થાય છે. એવું નથી કે જે પ્રમાણે નિમિત્તભૂત પરદ્રવ્ય પરિણામિત કરે છે; તે પ્રમાણે આત્મા પરિણામિત થાય છે અને તેમાં આત્માનો કંઈ પુરુષાર્થ છે જ નહિ. જેને આત્માના આવા સ્વરૂપનું જ્ઞાન નથી, તે એમ માને છે કે પરદ્રવ્ય આત્માને જે પ્રમાણે પરિણામન કરાવે છે : તે પ્રમાણે આત્મા પરિણામિત થાય છે, એવું માનવાવાળા મોહરૂપ નહીને પાર નથી કરી શકતા. અથવા મોહ સૈન્યને હરાવી શકતા નથી; તેમના રાગ-દ્રેષ્ણ મટતા નથી; કારણકે રાગ-દ્રેષ્ણ કરવામાં જે આપણો પુરુષાર્થ હોય તો તેનો નાશ કરવામાં આપણો પુરુષાર્થ હોવો જોઈએ; પરંતુ જે બીજના કરવાવાથી રાગદ્રેષ્ણ થતો હોય તો બીજા તો રાગ-દ્રેષ્ણ કરાવ્યા કરે, તો આત્મા તેનો કેવી રીતે નાશ કરી શકે. એટલા માટે રાગ-દ્રેષ્ણ પોતાના કરવાથી થાય છે અને પોતાના મટાડવાથી મેરે છે. આ પ્રકારે કથંચિત માનવુ તે સમ્યગ્જ્ઞાન છે.”

પાંઠે રાજમલલુ કળશ ટીકામાં લખે છે :-

“ભાવાર્થ આ પ્રમાણે છે કે જીવ દ્વારા સંસાર અવસ્થામાં રાગ-દ્રેષ્ટ-મોહ અશુદ્ધચેતનાદ્રૂપ પરિણમે છે; તે વસ્તુના સ્વરૂપનો વિચાર કરતાં જીવનો દોષ છે, પુદ્ગલદ્રવ્યનો જરા પણ દોષ નથી; કારણકે જીવદ્રવ્ય પોતાના વિભાવ મિથ્યાત્વદ્રૂપ પરિણમતો થકો પોતાના અજ્ઞાનપણાને લીધે રાગ-દ્રેષ્ટ-મોહદ્રૂપ પોતે પરિણમે છે; જેકે ક્યારેક શુદ્ધ પરિણતિદ્રૂપ થઈને શુદ્ધસ્વરૂપના અનુભવદ્રૂપ પરિણમે, રાગ-દ્રેષ્ટ-મોહદ્રૂપ ન પરિણમે તો પુદ્ગલદ્રવ્યનો શું ઈલાજ છે.

જીવદ્રવ્ય શુદ્ધસ્વરૂપ છે. તેમાં મોહ-રાગ-દ્રેષ્ટદ્રૂપ અશુદ્ધ પરિણતિ થાય છે. તે અશુદ્ધ પરિણતિને નાશ કરવાનો ઉપાય એ છે કે સહજ જ દ્રવ્ય શુદ્ધત્વદ્રૂપ પરિણમે તો અશુદ્ધ પરિણતિ મટે બીજે તો કોઈ ઉપાય નથી.

આઠ કર્મ, શરીર આદિ નોકર્મ તથા બાહ્ય ભોગસામગ્રીદ્રૂપ પુદ્ગલદ્રવ્યનું નિમિત્ત પામીને જીવ રાગાદિ અશુદ્ધદ્રૂપ પરિણમે છે - એવી શ્રદ્ધા કોઈ જીવરાશિ કરે છે તે મિથ્યાદ્રાચિ છે - અનંત સંસારી છે, જે એવું વિચારે છે કે સંસારીજીવને રાગાદિ અશુદ્ધદ્રૂપ પરિણમનશક્તિ નથી. પુદ્ગલકર્મ બલાત્કારે પરિણમાવે છે. જે એમ છે તો પુદ્ગલકર્મ તો હંમેશા વિદ્યમાન છે જ. જીવને શુદ્ધ પરિણામનો અવસર ક્યાં ? કોઈ અવસર નહિ.”

કળશ દીકાનો આધાર લઈ કવિવર બનારસીહાસળ આ કળશોનો ભાવ પાંચ દુષ્ટામાં આ પ્રમાણે વ્યક્ત કરે છે :-

(દોહા)

કોઉ મૂરખ યોં કહે, રાગ દોષ પરિનામ ।

પુગગલ કી જોરાવરી, વરતેં આતમરામ ॥

જ્યોં જ્યોં પુગગલ બલ કરૈ, ધરિ-ધરિ કર્મજ લેખ ।

રાગ દોષ કી પરિનમન, ત્યો-ત્યોં હોઈ વિશેષ ॥

ઇહિવિધિ જો વિપરીત પખ, ગહે સદહે કોઈ ।

સો નર રાગ વિરોધ સૌં, કબહૂં ભિન્ન ન હોઈ ॥

સુગુરુ કહે જગ મૈં રહે, પુરુગલ સંગ સદીવ ।
સહજ સુધ્ર પરિનમનિ કો, ઓસર લહે ન જીવ ॥

તાતેં ચિદભાવનિ વિષે, સમર્થ ચેતન રાજ ।
રાગ વિરોધ મિથ્યાત મૈં, સમકિત મૈં સિવ ભાઉ ॥

કોઈ મૂર્ખ એમ કહે છે કે આત્મામા રાગદ્રેષના પરિણામ પુરુગલ
કર્મની જેરાવરીથી થાય છે.

કર્મનો વેષ ધારણ કરીને પુરુગલ જે જે અંશોમાં જેર કરે છે તે
તે અંશોમાં રાગ-દ્રેષના વિરોધ પરિણામ થાય છે. આ રીતે ડેટલાક લોકો
વિપરીત પક્ષને ગ્રહણ કરે છે, તેનું શ્રદ્ધાન કરે છે; તેવા લોકો રાગદ્રેષથી
ક્યારેય જુદા થઈ શકતા નથી.

સુગુરુ કહે છે કે જગતમાં પૌર્ણાલિક કર્મોનો સાથ તો સદાય રહે
છે; આવી સ્થિતિમાં જીવને પોતાના સહજ શુદ્ધ પરિણામનાં અવસર કદાપી
મળેજ નહિ. એટલા માટે એ બરાબર છે કે ચિદભાવોને કરવામાં ચેતનરાજ
હંમેશા સમર્થ છે. રાગદ્રેષની ઉત્પત્તિ તો મિથ્યાભાવોનું ફળ છે અને
સમ્યક્કાલાય મુક્તિનું કારણ છે.

આ કળશોનો ભાવ પૂરુદેવશી આ પ્રમાણે સ્પષ્ટ કરે છે^૧ :-
“આત્માની પર્યાયમાં જે રાગદ્રેષ ઉત્પન્ન થાય છે, તે પર્યાયનો અપરાધ
છે, તેમાં પરદ્રવ્યનો જરાપણ અપરાધ નથી. પરદ્રવ્યોને રાગાદિ દોષોને
ઉત્પન્ન કરાવવાવાળા માની તેના પર કોધ ન કરો

અહિં એકલો રાગ શબ્દ કહ્યો છે પણ રાગ સાથે દ્રેષ પણ લેવો.
રાગ-દ્રેષમાં બધી કખાયો આવી જય છે. આ બધાની ઉત્પત્તિમાં જેઓ
માત્ર પરદ્રવ્યને જ કારણ માને છે તેઓ અજ્ઞાની છે, દીર્ઘ સંસારી છે જે
કે રાગ પરદ્રવ્યનું લક્ષ કરવાથી થાય છે; પરંતુ પરપદાર્થ રાગનું સાચું કારણ
નથી. જ્યારે જીવની જ્ઞાનપર્યાય સ્વયં પરનું લક્ષ કરે છે, ત્યારે તેને રાગ-

^૧ હિંદી પ્રવચન રત્નાકર ભાગ ૮ પાના ૩૬૦

દેખની ઉત્પત્તિ થાય છે. જે રાગની ઉત્પત્તિમાં કર્મને કારણ માને છે તે અજાણી છે. તે કયારેય મોહ નહીને પાર નહિ કરી શકે. દર્શનમોહના નિમિત્તથી મિથ્યાત્વ થાય છે, ચારિત્રમોહના ઉદ્ઘયથી જીવને રાગ-દેખાદિ થાય છે એવું કથન ગોમટસાર આદિમાં આવે છે.

એવા કથનો શાસ્ત્રોમાં છે ખરા; પરંતુ તે તો વ્યવહારનયથી નિમિત્તની મુખ્યતાથી કરવામાં આવ્યા છે. કર્મ વિકારનું વાસ્તવિક કારણ નથી. એ તો માત્ર એટલું બતાવે છે કે જે વિકાર થયો છે તે કોના લક્ષે વા કોના નિમિત્તથી થયો છે.^૧

આત્મા પોતાના અપરાધથી રાગ-દેખડૃપ થાય છે. અહા ! સ્વયં વિકાલ એકડૃપ જ્ઞાનસ્વરૂપ હોવા છીતાં પણ જે વર્તમાન પર્યાયમાં મોહ-રાગ-દેખડૃપે પરિણામે છે, તે પોતાના અપરાધથી જ પરિણામે છે. જે પર્યાયમાં અશુદ્ધડૃપથી-વિકારડૃપથી ન પરિણામે તો પોતે તો સ્વયં ચિદાનંદ પ્રભુ છે અને તો તો તેને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવવો જોઈએ, પરંતુ તેમ તો થતું જ નથી એટલા માટે પર્યાયમાં રાગાદિ વિકાર છે અને તે પોતાના અપરાધથી છે.^૨

એવું નથી કે જેવું નિમિત્તભૂત પરદ્રવ્ય પરિણામાવે તેવું પરિણામે છે અને તેમાં આત્માનો કંઈ પુરુષાર્થ નથી. એવું પણ નથી કે જેવો કર્મનો ઉદ્ઘ આવે તે પ્રમાણે આત્માએ - પરિણામવું જ પડે. ખરેખર તો પોતાના ઉંઘા પુરુષાર્થથી જ આત્મા સ્વયં રાગ-દેખડૃપ પરિણામે છે, કર્મોદ્ઘયના કારણે નહિ.

હવે કહે છે કે જેને જ્ઞાન નથી તેઓ એમ માને છે કે આત્માને પરદ્રવ્ય અથવા કર્મોદ્ઘય જેમ પરિણામાવે તેમ આત્માને - પરિણામવું પડે છે પરંતુ એમ માનવાવાળા કંદિ મોહનહીને પાર નહિ કરી શકે.^૩

૧ લિંદી પ્ર. રત્નાકર ભાગ ૮ પા.૩૮૨

૨ લિંદી પ્ર. રત્નાકર ભાગ-૮ પાના ૩૮૭

૩ લિંદી પ્ર. રત્નાકર ભાગ ૮ પાના ૩૮૮

પર્યાયદ્વારાં જેતા પર્યાયમાં જે રાગ-ક્રેષ છે તે પોતાના અપરાધથી જ છે. કર્માનો ઉદ્ઘ આત્માને અપરાધ ન કરાવી શકે પરંતુ જીવના ઉંઘા પુરુષાર્થથી જ રાગાદિ વિકાર થાય છે. તેથી કર્મા ઉપર જ દોષ ન નાખો. જે વિકાર થવા માટે કર્મા પર દોષ નાખે છે, તેઓ અજ્ઞાની છે, તેમના રાગ-ક્રેષ મટતા નથી.

હવે કહે છે કે અજ્ઞાનીના રાગ-ક્રેષ નહિ મટવાનું મુખ્ય કારણ એ છે કે પુરુષ-પાપ આદિ વિકારીભાવો થવામાં પોતાના ઉલ્લા પુરુષાર્થને ન માનતા કર્માને જ કારણ માને છે.

જે પોતાના ઉંઘા પુરુષાર્થને કારણ માને તો (સમ્યક) સાચો પુરુષાર્થ કરી તેને મટાડી શકે છે; પરંતુ પરના કરાવવાથી જ રાગ-ક્રેષ કરાવ્યા જ કરશે; તેને આત્મા કેવી રીતે મટાડી શકશે? તેથી એવું માનવું તે જ સમ્યગ્જ્ઞાન છે કે રાગ-ક્રેષ આદિ પોતાની ભૂલથી જ થાય છે અને પોતાની ભૂલ સુધારી દઈ તેને મટાડી શકે છે.

સંમિક્તિ ધર્મા જીવોને પણ રાગ-ક્રેષ પોતાની અસ્થિરતાના અપરાધથી હોય છે, કર્માદ્વયથી નહિ એમ ધર્થાર્થ માનવું જેઈએ.¹

ઉપરના સંપૂર્ણ કથનનો સાર એ છે કે રાગ-ક્રેષકૃપ વિકારીભાવોની ઉત્પત્તિમાં પરદ્રવ્યોનો કોઈ દોષ નથી; પરદ્રવ્ય આ આત્માને બણજ્ઝરીથી રાગ-ક્રેષકૃપ - પરિણમાવતા નથી; પણ આ આત્મા જ પોતાના અજ્ઞાનભાવના કારણે રાગ-ક્રેષકૃપ પરિણમે છે તથા જ્યારે આ આત્મા સ્વયં પોતાના અજ્ઞાનના કારણે રાગ-ક્રેષકૃપ પરિણમે છે; ત્યારે પરદ્રવ્ય સહજભાવથી નિમિત્ત માત્ર થાય છે.

પરદ્રવ્યોની નિમિત્તતા હેઠી તેને જ રાગ-ક્રેષનો કર્તા માની લેવો તે સ્વયં અજ્ઞાનભાવ છે અને આ અજ્ઞાનભાવ તે જ મુખ્ય બંધનું કારણ છે.

આ વાતને હવે પછીની ગાથાઓથી સ્પષ્ટ કરશે.

¹ લિંગી પ્ર. રત્નાકર ભાગ ૮ પા. ૩૮૭/૩૮૮/૩૮૯/૩૯૦

સમયસાર ગાથા ૩૭૩-૩૮૨

જે વાત અગાઉ કળશોમાં કહેવામાં આવી છે; હવે તેની પુષ્ટિ ગાથાઓ મારફત કહે છે.

ણિંદિયસંથુયવયણાણિ પોગલા પરિણમંતિ બહ્યાણિ ।
 તાણિ સુણિકણ રૂસડ તૂસડ ય પુણો અહું ભણિઅ ॥૩૭૩॥

પોગલદવ્બં સદ્ગતપરિણયં તસ્સ જડ ગુણો અણ્ણો ।
 તહ્યા ણ તુમં ભણિઓ કિંચિવિ કિં રૂસસિ અબુદ્ધો ॥૩૭૪॥

અસુહો સુહો વ સહો ણ તં ભણડ સુણસુ મંતિ સો ચેવ ।
 ણ ય એડ વિણિગાહિં સોયવિસયમાગયં સહં ॥૩૭૫॥

અસુહં સુહં વ રૂણં ણ તં ભણડ પિચ્છ મંતિ સો ચેવ ।
 ણ ય એડ વિણિગાહિં ચક્ખવિસયમાગયં રૂવં ॥૩૭૬॥

અસુહો સુહો વ ગંધો ણ તં ભણડ જિગઘ મંતિ સો ચેવ ।
 ણ ય એડ વિણિગાહિં ઘાણવિસયમાગયં તુ ગંધં ॥૩૭૭॥

અસુહો સુહો વ રસો ણ તં ભણડ રસય મંતિ સો ચેવ ।
 ણ ય એડ વિણિગાહિં રસણવિસયમાગયં તુ રસં ॥૩૭૮॥

અસુહો સુહો વ ફાસો ણ તં ભણડ ફુસસુ મંતિ સો ચેવ।
 ણ ય એડ વિણિગાહિં કાયવિસયમાગયં ફાસં ॥૩૭૯॥

અસુહો સુહો વ ગુણો ણ તં ભણડ વુજ્જ મંતિ સો ચેવ।
 ણ ય એડ વિણિગાહિં બુદ્ધિવિસયમાગયં તુ ગુણં ॥૩૮૦॥

असुहं सुहं व दव्वं ण तं भणइ बुज्ज्ञ मःति सो चेव ।

ण य एइ विणिगगहिं बुद्धिविसयमागयं दव्वं ॥३८१॥

एयं तु जाणिऊण उवसमं णेव गच्छई मूढो ।

णिगगहमणा परस्स य सयं च बुद्धिं सिवमपत्तो ॥३८२॥

ऐ ! पुद्गलो भडुविध निंदा-स्तुतिवयन३५ परिगुमे,

तेने सुणी, 'मुज्जने कल्पु' गाँगी, रोप तोप ज्ञवो करे. ३७३

पु३६'गलदरव शब्दत्वपरिगत, तेडनो गुगु अन्य छे,

तो नव कल्पु कंदि पाग तने, हे अभुध ! रोप तुं क्यम करे ? ३७४

शुभ के अशुभ जे शब्द ते 'तुं सुग मने' न तने कहे,

ने ज्ञव पाग ग्रहवा न जाये कार्णःगोचर शब्दने; ३७५

शुभ के अशुभ जे इप ते 'तुं ज्ञे मने' न तने कहे,

ने ज्ञव पाग ग्रहवा न जाये यक्षुगोचर इपने; ३७६

शुभ के अशुभ जे गंध ते 'तुं सूंध मुज्जने' नव कहे,

ने ज्ञव पाग ग्रहवा न जाये धारुगोचर गंधने; ३७७

शुभ के अशुभ रस ज्ञेह ते 'तुं चाख मुज्जने' नव कहे,

ने ज्ञव पाग ग्रहवा न जाये रसनगोचर रस अरे ! ३७८

शुभ के अशुभ जे स्पर्श ते 'तुं स्पर्श मुज्जने' नव कहे,

ने ज्ञव पाग ग्रहवा न जाये कायगोचर स्पर्शने; ३७९

शुभ के अशुभ जे गुगु ते 'तुं ज्ञाग मुज्जने' नव कहे,

ने ज्ञव पाग ग्रहवा न जाये बुद्धिगोचर गुगुने; ३८०

शुभ के अशुभ जे द्रव्य ते 'तुं ज्ञाग मुज्जने' नव कहे,

ने ज्ञव पाग ग्रहवा न जाये बुद्धिगोचर द्रव्यने. ३८१

-आ ज्ञागीने पाग मूढ ज्ञव पामे नहि उपशम अरे!

शिव बुद्धिने पामेल नहि ए पर ग्रहागु करवा यहे. ३८२

ભાવાર્થ :- શબ્દાદિક જડ પુછગલદ્રવ્યના ગુણો છે. તેઓ આત્માને કંઈ કહેતા નથી, કે ‘તું અમને ગ્રહણ કર (અર્થાત् તું અમને જાણ);’ અને આત્મા પણ પોતાના સ્થાનથી ચ્યુત થઈને તેમને ગ્રહવા (-જાણવા) તેમના પ્રત્યે જતો નથી. જેમ શબ્દાદિક સમીપ ન હોય ત્યારે આત્મા પોતાના સ્વરૂપથી જ જાણો છે, તેમ શબ્દાદિક સમીપ હોય ત્યારે પણ આત્મા પોતાના સ્વરૂપથી જ જાણો છે. આમ પોતાના સ્વરૂપથી જ જાણતા એવા આત્માને પોતાપોતાના સ્વભાવથી જ પરિણમતા શબ્દાદિક વિચિત્રમાત્ર પણ વિકાર કરતા નથી, જેમ પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એવા દીવાને ઘટપટાદિ પદાર્થો વિકાર કરતા નથી તેમ. આવો વસ્તુસ્વભાવ છે, તોપણ જવ શબ્દને સાંભળી, સ્વરૂપને દેખી, ગંધને સૂંધી, રસને આસ્વાહી, સ્પર્શને સ્પર્શી, ગુણ-દ્રવ્યને જાહી, તેમને સારાં-નરસાં માની રાગદ્રેષ કરે છે, તે અજ્ઞાન જ છે.

આ ગાથાઓના ભાવો પૂર્ણ ગુરુદેવ આ પ્રમાણે સ્પર્શ કરે છે ‘હેખો, અહિં દિપક અને ઘટનો દાખલો આપીને આ મહત્વપૂર્ણ સિદ્ધાંત કહ્યો છે કે ઘટપટાદિ બાબ્ય પદાર્થ પોતાના સ્વભાવથી જ વિચિત્ર પરિણાતિને પ્રાપ્ત થાય છે, દિપકના કારણે નહિ તથા તે બાબ્ય પદાર્થ પોતાના સ્વરૂપથી જ પ્રકાશિત થતાં થકા દિપકમાં જરાપણ વિકિયા ઉત્પન્ન કરતાં નથી.

જે એમ કહેવાય છે કે દાણા દાણા પર લઘું છે ખાવાવાળાનું નામ; તેવી રીતે પ્રત્યેક જોય પદાર્થ પર તેને જાણવાવાળી જ્ઞાનપર્યાયનું પણ નામ લખેલ છે. જવા-આવવાવાળા દેરેક પરમાણુનું આવન-જવન પણ પોત-પોતાના સ્વસસ્મયે જ થાય છે, તેમાં પણ ફેરફાર કરવાની તાકાત કોઈમાં નથી. તેથી તું જે પરને હટાવવાની કે લેગા કરવાની તારી શક્તિનો અપવ્યય કરે છે - તે તારી મૂર્ખતા છે, પાગલપન છે.

આ વાણી જે જડધવનિ છે, નિનદા-પ્રશંસાના જે શબ્દો છે, તે આત્માને એમ નથી કહેતા “તું મને સાંભળ” એ જ રીતે સ્ત્રીનું સુંદરકૃપ તેનો કોમળ સ્પર્શ એવો આગ્રહ નથી કરતું કે ‘તું મને દેખ, તું મને સ્પર્શ

કર” પરંતુ અજ્ઞાની જીવ આમાં મિથ્યા સુખબુદ્ધિના ભ્રમમાં પડી પોતાને ઓળખતો નથી. બસ, આવા વિષયાનુરાગમાં સ્વયં અટકે છે, તેથી આચાર્યદ્વારા કહે છે કે “બહારમાંથી ઉપયોગ હટાવી ઉપયોગને સ્વરૂપસન્મુખ કર” આનાથી તને આત્મજ્ઞાન અને અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ થશે અને આના વિના તારો બધોજ શ્રમ નિરર્થક રહેશે.”^૧

જુબો, અહિં એ સિદ્ધાંત કહ્યો છે કે વસ્તુસ્વભાવ બીજાથી ઉત્પન્ન કરાવી શકાય નહિ. આત્માની જ્ઞાનની દરશા શબ્દાદિ બાહ્ય પદાર્થોથી ઉત્પન્ન થઈ શકે નહિ; કેમકે જ્ઞાનનું પોતાનું પરિણમન પોતાના ગુણથી ઉત્પન્ન થાય છે, પરથી નહિ. ભાઈ ! એમ માની લેવું કે શાસ્ત્રથી જ્ઞાન થાય, ભગવાનની વાણી સાંભળવાથી જ્ઞાન થાય, અથવા ગુરુનો ઉપદેશ સાંભળવાથી જ્ઞાન થાય, તે સાચું નથી; કેમકે વસ્તુસ્વરૂપ જ એવું નથી. પરવસ્તુથી ત્રણકાળમાં આત્માનું જ્ઞાન થાય નહિ. આપણો પોતાનો આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે, તેના પર દ્વારા કરવાથી જ આપણું જ્ઞાન અને આનંદ ઉત્પન્ન થાય છે. જ્યારે આ જીવ પોતાથી સમજે તો એ વખતે કાનમાં પહેલ ગુરુની વાણીને નિમિત્ત કહેવાય છે. ખરેખર તો આ આત્મા પોતેજ પોતાનો ગુરુ છે.

બીજી રીતે કહીએ તો સમયસારની ૧૭-૧૮ ગાથામાં તો આચાર્યદ્વારા એમ કહે છે કે ભલે અજ્ઞાનીની જ્ઞાન પર્યાય હો, તેમાં પણ આત્મા જાળાય જય છે. અજ્ઞાનીની જ્ઞાનપર્યાયનો સ્વભાવ પણ સ્વ-પરપ્રકાશક હોવાથી પર્યાયમાં સ્વજ્ઞાયક ચિદાનંદ ભગવાન પુરેપુરો જાળવામાં આવે છે. જ્ઞાનનો સ્વભાવ સ્વ-પરપ્રકાશક હોવાથી તેની પર્યાયમાં એકલુ પર જાળવામાં આવે એ શક્ય નથી. જ્ઞાનપર્યાયનો એવો સ્વભાવ જ છે કે તે સ્વને પણ જાણે અને પરને પણ જાણે.

જેવી રીતે ત્રિકાળી જ્ઞાનગુણનો સ્વ-પર પ્રકાશક સ્વભાવ છે તેવી રીતે તે જ્ઞાનગુણની વર્તમાન પ્રગટ પર્યાયનો સ્વભાવ પણ સ્વ-પરપ્રકાશક

^૧ લિંગ્દી પ્ર. રત્નાકર ભાગ ૧૦ પા.૮-૯

છે. આ કારણથી તે પર્યાયમાં બધા જીવોને સદાકાળ જ્ઞાયક જાણાતો હોવા છતાં રાગને વશ થવાથી અજ્ઞાની જીવ તે જ્ઞાયકને જોઈ શકતો નથી, તેમાં પોતાપણું સ્થાપિત કરતો નથી. તેની દ્રષ્ટિ ફક્ત પર્યાય અને રાગ પર રહે છે, તે કારણે “હું જ્ઞાયકને જાણું છું” - અજ્ઞાની તે વાત ભૂલી જય છે.

એક સમયની જાણવા-દેખવારૂપ સ્વ-પરપ્રકાશક પર્યાયમાં સંપૂર્ણ આત્મદ્રવ્યના અનંત ગુણ અને તેની ત્રણે કાળ સંબંધી અનંત પર્યાયો તથા છ દ્રવ્યોના અનંત દ્રવ્ય ગુણ પર્યાયો બધું જ એક સમયમાં જાણવામાં આવી જય છે.¹

અરે પ્રભુ ! તું કોણ છે ? અને તાડું સામર્થ્ય શું છે ? તેની તને ખખર નથી. નહિ તો આવી વાત જ કેમ કરે ?

જે વખતે આત્મા પોતાના સ્વ-પર પ્રકાશક સ્વભાવનાં સામર્થ્યથી પોતાને પ્રકાશિત કરે છે, તે જ વખતે તથા તે પ્રકારે કાળબેદ કર્યા વગર એક સમયમાં ત્રણકાળ અને ત્રણલોકના સંપૂર્ણ દ્રવ્ય-ગુણ-પર્યાયોને જાણે છે. તેનું એવું અલૌકિક સામર્થ્ય છે. બાઈ ! જે અંતરમાં જગૃત થઈ આ વાત દેખે તેને જ સમજમાં આવી શકે છે.

કેવળજ્ઞાન પોતાને જાણતા થકા બહારના દૂરવર્તી અથવા નિકટવર્તી પદ્ધારોને એક સમયમાં જ એક સાથે જાણે છે. કેવળજ્ઞાનના જાણવામાં કાળબેદ હોતો નથી. શ્રુતજ્ઞાનની પર્યાય પણ દૂરવર્તી અનંત સિદ્ધોને તથા સમીપવર્તી સમવશરણમાં બિરાજમાન અરહંતદેવને એક સાથે જાણે છે. “સ્વને” જાણતા થકા પરને જાણે-એવું જ એનું સ્વરૂપ છે.

જે રીતે દીપક પરને પ્રકાશિત કરવામાં તટસ્થ છે; એ જ રીતે આત્માનો સ્વભાવ પરપ્રતિ તટસ્થ છે. જેવી રીતે નહીમાં પાણીનો પ્રવાહ ચાલ્યો જતો હોય છે અને બન્ને કિનારા પોતાની જગાએ સ્થિર રહે છે; તે જ રીતે આત્મા પરને જાણે છે, તે પરથી સંબંધ રહિત રહીને કેવળ

૧ હિંદી પ્રથમન રલનકર ભાગ ૧૦, પાના. ૧૦-૧૧-૧૨-૧૩

જાતા-દ્રષ્ટા ભાવથી જાણે છે. આ વસ્તુનું સ્વક્રપ છે અને આ જ સાચો મોક્ષમાર્ગ છે.^૧

ગાથાઓ અને તેની દીકરામાં અહિં ઉદાહરણ સાથે તર્કસંગત પ્રકાશ પાડેલ છે.

(૧) ન તો બાહ્ય જ્ઞય પદાર્થ આત્માને એમ કહે છે કે તું અમને જાણ.

(૨) અને ન તો આત્મા તેમને જાણવા માટે તેમની પાસે જય છે; તે તો સમીપવત્તી અને દૂરવત્તી પદાર્થને પોતાના સ્વભાવને કારણે સહજભાવથી જાણે છે.

આ પ્રકારે આ આત્મા અને પરદ્રવ્યો વચ્ચે થતો એક સહજ જ્ઞય-જ્ઞાયક સંબંધ છે. આમાં પરસ્પર કોઈ પ્રકારની પરાધીનતા નથી.

આ વાતને સમજલવવા માટે આત્મઘ્�યાતિમાં દીપકનું ઉદાહરણ આપેલ છે. દીપકની વાતને સ્પષ્ટ કરવા માટે દેવદત્ત અને યજાહતનું ઉદાહરણ આપેલ છે. પણ તે વ્યતિરેકી છે.

જેવી રીતે દેવદત્ત યજાહતનો હાથ પકડીને કોઈ કામમાં લગાવે છે; તેવીરીતે ઘટપટાદિ બાહ્ય જ્ઞયપદાર્થ આત્માને તેમને જાણવા માટે પ્રેરિત કરતા નથી. આ ઉદાહરણ વ્યતિરેકી ઉદાહરણ છે; કેમકે દેવદત્ત તો યજાહતને પ્રેરિત કરે છે; પણ બાહ્યપદાર્થ આત્માને તેમને જાણવા માટે પ્રેરિત કરતાં નથી.

દીપક પણ બાહ્યપદાર્થોને પ્રકાશિત કરવા માટે તેની પાસે જતો નથી - તે વાત સમજલવવા માટે લોહચુંબક દ્વારા ખેંચાતી લોઢાની સોયનું વ્યતિરેકી ઉદાહરણ આપેલ છે. સોય તો ચુંબકદ્વારા ખેંચાતી તેની સમીપે ચાલી જય છે; પણ દીપક દીઘ પદાર્થોથી આકર્ષાતો નથી, આકર્ષિત થતો તેની પાસે જતો નથી. બાહ્ય દીઘપદાર્થો અને દીપકમાં સહજ જ દીઘ-દીપક સંબંધ બનતો હોય છે તેમાં પરસ્પર કોઈ પરાધીનતા નથી.

૧ લિંગી પ્ર. રત્નાકર ભાગ ૧૦ પાના ૧૩-૧૪-૧૭

દીપકની જેમ આ ભગવાન આત્મા પણ સહજભાવથી જૈય પદાર્થોને જાણે છે. ન તો જૈયપદાર્થ આત્માની પાસે આવે છે અને ન તો આત્મા તેમને જાણવા માટે તેની પાસે જય છે; ન તો જૈયપદાર્થ આત્માને પ્રેરિત કરે છે કે તું અમને જાણ અને ન તો આત્મા જૈયપદાર્થોને પ્રેરિત કરે છે કે તું અમારા જ્ઞાનનું જૈય બને. બજે પોતપોતાના સહજસ્વભાવના કારણે જ જૈય-જ્ઞાયકભાવથી પરિણામિત થાય છે. બાહ્યપદાર્થ પોતાના જૈયસ્વભાવને કારણે જ્ઞાનનું જૈય બને છે અને આત્મા પોતાના જ્ઞાયકસ્વભાવના કારણે તેને જાણે છે, જાણવારૂપ પરિણામિત થાય છે.

દીપકના ઉદાહરણથી એક વાત વધારે સ્પષ્ટ કરી છે કે જેવી રીતે દીપક દૂરવર્તી અને સમીપવર્તી સર્વે પદાર્થોને સમાનઙ્કપથી પ્રકાશિત કરે છે; તેવી રીતે આ આત્મા પણ દૂરવર્તી અને સમીપવર્તી બધા પદાર્થોને સમાનઙ્કપથી જાણે છે.

અંતમાં આચાર્યદીવ આશ્રમ્ય વ્યક્ત કરતા કહે છે કે આવી વસ્તુસ્થિતિ સ્પષ્ટ હોવા છતાં અજ્ઞાનીજન ઉપશમભાવને પ્રાપ્ત થતાં નથી; કલ્યાણકારીબુદ્ધિને, સમ્યગજ્ઞાનને પ્રાપ્ત ન થતાં પરપદાર્થોને ગ્રહણ કરવાનો ભાવ કરતાં રહે છે. આ એક મોટી આશ્રમ્યની વાત છે !

તાત્પર્ય એ છે કે ન તો પરપદાર્થ આત્માને વિકાર કરાવે છે અને ન તો આત્મા તેમાં કંઈ ફેરફાર કરે છે. પરને જાણવું તે વિકારનું કારણ નથી અને જ્ઞાનમાં જાણવામાં આવવું તે પરાધીનતા નથી.

આચાર્ય જ્યસેનની તાત્પર્યવૃત્તિમાં ઉપરની ગાથાઓના ભાવને આ પ્રકારે સ્પષ્ટ કરે છે; તો પણ તે શંકા ઉભી કરી એક વાતનું વધારે સ્પષ્ટિકરણ પ્રસ્તુત કરે છે જે આ પ્રમાણે છે -

શંકા - હે ભગવાન આ પહેલા બંધાધિકારમાં કલ્યું છે કે -

એવું ણાણી સુદ્ધો ણ સયં પરિણમદિ રાયમાદીહિં ।

રાઇઝદિ અણોહિં દુ સો રત્તાદિ એહિં ભાવેહિં ॥

આ પ્રકારે જ્ઞાની શુદ્ધ છે, તે રાગાદિભાવોથી સ્વયં પરિણમન કરતા નથી પરંતુ તે અન્ય રાગાદિભાવોથી (દોષોથી) રાગાદિવિકારભાવમય કરાવવામાં આવે છે એટલા માટે જ્ઞાની (આત્મા) રાગાદિના અકર્તા છે અને રાગાદિ પરદ્રવ્યોથી ઉત્પન્ન થાય છે એવું કહેવાયું છે. પરંતુ અહિં પોતાની બુદ્ધિના દોષથી ઉત્પન્ન થવાવાળા રાગાદિભાવ છે, બીજાથી કરાવેલ શબ્દાદિ પંચેન્દ્રિયોના વિષયોનો દોષ નથી - એવું કહેતા હો તો; આમાં પૂર્વાપર વિરોધ આવે છે ?

સમાધાન : ત્યાં બંધાવિકારના વ્યાખ્યાનમાં જ્ઞાનીજીવની મુખ્યતા છે અને સમ્યગ્જ્ઞાની તો રાગાદિભાવોથી - પરિણમન કરતાં નથી એટલામાટે રાગાદિભાવ પરદ્રવ્યજનિત છે એમ કહ્યું છે. અને અહિં અજ્ઞાનીજીવની મુખ્યતા છે તે અજ્ઞાનીજીવ પોતાની બુદ્ધિના દોષથી પરદ્રવ્યને નિમિત્તમાત્ર આશ્રય કરીને રાગાદિભાવકૃપથી પરિણમન કરે છે; એ કારણે પરથી કરાવેલ શબ્દાદિ પંચેન્દ્રિય વિષયોનો દોષ નથી; એમ કહ્યું છે. તેથી આમાં પૂર્વાપર વિરોધ નથી.

આ પ્રકારે નિશ્ચયવ્યવહાર મોકષમાર્ગભૂત નિશ્ચયકારણસમયસાર અને વ્યવહારકારણસમયસાર - આ બજેને જાણવાવાળો ન થતાં અજ્ઞાનીજીવ પોતાની બુદ્ધિના દોષથી રાગાદિભાવકૃપે પરિણમન કરે છે; આમાં બીજ શબ્દાદિનો દોષ નથી."

આ પ્રકારે આ ગાથાઓમાં એ જ કહેવાયું છે કે જ્યારે જૈયપદાર્થો પોતાને જાણવામાટે આત્માને ફરજ પાડતાં નથી અને આત્મા પણ તેને જાણવા માટે તેની પાસે જતો નથી; સહજભાવથી જ જૈયપદાર્થ જાણવામાં આવે છે - આવી રહે છે.

આવી સ્થિતિ હોવા છતાં પાણ શા માટે કેટલાક અજ્ઞાનીલોકો તેને જાણવા માટે આકુળ-વ્યાકુળ થઈ રહ્યા છે અને કેટલાક તો જૈયોને જાણવા માત્રથી જાણે કે કંઈ અપરાધ થઈ ગયો હોય તેવું માને છે ! આ ઓક આશ્રય છે ! કારણ કે પરજૈયને જાણવા અને નહિ જાણવા - આ બજે સ્થિતિમાં સહજભાવ ધારાગ કરવો એ જ ઓક માત્ર માર્ગ છે.

હવે આત્મભ્યાતિમાં આચાર્ય અમૃતચંદ્ર આ જ ભાવને પોષક
કળશ-કાચ્ય લખે છે જે આ પ્રમાણે છે -

(શારૂલવિક્રીડિત)

પૂર્ણકાચ્યુતશુદ્ધબોધમહિમા બોધો ન બોધ્યાદયં
યાયાત્કામપિ વિક્રિયાં તત ઇતો દીપ: પ્રકાશ્યાદિવ ।
તદ્વસ્તુસ્થિતિબોધવંધ્યધિષણા એતે કિમજ્ઞાનિનો
રાગદ્વેષમયી ભવંતિ સહજાં મુંચન્યુદાસીનતામ् ॥૨૨૨॥

(રોલા)

જૈસે દિપક દીપ્ય વસ્તુઓં સે અપ્રભાવિત ।
વૈસે હી જ્ઞાયક જ્ઞેયોં સે વિકૃત ન હો ॥
કિર ભી અજ્ઞાનીજન ક્યોં અસહજ હોતે હેં ।
ન જને ક્યોં વ્યાકુલ હો વિચલિત હોતે હેં ॥૨૨૨॥

જેવી રીતે દીપક દિપકથી પ્રકાશિત થવાવાળા પદાર્થોથી વિક્રિયાને
પ્રાપ્ત થતો નથી એવી રીતે શુદ્ધબોધ જેનો મહિમા છે એવો આ પૂર્ણ,
એક અને અચ્યુત જ્ઞાયક આત્મા જ્ઞેય પદાર્થોથી કિંચિત માત્ર પણ વિક્રિયાને
પ્રાપ્ત થતો નથી. આવી સ્થિતિ હોવા છતાં પણ જેની બુદ્ધિ આવી
વસ્તુસ્થિતિના જ્ઞાનથી રહિત છે. એવા અજ્ઞાનીજવ પોતાની સહજ
ઉદાસીનતા છોડી રાગદ્વેષમય થાય છે. એ મોટી ખેદની વાત છે, આશ્વર્યની
વાત છે.

આચાર્યદિવ ખેદ વ્યક્ત કરતાં કહે છે કે આવું કેમ થાય છે ? તાત્પર્ય
એ છે કે જે કે એમ થવું ન જોઈએ. છતાંપણ તેવું થાય છે એ હકીકિત
છે.

આ કળશના ભાવોને સ્પષ્ટ કરતાં કળશટીકામાં પાન્દે રાજમલણ
લખે છે.

“ભાવાર્થ આ પ્રમાણે છે કે કોઈ મિથ્યાદ્રષ્ટિ જવ એવી આશંકા

કરશે કે જીવદ્રવ્ય શાયક છે, સમસ્ત જોયને જાણે છે; તેથી પરદ્રવ્યોના જાણવાથી કંઈક થોડો-વધારે રાગાદિ અશુદ્ધ પરિણતિનો વિકાર થતો હશે? ઉત્તર આ પ્રમાણે છે કે પરદ્રવ્યને જાણતા તો એક અંશમાત્ર પણ વિકાર થતો નથી, પોતાની વિભાવપરિણતિથી વિકાર છે. પોતાની શુદ્ધ પરિણતિ થવાથી નિર્વિકાર છે.

ભાવાર્થ આમ છે કે જેવીરીતે દીપક પ્રકાશસ્વરૂપ છે, ઘટ-પટ વિ. અનેક વસ્તુને પ્રકાશિત કરે છે. પ્રકાશતાં છતાં પોતાનું પ્રકાશમાત્ર સ્વરૂપ હતું તે તો તેવું જ છે; વિકાર તો કંઈ દેખાતો નથી.

એ જ રીતે જીવદ્રવ્ય જ્ઞાનસ્વરૂપ છે, સમસ્તજોયને જાણે છે જાણતા છતાં જે પોતાનું જ્ઞાનમાત્ર સ્વરૂપ હતું તેવું જ રહે છે. જોયને જાણતા છતાં વિકાર કંઈ નથી - એવું વસ્તુનું સ્વરૂપ જેમને જણાતું નથી; તેઓ મિથ્યાદ્રાષ્ટિ છે.”

ઉપરના કથનમાં પાંઠે રાજમલા અંત્યન્ત સ્પષ્ટ શબ્દોમાં એવું કહે છે કે પરને જાણવાથી જરાપણ વિકાર થતો નથી, બંધ થતો નથી. તાત્પર્ય એ છે કે પરને જાણવું તે બંધનું કારણ નથી, રાગાદિ ભાવોનું પણ કારણ નથી.

ઉપરના ભાવોને આધાર બનાવી કવિવર બનારસીદાસજીએ નાટક સમયસારમાં પાંચ દોહા લખેલ છે. જે આ પ્રમાણે છે

દોહા

જ્યોં દિપક રજની સમૈ ચું દિસિ કરૈ ઉદોત ।

પ્રગટૈ ઘટપટરૂપ મૈં ઘટપટરૂપ ન હોત ॥

ત્વ્યોં સુગ્યાન જાનૈ સકલ જ્ઞેય વસ્તુ કૌ મર્મ ।

જ્ઞેયાકૃતિ પરિનવૈ પૈ તજૈ ન આતમ-ધર્મ ॥

ગ્યાનધર્મ અવિચલ સદા ગહ વિકાર ન કોડ ।

રાગ વિરોધ વિમોહમય કબૂં ભૂલિ ન હોડ ॥

એસી મહિમા ગ્યાન કી નિહચૈ હૈ ઘટ માંહિ ।

મૂરુખ મિથ્યાદ્રિષ્ટિ સાઁ સહજ વિલોકે નાંહિ ॥
 પર સુભાવ મૈં મગન હૈ, ઠાને રાગ વિરોધ ।
 ધરે પરિગ્રહ ધારના, કરૈ ન આતમ સોધ ॥

જેવી રીતે દીપક રાતના સમયે ચારેથ દિશાઓમાં પ્રકાશ કરે છે અને
 તે દીપકના પ્રકાશમાં ઘટપટાઈ પદાર્થ પ્રકાશિત થાય છે; પણ એ કારણે
 દીપક ઘટ-પટૃપ થતો નથી, દીપક જ રહે છે; એ જ રીતે શાન સંપૂર્ણ
 જૈય વસ્તુના મર્મને જાણે છે, જૈયકારૃપથી પરિણામન કરે છે; પરંતુ પોતાના
 આત્મધર્મને છોડતું નથી.

શાન પોતાના સ્વભાવમાં સદા અચલ રહે છે વિકારને ક્યારેય ગ્રહણ
 કરતું નથી અને ભૂલથી પણ ક્યારેય મિથ્યાત્વ અને રાગ-દેખરૂપ નથી થતું.

આ જગતમાં જ્ઞાનની એવી જ મહિમા છે; પરંતુ અજ્ઞાની જીવ
 મિથ્યાત્વના કારણે તેને સહજતાથી દેખતો નથી.

અજ્ઞાનીજીવ પરવસ્તુઓના સ્વભાવમાં મર્મન થઈને રાગદ્રેષમાં પહ્યો
 રહે છે અને પરિગ્રહને મેળવવામાં લિપ્ત રહેવાવાળા તે લોકો આત્માની શોધ
 કરતાં નથી.

આ પ્રકરણે કવિવર પંડિત બનારસીદાસજીને એવા તો પ્રભાવિત કર્યા
 કે નાટક સમયસારમાં ત્યાં સુમતિને રાધિકા (રાધા) અને કુમતિને કુળજી
 કહીને અનેક છંદો લખ્યા છે; જે મૂળમાં વાંચવા જેવા છે; કારણુકે તે છંદોમાં
 જ્ઞાની અને અજ્ઞાનની પરિણતિનું ખૂબ જ આકર્ષક ચિત્રણ કરેલ છે. જે
 કે તે પ્રકરણ વિશેષ ધ્યાન આપવા જેવું છે; છતાંપણ તે છંદોના ભાવને
 પોષક કળશ આત્મધ્યાતિમાં નથી; તેથી તેને અહિં મુકવા વ્યાજબી લાગતું
 નથી. જિશાસુ પાઠક તેને નાટક સમયસારમાં જરૂર વાંચે.

આ કળશોનો ભાવ સ્પષ્ટ કરતાં પન્દિત જયયંદળ છાબડા લખે છે.

“જેવી રીતે દીપકનો સ્વભાવ ઘટ-પટાઈને પ્રકાશિત કરવાનો છે;

તેવી રીતે જ્ઞાનનો સ્વભાવ પણ જોયને જાણવાનો જ છે. એવો વસ્તુનો સ્વભાવ છે. જોયને જાણવા માત્રથી જ્ઞાનમાં વિકાર થતો નથી. જોયોને જાણીને, તેને સારા નરસા માની, આત્મા રાગી-દ્રેષ્ટ-વિકારી થાય છે અને તે અજ્ઞાન છે. એટલા માટે આચાર્યદ્વારા ચિંતબ્યુ કે વસ્તુનો સ્વભાવ તો આવો છે, તોપણ આ આત્મા અજ્ઞાની થઈને રાગ-દ્રેષ્ટબ્યુ કેમ પરિણામે છે ? પોતાની સ્વભાવિક ઉદારીન-અવસ્થાબ્યુ કેમ નથી રહેતો ? આ પ્રકારે આચાર્યદ્વારા જે ચિંતન કર્યું છે, તે વ્યાજબી જ છે; કેમકે જ્યાંસુધી શુભરાગ છે ત્યાંસુધી પ્રાણીયોને અજ્ઞાનથી દુઃખી હેઠળી કર્ણા ઉત્પન્ન થાય છે અને તેથી ચિંતન પણ થાય છે.”

આ કળશનાં ભાવ ગુરુદેવશ્રી આ પ્રમાણે સ્પષ્ટ કરે છે - “જો કે ભગવાન કેવળી સમસ્ત જોયોને ત્રણ લોક અને ત્રણકાળને તથા તેની બધી દ્રવ્ય-ગુણ પર્યાયોને કેવળજ્ઞાનમાં એક સાથે જાણો છે; તો પણ તેમને જરાપણ રાગ થતો નથી. આનાથી સ્પષ્ટ છે કે પરપદાર્થોને જાણવામાત્રથી જીવોને વિકાર નથી થતો; પરંતુ અજ્ઞાનીજીવો બાહ્ય પદાર્થોને ઈષ્ટ-અનિષ્ટ અથવા અનુકૂળ-પ્રતિકૂળ માને છે તે કારણે તેઓને રાગ-દ્રેષ્ટ થાય છે.

બાહ્યપદાર્થો તો અજ્ઞાનીને પણ રાગ-દ્રેષ્ટ નથી કરાવતાં અજ્ઞાની પોતે જ બાહ્યપદાર્થોમાં ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ કરે છે ભલા-બુરાની ખોટી કલ્પના કરે છે, તે કારણે તેને સ્વયં રાગ-દ્રેષ્ટ થાય છે.

પરજોયોના કારણે રાગ-દ્રેષ્ટાદિ વિકાર ઉત્પત્ત નથી થતાં. તેઓને જાણવાથી પણ વિકાર ઉત્પન્ન થતો નથી.

જુઓ, લખ્યું પણ છે કે ‘કામપિ વિક્રિયાં ન યાયાત’ અર્થાત્ આત્મામાં જોયપદાર્થોના કારણે જરાપણ વિકિયા થતી નથી.

ભાઈ ! જે પરવસ્તુના જાણવાથી વિકાર થતો હોય તો કેવળીને સૌથી વધારે વિકાર થવો જોઈએ; કેમકે તેઓ તો ત્રણ લોક અને ત્રણકાળની સમસ્ત દ્રવ્ય-ગુણ-પર્યાયોને એક સાથે જાણો છે, તો પણ તેમને કિંચિત પણ રાગાદિ વિકાર થતો નથી.

જે કે આત્મા પૂર્ણ, અભેદ, એકડૃપ છે; તો પણ તેમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર છે, રાગાદિ છે - એવો બેદ કરવો વ્યવહાર છે. કેવળી ભગવાન એવા ભેદોને પણ જાણે છે, તો પણ તેમને રાગ થતો નથી. હાં, રાગીજીવોને પરને તથા ભેદોને જાણતા તેમાં ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ હોવાથી તે કારણે રાગદ્રેષ્ય થાય છે, માત્ર તેમને, પરને જાણવાના કારણે નહિ.

જુબો, આમાં બહુ સરસ વાત કરી છે. પર્યાય છે તો પોતાની જ અવસ્થા; પરંતુ જે પર્યાય અને ભેદો પર દ્રષ્ટિ જશે તો સરાગીને વિકલ્પ-રાગ થશે, નિર્વિકલ્પતા નહિ થાય. એ કારણે અભેદની દ્રષ્ટિ કરાવવા માટે પોતાની હોવા છીતાં પણ પર્યાય અને ભેદોને પણ ગૌણ કરી તેને વ્યવહાર કર્યો છે અને નિકાળી અભેદ વસ્તુનો આશ્રય કરાવવા માટે અભેદને નિશ્ચય કહ્યો છે. વીતરાગ થયા પછી કેવળી તો બેદ-અભેદને બધાને જાણે છે.

પંચાધ્યાત્માં આવે છે કે હે જ્ઞાની ! તારો તો જ્ઞાનસ્વભાવ છે, બધું જ જાણ. જાણવાથી રાગ-દ્રેષ્ય થતાં નથી. પરમાં ભલા-બુરાની મિથ્યા કલ્પના કરવાથી રાગ-દ્રેષ્ય ઉત્પન્ન થાય છે. પંચપરમેષ્ઠિ ઢીક છે એવી કલ્પના કરીશ તો રાગ થશે. પંચપરમેષ્ઠિને પરજોયડૃપ માત્ર જાણવાથી તો રાગ થશે. નહિ.

આ પ્રકારે આ કળશામાં એ જ કહેવામાં આવ્યું છે કે જોયોને જાણવાથી જ્ઞાનમાં રંચમાત્ર પણ વિકાર થતો નથી. પરને જાણવું તેને વિકારનું કારણ માનવું તે અજ્ઞાન છે. જે લોકોની એવી માન્યતા છે કે પરને જાણવું તે વિકારનું કારણ છે અને તેટલા માટે તેઓ પરને જાણવાનો નિષેધ પણ કરે છે; તેમણે આ પ્રકરણ પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ.

હવે આગામી ગાથાઓને સૂચક કળશ કાવ્ય લખે છે; જે આ પ્રકારે છે :-

૧ લિંદી પ્ર. રલાકર ભાગ ૧૦ પાના ૨૦,૨૧,૨૨,૨૩

(શાર્ડૂલવિક્રીડિત)

રાગદ્વેષવિભાવમુક્તમહસો નિત્યં સ્વભાવસ્પૃષ્ટઃ
 પૂર્વાગામિસમસ્તકર્મવિકલા ભિન્નાસ્તદાત્વોદ્યાત् ।
 દૂરારૂઢચિત્રવૈભવ બલાચ્છંચચિવદર્ચિમર્ય
 વિંદન્તિ સ્વરસાભિષિક્તભુવનાં જ્ઞાનસ્ય સંચેતનામ् ॥૨૨૩॥

(રોલા)

રાગ-દેખ સે રહિત ભૂત-ભાવી કર્મો સે ।
 મુક્ત સ્વયં કો વે નિત હી અનુભવ કરતે હેં ॥
 ઓર સ્વયં મેં રત રહ જ્ઞાનમયી ચેતનતા ।
 કો ધારાગુ કર નિજ મેં નિત્ય ભગન રહતે હેં ॥૨૨૩॥

રાગદ્વેષક્રૂપી વિભાવથી મુક્ત તેજવાલા, નિજ ચૈતન્ય-ચમત્કારી સ્વભાવનું હંમેશા સ્પર્શ કરવાવાળો ભૂત અને ભાવી કર્મોથી રહિત અને વર્તમાન કર્મોદ્યથી ભિન્ન સમ્યગદાચિ જ્ઞાનીજન અતિ પ્રબલ ચારિત્રના વૈભવના બળે પોતાના રસથી સંપૂર્ણ જગતને જાણ્યું છે જેમણે - એવી ચૈતન્યજ્યોતિમયી ચમકતી જ્ઞાનચેતનાનો અનુભવ કરે છે.

અહિં એ તાત્પર્ય સમજવું જોઈએ કે જીવ પહેલા તો કર્મચેતના અને કર્મફલચેતનાથી જુદી જે પોતાની ચૈતન્યના પરિણામનસ્વરૂપ જ્ઞાનચેતના છે, તેનો અનુભવ કરે છે.

અહિં એ તાત્પર્ય સમજવું જોઈએ કે જીવ પહેલા તો કર્મચેતના અને કર્મફલચેતનાથી જુદી પોતાની જ્ઞાનચેતનાનું સ્વરૂપ આગમપ્રમાણ, અનુમાનપ્રમાણ અને સ્વસંવેદનપ્રમાણથી જાણવું જોઈએ અને તેનું શ્રદ્ધાન (પ્રતીતિ) દ્રબ્ધ કરે છે. આ તો અવિરત, દેશવિરત અને પ્રમત અવસ્થામાં પણ થાય છે અને જ્યારે અપ્રમત અવસ્થા થાય છે; ત્યારે જીવ પોતાના સ્વરૂપનું જ ધ્યાન કરે છે. એ વખતે, તેણે જે જ્ઞાનચેતનાનું પ્રથમ શ્રદ્ધાન કર્યું હતું તેમાં લીન થઈ, શ્રેણી ચઢી, કેવળજ્ઞાન ઉત્પન્ન કરીને સાક્ષાત જ્ઞાનચેતનારૂપ થઈ જય છે.

આહિ એક પ્રશ્ન સંભવે છે કે સમ્યગ્દ્રષ્ટિ અને કેવળાની જ્ઞાનચેતનામાં શું અંતર છે ?

જો કે જ્યથંદજ છાબડાના ભાવાર્થમાં આ વાત સ્પષ્ટ થઈ ગઈ છે છતાં વિશેષ સ્પષ્ટિકરણ આ પ્રમાણે છે :-

કેવળજ્ઞાની જીવને સાક્ષાત જ્ઞાનચેતના હોય છે. કેવળજ્ઞાન થવા પહેલા પણ, નિર્વિકલ્પ અનુભવ વખતે જીવને ઉપયોગાત્મક જ્ઞાનચેતના હોય છે. જો જ્ઞાનચેતનાના ઉપયોગાત્મકને મુખ્ય ન કરવામાં આવે તો સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાનચેતના નિરંતર હોય છે, કર્મચેતના અને કર્મફળચેતના નથી હોતી; કેમકે તેમનું નિરંતર જ્ઞાનના સ્વામિત્વભાવથી પરિણમન હોતું નથી.

આ પ્રકારે એમ નક્કી થયું કે સમ્યગ્દ્રષ્ટિઓને કેવળજ્ઞાન થવા પહેલા પણ જ્ઞાનચેતના હોય છે અને કેવળજ્ઞાન થતાં સાક્ષાત જ્ઞાનચેતના થાય છે.

આ કળશનો ભાવાનુવાદ કવિવર બનારસીદાસજ નાટક સમયસારમાં આ પ્રમાણે કરે છે.

(સવૈયા ઇકતીસા)

જહાં સુદ્ધ ગ્યાન કી કલા ઉદોત દીસે તહાં,
સુદ્ધતા પ્રવાંન સુદ્ધ ચારિત કૌ અંસ હૈ ।
તા કારન ગ્યાની સબ જાનૈ જ્ઞેયવસ્તુ મર્મ,
વૈરાગ વિલાસ ધર્મ વાકૌ સરવંસ હૈ ॥
રાગ દોષ મોહ કી દસા સાઁ ભિન્ન રહૈ યાતેં,
સર્વથા ત્રિકાલ કર્મજાલ કૌ વિધુંસ હૈ ।
નિરૂપાધિ આતમ સમાધિ મૈં વિરાજૈ તાતેં,
કહિએ પ્રગટ પૂરન પરમ હંસ હૈ ॥

જ્યાં શુદ્ધજ્ઞાનની કલાનો ઉદ્ઘ થાય છે; ત્યાં તેની શુદ્ધતાના

પરિણામમાં શુદ્ધ ચારિત્રનો અંશ અવશ્ય જ પ્રગટ થઈ જય છે એ પ્રકારે જ્ઞાનીજીવ જૈયવસ્તુઓના ભર્મને જાણી લે છે અને તેમને સર્વાગ વૈરાગ્યાવ પ્રગટ થઈ જય છે.: તે જ્ઞાનીજીવ રાગ-દ્રેષ અને મોહ (મિથ્યાત્વ)ની અવસ્થાથી સર્વથા જુદ્દો રહે છે; એ કારણે તેને ભૂત-ભવિષ્ય અને વર્તમાનકાળની કર્મોની જળનો નાશ થઈ જવાથી તે નિરૂપાધિ આત્મસમાધિમાં બિરાજે છે અને પ્રગટૃપથી પૂર્ણ પરમાત્મા બની જય છે.

આ કળશના ભાવને પૂર્ણ ગુરુદેવશ્રી આ પ્રકારે સ્પષ્ટ કરે છે -
 “જુઓ, સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાનની પછી સમ્યક્ષચારિત્રની વાત કરે છે.
 જેમને સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન થયું છે, તે જ્ઞાનીજનોને જ્ઞાનચેતના છે. જેકે તેમને કર્મચેતના અને કર્મજળચેતનાનું સ્વામીપણું નથી, છતાં પણ તેનું વેદન તેમને ગૌણપણે થાય છે. ચારિત્રની પ્રાપ્તિમાં તે જ્ઞાનીજનો કર્મચેતના અને કર્મજળચેતનાનો અભાવ કરે છે.

જુઓ આ ચારિત્રની દરા ! ભૂતકાળના રાગથી રહિત થવું પ્રતિક્રમણ છે. જે ભવિષ્યમાં કર્મ ન કરવાની પ્રતિક્રિયા કરે અથવા જે ભાવોથી આગામી કર્મ બંધાય છે, તે ભાવોનું ભમત્વ છોડે; તે આત્મા પ્રત્યાખ્યાન છે તથા જે ઉદ્યમાં આવતાં વર્તમાન કર્મોનું ભમત્વ છોડે, તે આત્મા આલોચના છે. એવી રીતે પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, અને આલોચનાપૂર્વક વર્તતો થકો આત્મા ચારિત્ર છે.

જુઓ, અહિં એમ કહ્યું કે ભૂતકાળમાં થયેલ દ્વા-દાન આદિના શુભભાવ અથવા હિંસા આદિના અશુભ વિકલ્પોથી પાછા હી પોતાના નિજસ્વરૂપમાં સ્થિર થઈ જવું, અટકી જવું તે આત્માનું પ્રતિક્રમણ છે. હું તો એક જ્ઞાતા-દ્રષ્ટા આત્મા છું. એવું અન્તરમાં એકાગ્ર થઈ સ્વરૂપમાં તીન થઈ રમણ કરવું પ્રતિક્રમણ છે.

અહો ! એવું એક સમયનું પ્રતિક્રમણ જન્મ-મરણનો અભાવ કરવાવાળું છે.

દ્યા-દાન, વ્રત-ભક્તિ આદિ શુભભાવ તથા હિંસા-ગૂઠ-ચોરી આદિ અશુભભાવ ભવિષ્યમાં નહિ કરવાની પ્રતિજ્ઞા કરીને પોતાના સ્વરૂપમાં રમણ કરવું તેનું નામ પ્રત્યાખ્યાન છે.

જે વર્તમાનમાં ઉદ્ય આવવાવાળા કર્મનું મમત્વ છોડે છે, તે આત્મા આલોચના છે. નિજ જ્ઞાનાનંદ પરમાનંદમય સ્વરૂપને જાણીને તેમાંજ તીન થઈ જવું આલોચના છે.

આ જે નિશ્ચય પ્રતિક્રિમણ આદિ છે; તે સંવર છે, નિર્જરા છે, તથા મોક્ષનો માર્ગ છે. આવા પ્રતિક્રિમણ, પ્રત્યાખ્યાન અને આલોચનાપૂર્વક વર્તતો આત્મા ચારિત્ર છે. એવું જ ચારિત્રનું વિધાન આગળની ગાથાઓમાં કહેશે.¹

આ પ્રકારે આગામી ગાથાઓના ભાવની સૂચના દેવાવાળા આ કળશમાં એ જ કહેવામાં આવ્યું છે કે પ્રતિક્રિમણ, પ્રત્યાખ્યાન અને આલોચનાના માધ્યમથી ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાતીન કર્મથી રહિત તેમજ પોતાના સ્વભાવને નિત્ય સ્પર્શથી જ્ઞાનીજન ચારિત્રના બળથી કર્મચેતના અને કર્મફળચેતનાથી રહિત થઈ કેવળજ્ઞાનમયી સાક્ષાત જ્ઞાનચેતનાને પ્રાપ્ત થાય છે.



મંથન

ભગવાન તીર્થકરદેવ વડે ચિંતિવન કરવામાં આવેલી અધ્યુબ આદિ બાર-ભાવના વૈરાગ્યની માતા છે, સમસ્ત જીવોનું હિત કરવાવાળી છે, દુઃખી જીવોને શરણભૂત છે, આનંદ ઉત્પત્ત કરવાવાળી છે, પરમાર્થમાર્ગને બતાવવાવાળી છે, તત્ત્વનો નિશ્ચય કરાવનારી છે, સમ્યક્ત્વ ઉત્પત્ત કરનારી છે, અશુભધ્યાનને નાશ કરનારી છે, આત્મકલ્યાણના અર્થી જીવ હંમેશા ચિંતિવન કરવાયોગ્ય છે. (શ્રી ભગવતી આરાધના)

સમયસાર ગાથા ૩૮૩-૩૮૯

કર્મ જં પુષ્વકયં સુહાસુહમળેયવિત્થરવિસેસં ।
તત્તો ણિયત્તએ અપ્પયં તુ જો સો પડિક્કમણં ॥૩૮૩॥

કર્મ જં સુહમસુહ જહિ ય ભાવહિ વજ્ઞાઇ ભવિસ્સં ।
તત્તો ણિયત્તએ જો સો પચ્ચક્કાણં હવઙ્ગ ચેયા ॥૩૮૪॥

જં સુહમસુહમુદિણં સંપદિ ય અણેયવિત્થરવિસેસં ।
તં દોસં જો ચેયઙ્ગ સો ખલુ આલોયણં ચેયા ॥૩૮૫॥

ણિચ્ચં પચ્ચક્કાણં કુલ્બઙ ણિચ્ચં પડિક્કમાદિ યો ય ।
ણિચ્ચં આલોચેયઙ સો હુ ચરિત્તં હવઙ્ગ ચેયા ॥૩૮૬॥

શુભ ને અશુભ અનેકવિધ પૂર્વે કરેલું કર્મ જે,
તેથી નિવર્ત્ત આત્મને, તે આત્મા પ્રતિક્માગું છે; ૩૮૩

શુભ ને અશુભ ભાવી કરેમ જે ભાવમાં બંધાય છે,
તેથી નિવર્તન જે કરે, તે આત્મા પચ્યખાગું છે. ૩૮૪

શુભ ને અશુભ અનેકવિધ છે વર્તમાને ઉદિત જે,
તે દોષને જે ચેતતો, તે જીવ આલોયન ખરે. ૩૮૫

પચ્યખાગું નિત્ય કરે અને પ્રતિક્માગું જે નિત્યે કરે,
નિત્યે કરે આલોયના, તે આત્મા ચારિત્ર છે. ૩૮૬

ભાવાર્થ:- ચારિત્રમાં પ્રતિક્રમણ, પ્રત્યાપ્યાન અને આલોચનાનું વિધાન છે. તેમાં, પૂર્વે લાગેલા દોષથી આત્માને નિવર્તાવવો તે પ્રતિક્રમણ છે, ભવિષ્યમાં દોષ લગાડવાનો ત્યાગ કરવો તે પ્રત્યાપ્યાન છે અને વર્તમાન દોષથી આત્માને જુદ્દો કરવો તે આલોચના છે. અહીં તો નિશ્ચયચારિત્રને પ્રધાન કરીને કથન છે; માટે નિશ્ચયથી વિચારતાં તો, જે આત્મા ત્રણે કાળનાં કર્મોથી પોતાને બિજ્ઞ જાણે છે, શ્રદ્ધે છે અને અનુભવે છે, તે આત્મા પોતે જ પ્રતિક્રમણ છે, પોતે જ પ્રત્યાપ્યાન છે અને પોતે જ આલોચના છે. એમ પ્રતિક્રમણસ્વરૂપ, પ્રત્યાપ્યાનસ્વરૂપ અને આલોચનાસ્વરૂપ આત્માનું નિરંતર અનુભવન તે જ નિશ્ચયચારિત્ર છે. જે આ નિશ્ચયચારિત્ર, તે જ જ્ઞાનચેતના (અર્થાત् જ્ઞાનનું અનુભવન) છે. તે જ જ્ઞાનચેતનાથી (અર્થાત् જ્ઞાનના અનુભવનથી) સાક્ષાત્ જ્ઞાનચેતનાસ્વરૂપ ડેવળજ્ઞાનમય આત્મા પ્રગટ થાય છે.

જે પૂર્વકાળમાં કરેલ અનેક પ્રકારના જ્ઞાનાવરણ આદિ શુભાશુભ કર્મોથી પોતાના આત્માને દૂર રાખે છે તે આત્મા પ્રતિક્રમણ છે.

જે ભાવથી ભવિષ્યકાળમાં શુભાશુભ કર્મ બંધાય તે ભાવથી નિવૃત થવાવાળો આત્મા પ્રત્યાપ્યાન છે.

વર્તમાનકાળમાં ઉદ્યાગત અનેક પ્રકારના વિસ્તારવાળું શુભાશુભકર્મના દોષથી ચેતવબાળો-ઇડોડાવાવાળો આત્મા આલોચના છે. જે સદા પ્રત્યાપ્યાન કરે છે, સદા પ્રતિક્રમણ કરે છે અને સદા આલોચના કરે છે; ખરેખર તે આત્મા ચારિત્ર છે.

આ ગાથાઓનો ભાવ આત્મપ્રયાતિમાં આ પ્રમાણે વ્યક્ત કરવામાં આવ્યો છે.

“જે આત્મા પુરુષાલકર્મના વિપાકથી (ઉત્પન્ન) થયેલ ભાવોથી પોતાને ઇડાવે છે, દૂર રાખે છે; તે આત્મા તે ભાવોના કારણભૂત પૂર્વકર્મોનું પ્રતિક્રમણ કરતો પોતેજ પ્રતિક્રમણ છે, તે જ આત્મા તે ભાવોના કાર્યભૂત ઉત્તરકર્મોનું પ્રત્યાપ્યાન કરતો થકો સ્વયં જ પ્રત્યાપ્યાન છે અને તે જ

આત્મા વર્તમાન કર્મવિપાકને પોતાથી બિજ્ઞ અનુભવ કરતો થકો આલોચના છે.

આ પ્રકારે તે આત્મા સદા પ્રતિક્રમણ કરતો થકો, સદા પ્રત્યાઘ્યાન કરતો થકો અને સદા આલોચના કરતો થકો પૂર્વકર્મના કાર્યક્રમ અને ઉત્તરકર્મના કારણક્રમ ભાવોથી અત્યંત નિવૃત્ત થતો થકો અને વર્તમાન કર્મવિપાકને પોતાથી અત્યંત બિજ્ઞ અનુભવતો થકો પોતામાં જ, પોતાના જ્ઞાનસ્વભાવમાં જ નિરંતર ચરવાથી, લીન રહેવાથી ચારિત્ર છે.

આ પ્રકારે ચારિત્રસ્વક્રમ થતો થકો આત્મા પોતેજ જ્ઞાનમાત્ર ચેતનાક્રમ અનુભવ કરે છે; તેથી પોતેજ જ્ઞાનચેતના છે - એવો આશય છે.

તાત્પર્યવૃત્તિમાં આ ગાથાઓ અહિં પ્રાપ્ત ન થતાં ઉજર ગાથાની ઉપરાંત પ્રાપ્ત થાય છે અને તેમાં આનો ભાવ આત્મઘ્યાતિની જેવો જ સ્પષ્ટ કરેલ છે.

આ ગાથાઓનો ભાવ જ્યયંદળ છાબડા ભાવાર્થમાં આ પ્રકારે સ્પષ્ટ કરે છે -

“ચારિત્રમાં પ્રતિક્રમણ, પ્રત્યાઘ્યાન અને આલોચનાનું વિધાન છે. તેમાં પહેલા લાગેલા દોષોથી આત્માને નિવૃત્ત કરવો તે પ્રતિક્રમણ છે, ભવિષ્યમાં દોષ લાગે તેનો ત્યાગ કરવો તે પ્રત્યાઘ્યાન છે અને વર્તમાન દોષથી આત્માને જુદ્દો કરવો તે આલોચના છે.

અહિં નિશ્ચય ચારિત્રને મુખ્ય કરીને કથન છે એટલે નિશ્ચયથી વિચાર કરીએ તો જે આત્મા વિકાળના કર્મોથી પોતાને બિજ્ઞ જણે છે, શ્રદ્ધા કરે છે, અને અનુભવ કરે છે; તે આત્મા પોતેજ પ્રતિક્રમણ છે. પોતે જ પ્રત્યાઘ્યાન છે અને પોતે જ આલોચના છે.

આ પ્રકારે પ્રતિક્રમણસ્વક્રમ, પ્રત્યાઘ્યાનસ્વક્રમ અને આલોચનાસ્વક્રમ નિરંતર આત્માનો અનુભવ જ નિશ્ચયચારિત્ર છે. જે આ નિશ્ચય ચારિત્ર છે, તે જ જ્ઞાનચેતના છે (અર્થાત જ્ઞાનનો અનુભવ છે)

તે જ્ઞાનચેતનાથી (અર્થાત् જ્ઞાનના અનુભવથી) સાક્ષાત જ્ઞાનચેતનાસ્વરૂપ કેવળજ્ઞાનમય આત્મા પ્રગટ થાય છે.”

આ ગાથાઓના ભાવને પૂરુષુદેવશ્રી આ પ્રકારે સ્પષ્ટ કરે છે -

“જુઓ, એક જ સમયમાં પ્રતિક્રમણ, આલોચના અને પ્રત્યાખ્યાન છે.

- ૧) જે સમયે આત્મા પુરુષ-પાપના ભાવોથી નિવૃત થયો, તે જ સમયે તે ભાવોના કારણભૂત પૂર્વકર્મથી નિવૃત થયો છે, તેથી તે આત્મા સ્વયં પ્રતિક્રમણ છે.
- ૨) તે જ સમયે તે ભાવોના કાર્યભૂત ભવિષ્યના કર્મોથી નિવૃત થયો, એથી તે જ આત્મા સ્વયં પ્રત્યાખ્યાન છે.
- ૩) તથા તે જ વખતે વર્તમાન કર્મોના ઉદ્ઘયથી નિવૃત થયો, તેથી તે જ આત્મા સ્વયં જ આલોચના છે. બસ આનું જ નામ ચારિત્ર છે. ભાઈ ! જે શુભાશુભભાવ છે; તે અચારિત્ર છે, અપ્રતિક્રમણ છે, અપ્રત્યાખ્યાન છે. આ બધા આશ્રવભાવો છે; આનાથી નિવૃત થઈને સ્વરૂપમાં એકાગ્ર થયું એ જ ભાવસંવર છે, ચારિત્ર છે.

આ એકસમયની સ્વરૂપસ્થિતિની દરાની છે. આને જ પૂર્વકર્મથી નિવૃત થવાની અપેક્ષા પ્રતિક્રમણ કહે છે. ભવિષ્યના કર્મથી નિવૃત થવાની અપેક્ષા પ્રત્યાખ્યાન કહે છે અને વર્તમાન કર્મવિપાકથી નિવૃત થવાની અપેક્ષા આલોચના કહે છે. આ જ ચારિત્ર છે.^૧

જેને સમ્બંધર્ણન-જ્ઞાન થયું છે, તેને હજુ અસ્થિરતાનો ભાવ છે, આ અસ્થિરતાથી નિવૃત થઈ સ્વભાવમાં પ્રવર્તયું, રમયું, લીન થયું આલોચના છે તથા તે જ ભૂત અને ભાવી કર્મથી નિવૃત થવાની અપેક્ષા પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન છે આ ચારિત્રની વિધિ છે.

ભાઈ ! વ્રત-ભક્તિ-દ્વારા આદિ પાળવારૂપ જે ભાવો થાય છે, તે

^૧ હિંદી પ્ર. રત્નાકર ભાગ ૧૦ પાના ૩૮

અસ્થિરતા છે, તેનાથી નિવૃત હોવાની વાત છે. જેનાથી નિવૃત થવું છે, અજ્ઞાની તેને જ સંયમ અને ચારિત્ર માનવા લાગે છે. ભલે મુનિરાજેને નિશ્ચયચારિત્રની સાથે આવું વ્યવહારચારિત્ર સહયારીપણે હોય; પરંતુ તે શુભભાવકૃપ વ્યવહાર ચારિત્ર નથી. ખરેખર તો ચારિત્રનું કારણ પણ નથી.

હું પ્રતિક્રમણ કરું, પ્રત્યાપ્યાન કરું? આલોચના કરું એવા જે વિકલ્પ છે - તે બધો રાગ છે, તે ચારિત્ર નથી; કારણ કે તે આત્માનું શુદ્ધ સ્વકૃપ જ નથી. કહે છે કે જે જે આત્મા પોતાના શુદ્ધસ્વકૃપના, ચૈતન્યસ્વકૃપના આશ્રયે રાગની એકત્વબુદ્ધિ તોડી, અસ્થિરતાકૃપ રાગથી નિવૃત થઈ સ્વભાવમાં લીનતાકૃપ પ્રવૃત્તિ કરે છે; તે આત્મા જ પ્રતિક્રમણ છે પ્રત્યાપ્યાન છે, સંવર છે તથા તેનું જ નામ ચારિત્ર છે.^૧

અહિં તો એમ કહે છે કે પૂર્વકર્મનું કાર્ય અને ઉત્તરકર્મનું કારણ એવા જે પુણ્ય-પાપ આદિ ભાવ ધર્માત્માઓને પોતાની દશામાં થાય છે, તેનાથી નિવૃત થઈ એક જ્ઞાનભાવમાં વર્તવું, રમવું, રહેવું ચારિત્ર છે. પરભાવોથી નિવૃત થતાં એક જ્ઞાનભાવમાં જ નિરંતર વિચરતો આત્મા સ્વયં જ ચારિત્ર છે.^૨

ભૂત-વર્તમાન અને ભાવીના કર્મોથી નિવૃત થઈ એક જ્ઞાનસ્વભાવમાં જ એકાકાર થવાનું નામ ચારિત્ર છે. જે સ્વયં એ ચારિત્રકૃપ સદા પરિણામી રહ્યા છે, તેમને કદાચિત વ્યવહાર પ્રતિક્રમણ આદિના વિકલ્પ પણ ઉઠે છે, પરંતુ તે દોષ છે. આ વાત ભગવાન સર્વજાહેવની વાળીમાં આવી છે.

પ્રશ્ન :- મુખ્યકૃપથી તો આ ચારિત્ર જ મોક્ષમાર્ગ છે ને ?
સમ્યગુર્દ્ધન અને સમ્યગ્જ્ઞાન તો ફક્ત તેનું કારણ જ થયું ને ?

ઉત્તર :- ભાઈ ! સમ્યગુર્દ્ધન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર - આ લેદો તો માત્ર સમજવા માટે છે. આ ત્રણે એક સમયમાં જ થાય છે. ત્રણે મળીને જ એક મોક્ષમાર્ગ છે.

નુચો અહિંયા નિશ્ચયચારિત્રની પ્રધાનતા છે, વ્યવહારની કિયા અહિં

૧ લિંગી પ્ર. રત્નાકર ભાગ ૧૦ પાના ૩૬/૪૦

ગૌણ છે. તેથી અહિં તો એમ કહે છે કે શુભાશુભ બને દોષોથી નિવૃત્ત થઈ આત્મદૃપ થવું તે જ ચારિત્ર છે. ઉપયોગને સ્વરૂપલીન કરવો તે જ નિશ્ચયપ્રતિકમણા, પ્રત્યાપ્યાન અને આલોચના છે.

જ્યાંસુધી પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાંસુધી સ્વરૂપની દ્રષ્ટિ અને ચારિત્રની ભૂમિકામાં વ્યવહાર પ્રતિકમળાના વિકલ્પ જરૂર હોય છે પણ તેમાં ફક્ત અશુભથી નિવૃત્ત થવાની જ મર્યાદા હોય છે.

આ પ્રકારે પ્રતિકમળાસ્વરૂપ, પ્રત્યાપ્યાનસ્વરૂપ અને આલોચના સ્વરૂપ આત્માનો નિરંતર અનુભવ કરવો તે નિશ્ચય ચારિત્ર છે. આ જ જ્ઞાનચેતના છે. આ ચેતનાથી જ સાક્ષાત જ્ઞાનચેતનાસ્વરૂપ કેવળજ્ઞાનગમ્ય, આત્મા પ્રગટ થાય છે.^૧

આ પ્રકારે આ ગાથાઓમાં એ જ કહેવાયું છે કે નિશ્ચય પ્રતિકમળા, નિશ્ચય પ્રત્યાપ્યાન અને નિશ્ચય આલોચના તો ભૂત-ભવિષ્ય અને વર્તમાન-ત્રણે કાળ સંબંધી શુભાશુભભાવોથી નિવૃત્ત થઈ પોતાના જ્ઞાનસ્વભાવમાં વર્તયું, રમ્યાં, સિથર થવું તે છે અને તે જ નિશ્ચય ચારિત્ર છે - જે સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક થાય છે. તેથી એકમાત્ર કરવા જેવું યોગ્ય કાર્ય તો આત્મજ્ઞાનપૂર્વક આત્મરમણતા જ છે.

હવે આગામી ગાથાઓનાભાવોને બતાવવાવાળો કળશક્તિ કહે છે જે આ પ્રકારે છે.

(ઉપજતિ)

જ્ઞાનસ્ય સંચેતનયૈવ નિત્યં પ્રકાશતે જ્ઞાનમતીવ શુદ્ધમ् ।

અજ્ઞાનસંચેતનયા તુ ધાવન् બોધસ્ય શુદ્ધિં નિરુણદ્ધિ બંધ: ॥૨૨૪॥

(રોલા)

જ્ઞાનચેતના શુદ્ધજ્ઞાન કો કરે પ્રકાશિત ।

શુદ્ધજ્ઞાન કો રોકે નિત અજ્ઞાનચેતના ॥

¹ લિંગી પ્ર. રત્નાકર ભાગ ૧૦ પા. ૩૮/૪૦/૪૧/૪૨/૪૩

ઓર બંધ કી કર્તા યહ અજ્ઞાનચેતના ।
યહી જાન ચેતો આત્મ નિત જ્ઞાનચેતના ॥૨૨૪॥

આ જ્ઞાનસ્વભાવી ભગવાન આત્મા જ્ઞાનની નિરંતર સંચેતનાથી અત્યંત શુદ્ધપ્રમાણ પ્રકાશિત થાય છે અને અજ્ઞાનની સંચેતનાથી બંધ દોડતો આવી જ્ઞાનસ્વભાવી આત્માની શુદ્ધિને રોકી લે છે.

તાત્પર્ય એ છે કે જે બંધને રોકવો છે અને શુદ્ધજ્ઞાનને પ્રકાશિત કરવો છે તો જ્ઞાનની સંચેતનાને નિરંતર પ્રદાન કરો. આ જ એક માર્ગ છે.

આ કળશનો ભાવ સ્પષ્ટ કરવા માટે પં. બનારસીદાસજીએ નાટક સમયસારમાં પાંચ દુહા અને બે ચૌપાઈ લખી છે જે આ પ્રમાણે છે.

(દોહા)

જ્યાયકભાવ જહાં તહાં, શુદ્ધ ચરન કી ચાલ ।

તાતેં જ્યાન વિરાગ મિલિ, સિવ સાધે સમકાલ ॥

જથા અંધ કે કંધ પર, ચઢૈ પંગુ નર કોઈ ।

વાકે દગ વાકે ચરન, હોહિ પથિક મિલિ દોઈ ॥

જહાં જ્યાન ડિરિયા મિલે, તહાં મોખ-મગ સોઈ ।

વહ જાને પદ કા મરમ, વહ પદ મેં થિર હોઈ ॥

જ્યાન જીવ કી સજગતા, કરમ જીવ કી ભૂલ ।

જ્યાન મોખ અંકૂર હે, કરમ જગત કા મૂલ ॥

જ્ઞાનચેતના કે જગો, પ્રગતૈ કેવલરામ ।

કર્મચેતના મેં બસે, કર્મબંધ પરિનામ ॥

(ચૌપાઈ)

જબલગ જ્યાન ચેતના ન્યારી । તબલગ જીવ વિકલ સંસારી ॥

જબ ઘટ જ્યાન ચેતના જગી । તબ સમકિતી સહજ વૈરાગી ॥

સિદ્ધ સમાન રૂપ નિજ જાને । પર સંજોગ ભાવ પર માને ॥
સુધ્બતમ અનુભો અભ્યાસે । ત્રિવિધ કર્મ કી મમતા નાસે ॥

જ્યાં શાયકભાવ અર્થાત આત્મજ્ઞાન છે ત્યાં શુદ્ધચારિત્ર અવશ્ય રહે છે. આ પ્રકારે તે જ્ઞાન અને વૈરાગ્ય (ચારિત્ર) એક સાથે મળી મુક્તિને સાધે છે.

જે રીતે આંધળાની પીઠ પર લંગડો બેસી જથ્ય તો આંધળાના પગ અને લંગડાની આંખો મળી રસ્તો પાર કરી લે છે; એ પ્રકારે જ્યાં આત્મજ્ઞાન અને આત્મરમણતદ્વારા મળી જથ્ય છે, ત્યાં મોક્ષમાર્ગ સધારાય છે; કેમકે જ્ઞાન આત્મપદ્ધનો મર્મ જણી લે છે અને ચારિત્ર આત્મપદ્ધમાં ઉપયોગની સ્થિરતા પ્રદાન કરે છે.

જ્ઞાનચેતના જીવની સજગતા છે, સાવધાની છે અને કર્મચેતના જીવની ભૂલ છે, જીવને ભૂલાવવામાં નાખવાવાળી છે; જ્ઞાનચેતના મોક્ષનો અંકુર છે અને કર્મચેતના સંસારની જરૂર છે જ્ઞાનચેતના જગવાથી આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય છે અને કર્મચેતનામાં વસવાથી કર્મોનો બંધ કરવાવાળો ભાવ પેદા થાય છે.

જ્યાંસુધી જ્ઞાનચેતના નથી, ત્યાંસુધી આ જીવ દુઃખી થતો સંસારમાં જ બટકે છે અને જ્યારે હૃદયમાં જ્ઞાનચેતના જાગે છે - ત્યારે જીવ સહજ વૈરાગ્યને ધારણ કરવાવાળો સમ્યગ્દ્રષ્ટિ થઈ જથ્ય છે.

જ્ઞાનચેતના જગવાથી તે સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતાના સ્વરૂપને સિદ્ધભગવાન જેવું જણવા લાગે છે અને પરપદાર્થ અને સંયોગીભાવોને પર માનવા લાગે છે તથા શુદ્ધાત્માના અનુભવનો અભ્યાસ કરવા લાગે છે અને દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ આ પ્રકારે તે ત્રણ પ્રકારના કર્મોની મમતા છોડી દે છે; તેમાં એકત્વ-મમત્વ નથી કરતાં, તેનો કર્તા-ભોક્તા પણ થતો નથી.

આ કળશનો ભાવ પૂરુ ગુરુહેવશ્રી આ પ્રમાણે કરે છે -

જુઓ ! અહિં જ્ઞાન અને અજ્ઞાનની સંચેતનાનું ફળ કહ્યું છે ભગવાન આત્મા સર્વજ્ઞસ્વભાવી વીતરાગસ્વભાવી શુદ્ધ એક ચૈતન્યમાત્ર વસ્તુ છે. એવા નિજસ્વરૂપમાં એકાગ્ર થઈ જે તેનેજ વેદે છે, તેનો જ અનુભવ કરે છે; તેની પર્યાયમાં અત્યંત શુદ્ધ જ્ઞાન પ્રકાશિત થાય છે, તેને શુદ્ધતાની વિશેષદશા પ્રગટ થાય છે. તેને જ સંવર અને નિર્જરા કહે છે.

સંવર અને નિર્જરા બન્ને સાથે હોય છે વર્તમાનમાં જે શુદ્ધિ થાય છે તે સંવર તથા વિશેષ રમણતાથી જે શુદ્ધિમાં વૃદ્ધિ થાય છે તે નિર્જરા છે. તે ચારિત્રની વિશેષદશાની વાત છે.

કળશમાં જે સંચેતન શબ્દ આવ્યો છે, તેનો અર્થ એ છે કે વસ્તુ પ્રતિ એકાગ્ર થઈ, ઉપયોગને તેમાં જ જેડી તેના પ્રતિ જ જગત રહેવું, તેના જ સ્વાદમાં લીન રહેવું તે જ્ઞાનનું સંચેતન છે, જ્ઞાનચેતના છે. સમ્યગુદ્ધર્ણનપૂર્વક ઉપયોગની અંતર એકાગ્રતા હોવી તે જ જ્ઞાનની સંચેતના છે.

ભગવાન આત્મા સચિચદાનંદપ્રભુ જ્ઞાન અને આનંદસ્વરૂપ છે, તેમાં એકાગ્ર થઈ તેમાં લીન થવું તે જ્ઞાનચેતના છે. જેવી રીતે મોર ઉત્સાહમાં આવી આનંદવિભોર થઈ જ્યારે નૃત્ય કરે છે તો તેની પાંખો ખિલે છે, પાંખો ફેલાઈ જાય છે; તેવી રીતે જ્યારે ભગવાન આત્મા નિજસ્વરૂપમાં એકાગ્ર થઈ રહે છે, ત્યારે પર્યાયમાં જ્ઞાન અને આનંદની કળા ખીલી ઉઠ છે તથા તે જ્ઞાનચેતના વૃદ્ધિગત થઈ પૂર્ણમના ચંદ્રની માફક સર્વ કળાઓથી ખીલી કેવળજ્ઞાન ઢ્રે વ્યક્ત થઈ જાય છે.

જુઓ, પુરુથ-પાપ આદિ કર્મજ્ઞપ અને કર્મકળજ્ઞપ ભાવોમાં એકાગ્ર થઈ તેમાં ઉપયોગને રોકી રાખવો તે અજ્ઞાનચેતના છે. તેમાં કર્મોનો બંધ થાય છે, કેમકે તે અજ્ઞાનચેતના જ્ઞાનની શુદ્ધતાને રોકી રાખે છે.

સ્વયં પોતાનો આત્મા ચૈતન્યપ્રકાશનો પુંજ જિનચંદ્ર છે, તેને ભૂલી

પ્રતાદિના રાગમાં એકાગ્ર થઈ પ્રવર્તતવું મિથ્યાત્વના અંધકારમાં જ રહેવા જોવું છે. આવા જીવોનું સંસારપરિભ્રમણ મળું નથી. ૧

ઉપરનાં સંપૂર્ણ કથનનો સાર એ છે કે જ્ઞાનચેતના મોક્ષમાર્ગ છે અને કર્મચેતના અને કર્મફળચેતનાઙ્ગુપ અજ્ઞાનચેતના સંસારનો માર્ગ છે.

એટલા માટે આપણે કર્મચેતના અને કર્મફળચેતનાઙ્ગુપ અજ્ઞાનચેતનાથી મુક્ત થઈ જ્ઞાનચેતનાઙ્ગુપ જ નિરંતર પ્રવર્તતવું જોઈએ.



આગામી શાબ્દિ

શંકા : તીર્થકરોના અનુપમ સામર્થ્ય કેટલું ?

સમાધાન :- તીર્થકરોના અનુપમ સામર્થ્યની કલ્પના કરવી શક્ય નથી, તો પણ સ્થૂળદ્ધાર્થાંત દ્વારા સમજલીએ છીએ. બધા પશુ સમૂહમાં સૌથી વધુ બલશાળી પ્રાણી હાથી છે એમ લોકો સમજે છે, પરન્તુ હન્જરો હાથીઓનું બળ એક સિંહમાં હોય છે અને હન્જરો સિંહનું બળ એક શરબ (શાર્વલ) માં હોય છે. હન્જરો શરબોનું બળ એક બલદેવમાં હોય છે, બે બલદેવોની શક્તિ એક અર્ધચક્રીમાં રહે છે. બે અર્ધચક્રીઓનું બળ એક ચક્રવર્તીમાં હોય છે. એક હન્જર ચક્રવર્તિઓનું બળ એક ઈન્દ્રમાં હોય છે. અસંખ્ય ઈન્દ્રોના બળથી પાગ અધિક શક્તિ એક તીર્થકરમાં હોય છે. વાસ્તવમાં તીર્થકરોને જન્મથી જ અતુલ બળ અથવા અપ્રતિમ વીર્યતા નામક એક અતિશાય ગુણ હોય છે. તે બળની તુલના નથી થઈ શકતી.

૧ હિંદી પ્ર. રત્નાકર ભાગ ૧૦ પાના ૪૬-૪૭

સમયસાર ગાથા ૩૮૭-૩૮૯

વેદંતો કર્મફળં અપ્પાણં કુણા જો દુ કર્મફળં ।
સો તં પુણો વિ બંધિ વીયં દુક્ખસ્સ અદૃવિહં ॥૩૮૭॥

વેદંતો કર્મફળં મએ કયં મુણા જો દુ કર્મફળં ।
સો તં પુણો વિ બંધિ વીયં દુક્ખસ્સ અદૃવિહં ॥૩૮૮॥

વેદંતો કર્મલં સુહિદો દુહિદો ય હવદિ જો ચેદા ।
સો તં પુણો વિ બંધિ વીયં દુક્ખસ્સ અદૃવિહં ॥૩૮૯॥

જે કર્મફળને વેદતો નિજરૂપ કર્મફળને કરે,
તે ફરીય બાંધે અષ્ટવિધના કર્મને - દુઃખબીજને; ૩૮૭

જે કર્મફળને વેદતો જાણે 'કર્મફળ મેં કર્યું',
તે ફરીય બાંધે અષ્ટવિધના કર્મને - દુઃખબીજને; ૩૮૮

જે કર્મફળને વેદતો આત્મા સુખી દુઃખી થાય છે,
તે ફરીય બાંધે અષ્ટવિધના કર્મને - દુઃખબીજને; ૩૮૯

જે આત્મા કર્મના ફળનું વેદન કરતો થકો કર્મના ફળને નિજરૂપ
કરે છે અર્થાત્ તેમાં એકત્વબુદ્ધિ કરે છે; તે આત્મા દુઃખના બીજરૂપ આઠ
પ્રકારના કર્મોને ફરી બાંધે છે.

જે આત્મા કર્મના ફળનું વેદન કરતો થકો એવું જાણો-માને છે
કે મે કર્મફળ કર્યું; તે આત્મા દુઃખના બીજરૂપ આઠ પ્રકારના કર્મોને ફરી
બાંધે છે.

કર્મના ફળને વેદતો થકો જે આત્મા સુખી-દુઃખી થાય છે; તે આત્મા દુઃખના બીજડુપ આઠ પ્રકારના કર્મોને બાંધે છે.

આ ત્રણે ગાથા લગભગ સમાન જેવી જ છે. શેષ વાતો સમાન હોવા છતાં અંતર માત્ર એટલું જ છે કે પહેલી ગાથામાં વેદનમાં આવતું કર્મફળમાં એકત્વ મમત્વની વાત છે, બીજી ગાથામાં કર્તૃત્વની વાત છે અને ત્રીજી ગાથામાં બોક્તૃત્વની વાત છે.

ત્રણે ગાથાનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે વેદનમાં આવતું કર્મફળ તેમાં જે એકત્વ-મમત્વ તેમજ કર્તૃત્વ-બોક્તૃત્વ ધારણ કરવાવાળો આત્મા ફરી ફરી કર્મબંધનને પ્રાપ્ત કરે છે.

આત્મઘ્�યાતિમાં આ ગાથાઓના ભાવ આ પ્રકારે સ્પષ્ટ કર્યો છે. જ્ઞાનસ્વભાવી પોતાના આત્માથી બિજ્ઞ ભાવોમાં આ પ્રકારે ચેતવું-વિચારવું, જણવું-માનવું કે ‘આ તે હું’ તે અજ્ઞાનચેતના છે. આ અજ્ઞાનચેતના બે પ્રકારની હોય છે - કર્મચેતના અને કર્મફળચેતના.

તેમાં જ્ઞાન (આત્મા) થી અન્ય ભાવોમાં એવું જણવું-માનવું કે હું આનો કર્તા છું. કર્મચેતના છે અને એવું માનવું કે હું આનો બોક્તા છું - તે કર્મફળચેતના છે.

આ સમસ્ત અજ્ઞાનચેતના સંસારનું બીજ છે; કેમકે સંસારના બીજડુપ જે જ્ઞાનવરણાદ આઠ કર્મ છે, તે અજ્ઞાન-ચેતના તેનું બીજ છે. એ માટે મોક્ષાથી પુરુષે આ અજ્ઞાનચેતનાના નાશને માટે, જડમૂળથી ઉખાડીને ફેંકવા માટે સંપૂર્ણ કર્મોથી નિવૃત્તિની ભાવનાને અને સંપૂર્ણ કર્મફળથી નિવૃત્તિની ભાવનાને નચાવી વારંવાર ભાવીને; સ્વભાવભૂત ભગવતી જ્ઞાનચેતનાને જ સદા નચાવવી જેઈએ, ભાવવી જેઈએ.”

આ ગાથાઓના ભાવને તાત્પર્યવૃત્તિમાં પણ આ પ્રકારે સ્પષ્ટ કરવામાં આવ્યા છે.

આ ગાથાઓના ભાવને પૂરુષેવશ્રી આ પ્રમાણે સ્પષ્ટ કરે છે.¹

¹ લિંગી પ્ર. રત્નાકર ભાગ ૧૦ પાના ૫૦

“‘જ્ઞાનથી અન્ય’ એવું જે કહ્યું તે ‘જ્ઞાન’ શબ્દનો અર્થ આત્મા છે ભાઈ ! શુભ અને અશુભભાવ આત્માથી જુદા છે, અન્ય છે. તેમાં પોતાપણાનો અનુભવ કરવો તે અજ્ઞાનચેતના છે. તે અજ્ઞાનચેતના બે પ્રકારની છે - કર્મચેતના અને કર્મફળચેતના.

ભગવાન આત્મા સિવાય અન્ય પુણ્ય-પાપના વિકારીભાવને “હું કરું છું” એમ અનુભવવું-માનવું કર્મચેતના છે. અહિં કર્મ શબ્દથી જરૂરી વાત ન લેવી. આ શુભાશુભ ભાવકર્મની વાત છે.

તથા વિકારમાં હર્ષ-શોકનું વેદન કરવું કર્મફળચેતના છે. જુઓ, સમસ્ત શુભાશુભભાવોને કરવાકૃપ અને ભોગવવાકૃપ પરિણામ સંસારનું બીજ છે, ચોરાસી લાખ યોનીઓમાં ભટકવાનું બીજ છે, કેમકે આઠેય કર્મ અજ્ઞાનચેતનાના બીજ છે.

રાગથી બિન્ન કરીને ભેદજ્ઞાનના અભ્યાસ દ્વારા ‘હું તો શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ છું’ અંતરમાં આવી પ્રતીતિ અને અનુભવ કરવાનું નામ જ્ઞાનચેતના છે અને તે ધર્મ છે. આત્મા શુદ્ધ એક ચૈતન્ય સત્તાપણે અંદરમાં બિરાજમાન છે; તેની સન્મુખ થઈ તેનો જ અનુભવ કરવો તે ભંગવતી જ્ઞાનચેતના છે તથા તે જ ભવછેદનો ઉપાય છે.

પ્રશ્ન - શુભાશુભ ભાવ જે કરવા લાયક નથી તો છોડવા લાયક પણ નથી; કેમકે તે સભ્યગ્રદ્રષ્ટિને પણ હોય છે ?

ઉત્તર - અરે ભાઈ ! સર્વ શુભાશુભભાવ છોડવા લાયક જ છે. ૧૦૮માં કળશની ટીકામાં પાને રાજમલળુચે આનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે કર્યું છે.

અહિં કોઈ જાણશે કે શુભ-અશુભક્ષિયકૃપ અથવા આચરણકૃપ જે ચારિત્ર છે, તે જે કરવા જેવું નથી તો છોડવા યોગ્ય પણ નથી ને ?

ઉત્તર આ પ્રમાણે છે કે છોડવા યોગ્ય છે; કારણ કે વ્યવહાર ચારિત્ર હોવા છતાં પણ દુષ્પ છે, અનિષ્ટ છે, ધાતક છે; એ કારણે વિષય-કષાયની જેમ જ ક્ષિયકૃપ ચારિત્ર નિષિદ્ધ છે.

જાનીને પણ રાગનો વિકલ્પ આવે છે; પરંતુ તેને નિરંતર એવું બેદજાન વર્તે છે કે “હું આનાથી જુદ્દો છું.” બેદજાનના આવા જ ઉગ્ર અભ્યાસથી સ્વરૂપસન્મુખતા થાય છે. તેથી હે ભવ્ય ! સકલ કર્મની અને સકલ કર્મફળની ભાવનાનો ત્યાગ કરી સ્વભાવભૂત ભગવતી જ્ઞાનચેતનાને જ સદા ભાવો.

જેને અંતરંગમાં સિદ્ધપદને પ્રાપ્ત કરવાની ભાવના થઈ; તેને આચાર્ય ફરમાવે છે - હે મોક્ષાર્થી ! તું સકલ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવી તારી પોતાની સ્વભાવભૂત ભગવતી જ્ઞાનચેતનાને જ સદા નચાવ; જ્ઞાનચેતનારૂપ થઈને જ સતત પરિણામન કર. ભગવાન આત્માનું સ્વસંવેદન કરી જ્ઞાન અને આનંદના વેદનમાં રહો.

આ ભગવતી જ્ઞાનચેતનાને સદા નચાવો; કેમકે આ જ એકમાત્ર મોકાનો ઉપાય છે. ભગવતી જ્ઞાનચેતના કહો કે ભગવતીપ્રકાશ કહો - બન્ને એક જ વાત છે ?^૧

આ પ્રમાણે આ ગાથાઓમાં એ જ કહેવાયું છે કે કર્મચેતના અને કર્મફળચેતના એ બન્ને અજ્ઞાનચેતનારૂપ હોવારી હેય છે અને જ્ઞાનચેતના પરમ ઉપાદેય છે.

આ ગાથાઓ અને તેની આત્મભ્યાતિ ટીકામાં ભગવતી જ્ઞાનચેતનાને નિત્ય નચાવવાની પ્રેરણા આપવામાં આવી છે. તે પ્રેરણાને સ્વયં અપનાવીને હવે અહિં આચાર્ય અમૃતચંદ્રદેવ પદ અને ગધના માધ્યમથી જ્ઞાનચેતનાનું નૃત્ય પ્રસ્તુત કરે છે; જેમાં તે ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળની કર્મચેતના સંબંધી ભૂલોનું પ્રતિકમળકલ્પ, આલોચનાકલ્પ અને પ્રત્યાખ્યાનકલ્પના માધ્યમથી મન-વચન-કાય અને હૃત-કારિત-અનુમોદનાનો ત્યાગ કરવાની વારંવાર ભાવના ભાવે છે અને ૧૪૮ કર્મ પ્રકૃતિઓના ફળના ત્યાગરૂપ કર્મફળચેતના સંબંધી ભૂલોના ત્યાગની ભાવના ભાવે છે.

^૧ હિંદી પ્ર. રત્નાકર ભાગ ૧૦ પા. ૫૦-૫૧-૫૨

સર્વ પ્રથમ તે ત્રણે કલ્પોની પ્રસ્તાવનાકૃપ એક આર્યા છન્દ પ્રસ્તુત કરે છે, જે આ પ્રકારે છે -

(આર્ય)

કૃતકારિતાનુમનનૈસ્ત્રિકાલવિષયં મનોવચનકાયૈ: ।

પરિહૃત્ય કર્મ સર્વ પરમં નૈષ્ઠકમ્ર્યમવલમ્બે ॥૨૨૫॥

(રોતા)

ભૂત ભવિષ્યત વર્તમાન કે સભી કર્મકૃત ।

કારિત અર અનુમોદનાદિ મેં સભી ઓર સે ॥

સભકા કર પરિત્યાગ હૃદય સે વચન-કાય સે ।

અવલભન લેતા હું પરમ નિષ્કર્મભાવ કા ॥૨૨૫॥

ત્રણકાળના સમસ્ત કર્મોના મન-વચન-કાય અને કરવું કરાવવું અનુમોદવું તેનો ત્યાગ કરીને હવે હું પરમ-નૈષ્ઠકમ્ર્યભાવનું અવલભન લઉં છું.

આ કળશની ભૂમિકાને સ્પષ્ટ કરતાં આચાર્ય અમૃતચંદ્ર ઉત્થાનિકામાં લખે છે કે સૌથી પહેલાં સમ્પૂર્ણ કર્મોથી સંન્યાસ લેવાની ભાવનાને નચાવે છે.

એ રીતે આ કળશ પ્રતિક્રમણકલ્પ, આલોચનાકલ્પ અને પ્રત્યાખ્યાનકલ્પ - આ ત્રણે કલ્પોની પ્રસ્તાવનાકૃપ કળશ છે.

ભૂતકાળમાં કરેલ દુષ્કૃતો (પાપ)નું પ્રાયશ્રિત પ્રતિક્રમણકલ્પમાં અને વર્તમાનમાં થઈ રહ્યા તે દુષ્કૃતોનું પ્રાયશ્રિત આલોચના કલ્પમાં કરવામાં આવે છે તથા પ્રત્યાખ્યાનકલ્પમાં ભવીષ્યકાળમાં સંભવિત દુષ્કૃતોથી બચવાની ભાવના ભાવવામાં આવે છે. તેનાથી બચવાનો સંકલ્પ કરવામાં આવે છે.

આ ત્રણેકાળના દુષ્કૃત્યોના ત્યાગની ભાવના મન-વચન-કાય અને કરવું-કરાવવું-અનુમોદના પૂર્વક કરવામાં આવે છે.

પોતે કરે તેને કરવું કહેવાય છે, બીજી પાસે કરાવવું તેને કરાવવું કહેવાય છે અને પોતે ન કરે અને બીજી પાસે ન કરાવે; પણ બીજી કરે તેની પ્રશંસા કરે તેને અનુમોદના કહે છે.

આ બધાને પરસ્પર સંયુક્ત કરવાથી પ્રતિક્રમણકલ્પનાં ૪૮ ભંગ, આતોચના કલ્પના ૪૮ ભંગ અને પ્રત્યાઘ્યાનકલ્પના ૪૮ ભંગ એ રીતે ૧૪૭ ભંગ થયા પ્રત્યેકના આ $48+48+48=144$ ભંગ બનાવવાની રીત સ્પષ્ટ કરતાં પં. જગન્ભોહનલાલજી શાસ્ત્રી ‘અધ્યાત્મ અમૃત કળશ’ માં લખે છે.

મન-વચન-કાયા આ વ્રણમાં એક એક ને જુદા જુદા ગ્રહણ કરવાથી ૩ બેદ થાય છે. બધાને એક સાથે લેવાથી પણ ૩ બેદ બને છે. વ્રણને એક સાથે લેવાથી ૧ બેદ બને છે - આવી રીતે સાત બેદ થયા. કરવું-કરાવવું અને અનુમોદવું તેના પણ એક એક રૂપમાં ઉપરમુજબ ૭ બેદ થયા.

મન-વચન-કાયાના ૭ કરવું, કરાવવું, અનુમોદવું તેના ૭ એમ $7 \times 7 = 49$ બેદ થયા.

આ પ્રકારે આ કળશમાં મન-વચન-કાયા અને કરવું-કરાવવું-અનુમોદના પૂર્વક વ્રણકાળમાં કરેલ સમસ્ત શુભાશુભભાવોનો ત્યાગ કરીને પરમ કર્મરહિત ભાવમાં સ્થિત થવાની કામના કરવામાં આવી છે.

પ્રતિક્રમણકલ્પની ભૂમિકા બાંધતા થકા કવિવર પં. બનારસીદાસજી એક દોહા લખે છે; જે આ પ્રમાણે છે -

જ્યાનવંત અપની કથા, કહે આપસૌં આપ
મૈં મિથ્યાત દસાવિષે, કીને બહુવિધિ પાપ

જ્ઞાની જીવ પોતાની કહાની પોતાની ભાષામાં પોતેજ કહે છે કે મેં ભૂતકાળમાં મિથ્યાત્વદર્શામાં અનેકપ્રકારના ધણા પાપ કર્યા છે.

તે ઉપરાંત તેઓ એક ઈક્તીસા સવૈયા દ્વારા તે પાપોનું ચિત્રણ આ પ્રકારે કરે છે.

(સવૈયા ઇક્તીસા)

હિરદૈ હમારે મહા મોહ કી વિકલતાઈ,
તાતેં હમ કરુના ન કીની જીવધાત કી ।
આપ પાપ કીનેં ઔરનિ કૌં ઉપદેસ દીનેં,
હુતી અનુમોદના હમારે યાહી બાત કી ॥
મન બચ કાયા મૈં મગન હૈ કમાયે કર્મ,
ધાયે ભ્રમજાલ મૈં કહાયે હમ પાતકી ।
ગ્યાન કે ઉદય ભએ હમારી દસા ઐસી ભર્ડી,
જૈસેં ભાનુ ભાસત અવસ્થા હોત પ્રાત કી ॥

અમારા હદ્યમાં મહામોહ અર્થાત્ ભિથ્યાત્યના કારણે અનંત સંકલ્પ-વિકલ્પ હતા, ખૂબ જ આકૃણતા હતી; એ કારણે અમે અનંત જીવોનો ધાત કર્યો, તેમના પ્રત્યે રંચમાત્ર પણ દ્યાભાવ ન રાખ્યો.

અમે સ્વયં પાપ કર્યા અને બીજા પાસે કરાવ્યા, તેને પાપ કરવાનો ઉપદેશ આપ્યો તથા બીજ દ્વારા કરવામાં આવેલ પાપોની અનુમોદના પણ કરી. એ રીતે અમે કરવું, કરાવવું અને અનુમોદના કરી નિર્દ્ય થઈ અનંત પાપ કર્યા છે.

આ પાપ અમે મન-વચન અને કાયાની કિયામાં મળન થઈ તેમાં એકત્વ સ્થાપી કર્યા; આ પ્રકારે ભ્રમજાળમાં પડી અમે મહાપાપી કહેવાયા.

પરંતુ સમ્યગ્જાનની પ્રાપ્તિ થતાં અમારી દશા તેવી થઈ ગઈ છે જેવી પ્રાત:કાળમાં સૂર્ય પ્રકાશિત થતાં ગાઢ અંધકારની થાય છે. આ પ્રકારે સમ્યગ્જાનકૂપી સૂર્યના ઉદ્યથી અમારો અજ્ઞાનકૂપ રાત્રિનો ગાઢ અંધકાર દૂર થઈ ગયો છે.

આ પ્રકારે પ્રતિક્રમણ, આતોચના અને પ્રત્યાઘ્યાનના આ ૪૮/

૪૬ ભંગોને યાદ રાખવા જો કે સરળ નથી; છતાં તેને નિચે પ્રમાણે માધ્યમથી સહેલાઈથો યાદ રાખી શકાય છે.

એક નિસંયોગી, ત્રણ દ્વિસંયોગી અને ત્રણ અસંયોગી આ પ્રમાણે મન-વચન-કાયના ઇ ભંગ બને છે, જે આ પ્રમાણે છે ૧. મન-વચન-કાય, ૨. મન-વચન, ૩. મન-કાય ૪. વચન-કાય ૫. મન ૬. વચન ઇ. કાય.

આ પ્રમાણે કરવું, કરાવવું અને અનુમોદવું તેના પણ વધારેમાં વધારે ઇ ભંગ બને છે જે આ પ્રકારે છે -

૧. કરવું-કરાવવું-અનુમોદવું. ૨. કરાવું-કરાવવું ૩. કરવું-અનુમોદવું
૪. કરાવવું-અનુમોદવું ૫. કરવું ૬ કરાવવું ઇ અનુમોદવું.

મન-વચન-કાયના ઇ ભંગમાંથી દેશેકના કરવું-કરાવવું-અનુમોદવું એ ઇ ભંગો મેળવતાં ૪૬ ભંગ થશે.

જેવી રીતે -

- ૧ મેં પૂર્વે મન-વચન-કાયથી જે ખોટું કામ (પાપ) કર્યું, કરાવ્યું અને અનુમોદન કર્યું હોય; તે મિથ્યા થાઓ.
- ૨ મેં પૂર્વે મન-વચન-કાયથી જે ખોટું કામ (પાપ) કર્યું, અને કરાવ્યું હોય તે મિથ્યા થાઓ.
- ૩ મેં પૂર્વે મન-વચન-કાયથી જે ખોટું કામ (પાપ) કર્યું અને અનુમોદ્યું હોય તે મિથ્યા થાઓ.
- ૪ મેં પૂર્વે વચન-કાયથી જે ખોટું કામ (પાપ) કર્યું, કરાવ્યું અને અનુમોદ્યું હોય તે મિથ્યા થાઓ.
- ૫ મેં પૂર્વે મન-વચન-કાયથી જે દુષ્કૃત (પાપ) કર્યું હોય તે મિથ્યા થાઓ.

- ૬ મેં પૂર્વે મન-વચન-કાયાથી જે દુષ્કૃત કરાવ્યું હોય તે મિથ્યા થાઓ.
- ૭ મેં પૂર્વે મન-વચન-કાયાથી જે દુષ્કૃત (પાપ)નું અનુમોદન કર્યું હોય તે મિથ્યા થાઓ.

જેવી રીતે મન-વચન-કાયાના આ ૭ બંગ બને છે તેવી રીતે મન-વચન, મન-કાય, વચન-કાય તથા મન-વચન અને કાયા તેમાં દરેકના ૭-૭ બંગ બનશે; તે પ્રકારે ૪૮ બંગ બની જશે. આ ૪૮ બેદ પ્રતિક્રમણના છે. તે જે પ્રકારે ૪૮ બંગ આલોચનાના તેમજ ૪૮ બંગ પ્રત્યાખ્યાનના બનશે.

આ પ્રકારે કુલ્લે ૧૪૭ બંગોના પ્રથક પ્રથક ઉત્તેખ કરતાં થકા તેના ત્યાગની ભાવના વારંવાર ભાવવી, યાદ કરવી, નચાવવી તે જે કર્મચેતનાના ત્યાગક્રિય શાનચેતનાનું નૃત્ય છે અને ૧૪૮ કર્મપ્રકૃતિઓના ફળના ત્યાગની ભાવના ભાવવી. વારંવાર યાદ કરવી તે જે કર્મફળના ત્યાગક્રિય શાનચેતનાનું નૃત્ય છે.

પ્રશ્ન - પ્રતિક્રમણકલ્પ, આલોચનાકલ્પ તેમજ પ્રત્યાખ્યાનકલ્પ ના ૪૮-૪૮ બંગ કયા કયા છે ?

ઉત્તર - આત્મખ્યાતિ દીકામાં આ કળશ ઉપરાંત ૪૮-૪૮ બંગોને આ પ્રકારે કહ્યા છે -

પ્રતિક્રમણ કરવાવાળો કહે છે -

- ૧ મેં પૂર્વે મન-વચન-કાયાથી જે દુષ્કૃત કર્યું, કરાવ્યું અને અનુમોદ્યું હોય તે દુષ્કૃત મિથ્યા થાઓ.
- ૨ મેં પૂર્વે મન-વચનથી જે દુષ્કૃત કર્યું, કરાવ્યું અને અનુમોદન કર્યું હોય તે દુષ્કૃત મિથ્યા થાઓ.
- ૩ મેં પૂર્વે મન અને કાયાથી જે દુષ્કૃત કર્યું, કરાવ્યું અને અનુમોદન કર્યું હોય તે દુષ્કૃત મિથ્યા થાઓ.

- ૪ મેં પૂર્વે વચન અને કાયાથી જે દુઃખત કર્યું, કરાવ્યું અને અનુમોદન કર્યું હોય તે દુઃખત ભિથ્યા થાઓ.
- ૫ મેં પૂર્વે મનથી જે દુઃખત કર્યું, કરાવ્યું અને અનુમોદન કર્યું હોય તે દુઃખત ભિથ્યા થાઓ.
- ૬ મેં પૂર્વે વચનથી જે દુઃખત કર્યું, કરાવ્યું અને અનુમોદન કર્યું હોય તે દુઃખત ભિથ્યા થાઓ.
- ૭ મેં પૂર્વે કાયથી જે દુઃખત કર્યું, કરાવ્યું અને અનુમોદન કર્યું હોય તે દુઃખત ભિથ્યા થાઓ.
- ૮ મેં પૂર્વે મન-વચન-કાયથી જે દુઃખત કર્યું, કરાવ્યું હોય તે દુઃખત ભિથ્યા થાઓ.
- ૯ મેં પૂર્વે મન-વચન-કાયથી જે દુઃખત કર્યું અને અનુમોદન કર્યું હોય તે દુઃખત ભિથ્યા થાઓ.
- ૧૦ મેં પૂર્વે મન-વચન-કાયથી જે દુઃખત કરાવ્યું હોય તે દુઃખત ભિથ્યા થાઓ.
- ૧૧ મેં પૂર્વે મન અને વચનથી જે દુઃખત કર્યું, કરાવ્યું હોય તે દુઃખત ભિથ્યા થાઓ.
- ૧૨ મેં પૂર્વે મન-વચનથી જે દુઃખત કર્યું અને અનુમોદન કર્યું હોય તે દુઃખત ભિથ્યા થાઓ.
- ૧૩ મેં પૂર્વે મન-વચનથી જે દુઃખત કર્યું, કરાવ્યું અને અનુમોદન કર્યું હોય તે દુઃખત ભિથ્યા થાઓ.
- ૧૪ મેં પૂર્વે મન તથા કાયથી જે દુઃખત કર્યું, કરાવ્યું હોય તે દુઃખત ભિથ્યા થાઓ.
- ૧૫ મેં પૂર્વે મન અને કાયથી જે દુઃખત કર્યું અને અનુમોદન કર્યું હોય તે દુઃખત ભિથ્યા થાઓ.

- ૧૬ મેં પૂર્વે મન અને કાયાથી જે દુઃ્ખત કરાવ્યું અને અનુમોદન કર્યું હોય તે દુઃ્ખત ભિથ્યા થાઓ.
- ૧૭ મેં પૂર્વે વચન અને કાયાથી જે દુઃ્ખત કર્યું, કરાવ્યું હોય તે દુઃ્ખત ભિથ્યા થાઓ.
- ૧૮ મેં પૂર્વે વચન અને કાયથી જે દુઃ્ખત કર્યું અને અનુમોદન કર્યું હોય તે દુઃ્ખત ભિથ્યા થાઓ.
- ૧૯ મેં પૂર્વે વચન અને કાયથી જે દુઃ્ખત કર્યું અને અનુમોદન કર્યું હોય તે દુઃ્ખત ભિથ્યા થાઓ.
- ૨૦ મેં પૂર્વે મનથી જે દુઃ્ખત કર્યું, કરાવ્યું હોય તે દુઃ્ખત ભિથ્યા થાઓ.
- ૨૧ મેં મનથી જે દુઃ્ખત કર્યું, કરાવ્યું અને અનુમોદન કર્યું હોય તે દુઃ્ખત ભિથ્યા થાઓ.
- ૨૨ મેં પૂર્વે મનથી જે દુઃ્ખત કરાવ્યું અને અનુમોદન કર્યું હોય તે દુઃ્ખત ભિથ્યા થાઓ.
- ૨૩ મેં પૂર્વે વચનથી જે દુઃ્ખત કર્યું, કરાવ્યું હોય તે દુઃ્ખત ભિથ્યા થાઓ.
- ૨૪ મેં પૂર્વે વચનથી જે દુઃ્ખત કર્યું અને અનુમોદન કર્યું હોય તે દુઃ્ખત ભિથ્યા થાઓ.
- ૨૫ મેં પૂર્વે વચનથી જે દુઃ્ખત કરાવ્યું અને અનુમોદન કર્યું હોય તે દુઃ્ખત ભિથ્યા થાઓ.
- ૨૬ મેં પૂર્વે કાયથી જે દુઃ્ખત કર્યું, કરાવ્યું હોય તે દુઃ્ખત ભિથ્યા થાઓ.
- ૨૭ મેં પૂર્વે કાયથી જે દુઃ્ખત કર્યું અને અનુમોદન કર્યું હોય તે દુઃ્ખત ભિથ્યા થાઓ.
- ૨૮ મેં પૂર્વે કાયથી જે દુઃ્ખત કરાવ્યું અને અનુમોદન કર્યું હોય તે દુઃ્ખત ભિથ્યા થાઓ.

- ૨૬ મેં પૂર્વે મન-વચન-કાયાથી જે દુષ્કૃત કર્યું હોય તે દુષ્કૃત ભિથ્યા થાઓ.
- ૩૦ મેં પૂર્વે મન-વચન-કાયાથી જે દુષ્કૃત કરાવ્યું કર્યું હોય તે દુષ્કૃત ભિથ્યા થાઓ.
- ૩૧ મેં પૂર્વે મન-વચન-કાયાથી જે દુષ્કૃત અનુમોદન કર્યું હોય તે દુષ્કૃત ભિથ્યા થાઓ.
- ૩૨ મેં પૂર્વે મન-વચનથી જે દુષ્કૃત કર્યું, તે દુષ્કૃત ભિથ્યા થાઓ.
- ૩૩ મેં પૂર્વે મન-વચનથી જે દુષ્કૃત કરાવ્યું તે દુષ્કૃત ભિથ્યા થાઓ.
- ૩૪ મેં પૂર્વે મન-વચનથી જે દુષ્કૃત અનુમોદન કર્યું હોય તે દુષ્કૃત ભિથ્યા થાઓ.
- ૩૫ મેં પૂર્વે મન અને કાયથી જે દુષ્કૃત કર્યું, હોય તે દુષ્કૃત ભિથ્યા થાઓ.
- ૩૬ મેં પૂર્વે મન અને કાયાથી જે દુષ્કૃત કરાવ્યું હોય તે દુષ્કૃત ભિથ્યા થાઓ.
- ૩૭ મેં પૂર્વે મન અને કાયાથી જે દુષ્કૃત અનુમોદન કર્યું હોય તે દુષ્કૃત ભિથ્યા થાઓ.
- ૩૮ મેં પૂર્વે વચન અને કાયાથી જે દુષ્કૃત કર્યું, તે દુષ્કૃત ભિથ્યા થાઓ.
- ૩૯ મેં પૂર્વે વચન અને કાયાથી જે દુષ્કૃત કરાવ્યું તે દુષ્કૃત ભિથ્યા થાઓ.
- ૪૦ મેં પૂર્વે વચન અને કાયાથી જે દુષ્કૃત અનુમોદન કર્યું તે દુષ્કૃત ભિથ્યા થાઓ.
- ૪૧ મેં પૂર્વે મનથી જે દુષ્કૃત કર્યું, તે દુષ્કૃત ભિથ્યા થાઓ.
- ૪૨ મેં પૂર્વે મનથી જે દુષ્કૃત કરાવ્યું તે દુષ્કૃત ભિથ્યા થાઓ.

- ૪૩ મેં પૂર્વે મનથી જે દુઃ્ખત અનુમોદન કર્યું તે દુઃ્ખત ભિથ્યા થાઓ.
- ૪૪ મેં પૂર્વે વચનથી જે દુઃ્ખત કર્યું, તે દુઃ્ખત ભિથ્યા થાઓ.
- ૪૫ મેં પૂર્વે વચનથી જે દુઃ્ખત કરાવ્યું તે દુઃ્ખત ભિથ્યા થાઓ.
- ૪૬ મેં પૂર્વે વચનથી જે દુઃ્ખત અનુમોદન કર્યું તે દુઃ્ખત ભિથ્યા થાઓ.
- ૪૭ મેં પૂર્વે કાયથી જે દુઃ્ખત કર્યું, તે દુઃ્ખત ભિથ્યા થાઓ.
- ૪૮ મેં પૂર્વે કાયથી જે દુઃ્ખત કરાવ્યું તે દુઃ્ખત ભિથ્યા થાઓ.
- ૪૯ મેં પૂર્વે કાયથી જે દુઃ્ખત અનુમોદન કર્યું, તે દુઃ્ખત ભિથ્યા થાઓ.

પ્રતિક્રમણકલ્પ ના ઉપર મુજબ ૪૯ ભંગ ની ઉપરાંત આચાર્ય અમૃતાંગ્ર આત્મપ્રાતિમાં તેના ઉપસંહારકલ્પ એક કળશ કાવ્ય લખે છે; જે આ પ્રકારે છે.

(આર્ય)

મોહાદ્યદહમકાર્ષ સમસ્તમપિ કર્મ તત્પ્રતિક્રમ્ય ।

આત્મનિ ચૈતન્યાત્મનિ નિષ્કર્મणિ નિત્યમાત્મના વર્તે ॥૨૨૬॥

(રોલા)

મોહભાવ સે ભૂતકાલ મેં કર્મ કિયે જે ।

ઉન સબકા હી પ્રતિક્રમણ કરકે અબ મૈં તો ॥

વર્ત રહા હું અરે નિરંતર સ્વયં સ્વયં કે ।

શુદ્ધ બુદ્ધ ચૈતન્ય પરમ નિષ્કર્મ આત્મ મેં ॥૨૨૬॥

મોહ (અજ્ઞાન)થી કરવામાં આવેલ ભૂતકાળના સમસ્ત કર્મોનું પ્રતિક્રમણ કરીને હવે હું ચૈતન્યસ્વક્રપ નિષ્કર્મ આત્મામાં આત્માથી જ નિરંતર વર્તી રહ્યો છું.

આ પ્રમાણે પ્રતિક્રમણકલ્પને પ્રસ્તુત કર્યા પછી આત્મભ્યાતિમાં આલોચનાકલ્પ ના છે બંગ પ્રસ્તુત કર્યા છે જે આ પ્રમાણે છે -

- ૧ હું વર્તમાનમાં મન-વચન-કાયાથી કર્મ કરતો નથી, કરાવતો નથી અન્ય કરનારને અનુમોદતો નથી.
- ૨ હું વર્તમાનમાં મન-વચનથી કર્મ કરતો નથી, કરાવતો નથી અન્ય કરનારને અનુમોદતો નથી.
- ૩ હું વર્તમાનમાં મન અને કાયાથી કર્મ કરતો નથી, કરાવતો નથી અન્ય કરનારને અનુમોદતો નથી.
- ૪ હું વર્તમાનમાં વચન અને કાયાથી કર્મ કરતો નથી, કરાવતો નથી અન્ય કરનારને અનુમોદતો નથી.
- ૫ હું વર્તમાનમાં મનથી કર્મ કરતો નથી, કરાવતો નથી અન્ય કરનારને અનુમોદતો નથી.
- ૬ હું વર્તમાનમાં વચનથી કર્મ કરતો નથી, કરાવતો નથી અન્ય કરનારને અનુમોદતો નથી.
- ૭ હું વર્તમાનમાં કાયાથી કર્મ કરતો નથી, કરાવતો નથી અન્ય કરનારને અનુમોદતો નથી.
- ૮ હું વર્તમાનમાં મન-વચન-કાયાથી કર્મ કરતો નથી કરાવતો નથી.
- ૯ હું વર્તમાનમાં મન-વચન-કાયાથી કર્મ કરતો નથી અને કર્મ કરનારને અનુમોદતો નથી.
- ૧૦ હું વર્તમાનમાં મન-વચન-કાયાથી કર્મ કરતો નથી, કરાવતો નથી અન્ય કરનારને અનુમોદતો નથી.
- ૧૧ હું વર્તમાનમાં મન-વચનથી કર્મ કરતો નથી અને કરાવતો નથી.
- ૧૨ હું વર્તમાનમાં મન-વચનથી કર્મ કરતો નથી અને અન્ય કરનારને અનુમોદતો નથી.

- ૧૩ હું વર્તમાનમાં મન-વચનથી કર્મ કરાવતો નથી, અન્ય કરનારને અનુમોદતો નથી.
- ૧૪ હું વર્તમાનમાં મન અને કાયાથી કર્મ કરતો નથી અને કરાવતો નથી.
- ૧૫ હું વર્તમાનમાં મન અને કાયાથી કર્મ કરતો નથી અને બીજા કરનારને અનુમોદતો નથી.
- ૧૬ હું વર્તમાનમાં મન અને કાયાથી કર્મ કરાવતો નથી અને અન્ય કરનારને અનુમોદતો નથી.
- ૧૭ હું વર્તમાનમાં વચન અને કાયાથી કર્મ કરતો નથી કરાવતો નથી.
- ૧૮ હું વર્તમાનમાં વચન અને કાયાથી કર્મ કરતો નથી, અને અન્ય કરનારને અનુમોદતો નથી.
- ૧૯ હું વર્તમાનમાં વચન અને કાયાથી કર્મ કરાવતો નથી, અને અન્ય કરનારને અનુમોદતો નથી.
- ૨૦ હું વર્તમાનમાં મનથી કર્મ કરતો નથી અને કરાવતો નથી.
- ૨૧ હું વર્તમાનમાં મનથી કર્મ કરતો નથી અને અન્ય કરનારને અનુમોદતો નથી.
- ૨૨ હું વર્તમાનમાં મનથી કર્મ કરાવતો નથી અને અન્ય કરનારને અનુમોદતો નથી.
- ૨૩ હું વર્તમાનમાં વચનથી કર્મ કરતો નથી અને કરાવતો નથી.
- ૨૪ હું વર્તમાનમાં વચનથી કર્મ કરતો નથી અને અન્ય કરનારને અનુમોદતો નથી.
- ૨૫ હું વર્તમાનમાં વચનથી કર્મ કરાવતો નથી અને અન્ય કરનારને અનુમોદતો નથી.
- ૨૬ હું વર્તમાનમાં કાયાથી કર્મ કરતો નથી અને કરાવતો નથી.
- ૨૭ હું વર્તમાનમાં કાયાથી કર્મ કરતો નથી અને અન્ય કરનારને અનુમોદતો નથી.

- ૨૮ હું વર્તમાનમાં કાયાથી કર્મ કરાવતો નથી અને અન્ય કરનારને અનુમોદતો નથી.
- ૨૯ હું વર્તમાનમાં મન-વચન-કાયાથી કર્મ કરતો નથી.
- ૩૦ હું વર્તમાનમાં મન-વચન-કાયાથી કર્મ કરાવતો નથી.
- ૩૧ હું વર્તમાનમાં મન-વચન-કાયાથી અન્ય કર્મ કરે તેને અનુમોદતો નથી.
- ૩૨ હું વર્તમાનમાં મન-વચનથી કર્મ કરતો નથી.
- ૩૩ હું વર્તમાનમાં મન-વચનથી કર્મ કરાવતો નથી.
- ૩૪ હું વર્તમાનમાં મન-વચનથી અન્ય કર્મ કરનારને અનુમોદતો નથી.
- ૩૫ હું વર્તમાનમાં મન અને કાયાથી કર્મ કરતો નથી.
- ૩૬ હું વર્તમાનમાં મન અને કાયાથી કર્મ કરાવતો નથી.
- ૩૭ હું વર્તમાનમાં મન અને કાયાથી અન્ય કર્મ કરે તેને અનુમોદતો નથી.
- ૩૮ હું વર્તમાનમાં વચન અને કાયાથી કર્મ કરતો નથી.
- ૩૯ હું વર્તમાનમાં વચન અને કાયાથી કર્મ કરાવતો નથી.
- ૪૦ હું વર્તમાનમાં વચન અને કાયાથી અન્ય કર્મ કરે તેને અનુમોદતો નથી
- ૪૧ હું વર્તમાનમાં મનથી કર્મ કરતો નથી.
- ૪૨ હું વર્તમાનમાં મનથી કર્મ કરાવતો નથી.
- ૪૩ હું વર્તમાનમાં મનથી અન્ય કર્મ કરે તેને અનુમોદતો નથી.
- ૪૪ હું વર્તમાનમાં વચનથી કર્મ કરતો નથી.
- ૪૫ હું વર્તમાનમાં વચનથી કર્મ કરાવતો નથી.
- ૪૬ હું વર્તમાનમાં વચનથી અન્ય કર્મ કરનારને અનુમોદતો નથી.
- ૪૭ હું વર્તમાનમાં કાયાથી કર્મ કરતો નથી.
- ૪૮ હું વર્તમાનમાં કાયાથી કર્મ કરાવતો નથી.
- ૪૯ હું વર્તમાનમાં કાયાથી અન્ય કર્મ કરનારને અનુમોદતો નથી.

આ પ્રકારે આલોચનાકલ્પ ના ૪૮ ભંગ લખ્યા પછી તેના ઉપસંહારકલ્પ કળશ કાવ્ય લખે છે, જે આ પ્રકારે છે.

(આર્ય)

મોહવિલાસવિજૃમ્ભિતમિદમુદ્યત્કર્મ સકલમાલોચ્ય ।

આત્મનિ ચૈતન્યાત્મનિ નિષ્કર્મણિ નિત્યમાત્મના વર્તે ॥૨૨૭॥

(હરિગીત)

જે મોહથી આવે ઉદ્યમાં કર્મ તે આલોચ્ય હું

નિષ્કર્મ આત્મામાં જ નિત આત્મા વડે વર્તી રહું. ૨૨૭

મોહના વિલાસથી ફેલાયેલા આ ઉદ્યમાન કર્માની આલોચના કરીને હવે હું ચૈતન્યકલ્પ નિષ્કર્મ આત્મામાં આત્માથી જ વર્તી રહ્યો છું.

આ પ્રમાણે આ ૨૨૬ અને ૨૨૭ માં છંદમાં અનુક્રમે પ્રતિક્રમણ અને આલોચનાપૂર્વક નિષ્કર્મ આત્મામાં વર્તવાની વાત કહેવામાં આવી છે.

અહીં શ્રદ્ધા-જ્ઞાનપૂર્વક નિજમાં સ્થિર થવું તેનું નામ જ વર્તવું છે.

પ્રતિક્રમણકલ્પ અને આલોચના કલ્પના ૪૮-૪૮ ભંગો ઉપરાત હવે પ્રત્યાખ્યાનકલ્પના ૪૮ ભંગ પ્રસ્તુત કરે છે; જે આ પ્રમાણે છે.

(૧) હું ભવિષ્યમાં મન-વચન-કાયાથી કર્મ કરીશ નહીં, કરાવીશ નહિ અને અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ.

(૨) હું ભવિષ્યમાં મન-વચનથી કર્મ કરીશ નહીં, કરાવીશ નહિ અને અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ.

(૩) હું ભવિષ્યમાં મન-કાયાથી કર્મ કરીશ નહીં, કરાવીશ નહિ અને અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ.

- (४) हुं भविष्यमां वयन-कायथी कर्म करीश नहीं, करावीश नहि अने अन्य करतो होय तेने अनुमोदीश नहि.
- (५) हुं भविष्यमां मनथी कर्म करीश नहीं, करावीश नहि अने अन्य करतो होय तेने अनुमोदीश नहि.
- (६) हुं भविष्यमां वयनथी कर्म करीश नहीं, करावीश नहि अने अन्य करतो होय तेने अनुमोदीश नहि.
- (७) हुं भविष्यमां कायथी कर्म करीश नहीं, करावीश नहि अने अन्य करतो होय तेने अनुमोदीश नहि.
- (८) हुं भविष्यमां मन-वयन-कायथी कर्म करीश नहीं अने करावीश नहि.
- (९) हुं भविष्यमां मन-वयन-कायथी कर्म करीश नहीं अने अन्य करतो होय तेने अनुमोदीश नहि.
- (१०) हुं भविष्यमां मन-वयन-कायथी कर्म करावीश नहि अने अन्य करतो होय तेने अनुमोदीश नहि.
- (११) हुं भविष्यमां मन-वयनथी कर्म करीश नहीं अने करावीश नहि.
- (१२) हुं भविष्यमां मन-वयनथी कर्म करीश नहीं अने अन्य करतो होय तेने अनुमोदीश नहि.
- (१३) हुं भविष्यमां मन-वयनथी कर्म करावीश नहि अने अन्य करतो होय तेने अनुमोदीश नहि.
- (१४) हुं भविष्यमां मन-कायथी कर्म करीश नहीं अने करावीश नहि.
- (१५) हुं भविष्यमां मन-कायथी कर्म करीश नहीं अने अन्य करतो होय तेने अनुमोदीश नहि.
- (१६) हुं भविष्यमां मन-कायथी कर्म करावीश नहि अने अन्य करतो होय तेने अनुमोदीश नहि.
- (१७) हुं भविष्यमां वयन-कायथी कर्म करीश नहीं अने करावीश नहि.

- (૧૮) હું ભવિષ્યમાં વચન-કાયાથી કર્મ કરીશ નહિ અને અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ.
- (૧૯) હું ભવિષ્યમાં વચન-કાયાથી કર્મ કરીશ નહિ અને અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ.
- (૨૦) હું ભવિષ્યમાં મનથી કર્મ કરીશ નહિ અને કરાવીશ નહિ.
- (૨૧) હું ભવિષ્યમાં મનથી કર્મ કરીશ નહિ અને અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ.
- (૨૨) હું ભવિષ્યમાં મનથી કર્મ કરાવીશ નહિ અને અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ.
- (૨૩) હું ભવિષ્યમાં વચનથી કર્મ કરીશ નહિ અને કરાવીશ નહિ.
- (૨૪) હું ભવિષ્યમાં વચનથી કર્મ કરીશ નહિ અને અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ.
- (૨૫) હું ભવિષ્યમાં વચનથી કર્મ કરાવીશ નહિ અને અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ.
- (૨૬) હું ભવિષ્યમાં કાયાથી કર્મ કરીશ નહિ અને કરાવીશ નહિ.
- (૨૭) હું ભવિષ્યમાં કાયાથી કર્મ કરીશ નહિ અને અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ.
- (૨૮) હું ભવિષ્યમાં કાયાથી કર્મ કરાવીશ નહિ અને અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ.
- (૨૯) હું ભવિષ્યમાં મન-વચન-કાયાથી કર્મ નહીં કરું.
- (૩૦) હું ભવિષ્યમાં મન-વચન-કાયાથી કર્મ કરાવીશ નહિ.
- (૩૧) હું ભવિષ્યમાં મન-વચન-કાયાથી, અન્ય કર્મ કરતો હોય તેને અનુમોદીશ નહિ.
- (૩૨) હું ભવિષ્યમાં મન-વચનથી કર્મ કરીશ નહિ.

- (૩૩) હું ભવિષ્યમાં મન-વચનથી કર્મ કરાવીશ નહિ.
- (૩૪) હું ભવિષ્યમાં મન-વચનથી, અન્ય કર્મ કરતો હોય તેને અનુમોદીશ નહિ.
- (૩૫) હું ભવિષ્યમાં મન-કાયાથી કર્મ કરીશ નહિ.
- (૩૬) હું ભવિષ્યમાં મન-કાયાથી કર્મ કરાવીશ નહિ.
- (૩૭) હું ભવિષ્યમાં મન-કાયાથી અન્ય કર્મ અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ.
- (૩૮) હું ભવિષ્યમાં વચન-કાયાથી કર્મ કરીશ નહિ.
- (૩૯) હું ભવિષ્યમાં વચન-કાયાથી કર્મ કરાવીશ નહિ.
- (૪૦) હું ભવિષ્યમાં વચન-કાયાથી અન્ય કર્મ કરતો હોય તેને અનુમોદીશ નહિ.
- (૪૧) હું ભવિષ્યમાં મનથી કર્મ કરીશ નહિ.
- (૪૨) હું ભવિષ્યમાં મનથી કર્મ કરાવીશ નહિ.
- (૪૩) હું ભવિષ્યમાં મનથી અન્ય કર્મ કરતો હોય તેને અનુમોદીશ નહિ.
- (૪૪) હું ભવિષ્યમાં વચનથી કર્મ કરીશ નહિ.
- (૪૫) હું ભવિષ્યમાં વચનથી કર્મ કરાવીશ નહિ.
- (૪૬) હું ભવિષ્યમાં વચનથી, અન્ય કર્મ કરતો હોય તેને અનુમોદીશ નહિ.
- (૪૭) હું ભવિષ્યમાં કાયાથી કર્મ કરીશ નહિ.
- (૪૮) હું ભવિષ્યમાં કાયાથી કર્મ કરાવીશ નહિ.
- (૪૯) હું ભવિષ્યમાં કાયાથી, અન્ય કર્મ કરતો હોય તેને અનુમોદીશ નહિ.

આ ૪૯ બંગોના ઉપસંહારકૃપે જે કળશ લખવામાં આવ્યો છે તે
આ પ્રમાણે છે.

પ્રત્યાખ્યાય ભવિષ્યત્કર્મ સમસ્તં નિરસ્તસંમોહ: ।
આત્મનિ ચૈતન્યાત્મનિ નિષ્કર્મणિ નિત્યમાત્મના વર્તે ॥૨૨૮॥

(હસ્તિગીત)

પથખી અનાગત સર્વ કર્માને થઈ નિર્માહી હું;
નિષ્કર્મ આત્મામાં જ નિત આત્મા વડે વર્તી રહે. ૨૨૮

જેનો મોહ નષ્ટ થઈ ગયો છે - એવો હું હવે ભવિષ્યમાં સમસ્ત કર્માનું પ્રત્યાખ્યાન કરીને ચૈતન્યસ્વરૂપ નિષ્કર્મ આત્મામાં આત્માથી જ નિરંતર વર્તી રહ્યો છું.

કર્મચેતનાના સંન્યાસની ચર્ચા ૧૪૭ બંગો અને ત્રણ કળશો દ્વારા વિસ્તારથી કર્યા ઉપરાંત હવે આત્માખ્યાતિમાં ઉકા સંપૂર્ણ પ્રકરણના ઉપસંહારકૃપ એક કળશ લખવામાં આવ્યો છે. જે આ પ્રમાણે છે.

(ઉપજાતિ)

સમસ્તમિત્યેવમપાસ્ય કર્મ ત્રૈકાલિકં શુદ્ધનયાવલંબી ।
વિલીનમોહો રહિતં વિકારેશ્વિન્માત્રાત્માનમથાવલંબે ॥૨૨૯॥

(હસ્તિગીત)

આ રીત વિધિ પૂર્વોક્તથી ભૂત, ભાવિ, સાંપ્રતના સહુ,
દૂરે કરી કર્મ બધાં સંન્યાસ કર્મ તાગો ચહું;
નયશુદ્ધને અવલંબનારો, મોહથી છું રહિત હું,
અવિકારી ચેતનમાત્ર આત્માને હવે અવલંબુ છું. ૨૨૯

જેનો મિથ્યાત્પ નષ્ટ થઈ ગયો છે - એવો શુદ્ધનયાવલંબી હું હવે આ પ્રમાણે ત્રણ કળસંબંધી સમસ્ત કર્માને દૂર કરીને સર્વવિકારોથી રહિત ચૈતન્યમાત્ર આત્માનું અવલંબન કરું છું.

૨૨૫ થી ૨૨૯ સુધીના પાંચ કળશ અને પ્રતિકમણ, આલોચના અને પ્રત્યાખ્યાન સંબંધી ૧૪૭ બંગોના સંદર્ભમાં પંડિતશ્રી જ્યયંદળ

છાબડાએ જે સ્પષ્ટીકરણ ભાવાર્થોમાં યથાસ્થાને આપ્યું છે; તેનો ધ્યાન દેવા યોગ્ય અંશ આ પ્રમાણે છે -

ભૂતકાળમાં કરેલા કર્મનું ૪૮ બંગપૂર્વક મિથ્યા કરનારું પ્રતિક્રમણ કરીને જ્ઞાની જ્ઞાનસ્વરૂપ આત્મામાં લીન થઈને નિરંતર ચૈતન્યસ્વરૂપ આત્માનો અનુભવ કરે, તેની આ વિધિ છે.

‘મિથ્યા’ કહેવાનું પ્રયોગન આ પ્રમાણે છે - જેમ પહેલા કોઈએ ઘન કમાવીને ઘરમાં રાખ્યું હોય અને પછી જ્યારે તેના પ્રત્યે ભમત્વ છોડી દીધું ત્યારે તેને ભોગવવાનો અભિપ્રાય તેનો રહ્યો નહિ; તે સમયે ભૂતકાળમાં જે ઘન કમાવ્યું હતું તે નહિ કમાવ્યા સમાન જ છે; તેવી જ રીતે જીવે પહેલા કર્મબંધ કર્યો હતો; પછી જ્યારે તેને અહિતરૂપ જાણીને તેના પ્રત્યે ભમત્વ છોડી દીધું અને તેના ફળમાં લીન ન થયો, ત્યારે ભૂતકાળમાં જે કર્મ બાંધ્યું હતું, તે નહિ બાંધ્યા સમાન મિથ્યા જ છે.

વર્તમાન કાળમાં કર્મનો ઉદ્ય આવે છે, તેના વિષયમાં જ્ઞાની આમ વિચારે છે કે પહેલા જે કર્મ બાંધ્યું હતું, તેનું આ કાર્ય છે, મારું તો આ કાર્ય નથી. હું તેનો કર્તા નથી, હું તો શુદ્ધ ચૈતન્યમાત્ર આત્મા છું. તેની દર્શનજ્ઞાનરૂપ પ્રવૃત્તિ છે. તે દર્શનજ્ઞાનરૂપ પ્રવૃત્તિ દ્વારા હું આ ઉદ્યાગત કર્મને દેખનાર-જાણનાર છું. હું મારા પોતાના સ્વરૂપમાં જ પ્રવર્તમાન છું. આવો અનુભવ કરવો તે જ નિશ્ચયચારિત્ર છે.

નિશ્ચયચારિત્રમાં પ્રત્યાખ્યાનનું એવું વિધાન છે કે સમસ્ત આગામી કર્મથી રહિત, ચૈતન્યની પ્રવૃત્તિરૂપ પોતાના શુદ્ધોપયોગમાં રહેવું તે પ્રત્યાખ્યાન છે. તેથી જ્ઞાની આગામી સમસ્ત કર્મનું પ્રત્યાખ્યાન કરીને પોતાના ચૈતન્યસ્વરૂપમાં રહે છે.

અહીં તાત્પર્ય આ પ્રમાણે જાણવું જોઈએ. વ્યવહારચારિત્રમાં તો પ્રતિજ્ઞામાં જે દોષ લાગે છે તેનું પ્રતિક્રમણ, આલોચના અને પ્રત્યાખ્યાન હોય છે. અહીં તો નિશ્ચયચારિત્રની પ્રધાનતાથી કથન છે; તેથી શુદ્ધોપયોગથી વિપરીત સર્વકર્મ આત્માના દોષસ્વરૂપ છે. તે સમસ્ત કર્મચૈતનાસ્વરૂપ

પરિણામોનું, ત્રણે કાળમાં કર્મોનું પ્રતિક્રમણ, આતોચના અને પ્રત્યાઘ્યાન કરીને જાની સર્વ કર્મચેતનાથી બિજ્ઞ પોતાના શુદ્ધોપયોગરૂપ આત્માના જ્ઞાન-શ્રદ્ધાન દ્વારા અને તેમાં સ્થિર થવાના વિધાન દ્વારા નિષ્પ્રમાદદશાને પ્રાપ્ત થઈને, શ્રેષ્ઠી ચઢીને કેવળજ્ઞાન ઉત્પન્ન કરવાને સન્મુખ થાય છે. આ જ્ઞાનીનું કાર્ય છે.”

ઉક્ત સંપૂર્ણ પ્રકરણ પર પ્રકાશ પાથરતાં પૂજ્ય ગુરુદેવ કહે છે -

“ધર્મી ચારિત્રવંત પુરુષ કહે છે કે હું ત્રણ કાળના સમસ્ત પુણ્ય-પાપરૂપ વિકારી કર્મોનું મન-વચન-કાય અને હૃત-કારિત-અનુમોદનાથી ત્યાગ કરું છું. હું તે કર્મોનો કર્તા નથી, કરાવનાર નથી અને અનુમોદન કરનાર પણ નથી. આ રીતે હું સર્વ કર્મોનો ત્યાગ કરું છું. પરમાં કાર્ય થાય - તેની તો અહીં વાત જ નથી.”

અહીં તો કહે છે કે જ્ઞાની જીવ વિકાળના સમસ્ત કર્મોને અર્થાત્ શુભાશુભભાવોને પણ કરતો નથી. પોતે કરતો નથી, બીજા વડે કરાવતો નથી અને મન-વચન-કાયથી અનુમોદના પણ કરતો નથી. તે તો એમ વિચારે છે કે ‘હું તો જ્ઞાનસ્વરૂપ શુદ્ધ એક ચિદાનંદ ભગવાન છું’ અને તે એમાં જ સ્થિર થાય છે, બસ તેનું જ નામ ચારિત્ર છે. મહાવતાહિનો શુભરાગ તે ચારિત્ર નથી. તેનો તો તે ત્યાગ કરે છે. આ પ્રમાણે સકળ કર્મના સંન્યાસપૂર્વક સમ્યગદ્ધિને સ્વરૂપમાં જે સ્થિરતા-રમણતા થાય છે તે ચારિત્ર છે.

ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ સહૈવ નિર્જર્મ શક્તિના સ્વભાવરૂપ છે. તેને આત્મસન્મુખ થઈને પરિણમતાં જે સ્વ-સંવેદન જ્ઞાન થયું, તે સમ્યગ્જ્ઞાન છે, “હું આ જ છું” આવી પ્રતીતિને સમ્યગ્દર્શન અને તેનો જ ઉગ્ર આશ્રય કરતાં જે નિર્જર્મ-વીતરાગદશા થાય છે તે ચારિત્ર છે.

આ પ્રમાણે જ્ઞાની સર્વકર્મોના ત્યાગની પ્રતિજ્ઞા કરે છે?

૧ પ્રવચનરલ્લાકર ભાગ ૧૦, પાનું ૫૨

૨ પ્રવચનરલ્લાકર ભાગ ૧૦, પાનું ૫૩

પહેલા અજ્ઞાનવશ પરમાં અટકીને જે શુભાશુભભાવો કર્યા, તે બધાનું પ્રતિક્ષમણ કરીને હું નિર્જર્મ ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ નિરંતર વર્તુ છું. ભાઈ ! શુભાશુભભાવ પણ દોષ છે, દુષ્કૃત છે. તેથી જ્ઞાની જીવ તેમનું પ્રતિક્ષમણ કરે છે.^૧

જુઓ ! ધર્માત્મા હિંસાદિ અશુભભાવોને ત્યાગીને દ્વા-દાન આદિ શુભભાવોમાં પ્રવર્તે છે, તે વ્યવહાર પ્રતિક્ષમણ છે. ‘હું સર્વ દોષોને છોડીને ચૈતન્યસ્વરૂપ આત્મામાં પોતાથી જ વર્તુ છું.’’ આમ જ્ઞાની ભૂતકાળમાં થયેલા સર્વકર્મોનું પ્રતિક્ષમણ કરે છે.^૨

નિરંતર નિજ ચૈતન્યસ્વરૂપ આત્માનો અનુભવ તેજ ખરું પ્રતિક્ષમણ છે.^૩

ભાઈ ! ધર્માત્મા તો રાગને મોહનો વિલાસ જાણે છે. શુભાશુભભાવ જ્ઞાનીની દાઢિમાં મોહનો જ વિલાસ છે. આ બધા પુરુષલના વિલાસ છે, જીવના વિલાસ નથી. ધર્મી જીવ તેમને ચૈતન્યનો વિલાસ માનતો નથી. ભક્તિના કાળમાં પણ તેને ભગવાન પ્રત્યે જે રાગ થાય છે, તેને પણ તે હેય જાણે છે. તેને જેવો આદર પોતાની અંદર બિરાજમાન શાયકદેવનો છે, તેવો આદર શુભ પ્રત્યે નથી. ભલે ભક્તિ આદિનો શુભરાગ આવે છે, પરંતુ તેને તે હેય જાણે છે.^૪

વાસ્તવમાં રાગથી બેદજ્ઞાન કરીને પોતાના શુદ્ધચૈતન્યસ્વરૂપમાં રમવું/રહેવું તે જ સમ્યગુદર્શન અને ધર્મ છે અને તે જ વાસ્તવિક આલોચના છે.^૫

શુદ્ધોપયોગમાં ઉત્ત્રતાપૂર્વક રમણ કરવાનું નામ પ્રત્યાઘ્યાન છે.

૧ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૬૧

૨ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૬૨

૩ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૬૩

૪ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૬૮

૫ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૬૬

દ્વા, દાન, વ્રત, ભક્તિના વિકલ્પ ઉઠિબા તે તો અપ્રત્યાખ્યાન છે. અશુદ્ધતા છે. તેનાથી ભેદજ્ઞાન કરીને શુદ્ધચૈતન્યમાત્ર ભાવમાં ઉપયોગનું રમવું તે પ્રત્યાખ્યાન છે.^૧

હું ભવિષ્યમાં સમસ્ત કર્મ કરીશ નહિ, બીજાઓ પાસેથી કરાવીશ નહિ અને અન્ય કરતા હોય તેમની અનુમોદના કરીશ નહિ. આ પ્રમાણે મન-વચન-કાયાથી સર્વકર્મનો ત્યાગ કરીને ધર્માત્મા કર્મથી મુક્ત થઈને સ્વસન-મુખ્યતા વડે શુદ્ધોપયોગઙ્ટપ પરિણામનમાં સ્થિર થાય છે. સ્વરૂપમાં જ ઉપયોગને રમાડે છે. આનું નામ પ્રત્યાખ્યાન છે, ચારિત્ર છે.^૨

જેવી રીતે અશુભરાગ અશુચિ છે, તેવી જ રીતે શુભરાગ પણ અશુચિ જ છે; જેવી રીતે અશુભભાવ હુઃખૃપ છે, તેવી જ રીતે શુભભાવ પણ અશુભતાઙ્ટપ જ છે. એકમાત્ર શુદ્ધોપયોગઙ્ટપ પરિણામ જ પવિત્ર અને નિરાકૃત છે. આત્મા અંદરમાં અતીન્દ્રિય આનંદનો સાગર પવિત્રતાનો પિંડ પ્રભુ છે. ઉપયોગને ત્યાંજ સ્થિર કરીને તેમાં જ રમવું તે વાસ્તવિક પ્રત્યાખ્યાન અને ચારિત્ર છે.^૩

ધર્માત્માઓને દ્વા-દાન, વ્રતાદિ શુભભાવ થતા જ નથી - એમ વાત નથી, થાય છે; પરંતુ એ બધાનું યથાસ્થાને હોવા છતાં પણ શુદ્ધોપયોગઙ્ટપ નિર્મળ પરિણામનાં તેનું કંઈ કામ નથી; પરંતુ નિશ્ચય પ્રત્યાખ્યાન થવા માટે શુભભાવોનું ન થવું તે જ અભીજ છે; કારણ કે તે શુભભાવ વીતરાગઙ્ટપ શુદ્ધોપયોગમાં બાધક જ હોય છે.^૪

તાત્પર્ય એ છે કે - વ્યવહારચારિત્રઙ્ટપ પ્રતિજ્ઞામાં જે દોષ લાગે છે, તેનું પ્રતિક્રિમણ, આલોચના અને પ્રત્યાખ્યાન થાય છે; પરંતુ અહીં નિશ્ચયચારિત્રનું પ્રધાનપણે કથન હોવાથી શુદ્ધોપયોગથી વિપરીત બધા કર્મ

૧ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૭૬

૨ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૭૭

૩ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૭૭

૪ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૭૮

આત્માના દોષસ્વરૂપ છે. તે સર્વ કર્મચેતનાસ્વરૂપ પરિણામોનું, જીણે કાળના કર્મોનું પ્રતિક્રિમણ, આલોચના અને પ્રત્યાખ્યાન કરીને જ્ઞાની સર્વ કર્મચેતનાથી જુદા પોતાના શુદ્ધોપયોગરૂપ આત્માના જ્ઞાન-શ્રદ્ધાન વડે તથા તેમાં જ સ્થિર થવાના વિધાનથી નિષ્પ્રમાદદશાને પ્રાપ્ત થઈને, શ્રેણી ચઢીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લે છે. તેજ જ્ઞાનીનું કાર્ય છે.

જુચો ! અહીં કહે છે કે વ્યવહારચારિત્રરૂપ પ્રતિજ્ઞામાં જે દોષ લાગે છે, તેનું પ્રતિક્રિમણ વગેરે થાય છે કે જે શુભભાવરૂપ છે અને પુણ્યબંધનું કારણ છે અને નિશ્ચયચારિત્રમાં તો શુદ્ધોપયોગથી વિપરીત સર્વધર્મ આત્મા માટે દોષસ્વરૂપ જ છે.

કહે છે કે આ સર્વ કર્મચેતનાથી બિન્ન પોતાના શુદ્ધોપયોગરૂપ આત્માના જ્ઞાન-શ્રદ્ધાન વડે તેમાં જ સ્થિર થવાના વિધાનથી નિષ્પ્રમાદદશાને પ્રાપ્ત કરીને શ્રેણીનું આરોહણ કરીને જ્ઞાની કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાને સન્મુખ થાય છે. બસ, આ જ એકમાત્ર જ્ઞાનીનું કાર્ય છે.¹

સમ્યગ્દર્શનપૂર્વક ચારિત્રદશા પ્રગટ કરવાની, સ્વરૂપમાં રમણ કરવાની જેને ઈચ્છા છે તે એમ જીણે છે, અનુભવ કરે છે કે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળના પુણ્ય-પાપના ભાવ તે માઝે સ્વરૂપ નથી, હું તેનાથી પાછો હું છું, તેનો પરિત્યાગ કરું છું. આ રીતે જીણે કાળના સમસ્ત શુભાશુભ દોષોને દૂર કરીને શુદ્ધનયાવલંબી અને મોહથી વિલીન એવો હું સર્વ વિરોધોથી રહિત શુદ્ધ ચૈતન્યમાત્ર આત્માનું અવલંબન કરું છું. હું તો શુદ્ધ એક સચ્ચિદાનંદમય આત્મા છું. તેમાં જ રમું છું, સ્થિર થાઉં છું. મને આ શુભાશુભભાવોથી શું પ્રયોજન ?

આ શરીર, મન, વાણી, ઈદ્રિય આદિ તો બધા જીડ પદાર્થ, પરપરાર્થ છે તેમનો તો મેં કદી સ્પર્શ જ કર્યો નથી. ‘હું તેમનાથી નિવૃત્ત થાઉં છું’, આ પણ નાસ્તિનું કથન છે. અસ્તિથી તો ‘હું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માને જ અવલંબુ છું, પ્રાપ્ત થાઉં છું.’

¹ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૮૦

હું તો વિકાળી અક્ખાથી, પરમશાંત વીતરાગરસથી, ચૈતન્યરસથી ભરેલો ભગવાન છું, તેનું જ અવલંબન કરું છું. બસ, આ જ ધર્મી પુરુષનું કાર્ય છે. ધર્મી જીવ તો આવા ચિંતનથી, આત્મોનમુખી પુરુષાર્થથી અલ્પકાળમાં જ કાર્ય પરમાત્મા બની જાય છે.^૧

અહીં ત્રણ વાતો કહી છે.

૧. હું ત્રણો કાળના સમસ્ત શુભાશુભક્રમોને છોડું છું. તેનાથી હું પોતાને બિજ્ઞ અનુભવું છું.
૨. હું અંતરમાં શુદ્ધ ચિદાનંદદ્દં પ્રભુ છું, શુદ્ધનયનું અવલંબન લઈને તેને જ પ્રાપ્ત કરીને તેનો જ આશ્રય લઈં છું.
૩. મારો ચિન્માત્ર આત્મા જ, ચિત્સ્વભાવી આત્મા જ મારું આલંબન છે, રાગ મારું આલંબન નથી; કારણ કે રાગ મારું સ્વરૂપ નથી, સ્વભાવ નથી.

આમ જ્યાં એક ચિન્માત્ર આત્માનું જ આલંબન છે, તે ચારિત્ર છે.^૨

ઉક્ત સંપૂર્ણ કથનનું મંથન કરતાં એક વાત સ્પષ્ટ થાય છે કે અહીં દુષ્કૃત શાબ્દનો અર્થ પાપક્રિયા અને પાપભાવ માત્ર નથી; પરંતુ સંપૂર્ણ પ્રકારની શુભાશુભ ક્રિયાઓ અને શુભાશુભભાવ છે; કારણ કે અહીં નિશ્ચય પ્રતિક્રમણ, નિશ્ચય આલોચના અને નિશ્ચય પ્રત્યાખ્યાનનું સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવી રહ્યું છે.

આમ તો વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર આલોચના અને વ્યવહાર પ્રત્યાખ્યાનમાં અશુભક્રિયા અને અશુભભાવોનો નિષેધ કરીને શુભક્રિયા અને શુભભાવ કરવાની પણ વાત આવે છે; છતાં અહીં તો એમ કહેવાઈ રહ્યું છે કે ત્રણો કાળ સંબંધી સમસ્ત શુભાશુભભાવોના અભાવપૂર્વક

^૧ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૮૦

^૨ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૮૦-૮૧

શુદ્ધોપયોગડુપદ્ધા થવી તે જ વાસ્તવિક પ્રતિક્રિમણ છે, વાસ્તવિક આલોચના છે અને વાસ્તવિક પ્રત્યાખ્યાન છે.

જે આપ ધ્યાનપૂર્વક જેશો તો અહીં એક વાત અત્યંત સ્પષ્ટડુપે દેખાઈ આવશે કે પાંચે કળશોની અંતિમ પંક્તિમાં નિર્જર્મ સ્થિતિના અવલંબનની જ વાત કરવામાં આવી છે, ચૈતન્ય આત્મામાં નિત્ય વર્તવાની વાત કહેવામાં આવી છે.

આ પ્રમાણે કર્મચેતનાના ત્યાગપૂર્વક થનારી જ્ઞાનચેતનાના નૃત્યની ચર્ચા ઉપરાંત હવે કર્મકણના ત્યાગડુપ જ્ઞાનચેતનાના નૃત્યના સ્વરૂપને પ્રસ્તુત કરતાં આચાર્ય અમૃતચંદ્ર સૌથી પહેલા એક કળશ કાવ્ય લખે છે; જે આ પ્રમાણે છે.

(આર્યા)

વિગલંતુ કર્મવિષતરુફલાનિ મમ ભુક્તિમન્તરેણીવ ।
સંચેતયેઽહમચલં ચैતન્યાત્માનમાત્માનમ् ॥૨૩૦॥

(હરિગીત)

વિષવૃક્ષકણ સમ કર્મ સહુ આ ભોગવ્યા વિગુણ ખરી જણે,
નિશ્ચયપાણે સંચેતુ છું ચૈતન્યમય આત્મા અહો ! ૨૩૦

હું પોતાના ચૈતન્યસ્વરૂપ આત્માનું નિશ્ચળતાથી સંચેતન કરું છું,
અનુભવ કરું છું; તેનાથી મારા કર્મકૃપી વિષવૃક્ષકણ સમસ્ત ફળ ભોગવ્યા
વિના જ ખરી જય - હું એવી ભાવના કરું છું.

આ કળશનો ભાવ ભાવાર્થમાં સ્પષ્ટ કરતાં પંડિત જ્યયચંદ્રલ
છાબડા લખે છે -

“જ્ઞાની કહે છે કે જે કર્મ ઉદ્યમાં આવે છે, તેના ફળને હું
જ્ઞાતાદઘટદુપે જાણું-દેખું છું, તેનો બોક્તા થતો નથી; તેથી મારા વડે
ભોગવાયા વિના જ તે કર્મો ખરી જય; હું પોતાના ચૈતન્યસ્વરૂપ આત્મામાં
લીન થતો થકો તેનો જ્ઞાતાદઘટ જ રહું.

અહીં એટલું વિશેષ જાણવું જોઈએ કે અવિરત, દેશવિરત તથા પ્રમત્તસંયત દ્રશ્યામાં તો આવા જ્ઞાન-શ્રદ્ધાન જ પ્રધાન છે અને જીવ જ્યારે અપ્રમત્તદ્રશ્યાને પ્રાપ્ત થઈ શ્રેણી ચેત છે, ત્યારે તે અનુભવ સાક્ષાત્ થાય છે.”

આ કળશના ભાવને સ્પષ્ટ કરતાં પૂજ્ય ગુરુદેવ કહે છે - “સમસ્ત કર્મફળના સંન્યાસની ભાવના કરનાર કહે છે કે જ્ઞાનાવરણાદિ આઠ કર્મ છે તથા તેમના બેદ-પ્રબેદ કરતાં ૧૪૮ બેદ થાય છે. જ્ઞાનીને આ સમસ્ત કર્મોના ફળને ત્યાગવાની ભાવના હોય છે. જ્ઞાની ધર્માત્મા કરે છે કે કર્મદ્વારી વિષવૃક્ષનાં ફળ મારા બોગવ્યા વિના જ ખરી જાઓ.

જુઓ ! જ્ઞાનીજનોના શુભભાવોના જેરમાં વિષવૃક્ષાણની ભાવના હોવાથી તીર્થકર નામકરણી પ્રકૃતિનો બંધ પણ થાય છે; છતાં તેઓ તેને વિષવૃક્ષ જ માને છે; કારણ કે તેમને તીર્થકર જેવા મહાન યશનો પણ લોભ રહેતો નથી. સાધારણ લોકોને એવું લાગી શકે કે તીર્થકર જેવા પવિત્ર પદને વિષવૃક્ષ જેવી હીન ઉપમા કેમ અપાઈ રહી છે; પણ ધ્યાન આપવા યોગ્ય વાત એ છે કે જ્ઞાનીને ભૂમિકાનુસાર શુભભાવ થાય છે; પરંતુ તેમને સંપૂર્ણ શુભાશુભ કર્મોના ફળ પ્રત્યે હેયબુદ્ધિ થઈ ગઈ છે; તેથી તેઓ બધા કર્મોથી પાછળ હઠી ગયા છે; બધાનું પ્રત્યાખ્યાન કરી ચૂક્યા છે. તેથી તેઓ ભાવના ભાવે છે કે અમે પૂર્વે જે શુભાશુભ કર્મો બાંધ્યા હતા; તે બધા વિષવૃક્ષના ફળ છે; તે બધા ફળ દીધા વિના જ ખરી જાઓ.

કોઈને આ વાત અટપટી લાગી શકે છે; પરંતુ આ તો અનાદિસિદ્ધ વીતરાગતાનો માર્ગ છે.¹

બાઈ ! કર્મોના ફળ વિષવૃક્ષના જ ફળ છે, તેમાં મિઠાસ છે જ કયાં ? તેથી ધર્મ જીવ કહે છે કે આ કર્મદ્વારી વિષવૃક્ષના ફળ મારા બોગવ્યા વિના જ નાચ થઈ જય, ખરી જય. તેમને કર્મફળ બોગવાની બિલ્કુલ ભાવના નથી. તેઓ તો કહે છે કે ‘અમે તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ આનંદકંદ નિજ આત્માનું જ સંચેતન કરીએ છીએ.

¹ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૮૦-૮૧

બલે શાતા વેદનીથના ઉદ્ઘયમાં પુણ્યના ફળસ્વરૂપ ભોગસામગ્રી પ્રચુરમાત્રમાં મળે છે; પરંતુ તે બધી જ્ઞાનીઓને વિષફળ જેવી જ પ્રતીત થાય છે, વિચાર કરતાં આકૃણતામય હોવાથી દુઃખદાયી લાગે છે; તેથી અતીન્દ્રિય આનંદનો અનુભવ કરનારા જ્ઞાનીજ્ઞન કહે છે કે આ કર્મફળ ભોગવ્યા વિના જ ખરી જય.

આ પ્રમાણે પહેલા કર્મચેતનાના ત્યાગની ભાવના ભાવી અને હવે કર્મફળચેતનાના ત્યાગની ભાવના ભાવે છે.^૧

જુઓ, ચોથા-પાંચમા ગુણસ્થાનમાં રાગની એકતા તૂટી છે; પરંતુ હજુ અહીં અસ્થિરતા છૂટી નથી. પાંચમા ગુણસ્થાનમાં દેશવિરતી શ્રાવકને આનંદની વૃદ્ધિ જરૂર થઈ છે; છતાં પણ તેને હજુ અસ્થિરતાનો ભાવ થાય છે. છઠા ગુણસ્થાનમાં અનંતાનુભંગી આદિ ત્રણ કષાયોનો અભાવ થયો છે, પ્રચુર આનંદનું સંવેદન વર્તે છે; પરંતુ હજુ પ્રમત્તદશા છે, પ્રમાદજનિત રાગ છે; તેથી આ ત્રણે અવસ્થાઓમાં જ્ઞાત-શ્રદ્ધાન મુખ્ય છે. જ્યારે તે જીવ અપ્રમત્તદશાને પ્રાપ્ત કરીને શ્રેણી ચેડે છે, ત્યારે આ અનુભવ સાક્ષાત્ થાય છે.^૨

ગંથના આરંભમાં જ કહ્યું હતું કે અમારા લુલનમાં એક મોહ જ નાચે છે. કર્મચેતના અને કર્મફળચેતનાનું હોવું તે મોહનું નૃત્ય છે. અને આ બંનેનો અભાવ થઈને જ્ઞાનચેતનાનું હોવું તે જ્ઞાનનું નૃત્ય છે.

કર્મચેતનાના સંન્યાસની ચર્ચામાં મન-વચન-કાય અને કૃત-કારિત અનુમોદનાથી ત્રણે કાળના શુભાશુભભાવોના કર્તૃત્વના ત્યાગની વાત કરી હતી અને હવે અહીં કર્મફળચેતનાના સંન્યાસની ચર્ચામાં કોઈ પણ ભેદભાવ વગર આઠ કર્મોની એકસો અડતાલીસ કર્મ પ્રકૃતિઓના - જેમાં તીર્થકર નામકર્મ જેવી પુણ્યપ્રકૃતિઓ પણ શામેલ છે - ફળના ભોકૃત્વની ભાવનાના ત્યાગની વાત કહેવાઈ રહી છે.

૧ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૮૨

૨ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૮૩

આ કળણના બાદ તત્કાળ જ આચાર્યદેવ તે ૧૪૮ પ્રકૃતિઓના ફળના ભોકૃતૃત્વના સંન્યાસની વાત સ્વયં પૃથ્વે-પૃથ્વકરૂપે કરી રહ્યા છે કે જેથી કંઈ ભ્રમ રહી ન જય.

ધ્યાન રાખવાનું છે, અહીં તીર્થકર નામકર્મના ફળના અભોકૃતૃત્વની ભાવના મિથ્યાત્વના અભોકૃતૃત્વની ભાવનાની સમાન જ કંઈ પણ અંતર પાડ્યા વિના ભાવી રહ્યા છે.

કર્મફળત્યાગની ભાવનાના ૧૪૮ પ્રકાર આ પ્રમાણે છે -

- (૧) હું મતિજ્ઞાનાવરણીય કર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૨) હું શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૩) હું અવધિજ્ઞાનાવરણીય કર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૪) હું મન:પર્યઙ્જાનાવરણીય કર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૫) હું કેવળજ્ઞાનાવરણીય કર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૬) હું ચક્ષુદર્શનાવરણીય કર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૭) હું અચક્ષુદર્શનાવરણીય કર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૮) હું અવધિદર્શનાવરણીય કર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૯) હું કેવળદર્શનાવરણીય કર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.

- (૧૦) હું નિદ્રાદર્શનાવરણીય કર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૧) હું નિદ્રાનિદ્રાદર્શનાવરણીય કર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૨) હું પ્રચલાદર્શનાવરણીય કર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૩) હું પ્રચલાપ્રચલાદર્શનાવરણીય કર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૪) હું સ્તથાનગૃહ્ણદર્શનાવરણીય કર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૫) હું શાતાવેદનીય કર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૬) હું અશાતાવેદનીય કર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૭) હું સમ્યક્ષત્વમોહનીય કર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૮) હું મિથ્યાત્વમોહનીય કર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૯) હું સમ્યક્ષત્વમિથ્યાત્વમોહનીય કર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૨૦) હું અનંતાનુંબંધિકોધકખાયવેદનીયમોહનીય કર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.

- (૨૧) હું અપ્રત્યાખ્યાનાવરણીકોધકખાયવેદનીયમોહનીય કર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૨૨) હું પ્રત્યાખ્યાનાવરણીકોધકખાયવેદનીયમોહનીય કર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૨૩) હું સંજ્વલનકોધકખાયવેદનીયમોહનીય કર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૨૪) હું અનંતાનુંબંધીમાનકખાયવેદનીયમોહનીય કર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૨૫) હું અપ્રત્યાખ્યાનાવરણીમાનકખાયવેદનીયમોહનીય કર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૨૬) હું પ્રત્યાખ્યાનાવરણીમાનકખાયવેદનીયમોહનીય કર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૨૭) હું સંજ્વલનમાનકખાયવેદનીય મોહનીય કર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૨૮) હું અનંતાનુંબંધીમાયાકખાયવેદનીય મોહનીય કર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૨૯) હું અપ્રત્યાખ્યાનાવરણીમાયાકખાયવેદનીય મોહનીય કર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૩૦) હું પ્રત્યાખ્યાનાવરણીમાયાકખાયવેદનીય મોહનીય કર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.

- (૩૧) હું સંજ્વલનમાયકખાયવેદનીય મોહનીય કર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૩૨) હું અનંતાનુભંધીલોકકખાયવેદનીય મોહનીય કર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૩૩) હું અપ્રત્યાપ્યાનાવરણીલોભકખાયવેદનીય મોહનીય કર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૩૪) હું પ્રત્યાપ્યાનાવરણીલોભકખાયવેદનીય મોહનીય કર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૩૫) હું સંજ્વલનલોભકખાયવેદનીય મોહનીય કર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૩૬) હું હાસ્યનોકખાયવેદનીય મોહનીય કર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૩૭) હું રતિનોકખાયવેદનીય મોહનીય કર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૩૮) હું અરતિનોકખાયવેદનીય મોહનીય કર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૩૯) હું શોકનોકખાયવેદનીય મોહનીય કર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૪૦) હું ભયનોકખાયવેદનીય મોહનીય કર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૪૧) હું જુગુપ્સાનોકખાયવેદનીય મોહનીય કર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૪૨) હું સ્ત્રીવેદનોકખાયવેદનીય મોહનીય કર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.

- (૪૩) હું પુરુષવેદનોકખાયવેદનીય મોહનીય કર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૪૪) હું નપુંસકવેદનોકખાયવેદનીય મોહનીય કર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૪૫) હું નરક આયુકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૪૬) હું તિર્યંચ આયુકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૪૭) હું મનુષ્ય આયુકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૪૮) હું દેવ આયુકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૪૯) હું નરકગતિનામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૫૦) હું તિર્યંચગતિ નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૫૧) હું મનુષ્યગતિ નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૫૨) હું દેવગતિ નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૫૩) હું એકન્દ્રિયજલતિ નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૫૪) હું દીલ્લિન્દ્રિયજલતિ નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.

- (५५) हुं ग्रीन्द्रियज्ञति नामकर्मना फृणने भोगवतो नथी; कारण के हुं चैतन्यस्वरूप आत्मानुं ज संचेतन कङ् छुं.
- (५६) हुं चतुरिन्द्रियज्ञति नामकर्मना फृणने भोगवतो नथी; कारण के हुं चैतन्यस्वरूप आत्मानुं ज संचेतन कङ् छुं.
- (५७) हुं पंचेन्द्रिय नामकर्मना फृणने भोगवतो नथी; कारण के हुं चैतन्यस्वरूप आत्मानुं ज संचेतन कङ् छुं.
- (५८) हुं औदारिकशरीर नामकर्मना फृणने भोगवतो नथी; कारण के हुं चैतन्यस्वरूप आत्मानुं ज संचेतन कङ् छुं.
- (५९) हुं वैक्षिकशरीर नामकर्मना फृणने भोगवतो नथी; कारण के हुं चैतन्यस्वरूप आत्मानुं ज संचेतन कङ् छुं.
- (६०) हुं आहारकशरीर नामकर्मना फृणने भोगवतो नथी; कारण के हुं चैतन्यस्वरूप आत्मानुं ज संचेतन कङ् छुं.
- (६१) हुं तेजशरीर नामकर्मना फृणने भोगवतो नथी; कारण के हुं चैतन्यस्वरूप आत्मानुं ज संचेतन कङ् छुं.
- (६२) हुं कार्मणशरीर नामकर्मना फृणने भोगवतो नथी; कारण के हुं चैतन्यस्वरूप आत्मानुं ज संचेतन कङ् छुं.
- (६३) हुं औदारिकशरीर अंगोपांग नामकर्मना फृणने भोगवतो नथी; कारण के हुं चैतन्यस्वरूप आत्मानुं ज संचेतन कङ् छुं.
- (६४) हुं वैक्षिकशरीर अंगोपांग नामकर्मना फृणने भोगवतो नथी; कारण के हुं चैतन्यस्वरूप आत्मानुं ज संचेतन कङ् छुं.
- (६५) हुं आहारकशरीर अंगोपांग नामकर्मना फृणने भोगवतो नथी; कारण के हुं चैतन्यस्वरूप आत्मानुं ज संचेतन कङ् छुं.
- (६६) हुं औदारिकशरीरबंधन नामकर्मना फृणने भोगवतो नथी; कारण के हुं चैतन्यस्वरूप आत्मानुं ज संचेतन कङ् छुं.

- (૬૭) હું વૈક્ષિકશરીરબંધન નામકર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૬૮) હું આહારકશરીરબંધન નામકર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૬૯) હું તેજસશરીરબંધન નામકર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૭૦) હું કાર્મણશરીરબંધન નામકર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૭૧) હું ઔદારિકશરીરબંધન નામકર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૭૨) હું વૈક્ષિકશરીરસંધાત નામકર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૭૩) હું આહારકશરીરસંધાત નામકર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૭૪) હું તેજસશરીરસંધાત નામકર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૭૫) હું કાર્મણશરીરસંધાત નામકર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૭૬) હું સમચતુરસત્રસંસ્થાન નામકર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૭૭) હું ન્યાગ્રોધપરિમંડલસંસ્થાન નામકર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૭૮) હું શાતિકસંસ્થાન નામકર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.

- (૭૯) હું કુળજકસંસ્થાન નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૮૦) હું વામનસંસ્થાન નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૮૧) હું હુંડકસંસ્થાન નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૮૨) હું વજાખિભનારાચસંહનન નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૮૩) હું વજાનારાચસંહનન નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૮૪) હું નારાચસંહનન નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૮૫) હું અર્ધનારાચસંહનન નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૮૬) હું કીલિકસંહનન નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૮૭) હું અસંગ્રાપ્તાસૃપાટિકસંહનન નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૮૮) હું સ્નિગ્ધસ્પર્શ નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૮૯) હું રક્ષસ્પર્શ નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૯૦) હું શીતસ્પર્શ નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.

- (૮૧) હું ઉધણસ્પર્શ નામકર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૮૨) હું ગુરુસ્પર્શ નામકર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૮૩) હું લધુસ્પર્શ નામકર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૮૪) હું મૃદુસ્પર્શ નામકર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૮૫) હું કર્કશસ્પર્શ નામકર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૮૬) હું મધુરસ નામકર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૮૭) હું અમલરસ નામકર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૮૮) હું તિકટરસ નામકર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૮૯) હું કટુકરસ નામકર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૦૦) હું કખાયરસ નામકર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૦૧) હું સુરભિગંધ નામકર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૦૨) હું અસુરભિગંધ નામકર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.

- (૧૦૩) હું શુક્લવર્ણી નામકર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૦૪) હું રક્તવર્ણી નામકર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૦૫) હું પીતવર્ણી નામકર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૦૬) હું હરિતવર્ણી નામકર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૦૭) હું કૃષ્ણવર્ણી નામકર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૦૮) હું નરકગત્યાનુપૂર્વી નામકર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૦૯) હું તિર્યંગત્યાનુપૂર્વી નામકર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૧૦) હું મનુષ્યગત્યાનુપૂર્વી નામકર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૧૧) હું દેવગત્યાનુપૂર્વી નામકર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૧૨) હું નિર્માણ નામકર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૧૩) હું અગુરુલઘુ નામકર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૧૪) હું ઉપધાત નામકર્મના ફળને ભોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.

- (૧૧૫) હું પરધાત નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૧૬) હું આત્પ નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૧૭) હું ઉદ્ઘોત નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૧૮) હું ઉચ્છવાસ નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૧૯) હું પ્રશસ્તાવિહાયોગતિ નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૨૦) હું અપ્રશસ્તાવિહાયોગતિ નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૨૧) હું સાધારણ શરીર નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૨૨) હું પ્રત્યેકશરીર નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૨૩) હું સ્થાપર નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૨૪) હું ત્રસ નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૨૫) હું સુભગ નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૨૬) હું દુર્ભગ નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.

- (૧૨૭) હું સુસ્વર નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૨૮) હું દુઃસ્વર નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૨૯) હું શુભ નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૩૦) હું અશુભ નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૩૧) હું સૂક્ષ્મશરીર નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૩૨) હું બાદરશરીર નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૩૩) હું પર્યાપ્ત નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૩૪) હું અપર્યાપ્ત નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૩૫) હું સ્થિર નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૩૬) હું અસ્થિર નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૩૭) હું આદેય નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૩૮) હું અનાદેય નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.

- (૧૩૯) હું યશ:કીર્તિ નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૪૦) હું અયશ:કીર્તિ નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૪૧) હું તીર્થકર નામકર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.
- (૧૪૨) હું ઉચ્ચગોત્ર કર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.
- (૧૪૩) હું નીચગોત્ર કર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.
- (૧૪૪) હું દાનાંતરાય કર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.
- (૧૪૫) હું લાભાંતરાય કર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.
- (૧૪૬) હું બોગાંતરાય કર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.
- (૧૪૭) હું ઉપબોગાંતરાય કર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.
- (૧૪૮) હું વીર્યાંતરાય કર્મના ફળને બોગવતો નથી; કારણ કે હું ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.

ઉક્ત ૧૪૮ બોલ પર ધ્યાન આપતાં એક વાત સ્પષ્ટરૂપે ઘ્યાલમાં આવે છે કે પ્રત્યેક બોલના ઉત્તરાર્ધમાં એમ કહેવામાં આવ્યું છે કે હું ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું તથા પૂર્વાર્દ્ધમાં ક્રમશ: ૧૪૮ કર્મપ્રકૃતિઓના નામ આપીને એમ કહેવામાં આવ્યું છે કે હું તેમના ફળને બોગવતો નથી.

માત્ર કર્મપ્રકૃતિના નામ પરિવર્તનની સાથે એક જ વાતને ૧૪૮ વખત દોહરાવવામાં આવી છે. તેનો એક માત્ર હેતુ કર્મફળચેતનાનો ત્યાગ અને શાનચેતનાની ભાવનાને વારંવાર નચાવવાનો છે; કારણ કે સાક્ષાતું મુક્તિનો માર્ગ આ પ્રકારની ભાવનાની પ્રબળતા જ છે.

ઉક્ત ૧૪૮ બોલ પર ટીકા કરતાં પૂજ્ય ગુરુદેવ કહે છે કે - “અહીં શાની કહે છે કે મતિજ્ઞાનાવરણીય કર્મના ફળમાં જે મારી શાનની હીનદશા છે, તેના પર માંડું લક્ષ્ય નથી. માંડું લક્ષ્ય તો વિકાળ શાનાનંદસ્વભાવી ભગવાન આત્મા પર છે. તેથી હું મતિજ્ઞાનાવરણીય કર્મના ફળને ભોગવતો નથી તેનાથી બિન્દુ પોતાના શાન અર્થાત્ શાયકસ્વભાવનું જ સંચેતન કરું છું. તેનો જ એકાગ્રપણે અનુભવ કરું છું, વેદન કરું છું.”^૧

વાત સુફખ છે બાપુ ! મતિજ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ સત્તામાં પડી છે, તેનો ઉદ્દ્ય પણ છે તથા તેના નિભિત્થી શાનની હીનદશા પણ છે; પરંતુ તે હીનદશા કર્મનું ફળ છે, તેને હું કેમ ભોગવું ? હું તો તેનાથી બિન્દુ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન છું, હું તો પોતાના તે ભગવાન આત્માનું જ સંચેતન કરું છું.

શરીર, વાણી, સ્ત્રી, મહેલ-મકાન અને પ્રતિષ્ઠા આદિ બધા સંયોગ તો બાહ્ય વસ્તુઓ છે. તેને આત્મા ભોગવે છે યા ભોગવી શકે છે - એ તો વાત જ અસંભવ છે. અહીં તો શાની કહે છે કે શાનની વર્તમાન હીનદશા પણ કર્મનું જ ફળ છે, તેને હું ભોગવતો નથી.

વર્તમાનમાં તો કરણાનુયોગને બહાને અધિકાંશ એમ જ માનવામાં તેમ જ કહેવામાં આવે છે કે કર્મને કારણે વિકાર થાય છે; પરંતુ તે વાત બરોબર નથી. કર્મ તો નિભિત્થમાત્ર છે. વિકારરૂપ કાર્ય તો ઉપાદાનમાં ઉપાદાનની તત્ત્વમયની યોગ્યતાથી થાય છે. વિકારનું ઉપાદાન જરૂર નથી, પરંતુ જીવ છે. વિકાર થવામાં હીનદશાનું પરિણમન મારામાં મારાથી થાય છે. આમ શાની જણે છે, માને છે.

અહીં જાની કહે છે કે તે હીનદશા માઝે સ્વરૂપ નથી, હું નથી, હું તેને બોગવતો નથી. હવે માઝે લક્ષ્ય સ્વભાવમાં જોડાઈ ગયું છે, સ્વભાવસન્મુખ થયું છે. રાગ અર્ણે હીનદશાના પક્ષને છોડીને હવે મને સ્વભાવનો પક્ષ થઈ ગયો છે. ભાઈ ! જન્મ-મરણથી ધૂટવાની એકમાત્ર આ જ વિધિ છે, આ જ માર્ગ છે. ચૈતન્યસ્વરૂપ નિજ આત્મતત્ત્વની, શાયકતત્ત્વની દાચિ કરવી જ એકમાત્ર ધર્મનો માર્ગ છે. પર્યાયની તેમાં વાત જ નથી. ચૈતન્યસ્વરૂપ આત્માનો અનુભવ પણ પર્યાય છે; પરંતુ તેને પર્યાયનો આશ્રય નથી, તે પર્યાયને તો વિકાળીદ્રવ્યનો જ આશ્રય છે.¹

પ્રશ્નઃ- જ્યારે મન:પર્યાયજ્ઞાન છે જ નહીં તો તેને બોગવવાની કે ન બોગવવાની વાત જ આવતી નથી ? છતાં પણ ‘હું તેને નથી બોગવતો’ - એવું કેમ કહેવામાં આવ્યું છે ?

ઉત્તરઃ- અહીં તો એમ કહેવાઈ રહ્યું છે કે જાનીને કોઈ પણ કર્મફળનું સ્વામિત્વ નથી. જાનીનું પર્યાય તરફ જેર જ નથી, એક નિજનંદસ્વરૂપ પ્રભુ આત્માનું જ જેર છે. એ બતાવવા માટે એક-એક કર્મપ્રકૃતિનો નામ સાથે નિષેખ કરવામાં આવ્યો છે.

જુઓ, કર્મની ૧૪૮ પ્રકૃતિઓ છે. બધા જીવોને ૧૪૮ કર્મપ્રકૃતિઓની સત્તા તથા ઉદ્ય આદિ સદા હોતા નથી; પરંતુ સામાન્ય વર્ણન કરવામાં બધા ભેદ-પ્રભેદોની વાત કહેવામાં આવે છે. ક્ષાણિક સમકિતીને મિથ્યાત્વ સંબંધી ત્રણ પ્રકૃતિઓની સત્તા હોતી નથી. પરંતુ અન્ય સમ્યગદાચિઓને ત્રણે પ્રકૃતિઓ સત્તામાં હોવા છતાં પણ જાનીનું તે તરફ લક્ષ્ય હોતું નથી; તેથી તેઓ કહે છે કે હું તેમને બોગવતો નથી.

એક તીર્થકર નામકર્મની પ્રકૃતિ પણ બધાને હોતી નથી. મિથ્યાદાચિની તો અહીં વાત જ નથી. અહીં તો ક્ષાણિક રાગાદિભાવથી બિજી થઈને વિકાળી ચૈતન્યસ્વભાવનો આશ્રય લેવાની વાત છે. અહીં જાની કહે છે કે પ્રકૃતિના ઉદ્યના ફળને હું બોગવતો નથી તીર્થકર પ્રકૃતિનો ઉદ્યતો ૧૩મા

ગુણસ્થાનમાં આવે છે; પરંતુ જે તે પ્રકૃતિ જ્ઞાતીની સત્તામાં પડી હોય તો પણ તેના ફળની તરફ જ્ઞાનીનું લક્ષ્ય રહેતું નથી. ‘હું ભવિષ્યમાં તીર્થકર થવાનો છું’ – એવું પણ જ્ઞાનીનું લક્ષ્ય રહેતું નથી. તે તો તીર્થકરપ્રકૃતિના ફળને પણ વિષવૃક્ષનું ફળ જાણે છે.

સમ્યગદાચિ પુરુષ કહે છે કે ‘હું જ્ઞાનાવરણીય આદિ કર્મોના ફળને ભોગવતો નથી. હું તો નિર્વિકાર, પુર્ણ, પર્યાયની પામરતાથી પૃથ્વી ત્રણલોકનો નાથ જ્ઞાનાનંદસ્વરૂપી ભગવાન આત્મા છું. હું પોતાના આવા નિજજ્ઞાયક સ્વરૂપી આત્માનું જ સંચેતન કરું છું, અનુભવ કરું છું. વર્તમાન જ્ઞાનની અધૂરી દર્શા પર મારું લક્ષ્ય નથી. હું પુર્ણ વસ્તુનો અનુભવ કરું છું.’

જ્ઞાની આ પ્રમાણે દર્શાવવરણીયકર્મની પ્રકૃતિઓ સંબંધી વિચાર કરે છે કે હું ચક્ષુદર્શનાવરણીય, અચક્ષુદર્શનાવરણીય અવધિદર્શનાવરણીય, અને કેવળદર્શનાવરણીય આદિ કર્મોના ફળને ભોગવતો નથી. હું તો ચૈતન્યસ્વરૂપ આત્માનો જ અનુભવ કરું છું. જે પ્રકૃતિઓ ઉદ્ઘયમાં છે અને સત્તામાં પડી છે, તેના નિમિત્તથી હીનદર્શા પણ છે; પરંતુ જ્ઞાનીનું તેના વેદન તરફ લક્ષ્ય નથી, ત્યાં ઝુકાવ નથી; તે પૂર્ણાનંદના નાથ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માનું જ વેદન કરે છે, અનુભવ કરે છે.^૧

આ પ્રમાણે વેદનીય કર્મની જે બે પ્રકૃતિઓ છે, તેમાં શાતાવેદનીયકર્મના નિમિત્તથી બાબ્ય સામગ્રી ધન, કુટુંબ, પરિવાર, શરીરની નીરોગતા આદિની પ્રાપ્તિ થાય છે તથા અશાતાના ઉદ્ઘયમાં પ્રતિકુળ સંયોગો મળે છે, તેના પ્રતિ પણ જ્ઞાનીનું લક્ષ્ય નથી. તે વિચારે છે કે શાતાના ઉદ્ઘયમાં જે ફળ પ્રાપ્ત થાય છે, તે મારું સ્વરૂપ નથી, હું તેને ભોગવતો નથી. હું તો નિજ ચૈતન્યમૂર્તિ ચિદ્ગુપ પ્રભુ આત્માને જ ચેતું છું. તેવી જ રીતે અશાતાના ઉદ્ઘયમાં જે રોગ આદિ પ્રતિકુળતાઓ પ્રાપ્ત થાય છે, જ્ઞાની તેમને પણ ભોગવતો નથી.^૨

^૧ પ્રવચનરત્નાકાર ભાગ ૧૦, પાનું ૧૦૫-૧૦૬

^૨ તે જ, પાનું ૧૦૬

હવે મોહનીયકર્મની ૨૮ પ્રકૃતિઓના સંબંધમાં જ્ઞાની કહે છે કે હું ભિથ્યાત્વ, સમ્યક્ભિથ્યાત્વ (ભિશ) અને સમ્યક્પ્રકૃતિ ભિથ્યાત્વ કર્મના ફળને બોગવતો નથી.^૧

હું અનંતાનુભંધી કોધ કષાય વેદનીય મોહનીયકર્મના ફળને બોગવતો નથી, ચૈતન્યસ્વરૂપ આત્માનું જ સંચેતન કરું છું.^૨

‘હું અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજનવલન સંબંધી કોધકષાય વેદનીય મોહનીયકર્મના ફળને બોગવતો નથી; હું તો ચૈતન્યસ્વરૂપ આત્માને જ બોગવું છું.’^૩

આ પ્રમાણે જેવી રીતે કોધકષાયની ચોકડીની વાત કરી; તે જ પ્રમાણે માન, માયા અને લોબ કષાયની ચોકડીના ફળના ત્યાગની ભાવના પણ જ્ઞાની ભાવે છે, તેઓ કહે છે કે હું આ કર્માને બોગવતો નથી. હું તો ચૈતન્યસ્વરૂપ આત્માનો જ અનુભવ કરું છું.

નોકષાય મોહનીયકર્મની પ્રકૃતિના જે હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા અને સ્ત્રી-પુરુષ અને નપુંસક વેદના બેદ કહ્યા, જ્ઞાની તેના ફળને પણ બોગવતો નથી.^૪

હું નરક આયુ તિર્યંચ આયુ, મનુષ્ય આયુ અને દેવ આયુ કર્મના ફળને બોગવતો નથી. હું તો ચૈતન્યસ્વરૂપ આત્માનો જ અનુભવ કરું છું.^૫

આ પ્રમાણે જ્ઞાની સકળ કર્માના ફળના સંન્યાસની ભાવના કરે છે.

અહીં ભાવનાનો અર્થ છે વારંવાર ચિંતન કરીને ઉપયોગનો અભ્યાસ કરવો.^૬

૧ તે જ, પાનું ૧૦૭

૨ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૧૦૮

૩ તે જ, પાનું ૧૦૮

૪ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૧૦૮-૧૦૯

૫ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૧૦૯

૬ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૧૧૦

પંચાસ્તિકાયની ઉદ્ભી ગાથામાં એમ કહ્યું છે કે 'જ્ઞાનચેતના તો કેવળીને જ હોય છે' તે તો પૂર્ણતાની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે. જ્ઞાનચેતનાઙ્ગ્રાપ અનુભવની શરૂઆત તો ચોથા ગુણસ્થાનથી જ થઈ જય છે. રાગથી હૃદીને જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મામાં એકાગ્ર થવું જ્ઞાનચેતના છે અને તે ચોથા ગુણસ્થાનથી પ્રારંભ થાય છે. સમ્બ્રગદાઢિને જ્ઞાનચેતના હોય છે; પરંતુ ત્યાં પૂર્ણ હોતી નથી. સાથે કર્મચેતના અને કર્મક્ષળચેતના પણ હોય છે.

સાક્ષાત્ જ્ઞાનચેતનાઙ્ગ્રાપ પરિણામન થયા બાદ આત્મા અનંતકાળ સુધી જ્ઞાનચેતનાઙ્ગ્રાપ રહેતો થકો પરમાનંદમાં ભગ્ન રહે છે.¹

આપ્રમાણે અહીં પ્રત્યેક કર્મનું નામ લઈને સ્વરૂપ સ્પર્શ કરતાં થકાતેના ફળના ત્યાગની ભાવના ભાવી છે.

આ પછી કર્મક્ષળચેતનાના ત્યાગની ભાવનાના ઉપસંહારઙ્ગ્રાપે બે કણશ કાવ્ય આપવામાં આવ્યા છે; જે આ પ્રમાણે છે.

(વસન્તતિલકા)

નિ:શોષકર્મફલસંન્યસનાન્મમૈવं

સર્વક્રિયાંતરવિહારનિવૃત્તવૃત્તેः ।

ચૈતન્ય લક્ષ્મભજતો ભૃશમાત્મતત્ત્વં

કાલાવલીયમચલસ્ય વહત્વનંતા ॥૨૩૧॥

ય: પૂર્વભાવકૃતકર્મવિષદ્ધુમાણાં

ભુંકે ફલાનિ ન ખલુ સ્વતઃ એવ તૃપ્તઃ ।

આપાતકાલરમणીયમુદ્રકરમ્યં

નિષ્કર્મશર્મમયમેતિ દશાંતરં સ: ॥૨૩૨॥

¹ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૧૧૨

(હરિગીત)

પૂર્વોક્ત રીત કર્મો તારું ફળ ત્યાગીને સહ, ભાગવું
 છું આત્મને અતિશયપાળે ચૈતન્યલક્ષ્મણ જેહનું;
 ને અન્ય સર્વ કિયા મહીં ન વિહારમય વૃત્તિ કરે,
 આ રીત આત્મતત્ત્વનો છે અચળ ભોગવટો મને;
 કાળાવલિ વહેજે અનંતી આત્માના ઉપભોગમાં
 ઉપયોગની મારી પ્રવૃત્તિ જાઓ ના કદી અન્યમાં. ૨૩૧

અજ્ઞાનથી પૂર્વે કરેલાં કર્મરૂપ વિષવૃક્ષનાં
 ફળ ભોગવે નહીં જે અને છે તૃપ્ત આત્મસ્વરૂપમાં;
 નિર્જર્મ સુખમય ને અપૂરવ દર્શાંતરને પામતો,
 રમણીય છે જે વર્તમાન ને ભવિષ્યે પાળ અહો !! ૨૩૨

આ પ્રમાણે પૂર્વોક્ત સમસ્ત પ્રકારના કર્મોના ફળનો સંન્યાસ
 (ત્યાગ) કરીને ચૈતન્યલક્ષ્મણ આત્મતત્ત્વને અતિશયતાથી ભોગવું છું અને
 તેનાથી બિજ્ઞ અન્ય સર્વ કિયાઓના વિહારથી મારી વૃત્તિ સંપૂર્ણપણે નિવૃત્ત
 છે. આપ્રમાણે આત્મતત્ત્વના ઉપભોગમાં અચળ-એવા મને આ કાળની
 આવલી કે જે પ્રગટ્યે અનંત છે; તે આત્મતત્ત્વના ઉપયોગમાં જ વહેતી
 રહે. ઉપયોગની પ્રવૃત્તિ અન્ય વિષયોમાં કયારે પણ ન જય.

પહેલા અજ્ઞાનભાવમાં ઉપાર્જિત કર્મરૂપી વિષવૃક્ષોના ફળને જે
 પુરુષ તેમનો સ્વામી થઈને ભોગવતો નથી અને પોતામાં જ તૃપ્ત છે; તે
 પુરુષ વર્તમાન અને ભવિષ્યમાં રમણીય નિર્જર્મ સુખમય દર્શાને પ્રાપ્ત થાય
 છે.

આ કળશોનો ભાવ સ્પષ્ટ કરતાં પંડિત જયચંદ્રજ છાબડા
 ભાવાર્થમાં લખે છે -

“આવી ભાવના કરનારો જ્ઞાની એવો તૃપ્ત થઈ ગયો છે કે જાણે
 ભાવના કરતો થકો સાક્ષાત્ કેવળી જ થઈ ગયો છે; તેથી તે અનંતકાળ
 સુધી તેમ જ રહેવા ઈચ્છે છે અને તે ચોગ્ય જ છે; કારણ કે આવી ભાવનાથી

જ કેવળી થવાય છે. કેવળજ્ઞાન ઉત્પન્ન કરવાનો પરમાર્થ ઉપાય આ જ છે. બાહ્ય વ્યવહારચારિત્ર તેના જ સાધનકુપ છે અને તેના વિના વ્યવહારચારિત્ર શુભકર્મને બાંધે છે, તે મોક્ષનો ઉપાય નથી.

શાનચેતનાની ભાવનાનું ફળ એ છે કે આ ભાવનાથી લુધ અત્યંત ટૃપ્ત રહે છે, અન્ય ટૃષ્ણા રહેતી નથી અને ભવિષ્યમાં કેવળજ્ઞાન ઉત્પન્ન કરીને સમસ્ત કર્મથી રહિત મોક્ષ અવસ્થાને પ્રાપ્ત થાય છે.”

આ કળશોનો ભાવ મૂજ્ય ગુરુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે. “તાંક ચૈતન્યતત્ત્વ અંદર કર્મચેતના અને કર્મફળચેતનાથી બિજ્ઞ છે. વિકારીભાવોમાં એકાગ્ર થઈને ચૈતવાનું નામ કર્મચેતના છે તથા તેમાં હૃષ-શોક થવા તે કર્મફળચેતના છે. બંને જ દુઃખદાયક છે. આ બંન્નેથી બિજ્ઞ થઈ લેદશાન કરીને અંદર ચિન્માત્ર નિજસ્વરૂપના આશ્રયથી જોણે શાનચેતના પ્રગટ કરી છે, તે શાની છે.

આત્મા ત્રિકાળી વસ્તુ છે, તેનો શાનાનંદસ્વભાવ પણ ત્રિકાળ છે. આવા નિજસ્વભાવનું ભાન કરીને અંદરમાં એકાગ્રતા દ્વારા આત્માનુભૂતિ કરવી તે શાનચેતના છે.^૧

આવી શાનચેતના જ ભવનો અંત આણનારી અને પરમાનંદ દેનારી છે, તેને જ ધર્મ કહે છે.^૨

જુઓ, આ અંતરરમણ કરવાની-ચારિત્રની વાત છે. સમ્યગુદ્ધશિન બાદ જેને અંતરંગમાં, સ્વરૂપમાં રમણ કરવાની સ્થિરતા થઈ ગઈ છે, તે એવો પૂર્ણ ટૃપ્ત થઈ જય છે કે જોણે સાક્ષાત્ કેવળી જ થઈ ગયો છે. હવે તેને સ્વરૂપમાંથી બહાર નીકળવું પોષાતું જ નથી, સ્વરૂપમાંથી બહાર આવવાનું બિલ્કુલ ગમતું નથી. તે અનંતકાળ સુધી સ્વરૂપમાં જ રહેવા ઈચ્છે છે.

^૧ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૧૧૪

^૨ તે જ, પાનું ૧૧૪

પંડિત જયચંદ્ર છાબડા કહે છે કે આ વાત યોગ્ય ન છે; કારણ કે આવી ભાવનાથી જ કેવળી થવાય છે. વ્રત-તપ આદિ કિયાકાંડના વિકલ્પથી કેવળજ્ઞાન પ્રગટ થતું નથી. સ્વ-સ્વરૂપનો અનુભવ, પછી તેનો જ અભ્યાસ અને પછી સ્વરૂપરમણતાની જ જમાવાટ સ્થિરતા. બસ, આ જ એક કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાનો ઉપાય છે.^૧

મોક્ષનું યથાર્થ સાધન તો સ્વરૂપરમણતા જ છે; પરંતુ રાગાંશને તેનું સહયોગ અથવા નિમિત્ત જાણીને તેને પણ વ્યવહારનું સાધન કહેવામાં આવ્યું છે. વાસ્તવિક સાધન વગર વ્યવહારચારિત્ર કંઈ જ નથી. તે એકલા બાધ્યસાધન કેવળ શુભકર્મને જ બાંધે છે.^૨

ભગવાન આત્મા તો અમૃતનું વૃક્ષ છે અને કર્મોનું ફળ વિષવૃક્ષનું ફળ છે. બંને બિત્ત-બિત્ત વસ્તુઓ છે. અમૃતસ્વરૂપ આત્માનું અવલંબન લઈને પરિણતિમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રક અમૃતના ફળ પાકે છે; પરંતુ અજ્ઞાનદર્શામાં જે કર્મો બાંધવામાં આવ્યા હતા, તેના ફળમાં વિષવૃક્ષના ફળ જ પ્રાપ્ત થાય છે. તે કર્મોના ફળકૃપે ભલે શાતાનો ઉદ્ઘય આવે કે અશાતાનો ઉદ્ઘય આવે - તે બધા વિષવૃક્ષના જ ફળ છે.

અહીં કહે છે કે ચારિત્રવાન ધર્મી પુરુષ પોતાના સ્વરૂપથી જ તૃપ્ત છે, તેની પર્યાયમાં અતીન્દ્રિય આનંદનો મહાસાગર ઉછણે છે. જે કંઈ રાગ રહ્યો છે, તેને તે માત્ર જણે છે અર્થાત્ તેનો જ્ઞાતા-દ્વારા બનીને રહે છે. અહા ! પોતાના નિર્મણ જ્ઞાનાનંદસ્વરૂપનો અનુભવી જ્ઞાની પૂર્વકર્મોના ફળમાં જોડાતો નથી. સ્થિરતાને પ્રાપ્ત થઈ સ્વરૂપાચરણમાં રમનારા મુનિવરોને વર્તમાનમાં રમણીય સુખનો અનુભવ વર્તે છે અને ભવિષ્યમાં તેના ફળમાં રમણીય, નિર્જર્મ પૂર્ણ સુખમયદરા રહે છે. આવા સુખમય ચારિત્રને અજ્ઞાનીજન કષ્ટદાયક માને છે. ન કેવળ માને છે, એમ કહેતાં પણ સાંભળવામાં આવે છે કે ચારિત્રનું ધારણ કરવું તો લોઢાના ચણા

^૧ પ્રવચનરલ્લાકર ભાગ ૧૦, પાનું ૧૧૭

^૨ તે જ, પાનું ૧૧૭

ચાવવા જેવું કષ્ટપ્રદ અને કઠળા કામ છે. અરે ભાઈ ! આ લોકોને ચારિત્રના વાસ્તવિક સ્વરૂપની ખબર નથી.^૧

જુઓ, રાગમાં એકાગ્ર થવું તે કર્મચેતના છે અને હર્ષ-શોકમાં એકાગ્ર થવું તે કર્મફળચેતના છે. આ બંનેથી લિઙ્ગ પોતાના જ્ઞાનાનંદસ્વભાવી ચિન્માત્રવસ્તુ ભગવાન આત્મામાં એકાગ્ર થવું તે જ્ઞાનચેતના છે. તે જ્ઞાનચેતનાનું ફળ એ છે કે તેની ભાવનાથી જીવ અત્યંત તૃપ્ત રહે છે. તેના જીવનમાં અન્ય કોઈ તૃષ્ણા રહેતી નથી.^૨

પરમાં કંઈક કરવાની વૃત્તિ કર્મચેતના છે અને અનુકૂળ-પ્રતિકૂળ સંયોગોમાં અનુકૂળતા-પ્રતિકૂળતાનું વેદન જ કર્મફળચેતના છે. આ બંને જ અજ્ઞાનચેતના છે અને પોતાના આત્મામાં પોતાપણું, તેને જ પોતાનો જાણવો અને તેમાં જ મગન રહેવું તે જ્ઞાનચેતના છે. કર્મચેતના અને કર્મફળચેતના હેય છે અને જ્ઞાનચેતના ઉપાદેય છે; તેથી ધર્મ છે, મુક્તિનો માર્ગ છે, મુક્તિસ્વરૂપ છે.

તેથી અહીં કર્મચેતના અને કર્મફળચેતનાના ત્યાગની ભાવના ભાવીને અજ્ઞાનચેતનાને જડમૂળથી ઉખેડીને જ્ઞાનચેતનામાં મગન રહેવાની ચર્ચા કરવા ઉપરાંત આ સંપૂર્ણ પ્રકરણના ઉપસંહાર કરતા આત્મભ્યાતિમાં એક કળશ લખવામાં આવ્યો છે. ધ્યાન રખવું કે, આગલા બે કળશ કર્મફળચેતનાના ઉપસંહારરૂપ હતા અને પ્રસ્તુત કળશ સંપૂર્ણ પ્રકરણના ઉપસંહારનો કળશ છે.

(સ્રાવધરા)

અત્યંતं ભાવયિત્વા વિરતિમવિરતં કર્મણસ્તત્કલાચ્ચ

પ્રસ્પર્ષં નાટયિત્વા પ્રલયનમખિલાજ્ઞાનસંચેતનાયા: ।

પૂર્ણ કૃત્વા સ્વભાવં સ્વરસપરિગતં જ્ઞાનસંચેતનાં સ્વાં

સાનંદં નાટયન્ત: પ્રશમરસમિત: સર્વકાલં પિબન્તુ ॥૨૩૩॥

^૧ પ્રથમનરત્નાકર ભાગ ૧૦, પાનું ૧૧૭

^૨ તે જ, પાનું ૧૧૭

(હરિગીત)

પૂર્વકિત રીતે કર્મથી ને કર્મફળથી પાણ અહો !
 વિરતિ અનિશ્ચય ભાવીને અવિરતપાણે શાનીજનો;
 અશાનદૃષ્ટિ ચેતનાનો પ્રલય પ્રગટ નચાવીને,
 પૂરણ કરીને સર્વ રીતે રસથી પ્રાપ્ત સ્વભાવને;
 પ્રગટાવીને આનંદપૂર્વક ચેતના નિજ શાનની,
 પીઓ પ્રશ્નમરસને સદાય શાનીજન હે આજથી. ૨૩૩

કર્મ અને કર્મફળથી અત્યંત વિરક્તિભાવને ભાવીને, સમસ્ત અશાનચેતનાના નાશને સ્પષ્ટતાથી નચાવીને અને નિજરસને પ્રાપ્ત પોતાના સ્વભાવને પૂર્ણ કરીને પોતાની શાનચેતનાને આનંદપૂર્વક નચાવતાં હવે હંમેશા પ્રશ્નમરસને પીઓ.

આ કળશમાં તો માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે કર્મચેતના અને કર્મફળચેતનાદ્વારા અશાનચેતનાનો અભાવ કરીને આત્માના અનુભવદ્વારા શાનચેતનાની ભાવના સદા ભાવવી - આ માર્ગ છે. એ જ વાસ્તવિક ધર્મ છે, શેષ બધા કિયાંડાનો ધર્મ સાથે કોઈ નાતો નથી. ધર્મના નામે તેમાં સમય અને શક્તિ ગુમાવવી તે અમૂલ્ય નરભવની હાર છે. તેથી અધિક તો બીજું શું કહી શકાય ?

કવિવર બનારસીદાસજીએ પણ નાટક સમયસારમાં ઉક્ત પ્રકરણનો આધાર લઈને અનેક છંદ લખ્યા છે; જે મૂળથી અભ્યાસ કરવા યોગ્ય છે. અહીં તે બધાને તો અહીં આપવાનું સંભવ નથી; છતાં અમુક મહત્વપૂર્ણ છંદ નમૂના તરીક અહીં અપાઈ રહ્યા છે જે ઉક્ત પ્રકરણ પર પ્રકાશ પાથરે છે.

(દોહા)

ગ્યાનવંત અપની કથા, કહૈ આપ સૌં આપ ।
 મૈં મિથ્યાત દસાવિષે, કીને બહુવિધિ પાપ ॥
 મૈં કીનીં મૈં યીં કરીં, અબ યહ મેરી કામ ।
 મન વચ કાયા મૈં બસૈ, એ મિથ્યા પરિનામ ॥

મન-વચન-કાયા કરમફળ, કરમ-દસા જડ અંગ ।
 દરબિત પુગલ પિંડમય, ભાવિત ભરમ તરંગ ॥
 તાતેં આત્મ ધરમ સૌં, કરમ સુભાડ અપૂર્ઠ ।
 કૌન કરાવૈ કૌ કરૈ, કોસલ હૈ સબ ઝૂઠ ॥
 કરની હિત હરની સદા, મુકતિ વિતરની નાંહિ ।
 ગની બંધ-પદ્ધતિ વિષૈ, સની મહાદુખમાંહિ ॥

પ્રતિક્ષમણ, આલોચના અને પ્રત્યાઘ્યાનની ડિયામાં જ્ઞાની લુધ
 પોતાની વાર્તા પોતે જ કહે છે. તેઓ કહે છે કે અમે ભૂતકાળમાં મિથ્યાત્વ
 અવસ્થામાં ધણા પ્રકારનાં પાપ કર્યા છે.

‘મેં આમ કર્યું, હું આમ કર્યું છું અને હવે હું આમ કરીશ અર્થાત્
 હવે આ માંન કાર્ય છે, કર્તવ્ય છે’ - આ પ્રકારના મિથ્યા પરિણામ મારા
 મન-વચન-કાયામાં વસી રહ્યા છે.

આ મન-વચન-કાયા કર્મોદ્દયથી પ્રાપ્ત થયા છે; તેથી તે કર્મોનું
 ફળ જ છે અને કર્મની અવસ્થા તો જડૃપ જ છે. દ્રવ્યકર્મ પુદ્ધગલનો
 જ પિંડ છે અને ભાવકર્મ આત્મામાં ઉત્પન્ન થતી ભ્રમદૃપ તરંગો છે.

તેથી આત્મધર્મથી કર્મનો સ્વભાવ વિપરીત જ છે. તેથી આ કર્મોને
 કોણ કરે અને કોણ કરાવે ? અર્થાત્ તેમનો કર્તા કરાવનાર આત્મા નથી.
 તેમનો કર્તા પોતાને માનવો તે ખોટી ચતુરાઈ છે.

અધિક શું કહીએ - પરમાં કંઈ પણ કરવાના પરિણામ અહિત
 કરનારા જ છે, મુક્તિ દેનારા નથી; તે તો મહાદુઃખથી એકમેક થયેતી ભરેતી
 બંધપદ્ધતિ જ માનવામાં આવે છે.

(ચૌપાઈ)

મૈં ત્રિકાલ કરની સૌં ન્યારા । ચિદવિલાસ પદ જગ ઉજયારા ॥
 રાગ વિરોધ મોહ મમ નાંહિ । મેરો અવલંબન મુજ્જ માંહિ ॥

હું તો સદાય કર્તૃત્વબુદ્ધિથી બિજ્ઞ છું, ચૈતન્યમાં વિલાસ કરનાર છું, સંપૂર્ણ જગતનો પ્રકાશક છું, શાયક છું, મોહ-રાગ-દ્રેષ મારામાં નથી; તેથી મારો આશ્રય તો મારામાં જ વિધમાન છે. અર્થાત્ મારો આશ્રય તો હું પોતે જ છું.

(દોહા)

કહે વિચચ્છન મેં રહ્ણૌ, સદા ગ્યાન રસ રાચિ ।

સુદ્ધાતમ અનુભૂતિ સૌં, ખલિત ન હોહું કદાચિ ॥

પુઠ્વકરમ વિષતરુ ભએ, ઉદૈ ભોગ ફલફૂલ ।

મેં ઇનકો નહિ ભોગતા, સહજ હોહુ નિરમૂલ ॥

જો પૂરવકૃત કરમ-ફલ, રુચિ સૌં ભુંજે નાંહિ ।

મગન રહૈ આઠોં પહર, સુદ્ધાતમ પદ માંહિ ॥

સો બુધ કરમદસા રહિત, પાવૈ મોખ તુરંત ।

ભુંજે પરમ સમાધિ સુખ, આગમ કાલ અનંત ॥

વિચક્ષણ પુર્ણ કહે છે કે હું તો સદાય પોતાના શાનરસમાં જ રચી-પચી રહ્યો છું; પોતાના શુદ્ધાત્માની અનુભૂતિથી કૃપારેય સ્ફુરિત થતો નથી.

પૂર્વકૃતકર્મ વિષવૃક્ષ છે; પૂર્વકૃત કર્મોના ઉદ્ઘયને ભોગવવા તે જ તેમના ફળ-કૂલ છે. હું તેમનો ભોક્તા નથી; તેથી તે સહજ નિર્મૂળ થઈ જશે.

જે વ્યક્તિ પૂર્વકૃત કર્મોના ફળને ઝચિપૂર્વક ભોગવતા નથી અને આઠે પહર અર્થાત્ દિવસ-રાત શુદ્ધાત્મામાં જ મગન રહે છે; તે લોકો અતિશીધ કર્મરહિત મુક્તિદશાને પ્રાપ્ત કરે છે અને આગામી અનંત કાળ સુધી પરમસમાધિગત સુખને ભોગવે છે.

(છપ્પય)

જો પૂરવકૃતકરમ, વિરખ-વિષ-ફલ નહિં ભુંજે ।

જોગ જુગતિ કારિજ કરંતિ, મમતા ન પ્રયુંજે ॥

રાગ વિરોધ નિરોધિ, સંગ વિકલપ સબ છંડઙ્ગ ।

સુદ્ધાતમ અનુભો અભ્યાસિ, સિવ નાટક મંડઙ્ગ ॥

જો ગ્યાનવંત ઇહિ મગ ચલત, પૂરન હૈ કેવળ લહૈ ।

સો પરમ અતીન્દ્રિય સુખ વિર્ણ, મગનરૂપ સંતત રહૈ ॥

જે પૂર્વકૃત કર્મદ્વારા વિષવૃક્ષોના ફળને ભોગવતો નથી અને મન-વચન-કાયારૂપ યોગોની ડિયામાં મમતા રાખતો નથી; રાગ-દ્રેષ્ણને રેકીને, પરિગ્રહ અને વિકલ્પોને છોડીને શુદ્ધાત્માનો અનુભવ કરે છે; તે જ્ઞાનીજન આ માર્ગ પર ચાતતાં પૂર્ણતાને પ્રાપ્ત કરીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરે છે અને સદાય પરમ અતીન્દ્રિય આનંદમાં ભર્ણ રહે છે.

કવિવર બનારસીદાસજીએ ઉક્ત છંદોમાં આ જ વાત કહી છે કે જ્ઞાનીજન પ્રતિક્રિયા, આલોચના અને પ્રત્યાખ્યાનના માધ્યમથી કર્મચેતના અને કર્મફળચેતનાના ત્યાગની ભાવના ભાવતાં જ્ઞાનચેતનારૂપ પરિણામિત થઈ અનંતસુખને પ્રાપ્ત કરે છે અને પછી તેને જ અનંત કાળ સુધી ભોગવે છે.

વાસ્તવિક ધર્મ પણ આ જ છે, આ જ એક કરવા યોગ્ય માત્ર કાર્ય છે; તેના સિવાય ધર્મને નામે જે કંઈ થઈ રહ્યું છે તે ધર્મ નથી, કર્મ જ છે, કર્મબંધનું જ કારણ છે, કર્મચેતના જ છે, કર્મફળચેતના જ છે, અજ્ઞાનચેતના છે જ્ઞાનચેતના કયારેય નથી.

એકમાત્ર જ્ઞાનચેતના જ ધર્મ છે, ધર્મનો માર્ગ છે, મુક્તિનો માર્ગ છે, સાક્ષાત મુક્તિ જ છે.

આ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર છે. તેમાં અત્યાર સુધી એ જ બતાવવામાં આવી રહ્યું છે કે સર્વવિશુદ્ધજ્ઞાન પરનો કર્તા-ભોક્તા નથી.

હવે આગામી ગાથાઓમાં એમ બતાવશે કે નિશ્ચયથી સર્વવિશુદ્ધજ્ઞાન પરજ્ઞેયોને જાણવા છતાં પણ પરજ્ઞેયોથી સર્વથા બિન્ન છે.

ઉક્ત વિષયને સ્પષ્ટ કરનાર ગાથાઓની ઉત્થાનિકારૂપે આચાર્ય અમૃતયંદ્રેવે એક કળશ લખ્યો છે; જે આ પ્રમાણે છે -

(वंशस्थ)

इतः पदार्थप्रथनावगुंठनाद्विना

कृतेरेकमनाकुलं ज्वलत् ।

समस्तवस्तुव्यतिरेकनिश्चयाद्

विवेचितं ज्ञानमिहावतिष्ठते ॥२३४॥

(हस्तित)

वस्तु समस्तथी भिन्नताना निश्चये जुहुं पडी,
 आ शान थाये रહित सर्व पदार्थना संबंधथी;
 बस एक ज्ञानकियामयी थઈने अनाकुण शान ते,
 देवीभ्यमान थयुं थकुं निश्चण हो अहींथी हवे. २३४

हवे अहींथी आगणनी गाथाओमां कहे छे के समस्त वस्तुओथी
 भिन्नत्वना निश्चय द्वारा आ शान पदार्थोना विस्तारनी साथे गुंथायेल
 होवाथी उत्पन्न थनार कियाथी रहित एक ज्ञानकियामात्र अनाकुण अने
 देवीभ्यमान निश्चण रहे छे.

आ कणशमां मात्र एम ज कहेवामां आव्युं छे के शान जेयोनी
 साथे गुंथायेल होवा इतां पाण, जेयोने जाणतुं रहेतुं इतां पाण, जेयोनुं
 थई जतुं नथी, जेयडप थई जतुं नथी, जेयोथी पृथक्ष ज रहे छे.

हवे आ ज वातने विस्तारथी आगणनी गाथाओमां कहे छे.



समयसार गाथा ३६० - ४०४

सत्थं णाणं ण हवदि जम्हा सत्थं ण याणदे किंचि ।
 तम्हा अण्णं णाणं अण्णं सत्थं जिणा बेंति ॥३९०॥

सद्वे णाणं ण हवदि जम्हा सद्वे ण याणदे किंचि ।
 तम्हा अण्णं णाणं अण्णं सद्वे जिणा बेंति ॥३९१॥

रुवं णाणं ण हवदि जम्हा रुवं ण याणदे किंचि ।
 तम्हा अण्णं णाणं अण्णं रुवं जिणा बेंति ॥३९२॥

वण्णो णाणं ण हवदि जम्हा वण्णो ण याणदे किंचि ।
 तम्हा अण्णं णाणं अण्णं वण्णं जिणा बेंति ॥३९३॥

गंधो णाणं ण हवदि जम्हा गंधो ण याणदे किंचि ।
 तम्हा अण्णं णाणं अण्णं गंधं जिणा बेंति ॥३९४॥

ण रसो दु हवदि णाणं जम्हा दु रसो ण याणदे किंचि ।
 तम्हा अण्णं णाणं रसं च अण्णं जिणा बेंति ॥३९५॥

फासो ण हवदि णाणं जम्हा फासो ण याणदे किंचि ।
 तम्हा अण्णं णाणं अण्णं फासं जिणा बेंति ॥३९६॥

कम्मं णाणं ण हवदि जम्हा कम्मं ण याणदे किंचि ।
 तम्हा अण्णं णाणं अण्णं कम्मं जिणा बेंति ॥३९७॥

धर्मो णाणं ण हवदि जम्हा धर्मो ण याणदे किंचि ।

तम्हा अणं णाणं अणं धर्मं जिणा वेंति ॥३९८॥

णाणमधर्मो ण हवदि जम्हाधर्मो ण याणदे किंचि ।

तम्हा अणं णाणं अणं धर्मं जिणा वेंति ॥३९९॥

कालो णाणं ण हवदि जम्हा कालो ण याणदे किंचि ।

तम्हा अणं णाणं अणं कालं जिणा वेंति ॥४००॥

आयासं पि ण णाणं जम्हायासं ण याणदे किंचि ।

तम्हायासं अणं अणं णाणं जिणा वेंति ॥४०१॥

एजङ्गवसाणं णाणं अजङ्गवसाणं अचेदणं जम्हा ।

तम्हा अणं णाणं अजङ्गवसाणं तहा अणं ॥४०२॥

जम्हा जाणदि णिचं तम्हा जीवो दु जाणगो णाणी ।

णाणं च जाणयादो अव्वदिरितं मुणेयवं ॥४०३॥

णाणं सम्मादिडिं दु संजमं सुत्तमं गपुव्वगयं ।

धर्माधर्मं च तहा पव्वजं अबभुवंति बुहा ॥४०४॥

(हरिगीत)

रे ! शास्त्र ते नथी शान, जेथी शास्त्र कुट्ठ आगे नहीं,

ते कारागे छे शान जुहुं, शास्त्र जुहुं-जिन कहे; ३८०

रे ! शष्ट ते नथी शान, जेथी शष्ट कुट्ठ आगे नहीं,

ते कारागे छे शान जुहुं, शष्ट जुहो-जिन कहे; ३८१

रे ! ३५ ते नथी शान, जेथी ३५ कुट्ठ आगे नहीं,

ते कारागे छे शान जुहुं ३५ जुहुं-जिन कहे; ३८२

रे ! वार्ग ते नथी शान, जेथी वार्ग कुट्ठ आगे नहीं,

ते कारागे छे शान जुहुं वार्ग जुहो-जिन कहे; ३८३

રે ! ગંધ તે નથી શાન, જેથી ગંધ કંઈ જાએ નહીં,
તે કારાગે છે શાન જુદું, ગંધ જુદી જિન કહે; ૩૫૪

રે ! રસ નથી કંઈ શાન, જેથી રસ કંઈ જાએ નહીં,
તે કારાગે છે શાન જુદું, રસ જુદો-જિનવર કહે; ૩૫૫

રે ! સ્પર્શ તે નથી શાન, જેથી સ્પર્શ કંઈ જાએ નહીં,
તે કારાગે છે શાન જુદું, સ્પર્શ જુદો-જિનવર કહે; ૩૫૬

રે ! કર્મ તે નથી શાન, જેથી કર્મ કંઈ જાએ નહીં,
તે કારાગે છે શાન જુદું, કર્મ જુદું-જિન કહે; ૩૫૭

રે ! ધર્મ તે નથી શાન, જેથી ધર્મ કંઈ જાએ નહીં,
તે કારાગે છે શાન જુદું, ધર્મ જુદો-જિન કહે; ૩૫૮

અધર્મ તે નથી શાન, જેથી અધર્મ કંઈ જાએ નહીં,
તે કારાગે છે શાન જુદું, અધર્મ જુદો-જિન કહે; ૩૫૯

રે ! કાળ તે નથી શાન, જેથી કાળ કંઈ જાએ નહીં,
તે કારાગે છે શાન જુદું, કાળ જુદો-જિન કહે; ૪૦૦

આકાશ તે નથી શાન, જેથી આકાશ કંઈ જાએ નહીં,
તે કારાગે છે આકાશ જુદું, શાન જુદું-જિન કહે; ૪૦૧

નહિ શાન અધ્યવસાન છે, જેથી અચેતન તેણ છે,
તે કારાગે છે શાન જુદું, જુદું અધ્યવસાન છે. ૪૦૨

રે ! સર્વદા જાએ જ તેથી જીવ શાયક શાની છે,
ને શાન છે શાયકથી અવ્યતિરિક્ત ઈમ શાત્ર્ય છે. ૪૦૩

સમ્યક્ત્વ ને સંયમ તથા પૂર્વિગગત સૂત્રો અને
ધર્મધિરમ, દીક્ષા વળી, બુધ પુરુષ માને શાનને. ૪૦૪

શાસ્ત્ર જ્ઞાન નથી; કારણ કે શાસ્ત્ર કાંઈ જાણતું નથી; માટે જ્ઞાન અન્ય છે અને શાસ્ત્ર અન્ય છે - એમ જિનદેવો કહે છે.

શબ્દ જ્ઞાન નથી; કારણ કે શબ્દ કાંઈ જાણતું નથી; માટે જ્ઞાન અન્ય છે અને શબ્દ અન્ય છે - એમ જિનદેવો કહે છે.

રૂપ જ્ઞાન નથી; કારણ કે રૂપ કાંઈ જાણતું નથી; માટે જ્ઞાન અન્ય છે અને રૂપ અન્ય છે - એમ જિનદેવો કહે છે.

વર્ણ જ્ઞાન નથી; કારણ કે વર્ણ કાંઈ જાણતું નથી; માટે જ્ઞાન અન્ય છે અને વર્ણ અન્ય છે - એમ જિનદેવો કહે છે.

ગંધ જ્ઞાન નથી; કારણ કે ગંધ કાંઈ જાણતી નથી; માટે જ્ઞાન અન્ય છે અને ગંધ અન્ય છે - એમ જિનદેવો કહે છે.

રસ જ્ઞાન નથી; કારણ કે રસ કાંઈ જાણતો નથી; માટે જ્ઞાન અન્ય છે અને રસ અન્ય છે - એમ જિનદેવો કહે છે.

સ્પર્શ જ્ઞાન નથી; કારણ કે સ્પર્શ કાંઈ જાણતો નથી; માટે જ્ઞાન અન્ય છે અને સ્પર્શ અન્ય છે - એમ જિનદેવો કહે છે.

કર્મ જ્ઞાન નથી; કારણ કે કર્મ કાંઈ જાણતું નથી; માટે જ્ઞાન અન્ય છે અને કર્મ અન્ય છે - એમ જિનદેવો કહે છે.

ધર્મ જ્ઞાન નથી; કારણ કે ધર્મ કાંઈ જાણતો નથી; માટે જ્ઞાન અન્ય છે અને ધર્મ અન્ય છે - એમ જિનદેવો કહે છે.

અધર્મ જ્ઞાન નથી; કારણ કે અધર્મ કાંઈ જાણતો નથી; માટે જ્ઞાન અન્ય છે અને અધર્મ અન્ય છે - એમ જિનદેવો કહે છે.

કાળ જ્ઞાન નથી; કારણ કે કાળ કાંઈ જાણતો નથી; માટે જ્ઞાન અન્ય છે અને કાળ અન્ય છે - એમ જિનદેવો કહે છે.

આકાશ જ્ઞાન નથી; કારણ કે આકાશ કાંઈ જાણતું નથી; માટે જ્ઞાન અન્ય છે અને આકાશ અન્ય છે - એમ જિનદેવો કહે છે.

અધ્યવસાન જ્ઞાન નથી; કારણ કે અધ્યવસાન અચેતન છે; માટે જ્ઞાન અન્ય છે અને અધ્યવસાન અન્ય છે - એમ જિનદેવો કહે છે.

કારણ કે જીવ નિરંતર જાણે છે; માટે જ્ઞાયક એવો જીવ જ્ઞાની છે, જ્ઞાનસ્વરૂપ છે અને જ્ઞાન જ્ઞાયકથી અવ્યતિરિક્ત છે, અભિજ્ઞ છે - આમ જાણવું જેઈએ.

સમ્યગદાચિ (જ્ઞાનીજન) જ્ઞાન ને જી સમ્યગદાચિ, સંયમ, અંગપૂર્વગત સૂત્ર, ધર્મ-અધર્મ (પુરુષ-પાપ) અને દીક્ષા માને છે.

આચાર્ય અમૃતચંદ્ર આત્મભ્યાતિમાં આ ગાથાઓનો ભાવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે -

“શ્રુત (વચનાત્મક દ્રવ્યશ્રુત) જ્ઞાન નથી; કારણ કે શ્રુત અચેતન છે; તેથી જ્ઞાન અને શ્રુતને વ્યતિરેક (બિજ્ઞતા) છે. શબ્દ જ્ઞાન નથી; કારણ કે શબ્દ અચેતન છે; તેથી જ્ઞાનને અને શબ્દને વ્યતિરેક-બિજ્ઞતા છે. રૂપ જ્ઞાન નથી; કારણ કે રૂપ અચેતન છે; તેથી જ્ઞાનને અને રૂપને વ્યતિરેક-બિજ્ઞતા છે. વર્ણ જ્ઞાન નથી; કારણ કે વર્ણ અચેતન છે; તેથી જ્ઞાનને અને વર્ણને વ્યતિરેક-બિજ્ઞતા છે. ગંધ જ્ઞાન નથી; કારણ કે ગંધ અચેતન છે; તેથી જ્ઞાનને અને ગંધને વ્યતિરેક-બિજ્ઞતા છે. રસ જ્ઞાન નથી; કારણ કે રસ અચેતન છે; તેથી જ્ઞાનને અને રસને વ્યતિરેક-બિજ્ઞતા છે. સ્પર્શ જ્ઞાન નથી; કારણ કે સ્પર્શ અચેતન છે; તેથી જ્ઞાનને અને સ્પર્શને વ્યતિરેક-બિજ્ઞતા છે. કર્મ જ્ઞાન નથી; કારણ કે કર્મ અચેતન છે; તેથી જ્ઞાનને અને કર્મને વ્યતિરેક-બિજ્ઞતા છે. કર્મ જ્ઞાન નથી; કારણ કે કર્મ અચેતન છે; તેથી જ્ઞાનને અને કર્મને વ્યતિરેક-બિજ્ઞતા છે. અધર્મ જ્ઞાન નથી; કારણ કે અધર્મ અચેતન છે; તેથી જ્ઞાનને અને અધર્મને વ્યતિરેક-બિજ્ઞતા છે. કાળ જ્ઞાન નથી; કારણ કે કાળ અચેતન છે; તેથી જ્ઞાનને અને કાળને વ્યતિરેક-બિજ્ઞતા છે. આકાશ જ્ઞાન નથી; કારણ કે આકાશ અચેતન છે; તેથી જ્ઞાનને અને આકાશને વ્યતિરેક-બિજ્ઞતા છે. અધ્યવસાન જ્ઞાન નથી; કારણ કે અધ્યવસાન અચેતન છે; તેથી જ્ઞાનને અને અધ્યવસાનને વ્યતિરેક-બિજ્ઞતા છે.

આ પ્રમાણે જ્ઞાનનું બીજી બધા પરદવ્યો સાથે વ્યતિરેક નિશ્ચયસાધિત

જેવું જોઈએ. તાત્પર્ય આ છે કે નિશ્ચયથી વિચાર કરતાં જ્ઞાન પરદ્રવ્યોથી બિન્ન જ છે.

હવે એમ નક્કી કરે છે કે જીવ એક જ્ઞાન જ છે; કારણ કે જીવ ચેતન છે; માટે જ્ઞાનને અને જીવને અવ્યતિરેક (અભેદ) છે.

આ વાતની ! જરાય શંકા કરવી ન જોઈએ કે જ્ઞાન અને જીવમાં કંઈ થોડો તો વ્યતિરેક (બિન્નતા) હશે; કારણ કે જીવ સ્વયં જ જ્ઞાન છે. આ પ્રમાણે જ્ઞાન અને જીવ અભિન્ન હોવાથી જ્ઞાન જ સમ્યગદાખિ છે, જ્ઞાન જ સંયમ છે, જ્ઞાન જ અંગપૂર્વકૃપ સૂત્ર છે, જ્ઞાન જ ધર્મ-અધર્મ (પુણ્ય-પાપ) છે, જ્ઞાન જ પ્રવળજ્યા છે.

આપ્રમાણે જ્ઞાનનો જીવની પર્યાયો સાથે પણ અવ્યતિરેક (અભેદ) નિશ્ચયસાધિત દેખવો. તાત્પર્ય એ છે કે જીવપર્યાયોનો જીવની સાથે અભેદ નિશ્ચયથી જ છે.

આપ્રમાણે સર્વ પરદ્રવ્યો સાથે વ્યતિરેક વડે અને સર્વ દર્શનાદિ જીવસ્વભાવો સાથે અવ્યતિરેકવડે અતિવ્યાપ્તિને અને અવ્યાપ્તિને દૂર કરતું થકું; અનાદિ વિષ્વભ જેનું મૂળ છે એવા પુણ્ય-પાપ અને શુભ-અશુભકૃપ ધર્મ-અધર્માંતક પરસમયને દૂર કરીને, પોતે જ નિશ્ચયચારિત્રકૃપ પ્રવળજ્યાને પામીને, દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતિકૃપ સ્વસમયને પ્રાપ્ત કરીને, મોક્ષમાર્ગને પોતામાં જ પરિણત કરીને, જેણે સંપૂર્ણ વિજ્ઞાનધન-સ્વભાવને પ્રાપ્ત કર્યો છે - એવું ત્યાગ-ગ્રહણથી રહિત સાક્ષાત્ સમયસારભૂત, પરમાર્થકૃપ એક શુદ્ધજ્ઞાનને નિશ્ચળ દેખવું અર્થાત્ પ્રત્યક્ષ સ્વસંવેદનથી નિશ્ચળ અનુભવ કરવો જોઈએ.”

ગાથાઓ અને આત્મઘ્યાતિ ટીકાના અભિપ્રાયને પંડિત જયચંદ્રલું છાબડા ભાવાર્થમાં વિસ્તારથી આપ્રમાણે સ્પષ્ટ કરે છે -

“અહીં જ્ઞાનને સમસ્ત પરદ્રવ્યોથી બિન્ન અને પોતાની પર્યાયોથી અભિન્ન બતાવ્યું છે; તેથી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ નામના લક્ષણદોષ દૂર થઈ ગયા. આત્માનું લક્ષણ ઉપયોગ છે અને ઉપયોગમાં જ્ઞાન પ્રધાન

છે; તે (જ્ઞાન) અન્ય અચેતન દ્રવ્યોમાં નથી; માટે તે અતિવ્યાપ્તિવાળું નથી અને પોતાની સર્વ અવસ્થાઓમાં છે; તેથી અવ્યાપ્તિવાળું નથી. આ પ્રમાણે જ્ઞાનલક્ષણ કહેતાં અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષ આવતો નથી.

અહીં જ્ઞાનને જ પ્રધાન કરીને આત્માનો અધિકાર છે; કારણ કે જ્ઞાનલક્ષણથી જ આત્મા સર્વ પરદ્રવ્યોથી બિન્ન અનુભવગોચર થાય છે.

આમ તો આત્મામાં અનંત ધર્મ છે, છતાં તેમાંથી કેટલા તો છિદ્રસ્થને અનુભવગોચર જ નથી. તે ધર્મોને કહેતાં છિદ્રસ્થ જ્ઞાની આત્માને કેમ ઓળખી શકે? અને કેટલાક ધર્મતો અનુભવગોચર છે; પરંતુ તેમાંથી કેટલાય તો અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ આદિ તો - અન્ય દ્રવ્યો સાથે સામાન્ય અર્થાત્ સમાન જ છે; તેથી તેમને કહેતાં પૃથક આત્મા જાણી શકતો નથી અને કેટલાય (ધર્મ) પરદ્રવ્યના નિમિત્તથી થયા છે; તેમને કહેતાં પરમાર્થભૂત આત્માનું શુદ્ધસ્વરૂપ કેમ જાણી શકાય? તેથી જ્ઞાન એમ કહેતાં જ છિદ્રસ્થ જ્ઞાની આત્માને ઓળખી શકે છે.

અહીં જ્ઞાનને આત્માનું લક્ષણ કહ્યું છે - એટલું જ નહીં, પરંતુ જ્ઞાનને જ આત્મા કહ્યો છે; કારણ કે અભેદવિવક્ષામાં ગુણ-ગુણીનો અભેદ હોવાથી જ્ઞાન છે તે આત્મા જ છે. અભેદવિવક્ષાથી ચાહે જ્ઞાન કહો યા આત્મા કોઈ વિરોધ નથી; તેથી અહીં જ્ઞાન કહેતાં આત્મા જ સમજવું જોઈએ.

દીકાના અંતમાં એમ કહ્યું છે કે પોતામાં અનાદિ અજ્ઞાનથી થનારી શુભાશુભ ઉપયોગકૃપ પરસમયની પ્રવૃત્તિને દૂર કરીને, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચાચ્રિતમાં પ્રવૃત્તિકૃપ સ્વસમયને પ્રાપ્ત થઈને, તે સ્વસમયકૃપ પરિણમનસ્વરૂપે મોક્ષમાર્ગમાં પોતાને પરિણમાવીને જે સંપૂર્ણ વિજ્ઞાનસ્વભાવને પ્રાપ્ત થયો છે અને જેમાં કંઈ ત્યાગ-ગ્રહણ નથી, એવા સાક્ષાત્ સમયસારસ્વરૂપ, પરમાર્થભૂત, નિશ્ચળ રહેલા, શુદ્ધ પૂર્ણ જ્ઞાનને (પૂર્ણ આત્મદ્રવ્યને) દેખવું.

અહીં 'દેખવું' ત્રણ પ્રકારે સમજવું જોઈએ.

૧. શુદ્ધનયનું જ્ઞાન કરીન પૂર્ણ જ્ઞાનનું શ્રદ્ધાન કરવું તે પહેલા પ્રકારનું દેખવું છે. તે અવિરત આદિ અવસ્થામાં પણ હોય છે.
૨. જ્ઞાન-શ્રદ્ધાન થયા બાદ સર્વ પરિગ્રહનો ત્યાગ કરીને તેનો (પૂર્ણ જ્ઞાનનો) અભ્યાસ કરવો, ઉપયોગને જ્ઞાનમાં સ્થિર કરવો. જેવું શુદ્ધનયથી પોતાના સ્વરૂપને સિદ્ધ સમાન જાણું-શ્રદ્ધયું હતું તેવું જ ધ્યાનમાં લઈને ચિત્તને એકાગ્ર-સ્થિર કરવું અને ફરી ફરી તેનો જ અભ્યાસ કરવો, તે બીજી પ્રકારનું દેખવું છે.
આ પ્રમાણેનું દેખવું અપ્રમતદશામાં થાય છે. જ્યાં સુધી તે પ્રકારના અભ્યાસથી કેવળજ્ઞાન ઉત્પન્ન ન થાય, ત્યાંસુધી આવો અભ્યાસ નિરંતર રહે છે, આ દેખવાનો બીજો પ્રકાર થયો.
૩. જ્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યારે સાક્ષાત્ દેખવું થાય છે.

તે બીજી પ્રકારે દેખવું છે. તે સ્થિતિમાં જ્ઞાન સર્વ વિભાવોથી રહિત થયું થકું સર્વનું જ્ઞાતા-દાટા છે, તેથી આ બીજી પ્રકારનું દેખવું તે પૂર્ણ જ્ઞાનનું પ્રત્યક્ષ દેખવું છે.

આ બધાનો ભાવ પૂજ્ય ગુરુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે :

“અહીં કહે છે - દ્રવ્યશ્રુત જ્ઞાન નથી, ભગવાનની વાણી જ્ઞાન નથી, આત્મા નથી; કારણ કે તે અચેતન છે.

પ્રશ્ન:- ધ્યાનામાં તો એમ કહ્યું છે કે ‘ભગવાનની વાણીમાં ભાવશ્રુતથી ઉપદેશ આવ્યો છે, તેનો શો અર્થ છે ?’

ઉત્તર:- હા, વાણી તો જરૂર છે, પરંતુ વાણીના સાંભળનાર વાણીને સાંભળીને અંતર્મુખ થઈને ભાવશ્રુતકૃપે પરિણામે છે ને ? બસ તે જ કારણે ભગવાનની વાણીમાં ભાવશ્રુતથી ઉપદેશ આપવામાં આવ્યો છે - એમ કહેવાય છે, વાણી ભાવશ્રુત નથી વાણીમાં કેવળજ્ઞાન પણ નથી. વાણી તો દ્રવ્યશ્રુત છે, અચેતન છે.”

ધ્વલામાં એવો પાઠ છે કે ભગવાન ભાવશ્રુતથી પ્રકૃપણા કરે છે, કેવળજ્ઞાનથી નહીં. તેનું તાત્પર્ય તો એ છે કે શ્રોતા પોતે પોતાની અંદર સ્વરૂપમાં લક્ષ્ય કરે છે, ત્યારે તેને ભાવશ્રુતજ્ઞાન પ્રગટ થાય છે. તેમાં ભગવાનની હિંબ્યધ્વનિ નિમિત્ત છે. બસ, આ જ કારણે હિંબ્યધ્વનિને ભાવશ્રુતથી પ્રકૃપણા કરી આમ કહેવામાં આવ્યું છે. ભગવાનને તો કેવળજ્ઞાન છે પરંતુ વાણીમાં ભાવશ્રુતનો ભાવ શ્રોતાઓને પ્રાપ્ત થાય છે. આ કારણથી ભાવથી પ્રકૃપણા કરી - એમ કહેવામાં આવ્યું છે.

ત્યાં હિંબ્યધ્વનિમાં જે પણ નિરક્ષરી ધ્વનિ નીકળે છે; તે તો જડ છે. તે ભાવશ્રુતકૃપ નથી. તે ઊં ધ્વનિથી જે જ્ઞાન થાય છે; તે પણ જડ છે, અચેતન છે. તે જ સમયે જે જ્ઞાન પોતાના ચૈતન્યજ્યોતિસ્વરૂપ ભગવાન આત્માના લક્ષ્યે પ્રગટ થાય છે, તે જ્ઞાન જ વાસ્તવિક જ્ઞાન છે. તે આત્મજ્ઞાન છે, સમ્યગ્જ્ઞાન છે, ભાવશ્રુતજ્ઞાન છે.^૧

જુઓ, હવે કહે છે કે જીવ જ જ્ઞાન છે; કારણ કે જ્ઞાન ચેતન છે અને જીવ પણ ચેતન છે. અહીં જ્ઞાન અને જીવની એકતામાં અભિપ્રાતા બતાવવામાં આવી છે. જ્ઞાન અને જીવ આપ્રમાણે બે શબ્દોની બિજ્ઞ-બિજ્ઞ ધ્વનિ ઉઠે છે, તેથી એવો ભ્રમ થાય છે કે જ્ઞાન અને જીવ બંને જુદા-જુદા હશે - લોકો એમ સમજે છે; પરંતુ એવી શંકા કરવી ન જોઈએ. ભગવાન આત્મા ભાવવાન અને જ્ઞાન ભાવ-આમ ભાવ અને ભાવવાન બંનેને જુદા-જુદા નહીં, એક જ સમજવા જોઈએ; કારણ કે બંને વસ્તુપણે એક જ છે. નામ જુદા-જુદા ને છે, પણ વસ્તુ બે નથી. જીવ અને જ્ઞાન-આવા બે નામ હોવા છીતાં પણ વસ્તુ તાદાત્મ્યરૂપે એક જ છે.^૨

હવે કહે છે કે જ્ઞાન જ સમ્યગ્દર્શિ છે. અહીં પ્રશ્ન છે કે જે સમ્યગ્દર્શિ છે તે આત્મા છે કે નહીં? ઉત્તરમાં કહ્યું છે કે હા, આત્મા જ સમ્યગ્દર્શિ છે; કારણ કે આત્માથી જુદું તો કોઈ સમ્યગ્દર્શન નથી.

^૧ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૧૩૮

^૨ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૧૪૧-૧૪૨

આહા ! આત્મા પૂર્ણ જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ છે. તે જ્ઞાનમાં જૈય થતાં તેની પ્રતીતિ થઈ કે 'આ હું છું' બસ, એ જ તો સમ્યગ્દર્શન છે. આ સમ્યગ્દર્શન આત્મસ્વરૂપ છે. સમ્યગ્દર્શન કોઈ જુદી વસ્તુ છે અને આત્મા જુદો છે - એવું નથી; તેથી કહે છે કે જ્ઞાન જ સમ્યગ્દર્શિ છે. અહીં જ્ઞાન શબ્દથી અભેદ્ધ આત્મા જ કહ્યો છે. આ રીતે એ સ્પષ્ટ છે કે આત્મા જ સમ્યગ્દર્શન અથવા સમ્યગ્દર્શિ છે; કારણ કે આત્માથી બિજ્ઞ કોઈ અલગ સમ્યગ્દર્શન નથી, સમ્યગ્દર્શિ નથી.

હવે કહે છે કે જ્ઞાન જ સંયમ છે. જ્ઞાન અર્થાત્ આત્મા જ સંયમ છે. પાંચે ઈન્દ્રિયોના વિષયોને ત્યાગવા અને મનને જીતવું - આ તો નાસ્તિકી સંયમની વાત છે. અસ્તિકી તો જ્ઞાન અર્થાત્ આત્મામાં જ રમવાનું નામ સંયમ છે અને તે સંયમ આત્મા જ છે. સંયમની વીતરાગી પર્યાયકાર્યે આત્મા જ પરિણામે છે ને ? તેથી આત્મા જ સંયમ છે.^૧

જુઓ, અહીં સમ્યગ્દર્શન, સંયમ આદિ પર્યાયોને આત્મા કહ્યો છે, જ્યારે ગાથા ૧૧માં તેને વ્યવહાર કહીને અભૂતાર્થ કહ્યો છે. નિયમસારની ઉટ્ટમી ગાથામાં પુણ્ય-પાપ, આસ્રવ-બંધ, સંવર-નિર્જરા અને મોક્ષ સહિત જોટલી પર્યાયો છે તે બધાને પરદ્રવ્ય કહીને હેઠ કહી છે.

પ્રશ્નઃ- આ બંને કથનોમાં કયું કથન સત્ય છે ?

ઉત્તરઃ- પોતપોતાની અપેક્ષાથી બંને જ કથન સત્ય છે. ભાઈ ! અનેકાંતથી બધું સિદ્ધ થાય છે.^૨

આત્માનું સ્વયં પોતામાં જ સ્થિર થઈ જવું, જમી જવું તે જ સંયમ છે, જ્ઞાન જ સંયમ છે. આ દેહની કિયા અને દ્વા, દાન, વ્રત, તપ આદિ કિયાકંડના વિકલ્પ સંયમ નથી.^૩

બાર અંગાનું જ્ઞાન માત્ર શબ્દો સુધી સીમિત નથી, સ્વના આશ્રયથી જે સમ્યગ્જ્ઞાન પ્રગટ થાય છે, તે ભાવશ્રુતજ્ઞાન અંગપૂર્વકાર્ય સૂત્ર છે.

૧ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૧૪૨

૨ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૧૪૩-૧૪૪

૩ તે જ, પાનું ૧૪૪

હવે કહે છે કે જ્ઞાન જ ધર્મ-અધર્મ અર્થાત् પુણ્ય-પાપ છે. જુઓ,
પુણ્ય-પાપ આત્માની પર્યાયમાં થાય છે, માત્ર આ અપેક્ષાથી તેમને આત્મા
કહ્યા છે, પરંતુ વિભ્રમ તેની ઉત્પત્તિનું મૂળ છે. બલે ને જીવની પર્યાયમાં
ઉત્પન્ન થયા છે; છતાં તે પરસ્તાવલંબી ભાવે હોવાથી બંધનકૃપ જ છે,
બંધનું જ કારણ છે.

પ્રશ્ન:- જ્યારે તે પરાવલંબી છે અને બંધનું કારણ છે, તો પછી
તેમને આત્મા કહેવાનું શું પ્રયોજન છે ?

ઉત્તર:- ભાઈ ! અહીં સ્વના દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વકીય છે, પરથી
બિન્ન છે; પરંતુ પરદ્રવ્યકૃપ નથી - આમ સિદ્ધ કરવું છે, તેથી આ જીવની
પર્યાયમાં જે શુભાશુભભાવ થાય છે, તેમને અહીં આત્મા કહ્યા છે.
આત્માની પર્યાય પણ આત્મા - આ શૈલીથી અહીં વાત કરી છે. તેથી
જ સમ્યગુર્દર્શન, સંયમ, અંગપૂર્વસૂત્રની નિર્મળ પર્યાય અને ધર્મ-અધર્મ
(પુણ્ય-પાપ) ની વિભાવકૃપ મલિન પર્યાયોને અહીં આત્મા કહી છે.^૧

જીવ અનાદિથી શુભાશુભભાવ કરતો આવ્યો છે, આ શુભાશુભભાવ
અનાદિ-સાંત છે. આટલા લાંબા સમયથી અશુદ્ધતા રહી, જે તેને માનીએ
જ નહીં તો ગુણ જ સિદ્ધ નહીં થાય અને દ્રવ્ય પણ સિદ્ધ નહીં થાય.
ગુણોનું અશુદ્ધ પરિણમન થવું તે તેમની તત્ત્વસમયની યોગ્યતા છે. જે આ
બધાના અશુદ્ધ પરિણમનને ન માનવામાં આવે તો નિકાળી ગુણ જ સિદ્ધ
નહીં થાય; તો પછી તે ગુણોના સમુહ દ્રવ્યની સિદ્ધિ કેમ થશે ?^૨

પ્રવચનસારના નય અધિકારમાં એવું કથન છે કે શુદ્ધ અને અશુદ્ધ
પરિણામોનો અધિષ્ઠાતા આત્મા છે અને અહીં પણ એમજ કહ્યું છે કે
જ્ઞાન જ સમ્યગુર્દર્શિ છે, જ્ઞાન જ સંયમ છે, જ્ઞાન જ ધર્મ-અધર્મ છે.
અહીં તો વર્તમાન વર્તતી પર્યાયને આત્માની કહેવી છે ને ? ભાઈ ! અહીં
કઈ અપેક્ષાથી કહેવાઈ રહ્યું છે - તે સમજવું બહુ જરૂરી છે.^૩

૧ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૧૪૪-૧૪૫

૨ સમયસાર ભાગ ૧૦, પાનું ૧૪૬

૩ તે જ, પાનું ૧૪૭-૧૪૮

(હરિગીત)

પૂર્વોક્ત રીતે કર્મથી ને કર્મફળથી પાગ અહો !
 વિરતિ અતિશય ભાવીને અવિરતપાગે જ્ઞાનીજનો;
 અજ્ઞાનદ્વારી ચેતનાનો પ્રલય પ્રગટ નચાવીને,
 પૂરાગ કરીને સર્વ રીતે રસથી પ્રાપ્ત સ્વભાવને;
 પ્રગટાવીને આનંદપૂર્વક ચેતના નિજ જ્ઞાનની,
 પીઓ પ્રશ્નમરસને સદાય જ્ઞાનીજન હે આજથી. ૨૩૩

કર્મ અને કર્મફળથી અત્યંત વિરક્તિભાવને ભાવીને, સમસ્ત અજ્ઞાનચેતનાના નાશને સ્પષ્ટતાથી નચાવીને અને નિજરસને પ્રાપ્ત પોતાના સ્વભાવને પૂર્ણ કરીને પોતાની જ્ઞાનચેતનાને આનંદપૂર્વક નચાવતાં હવે હંમેશા પ્રશ્નમરસને પીઓ.

આ કળશરમાં તો માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે કર્મચેતના અને કર્મફળચેતનાઙ્કુપ અજ્ઞાનચેતનાનો અભાવ કરીને આત્માના અનુભવઙ્કુપ જ્ઞાનચેતનાની ભાવના સદા ભાવવી - આ માર્ગ છે. એ જ વાસ્તવિક ધર્મ છે, શેષ બધા કિયાકાંડનો ધર્મ સાથે કોઈ નાતો નથી. ધર્મના નામે તેમાં સમય અને શક્તિ ગુમાવવી તે અમૃત્ય નરભવની હાર છે. તેથી અધિક તો બીજું શું કહી શકાય ?

કવિવર બનારસીદાસજીએ પણ નાટક સમયસારમાં ઉક્ત પ્રકરણનો આધાર લઈને અનેક છંદ લખ્યા છે; જે મૂળથી અભ્યાસ કરવા યોગ્ય છે. અહીં તે બધાને તો અહીં આપવાનું સંભવ નથી; છાતાં અમૃક મહત્વપૂર્ણ છંદ નમૂના તરીકે અહીં આપાઈ રહ્યા છે જે ઉક્ત પ્રકરણ પર પ્રકાશ પાથરે છે.

(દોહા)

ગ્યાનવંત અપની કથા, કહૈ આપ સૌં આપ ।
 મૈં મિથ્યાત દસાવિં, કીને બહુવિધિ પાપ ॥
 મૈં કીનોં મૈં યોં કરોં, અબ યહ મેરી કામ ।
 મન વચ કાયા મૈં બસૈ, એ મિથ્યા પરિનામ ॥

મન-વચન-કાયા કરમફળ, કરમ-દસા જડ અંગ ।
 દરબિત પુગલ પિંડમય, ભાવિત ભરમ તરંગ ॥
 તાતેં આતમ ધરમ સૌં, કરમ સુભાડ અપૂર્ઠ ।
 કૌન કરાવૈ કૌ કરૈ, કોસલ હૈ સબ ઝૂઠ ॥
 કરની હિત હરની સદા, મુકતિ વિતરની નાંહિ ।
 ગની બંધ-પદ્ધતિ વિષૈ, સની મહાદુખમાંહિ ॥

પ્રતિક્ષમણ, આતોચના અને પ્રત્યાખ્યાનની કિયામાં જ્ઞાની જીવ
 પોતાની વાર્તા પોતે જ કહે છે. તેઓ કહે છે કે અમે ભૂતકાળમાં મિથ્યાત્ય
 અવસ્થામાં ઘણા પ્રકારનાં પાપ કર્યા છે.

‘મેં આમ કર્યું, હું આમ કર્યું છું અને હવે હું આમ કરીશ અર્થાત્
 હવે આ મારું કાર્ય છે, કર્તવ્ય છે’ - આ પ્રકારના મિથ્યા પરિણામ મારા
 મન-વચન-કાયામાં વસી રહ્યા છે.

આ મન-વચન-કાયા કર્મોદ્યથી પ્રાપ્ત થયા છે; તેથી તે કર્મોનું
 ફળ જ છે અને કર્મની અવસ્થા તો જડૃપ જ છે. દ્રવ્યકર્મ પુદ્ગલનો
 જ પિંડ છે અને ભાવકર્મ આત્મામાં ઉત્પન્ન થતી ભ્રમૃપ તરંગો છે.

તેથી આત્મધર્મથી કર્મનો સ્વભાવ વિપરીત જ છે. તેથી આ કર્મોને
 કોણ કરે અને કોણ કરાવે ? અર્થાત્ તેમનો કર્તા કરાવનાર આત્મા નથી.
 તેમનો કર્તા પોતાને માનવો તે ખોટી ચતુરાઈ છે.

અધિક શું કહીએ - પરમાં કંઈ પણ કરવાના પરિણામ અહિત
 કરનારા જ છે, મુક્તિ દેનારા નથી; તે તો મહાદુઃખથી એકમેક થયેલી ભરેલી
 બંધપદ્ધતિ જ માનવામાં આવે છે.

(ચૌપાઈ)

મૈં ત્રિકાલ કરની સૌં ન્યારા । ચિદવિલાસ પદ જગ ઉજયારા ॥
 રાગ વિરોધ મોહ મમ નાંહી । મેરો અવલંબન મુજા માંહી ॥

હું તો સદાય કર્તૃત્વબુદ્ધિથી બિજ્ઞ છું, ચૈતન્યમાં વિલાસ કરનાર છું, સંપૂર્ણ જગતનો પ્રકારશક છું, શાયક છું, મોહ-રાગ-દ્રેષ મારામાં નથી; તેથી મારો આશ્રય તો મારામાં જ વિદ્યમાન છે. અર્થાત્ મારો આશ્રય તો હું પોતે જ છું.

(દોહા)

કહે વિચચ્છન મેં રહ્યૌ, સદા ગ્યાન રસ રાચિ ।

સુદ્ગાતમ અનુભૂતિ સૌં, ખલિત ન હોહું કદાચિ ॥

પુર્વકરમ વિષતરુ ભએ, ઉદૈ ભોગ ફલફૂલ ।

મેં ઇનકો નહિ ભોગતા, સહજ હોહુ નિરમૂલ ॥

જો પૂરવકૃત કરમ-ફળ, રુચિ સૌં ભુંજે નાંહિ ।

મગન રહૈ આઠોં પહર, સુદ્ગાતમ પદ માંહિ ॥

સો બુધ કરમદસા રહિત, પાવૈ મોખ તુરંત ।

ભુંજે પરમ સમાધિ સુખ, આગમ કાલ અનંત ॥

વિચક્ષણ પુર્ણ કહે છે કે હું તો સદાય પોતાના જ્ઞાનરસમાં જ રચી-પચી રહ્યો છું; પોતાના શુદ્ગાત્માની અનુભૂતિથી ક્યારેય સ્ફુરિત થતો નથી.

પૂર્વકૃતકર્મ વિષવૃક્ષ છે; પૂર્વકૃત કર્મોના ઉદ્ઘયને ભોગવવા તે જ તેમના ફળ-કૂલ છે. હું તેમનો ભોક્તા નથી; તેથી તે સહજ નિર્મૂળ થઈ જશે.

જે વ્યક્તિ પૂર્વકૃત કર્મોના ફળને ડ્રિચ્યુર્વક ભોગવતા નથી અને આઠે પછી અર્થાત્ દ્વિવસ-રાત શુદ્ગાત્મામાં જ મગન રહે છે; તે લોકો અતિશીધ કર્મરહિત મુક્તિદશાને પ્રાપ્ત કરે છે અને આગામી અનંત કાળ સુધી પરમસમાધિગત સુખને ભોગવે છે.

(છણ્ય)

જો પૂરવકૃતકરમ, વિરખ-વિષ-ફળ નહિં ભુંજે ।

જોગ જુગતિ કારિજ કરંતિ, મમતા ન પ્રયુંજે ॥

રાગ વિરોધ નિરોધિ, સંગ વિકલપ સબ છંડઝ ।

સુદ્ધાતમ અનુભૌ અભ્યાસિ, સિવ નાટક મંડઝ ॥

જો ગ્યાનવંત ઇહિ મગ ચલત, પૂરન હૈ કેવળ લહૈ ।
સો પરમ અતીન્દ્રિય સુખ વિર્ણ, મગનરૂપ સંતત રહૈ ॥

જે પૂર્વકૃત કર્મદ્વારા વિષવૃક્ષોના ફળને ભોગવતો નથી અને મન-વચન-કાયાર્થપ યોગોની ડિયામાં મભતા રાખતો નથી; રાગ-દ્રેષ્ણને રોકીને, પરિગ્રહ અને વિકલ્પોને છોડીને શુદ્ધાત્માનો અનુભવ કરે છે; તે જ્ઞાનીજન આ માર્ગ પર ચાલતાં પૂર્ણતાને પ્રાપ્ત કરીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરે છે અને સદાય પરમ અતીન્દ્રિય આનંદમાં મળું રહે છે.

કવિવર બનારસીદાસલુએ ઉક્ત છંદોમાં આ જ વાત કહી છે કે જ્ઞાનીજન પ્રતિક્રિમણ, આલોચના અને પ્રત્યાખ્યાનના માધ્યમથી કર્મચેતના અને કર્મફળચેતનાના ત્યાગની ભાવના ભાવતાં જ્ઞાનચેતનાર્થપ પરિણામિત થઈ અનંતસુખને પ્રાપ્ત કરે છે અને પછી તેને જ અનંત કાળ સુધી ભોગવે છે.

વાસ્તવિક ધર્મ પણ આ જ છે, આ જ એક કરવા યોગ્ય માત્ર કાર્ય છે; તેના સિવાય ધર્મને નામે જે કંઈ થઈ રહ્યું છે તે ધર્મ નથી, કર્મ જ છે, કર્મબંધનું જ કારણ છે, કર્મચેતના જ છે, કર્મફળચેતના જ છે, અજ્ઞાનચેતના છે જ્ઞાનચેતના કયારેય નથી.

એકમાત્ર જ્ઞાનચેતના જ ધર્મ છે, ધર્મનો માર્ગ છે, મુક્તિનો માર્ગ છે, સાક્ષાત્ મુક્તિ જ છે.

આ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર છે. તેમાં અત્યાર સુધી એ જ બતાવવામાં આવી રહ્યું છે કે સર્વવિશુદ્ધજ્ઞાન પરનો કર્તા-ભોક્તા નથી.

હવે આગામી ગાથાઓમાં એમ બતાવશે કે નિશ્ચયથી સર્વવિશુદ્ધજ્ઞાન પરશેયોને જાણવા છતાં પણ પરશેયોથી સર્વથા લિન્ન છે.

ઉક્ત વિષયને સ્પષ્ટ કરનાર ગાથાઓની ઉત્થાનિકાર્થે આચાર્ય અમૃતચંદ્રદેવે એક કળશ લઘ્યો છે; જે આ પ્રમાણે છે -

(વંશસ્થ)

ઇતः पदार्थप्रथनावगुंठनाद्विना
 कृतेरेकमनाकुलं ज्वलत् ।
 सમस्तवस्तुव्यतिरेकनिश्चयाद्
 विवेचितं ज्ञानमिहावतिष्ठते ॥૨૩૪॥

(હસ્તિત)

વસ્તુ સમસ્તથી બિજ્ઞતાના નિશ્ચયે જુદું પડી,
 આ જ્ઞાન થાયે રહિત સર્વ પદાર્થના સંબંધથી;
 બસ એક જ્ઞાનક્ષિયામયી થઈને અનાકુળ જ્ઞાન તે,
 દેદીખ્યમાન થયું થકું નિશ્ચળ હો અહીંથી હવે. ૨૩૪

હવે અહીંથી આગળની ગાથાઓમાં કહે છે કે સમસ્ત વસ્તુઓથી
 બિજ્ઞત્વના નિશ્ચય દ્વારા આ જ્ઞાન પદ્ધારોના વિસ્તારની સાથે ગુંથાયેલ
 હોવાથી ઉત્પન્ન થનાર કિયાથી રહિત એક જ્ઞાનક્ષિયામાત્ર અનાકુળ અને
 દેદીખ્યમાન નિશ્ચળ રહે છે.

આ કળશમાં માત્ર એમ જ કહેવામાં આવ્યું છે કે જ્ઞાન જ્ઞેયોની
 સાથે ગુંથાયેલ હોવા છતાં પણ, જ્ઞેયોને જાણતું રહેતું છતાં પણ, જ્ઞેયોનું
 થઈ જતું નથી, જ્ઞેયકૃપ થઈ જતું નથી, જ્ઞેયોથી પૃથ્વે જ રહે છે.

હવે આ જ વાતને વિસ્તારથી આગળની ગાથાઓમાં કહે છે.



समयसार गाथा ३६० - ४०४

सत्थं णाणं ण हवदि जम्हा सत्थं ण याणदे किंचि ।
 तम्हा अण्णं णाणं अण्णं सत्थं जिणा बेंति ॥३९०॥

सद्वो णाणं ण हवदि जम्हा सद्वो ण याणदे किंचि ।
 तम्हा अण्णं णाणं अण्णं सद्वं जिणा बेंति ॥३९१॥

रुवं णाणं ण हवदि जम्हा रुवं ण याणदे किंचि ।
 तम्हा अण्णं णाणं अण्णं रुवं जिणा बेंति ॥३९२॥

वण्णो णाणं ण हवदि जम्हा वण्णो ण याणदे किंचि ।
 तम्हा अण्णं णाणं अण्णं वण्णं जिणा बेंति ॥३९३॥

गंधो णाणं ण हवदि जम्हा गंधो ण याणदे किंचि ।
 तम्हा अण्णं णाणं अण्णं गंधं जिणा बेंति ॥३९४॥

ण रसो दु हवदि णाणं जम्हा दु रसो ण याणदे किंचि ।
 तम्हा अण्णं णाणं रसं च अण्णं जिणा बेंति ॥३९५॥

फासो ण हवदि णाणं जम्हा फासो ण याणदे किंचि ।
 तम्हा अण्णं णाणं अण्णं फासं जिणा बेंति ॥३९६॥

कम्मं णाणं ण हवदि जम्हा कम्मं ण याणदे किंचि ।
 तम्हा अण्णं णाणं अण्णं कम्मं जिणा बेंति ॥३९७॥

ધર્મો ણાણં ણ હવદિ જમ્હા ધર્મો ણ યાણદે કિંચિ ।
તમ્હા અણં ણાણં અણં ધર્મં જિણા બેંતિ ॥૩૯૮॥

ણાણમધર્મો ણ હવદિ જમ્હાધર્મો ણ યાણદે કિંચિ ।
તમ્હા અણં ણાણં અણં ધર્મં જિણા બેંતિ ॥૩૯૯॥

કાલો ણાણં ણ હવદિ જમ્હા કાલો ણ યાણદે કિંચિ ।
તમ્હા અણં ણાણં અણં કાલં જિણા બેંતિ ॥૪૦૦॥

આયાસં પિ ણ ણાણં જમ્હાયાસં ણ યાણદે કિંચિ ।
તમ્હાયાસં અણં અણં ણાણં જિણા બેંતિ ॥૪૦૧॥

અજ્ઞાવસાણં ણાણં અજ્ઞાવસાણં અચેદણં જમ્હા ।
તમ્હા અણં ણાણં અજ્ઞાવસાણં તહા અણં ॥૪૦૨॥

જમ્હા જાણદિ ણિચ્ચં તમ્હા જીવો દુ જાણગો ણાણી ।
ણાણં ચ જાણયાદો અવ્વદિરિતં મુણેયવં ॥૪૦૩॥

ણાણં સમ્માદિદ્ધિં દુ સંજમં સુત્તમંગપુંબગયં ।
ધર્મમાધર્મં ચ તહા પવ્વજ્ઞ અબખુવંતિ બુહા ॥૪૦૪॥

(હસ્તિત)

૨ ! શાસ્ત્ર તે નથી શાન, જેથી શાસ્ત્ર કંઈ જાએ નહીં,
તે કારાએ છે શાન જુદું, શાસ્ત્ર જુદું-નિન કહે; ૩૬૦

૨ ! શબ્દ તે નથી શાન, જેથી શબ્દ કંઈ જાએ નહીં,
તે કારાએ છે શાન જુદું, શબ્દ જુદો-નિન કહે; ૩૬૧

૨ ! રૂપ તે નથી શાન, જેથી રૂપ કંઈ જાએ નહીં,
તે કારાએ છે શાન જુદું રૂપ જુદું-નિન કહે; ૩૬૨

૨ ! વાર્ગ તે નથી શાન, જેથી વાર્ગ કંઈ જાએ નહીં,
તે કારાએ છે શાન જુદું વાર્ગ જુદો-નિન કહે; ૩૬૩

રે ! ગંધ તે નથી શાન, જેથી ગંધ કંઈ જાગે નહીં,
તે કારણો છે શાન જુદું, ગંધ જુદી જિન કહે; ૩૮૪

રે ! રસ નથી કંઈ શાન, જેથી રસ કંઈ જાગે નહીં,
તે કારણો છે શાન જુદું, રસ જુદો-જિનવર કહે; ૩૮૫

રે ! સ્પર્શ તે નથી શાન, જેથી સ્પર્શ કંઈ જાગે નહીં,
તે કારણો છે શાન જુદું, સ્પર્શ જુદો-જિનવર કહે; ૩૮૬

રે ! કર્મ તે નથી શાન, જેથી કર્મ કંઈ જાગે નહીં,
તે કારણો છે શાન જુદું, કર્મ જુદો-જિન કહે; ૩૮૭

રે ! ધર્મ તે નથી શાન, જેથી ધર્મ કંઈ જાગે નહીં,
તે કારણો છે શાન જુદું, ધર્મ જુદો-જિન કહે; ૩૮૮

અધર્મ તે નથી શાન, જેથી અધર્મ કંઈ જાગે નહીં,
તે કારણો છે શાન જુદું, અધર્મ જુદો-જિન કહે; ૩૮૯

રે ! કાળ તે નથી શાન, જેથી કાળ કંઈ જાગે નહીં,
તે કારણો છે શાન જુદું, કાળ જુદો-જિન કહે; ૪૦૦

આકાશ તે નથી શાન, જેથી આકાશ કંઈ જાગે નહીં,
તે કારણો છે આકાશ જુદું, શાન જુદું-જિન કહે; ૪૦૧

નહિ શાન અધ્યવસાન છે, જેથી અયેતન તેહ છે,
તે કારણો છે શાન જુદું, જુદું અધ્યવસાન છે. ૪૦૨

રે ! સર્વદા જાગે જ તેથી જીવ શાયક શાની છે,
ને શાન છે શાયકથી અબ્યતિરિક્ત ઈમ શાત્રવ છે. ૪૦૩

સમ્યક્ત ને સંયમ તથા પૂર્વાગત સૂત્રો અને
ધર્મધિરમ, દીક્ષા વળી, બુધ પુરુષ માને શાનને. ૪૦૪

શાસ્ત્ર જ્ઞાન નથી; કારણ કે શાસ્ત્ર કાંઈ જાણતું નથી; માટે જ્ઞાન અન્ય છે અને શાસ્ત્ર અન્ય છે - એમ જિનદેવો કહે છે.

શબ્દ જ્ઞાન નથી; કારણ કે શબ્દ કાંઈ જાણતું નથી; માટે જ્ઞાન અન્ય છે અને શબ્દ અન્ય છે - એમ જિનદેવો કહે છે.

રૂપ જ્ઞાન નથી; કારણ કે રૂપ કાંઈ જાણતું નથી; માટે જ્ઞાન અન્ય છે અને રૂપ અન્ય છે - એમ જિનદેવો કહે છે.

વર્ણ જ્ઞાન નથી; કારણ કે વર્ણ કાંઈ જાણતું નથી; માટે જ્ઞાન અન્ય છે અને વર્ણ અન્ય છે - એમ જિનદેવો કહે છે.

ગંધ જ્ઞાન નથી; કારણ કે ગંધ કાંઈ જાણતી નથી; માટે જ્ઞાન અન્ય છે અને ગંધ અન્ય છે - એમ જિનદેવો કહે છે.

રસ જ્ઞાન નથી; કારણ કે રસ કાંઈ જાણતો નથી; માટે જ્ઞાન અન્ય છે અને રસ અન્ય છે - એમ જિનદેવો કહે છે.

સ્પર્શ જ્ઞાન નથી; કારણ કે સ્પર્શ કાંઈ જાણતો નથી; માટે જ્ઞાન અન્ય છે અને સ્પર્શ અન્ય છે - એમ જિનદેવો કહે છે.

કર્મ જ્ઞાન નથી; કારણ કે કર્મ કાંઈ જાણતું નથી; માટે જ્ઞાન અન્ય છે અને કર્મ અન્ય છે - એમ જિનદેવો કહે છે.

ધર્મ જ્ઞાન નથી; કારણ કે ધર્મ કાંઈ જાણતો નથી; માટે જ્ઞાન અન્ય છે અને ધર્મ અન્ય છે - એમ જિનદેવો કહે છે.

અધર્મ જ્ઞાન નથી; કારણ કે અધર્મ કાંઈ જાણતો નથી; માટે જ્ઞાન અન્ય છે અને અધર્મ અન્ય છે - એમ જિનદેવો કહે છે.

કાળ જ્ઞાન નથી; કારણ કે કાળ કાંઈ જાણતો નથી; માટે જ્ઞાન અન્ય છે અને કાળ અન્ય છે - એમ જિનદેવો કહે છે.

આકાશ જ્ઞાન નથી; કારણ કે આકાશ કાંઈ જાણતું નથી; માટે જ્ઞાન અન્ય છે અને આકાશ અન્ય છે - એમ જિનદેવો કહે છે.

અધ્યવસાન જ્ઞાન નથી; કારણ કે અધ્યવસાન અચેતન છે; માટે જ્ઞાન અન્ય છે અને અધ્યવસાન અન્ય છે - એમ જિનદેવો કહે છે.

કારણ કે જીવ નિરંતર જાણે છે; માટે જ્ઞાયક એવો જીવ જ્ઞાની છે, જ્ઞાનસ્તપૃષ્ઠ છે અને જ્ઞાન જ્ઞાયકથી અવ્યતિરિક્ત છે, અભિજ્ઞ છે - આમ જાણવું જોઈએ.

સમ્બુદ્ધિ (જ્ઞાનીજન) જ્ઞાન ને જી સમ્બુદ્ધિ, સંયમ, અંગપૂર્વગત સૂત્ર, ધર્મ-અધર્મ (પુણ્ય-પાપ) અને દીક્ષા માને છે.

આચાર્ય અમૃતચંદ્ર આત્મમ્ખ્યાતિમાં આ ગાથાઓનો ભાવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે -

“શ્રુત (વચનાત્મક દ્રવ્યશ્રુત) જ્ઞાન નથી; કારણ કે શ્રુત અચેતન છે; તેથી જ્ઞાન અને શ્રુતને વ્યતિરેક (બિજ્ઞતા) છે. શબ્દ જ્ઞાન નથી; કારણ કે શબ્દ અચેતન છે; તેથી જ્ઞાનને અને શબ્દને વ્યતિરેક-બિજ્ઞતા છે. રૂપ જ્ઞાન નથી; કારણ કે રૂપ અચેતન છે; તેથી જ્ઞાનને અને રૂપને વ્યતિરેક-બિજ્ઞતા છે. વર્ણ જ્ઞાન નથી; કારણ કે વર્ણ અચેતન છે; તેથી જ્ઞાનને અને વર્ણને વ્યતિરેક-બિજ્ઞતા છે. ગંધ જ્ઞાન નથી; કારણ કે ગંધ અચેતન છે; તેથી જ્ઞાનને અને ગંધને વ્યતિરેક-બિજ્ઞતા છે. રસ જ્ઞાન નથી; કારણ કે રસ અચેતન છે; તેથી જ્ઞાનને અને રસને વ્યતિરેક-બિજ્ઞતા છે. સ્પર્શ જ્ઞાન નથી; કારણ કે સ્પર્શ અચેતન છે; તેથી જ્ઞાનને અને સ્પર્શને વ્યતિરેક-બિજ્ઞતા છે. કર્મ જ્ઞાન નથી; કારણ કે કર્મ અચેતન છે; તેથી જ્ઞાનને અને કર્મને વ્યતિરેક-બિજ્ઞતા છે. કર્મ જ્ઞાન નથી; કારણ કે કર્મ અચેતન છે; તેથી જ્ઞાનને અને કર્મને વ્યતિરેક-બિજ્ઞતા છે. અધર્મ જ્ઞાન નથી; કારણ કે અધર્મ અચેતન છે; તેથી જ્ઞાનને અને અધર્મને વ્યતિરેક-બિજ્ઞતા છે. કાળ જ્ઞાન નથી; કારણ કે કાળ અચેતન છે; તેથી જ્ઞાનને અને કાળને વ્યતિરેક-બિજ્ઞતા છે. આકાશ જ્ઞાન નથી; કારણ કે આકાશ અચેતન છે; તેથી જ્ઞાનને અને આકાશને વ્યતિરેક-બિજ્ઞતા છે. અધ્યવસાન જ્ઞાન નથી; કારણ કે અધ્યવસાન અચેતન છે; તેથી જ્ઞાનને અને અધ્યવસાનને વ્યતિરેક-બિજ્ઞતા છે.

આ પ્રમાણે જ્ઞાનનું બીજા બધા પરદ્વયો સાથે વ્યતિરેક નિશ્ચયસાધિત

બેંબું જોઈએ. તાત્પર્ય આ છે કે નિશ્ચયથી વિચાર કરતાં જ્ઞાન પરદ્રવ્યોથી બિન્ન જ છે.

હવે એમ નક્કી કરે છે કે જીવ એક જ્ઞાન જ છે; કારણ કે જીવ ચેતન છે; માટે જ્ઞાનને અને જીવને અવ્યતિરેક (અભેદ) છે.

આ વાતની ! જરાય શંકા કરવી ન જોઈએ કે જ્ઞાન અને જીવમાં કંઈ થોડો તો વ્યતિરેક (બિન્નતા) હશે; કારણ કે જીવ સ્વયં જ જ્ઞાન છે. આ પ્રમાણે જ્ઞાન અને જીવ અભિન્ન હોવાથી જ્ઞાન જ સમ્યગદાખ્યિ છે, જ્ઞાન જ સંયમ છે, જ્ઞાન જ અંગપૂર્વકૃપ સૂત્ર છે, જ્ઞાન જ ધર્મ-અધર્મ (પુણ્ય-પાપ) છે, જ્ઞાન જ પ્રવ્રજ્યા છે.

આપ્રમાણે જ્ઞાનનો જીવની પર્યાયો સાથે પણ અવ્યતિરેક (અભેદ) નિશ્ચયસાધિત દેખવો. તાત્પર્ય એ છે કે જીવપર્યાયોનો જીવની સાથે અભેદ નિશ્ચયથી જ છે.

આપ્રમાણે સર્વ પરદ્રવ્યો સાથે વ્યતિરેક વડે અને સર્વ દર્શનાદિ જીવસ્વભાવો સાથે અવ્યતિરેકવડે અતિવ્યાપ્તિને અને અવ્યાપ્તિને દૂર કરતું થકું; અનાદિ વિભાગ જેનું મૂળ છે એવા પુણ્ય-પાપ અને શુભ-અશુભકૃપ ધર્મ-અધર્માંક પરસમયને દૂર કરીને, પોતે જ નિશ્ચયચારિતકૃપ પ્રવ્રજ્યાને પામીને, દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતિકૃપ સ્વસમયને પ્રાપ્ત કરીને, મોક્ષમાર્ગને પોતામાં જ પરિણાત કરીને, જેણો સંપૂર્ણ વિજ્ઞાનધન-સ્વભાવને પ્રાપ્ત કર્યો છે - એવું ત્યાગ-ગ્રહણથી રહિત સાક્ષાત સમયસારભૂત, પરમાર્થકૃપ એક શુદ્ધજ્ઞાનને નિશ્ચળ દેખવું અર્થાત પ્રત્યક્ષ સ્વસંવેદનથી નિશ્ચળ અનુભવ કરવો જોઈએ.”

ગાથાઓ અને આત્મઘ્યાતિ ટીકાના અભિપ્રાયને પંડિત જ્યયચંદ્લ છાબડા ભાવાર્થમાં વિસ્તારથી આપ્રમાણે સ્પષ્ટ કરે છે -

“અહીં જ્ઞાનને સમસ્ત પરદ્રવ્યોથી બિન્ન અને પોતાની પર્યાયોથી અભિન્ન બતાવ્યું છે; તેથી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ નામના લક્ષણાદોષ દૂર થઈ ગયા. આત્માનું લક્ષણ ઉપયોગ છે અને ઉપયોગમાં જ્ઞાન પ્રધાન

છે; તે (જ્ઞાન) અન્ય અચેતન દ્રવ્યોમાં નથી; માટે તે અતિવ્યાપ્તિવાળું નથી અને પોતાની સર્વ અવસ્થાઓમાં છે; તેથી અવ્યાપ્તિવાળું નથી. આ પ્રમાણે જ્ઞાનલક્ષણ કહેતાં અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષ આવતો નથી.

અહીં જ્ઞાનને જ પ્રધાન કરીને આત્માનો અધિકાર છે; કારણ કે જ્ઞાનલક્ષણથી જ આત્મા સર્વ પરદ્રવ્યોથી બિન્ન અનુભવગોચર થાય છે.

આમ તો આત્મામાં અનંત ધર્મ છે, છતાં તેમાંથી કેટલા તો છિદ્રસ્થને અનુભવગોચર જ નથી. તે ધર્મોને કહેતાં છિદ્રસ્થ જ્ઞાની આત્માને કેમ ઓળખી શકે? અને કેટલાક ધર્મતો અનુભવગોચર છે; પરંતુ તેમાંથી કેટલાય તો અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ આદિ તો - અન્ય દ્રવ્યો સાથે સામાન્ય અર્થાત् સમાન જ છે; તેથી તેમને કહેતાં પૃથક આત્મા જાણી શકતો નથી અને કેટલાય (ધર્મ) પરદ્રવ્યના નિમિત્તથી થયા છે; તેમને કહેતાં પરમાર્થભૂત આત્માનું શુદ્ધસ્વરૂપ કેમ જાણી શકાય? તેથી જ્ઞાન એમ કહેતાં જ છિદ્રસ્થ જ્ઞાની આત્માને ઓળખી શકે છે.

અહીં જ્ઞાનને આત્માનું લક્ષણ કહ્યું છે - એટલું જ નહીં, પરંતુ જ્ઞાનને જ આત્મા કહ્યો છે; કારણ કે અભેદવિવક્ષામાં ગુણ-ગુણીનો અભેદ હોવાથી જ્ઞાન છે તે આત્મા જ છે. અભેદવિવક્ષાથી ચાહે જ્ઞાન કહો યા આત્મા કોઈ વિરોધ નથી; તેથી અહીં જ્ઞાન કહેતાં આત્મા જ સમજવું જોઈએ.

દીકાના અંતમાં એમ કહ્યું છે કે પોતામાં અનાદિ અજ્ઞાનથી થનારી શુભાશુભ ઉપયોગરૂપ પરસમયની પ્રવૃત્તિને દૂર કરીને, સમ્યગુદ્ધર્ણન-જ્ઞાન-ચારિત્રમાં પ્રવૃત્તિરૂપ સ્વસમયને પ્રાપ્ત થઈને, તે સ્વસમયરૂપ પરિણામનસ્વરૂપે મોક્ષમાર્ગમાં પોતાને પરિણામાવીને જે સંપૂર્ણ વિજ્ઞાનસ્વભાવને પ્રાપ્ત થયો છે અને જેમાં કંઈ ત્યાગ-ગ્રહણ નથી, એવા સાક્ષાત્ સમયસારસ્વરૂપ, પરમાર્થભૂત, નિશ્ચળ રહેતા, શુદ્ધ પૂર્ણ જ્ઞાનને (પૂર્ણ આત્મદ્રવ્યને) દેખવું.

અહીં 'દેખવું' ત્રણ પ્રકારે સમજવું જોઈએ.

૧. શુદ્ધનયનું જ્ઞાન કરીન પૂર્ણ જ્ઞાનનું શ્રદ્ધાન કરવું તે પહેલા પ્રકારનું દેખવું છે. તે અવિરત આદિ અવસ્થામાં પણ હોય છે.
૨. જ્ઞાન-શ્રદ્ધાન થયા બાદ સર્વ પરિગ્રહનો ત્યાગ કરીને તેનો (પૂર્ણ જ્ઞાનનો) અભ્યાસ કરવો, ઉપયોગને જ્ઞાનમાં સ્થિર કરવો. જેવું શુદ્ધનયથી પોતાના સ્વરૂપને સિદ્ધ સમાન જાણ્યું-શ્રદ્ધયું હતું તેવું જ ધ્યાનમાં લઈને ચિત્તને એકાગ્ર-સ્થિર કરવું અને ફરી ફરી તેનો જ અભ્યાસ કરવો, તે બીજા પ્રકારનું દેખવું છે.
આ પ્રમાણેનું દેખવું અપ્રમતદશામાં થાય છે. જ્યાં સુધી તે પ્રકારના અભ્યાસથી કેવળજ્ઞાન ઉત્પન્ન ન થાય, ત્યાંસુધી આવો અભ્યાસ નિરંતર રહે છે, આ દેખવાનો બીજો પ્રકાર થયો.
૩. જ્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યારે સાક્ષાત્ દેખવું થાય છે.

તે બીજા પ્રકારે દેખવું છે. તે સ્થિતિમાં જ્ઞાન સર્વ વિભાવોથી રહિત થયું થકું સર્વનું જ્ઞાતા-દાટા છે, તેથી આ બીજા પ્રકારનું દેખવું તે પૂર્ણ જ્ઞાનનું પ્રત્યક્ષ દેખવું છે.

આ બધાનો ભાવ પૂજય ગુરુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે :

“અહીં કહે છે - દ્રવ્યશ્રુત જ્ઞાન નથી, ભગવાનની વાણી જ્ઞાન નથી, આત્મા નથી; કારણ કે તે અચેતન છે.

પ્રશ્ન:- ધ્વલામાં તો એમ કહ્યું છે કે ‘ભગવાનની વાણીમાં ભાવશ્રુતથી ઉપદેશ આવ્યો છે, તેનો શો અર્થ છે ?’

ઉત્તર:- હા, વાણી તો જરૂર છે, પરંતુ વાણીના સાંભળનાર વાણીને સાંભળીને અંતર્મુખ થઈને ભાવશ્રુતકૃપે પરિણમે છે ને ? બસ તે જ કારણે ભગવાનની વાણીમાં ભાવશ્રુતથી ઉપદેશ આપવામાં આવ્યો છે - એમ કહેવાય છે, વાણી ભાવશ્રુત નથી વાણીમાં કેવળજ્ઞાન પણ નથી. વાણી તો દ્રવ્યશ્રુત છે, અચેતન છે.”

ધ્વલામાં એવો પાઠ છે કે ભગવાન ભાવશ્રુતથી પ્રકૃપણા કરે છે, કેવળજ્ઞાનથી નહીં. તેનું તાત્પર તો એ છે કે શ્રોતા પોતે પોતાની અંદર સ્વરૂપમાં લક્ષ્ય કરે છે, ત્યારે તેને ભાવશ્રુતજ્ઞાન પ્રગટ થાય છે. તેમાં ભગવાનની હિવ્યધ્વનિ નિમિત્ત છે. બસ, આ જ કારણે હિવ્યધ્વનિને ભાવશ્રુતથી પ્રકૃપણા કરી આમ કહેવામાં આવ્યું છે. ભગવાનને તો કેવળજ્ઞાન છે પરંતુ વાણીમાં ભાવશ્રુતનો ભાવ શ્રોતાઓને પ્રાપ્ત થાય છે. આ કારણથી ભાવથી પ્રકૃપણા કરી - એમ કહેવામાં આવ્યું છે.

ત્યાં હિવ્યધ્વનિમાં જે પણ નિરક્ષરી ધ્વનિ નીકળે છે; તે તો જડ છે. તે ભાવશ્રુતકૃપ નથી. તે ઉંઘનિથી જે જ્ઞાન થાય છે; તે પણ જડ છે, અચેતન છે. તે જ સમયે જે જ્ઞાન પોતાના ચૈતન્યજ્યોતિસ્વરૂપ ભગવાન આત્માના લક્ષ્યે પ્રગટ થાય છે, તે જ્ઞાન જ વાસ્તવિક જ્ઞાન છે. તે આત્મજ્ઞાન છે, સમ્યગ્જ્ઞાન છે, ભાવશ્રુતજ્ઞાન છે.^૧

જુઓ, હવે કહે છે કે જીવ જ જ્ઞાન છે; કારણ કે જ્ઞાન ચેતન છે અને જીવ પણ ચેતન છે. અહીં જ્ઞાન અને જીવની એકતામાં અભિપ્રાતા બતાવવામાં આવી છે. જ્ઞાન અને જીવ આપ્રમાણે બે શબ્દોની બિજ્ઞ-બિજ્ઞ ધ્વનિ ઉઠે છે, તેથી એવો ભ્રમ થાય છે કે જ્ઞાન અને જીવ બંને જુદા-જુદા હશે - લોકો એમ સમજે છે; પરંતુ એવી શંકા કરવી ન જોઈએ. ભગવાન આત્મા ભાવવાન અને જ્ઞાન ભાવ-આમ ભાવ અને ભાવવાન બંનેને જુદા-જુદા નહીં, એક જ સમજવા જોઈએ; કારણ કે બંને વસ્તુપણે એક જ છે. નામ જુદા-જુદા બે છે, પણ વસ્તુ બે નથી. જીવ અને જ્ઞાન-આવા બે નામ હોવા છીતાં પણ વસ્તુ તાદીતભૂતે એક જ છે.^૨

હવે કહે છે કે જ્ઞાન જ સમ્યગ્દર્શિ છે. અહીં પ્રશ્ન છે કે જે સમ્યગ્દર્શિ છે તે આત્મા છે કે નહીં? ઉત્તરમાં કહ્યું છે કે હા, આત્મા જ સમ્યગ્દર્શિ છે; કારણ કે આત્માથી જુદું તો કોઈ સમ્યગ્દર્શન નથી.

^૧ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૧૩૮

^૨ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૧૪૧-૧૪૨

આહા ! આત્મા પૂર્ણ જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ છે. તે જ્ઞાનમાં જોય થતાં તેની પ્રતીતિ થઈ કે 'આ હું છું' બસ, એ જ તો સમ્યગ્દર્શન છે. આ સમ્યગ્દર્શન આત્મસ્વરૂપ છે. સમ્યગ્દર્શન કોઈ જુદી વસ્તુ છે અને આત્મા જુદો છે - એવું નથી; તેથી કહે છે કે જ્ઞાન જ સમ્યગ્દર્શિ છે. અહીં જ્ઞાન શબ્દથી અભેદરૂપ આત્મા જ કહ્યો છે. આ રીતે એ સ્પષ્ટ છે કે આત્મા જ સમ્યગ્દર્શન અથવા સમ્યગ્દર્શિ છે; કારણ કે આત્માથી બિન્ન કોઈ અલગ સમ્યગ્દર્શન નથી, સમ્યગ્દર્શિ નથી.

હવે કહે છે કે જ્ઞાન જ સંયમ છે. જ્ઞાન અર્થાત્ આત્મા જ સંયમ છે. પાંચે ઈન્ડિયોના વિષયોને ત્યાગવા અને મનને જીતવું - આ તો નાસ્તિથી સંયમની વાત છે. અસ્તિથી તો જ્ઞાન અર્થાત્ આત્મામાં જ રમવાનું નામ સંયમ છે અને તે સંયમ આત્મા જ છે. સંયમની વીતરાગી પર્યાયકૃતે આત્મા જ પરિણામે છે ને ? તેથી આત્મા જ સંયમ છે.^૧

જુઓ, અહીં સમ્યગ્દર્શન, સંયમ આદિ પર્યાયોને આત્મા કહ્યો છે, જ્યારે ગાથા ૧૧માં તેને વ્યવહાર કહીને અભૂતાર્થ કહ્યો છે. નિયમસારની ૩૮મી ગાથામાં પુણ્ય-પાપ, આસ્રવ-બંધ, સંવર-નિર્જરા અને મોક્ષ સહિત જેટલી પર્યાયો છે તે બધાને પરદ્રવ્ય કહીને હેઠ કહી છે.

પ્રશ્ન:- આ બંને કથનોમાં કયું કથન સત્ય છે ?

ઉત્તર:- પોતપોતાની અપેક્ષાથી બંને જ કથન સત્ય છે. ભાઈ ! અનેકાંતથી બધું સિદ્ધ થાય છે.^૨

આત્માનું સ્વયં પોતામાં જ સ્થિર થઈ જવું, જમી જવું તે જ સંયમ છે, જ્ઞાન જ સંયમ છે. આ દેહની કિયા અને દ્વા, દાન, વ્રત, તપ આદિ કિયાકંડના વિકલ્પ સંયમ નથી.^૩

બાર અંગાનું જ્ઞાન માત્ર શબ્દો સુધી સીમિત નથી, સ્વતાં આત્મયથી જે સમ્યગ્જ્ઞાન પ્રગટ થાય છે, તે ભાવશ્રુતજ્ઞાન અંગપૂર્વકૃપ સૂત્ર છે.

૧ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૧૪૨

૨ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૧૪૩-૧૪૪

૩ તે જ, પાનું ૧૪૪

હવે કહે છે કે જ્ઞાન જ ધર્મ-અધર્મ અર્થાત્ પુણ્ય-પાપ છે. જુઓ, પુણ્ય-પાપ આત્માની પર્યાયમાં થાય છે, માત્ર આ અપેક્ષાથી તેમને આત્મા કહ્યા છે, પરંતુ વિભાગ તેની ઉત્પત્તિનું મૂળ છે. ભલે ને જીવની પર્યાયમાં ઉત્પન્ન થયા છે; છતાં તે પરસ્સતાયાંબી ભાવે હેઠાથી બંધનકૃપ જ છે, બંધનું જ કારણ છે.

પ્રશ્ન:- જ્યારે તે પરાવલંબી છે અને બંધનું કારણ છે, તો પછી તેમને આત્મા કહેવાનું શું પ્રયોજન છે ?

ઉત્તર:- ભાઈ ! અહીં સ્વના દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વકીય છે, પરથી બિન્ન છે; પરંતુ પરદ્રવ્યકૃપ નથી - આમ સિદ્ધ કરવું છે, તેથી આ જીવની પર્યાયમાં જે શુભાશુભભાવ થાય છે, તેમને અહીં આત્મા કહ્યા છે. આત્માની પર્યાય પણ આત્મા - આ શૈલીથી અહીં વાત કરી છે. તેથી જ સમ્યગ્દર્શન, સંયમ, અંગપૂર્વસૂત્રની નિર્મળ પર્યાય અને ધર્મ-અધર્મ (પુણ્ય-પાપ) ની વિભાવકૃપ મળિન પર્યાયોને અહીં આત્મા કહી છે.^૧

જીવ અનાદિથી શુભાશુભભાવ કરતો આવ્યો છે, આ શુભાશુભભાવ અનાદિ-સાંત છે. આટલા લાંબા સમયથી અશુદ્ધતા રહી, જે તેને માનીએ જ નહીં તો ગુણ જ સિદ્ધ નહીં થાય અને દ્રવ્ય પણ સિદ્ધ નહીં થાય. ગુણોનું અશુદ્ધ પરિણામન થવું તે તેમની તત્ત્વસમયની યોગ્યતા છે. જે આ બધાના અશુદ્ધ પરિણામનને ન માનવામાં આવે તો નિકાળી ગુણ જ સિદ્ધ નહીં થાય; તો પછી તે ગુણોના સમુહ દ્રવ્યની સિદ્ધિ કેમ થશે ?^૨

પ્રવચનસારના નય અધિકારમાં એવું કથન છે કે શુદ્ધ અને અશુદ્ધ પરિણામોનો અધિષ્ઠાતા આત્મા છે અને અહીં પણ એમજ કહ્યું છે કે જ્ઞાન જ સમ્યગ્દર્શિ છે, જ્ઞાન જ સંયમ છે, જ્ઞાન જ ધર્મ-અધર્મ છે. અહીં તો વર્તમાન વર્તતી પર્યાયને આત્માની કહેવી છે ને ? ભાઈ ! અહીં કઈ અપેક્ષાથી કહેવાઈ રહ્યું છે - તે સમજવું બહુ જરૂરી છે.^૩

૧ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૧૪૪-૧૪૫

૨ સમયસાર ભાગ ૧૦, પાનું ૧૪૬

૩ તે જ, પાનું ૧૪૭-૧૪૮

અહીં એમ સિદ્ધ કરવું છે કે જ્ઞાન અર્થાત્ આત્મા જ પુણ્ય-પાપ છે; કારણ કે ત્રિકાળીદ્રવ્ય (અંશી)ના અંશ (પર્યાય)માં આ ભાવ ઉત્પન્ન થાય છે.

ત્રિકાળી દ્રવ્ય આત્મવસ્તુ સામાન્યસ્વરૂપ છે અને નિર્મળ અને મલિન પર્યાય તેનું વિશેષ સ્વરૂપ છે. સામાન્ય અને વિશેષ મળીને જ સંપૂર્ણ વસ્તુ થાય છે. જે આ વસ્તુના એક પર્યાય અંશને કાઢી નાખીએ તો વસ્તુ જ અધૂરી રહી જશે. અખંડ વસ્તુની સિદ્ધ જ સંભવ નહીં થાય. જ્યારે અહીં તો એમ સિદ્ધ કરવું છે કે દ્રવ્ય-પર્યાય બંને જ જીવનું સ્વરૂપ છે; તેથી કહ્યું છે કે આત્મા જ સંયમ છે, આત્મા જ પુણ્ય-પાપ છે.

હવે કહે છે કે જ્ઞાન જ પ્રવ્રજ્યા (દીક્ષા) છે. માત્ર નગનદ્દશા ધારણ કરીને સ્થુલરૂપે મહાવ્રતાદિનનું પાલન કરવું તે દીક્ષા નથી. વિષય-કખાયમાં અટકી રહેવું તો વિશુદ્ધ પાપ છે જ; પરંતુ માત્ર દ્વા-દાન અને વ્રતાદિના શુભભાવ પણ રાગ જ છે. આ દ્વા-દાનાદિના પરિણામ તો પરસમય છે, તેમનું લક્ષ્ય છોડીને પોતાના સ્વસમયમાં આવો - એવું અહીં કહ્યું છે; કારણ કે આત્મા જ પ્રવ્રજ્યા છે. આત્માને છોડીને કોઈ પ્રવ્રજ્યાનું, ચારિત્રનું સ્વરૂપ જ નથી. નિર્મળાનંદ પ્રભુ આત્મા સ્વયં જ ચારિત્ર છે. ચૈતન્યધન પ્રભુ આત્મા સ્વયં જ પ્રવ્રજ્યા છે. સ્વ-સ્વરૂપમાં અંતર્લીનિ થયેલી દશા ચારિત્ર છે અને તે સ્વયં આત્મા જ છે. તેમાં રાગનું આલંબન નથી.

આ પ્રમાણે જ્ઞાનનો જીવપર્યાયોની સાથે અવ્યતિરેક નિશ્ચયસાધિત જેવો. અહીં 'જ્ઞાન' શબ્દ આત્માના અર્થમાં ગ્રહણ કરવો. મલિન અને નિર્મળ પર્યાયોની સાથે આત્માની બિજ્ઞતા નથી, અબિજ્ઞતા છે - આમ નિશ્ચયથી સિદ્ધ થયેલ જાણવું. પર્યાયમાં જે શુદ્ધતા-અશુદ્ધતા છે, તે આત્મા જ છે - આમ જાણવું.

હવે કહે છે કે સર્વ પરદ્રવ્યોની સાથે આત્માની બિજ્ઞતા છે. આ શરીર-મન-વાણી, ઈદ્રિયો, આઠ કર્મ અને દેવ-શાસ્ત્ર-ગુરુ આદિ

પરપદાર્થોથી જ્ઞાનની (આત્માની) બિજ્ઞતા છે, પૃથક્તતા છે અને દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ જીવસ્વભાવની સાથે અવ્યતિરેક (અભિજ્ઞ) છે, એકડ્ર્યપ છે. આ પ્રમાણે અતિવ્યાપ્તિ અને અવ્યાપિત દોષોને દૂર કરીને શુદ્ધ એક પરમાર્થડ્ર્યપ જ્ઞાનનો પ્રત્યક્ષ સ્વ-સંવેદનથી અનુભવ કરવો.^૧

જે દ્રવ્યદાચિના વિષયની અપેક્ષાથી વાત હોય તો પુણ્ય-પાપના પરિણામ પુછુગલના પરિણામ છે. આમ કહેવામાં આવે છે; પરંતુ આ કથનથી કોઈ એકાંત એમ માની લે કે તે જીવની પર્યાયમાં થયા જ નથી; તો એમ માનવું સાચું નથી.

દ્રવ્યદાચિની અપેક્ષા પુણ્ય-પાપના ભાવ પણ જરૂર છે, અજીવ છે-આમ કહીને પુછુગલ તેનો સ્વામી છે. આમ કહું છે અને પર્યાયની અપેક્ષાએ જીવની પર્યાયમાં વ્યાપ્ત છે, તેથી જીવ જ છે - એમ કહું છે. વસ્તુનું આવું અનેકાંતમય સ્વર્દ્ર્યપ છે.^૨

આત્માનું લક્ષણ ઉપયોગ છે. આ લક્ષણથી લક્ષ્ય (આત્મા) જાણી શકાય છે. જુઓ, ભગવાન આત્મા વ્યવહારરત્નત્રયના રાગથી જાણી શકાતો નથી. તે તો જ્ઞાનલક્ષણથી જ જાણી શકાય છે. અહીં ઉપયોગમાં જ્ઞાનની મુખ્યતાથી વાત કરી છે, દર્શનની અપેક્ષાએ અહીં વાત કરી નથી. જ્ઞાન અન્ય અચેતન દ્રવ્યોમાં નથી તથા બધાય આત્મામાં છે, તેથી આ જ્ઞાનલક્ષણ જ જીવનું નિર્દોષ લક્ષણ છે.

અહીં જ્ઞાનપ્રધાન આત્માનો અધિકાર છે; કારણ કે જ્ઞાનલક્ષણથી જ આત્મા સર્વ પરદ્રવ્યોથી બિજ્ઞ અનુભવગોચર થાય છે. જે કે આત્મામાં અનંત ધર્મ છે, છતાં પણ જ્ઞાન જ પ્રધાન છે; કારણ કે

૧ ધર્મ તો છિદ્રસ્થને અનુભવગોચર જ નથી. તે ધર્મોને કહેવાથી, ઉલ્લેખ કરવાથી આત્માને કેમ ઓળખી શકાય ?

૧ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૧૪૬-૧૫૦

૨ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૧૫૧-૧૫૨

૨. જે કોઈ થોડા ધર્મ અનુભવગોચર છે, તે બધા દ્રવ્યોમાં સામાન્ય છે. જેમકે અસ્તિત્વ-વસ્તુત્વ આદિ. આ સર્વ દ્રવ્યોમાં પણ સમાનદ્વારે જેવામાં આવે છે. તેથી તેના વહે પણ આત્માની ઓળખાણ થઈ શકતી નથી.
૩. અમુક ધર્મ, જે પરદ્રવ્યોના નિમિત્તથી થયેતા નૈમિત્તિક ભાવ છે. જેવા કે પુણ્ય-પાપ આદિ વિભાવ. ખરેખર તો તે ઔપાધિકભાવ છે. તેમનાથી પણ શુદ્ધાત્મસ્વરૂપની ઓળખાણ થઈ શકતી નથી.

તેથી એમ નિર્ણય થયો કે જ્ઞાન કહેવાથી જ્ઞાની આત્માની ઓળખાણ થઈ શકે છે; કારણ કે જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ હોવાથી નિર્દોષ નિબોધ લક્ષણ છે, તેથી આત્માના અધિકારમાં જ્ઞાન પ્રધાન છે.¹

ઉક્ત સંપૂર્ણ વિશ્લેષણ પર દર્શિપાત કરતાં એક વાત અત્યંત સ્પષ્ટદ્વારે જણાય છે કે આ ગાથાઓમાં એ બધા પરપદાર્થોને જ્ઞાનસ્વભાવી આત્માથી બિન્ન બતાવવામાં આવ્યા છે; જે છે તો જોય; પણ જેમને ભ્રમથી જ્ઞાન સમજી લેવામાં આવે છે.

પાછળની ગાથાઓમાં શુભાશુભક્રિયાઓ અને શુભાશુભભાવોના કર્તૃત્વ-ભોક્તૃત્વનો નિષેધ કરવામાં આવ્યો છે અને અહીં આ ગાથાઓમાં જોયપદાર્થોની સાથેના એકત્વ-મભત્વનો નિષેધ કરવામાં આવી રહ્યો છે.

શાસ્ત્ર, શબ્દ, ડ્ર્યુ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, કર્મ, ધર્મ, અધર્મ, કાળ, આકાશ અને અધ્યવસાન (મિથ્યાત્ત્વ) આ બધામાં જ્ઞાનત્વ (આત્માપણા)નો નિષેધ કરવામાં આવ્યો છે.

તે બધા આત્માના જોય છે. તેમની સાથે આત્માનો જોય-જ્ઞાયક સંબંધ સિવાય બીજે કોઈ સંબંધ નથી; છતાં પણ અજ્ઞાનીજન તેમનામાં પોતાપણું સ્થાપિત કરી લે છે; પરંતુ જ્ઞાનીજન એ સ્પષ્ટ રીતે જાણે છે કે તેમના સાથે આત્માનો કંઈ પણ સંબંધ નથી.

¹ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૧૫૪-૧૫૫ . . .

આ જે પરપદાર્થ જાળવામાં આવે છે; તેમને જાળવું એ પણ આત્માના સહજસ્વભાવનું જ સહજ પરિણામન છે.

આ ગાથાઓમાં કોઈપણ રૂપે આ ધ્વનિ નીકળતી નથી કે આત્મા તેમને જાળતો જ નથી અથવા તેમને જાળવાનો આત્માનો સ્વભાવ નથી; વિભાવ છે, અપરાધ છે.

બીજુ આ વાત ધ્યાન આપવા જેવી છે કે અંતિમ ગાથામાં સર્વદર્શિન, અંગપૂર્વગત સૂત્ર, સંયમ, ધર્મ-અધર્મ અને પ્રવજ્યાને આત્માથી અનન્ય અર્થાત્ આત્મા જ કહેવામાં આવ્યા છે. ગજબની વાત તો એ છે કે પરદ્રવ્યોથી બિજ્ઞતા અને પોતાની પર્યાયોથી અભિજ્ઞતા - એ બંનેને જ નિશ્ચયસાધિત કરીને નિશ્ચયનયનું કથન બતાવવામાં આવ્યું છે. તેના જ આધારે અર્થાત્ સર્વ પરદ્રવ્યોથી વ્યતિરેક અને સર્વદર્શિનાંદિ લુલસ્વભાવોથી અવ્યતિરેક વડે અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષોથી રહિતપણું સિદ્ધ કરીને નિશ્ચળ અનુભવ કરવાની પ્રેરણા આપવામાં આવી છે.

ઉક્ત સંદર્ભમાં પૂજ્ય ગુરુદેવે વિસ્તારથી પ્રકાશ પાથથો છે; જેનો અમૃક મહત્વપૂર્ણ અંશ આગળ ઉદ્ઘૃત કરવામાં આવ્યો જ છે, જેમને વિશેષ જિજ્ઞાસા હોય તેઓ પ્રવચન રત્નાકર ભાગ ૧૦માં ઉક્ત પ્રકરણનું ઉંડાણથી અધ્યયન કરે.

મૂળ વાત આ છે કે સંપૂર્ણ પ્રકરણમાં પરજોયોથી બિજ્ઞતાની જ વાત મુખ્ય છે; તેમને આત્મા જાળતો જ નથી, એ વાત બિલ્કુલ જ નથી.

આમ તો આચાર્ય જ્યસેન પણ તાત્પર્યવૃત્તિમાં આ ગાથાઓનો અર્થ આત્મઘ્યાતિની જેમ જ કરે છે; આટલે સુધી કે ત્યાં આત્મઘ્યાતિના કળશોને પણ ઉદ્ઘૃત કરે છે; છતાં પણ અંતમાં પ્રશ્નોત્તરના માધ્યમથી જે સ્પષ્ટીકરણ પ્રસ્તુત કરે છે; તે આ પ્રમાણે છે -

“જે અહીં કોઈ એમ પ્રશ્ન કરે કે સંયમ, પ્રવજ્યા આદિ તો તપાચરણકૃપ છે, તેમને ક્યા નયથી શાન માનવામાં આવે છે તો તેના ઉત્તરમાં કહે છે કે ભિદ્યાત્વ નામના પ્રથમ ગુણસ્થાનથી માંડીને ક્ષીણિકખાય

નામના બારમા ગુણસ્થાન સુધી પ્રત્યેક ગુણસ્થાનને યોગ્ય શુભોપયોગ, અશુભોપયોગ અને શુદ્ધોપયોગની સાથે અવિનાભાવ રાખનારા અશુદ્ધ-ઉપાદાનકૃપ વિવક્ષિત અશુદ્ધ-નિશ્ચયનયથી તપાચરણને જ્ઞાન માનવામાં આવે છે.

તેથી એમ સિદ્ધ થયું કે શુદ્ધ-ઉપાદાનકૃપ શુદ્ધપારિણામિક-પરમભાવગ્રાહક શુદ્ધદ્રવ્યાર્થિકનયથી જીવાદિ વ્યવહારિક નવ પદાર્થોથી બિજ્ઞ; આદિ, મધ્ય અને અંતથી રહિત એક, અખંડ પ્રતિભાસમય, સર્વ પ્રકારે ઉપાદેયભૂત, સહજશુદ્ધ નિજ નિરંજન પરમ સમયસાર નામનું શુદ્ધજ્ઞાન સ્વભાવવાળું શુદ્ધાત્મતત્વ જ શ્રદ્ધા કરવા યોગ્ય છે, પોતાપણું સ્થાપિત કરવા યોગ્ય છે, જણવા યોગ્ય છે; તેથી તેનું જ ધ્યાન કરવું જેઈએ.”

આચાર્ય જ્યસેને અહીં આવતાં આ ગાથાઓની ટીકા સમાપ્ત કરીને લખી દીધું કે આપ્રમાણે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, બંધ, સંલર, નિર્જરા અને મોક્ષ - આ વ્યવહારિક નવ તત્ત્વોમાં ભૂતાર્થનયથી એક શુદ્ધ જીવ જ સ્થિત છે - આ કથનની મુખ્યતાથી અગિયારમા સ્થાનની પંદર ગાથાઓ પૂર્ણ થઈ.

તે ઉપરાંત કિંચ લખીને કંઈક મહત્વપૂર્ણ પ્રમેય ઉપસ્થિત કરે છે; જે ૩૨૦ મી ગાથા બાદ આપેલા પ્રમેયોની સમાન જ મહત્વપૂર્ણ અને ધ્યાન આપવા યોગ્ય છે. તે મૂળ કથન આ પ્રમાણે છે.

“મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યજ્ઞાન અને કેવળજ્ઞાન - આ પાંચ જ્ઞાન પર્યાયકૃપ છે અને શુદ્ધપારિણામિકભાવ દ્રવ્યકૃપ છે. જીવ પદાર્થ ન એકલા દ્રવ્યકૃપ છે અને ન તો એકલી પર્યાયકૃપ; પરંતુ પરસ્પર સાપેક્ષ દ્રવ્ય-પર્યાયકૃપ ઘર્મોનો ઘર્મી છે.

હવે અહીં આ વાતનો વિચાર કરે છે કે મોક્ષ ક્યા જ્ઞાનથી થાય છે ?

કેવળજ્ઞાન તો ફળકૃપ છે અને તે તો ભવિષ્યમાં થશે અને હમણાં

આપણી પાસે છે જ નહીં. અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન બંને મૂર્તિ વિષયોને જ જાણવાને કારણે અમૃત આત્માને જાણવામાં અસમર્થ છે; કારણ કે મહાશાસ્ત્ર તત્ત્વાર્થસુત્રમાં રૂપિષ્વવદ્ધે: , તદનંતભાગે મન:પર્યાયસ્ય- અવધિજ્ઞાનનો વિષય રૂપી પદાર્થ જ છે અને મન:પર્યાયજ્ઞાનનો વિષય અવધિજ્ઞાનના વિષયનો જ અનંતમો ભાગ સુક્ષમ પુદ્ગલ જ છે - આમ લઘ્યું છે. તેથી આ અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાનથી પણ મોકણી પ્રાપ્તિ સંભવ નથી.

તેથી સહજ સામર્થ્યથી જ વાત સિદ્ધ થાય છે કે બાહ્ય વિષયોમાં વિકલ્પથી રહિત સ્વશુદ્ધાત્માભિમુખ - પારિચિદત્તિ લક્ષણવાળા નિશ્ચય નિર્વિકલ્પ ભાવકૃપ માનસ અને પંચેન્દ્રિયોના વિષયોથી પાર અતીન્દ્રિય શુદ્ધપારિણામિકભાવ-વિષયકભાવનાકૃપ નિર્વિકાર સ્વસંવેદન શબ્દથી વાચ્ય વિશિષ્ટ ભેદજ્ઞાનકૃપ અને ક્ષાયોપશમિકભાવકૃપ મતિશ્રુતજ્ઞાન જ મુક્તિનું કારણ છે, કારણ કે સંસારીઓને ક્ષાયિકજ્ઞાન તો છે જ નહીં.

પ્રશ્ન:- સંસારી જીવોને નિશ્ચયસ્વસંવેદનકૃપ મતિ-શ્રુત નામનું ક્ષાયોપક્ષમિકજ્ઞાન મુક્તિનું કારણ કેવી રીતે છે ?

ઉત્તર:- સમસ્ત ભિથ્યાત્વરાગાદિકૃપ વિકલ્પોની ઉત્પત્તિથી રહિત, સ્વશુદ્ધાત્મભાવનાથી ઉત્પન્ન, પરમ આલહાદલક્ષણવાળા સુખકૃપી અમૃતરસના સ્વાદમાં એકાકાર, પરમસમરસીભાવથી કાર્યભૂત અનંત જ્ઞાન સુખાદિકૃપ મોકણા ફળનો વિવક્ષિત એકદેશ શુદ્ધનિશ્ચયનયથી શુદ્ધ ઉપાદાનકારણકૃપ હોવાથી તે ક્ષાયોપક્ષમિક-મતિ-શ્રુતજ્ઞાન મુક્તિનું કારણ છે.

આ વાતની પુછ્યિ આત્મભ્યાતિમાં સમાગત નીચેના કળશથી પણ થાય છે.

ભેદવિજ્ઞાનત: સિદ્ધા: સિદ્ધા: યે કિલ કેચન ।

અસ્યૈવાભાવતો બદ્ધા બદ્ધા યે કિલ કેચન ॥૧૩૧॥

(હરિગીત)

જે કોઈ સિદ્ધ થયા, થયા તે બેદજાન-પ્રભાવથી,
જે કોઈ બદ્ધ રહ્યા, રહ્યા તે બેદભાન-અભાવથી. ૧૩૧

આજ સુધી જેટલા પણ જીવો સિદ્ધ થયા છે, તે બધા બેદજાનથી
જ થયા છે અને જેટલા પણ સંસારમાં બંધાયેલા છે, તે બધા બેદભાનના
અભાવથી જ બંધાયેલા છે.”

આચાર્ય જ્યસેનના ઉકિત કથનમાં આ વાત તો અત્યંત સ્પષ્ટ
છે કે મુક્તિની પ્રાપ્તિ એકમાત્ર જ્ઞાનથી જ થાય છે; પણ તે જ્ઞાન
આત્માનુભૂતિકૃપ હોવું જોઈએ. તાત્પર્ય એ છે કે તેમાં શ્રદ્ધાનું બળ અને
આત્મરમણતાપૂર્વક ચારિત્ર પણ સાથે હોવું જોઈએ.

અહીં એક પ્રક્રિયા સહજ જ સંભવે છે કે જે જ્ઞાન જ મુક્તિનું કારણ
છે તો જ્ઞાન તો પાંચ પ્રકારનું છે; તેમાંથી ક્યું જ્ઞાન મુક્તિનું કારણ છે?

આચાર્યદિવ સમજલવતાં કહે છે કે કેવળજ્ઞાન તો એક પ્રકારે મોક્ષકૃપ
જ છે અને તે આપણી પાસે છે જ કયાં? અવધિજ્ઞાન અને મન:પર્યજ્ઞાનનો
વિષય પુછ્છાલ છે; તેથી તેમના માધ્યમથી આત્મજ્ઞાન સંભવ જ નથી.

હવે રહ્યા મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન. તો એમના દ્વારા છ્યે દ્રવ્યોને
તેમની અમુક પર્યાયો સાથે જણી શકાય છે; પરંતુ પરને જણાવું મુક્તિના
માર્ગમાં કંઈ પણ કાર્યકરી નથી; તેથી આત્મસન્મુખ થયેલા મતિ-શ્રુતજ્ઞાન
જ મુક્તિનું કારણ છે; પરંતુ તે આત્મશ્રદ્ધાન અને આત્મધ્યાનથી સંયુક્ત
હોવા જોઈએ.

તેથી આપણું પરમ કર્તવ્ય છે કે આપણે મતિ શ્રુતજ્ઞાનપૂર્વક
ઉપલબ્ધ ક્ષયોપક્ષમ જ્ઞાનને બુદ્ધિપૂર્વક આત્મામાં લગાડીએ, આત્મસન્મુખ
કરીએ - આ જ માર્ગ છે.

હવે આ જ ભાવને પોષતા કળજકાય કહે છે.

(શારૂલવિક્રીડિત)

અન્યેભ્યો વ્યતિરિક્તમાત્મનિયતં વિભ્રતૃથગ્વસ્તુતા-
માદાનોજ્જ્વાનશૂન્યમેતદમલં જ્ઞાનं તથાવસ્થિતમ् ।
મધ્યાદ્યાન્તવિભાગમુક્ત સહજસ્ફારપ્રભાભાસર:
શુદ્ધજ્ઞાનઘનો યથાસ્ય મહિમા નિત્યોદિતસ્તિષ્ઠતિ ॥૨૩૫॥

(ઉપજાતિ)

ઉન્મુક્તમુન્મોચ્યશેષતસ્તત્ત તથાત્તમાદેયમશેષસ્તત્ત ।
યદાત્મનઃ સહતસર્વશક્તઃ પૂર્ણસ્ય સંધારણમાત્મનીહ ॥૨૩૬॥

(હરિગીત)

જે બિન્ન છે પરદવ્યથી ને નિયત છે નિજમાં અને
ધારે પૃથક વસ્તુપાગાને, ગ્રહાગ ત્યાગ નહીં કરે;
એ અમલ શાન તાગો અનુભવ થાય છે નિશ્ચળપાગે,
જ્યમ મધ્ય-આદિ-અંત એવા અંશ વિરહિત સહજ જે
વિસ્તૃત પ્રભા કરતી બહુ દેદીખ્યમાન મહાત્મ્યને
એ પુંજરૂપ સુશાનનો મહિમા સદા ઉદ્દિત રહે. ૨૩૫

સહુ શક્તિઓ જોગે સમેટી લીન કરી નિજરૂપમાં,
ધારાગ કરે નિજ માંહી નિજને તેહ પૂરાગ આત્મા;
તોંગે બધું છોડ્યું હતું જે છોડવાને યોગ્ય ને,
બસ ગ્રહાગ પાગ તેનું કર્યું જે ગ્રહાગ યોગ્ય હતું ખરે. ૨૩૬

અન્ય દ્રવ્યોથી બિન્ન, પોતામાં જ નિયત, પૃથક વસ્તુત્વને ધારણ
કરતું થકું, ગ્રહણ-ત્યાગથી રહિત આ અમલ શાન (આત્મા) આ પ્રમાણે
અનુભવમાં આવે છે કે જેની આદિ, મધ્ય અને અંતરૂપ વિભાગોથી રહિત
સહજ ફેલાયેલી પ્રભાવ દ્વારા દેદીખ્યમાન શુદ્ધજ્ઞાનરૂપ મહિમા નિત્ય ઉદ્દિત રહે.

સર્વ શક્તિઓને જેણે પોતામાં સમેટી લીધી છે એવા આ આત્મા
વહે પૂર્ણ આત્માનું આત્મામાં ધારણ કરવું તે જ છોડવા યોગ્ય બધાને

ઇઓડવું અને ગ્રહણ કરવા યોગ્ય બધાનું ગ્રહણ કરવું છે.

આ કળશોનો ભાવ સ્પૃષ્ટ કરતાં ભાવાર્થમાં પંડિત જ્યયચંદ્રજી છાબડા લખે છે -

“શાનનું પૂર્ણકૃપ બધાને જાણવું છે. તે જ્યારે પ્રગટ થાય છે, ત્યારે સર્વ વિશેષણો સહિત પ્રગટ થાય છે; તેથી તેની મહિમાને કોઈ બગાડી શકતું નથી, તે સદા ઉદ્દિત રહે છે.

પૂર્ણજ્ઞાનસ્વરૂપ, સર્વ શક્તિઓના સમૂહકૃપ જે આત્મા છે, તેને આત્મામાં ધારણ કરી રાખવું તે જ, જે કંઈ ત્યાગવા યોગ્ય હતું તે બધાને ત્યાગી દીધું અને ગ્રહણ કરવા યોગ્ય જે કંઈ હતું તેને ગ્રહણ કર્યું છે. તે જ ઝૃતકૃત્યતા છે.”

આ કળશોનો ભાવાનુવાદ કવિવર બનારસીદાસજી નાટક સમયસારમાં આ પ્રમાણે કરે છે.

(સવૈયા ઇકતીસા)

જૈસો નિરભેદરૂપ નિહચૈ અતીત હુતી,

તૈસો નિરભેદ અબ ભેદ કૌન કહૈગૌ ।

દીસૈ કર્મ રહિત સહિત સુખ સમાધાન,

પાયૌ નિજથાન ફિર બાહરિ ન બહૈગૌ ॥

કબહું કદાચિ અપનૌ સુભાવ ત્યાગિ કરિ,

રાગ રસ રાચિકેં ન પરવસ્તુ ગહૈગૌ ।

અમલાન ગ્યાન વિદ્યમાન પરગટ ભયૌ,

યાહી ભાંતિ આગમ અનંત કાલ રહૈગૌ ॥

જબહી તૈં ચેતન વિભાવ સોઁ ઉલટિ આપુ,

સમૈ પાડ અપનૌ સુભાડ ગહિ લીનૌ હૈ ।

તબહીં તૈં જો જો લેને જોગ સો સો સબ લીનૌ,

જો જો ત્યાગ જોગ સો સો સબ છાંડિ દીનૌ હૈ ॥

लैवे कों न रही ठौर त्यागिवे कों नांहि और,
 बाकी कहा उब्र्यो जु कारजु नवीनी है ।
 संग त्यागि अंग त्यागि वचनतरंग त्यागि,
 मन त्यागि बुद्धि त्यागि आपा सुद्ध कीनी है ॥

निश्चयनयथी द्रव्यस्वभावमां जे प्रकारनो अभेद अनादिकाणथी
 छे; ते ज प्रकारनो अभेद हवे पर्यायमां पण प्रगटी गयो छे; आ कारणे
 हवे भेदनी चर्चा कोइ करे ? जे ज्ञान कर्मरहित अने सुख-शांतिभय देखाई
 आवे छे तथा जेषे पोतानुं स्थान प्राप्त करी लीधुं छे; आवी स्थितिमां
 हवे आ ज्ञान भहिर्वृत्तिमां शा माटे वहे ?

हवे तो ते पोताना स्वभावनो त्याग करीने रागना रसमां रची-
 पचीने परवस्तुने क्यारेय ग्रहण नहीं करे. जे अमल ज्ञान हवे वर्तमानमां
 प्रगट थई गयुं छे, ते अनंतकाण सुधी आ ज ढ़े रहेशे.

ज्यारे आ आत्माए विभावभाव छोडीने पोताना स्वभावने ग्रहण
 करी लीघो; त्यारे ज तेषे ग्रहण करवा योग्य बधुं ग्रहण करी लीधुं अने
 त्यागवा योग्य बधुं त्यागी दीधुं. आम हवे ग्रहण करवा योग्य कंઈ शेष रह्युं
 नहीं अने त्यागवा योग्य पण कंઈ बच्युं नथी तथा कंઈ नवुं करवानुं पण
 रह्युं ज नथी; कारण के तेषे तो परिग्रह, शरीर, वाइना तरंग मन अने
 बुद्धि बधायनो त्याग करीने पोताना आत्माने शुद्ध करी लीघो छे.

उक्त कण्ठोनो भाव स्पष्ट करतां पूज्य गुरुदेव लभे छे - “जुओ
 पहेला परथी भिन्न कह्यो अने हवे कहे छे के आ आत्मा रागथी रहित
 छे. भाई ! अहीं परथी अने रागथी विमुख थईने स्वभाव सन्मुख थवानी
 अने भेदज्ञान प्रगट करवानी वात छे. अनादिथी परवस्तुनी साथे जे
 ऐकपण्युं मान्युं छे, ते भ्रमणा छे, जूठी कल्पना छे. तेनाथी भेदज्ञान करीने
 स्वयं अंदर जेवो छे अने जेवडो छे, तेने तेवो अने तेवडो ज स्वीकार
 करवुं, जाणवुं, मानवुं, भेदज्ञान छे, आ ज कर्तव्य छे, आ ज धर्म छे.”^१

^१ प्रवचनरत्नाकर भाग १०, पानुं १६२

આત્મા સર્વજ્ઞસ્વભાવી છે. ત્રણ લોક ત્રણકાળને એક સમયમાં જાણો - એવું તેનું સામર્થ્ય છે. તે સામર્થ્ય જ્યારે પ્રગટ થાય છે, ત્યારે સર્વ વિશેષણો સહિત પ્રગટ થાય છે. કેવળજ્ઞાન પ્રગટ થતાંની સાથે જ પૂર્ણ આનંદ, પૂર્ણ વીર્ય, પૂર્ણ શક્તિ, પૂર્ણ પ્રભુતા, પૂર્ણ સ્વચ્છતા ઈત્યાદિ શક્તિઓની પૂર્ણ વ્યક્તિદશા પ્રગટ થઈ જાય છે. તેનું નામ કેવળજ્ઞાન અને પૂર્ણદશા છે; તેથી કહે છે કે તેની ભહિમાને કહી આંચ આવતી નથી.^૧

પહેલા જ્ઞાનાદિ શક્તિઓ રાગમાં રોકાઈને-અટકીને ખંડખંડદ્વારા ખંડિત થતી હતી. હવે તેમને ત્યાંથી સમેટીને ચૈતન્યસ્વરૂપમાં લીન કરી, ત્યાં ગ્રહણ કરવા યોગ્ય બધાનું ગ્રહણ થયું અને ત્યાગવા યોગ્ય બધા વિકલ્પોનો સહજ ત્યાગ થઈ ગયો. ત્યાં પૂર્ણયના ભાવ પણ બૂમિકાનુસાર સહજ જ ધૂઠી જાય છે.^૨

અહીં કહે છે કે જેણો પોતાના નિકાળી ધ્રુવ ચૈતન્યરાજને જાણીને તેનો અનુભવ કર્યો અને તેમાં જ લીન થયો, તેણે ગ્રહણ કરવા યોગ્ય સર્વ પદાર્થ ગ્રહણ કરી લીધા અને છોડવા યોગ્ય બધું છોડી દીધું. અહો! ધન્ય તે મુનિદશા ! જે પ્રચુર સ્વસંવેદનમાં લીન થયા; તે મહામુનિરાજ તો બાદશાહોના બાદશાહ છે. પોતાની ચૈતન્યલક્ષ્મીથી સર્વ શોભાયમાન છે. જે બહારની સંપત્તિમાં લીન છે; તે તો બિચારા રંક છે, બિખારી છે.

પૂર્ણ જ્ઞાનધન પ્રભુ આત્મા અનંત શક્તિઓનો ધ્રુવધામ છે. તેને અંતરમાં ધારણ કરી તેમાં જ રમી જાઓ. તે જ રમવા-રહેવા અને ગ્રહણ કરવા યોગ્ય છે.

સ્વરૂપના આશ્રયથી જેણો સ્વરૂપનું શ્રદ્ધાન-જ્ઞાન અને રમણતા-લીનતા-સ્થિરતા પરિપૂર્ણ કરી લીધી; તેને હવે કંઈ પણ કરવાનું બાકી રહેતું નથી. તે કૃતકૃત્ય થઈ ગયો છે. દ્રવ્ય-ગુણ-પર્યાય તો પરિપૂર્ણ છે જ,

૧ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૧૬૨

૨ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૧૬૪

તેની પર્યાયમાં જ્યાં પૂર્ણતા વ્યક્ત થઈ, ત્યાં કૃતકૃત્યપણું થઈ ગયું, તેને હવે કંઈ પણ ગ્રહણ-ત્યાગ કરવાનું બાકી રહ્યું નથી.¹

આમ આ કળશોમાં આ સંપૂર્ણ પ્રકરણનો ઉપસંહાર છે. પહેલા પ્રતિક્રમણ, આતોચના અને પ્રત્યાખ્યાનના માધ્યમથી પરમાં કર્તૃત્વની ભાવનાદ્વારા કર્મચેતનાનો નિષેધ કર્યો; પછી કર્મોની ૧૪૮ પ્રકૃતિઓના ફળના ઉપભોગની ભાવનાદ્વારા કર્મફળચેતનાનો નિષેધ કર્યો. આ પ્રમાણે અજ્ઞાનચેતનાના નિષેધપૂર્વક જ્ઞાનચેતનાની સ્થાપના કરતાં થકાં સ્વપરપ્રકાશકજ્ઞાનની સ્થાપના કરીને પરમાં થનારા એકત્વ-મમત્વનો પણ નિષેધ કરી દીધો.

જ્ઞાનના સર્વજ્ઞસ્વભાવને સ્પષ્ટ કરતાં થકાં એમ કહેવામાં આવ્યું છે કે જ્ઞાન બધાને જાણો છે, છતાં પરદ્વપી થતું નથી. આ જ્ઞાનનો સહજ સ્વભાવ છે. પોતાના આ સહજ સ્વભાવમાં એકત્વ ધારણ કરનારું જ્ઞાન જ્યારે નિજમાં લીન થઈ જય છે ત્યારે સર્વજ્ઞતા પ્રગટ થઈ જય છે. સર્વજ્ઞતા પ્રગટ થતાં જ્ઞાનની સાથે અનંત ગુણ સંપૂર્ણદ્વારે પ્રગટી જય છે અને પછી અનંતકાળ સુધી પૂર્ણ જ રહે છે.

જ્યારે આત્મા પોતામાં પોતાપણું સ્થાપિત કરીને સ્વયંમાં લીન થાય છે, ત્યારે જાણો ધૂટવા યોગ્ય બધું છુટી ગયું છે અને મેળવવા યોગ્ય બધું મળી ગયું છે. હવે કંઈ કરવાનું બાકી રહેતું નથી. તેથી હવે વિકલ્પાત્મક પ્રતિક્રમણાદિક કરવાની પણ કંઈ આવશ્યકતા રહેતી નથી; કારણ કે આ શુદ્ધોપયોગની દ્વારા બધા ધર્મ સમાઈ જય છે.

આમ આ સંપૂર્ણ પ્રકરણનો ઉપસંહાર આ છે કે ત્રિકાળ સંબંધી દુર્જ્ઞતોના વિકલ્પાત્મક વ્યવહાર પ્રતિક્રમણાદિની ઉપયોગિતા ત્યાં સુધી છે; જ્યાં સુધી આ આત્મા પોતામાં સમાઈ જતો નથી, શુદ્ધોપયોગદ્વારે

¹ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૧૬૪-૧૬૫

સંપૂર્ણપણે પરિણમી જતો નથી. જ્યારે આ આત્મા સંપૂર્ણપણે શુદ્ધોપયોગકૃપે પરિણમી જય છે; ત્યારે તો અંતમુહૂર્તમાં જ વીતરાળી-સર્વજ્ઞ થઈ જય છે. અનંતસુખી થઈ જય છે. આ શુદ્ધોપયોગકૃપ પરિણમવું તે જ નિશ્ચય પ્રતિક્રમણાદિ છે. બધા ધર્મ તેમાં જ સમાયેલા છે. આ જ એક માત્ર કરવા યોગ્ય કાર્ય છે. તેના સિવાય જે ભાવોને ધર્મ કહેવામાં આવે છે. તે તેના સહચારી હોવાથી ધર્મ કહેવામાં આવે છે.

હવે આગામી ગાથાઓનું સૂચક કળશ કાવ્ય લખે છે; જે આ પ્રમાણે છે.

(અનુષ્ટુપ)

વ્યતિરિક્તं પરદ્રવ્યાદેવ જ્ઞાનમવસ્થિતમ् ।
કથમાહારકં તત્સ્યાદ્યેન દેહોऽસ્ય શંક્યતે ॥૨૩૭॥

(હરિગીત)

પરદ્રવ્યથી જુદું અવસ્થિત જ્ઞાન છે આ રીત જ્યાં;
નહિ હોય તે આ'રક તથાપિ 'દેહ-તે' શંકા જ કાં ? ૨૩૭

આ પ્રમાણે આ જ્ઞાન પરદ્રવ્યથી સંપૂર્ણ પૃથ્વી સ્થાપિત થયું. આવી સ્થિતિમાં તે જ્ઞાન (આત્મા) આહાર કરનારો કેમ હોઈ શકે કે જેથી તેના દેહવાન થવાની શંકા પણ કરી શકાય.

તાત્પર્ય આ છે કે જ્યારે જ્ઞાનસ્વભાવી આત્મા આહારક જ નથી તો દેહવાળો કેમ હોઈ શકે ? આત્માને દેહવાળો કહેવું તે તદ્દન અસદ્ભૂત છે, અસત્યાર્થ છે, અસદ્ભૂતવ્યવહારનો વિષય છે.



સમયસાર ગાથા ૪૦૫ - ૪૦૭

જે વાત ઉક્ત કળશમાં કહેવામાં આવી હતી; હવે તેને જ ગાથાઓ
દ્વારા વિસ્તારથી સ્પષ્ટ કરે છે.

અત્તા જસ્સામુજ્જો ણહુ સો આહારગો હવદિ એવં ।

આહારો ખલુ મુજ્જો જમ્હા સો પોગલમારો દુ ॥૪૦૫॥

ણ વિ સક્રદિ ઘેતું જં ણ વિમોતું જં ચ જં પરદ્વબ્બં ।

સો કો વિ ય તસ્સ ગુણો પાઉગિઓ વિસ્સસો વા વિ ॥૪૦૬॥

તમ્હા દુ જો વિસુદ્ધો ચેદા સો ણેવ ગેણહદે કિંચિ ।

ણેવ વિમુંચદિ કિંચિ વિ જીવાજીવાણ દવ્વાણ ॥૪૦૭॥

(હસ્તિત)

એમ આત્મા જેનો અમૂર્તિક તે નથી આ'રક ખરે,

પુદ્ગલમયી છે આ'ર તેથી આ'ર તો મૂર્તિક ખરે. ૪૦૫

જે દ્રવ્ય છે પર તેહને ન ચૃઢી, ન છોડી શકાય છે,

એવો જે તેનો ગુગુ કો પ્રાયોગી ને વૈભવસિક છે. ૪૦૬

તેથી ખરે જે શુદ્ધ આત્મા તે નહીં કંઈ પાણ ચૃઢે,

છોડે નહીં વળી કંઈ પાણ જીવને અજીવદ્રવ્યો વિષે. ૪૦૭

એ રીતે જેનો આત્મા અમૂર્તિક છે તે ખરેખર આહારક નથી; કારણ
કે આહાર પુદ્ગલમય હોવાથી મૂર્તિક છે.

જે પરદ્રવ્ય છે તે ગ્રહી શકતું નથી તથા છોડી શકતું નથી; કારણ કે આત્માનો એવો જ કોઈ પ્રાયોગિક તેમજ વૈસ્ત્રસિક ગુણ છે.

માટે વિશુદ્ધાત્મા જીવ અને અજીવ પરદ્રવ્યોમાં કાંઈ પણ ગ્રહતો નથી અને છોડતો પણ નથી.

ધ્યાન રાખો, અહીં પ્રાયોગિકનો આશય પરનિમિત્તથી ઉત્પન્ન થાય છે અને વૈસ્ત્રસિકનો આશય સ્વભાવિકરૂપે જ ઉત્પન્ન થાય છે. તાત્પર્ય છે કે ન તો આત્માના સ્વભાવમાં જ એવી વાત છે કે તે પરદ્રવ્યોને ગ્રહણ કરે અને છોડે અને ન તો કોઈ નિમિત્તના કારણે તે આમ કરે - આવી જ કોઈ વિવશતા છે. તેથી આત્મા પરદ્રવ્યોને ગ્રહણ કરે અથવા છોડે - આવી કોઈ વાત બનતી જ નથી.

ઉક્ત ગાથાઓનો અર્થ આત્મભ્યાતિમાં અત્યંત સંક્ષેપમાં કરવામાં આવ્યો છે, એક રીતે તો ગાથાઓના સામાન્ય અર્થને જ માત્ર ફરીથી કહેવામાં આવ્યો છે; જે આ પ્રમાણે છે -

“જ્ઞાન પરદ્રવ્યને જરા પણ ગ્રહણ કરતું નથી અને છોડતું પણ નથી; કારણ કે પ્રાયોગિક અને વૈસ્ત્રસિક ગુણના સામર્થ્યથી પરદ્રવ્યનો ગ્રહણ અને ત્યાગ અશક્ય છે. કર્મ અને નોકર્મઝપ પરદ્રવ્ય જ્ઞાન અર્થાત્ આત્મદ્રવ્યનો આહાર નથી; કારણ કે તે મૂર્તિક પુદૃગલદ્રવ્ય છે; તેથી જ્ઞાન આહારક નથી. માટે આવી આશંકા પણ નહિ કરવી જોઈએ કે જ્ઞાન (આત્મા) ને દેહ હશે.”

આચાર્ય જ્યથેને તાત્પર્યવૃત્તિમાં આ ગાથાઓનો અર્થ આત્મભ્યાતિ સમાન જ કર્યો છે; છતાં તેઓ પ્રાયોગિક અને વૈસ્ત્રસિકનો અર્થ સ્પષ્ટ કરતાં લખે છે કે પ્રાયોગિક: કર્મસંયોગજનિત: વૈસ્ત્રસિક: સ્વભાવત: જે કર્મના સંયોગથી ઉત્પન્ન થાય, તેને પ્રાયોગિક કહે છે અને જે સ્વભાવથી હોય, તેને વૈસ્ત્રસિક કહે છે.

તે જ રીતે તેઓ ‘આત્મા આહાર ગ્રહણ નથી કરતો’ આ વાતને વ્યવહારનય અને નિશ્ચયનન્યથી સ્પષ્ટ કરતાં થકાં બધા પ્રકારના આહારોનો

ઉલ્લેખ કરે છે. આ વાતને પ્રશ્નોત્તરના રૂપમાં તેઓ આ પ્રમાણે પ્રસ્તુત કરે છે.

“પ્રશ્ન - હે ભગવાન ! કર્મજનિત પ્રાયોગિક ગુણથી આહાર ગ્રહણ કરતાં થકાં તેઓ અનાહારક કેવી રીતે થઈ શકે ?

ઉત્તર:- હે શિષ્ય ! તમે ઠીક જ કહ્યું; પરંતુ નિશ્ચયનયથી આત્મા ઉકૃત આહારથી તન્મય થતો નથી. આહાર ગ્રહણ કરનાર કથન તો વ્યવહારનયનું છે; પરંતુ અહીં તો નિશ્ચયનયનું કથન ચાલી રહ્યું છે. નિશ્ચયનયથી તો આત્મા અનાહારક જ છે; તેથી વિશેષઝ્ઞપે જે રાગાદિ રહિત ચૈતન્ય આત્મા છે; તે કર્માહાર, નોકર્માહાર, કવલાહાર, લેખ્યાહાર, ઓળાહાર, માનસાહાર રૂપે જીવ-અજીવ દ્રવ્યોની વચ્ચેથી સચિત-અચિત આહાર-કોઈને પણ કંઈ ગ્રહણ કરતું નથી અને છોડતું પણ નથી. તેથી નોકર્મ આહારમય જે શરીર છે, તે જીવસ્વરૂપ નથી, જીવનું સ્વરૂપ નથી. શરીરના અભાવમાં શરીરસ્વરૂપ દ્રવ્યલિંગ પણ જીવનું સ્વરૂપ નથી. આમ નિશ્ચયનયથી જીવને આહાર નથી.”

આ ગાથાઓનો ભાવ ભાવાર્થમાં પંડિત જ્યયચંદ્રજી છાબડા આ પ્રમાણે સ્પષ્ટ કરે છે.

“જ્ઞાનસ્વરૂપ આત્મા અમૂર્તિક છે અને આહાર તો કર્મ-નોકર્મસ્વરૂપ પુદ્ગલમય મૂર્તિક છે; તેથી પરમાર્થથી આત્માને પુદ્ગલમય આહાર નથી અને આત્માનો એવો જ સ્વભાવ છે કે તે પરદ્રવ્યને ક્યારેય ગ્રહણ કરતું નથી; સ્વભાવસ્વરૂપ પરિણામતો હોય કે વિભાવસ્વરૂપ પરિણામતો હોય, પોતાના જ પરિણામનો ગ્રહણ-ત્યાગ થાય છે, પરદ્રવ્યનો ગ્રહણ-ત્યાગ તો કાંઈ પણ થતો નથી. આ રીતે આત્માને આહાર ન હોવાથી તેને દેહ જ નથી.”

આ ગાથાઓનો ભાવ પૂજય ગુરુદેવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે. “ભગવાન આત્મા પરદ્રવ્યના એક રજકણનો પણ ગ્રહણ ત્યાગ કરી શકતો નથી. આત્માનું આવું જ સ્વરૂપ છે. પ્રાયોગિક અર્થાત् પરના નિમિત્તથી

થયેલા ગુણના સામર્થ્યથી અને વૈભ્રસિક અર્થાત્ સ્વાભાવિક ગુણનાં સામર્થ્યથી પણ આત્મા વડે પરદ્વયનો ગ્રહણ અને ત્યાગ અશક્ય છે.^૧

જ્ઞાન-દર્શન-આનંદ આદિ ગુણ તો આત્માનો નિકાળી સ્વભાવ છે, તે પરને ગ્રહણ કરે અથવા છોડે - એ તો પ્રશ્ન જ નથી; કારણ કે ગ્રહણ-ત્યાગ તો પર્યાયમાં થાય છે; પરંતુ ગ્રહણ-ત્યાગડ્રષ્પ ઈચ્છાની વિભાવપર્યાયમાં પણ કોઈ તાકાત નથી કે તે પરનું ગ્રહણ કરે અથવા છોડે.

ભાઈ ! સંયોગમાં આવનારી વસ્તુ પોતાના સ્વકાળમાં પોતે જ સંયોગમાં આવે છે અને જનારી પોતે જ ચાલી જય છે. તેમનું આવવું-જવું તેમના કારણે જ થાય છે, જીવની ઈચ્છાથી બિલ્કુલ થતું નથી. આવી જ વસ્તુસ્થિતિ છે. એવું કહે છે ને કે 'દાણા-દાણા પર ખાનારનું નામ લખ્યું છે' તેનો અર્થ શું છે ? એમ જ ને કે જે રજકણ આવનાર છે, તે પોતાની સ્વચ્યતુઝ્યની યોગ્યતાથી પોતે જ આવે છે, કોઈની ઈચ્છાને કારણે નહીં. પરની ઈચ્છામાં એવું સામર્થ્ય જ નથી.

નોકર્મ અર્થાત્ આહાર-પાણી વગેરે પુદ્ગલજડ મૂર્તિક દ્રવ્ય છે અને આત્મા ચેતન અમૂર્તિક દ્રવ્ય છે. રોટલી-દાળ-ભાત-શાક આદિ મૂર્તિક દ્રવ્યદ્રષ્પ આહાર આત્માના છે જ નહીં; કારણ કે આહાર મૂર્તિક દ્રવ્ય છે અને આત્મા અમૂર્તિક દ્રવ્ય છે. અમૂર્તિક ચેતનદ્રવ્યને મૂર્તિક જડનો આહાર કેમ હોય ? તેથી આત્મા આહારક નથી.^૨

અડ્ઝી આત્માડ્ઝી કર્મ-નોકર્મને ગ્રહણ કરે અને છોડે - તે સંભવ નથી; કારણ કે ભગવાન આત્મા પરના ગ્રહણ-ત્યાગથી રહિત શૂન્ય છે.^૩

અરે ! ચારિત્રવંત મુનિરાજેને પણ કદાચિત્ આહારની વૃત્તિ હોય તો તે વૃત્તિને કારણે આહારનું ગ્રહણ થતું નથી, કર્મો અને નોકર્મોનો બંધ અને નિર્જરા પણ તે શુભરાગને કારણે થતી નથી. વૃત્તિ થઈ - એ અપેક્ષા

૧ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૧૬૮

૨ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૧૭૦

૩ તે જ, પાનું ૧૭૧

ભલે કર્તાં કહો, પરંતુ 'વૃત્તિ કરવા યોગ્ય છે' - એવું તે માનતા નથી. તેથી તે અપેક્ષાએ અકર્તાં જ છે, શાતા જ છે.

અહીં એમ સિદ્ધ કરવું છે કે સ્વભાવકૃપ પરિણમે અથવા વિભાવકૃપ પરિણમે, પ્રત્યેક સ્થિતિમાં પોતાના જ પરિણામોનો ગ્રહણ ત્યાગ છે, પરદ્રવ્યોનો ગ્રહણ-ત્યાગ તો જરા પણ નથી.^૧

ઉકટ સંપૂર્ણ કથનનો સારાંશ આ છે કે આ અમૂર્તિક આત્મા પુદ્ગલમથી મૂર્તિક આહાર કરી શકતો નથી; કારણ કે પરદ્રવ્યોનું ગ્રહણ કરવું એ ન તો આત્માનો સ્વભાવ છે અને ન તો પર નિમિત્તના સહયોગથી આમ કરવાનો આત્માનો સ્વભાવ છે.

તેથી નિષ્કર્ષ આ જ છે કે આ આત્મા પરલુંબો અને અજીવ દ્રવ્યોમાંથી ન તો કંઈ ગ્રહણ પણ કરે છે અને ન તો કંઈ ત્યાગે પણ છે. આત્મામાં એક ત્યાગોપાદાનશૂન્યત્વ નામની શક્તિ છે; તેનું પણ આ જ કાર્ય છે. ત્યાગોપાદાનશૂન્યત્વ શક્તિનું મૂળ ઉત્સ (હાર્દ) પણ આ જ પ્રકરણ છે.

હવે આગામી ગાથાઓની સૂચના આપનાડું કળશ-કાવ્ય કરે છે; જે આ પ્રમાણે છે.

(અનુષ્ટ્રપ)

એવ જ્ઞાનસ્ય શુદ્ધસ્ય દેહ એવ ન વિવાતે ।

તતો દેહમય જાતુ ને લિંગ મોક્ષકારણમ् ॥૨૩૮॥

(હસ્તિગીત)

આ રીત ચિન્મયજ્ઞાનને દેહ જ કદાપિ છે નહીં,
તે દેહદ્વપી લિંગ તેથી મોક્ષનું કારણ નથી. ૨૩૮

આ રીતે શુદ્ધજ્ઞાન (આત્મા) ને દેહ પણ નથી; માટે શાતા જીવને દેહમય ચિહ્ન (લિંગ) મોક્ષનું કારણ નથી.

૧ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૧૭૨

૨ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૧૭૨-૧૭૩

તાત્પર્ય આ છે કે જ્યારે શુદ્ધજ્ઞાનસ્વભાવી આત્માને દેહ જ નથી; તે પછી દેહમય ચિહ્ન (લિંગ) મુક્તિનું કારણ કેવી રીતે હોઈ શકે? અર્થાતું ભાવલિંગી સંતોને પણ નગન દિગંબરદશા મુક્તિનું કારણ નથી. મુક્તિનું કારણ તો એકમાત્ર નિશ્ચયરત્નત્રય જ છે.

આમ તો આ સત્ય છે કે નગન દિગંબરદશા ધારણ કર્યા વગર મુક્તિની પ્રાપ્તિ થતી નથી, તો પણ દેહની નગનતા મુક્તિનું કારણ નથી. દેહની નગનતાની સાથે ભિદ્યાત્વ અને ત્રણ કષાયના અભાવદ્યપ જે સમ્બંધનિઃશાન-ચારિત્ર છે; તે જ મુક્તિનું કારણ છે.

ગુરુદેવ તો મહાવ્રતોને પણ દેહમય લિંગમાં જ શામેલ કરે છે. તેમનું કથન આ પ્રમાણે છે -

“શુદ્ધજ્ઞાન અર્થાતું ભગવાન આત્માને દેહ પણ નથી. દેહ તો બાહ્ય વસ્તુ છે. જ્યારે દેહ જ નથી તો દેહમયલિંગ - નગનદશાનો ભેખ મોક્ષનું કારણ કેમ થઈ શકે? મુનિરાજને બહારમાં દેહની નગનદશા અને પંચમહાવ્રતાદિના વિકલ્પ હોય છે; પરંતુ તે મોક્ષના કારણ નથી.”^૧

ભાઈ! વ્રતાદિના વિકલ્પ પણ દેહલિંગમય જ છે. મુનિરાજ તેમને મોક્ષનું કારણ માનતા નથી.”^૨

આ પ્રકરણના કળશોનો ભાવાનુવાદ કવિવર બનારસીદાસજી ચાર છંદોમાં આ પ્રમાણે કરે છે.

(દોહા)

સુદ્ધ ગ્યાન કૈ દેહ નહિ, મુદ્રા ભેષ ન કોડું ।

તાતૈ કારન મોખ કૌ, દરબલિંગ નહિ હોડું ॥

દરબલિંગ ન્યારા પ્રગટ, કલા વચન વિગ્યાન ।

અષ્ટ મહારિધિ અષ્ટ સિધિ, એક હોહિ ન ગ્યાન ॥

આત્મા શુદ્ધજ્ઞાનમય છે અને શુદ્ધજ્ઞાનને શરીર નથી, મુદ્રા નથી

^૧ પ્રથમનરત્નાકર ભાગ ૧૦, પાનું ૧૭૩

^૨ તે જ, પાનું ૧૭૭

અને કોઈ વેષ પણ નથી. દેહ, મુદ્રા, વેષ આ બધી પુછુગળની રચનાઓ શાનસ્વભાવી આત્માની નથી. તેથી દ્રવ્યલિંગ મુક્તિનું કારણ નથી; નનદશાઙ્કપ દ્રવ્યલિંગ મુક્તિનું કારણ નથી, કારણ કે નનદશાઙ્કપ દ્રવ્યલિંગ દેહની જ દર્શાનું નામ છે.

આ ભગવાન આત્માથી દ્રવ્યલિંગ પણ બિન્ન છે, કલા-કૌશલ્ય પણ બિન્ન છે અને વચન ચાતુરી પણ બિન્ન જ છે. ત્યાં સુધી કે અખ્ય મહાત્માધિયો અને અખ્ય સિદ્ધિયો પણ આત્માથી બિન્ન જ છે; કારણ કે તે શાન નથી.

(સવૈયા ઇકતીસા)

ભેષ મેં ન ગ્યાન નહિ ગ્યાન ગુરુ વર્તન મેં,

મંત્ર જંત્ર તંત્ર મેં ન ગ્યાન કી કહાની હૈ ।

ગ્રંથ મેં ન ગ્યાન નહિ ગ્યાન કવિ ચાતુરી મેં,

બાતનિ મેં ગ્યાન નહિ ગ્યાન કહા બાની હૈ ॥

તાત્ત્વ ભેષ ગુરુતા કવિત્ત ગ્રંથ મંત્ર બાત,

ઇનત અતીત ગ્યાન ચેતના નિસાની હૈ,

ગ્યાન હી મેં ગ્યાન નહિ ગ્યાન ઔર ઠૌર કહું,

જાકે ઘટ ગ્યાન સોર્ડ ગ્યાન કા નિદાની હૈ ॥

ભેષ ધરિ લોકનિ કોં બંચૈ સૌ ધરમ ઠગ,

ગુરુ સો કહાવૈ ગુરુવાઈ જાહિ ચહિએ ।

મંત્ર તંત્ર સાધક કહાવૈ ગુની જાદૂગર,

પંડિત કહાવૈ પંડિતાઈ જામેં લહિયે ॥

કવિત્ત કી કલા મેં પ્રવીન સો કહાવૈ કવિ,

બાત કહિ જાનૈ સો પવારગીર કહિએ ।

એ તૌ સબ વિષ કે ભિખારી માયાધારી જીવ,

ઇન્હકોં વિલોકિ કૈ દયાલરૂપ રહિયે ॥

‘વેષમાં જ્ઞાન નથી અર્થાત् વેષ ધારણ કરી લેવાથી કોઈ આત્મજ્ઞાની થઈ જતું નથી. તેવી જ રીતે ગુરુઓ જેવું આચરણ કરી લેવાથી કોઈ જ્ઞાન થઈ જતું નથી અર્થાત્ ગુરુવર્તનમાં પણ આત્મજ્ઞાન નથી. મંત્ર, યંત્ર અને તંત્રમાં પણ જ્ઞાન નથી. મંત્રોથી ઝાડ કૂકીને, યંત્રથી અર્થાત્ તાવિજ દઈને અથવા તંત્ર એટલે ટોટકા કરીને કોઈ આત્મજ્ઞાની બનવા માગે છે તો તેની તે ભાવના ક્યારેય સફળ થનારી નથી.

ગ્રંથો (શાસ્ત્રો) અને કાવ્યકૌશલ્યમાં પણ જ્ઞાન નથી; વાતોમાં પણ જ્ઞાન નથી. તાત્પર્ય આમ છે કે શાસ્ત્રોનું અધ્યયન કરીને, તેને કાવ્યકૌશલ્યમાં અભિવ્યક્ત કરીને અને વ્યાખ્યાન દેવાની કળામાં ચતુરાઈ પ્રાપ્ત કરીને કોઈ એમ સમજે કે હું જ્ઞાની થઈ ગયો છું તો તે ઘોખામાં જ છે.

તેથી વેષ (નગન દિગંબરદર્શા), ગુરુતા, કવિતા, ગ્રંથ, મંત્ર-તંત્ર અને વ્યાખ્યાન - આ બધા જ્ઞાનચેતનાની નિશાની નથી; કારણ કે જ્ઞાન તો જ્ઞાન (આત્માનુભવ) માં જ છે, તે બીજે ક્યાંય નથી. આત્માનુભૂતિમધ્ય જ્ઞાન જેને પ્રગટ થઈ ગયું, તે જ વાસ્તવિક જ્ઞાની છે.

વિભિન્ન પ્રકારના વેષોને ધારણ કરીને જ વ્યક્તિ લોકોને ઠગે છે; તે તો ધર્મઠગ છે; કારણ કે ગુરુ તો તેને કહે છે, જેમાં ગુરુતા દેખાય અર્થાત્ જે નિશ્ચયસમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર્યી સંપત્ત હોય.

મંત્ર-તંત્રની સાધના કરનારાઓને ગુણિયો અથવા જાહૂગર કહે છે; જેમનામાં પંડિતાઈ દેખવામાં આવે તેને પંડિત કહે છે; જે કવિતા બનાવવાની કળામાં પ્રવિષા હોય છે, તેને કવિ કહે છે. અને જે વાતચીત અથવા વ્યાખ્યાનની કળામાં ચતુર હોય છે, તેને જાણકાર (સભાચતુર) કહે છે.

આત્મજ્ઞાનથી રહિત આ બધા માયાધારી જીવો તો વિષયોના બિખારી છે. તેમને જોઈને તો દ્વા આવવી જોઈએ. તેઓ કરુણાને પાત્ર છે; ન તો શર્દ્દાને પાત્ર છે અને ન તો કોઇને પાત્ર છે.

ઉક્ત સંપૂર્ણ કથનમાં એમ જ કહેવામાં આવ્યું છે કે જોઈએ તો શરીરની કિયારુપ દ્રવ્યલિંગ હો અને જોઈએ તો શુભભાવરુપ દ્રવ્યલિંગ હો-બંને જ આત્માનુભવ વગર કંઈ પણ કાર્યકરી નથી.

જે વ્યક્તિ આત્મજ્ઞાનશૂન્ય હોવા છીતાં પણ નગન હિંગંબર દરશા અને મહાપ્રતાદિ ધારણ કરીને પોતાને ધર્માત્મા માનીને બેઠા છે; તેઓ દ્વારાને પાત્ર છે. તે નથી તો શ્રદ્ધાને પાત્ર અને નથી તો ધૃણાને પાત્ર; કારણ કે તેઓ તો પોતે ભૂલેલા-ભટ્કેલા લોક છે.



આગામી ષષ્ઠી

પ્રશ્ન :- ચક્રવર્તીના પાંચ દિનિઓના વિષય વલ સ્વરૂપ?

- ઉત્તર :- (૧) સ્પર્શનેન્દ્રિય થી ૮ યોજન સુધીનો વિષય જાણી લ્યે છે.
(૨) રસનેન્દ્રિય થી ૮ યોજન સુધીનો વિષય જાણી લ્યે છે.
(૩) ગ્રાણેન્દ્રિય થી ૮ યોજન સુધીનો વિષય જાણી લ્યે છે.
(૪) ચક્ષુરન્દ્રિય થી ૪૭૨૬૩ ૭/૨૦ યોજન સુધી જોઈ શકે છે.
(૫) શ્રોતેન્દ્રિય થી ૧૨ યોજન સુધીના શબ્દ સાંભળે છે.

પ્રશ્ન :- ચક્રવર્તીના ૭ અંગ બળોનું સ્વરૂપ -

- ઉત્તર :- (૧) સ્વામી (૨) અમાત્ય (૩) દેશ (૪) દુર્ગ
(૫) ખજના (કોશ) (૬) ખડંગ બળ (૭) મિત્ર (સુહત્ત)

આ પ્રકારે સાત અંગ બળ હોય છે.

સમયસાર ગાથા ૪૦૮ - ૪૧૧

જે વાત પાછળના કળશમાં કહેવાઈ હતી; તે જ વાતને હવે ગાથાઓના ભાધ્યમથી વિસ્તારથી સ્પષ્ટ કરે છે. ગાથાઓ મૂળમાં આ પ્રમાણે છે.

પાસંડીલિંગાણિ વ ગિહિલિંગાણિ વ બહુપ્રયારાણિ ।

ઘેનું વંદિત મૂઢા લિંગમિણ મોક્ખમગ્ગો ત્તિ ॥૪૦૮॥

ણ દુ હોદિ મોક્ખમગ્ગો લિંગ જં દેહણિમ્મમા અરિહા ।

લિંગ મુઝ્જ્તુ દંસણણાણચરિત્તાણિ સેવંતિ ॥૪૦૯॥

ણ વિ એસ મોક્ખમગ્ગો પાંસંડીગિહિમયાણિ લિંગાણિ ।

દંસણણાણચરિત્તાણિ મોક્ખમગ્ગં જિણા બેંતિ ॥૪૧૦॥

તમ્હા જહિતુ લિંગે સાગારણગારએહિં વા ગહદે ।

દંસણણાણચરિત્તે અપ્પાણ જુંજ મોક્ખપહે ॥૪૧૧॥

(હરિગીત)

બહુવિધનાં મુનિલિંગને અથવા ગૃહસ્થીલિંગને,

ગ્રહીને કહે છે મૂઢજ્ઞન ‘આ લિંગ મુક્ષિતમાર્ગ છે’. ૪૦૮

પાગ લિંગ મુક્ષિતમાર્ગ નહિ, અર્હત નિર્મમ દેહમાં

બસ લિંગ છોડી જ્ઞાન ને ચારિત્ર, દર્શન સેવતા. ૪૦૯

મુનિલિંગ ને ગૃહીલિંગ - એ લિંગો ન મુક્તિમાર્ગ છે;
ચારિત્ર-દર્શન-જ્ઞાનને બસ મોક્ષમાર્ગ જિનો કહે. ૪૧૦

તેથી તજી સાગાર કે આગાજાર-ધારિત લિંગને,
ચારિત્ર-દર્શન-જ્ઞાનમાં તું જોડ રે ! નિજ આત્મને. ૪૧૧

બહુ પ્રકારનાં પાખંડી (મુનિ) લિંગો અથવા ગૃહસ્થ લિંગને ધારણ
કરીને તે મૂઠજ્ઞનો એમ કહે છે કે આ લિંગ મોક્ષમાર્ગ છે.

પરંતુ લિંગ મોક્ષમાર્ગ નથી; કારણ કે અહૃતદેવો લિંગને છોડીને
અર્થાત् લિંગ પરથી દાઢિ હટાવીને દર્શન-જ્ઞાન-ચારિત્રને જ સેવે છે.

મુનિ અને ગૃહસ્થનાં લિંગ (ચિહ્ન) એ મોક્ષમાર્ગ નથી; કારણ કે
જિનદેવો તો દર્શન-જ્ઞાન-ચારિત્રને મોક્ષમાર્ગ કહે છે.

તેથી ગૃહસ્થો અને મુનિઓ વહે ગ્રહણ કરાયેલા લિંગોને છોડીને,
તેમાંથી એકત્વબુદ્ધિ તોડીને મોક્ષમાર્ગદ્વિપ દર્શન-જ્ઞાન-ચારિત્રમાં પોતાને
લગાડો.

આ ગાથાઓનો ભાવ આત્મભ્યાતિમાં આ પ્રમાણે સ્પષ્ટ કરવામાં
આવ્યો છે -

‘કેટલાક લોકો અજ્ઞાનથી દ્રવ્યલિંગને મોક્ષમાર્ગ માનતા થકા
મોહથી દ્રવ્યલિંગને જ ધારણ કરે છે; પરંતુ આ ઠીક નથી; કારણ કે બધા
અરિહંત ભગવંતોને શુદ્ધજ્ઞાનમયતા હોવાથી દ્રવ્યલિંગને આશ્રયભૂત શરીરના
મમત્વનો ત્યાગ થાય છે. તેથી શરીરાશ્રિત દ્રવ્યલિંગના ત્યાગથી સમ્યગ્દર્શન-
જ્ઞાન ચારિત્રની મોક્ષમાર્ગદ્વિપે ઉપાસના જેવામાં આવે છે.

ખરેખર વાત એમ છે કે દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી; કારણ કે તે
દ્રવ્યલિંગ શરીરાશ્રિત હોવાથી પરદ્રવ્ય છે. દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ
છે; કારણ કે તે આત્માશ્રિત હોવાથી સ્વદ્રવ્ય છે.

દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી; તેથી બધા દ્રવ્યલિંગોનો ત્યાગ કરીને
દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ સ્થિત થાઓ. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જ

મોક્ષમાર્ગ હોવાથી તેમાં જ આત્માને લગાડવું ચોગ્ય છે - એવી સૂતની અનુમતિ છે.”

ઉક્ત ચારેય ગાથાનો સાર આ છે કે આત્માના આશ્રયથી આત્મામાં જ ઉત્પન્ન થનારા દર્શન-જ્ઞાન-ચારિત્રકૃપ ભાવલિંગ જ સાચો મોક્ષમાર્ગ છે; શરીરની નગનદિગંબર અવસ્થા અને મહાવ્રતાદિના શુભભાવકૃપ દ્વયલિંગ મોક્ષનો માર્ગ નથી; તેને તો ભાવલિંગનો અનિવાર્ય સહચારી હોવાથી ઉપચારથી વ્યવહાર મોક્ષમાર્ગ કહેવામાં આવે છે.

અહીં એક પ્રશ્ન થઈ શકે છે કે મુનિલિંગ તો નગનદિગંબર દર્શા છે, પણ ગૃહસ્થોનો તો કોઈ વેષ નિશ્ચિત નથી; તો પછી ગૃહીલિંગનું શું તાત્પર્ય છે ?

અરે ભાઈ ! શ્રાવકની અગિયાર પ્રતિમાઓ હોય છે; તેમાં જે અગિયારમી પ્રતિમા છે; તેમાં ક્ષુલ્લક અને એલક હોય છે; તેમનો વેષ પણ સુનિશ્ચિત હોય છે. એલક તો માત્ર લંગોટી જ પહેરે છે, પણ ક્ષુલ્લક લંગોટીની સાથે-સાથે ખંડવસ્ત પણ ધારણ કરે છે. ખંડવસ્તનું તાત્પર્ય એમ છે કે જ્યારે તેઓ સુતા હોય ત્યારે જે માથું ઢંકાય તો પગ ન ઢંકાય અને પગ ઢંકાઈ તો માથું ન ઢંકાય એવું વસ્ત્ર.

આચાર્ય જ્યસેને શેષ અર્થ તો આચાર્ય અમૃતચંદ્ર જેવો જ કર્યો છે; પણ ગૃહીલિંગને તેમણે વિશેષકૃપે સ્પષ્ટ કર્યું છે. તેના માટે તેમણે ‘કોપીન ગ્રહણ’ શબ્દનો પ્રયોગ કર્યો છે.

અહીં એક પ્રશ્ન બીજે પણ થઈ શકે છે કે તો શું મુનિલિંગ ધારણ કર્યા વગર મોક્ષ થઈ જશે ? જે એમ હોય તો આપના તીર્થકરોએ દીક્ષા લઈને નગનદિગંબર દર્શા કેમ ધારણ કરી ?

અરે ભાઈ ! એમ નથી. આ વાત તો વારંવાર સ્પષ્ટ કરતાં આવી રહ્યા છીએ કે મુક્તિના માર્ગમાં નગનદિગંબર દર્શા તો અનિવાર્ય જ છે, મહાવ્રત પણ આવશ્યક છે; પરંતુ તે પરદ્વયના પરિણમનકૃપ અને રાગકૃપ હોવાથી મુક્તિનું કારણ નથી.

ઉક્ત સંદર્ભમાં પંડિત શ્રી જ્યોતિંગને છાબડાનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે -

“અહીં દ્રવ્યલિંગને છોડીને આત્માને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં લગાડવાનું વચન છે, તે સામાન્ય પરમાર્થ વચન છે.

કોઈ એમ સમજશે કે આ મુનિ શ્રાવકના વ્રતોને છોડાવવાનો ઉપદેશ છે; પરંતુ તેમ નથી. જે માત્ર દ્રવ્યલિંગને જ મોક્ષમાર્ગ જાહીને વેશ ધારણ કરે છે, તેમને દ્રવ્યલિંગનો પક્ષ છોડાવવાનો ઉપદેશ આપ્યો છે. વેશમાત્રથી, બાધ્યતામાત્રથી મોક્ષ થતો નથી. પરમાર્થ મોક્ષમાર્ગ તો આત્માના પરિણામ જે દર્શન-જ્ઞાન-ચારિત્ર છે, તે જ છે. વ્યવહાર આચારસૂત્રના કથનાનુસાર જે મુનિ-શ્રાવકના બાધ્ય વ્રત છે, તે વ્યવહારથી નિશ્ચય મોક્ષમાર્ગના સાધક છે; તે વ્રતોને અહીં છોડાવ્યા નથી, પરંતુ એમ કહું છે કે તે વ્રતોનું પણ મમત્વ છોડીને પરમાર્થ મોક્ષમાર્ગમાં લાગવાથી મોક્ષ થાય છે, કેવળ વેશમાત્રથી-વ્રતમાત્રથી મોક્ષ થતો નથી.”

ઉક્ત સંદર્ભમાં પંડિત ટોડરમલજીના વિચાર પણ દાખલ છે; જે આ પ્રમાણે છે.

“ત્યાં કારણ તો અનેક પ્રકારના હોય છે. કોઈ કારણ તો એવા હોય છે, જેમના હોવા સિવાય કાર્ય થતું નથી અને જેમના થવાથી કાર્ય થાય પણ ને ન પણ થાય. જેમ મુનિલિંગ ધારણ કર્યા વિના મોક્ષ તો થતો નથી; પરંતુ મુનિલિંગ ધારણ કરી લેતાં મોક્ષ થાય પણ છે અને નથી પણ થતો તથા કેટલાક કારણ એવા છે કે મુખ્યત્વે તો તેમના હોવાથી જ કાર્ય થાય છે; પરંતુ કોઈને તે થયા વગર પણ કાર્યસિદ્ધ થાય છે. જેમકે - અનશનાદિક બાધ્યતપનું સાધન કરવાથી મુખ્યત્વે મોક્ષપ્રાપ્તિ થાય છે; પરંતુ ભરતાદિકને બાધ્યતપ કર્યા વગર જ મોક્ષની પ્રાપ્તિ થઈ તથા કેટલાક કારણ એવા છે કે જેમના હોવા પર કાર્યસિદ્ધ થાય ને થાય છે અને તેમના ન હોવા પર સર્વથા કાર્યસિદ્ધ થતી નથી. જેમકે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકના થતાં તો મોક્ષ થાય ને થાય જ છે અને તેમના

ન હોવા પર સર્વથા મોક્ષ થતો નથી. આવા આ કારણ કહ્યા, તેમાં અનિશ્ચયપૂર્વક નિયમથી મોક્ષનો સાધક જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની ઓક્તા તે મોક્ષમાર્ગ જાગ્રવો.”^૧

દોડરમલજીના ઉક્ત કથનમાં પણ એ જ કહેવામાં આવ્યું છે કે મુક્તિનું નિયામક કારણ તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રકૃપ પરિણામ જ છે, શેષ બે કારણ તો ઉપચારિત કારણ છે.

ઉક્ત સંપૂર્ણ પ્રકરણનું મંથન કરતાં પૂજ્ય ગુરુદેવ કહે છે - “આ શરીરની નગનદશા, પાંચ મહાવ્રત અને અષ્ટાવીસ મૂળગુણોનો બાધ્ય વ્યવહાર વાસ્તવિક મુનિપણું નથી. એ તો ભાવલિંગી સંત મુનિવરોને સહચારીક્રપે હોય છે, નિમિત્તક્રપે હોય છે, તેથી તેને દ્રવ્યલિંગ કહે છે. દ્રવ્યલિંગ નથી હોતું - તેવું પણ નથી અને દ્રવ્યલિંગ સત્યાર્થ મોક્ષમાર્ગ છે - એવું પણ નથી ભાઈ ! માર્ગ જેવો છે, તેને યથાર્થ - તેવો જ સમજવો જોઈએ.^૨

ભાઈ ! જેને અંતરંગમાં નિર્મળ જ્ઞાન-દર્શન-ચારિત્રમય ભાવલિંગ પ્રગટ થાય છે, તેને બહારમાં અષ્ટાવીસ મૂળગુણોના વિકલ્પકૃપ દ્રવ્યલિંગ હોય છે; પરંતુ તે બધો રાગ છે. મુનિરાજ તેને છોડીને પરમ મુક્તિપદને પ્રાપ્ત કરે છે.^૩

જુઓ, આચાર્ય કુંદુંદ્રદેવ જિનેન્દ્રદેવની સાક્ષી આપીને કહે છે કે દ્રવ્યલિંગ વાસ્તવમાં મોક્ષમાર્ગ નથી; કારણ કે તે આત્માના પરિણામ નથી. જ્યારે દર્શન-જ્ઞાન-ચારિત્ર આત્માના પરિણામ છે. તેથી નિશ્ચયથી તે જ મોક્ષમાર્ગ છે.^૪

પરમપારિણામિક ધ્રુવસ્વભાવની નિર્મળરત્નત્રયકૃપ પરિણતિ મોક્ષનું કારણ અને તેની પૂર્ણતા થબી તે મોક્ષ છે.^૫

૧ મોક્ષમાર્ગ પ્રકાશન પાનું ૩૧૩-૩૧૪

૨ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૧૭૭

૩ તે જ, પાનું ૧૭૮-૧૮૦

૪ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૧૮૦-૧૮૧

આ દેહની નગનદશા, પંચમહાવતના પરિણામ, અષ્ટાવીસ મૂળગુણોનું પાલન આ બધા દેહમયલિંગ છે, તેથી તે પુદ્ગલદ્રવ્યમય છે. મુનિરાજેને તે અવશ્ય હોય છે; પરંતુ તે મોક્ષમાર્ગ નથી; કારણ કે તે રાગભાવ છે, દેહાશ્રિત પરાશ્રિતભાવ છે અને પરદ્રવ્યમય છે તેથી તે મોક્ષમાર્ગ નથી.^૧

મોક્ષ તો આત્માના આશ્રયથી થનારા પરિણામ છે. અને તેનું કારણ (માર્ગ) પણ આત્માશ્રિત પરિણામ જ છે. રાગ તો વિભાવ છે, તે આત્માના પરિણામ નથી. નિશ્ચયથી તેને પુદ્ગલમય અને પુદ્ગલ કહ્યા છે. દેહમયલિંગ મોક્ષનો માર્ગ નથી. પણ તેનો અર્થ એમ પણ નથી કે કોઈ શુભને છોડીને અશુભમાં જય. વ્યવહાર છોડીને નીચે પડવાની વાત નથી, પણ વ્યવહારથી પણ ઉપર ઉઠીને સ્વરૂપમાં રમણતા અને અંતલીનિતા કરવાની આ વાત છે. સમ્યગદર્શન સહિત સમ્યક્યારિત આત્માના અવલંબનથી પ્રગટ થાય છે, વ્યવહાર-રાગથી નહીં. તેથી જે વ્રતાદ્ધિના વિકલ્પ થાય છે, તેમને છોડીને સ્વરૂપમાં લીન થવાની આ વાત છે. ભાઈ ! શુભરાગના પરિણામને દેહમયલિંગ કહ્યા છે અને તે અન્યદ્રવ્યમય હોવાથી મોક્ષમાર્ગરૂપ નથી - એમ કહ્યું છે.^૨

જુઓ, આચાર્ય કુંદુંદ અને આચાર્ય અમૃતચંદ્ર પોતે સ્પષ્ટ કરે છે કે આ નગનદશા અને પંચમહાવતાદિ અષ્ટાવીસ મૂળગુણોનો વિકલ્પ મોક્ષમાર્ગ નથી. આ વાત મૂળ ગાથા અને ટીકામાં કહી રહ્યા છે. અરે પ્રભુ ! દેહની નગનતા અને શુભરાગથી મોક્ષમાર્ગ માનવો તે મિથ્યાશાલ્ય છે; તે મોક્ષમાર્ગ નથી.^૩

વાત બહુ ગંભીર છે. આ કથનનો અભિપ્રાય જરા પણ એવો નથી કે કોઈનું વ્રત છોડીને અવત અવસ્થામાં પતન થઈ જય. કોઈ પણ ઉપદેશ ઉચ્ચે ચડવા માટે આપવામાં આવે છે, નીચે પડવા માટે નહીં, અહીં આ

^૧ પ્રથમનરત્નાકર ભાગ ૧૦, પાનું ૧૮૨

^૨ તે જ, પાનું ૧૮૩

^૩ પ્રથમનરત્નાકર ભાગ ૧૦, પાનું ૧૮૪

કહેવાનો અભિપ્રાય વ્રતો અને વિકલ્પોથી પણ હીને સ્વરૂપમાં જોડાઈ જવાનો છે.

અનંત ગુણોથી ભરેલા ભગવાન આત્માના, કારણ પરમાત્માના આશ્રયથી પ્રગટેલા શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ જ મોક્ષમાર્ગ છે. તેથી પોતાના આત્માને તેમાં જ જોડાવું યોગ્ય છે.^૧

સમાવિતંત્ર શ્લોક ૮૭, ૮૮, ૮૯ આધારે કોઈક લોકો એવું કહે છે કે ‘લિંગનો આગ્રહ હોવો ન જોઈએ’. પરંતુ તે તેમનો ભિથ્યા અભિપ્રાય છે. સમાવિતંત્રના કથનનો આશય તો એમ છે કે દેહની નગનદશા અને વ્રતના વિકલ્પ દેહાશ્રિત છે, ‘તેથી મોક્ષ થાય છે અથવા તે મોક્ષનું કારણ છે’ - એવો આગ્રહ છોડી દેવો જોઈએ. ભાઈ ! મુનિદશામાં બાહ્યલિંગ તો નગન જ હોય છે, પરંતુ આ શરીરની નગનદશા મુક્તિનો માર્ગ નથી. તેથી આ ખોટો અભિપ્રાય છોડવાની વાત છે. વસ્ત્રસહિત મુનિપણું માનવાની વાત તો ત્રણકાળમાં સંભવ જ નથી. જેને પણ મોક્ષ થશે, નગનદશામાં જ થશે. દિગંબર નગનદશા થયા વિના પણ મોક્ષ નથી અને દિગંબર નગનદશાથી પણ મોક્ષ નથી - આમ વાત છે. મુનિરાજને આવશ્યકરૂપે નગનદશા જ હોય છે. વસ્ત્ર-પાત્ર આદિ મુનિના થઈ શકતા જ નથી. વસ્ત્રસહિત લિંગ તો કુલિંગ જ છે.^૨

ભાઈ ! ભાવલિંગ સહિત દ્રવ્યલિંગઙ્કૃપ નગનદશા તો યથાર્થ આવી જ હોય છે; પરંતુ આવી સ્થિતિમાં પણ એક ભાવલિંગ જ મોક્ષનું કારણ છે, દ્રવ્યલિંગ મોક્ષનું કારણ નથી; છતાં પણ કોઈ દ્રવ્યલિંગને જ મોક્ષનું કારણ માનીને બેખ ધારણ કરીને સંતુષ્ટ રહે, તેનો દ્રવ્યલિંગનો પક્ષ છોડાવવા માટે આ ઉપદેશ છે. ભાઈ ! દિગંબર ધર્મ કોઈ પક્ષ નથી. એ તો વસ્તુસ્વરૂપ છે.^૩

૧ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૧૮૬

૨ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૧૮૬

૩ તે જ, પાનું ૧૮૭

અહીં અભિપ્રાય એમ છે કે વ્રતોનું પણ મમત્વ છોડીને પરમાર્થ મોક્ષમાર્ગમાં જોડાવાથી મોક્ષ થાય છે, કેવળ બેખ્માત્રથી, વ્રતમાત્રથી મોક્ષ થતો નથી. સ્વરૂપનું શ્રદ્ધાન, જ્ઞાન, રમણીતા-સ્થિરતા જ એકમાત્ર મોક્ષમાર્ગ છે. તેમાં જોડાવાથી જ મોક્ષ થાય છે. અહીં તો માત્ર એમ જ સિદ્ધ કરવું છે કે માત્ર બાહ્યવેશમાં મોક્ષમાર્ગ નથી. બાહ્યવેશ કંઈ પણ હો - એમ પણ નહીં ચાલે. બાહ્યમાં નગનદશા થવી એ તો અનિવાર્ય જ છે. બસ, આટલો આરોપ જોઈ ઉપચારથી જ તેને મોક્ષનું સાધન કર્યું છે.”

પૂજ્ય ગુરુદેવના ઉક્ત કથનથી આ વાત અત્યંત સ્પષ્ટ છે કે ભલે નગન દિગંબરદશા વગર મોક્ષ થતો નથી; છતાં પણ નગન દિગંબરદશા મુક્તિનું કારણ નથી; મુક્તિનું કારણ તો આત્માના આશ્રયથી આત્મામાં જ ઉત્પત્ત થનારા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રકૃપ નિર્મણ પરિણાત જ છે, નિશ્ચય રત્નત્રય જ છે. તેમના ઉક્ત કથનથી તેમને ‘ધૂપાયેલા શેતાંબર’ કહેનારાઓને પણ પોતાની કલ્પના પર ફરીથી વિચાર કરવાની આવશ્યકતા છે; સાથે જ તેમને પણ વિચાર કરવો જોઈએ; જેઓ કુંદુંદના ઉક્ત કથનોમાંથી પણ આ ભાવ કાઢવાનો પ્રયત્ન કરે છે કે જ્યારે લિંગ મુક્તિનું કારણ છે જ નહીં તો પછી દિગંબર (નગન) દશા અનિવાર્ય શા માટે ? કોઈપણ લિંગથી મોક્ષ થવાનું સંભવ થઈ શકે છે.

આ પ્રમાણે આ ગાથામાં એમ જ કહેવામાં આવ્યું છે કે ભલે નગન દિગંબરદશાકૃપ દ્રવ્યલિંગ વગર મોક્ષ થતો નથી; છતાં પણ સાચો મુક્તિમાર્ગ તો નિશ્ચયરત્નત્રયકૃપ ભાવલિંગ જ છે.

હવે આ જ વાતનું પોષક કળશ કાવ્ય લખે છે; જે આગામી ગાથાની ઉત્થાનિકા પણ પ્રસ્તુત કરે છે. તે કળશ આ પ્રમાણે છે.

(અનુષ્ઠળ)

દર્શનજ્ઞાનચારિત્રયાત્મા તત્ત્વમાત્મન: ।

એક એવ સદા સેવ્યો મોક્ષમાર્ગો મુમુક્ષુણા ॥૨૩૧॥

(હરિગીત)

બસ શાનદર્શનચરાગત્રિક એ આત્માનું તત્વ છે;
મોક્ષબ્ધુએ તેથી સદા એ મોક્ષમાર્ગ જ સેવ્ય છે. ૨૩૮

આત્માનું તત્વ દર્શનજ્ઞાન ચારિત્રયાત્મક છે; તેથી મુમુક્ષુઓએ
દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ આ એક મોક્ષમાર્ગનું જ સેવન કરવું જેઈએ.

કવિવર બનારસીદાસજી નાટક સમયસારમાં ઉક્ત કળણનો ભાવ
બે દોહામાં આ પ્રમાણે પ્રસ્તુત કરે છે -

(દોહા)

જો દ્વાલતા ભાવ સો, પ્રગટ ગ્યાન કૌ અંગ ।
પૈ તથાપિ અનુભ્રૌ સદા, વરતૈ વિગત તરંગ ॥
દરસન ગ્યાન ચરન દસા, કરૈ એક જો કોડ્ઝ ।
થિર હૈ સાધૈ મોખ-મગ, સુધી અનુભવી સોડ્ઝ ॥

ભલે દ્વાના પરિણામ પણ આત્માનું જ અંગ છે; છતાં પણ
અનુભવની દશા તો નિસ્તરંગ જ હોય છે.

દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ દર્શાને પ્રાપ્ત કરીને; તેમાં જ સ્થિર થઈને
જે મોક્ષમાર્ગને સાધે છે; તે બ્યક્તિ સુધીર (બુદ્ધિમાન) અને અનુભવી છે.

ઉક્ત કથનનું તાત્પર્ય એ છે કે દ્વાના આદિના પરિણામ શુભભાવ
હોવાથી પુણ્યબંધનું કારણ છે અને તેથી જ તેમને વ્યવહારથી ધર્મ પણ
કહેવામાં આવે છે. છતાં પણ તે દ્વાદિના પરિણામ વિકલ્પરૂપ છે; તેથી
તેમનાથી નિસ્તરંગરૂપ અનુભવદર્શાની પ્રાપ્તિ થઈ શકતી નથી. વાસ્તવિક
ધર્મ તો નિસ્તરંગ અનુભવદર્શા જ છે. તે જ દર્શનજ્ઞાનચારિત્રરૂપ પરિણામ
છે. તેથી જે બ્યક્તિ નિશ્ચય-દર્શનજ્ઞાનચારિત્રરૂપ પરિણમીને આત્મામાં જ
સ્થિર થાય છે; તે જ અનુભવી અને સમજદાર છે.



(गीता)

समयसार गाथा ४१२

जे वात पाइगना कणशमां कहेवामां आवी हती; हवे ते ज वातने
गाथा द्वारा स्पष्ट करे छे -

मोक्षपहे अप्याणं ठवेहि तं चेव झाहि तं चेय ।
तथेव विहर णिच्चं मा विहरसु अण्णदव्वेसु ॥४१२॥

(हरिगीत)

तुं स्थाप निजने भोक्षपंथे, ध्या, अनुभव तेहने;
तेमां ज नित्य विहार कर, नहि विहर परद्रव्यो विषे. ४१२

हे भव्य ! तुं पोताना आत्माने भोक्षमार्गमां स्थाप. ऐटले के
पोताना आत्मानुं ज ध्यान कर, आत्मामां ज चेत, आत्मानो ज अनुभव
कर अने पोताना आत्मामां ज निरंतर विहार कर; परद्रव्योमां विहार न
कर.

तात्पर्य ए छे के पोताना आत्मामां ज उपयोगने लगाइ,
परद्रव्योमां उलझवाथी कुर्द लाभ नथी.

आ गाथानो भाव आत्मभ्यातिमां आ प्रमाणे स्पष्ट करवामां
आव्यो छे.

“आम तो आ पोतानो आत्मा अनादिकाण्ठी पोतानी प्रशाना
दोषथी परद्रव्य अने राग-देखादिमां निरंतर स्थित छे; छतां पाण हे
आत्मन् ! तुं पोतानी प्रशाना गुण वडे पोताने त्यांथी हटावीने ज्ञान-
दर्शन-चारित्रमां निरंतर स्थापीने, समस्त चिंता (चिंतवन-विकल्प) नो

નિરોધ કરીને પોતામાં જ અત્યંત એકાગ્ર થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રનું જ ધ્યાન કર અને સમસ્ત કર્મચેતના અને કર્મકુળચેતનાના ત્યાગ વડે શુદ્ધજ્ઞાનચેતનામય થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રને જ ચેત, અનુભવ કર અને દ્રવ્યના સ્વભાવના વશે પ્રતિક્ષણે ઉત્પન્ન થનારા પરિણામો વડે તનમય પરિણામવાળો (દર્શન-જ્ઞાન-ચારિત્રવાળો) થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ વિહાર કર અને એક જ્ઞાનકૃપને જ અચળપણે અવલંબતો થકો જ્ઞાનકૃપ સમસ્ત પરદ્રવ્યોની ઉપાધિઓમાં જરા પણ ન વિહાર.”

આચાર્ય જ્યસેન આ ગાથાનો અર્થ કરતાં સીધી-સાદી ભાષામાં કહે છે કે “હે બબ્ય ! પોતાના આત્માનો, શુદ્ધજ્ઞાન દર્શનસ્વભાવી આત્માના દર્શન-જ્ઞાન-આચરણકૃપ અભેદ રત્નત્રયસ્વકૃપ મોક્ષમાર્ગનો પરમસમરસીભાવથી સદા અનુભવ કર, તેનું જ ધ્યાન કર, નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈ જ, તેમાં જ વિહાર કર, તેકૃપ જ પરિણમી જ; પહેલા જ્ઞેલા, સાંભળેલા, અનુભવેલા ભોગોની આકાંક્ષાકૃપ નિદાનબંધાદ્ધિકૃપ પરદ્રવ્યોના આલંબનથી ઉત્પન્ન થયેલા શુભાશુભ સંકલ્પ-વિકલ્પોમાં ન વિહાર, તેકૃપ પરિણમિત ન થા.”

આ ગાથા અને તેની ટીકાનો ભાવ ખોલતાં પૂજ્ય ગુરુદેવ લખે છે -

“ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા આનંદનો રસકંદ છે; પરંતુ અનાદિ સંસારથી માંડીને પ્રજ્ઞાના દોષથી પોતાને ભૂલી ગયો છે અને અનાદિથી નિરંતર રાગ-ક્રેષ્માં જ સ્થિત રહ્યો છે. પરની કિયાને તો કોઈ કરી જ શકતું નથી. ભાઈ ! પોતે જ પોતાના સ્વકૃપને ભૂલીને પર્યાયમાં નવા-નવા સંકલ્પ-વિકલ્પ કરે છે. તે જીવનો પોતાનો જ અપરાધ છે. તેથી પર્યાયમાં અનાદિથી આવી ભ્રમણા ચાલી આવી છે. અંતરંગમાં પોતે સ્વભાવથી તો જ્ઞાનાનંદસ્વકૃપ જેવો છે, તેવો જ છે.”^૧

‘પ્રજ્ઞાના ગુણ વડેનો અર્થ છે કે સ્વપુરુષાર્થ વડે પોતાના આત્માને

આત્મામાં જ સ્થાપિત કર. ‘હી’ શબ્દથી કોઈક લોકોને એકાંત જેવું લાગતું હશે; પરંતુ આ શબ્દ દઢતાનો સૂચક છે, આ સમ્યક એકાંત છે; કારણ કે બીજી કોઈ વિધિ-ઉપાય છે જ નહીં।^૧

હવે ગાથામાં આવેલા બીજા બોલની વ્યાખ્યા કરતાં આચાર્ય કહે છે કે સમસ્ત અન્ય ચિંતાઓનો નિરોધ કરીને અંતરમાં સ્વ-સ્વકૃપમાં એકાગ્ર થઈને દર્શનજ્ઞાનચારિત્ર સ્વકૃપ એક આત્માને જ ધ્યાવો ! તાત્પર્ય છે કે કે ભગવાન શુદ્ધ ચૈતન્ય ધ્યુવ આત્મા જે અંદરમાં બિરાજમાન છે, તેને દર્શિમાં લઈને તેને એકને જ આગળ કરીને શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રનું જ ધ્યાન કર ! અહીં પર્યાયની અપેક્ષાએ વાત કરી છે, બાકી નિકાળી શુદ્ધ દ્રવ્યને જ ધ્યાવવાનું છે.^૨

લોકમાં ઉત્તમ, મંગળ અને શરાણકૃપ પદાર્થ પોતાનો આત્મા જ છે. તેથી પરથી ધૂટીને પોતાના આત્માને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ સ્થાપ, તેનું જ ધ્યાન કર.

ભાઈ ! ધ્યાન કરવાનું તો તને આવડે જ છે. અનાદિથી સંસારના કારણભૂત આર્ત-રૌદ્ર ધ્યાન તો તું કરતો જ રહ્યો છે ને ! પરંતુ તે દુઃખમય છે. તેથી હવે કહે છે કે તું સ્વકૃપનું જ હવે ધ્યાન કર ! સ્વકૃપની દર્શિ, રમણતા એ જ સ્વકૃપનું ધ્યાન છે અને તે આનંદકારી છે, મંગળકારી છે.

હવે તીજ બોલની વ્યાખ્યા કરતાં કહે છે કે દ્વા, દાન, વ્રત, ભક્તિના રાગભાવકૃપ કર્મચેતના અને હર્ષ-શોકના ભાવકૃપ કર્મકળચેતનાના ત્યાગભાવથી જ્ઞાનચેતનામય થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ ચેત, તેનો જ અનુભવ કર, તારો આત્મા કે જે જ્ઞાયક પ્રભુ પરમાત્મસ્વકૃપ છે, તેમાં જ એકાગ્ર થઈને, તેમાં જ રમણતા કર, શુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્રને જ જગૃત કર, તેનો જ અનુભવ કર.

હવે ચોથા બોલનો ખુલાસો કરે છે - જુઓ ! દ્રવ્યના સ્વભાવના

^૧ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૧૯૬-૧૯૭

^૨ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૧૯૭-૧૯૮

આશ્રયથી ક્ષણે-ક્ષણે દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ ઉત્પન્ન થાય છે. દ્રવ્યસ્વભાવના વશથી જે પરિણામ ઉત્પન્ન થાય છે, તે નિર્ભળરત્નત્રયના પરિણામ હોય છે.^૧

તેથી તું તો આ નિર્ભળપરિણામન વડે તન્મય પરિણામવાળો થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ વિહાર કર. પુણ્ય-પાપના ભાવોમાં, દુઃખના ભાવોમાં વિહાર ન કર. તારી અંદર જ પૂર્ણાનંદનો નાથ નિર્ભળ આત્મા વિઘ્નમાન છે, તેના આશ્રયથી જે ક્ષણેક્ષણે દર્શન-જ્ઞાન-ચારિત્રના નિર્ભળ પરિણામ થાય છે, તેમાં જ વિહાર કર ! સ્વર્ગ અને નરકાદિ ચારેય ગતિઓ દુઃખદ્રષ્ટપ છે, તેથી પુણ્ય-પાપમાં ન વિહાર.^૨

સમોવશરણમાં વાધ, સિંહ વળે સેંકડો પશુઓ વાણી સાંભળવા આવે છે, સ્વર્ગનાં ઈન્દ્ર અને દેવતાઓનો સમુહ, શ્રાવક-શ્રાવિકાઓ અને મુનિવરો દિવ્યધ્વનિ સાંભળવા આવે છે; એ વાણી કેવી અલૌકિક હુશે? અરે ! ભરતક્ષેત્રમાં વર્તમાનમાં ભગવાનનો વિરહ થઈ ગયો છે; પરંતુ આપણા સૌભાગ્યથી તેમની વાણી બચી ગઈ છે અને આપણને પ્રાપ્ત પણ થઈ ગઈ છે. તે વાણીમાં ભગવાન કહે છે કે પ્રભુ ! તારા દ્રવ્યસ્વભાવનો તને ક્યારેય વિરહ થઈ નથી શકતો, તારી અંદર જ્ઞાન-દર્શન-શાંતિ અને આનંદનું ધૂબદળ પહુંચે છે. તે એકનું જ અચળપણે આલંબન લઈને પ્રાપ્ત થનારા નિર્ભળદર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ તું વિહાર કર ! બીજે ક્યાંય પણ વિહાર ના કર ! કારણ કે બીજે ક્યાંય પણ સુખ-શાંતિ નથી.^૩

જગનાથ ! એક વાર જગ !! સ્વભાવથી તું પોતે ચૈતન્યસ્વરૂપ ભગવાન છે; તેથી તું પોતાના તે સ્વભાવનું આલંબન લે. નિભિત્તના, દેવ-શાસ્ત્ર-ગુરુના, રાગના આલંબનમાં ન જ; કારણ કે પરના અને રાગના

૧ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૧૮૮

૨ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૧૮૮

૩ તે જ, પાનું ૧૮૮

અવલંબનથી ધર્મ નથી થતો. એક ધૂષ જ્ઞાનસ્વરૂપ આત્માના આલંબનથી જ ધર્મ થાય છે. અરે ! અધિક શું કહીએ ? આ જે નિર્મળપર્યાંયો પ્રગટ થાય છે, તેમના આલંબનથી નવી નિર્મળ પર્યાંયો ઉત્પન્ન થઈ શકતી નથી. બસ, એક ધૂષના ધ્યાનથી જ ધર્મ થાય છે.^૧

જેમ પાતાળમાં પાણી-પાણી જ રહે છે, તેમ જ તારા ધૂષસ્વભાવના પાતાળમાં અનંત-અનંત જ્ઞાન અને આનંદ ભર્યો છે. તે પાતાળમાં પ્રવેશ કરતાં જ પર્યાંયમાં અતીન્દ્રિય આનંદ ઉછળશે. તું ન્યાલ થઈ જઈશ, તારું જીવન ધન્ય થઈ જશે, અંતરમાં વિદ્યમાન ધૂષને ધ્યાનનું ધ્યેય બનાવતાં ધર્મ (જૈનધર્મ) પ્રગટ થશે. એક ધૂષના અવલંબનથી જ ધ્યાન થાય છે - આવો જ સમ્યક એકાંત છે. એક ધૂષના આશ્રયથી ધર્મ થાય છે અને વ્યવહારથી થતો નથી - આનું નામ સમ્યક અનેકાંત છે.

આગળ કહે છે કે પુણ્યના પરિણામ પરક્ષેયરૂપ ઉપાધિભાવ છે. ભાઈ ! જે તું પરની તરફ જુએ તો તને વિકલ્પરૂપ ઉપાધિ ઉઠ છે. ભગવાન કહે છે કે જે તું મારી તરફ જોઈશ તો પણ રાગ જ થશે, ઉપાધિ જ થશે; ધર્મ નહીં થાય. જ્ઞાનીને પણ વ્યવહારના શુદ્ધભાવ આવે છે, પરંતુ તે ઉપાધિ છે. તેથી બધી બાજુ ફેલાયેલા પરદ્રવ્યમાં વિહાર ના કર !

જુઓ, દેવ-શાસ્ત્ર-ગુરુના શ્રદ્ધા-વિનયનો ભાવ રાગ છે, વ્યવહાર છે; પંચમમહાવતના પરિણામ, જ કાયની રક્ષાના પરિણામ, શાસ્ત્ર વાંચવા-લખવાનો ભાવ રાગ છે, વ્યવહાર છે. આ બધા વ્યવહાર જ્ઞેયરૂપ ઉપાધિ છે, સ્વભાવ નથી, પરદ્રવ્ય છે. તેમાં જરાપણ, કંઈ પણ ઝચિ ન લે, તેની તરફ જેતો પણ નહિં. શુદ્ધ નિશ્ચયસ્વરૂપ એક જ્ઞાયકસ્વરૂપ ભગવાન આત્માનું જ આલંબન પ્રાપ્ત કરીને શુદ્ધદર્શન-જ્ઞાન-ચારિત્રમાં વિહાર કર, તેમાં જ ઉપયોગને કેન્દ્રિત કર.^૨

ભગવાન કહે છે કે 'તું મારી સામે પણ ના જે ! જોઈશ તો તને

^૧ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૧૯૯-૨૦૦

^૨ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૨૦૦

રાગ પણ થશે; કારણ કે હું પરદ્રવ્ય છું, હું તાકું દ્રવ્ય નથી તેથી મારા લક્ષ્યથી તાકું કલ્યાણ નહીં થાય. આ રાગની જ ઇચ્છિ છે ને ! તેથી તું પોતાના ચિદાનંદસ્વરૂપ પ્રભુની ઇચ્છિ કર, તેની જ દર્શિ કર; તેમાં જ રમણતા, લીનતા કર ! બસ, આ જ ધર્મ છે. આ જ મોક્ષમાર્ગ છે.

દર્શન-શાન-ચારિત્રમાં જ આત્માને સ્થાપિત કર ! તેનું જ ધ્યાન કર ! તેનો જ અનુભવ કર ! તેમાં જ વિહાર કર પ્રવર્તન કર ! અન્ય દ્રવ્યોમાં પ્રવર્તન ન કર ! આ જ પરમાર્થથી ઉપરેશ છે.”

ઉક્ત સંપૂર્ણ કથનનો સાર એ છે કે ભલે આ ભગવાન આત્મા અનાદિથી પોતાની પ્રજ્ઞાના દોષથી અર્થાત્ પોતાનો જ વિભાવપરિણમનરૂપ પર્યાયગત યોગ્યતાથી પોતે જ રાગ-ક્રેષ્ટપે પરિણમી રહ્યો છે; છતાં પણ પોતે જ પ્રજ્ઞાના ગુણથી અર્થાત્ પોતાની જ સ્વભાવ-પરિણમનરૂપ પર્યાયગત યોગ્યતાથી પોતાને વિકારી પરિણમનથી હટાવીને દર્શન-શાન-ચારિત્રરૂપ પરિણમન કરી શકે છે. તાત્પર્ય એ છે કે એના વિકારરૂપ પરિણમનમાં ન તો કોઈ પરનો દોષ છે અને સ્વભાવરૂપ પરિણમન પણ કોઈ બીજું નહિ કરાવે. તેથી પોતે જ વિકારી પરિણમને છોડીને સ્વભાવરૂપે પરિણમી શકે છે.

તેથી હે આત્મન્ ! હવે સમ્યક્રતનત્રયરૂપે પરિણમીને પોતાને પોતાની મેળે જ મોક્ષમાર્ગમાં સ્થાપ !

જે ભગવાન આત્માના આશ્રયથી સમ્યગ્દર્શન-શાન-ચારિત્રની ઉત્પત્તિ થાય છે; એકમાત્ર તેનું જ બધા વિકલ્પોનો અભાવ કરીને ધ્યાન કર. કર્મચેતના અને કર્મફળચેતનાના અભાવપૂર્વક શાનચેતનામાં જ ચેત અને પોતાના ભગવાન આત્મામાં જ વિહાર કર, અન્ય દ્રવ્યોમાં વિહાર ન કર; કારણ કે ત્યાં તને કંઈ પણ ઉપલબ્ધ થવાનું નથી.

અરિહંત ભગવાન પણ પોતાની દિવ્યધ્વનિમાં એમ જ કહે છે કે તું અમારી સામે શું જુએ છે ? પોતાની તરફ જે; કારણ કે નિશ્ચયરતનત્રયની

પ્રાપ્તિ તને તારા પોતાના આશ્રયથી જ થશે, અમે તો તારા માટે પરદ્રવ્ય જ છીએ. તું પરદ્રવ્યમાં વિહાર ન કર, સ્વયંમાં જ વિહાર કર !

આ પ્રમાણે આચાર્યદૈવ અહીં પોતાના ઉપયોગને સમસ્ત જગતથી હટાવીને આત્મામાં જ લગાવવાની પ્રેરણા આપી રહ્યા છે.

હવે આ જ ભાવનું પોષક કળશ કાવ્ય લખે છે; જે આ પ્રમાણે છે -

(શાર્દૂલવિક્રિડિત)

એકો મોક્ષપથો ય એષ નિયતો દ્રગ્જન્મિવૃત્યાત્મક-
સ્તત્રેવ સ્થિતિમેતિ યસ્તમનિશાં ધ્યાયેચ્ચ તં ચેતતિ ।
તસ્મિન્ત્રેવ નિરંતર વિહરતિ દ્રવ્યાંતરાણ્યસ્પૃશન्
સોઽવશ્યં સમયસ્ય સારમચિરાન્ત્રિત્યોદયં વિંદતિ ॥૨૪૦॥

(હસ્તિત)

દગ્ગાનચરણસ્વરૂપ જે આ નિયત મારગ મોક્ષનો,
તેમાં જ સ્થિર થઈ નિરંતર ધ્યાવતો ને ચેતતો;
તેમાં સદા જે વિહરતો નહીં અન્ય દ્રવ્યો સ્પર્શતો,
નિત્યોદયી એવા સમયના સારને તે પામતો. ૨૪૦

જે પુરુષ દર્શન-જ્ઞાન-ચારિત્રકૃપ નિયત મોક્ષમાર્ગમાં સ્થિત થાય છે, તેનું જ ધ્યાન કરે છે, તેમાં જે ચેતે છે, તેનો જ અનુભવ કરે છે અને અન્ય દ્રવ્યોને ન સ્પર્શતો થકો નિરંતર તેમાં જ વિહાર કરે છે; તે પુરુષ નિત્યોદિત સમયસારને અલ્પકાળમાં જ અવશ્ય પ્રાપ્ત કરે છે.

જે વાત ગાથામાં કહેવામાં આવી હતી, તે જ વાત આ કળશમાં તે જ શબ્દોમાં કહેવામાં આવી છે.

ઉક્ત કળશના ભાવને સ્પષ્ટ કરતાં પૂજ્ય ગુરુદેવ લખે છે - “ભાઈ!
જે મોક્ષની ઈચ્છા છે તો બહારની ચમત્કારી-વિસ્મયકારી વસ્તુઓ તરફ
જેવાનું છોડી દે અને અનંત વિસ્મયોથી ભરેલો ભગવાન આત્મા જે તું

પોતે છે, તારા જ દેહ દેવાલયમાં બિરાળે છે; તેમાં ઝચિ કર, રમણતા કર; આ એક જ મોક્ષમાર્ગ છે.

અરે ! લોકો વ્રત-તપ આદિ ડિયાકાંડના વિકલ્પોમાં અટક્યા છે, પરંતુ વસ્તુ તો નિર્વિકલ્પ છે ! પ્રભુ ! તારા આ વિકલ્પો દ્વારા તે કેમ જાણી શકાય ? કેમ અનુભવી શકાય ? તેથી તું આ વિકલ્પોથી ઉપર ઉઠીને નિર્વિકલ્પ આત્માનો અનુભવ કરવાનો પ્રયત્ન કર; તેમાં જ તને પરમ આનંદની પ્રાપ્તિ થશે.¹

ભાઈ ! તું પોતે અંતરમાં શાંતિનો સાગર છે, તેમાં દુબકી લગાવી લે; ઉપયોગને તેમાં જ દુબાડી દે ! તું તો અંતરમાં ચિન્માત્ર ચિંતામણી દેવોનો દેવ ભગવાન મહાદેવ છે. ત્યાં જ પોતાની દઘિને કેન્દ્રિત કરીને તેમાં જ થંબી જ ! તને રત્નત્રય પ્રગટ થઈ જશે, અનાકુળ શાંતિનું નિધાન પ્રગટી જશે. આ જ એક માર્ગ છે, એક શુદ્ધ નિશ્ચયનું લક્ષ્ય કરવું તે જ એકમાત્ર સાધન છે. કેવળ બાહ્ય સાધનોથી આત્માણ નહીં થાય.”

કવિવર બનારસીદાસજી આ છંદનો ભાવ ત્રણ છંદોમાં બાંધવાનો પ્રયાસ આ પ્રમાણે કરે છે.

(સવૈયા ઇકતીસા)

જોઈ દ્રિગ ગ્યાન ચરનાતમ મેં બૈઠિ ઠૌર,

ભયો નિરદીર પરવસ્તુ કોઈ ન પરસૈ ।

સુદ્ધતા વિચારે ધ્યાવૈ સુદ્ધતા મેં કેલિ કરૈ,

સુદ્ધતા મેં થિર હૈ અમૃત ધારા બરસૈ ॥

ત્યાગિ તન કષ્ટ હૈ સપષ્ટ અષ્ટ કરમ કૌ,

કરિ થાન ભ્રષ્ટ નષ્ટ કરૈ ઔર કરસૈ ।

સો તૌ વિકલપ વિજઈ અલપ કાલ માંહિ,

ત્યાગિ ભૌ વિધાન નિરવાન પર પરસૈ ॥

¹ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૨૦૩-૨૦૪

જે પુરુષ સમ્બ્યગદ્ધિન-શાન-ચારિત્રમાં બેસીને, સ્થિર થઈને, નિર્વિકલ્પ થઈને પરવસ્તુનો સ્પર્શ પણ કરતો નથી અને શુદ્ધ આત્માનો જ વિચાર કરે છે, શુદ્ધાત્માનું જ ધ્યાન કરે છે, શુદ્ધાત્મામાં જ કેળિ કરે છે અને શુદ્ધાત્મામાં જ સ્થિર થઈને આનંદામૃત વરસાવે છે; તે મહાપુરુષો શારીરિક કખોની પરવાહ કર્યા વગર આઠ કર્મોને કમનેર કરીને નષ્ટ કરી હે છે અથવા નષ્ટ કરી રહ્યા છે અને નષ્ટ કરશે પણ તાત્પર્ય છે કે તેમની નિર્જરા કરીને તેમનો સર્વનાશ કરી હે છે. વિકલ્પોને જીતી લેનાર નિર્વિકલ્પ આત્માનુભૂતિસંપત્ત શાનીજન અલ્પકાળમાં જ જન્મ-મરણનો નાશ કરીને નિર્વાણપદને પ્રાપ્ત કરી લે છે.

અહીં જે 'કરસૈ' શબ્દ છે; તેના બે અર્થ થઈ શકે છે કરસૈ અર્થાત્ ઝૃષ્ટ કરે, કમનેર કરે - આ તો એક અર્થ થયો. બીજે અર્થ એ છે કે કરસૈ અર્થાત્ કરશે, ભવિષ્યમાં કરશે.

(ચૌપાઇ)

ગુન પરજી મેં દ્રિષ્ટિ ન દીજી । નિરવિકલપ અનુભૂ-રસ પીજી ॥

આપ સમાઝ આપમેં લીજી । તત્તુપૌ મેટિ અપનુપૌ કીજી ॥

ગુણ અને પર્યાયોને દર્ઢિમાં ઓડલ કરીને નિર્વિકલ્પ આત્માનુભૂતિ કરીને અતીન્દ્રિય આનંદનો રસપાન કરો. શરીરમાંથી પોતાપણું છોડીને પોતાના આત્મામાં પોતાપણું ધારણ કરીને પોતામાં જ સમાઈને આત્માને પ્રાપ્ત કરી લો.

(દોહા)

તજિ વિભાउ હૂજી મગન, સુદ્ધાતમ પદ માંહિ ।

એક મોખ-મારગ યહૈ, ઔર દૂસરી નાંહિ ॥

વિભાવભાવોને છોડીને નિજ શુદ્ધાત્મામાં મગન થઈ જાઓ; કારણ કે આ જ એક મોક્ષનો માર્ગ છે, તેનાથી અતિરિક્ત બીજે કોઈ માર્ગ નથી.

બધું મળીને આ કળશનો આ જ ભાવ છે કે પોતાના આત્માને

જાણીને, ઓળખીને; તેમાં જ સમાઈ જવાથી કર્માંની નિર્જરા થાય છે અને મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે.

તેથી બધા આત્માર્થાઓનું એ જ કર્તવ્ય છે કે પોતાને જાણીને, ઓળખીને પોતામાં જ સમાઈ જય - આ જ એક માર્ગ છે, શેષ બધા ઉન્માર્ગ છે.

હવે આગામી ગાથાની ઉત્થાનિકાર્ય કળશ લખે છે જે આ પ્રમાણે છે.

(શાર્ડૂલવિક્રીદિત)

યે ત્વેનં પરિહૃત્ય સંવૃતિપથપ્રસ્થાપિતેનાત્મના
લિંગે દ્રવ્યમયે વહન્તિ મમતાં તત્ત્વાવબોધચ્યુતાઃ ।
નિત્યોદ્યોતમખંડમેકમતુલાલોકં સ્વભાવપ્રભા
પ્રાભારં સમયસ્ય સારમમલં નાદ્યાપિ પશ્યંતિ તે ॥૨૪૧॥

(હરિગીત)

પૂર્વોક્ત નિશ્ચયમાર્ગને છોડી પુર્ય નિજ આત્મને
બ્યવહારમારગ સ્થાપીને દ્રવ્યલિંગમાં મમતા કરે;
તત્ત્વાર્થશાન યથાર્થ વિરહિત વર્તતા જે આ રીતે,
નહિ અનુભવે તે પુર્ય હજુએ સમયના એ સારને;
જે ઉદ્દિત છે નિત્યે અને જે એક અમલ, અખંડ છે,
જેનો પ્રકાશ અતુલ છે, ચૈતન્યનો જે પુંજ છે. ૨૪૧

જે પુર્ય ઉક્ત પરમાર્થસ્વરૂપ મોક્ષમાર્ગને છોડીને બ્યવહાર માર્ગમાં
સ્થાપિત પોતાના આત્મા દ્વારા દ્રવ્યલિંગમાં મમતા ધારણ કરે છે; તે પુર્ય
તત્ત્વના યથાર્થ બોધથી રહિત હોવાને લીધે સમયના સારરૂપ નિત્ય
પ્રકાશમાન, અખંડ, એક, અતુલ, અમલ ચૈતન્યપ્રકાશમય આત્માને જેતા
નથી, આત્માનો અનુભવ કરતા નથી.

આનો ભાવાનુવાદ કવિવર બનારસીદાસજી આ પ્રમાણે કરે છે.

(सवैया)

केई मिथ्यात्रिष्ठि जीव धरै जिनमुद्रा भेष,
 क्रिया मैं मगन रहैं कहैं हम जती हैं ।
 अतुल अखण्ड मल रहित सदा उदोत,
 ऐसे ग्यानभाव सौं विमुख मूढ़मती हैं ॥

आगम संभालैं दोस टालैं विवहार भालैं,
 पालैं ब्रत जदपि तदपि अविरती हैं ।
 आपुकौं कहावैं मोख मारग के अधिकारी,
 मोख सौं सदीव रुष्ट दुष्ट दुरमती हैं ॥

भले अनेक मिथ्यादृष्टि ज्ञवो नग्नदिग्ंबर जिनमुद्राने धारण
 करीने ते संबंधी क्लियाकांडमां ज भग्न रहे छे अने कहे छे के अभे यति
 छीचे, साधु छीचे; पण ते भूढ़मतीओ अतुल, अखण्ड, अमल सदा
 उद्घोतमान शानभावथी विमुख ज रहे छे.

भले ते लोको आगमनुं अद्ययन करे छे, निर्दोष आहार-विहार
 करे छे; व्यवहारिक क्लियाओमां सावधान छे, प्रतोनुं पालन करे छे; छतां
 आत्मानुभव न होवाथी अविरति ज छे. ते दुष्ट दुर्भितिलोको भोक्षथी इकेला
 ज रहे छे, हूर ज रहे छे; छतां पोताने भोक्षभार्गना अधिकारी माने छे.

पूज्य गुरुदेव उक्त कलशना भावने आ प्रभाणे स्पष्ट करे छे -
 "ज्ञेओ द्रव्यलिंगने ज भोक्षभार्ग मानीने तेमां भमत्व राखे छे, तेमणे
 समयसारने अर्थात् शुद्धात्माने जाणयो ज नथी. आवुं कथन करनार
 गाथाओनी सूचनात्प आ कलश छे.

ऐमां कहुं छे के शुद्ध आत्मा चैतन्यस्वरूप शानानंदस्वरूप प्रभु
 छे. आ चैतन्यस्वरूप आत्मानी सन्मुख थर्ठने तेनुं श्रद्धान-शान अने
 आचरण प्रणट करवुं परमार्थस्वरूप निश्चय भोक्षभार्ग छे अने तेना सहकारी
 प्रतादिना रागने व्यवहार भोक्षभार्ग कहे छे.

અહીં કહે છે કે જે પુરુષો પરમાર્થસ્વરૂપ નિશ્ચય મોક્ષમાર્ગને છોડીને ઉક્ત વ્યવહારમોક્ષમાર્ગમાં સ્થાપિત પોતાના આત્મા વડે દ્વાયલિંગમાં મમતા કરે છે અર્થાત્ એમ માને છે કે આ દ્વાયલિંગ જ અમને મોક્ષમાર્ગ પ્રાપ્ત કરાવી હોશે, તેઓ યથાર્થ તત્ત્વજ્ઞાનથી રહિત રહેતાં શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરતા નથી, તેમને આત્માની અનુભૂતિ થતી નથી.

ભાઈ ! જેમને અંતરમાં નિજસ્વરૂપની રૂચિ અને રમણતારૂપ નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટ છે; તેમને જ્યાં સુધી પૂર્ણતા પ્રગટ ન થાય, ત્યાં સુધી બહારમાં વ્રત, તપ, ભક્તિ, પૂજા ઈત્યાદિ શુભરાગ હોય છે. તે શુભરાગ ઉપચારથી મોક્ષમાર્ગ છે - આમ સ્થાપિત કર્યું છે; પરંતુ કોઈ તેને જ સત્ત્યાર્થ મોક્ષમાર્ગ જાણીને તે જ આચરણમાં અટકી રહે તો તેઓ યથાર્થ તત્ત્વજ્ઞાનથી રહિત ભિથ્યાદ્રષ્ટિ છે. તેઓ સમયના સાર અર્થાત્ શુદ્ધાત્માનો અનુભવ કરતા નથી.^૧

ભગવાન આત્મા અખંડ છે. તેમાં અન્ય જોયોના નિમિત્તથી ખંડ થતા નથી. તે એક છે અર્થાત્ પર્યાયોથી અનેક અવસ્થાઓરૂપ થવા છતાં પણ તે પોતાના એકત્વને છોડતો નથી.

ભલે ને કેટલા પણ જોયોને જાણો, તો પણ જ્ઞાન ખંડ-ખંડ થતું નથી. અહીં ! ભગવાન પૂર્ણ જ્ઞાનધન પ્રભુ અખંડ પદાર્થ છે, એક છે. જ્ઞાન-દર્શન જેવા અનંત ગુણોની અનંત પર્યાયોરૂપે પરિણમવા છતા ત્રિકાળ એકરૂપ, જ્ઞાયકરૂપ જ રહે છે. આવી અખંડ, એકરૂપ નિજજ્ઞાયકવસ્તુનો અનુભવ થયો તે જ સમ્યગ્દર્શન છે.^૨

સમ્યગ્દર્શિ ઘર્માં જીવને નિશ્ચયની સાથે વ્યવહારતનત્ત્વયનો રાગ પણ આવે છે. તે સહજ આવે જ છે, તે કારણથી તેને સહકારી જાણીને તેનું સ્થાપન કર્યું છે, પરંતુ તે સત્ત્યાર્થ મોક્ષમાર્ગ નથી. વાસ્તવમાં તો તે બંધપદ્ધતિ જ છે. તેનું વ્યવહારનયથી વ્યવહારમોક્ષમાર્ગના રૂપમાં સ્થાપન

^૧ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૨૧૦

^૨ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૨૧૧

કર્યું છે, નિશ્ચયથી તે મોક્ષમાર્ગ નથી. આ જિનેન્ડ્રેવની આજા છે, છતાં પણ કોઈ ભ્રમમાં પડીને દ્રવ્યલિંગમાં મમતા કરે છે તો કરો, તેમને શુદ્ધાત્માની પ્રાપ્તિ નહીં થાય.^૧

આપ્રમાણે જે દ્રવ્યલિંગમાં મમત્વ કરે છે, તેમને જ્યાં નિશ્ચય કારણ સમયસારનો અનુભવ જ નથી તો પછી તેમને કાર્યસમયસારની પ્રાપ્તિ ક્યાંથી થાય? કેવી રીતે થાય? અર્થાત् થતી નથી.^૨

ઉક્ત સંપૂર્ણ મંથનનો સાર માત્ર આટલો જ છે કે મુક્તિના માર્ગમાં દ્રવ્યલિંગ અર્થાત્ નગનદિગંબર દશા અને મંચમહિવતાદિના શુભભાવ થાય તો અવશ્ય છે; કારણ કે તેમના વિના મુક્તિમાર્ગ થતો નથી; છતાં પણ નગનદિગંબરદશા શરીરની કિયા છે અને મહિવતાદિના શુભભાવ રાગભાવ છે; તેથી તેઓ મુક્તિના કારણ થઈ શકતા નથી. શરીરની કિયા તો પરદ્રવ્યની કિયા હોવાથી ન તો બંધનું કારણ છે અને ન તો મોકનું કારણ છે; પરંતુ શુભરાગ આત્માની વિકારી પરિણાતિ હોવાથી બંધનું જ કારણ છે, પુણ્યબંધનું જ કારણ છે; મુક્તિનું કારણ નથી.

તેથી આત્માના આશ્રયથી આત્મામાં જ ઉત્પન્ન થનારી નિશ્ચયરત્નત્રયકૃપ નિર્મળપરિણાતિ જ એકમાત્ર મુક્તિનું કારણ છે - આમ જાણવું-માનવું જ યોગ્ય છે. શાસ્ત્રોમાં પણ સર્વત્ર સમ્યગ્દર્શિન-જ્ઞાન-ચારિત્રને જ મુક્તિનું કારણ કહેવામાં આવ્યું છે.

તેથી સર્વવિકલ્પોનું શમન કરીને એકમાત્ર નિજ ભગવાન આત્માનો જ આશ્રય કરો, તેના જ શરણમાં ચાલ્યા જાઓ, તેને જ જાણો, માનો અને તેમાં જ જભી જાઓ, રમી જાઓ; સુખી થવાનો એકમાત્ર આ જ ઉપાય છે.



^૧ પ્રથમનરત્નાકર ભાગ ૧૦, પાનું ૨૧૧

^૨ તે જ, પાનું ૨૧૩-૨૧૪

સમયસાર ગાથા ૪૧૩

જે વાત પાછળના કળશભાં કહેવામાં આવી છે; હવે તે જ વાતને
મૂળ ગાથામાં સ્પષ્ટ કરે છે; જે આ પ્રમાણે છે -

પાસંડીલિંગેસુ વ ગિહિલિંગેસુ વ બહુપ્યારેસુ ।
કુબ્વનતિ જે મમતિં તેહિં ણ ણાં સમયસારં ॥૪૧૩॥

(હસ્તિત)

બહુવિધનાં મુનિલિંગમાં અથવા ગૃહીલિંગો વિષે
મમતા કરે, તેણે નથી જાણ્યો 'સમયના સાર' ને. ૪૧૩

જે વ્યક્તિ બહુ પ્રકારનાં મુનિલિંગોમાં અથવા ગૃહસ્થલિંગોમાં
મમત્વ કરે છે અર્થાત् એમ માને છે કે દ્રવ્યલિંગ જ મોક્ષનું કારણ છે;
તેમણે સમયસારને જાણ્યો નથી.

ઉક્ત ગાથાનો અર્થ આચાર્ય અમૃતચંદ્ર આત્મભ્યાતિમાં અત્યંત
સંક્ષેપ; પણ અત્યંત સશક્ત ભાષામાં આ પ્રમાણે વ્યક્ત કરે છે -

"હું શ્રમણ છું અથવા હું શ્રમણોપાસક (શ્રાવક) છું - આપ્રમાણે
દ્રવ્યલિંગમાં જ જે પુરુષ મમત્વભાવથી મિથ્યા અહંકાર કરે છે; તેઓ
અનાદિદિન વ્યવહારવિમૂઢ, પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય પર અનાકૃદ એવા પુરુષ
નિશ્ચિતક્રિયે પરમાર્થસત્ય એવા સમયસાર (શુદ્ધાત્મા) ને દેખતા નથી."

ઉક્ત ગાથા અને દીકાનો ભાવ ભાવાર્થમાં પંડિત જ્યયચંદ્ર છાબડા
આ પ્રમાણે સ્પષ્ટ કરે છે -

“અનાદિકાળથી પરદ્રવ્યના સંયોગમાં થનારા વ્યવહારમાં જ જે પુરુષો મૂઢ અર્થાત્ મોહિત છે; તેઓ એમ માને છે કે ‘આ બાધ્ય મહાવતાદિકૃપ વેશ જ અમને મોક્ષ પ્રાપ્ત કરાવી દેશે;’ પરંતુ જેનાથી ભેદજ્ઞાન થાય છે - એવા નિશ્ચયને તેઓ જણતા નથી. આવા પુરુષો સત્ત્યાર્થ, પરમાત્મકૃપ, શુદ્ધજ્ઞાનમય સમયસારને દેખતા નથી.

આચાર્ય જ્યસેન આ ગાથાની ટીકામાં મુનિલિંગ અને ગૃહસ્થલિંગનું સ્વકૃપ સ્પષ્ટ કરતાં થકા કહે છે કે વીતરાગ સ્વસંવેદનજ્ઞાનલક્ષણભાવલિંગથી રહિત નગનહિંગંબર નિર્ગયદશાને ધારણ કરનારા મુનિલિંગી અને લંગોટી આદિ ચિહ્નોથી જણાનારા એલક-ક્ષુલ્લક ગૃહસ્થલિંગી કહેવામાં આવે છે.

આગળ તેઓ અનેક વિશેષજ્ઞાનોનો પ્રયોગ કરતાં કહે છે કે કાર્ય સમયસારના ઉત્પાદક કારણ સમયસારને ઉકિત મુનિલિંગી અને ગૃહીલિંગી લોક જણતા નથી.

ઉકિત પ્રકરણ પર પ્રકાશ પાથરતાં પૂજ્ય ગુરુદેવ કહે છે - “ભગવાન આત્મા અનાદુણ આનંદરસનો, ચૈતન્યરસનો કંદ પ્રભુ છે. જેઓ અંતર્મુખ થઈને તે આત્માને જણતા-અનુભવતા નથી અને વ્યવહારના કિયકાંડમાં પોતાનું હિત માને છે, તે કિયકાંડના પાલનમાં જ ધર્મ માને છે, મુનિપણું અને શ્રાવકપણું માને છે, તેઓ અનાદિદ્દ વ્યવહારમૂઢ છે.

અરે ! શુભભાવનો વ્યવહાર તો અનાદિથી ચાલી રહ્યો છે, અનંત વાર કર્યો છે. તેમાં નવીનતા શું છે ? શુભ-અશુભ ભાવ તો નિગોધના -જીવ પણ નિરંતર કરે છે. અરે ! અંદરમાં જે આનંદસ્વકૃપ મહાચૈતન્યપ્રભુ બિરાજે છે, તેના પક્ષમાં ન જતાં રાગના પક્ષમાં રોકાઈને આ અજ્ઞાની જીવે ચૈતન્યના પક્ષનો ધાત કર્યો છે. જણે તેને પક્ષધાત (લક્વા)નો રોગ થઈ ગયો છે.

નિયમસારના ૧૨૧મા કળશમાં કહ્યું છે કે જે મોક્ષનું કહેવા માત્ર જ કારણ છે - એવા વ્યવહારતનત્ત્વથી ભવસાગરમાં દૂબેલા જીવને સ્વકૃપની પ્રાપ્તિ થતી નથી.¹

¹ પ્રવચનતત્ત્વકર ભાગ ૧૦, પાનું ૨૧૫-૨૧૬

પ્રશ્નઃ- આપનું કહેવું સાચું છે, પરંતુ બ્રહ્મચર્યથી તો રહેવું જ જોઈએ ને ?

ઉત્તરઃ- બાપુ ! બ્રહ્મચર્ય કોને કહે છે ? જાણો છો ? બ્રહ્મ નામ આત્મા; શુદ્ધ ચિદાનંદ ચૈતન્ય ચિંતામણી ભગવાન આત્માના સ્વકૃપમાં ચર્ચા અથાત् રમણ કરવું. આમ શુદ્ધ ચૈતન્ય આત્મામાં રમણ કરવાનું નામ બ્રહ્મચર્ય છે. શરીરથી બ્રહ્મચર્ય પાતન કરવાનો વિકલ્પ તો શુભભાવ છે. તેનાથી પુણ્યબંધ થાય છે, ધર્મ થતો નથી. તેમાં ધર્મ થવાનું માને તો આ માન્યતામાં મિથ્યાત્વનું મહાપાપ છે.

અરે ! ક્યારેક-ક્યારેક આ અજ્ઞાની જીવ સાંસારિક જંજટોથી ગભરાઈને તેનાથી નિવૃત્ત થઈ જય છે, કુંભ-પરિવારની જવાબદારીથી પરેશાન થઈને તેને છોડી હે છે અને શુભભાવ અને શુભભાવોના નિભિત્તોનો સહારો લઈને એમ માની લે છે કે આનાથી મારું કલ્યાણ થઈ જશે; પરંતુ ભાઈ ! મોક્ષપાહૃતમાં આચાર્ય કુંદુંદુર્દેવ કહે છે કે ‘પરદવ્વાઓ દુગાઇ’ અથાત् પોતાના પરમાનંદસ્વકૃપ ભગવાન આત્મા સિવાય કુંભ-પરિવાર અથવા દેવ-શાસ્ત્ર-ગુરુ તરફના લક્ષ્યથી થયેલા રાગાદિ બધા દુર્ગતિ છે. તે આત્માની અથવા ચૈતન્યની ગતિ નથી. ભલે શુભભાવોથી દેવગતિ મળે છે; પરંતુ તે પણ દુર્ગતિ છે અને તે ગતિ પણ દુર્ગતિ છે.

નગનદ્ધા અને મહાવ્રતાદ્વિપ ૨૮ મૂળગુણોની બધી કિયાઓને પાળવામાં શુભભાવ હોય છે. તેમાં કોઈ એવું માને કે ‘આ મારો ધર્મ અને આ મારું મુનિપણું છે’, તેમને આચાર્ય કહે છે કે પ્રભુ ! તું એક વાર સાંભળ તો ખરો ! તું ખોટા રસ્તા પર ભટકી ગયો છે. આ આત્માના હિતનો માર્ગ નથી.

અહીં ત્રણ બોલ કહ્યા છે - ૧. અનાદિઠ, ૨. બ્યવહારમૂઢ અને ૩. નિશ્ચયસ્વભાવમાં અનારૂપ. અહો ! અહીં તો આ ગાથામાં કેવળ માખણ જ માખણ ભર્યું છે; પરંતુ આ કોઈ ભાગ્યવાનને જ પ્રાપ્ત થાય છે.^૧

^૧ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૨૧૫-૨૧૬

^૧ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૨૧૬

“ધર્મના નામ પર થતા મહાવ્રતાદિમાં વ્યવહારમાં જેમની બુદ્ધિ વિમોહિત છે; તેઓ ખરેખર પરમાર્થને જાણતા નથી, તેઓ ચૈતન્યમૂર્તિ નિજસ્વરૂપને ઓળખતા નથી. બિચારા વ્યવહાર ક્રિયાકાંડના ફંડમાં જ ફસાયેલા રહે છે. તેમને નિજસ્વરૂપના અનુભવના રસનો સ્વાદ પ્રાપ્ત થતો નથી. તે જીવ પોતાની સાધિક બે હજાર સાગરની ત્રસપર્યાયની સ્થિતિ પૂરી કરીને ફરીથી એકેન્દ્રિય પર્યાય (નિગોદની પર્યાય) માં ચાલ્યા જાય છે. ત્રસ પર્યાયના બે હજાર સાગરમાં પણ અજ્ઞાની જીવ કાગડા, કુતરા, કીડા-મંકોડા, કીડી-મકોડી, માખી-મચ્છર આદિની દશામાં જ અધિક સમય વીતાવીને નિગોદમાં ચાલ્યા જાય છે.”

મહાવ્રતના પરિણામને તત્ત્વાર્થસૂત્રમાં આશ્રવ કહ્યા છે. તે ભાવ દુઃખમય છે. મોક્ષ અધિકારમાં તેમને જ વિષકુંભ કહ્યા છે. હિંસા, જૂઠ, ચોરી ઈત્યાદિ પાપના ભાવ તો મહાદુઃખનું જ છે; પરંતુ મહાવ્રતાદિના શુભપરિણામ પણ ઐરનો ઘડો છે. તેનાથી બિજ્ઞ અંદર ચૈતન્યધનસ્વરૂપ ભગવાન આત્મા અમૃતકુંભ છે. અતીન્દ્રિય આનંદરસથી રસિક પુરુષ તેના અનુભવરસનું પાન કરે છે. પરંતુ વ્યવહારમાં મુગધ જીવોને અંતરદશાની ખબર નથી. તેઓ બહારની શરીરની ક્રિયાઓને જેઈને તે શરીરની ક્રિયાઓમાં જ મમત્વ ધારણ કરે છે.”^૧

આપ્રમાણે આ કળશમાં એ જ કહેવામાં આવ્યું છે કે ફોતરાં સહિતના ચોખાને ધાન્ય કહેવાને કારણે કોઈ આણસમજુ જગતજન એ સમજી શકતા નથી કે ખાવા યોગ્ય તો ફક્ત ચોખા જ છે, તેના ફોતરા નહિ; તેવી જ રીતે મુક્તિની પ્રાપ્તિની કામનાવાળા કોઈક અજ્ઞાનીજન બાહ્યક્રિયા, શુભભાવ અને રત્નત્રય પરિણાતિ - આ બધા મુક્તિનું કારણ કહેવાય છે તેને લીધે બધાને એકસમાન જ મુક્તિનું કારણ માની લે છે. આ બેદને સમજતા નથી કે મુક્તિનું વાસ્તવિક કારણ તો એકમાત્ર

^૧ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૨૧૮

^૨ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૨૨૦-૨૨૧

નિશ્વયરત્નત્રય જ છે; નંનદશા અને શુભરાગ તો નિશ્વયરત્નત્રયના સહચારી હોવાથી વ્યવહારથી મોક્ષમાર્ગ કહેવામાં આવે છે, તે વાસ્તવિક મોક્ષમાર્ગ નથી. સમ્યગ્જ્ઞાની જીવ આ વાતને સારી રીતે જાણે છે.

હવે આગામી ગાથાનું સૂચક કળશ કાવ્ય લખે છે ને આ પ્રમાણે છે.

(સ્વાગત)

દ્રવ્યલિંગમમકારમીલિતૈ દેશ્યતે સમયસાર એવ ન ।

દ્રવ્યલિંગમિહ યત્કિલાન્યતો જ્ઞાનમેકમિદમેવ હિ સ્વત: ॥૨૪૩॥

(હરિશીત)

દ્રવ્યલિંગમાં મમકારથી જે અંધ ને અવિવેકી છે,
તેઓ સમયના સારને નહિ દેખી કે પામી શકે;
આ જગતમાં દ્રવ્યલિંગ તો પરદ્રવ્યમાત્રથી થાય છે,
આ જ્ઞાન એક સ્વયં ખરે નિજ આત્મદ્રવ્યથી થાય છે. ૨૪૩

ખરેખર દ્રવ્યલિંગ તો અન્ય દ્રવ્યસ્વરૂપ છે; માત્ર જ્ઞાનસ્વરૂપી આત્મા જ પોતાનો છે; છતાં દ્રવ્યલિંગના એકત્વ-મમત્વ વડે જેના નેત્ર બંધ થઈ ગયા છે, એવા અજ્ઞાની જીવ સમયસારસ્વરૂપ આત્માને દેખતા નથી.

આ કળશનો ભાવાનુવાદ કવિબર બનારસીદાસજી આ પ્રમાણે પ્રસ્તુત કરે છે.

(તેઝિસા સવૈયા)

જિન્હ કે દેહબુદ્ધિ ઘટ અંતર, મુનિ-મુદ્રા ધરિ ક્રિયા પ્રવાનનહિ ।
તે હિય અંધ બંધ કે કરતા, પરમ તત્ત્વ કૌ ભેદ ન જાનનહિ ॥
જિન્હ કે હિએ સુમતિ કી કનિકા, બાહિજ ક્રિયા ભેષ પરમાનહિ ।
તે સમકિતી મોખ મારગ મુખ, કરિ પ્રસ્થાન ભવસ્થિતિ ભાનનહિ ॥

જેમના હદ્દ્યમાં દેહ પ્રત્યે એકત્વ-મમત્વ વિદ્યમાન હોવા છતાં
જેઓ મુનિમુદ્રા ધારણ કરીને બાહ્યકિયામાં જ પ્રવૃત્ત રહે છે; તેવા હદ્દ્યથી

અંધ સાધુજન કર્મબંધ જ કરે છે; કારણ કે તેઓ પરમતત્ત્વ ભગવાન આત્માના સ્વભાવને જાણતા નથી.

જેમાં હદ્યમાં સમ્યગજ્ઞાનની કણિકા જગી ગઈ છે અને બાહ્યક્રિયા પણ ભૂમિકાનુસાર-વેશને અનુસાર જ કરે છે; તેવા સમ્યગદાચિ જીવ સંસારની સ્થિતિને જાણતાં થકાં મોક્ષમાર્ગની તરફ પ્રસ્થાન કરે છે અથવા મોક્ષના માર્ગની તરફ પ્રસ્થાન કરીને સંસારની સ્થિતિને કાપી નાખે છે.

પૂજય ગુરુદેવ આ કળશનો સાર આ પ્રમાણે પ્રસ્તુત કરે છે -

“એક સમયમાં ત્રણ લોક અને ત્રણ કાળને જાણનારા ભગવાન સર્વજ્ઞાદેવની દ્વિદ્વાનિમાં સિંહનાદ થયો કે ભગવાન ! તું નિશ્ચયથી પરમાત્મસ્વરૂપ છે; જે પરમાત્માની જાતિ છે, તે-જ તારી જાતિ છે. જેવી રીતે પરમાત્માની સર્વજ્ઞતા, તેમનું જ્ઞાન કેવળજ્ઞાનરૂપ પ્રગટ પર્યાયમાં છે; તેવી જ રીતે સ્વભાવથી તારી અંદર પણ સર્વજ્ઞત્વશક્તિ, સર્વદર્શિત્વ શક્તિ વિદ્યમાન છે. તારો પણ સર્વજ્ઞસ્વભાવ છે અને તું પણ અંતર્મુખી પુરુષાર્થથી પર્યાયમાં સર્વજ્ઞતા પ્રગટ કરી શકે છે.

તેનાથી વિપરીત દ્વા-દાન, વ્રત-ભક્તિ આહિના પરિણામ રાગ છે, અન્યદ્રવ્ય છે, તે આત્માનું સ્વરૂપ નથી. તેમ હોવા છતાં પણ દ્વા-દાન-વ્રત આહિના પરિણામને ધર્મ થતો માનવું તે સાચું નથી. એવું માનનારા મૂઢ છે.

અરે ભાઈ ! તું કોણ છે ? તેનો વિચાર તો કર ! આચાર્ય કહે છે કે તું તો અનંત અને અસીમ જ્ઞાન અને આનંદસ્વભાવી ભગવાન આત્મા છે. એવા જ્ઞાનાનંદ સ્વભાવને તું પોતાના સ્વ-સંવેદનજ્ઞાનમાં જાણો - એવું તારું સ્વરૂપ છે. જે તું અન્યદ્રવ્યમય કિયાકંડથી આત્મલાભ થવાનું માને તો એ તારું અજ્ઞાન છે, અંધપણું છે, અવિવેક છે. બાહ્યલિંગમાં ભમકાર કરનારો નિભાત્મસ્વરૂપને દેખતો નથી. ખરેખર તો રાગ આત્માને અડતો પણ નથી; છતાં રાગની કિયાથી લાભ થતો માનનાર અજ્ઞાની છે, આંધળો છે, વિવેકરહિત છે. બાહ્યલિંગમાં ભમકાર કરનાર નિજ આત્મસ્વરૂપને દેખતો નથી. આત્મસ્વભાવની સમીપ જઈને જેતાં રાગ ભગવાન આત્માનો સ્પર્શ પણ કરતો નથી.”

આ શુભરાગની કહિયાઓ તો પરદ્રવ્યના સંયોગથી થયેલી ઉપાધિ છે, જે તું તેમાં મમકાર કરે છે, તો તેનો અર્થ એ છે કે તું પોતાના સ્વરૂપનો ઈન્કાર કરે છે અને જે પોતાનું સ્વરૂપ નથી, તેને પોતાનું માને છે. આ દ્રવ્યલિંગમાં મમકાર હોવાથી તું આંધળો થઈ રહ્યો છે. તં જ્ઞાનાનંદસ્વરૂપી પોતાના ભગવાન આત્માનો જેવાના નેત્ર બંધ કરી રાખ્યા છે. જૈનકૃણમાં જન્મ લઈને પણ તને જિનેન્દ્રાદેવના કહેલા તત્ત્વની ખબર નથી. પોતાની મતિકલ્પનાથી દ્રવ્યલિંગમાં ધર્મ થતો માને છે. આ કેવી વિડંબના છે. આચાર્ય કહે છે કે આવા લોકો સમયસારને દેખતા નથી.”

ઉક્ત સંપૂર્ણ મંથનનો સાર આ છે કે શરીરાદ્ધની નજનદશા અને શુભભાવરૂપ દ્રવ્યલિંગ પરદ્રવ્યરૂપ હોવાથી આત્માનો ધર્મ નથી. તેમાં એકત્વ-મમત્વ કરવું અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. દ્રવ્યલિંગમાં ધર્મ માનનારા જ્ઞાનાનંદસ્વરૂપી ભગવાન આત્માને દેખવા-જ્ઞાનવામાં અસમર્થ છે.



ચિંતન કણ્ઠા

જે કંઈ થાય છે તે થવા દેવું, ન ઉદાસીન, ન અનુધમી થવું; ન પરમાત્મા પ્રત્યે પણ ઈચ્છા કરવી અને ન મૂંજાવું.... અહંપણું આદું આવતું હોય તો.... તેને ઈશ્વર્ધપણ કરી દેવું; તથાપિ દીનપણું ન આવવા દેવું. શું થશે ? એવો વિચાર કરવો નહીં, અને જે થાય તે કર્યા રહેવું. અધિક જાવાં નામવા પ્રયત્ન કરવું નહીં. અદ્વય પણ ભય રાખવો નહીં. ઉપાધિ માટે ભવિષ્યની એક પળની પણ ચિંતા કરવી નહીં; કચ્છાનો જે અભ્યાસ થઈ ગયો છે, તે વિસ્મરણ કર્યા રહેવું; તો જ ઈશ્વર પ્રસન્ન થશે, અને તે જ પરમભક્તિ પામ્યાનું કળ છે.

- શ્રીમદ્

૧ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૨૨૧

૨ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૨૨૬-૨૨૭

સમયસાર ગાથા ૪૧૪

જે વાત વિગત કળશમાં કહેવામાં આવી છે; હવે એ જ વાતને ગાથા દ્વારા કહે છે જે આ પ્રમાણે છે.

વવહારિઓ પુણ ણાઓ દોળણ વિ લિંગાળિ ભણદિ મોકખપહે ।
ણિચ્છયણાઓ ણ ઇચ્છદિ મોકખપહે સબ્વલિંગાળિ ॥૪૧૪॥

(હસ્તિગીત)

વ્યવહારનય એ ઉભય લિંગો મોક્ષપંથ વિષે કહે,
નિશ્ચય નહીં માને કદી કો લિંગ મુક્તિપથ વિષે. ૪૧૪

વ્યવહારનય મુનિલિંગ અને ગૃહીલિંગ - બંને ને જ મોક્ષમાર્ગ કહે છે; પરંતુ નિશ્ચયનય કોઈ પણ લિંગને મોક્ષમાર્ગ માનતો નથી.

ઉક્ત ગાથાનો ભાવ આત્મભ્યાતિમાં આ પ્રમાણે પ્રસ્તુત કરવામાં આવ્યો છે -

“શ્રમણ અને શ્રમણોપાસકના બેદથી દ્વયલિંગ બે પ્રકારના કહેવામાં આવ્યા છે; તેને મોક્ષમાર્ગ બતાવનાં કથન માત્ર વ્યવહારકથન છે, પરમાર્થ કથન નથી; કારણ કે ઉક્ત કથન સ્વયં અશુદ્ધદ્વયના અનુભવનસ્વરૂપ હોવાથી અપરમાર્થ છે; તેમાં પરમાર્થત્વનો અભાવ છે.

શ્રમણ અને શ્રમણોપાસકના વિકલ્પથી અતિકાંત દર્શન-જ્ઞાનસ્વભાવમાં પ્રવૃત્ત પરિણાત માત્ર શુદ્ધજ્ઞાનનો જ એક નિસ્તુષ્ટ (નિર્મણ)

અનુભવન પરમાર્થ છે; કારણ કે તે અનુભવન સ્વયં શુદ્ધદ્રવ્યના જ અનુભવનસ્વરૂપ હોવાથી ખેઠર પરમાર્થ છે.

તેથી જેઓ વ્યવહારને જ પરમાર્થબુદ્ધિથી પરમાર્થ માનીને અનુભવ કરે છે; તેઓ સમયસારનો અનુભવ જ કરતા નથી; પરંતુ જેઓ પરમાર્થને પરમાર્થબુદ્ધિથી અનુભવ કરે છે; તેઓ જ સમયસારનો અનુભવ કરે છે.”

ઉક્ત કથનનો ભાવ સંકેપમાં સમેટી લેતાં પંડિત જયચંદ્ર છાબડા ભાવાર્થમાં લખે છે -

“વ્યવહારનથનો વિષય તો બેદ્ધપ અશુદ્ધદ્રવ્ય છે, તેથી તે પરમાર્થ નથી; નિશ્ચયનથનો વિષય અબેદ્ધપ શુદ્ધદ્રવ્ય છે, તેથી તે જ પરમાર્થ છે. એટલે જેઓ વ્યવહારને જ નિશ્ચય માનીને પ્રવર્તન કરે છે, તેઓ સમયસારનો અનુભવ કરતા નથી; જેઓ પરમાર્થને પરમાર્થ માનીને પ્રવર્તન કરે છે, તેઓ જ સમયસારનો અનુભવ કરે છે (તેથી તેઓ જ મોક્ષ પ્રાપ્ત કરે છે)

પૂજ્ય ગુરુદેવ શ્રીકાનલુસ્વામી ઉક્ત કથનના મર્મને ખોલતાં કહે છે -

“જુઓ, કહે છે કે શ્રમણ અને શ્રમણોપાસકના બેદ્ધથી બે પ્રકારના દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ છે - આવી જે પ્રકૃપણા છે તે માત્ર વ્યવહારનથથી છે, પરમાર્થથી નહીં. મુનિદ્વારામાં જે વ્રત-તપ આદિ વિકલ્પ અને નગનદ્વા છે, તે સહયારીપણાને કારણે છે, તેને વ્યવહાર કર્યો છે, તે વ્યવહારપણે વ્યવહાર છે, પરંતુ નિશ્ચયથી તે આશ્રય કરવા લાયક નથી.

મોક્ષમાર્ગપ્રકાશકમાં પંડિત ટોડરમલલુએ સ્પષ્ટ કહ્યું છે કે ‘મોક્ષમાર્ગ બે નથી, પરંતુ મોક્ષમાર્ગનું નિર્દ્ધપણ બે પ્રકારે છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને મોક્ષમાર્ગ કહ્યો છે, તે નિશ્ચય મોક્ષમાર્ગ છે અને જે મોક્ષમાર્ગ તો નથી, પરંતુ મોક્ષમાર્ગનો નિમિત્ત અને સહયારી છે, તેને ઉપયારથી મોક્ષમાર્ગ કહેવો, તે વ્યવહાર મોક્ષમાર્ગ છે; કારણ કે નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર આવું જ લક્ષણ છે અર્થાત્ સાચું નિર્દ્ધપણ તે નિશ્ચય અને ઉપયાર નિર્દ્ધપણ તે

વ્યવહાર. તેથી નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારના મોક્ષમાર્ગ જાણવા. એક નિશ્ચય મોક્ષમાર્ગ છે તથા એક વ્યવહાર મોક્ષમાર્ગ છે. આવા બે મોક્ષમાર્ગ માનવા મિથ્યા છે. દ્રવ્યલિંગને મોક્ષમાર્ગ કહેવું તે આરોપિત કથન છે.

ભાવલિંગી સંત મુનિવરોને પંચમહાબતાદ્દિના પરિણામ નિયમથી હોય છે, ભૂમિકાનુસાર હોય જ છે; પરંતુ તે ભાવ સહચારીપણાથી હોય છે. તે સત્ત્યાર્થ મોક્ષમાર્ગ નથી. તેમને મોક્ષમાર્ગ કહેવું તે આરોપિત કથન છે, યથાર્થ નથી. જે તું વ્યવહારને વ્યવહારકૃપે જાણો તો તે બરાબર છે; પરંતુ જે તું તેને ધર્મ અથવા ધર્મનું કારણ માને તો તે માન્યતા સાચી નથી. બે નય છે - એમ જાણવું ખોટું નથી. પરંતુ બંને નય આશ્રય કરવા લાયક છે - એમ માનવું ભૂલ છે. આશ્રય કરવા યોગ્ય તો એક શુદ્ધ નિશ્ચયનય જ છે.

આહા ! અંદરમાં જે પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ ક્રિકાળ બિરાજે છે, તેવી દર્શિ, તેમાં જ્ઞાન અને રમણતા કરવાથી જે નિરાકૃત નિર્વિકલ્પ આનંદની ધારા અંદરમાં પ્રગટ થાય છે, તે એક જ મોક્ષમાર્ગ છે અને તે જ ધર્મ છે. સહચારીપણે રહેતા વ્રત આદિના રાગને ધર્મ કહેવું તે કેવળ વ્યવહાર જ છે, આરોપિત છે, યથાર્થ-પરમાર્થ નથી; કારણ કે તે વ્યવહાર સ્વયં અશુદ્ધ દ્રવ્યના અનુભવસ્વરૂપ હોવાથી તેમાં પરમાર્થપણાનો અભાવ છે. વ્રત-તપ-ભક્તિ આદિ અશુદ્ધદ્રવ્યના અનુભવરૂપ છે, શુદ્ધદ્રવ્યના અનુભવરૂપ નથી. અશુદ્ધદ્રવ્યનો અનુભવ કહો કે હુઃખનો અનુભવ કહો - એક જ વાત છે, તેમાં નિરાકૃત આનંદનો અનુભવ નથી.¹

નિમિત્ત, વ્યવહાર અને પર્યાય વ્યવહારનયના વિષય છે, તે પરમાર્થ નથી. પૂર્ણાનંદનો નાથ ભગવાન આત્મા શાશ્વત-ધ્યુત-ધ્યુત-ધ્યુત શુદ્ધ ચિદાનંદ પ્રભુ જે અંદરમાં છે, તે અભેદરૂપ શુદ્ધદ્રવ્ય છે, તે જ પરમાર્થ છે; કારણ કે તેના આશ્રયથી ધર્મ પ્રગટ થાય છે. અરે ભાઈ ! આ વ્યવહાર કિયાકાંડ તો બધી કર્મધારા છે, તે ધર્મધારાન નથી. ભૂતાર્થ અભેદ એક જે

¹ પ્રથમનરત્નાકર ભાગ ૧૦, પાનું ૨૩૦

શુદ્ધદ્વયના આશ્રયથી પ્રગટ નિર્ભળરત્નત્રય છે, તે જ ધરમ છે અને તે જ પરમાર્થ છે. તેથી કહે છે કે ત્રિકાળી ધ્રુવ એક જ્ઞાયકસ્વભાવની દાચિ કરો - આવી ભગવાનની આજ્ઞા છે.

અહા ! ભગવાન સર્વજ્ઞાદેવ કહે છે કે અમારી ઉપર જે તારી દાચિ છે, તે પણ છોડ ! પોતાની અંદર બિરાજમાન પોતાના ભગવાન આત્માને દાચિમાં લે ! અમારી (સર્વજ્ઞાની) ઉપર દાચિ કરવાથી, અમને લક્ષ્યમાં લેવાથી તને રાગ જ થશે. જે વ્યવહારને જ નિશ્ચય માની પ્રવર્તે છે તેને જ નિજ ભગવાન સમયસારનો અનુભવ થતો નથી.

અહા ! દિગંબર સંતોને કોઈની પરવાહ હોતી નથી. સમાજને જચે ન જચે, તેમને એની ચિંતા નથી; તેઓ તો પૂર્ણ નિર્ભય અને નિઃશંક થઈને વસ્તુનું જેવું સ્વર્દ્ધપ છે, મુક્તિનું જેવું સ્વર્દ્ધપ છે; તેવું જ તેવું નિર્દ્ધપણ કરે છે. તેઓ કહે છે કે જેઓ પરમાર્થને પરમાર્થ માનીને પ્રવર્તે છે, તેઓ જ સમયસારનો અનુભવ કરે છે, તેઓ જ મોક્ષ પ્રાપ્ત કરે છે.^૧

ઉક્ત સંપૂર્ણ કથનનો સાર આ છે કે ચાહે ગૃહસ્થોનું લિંગ એલક-ક્ષુલ્લક હોય, ચાહે મુનિઓનું લિંગ દિગંબરદશા હોય - બંને જ દર્શાઓ દ્વારાલિંગ છે, જે મુક્તિનું સાક્ષાત્ કારણ નથી; તે ભાવલિંગનું સહકારી કારણ હોવાથી પરંપરાથી મુક્તિનું કારણ કહેવાય છે; પણ મુક્તિનું સાક્ષાત્ કારણ તો સમ્યગ્દર્શન-શાન-ચારિત્રક્ષપ ભાવલિંગ જ છે.

આમ તો આચાર્ય જ્યસેન તાત્પર્યવૃત્તિમાં આ ગાથાનો અર્થ આત્મભ્યાતિના સમાન જ કરે છે; છતાં પણ કિંચ કહીને અનેક પ્રશ્નોત્તરોના માધ્યમથી સંબંધિત વિષયનું સ્પષ્ટીકરણ વિસ્તારથી કરે છે; જેનો મૂળભાવ આ પ્રમાણે છે.

“હે શિખ ! પાખણ્ડી લિંગાળિ આદિ સાત ગાથાઓને વાંચીને દ્વારાલિંગનો સર્વથા નિષેધ માની નહીં લેતો; પરંતુ એમ સમજજે કે આ

^૧ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૨૩૧-૨૩૨

તો નિશ્ચયરત્નત્રયાત્મક ભાવલિંગથી રહિત યતિઓને સંબોધન કર્યું (સમજાવ્યું) છે.

જે તમે પૂછો કે કઈ રીતે સમજાવ્યું છે તો કહે છે કે હે તપોધન! તમે દ્રવ્યલિંગમાત્રથી સંતોષ માની નહીં લેતા; પરંતુ દ્રવ્યલિંગના આધારે નિશ્ચયરત્નત્રયાત્મક નિર્વિકલ્પ-સમાધિક્રિપ પરિણામિત થવાની ભાવના કરવી અર્થાત્ સ્વાનુભૂતિક્રિપ પરિણામવું.

ત્યાં શિષ્ય કહે છે કે આ તો આપની કલ્પના છે કે અહીં દ્રવ્યલિંગનો નિષેધ કર્યો નથી, કારણ કે આ ગ્રંથમાં અહીં બે વાર લખ્યું છે કે એ વિ હોદિ મોકખમગો લિંગ ઇત્યાદિ લિંગ મોકષનો. માર્ગ નથી.

ત્યાં આચાર્ય કહે છે કે એમ નથી. લિંગ મોકષમાર્ગ નથી - ઈત્યાદિ કથનથી ભાવલિંગરહિત દ્રવ્યલિંગનો નિષેધ કરવામાં આવ્યો છે. ભાવલિંગ સહિત દ્રવ્યલિંગનો નહીં.

અહીં જે કોઈ એમ કહે કે આ વાત કેવી રીતે છે ? તો તેને કહીએ છીએ કે દ્રવ્યલિંગના આધારભૂત જે શરીર છે; તે શરીર પ્રત્યે મમત્વનો નિષેધ કરવામાં આવ્યો છે, દ્રવ્યલિંગનો નિષેધ કરવામાં આવ્યો નથી.

અહીં જે કોઈ એમ કહે કે આ વાત ક્યા રૂપે છે ? તો તેને કહીએ છીએ કે પહેલા દીક્ષાના સમયે સર્વ પરિગ્રહનો ત્યાગ કરવા છતાં પણ દેહનો ત્યાગ કર્યો ન હતો; કારણકે દેહધારણથી જ્ઞાન અને ધ્યાનનું અનુઝ્ઞાન થાય છે; શેષ પરિગ્રહની માફક દેહને પૃથક કરવાનું સંભવ પણ નથી; છતાં પણ વીતરાગ ધ્યાનના કાળમાં અર્થાત્ સ્વાનુભૂતિના સમયે 'હું દેહ છું, હું મુનિલિંગી અથવા ગૃહસ્થલિંગી છું - આવો વિકલ્પ વ્યવહારથી પણ કરવો ન લેઈએ.

પ્રશ્ન:- આ કથનથી દેહનું મમત્વ છોડાવ્યું છે, દ્રવ્યલિંગ નહીં - એ કેમ સુનિશ્ચિત થાય ?

ઉત્તર:- જે દેહ ણિમ્મમા અરિહા દંસણણાળ ચ સ્તિળિ સંવતે

ઈત્યાદિ વચનોથી. તાત્પર્ય છે કે આગમમાં એમ કહ્યું છે કે અરિહંત ભગવાન દેહથી નિર્મભ થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રનું સેવન કરે છે.

જ્યાંસુધી ચોખાનું બહારનું તુષ (ફોતરાં) વિદ્યમાન છે ત્યાંસુધી અંદરના તુષનું કાઢવું સંભવ નથી. અંતરંગ તુષનો ત્યાગ થતાં બહિરંગ તુષનો ત્યાગ નિયમથી થાય જ છે. આ ન્યાયથી સર્વસંગ (પરિગ્રહ) ના ત્યાગસ્વરૂપ દ્રવ્યલિંગ હોય છતાં ભાવલિંગ હોય કે ન હોય - એવો કોઈ નિયમ નથી; પરંતુ અંતરંગ ભાવલિંગ થતાં સર્વસંગ પરિત્યાગસ્વરૂપ દ્રવ્યલિંગ હોય જ છે - આવો નિયમ છે.

અહીં શિષ્ય અત્યંત વિનયપૂર્વક શંકા ઉપસ્થિત કરે છે કે હે ભગવાન ! જ્યાં ભાવલિંગ હોય છે, ત્યાં બાધ્ય દ્રવ્યલિંગ પણ હોય જ છે - આવો નિયમ નથી. કારણ કે સાહારણાસાહારણોત્યાદિ આગમનું વચન છે.

સમાધાન કરતાં આચાર્યદીલ કહે છે કે કોઈ તપસ્વી ધ્યાનારૂપ હોય અને કોઈએ દુધભાવથી તેમના પર વસ્ત્ર નાખી દીધા; તેમને વસ્ત્રોથી ઢાંકી દીધા અથવા આભૂષણ પહેરાવી દીધા; ત્યારે પણ તે તપસ્વી નિર્ણય જ છે, પરિગ્રહ રહિત જ છે; કારણ કે તેમને પાંડવાદિની સમાન બુદ્ધિપૂર્વક ભમત્વનો અભાવ છે. વળી જે ભરત ચક્કવતી આદિ બે ઘડી (અંતમુહૂર્ત) માં મોક્ષે ગયા; તેઓ નિર્ણથરૂપે જ મોક્ષે ગયા; છતાં તેમના પરિગ્રહત્યાગને લૌકિકજન જણતા નથી; કારણ કે તેમની નિર્ણથદશાનો કાળ અતિ અલ્પ હતો. આ ભાવાર્થ છે.

આ પ્રમાણે ભાવલિંગથી રહિત માત્ર દ્રવ્યલિંગ મોક્ષનું કારણ નથી અને ભાવલિંગ સહિત સંતોનું દ્રવ્યલિંગ બાધ્ય સહકારી કારણ છે - આ પ્રમાણે વ્યાખ્યાનની મુખ્યતાથી તેરમા સ્થળની સાત ગાથાઓ સમાપ્ત થઈ."

આચાર્ય જયસેનના ઉક્ત કથનમાં અનેક તર્ક-વિતર્કથી એમ સિદ્ધ કર્યું છે કે નગન હિંગંબરદશારૂપ દ્રવ્યલિંગ ભાવલિંગ વિના કાર્યકારી નથી,

પરંતુ મુક્તિના માર્ગમાં તેનું હોવું અત્યંત આવશ્યક છે.

આમ તો અહીં ૪૧૪મી ગાથામાં સમાયેલ પ્રકરણ સમાપ્ત થઈ ગયું છે; છતાં આચાર્ય જ્યસેન અહીં એક અત્યંત મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરે છે; જે ઉર્દૂમી ગાથા બાદ કરેલી ચર્ચાની સમાન જ અત્યંત ઉપયોગી છે.

તે ચર્ચા આ પ્રમાણે છે -

“અહીં શિષ્ય કહે છે કે કેવળજ્ઞાન શુદ્ધ છે અને છદ્રસ્થનું જ્ઞાન અશુદ્ધ છે. છદ્રસ્થોનું તે અશુદ્ધજ્ઞાન શુદ્ધ કેવળજ્ઞાનનું કારણ ન હોઈ શકે, કારણ કે આ જ શાસ્ત્રમાં કહ્યું છે કે સુદ્ધ, તુ વિયાણનો સુદ્ધમેવપ્પણ લહદિ જીવો - શુદ્ધ આત્માને જણતો થકો જીવ શુદ્ધાત્માને પ્રાપ્ત કરે છે.

શિષ્યના પ્રશ્નનો ઉત્તર આપતાં આચાર્યદ્વારા કહે છે કે તેમ નથી; કારણ કે છદ્રસ્થોનું જ્ઞાન સર્વથા અશુદ્ધ નથી, તે કથંચિત શુદ્ધ અને કથંચિત અશુદ્ધ છે.

ભલે છદ્રસ્થનું જ્ઞાન કેવળજ્ઞાનની અપેક્ષા શુદ્ધ નથી; છતાં મિથ્યાત્વ અને રાગાદિથી રહિત વીતરાગ સમ્યક્ત્વ અને ચારિત્ર સહિત હોવાથી શુદ્ધ જ છે. અભેદનયથી છદ્રસ્થનું તે બેદજ્ઞાન આત્મસ્વરૂપ જ હોય છે, આત્માનુભૂતિસ્વરૂપ જ હોય છે; તેથી એકદેશવ્યક્તિસ્વરૂપ જ્ઞાન વહે સકળદેવ-વ્યક્તિસ્વરૂપ કેવળજ્ઞાન થવામાં કોઈ દોષ નથી.

અહીં જે એમ મત વ્યક્ત કરવામાં આવે કે સાવરણ હોવાથી અથવા ક્ષાયોપશમિક હોવાથી છદ્રસ્થનું જ્ઞાન શુદ્ધ ન હોઈ શકે; આવી સ્થિતિમાં તો પછી કોઈ પણ છદ્રસ્થનો મોક્ષ થાય જ નહીં; કારણ કે છદ્રસ્થોનું જ્ઞાન ભલે એકદેશ નિરાવરણ છે, છતાં કેવળજ્ઞાનની અપેક્ષા નિયમથી સાવરણ હોવાથી ક્ષાયોપશમિક જ છે.

અહીં પણ જે આપનો અભિપ્રાય એમ હોય કે છદ્રસ્થને શુદ્ધપારિણામિકભાવ હોવાથી તેનો મોક્ષ થઈ જશે તો તેપણ ઘરિત નહીં

થાય કારણ કે કેવળજ્ઞાન થયા પહેલા પારિણામિકભાવ શક્તિદ્વારા શુદ્ધ છે, વ્યક્તિદ્વારે નહીં.

તેનું વિશેષ સ્પષ્ટીકરણ આ પ્રકાર છે કે પારિણામિકભાવ જીવત્વ, ભવ્યત્વ અને અભબ્યત્વના રૂપમાં ત્રણ પ્રકારનું છે. તેમાં અભબ્યત્વ તો મુક્તિનું કારણ થતું જ નથી; હવે રહ્યા જીવત્વ અને ભવ્યત્વ; તો આ બંનેનું શુદ્ધત્વ તો ત્યારે પ્રગટ થાય છે, જ્યારે આ છિદ્રસ્થ જીવ દર્શનજ્ઞાન-ચારિત્ર અર્થાત્ મોહનીયના ઉપશામ, ક્ષયોપક્ષમ અથવા ક્ષયથી થનારા વીતરાગ સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યકુચારિત્રદ્વારા પરિણામિત થાય છે.

આ શુદ્ધતા મુજ્યદ્વારે તો ઔપશામિક, ક્ષયોપશામિક અને ક્ષાયિકભાવ સંબંધી છે, પારિણામિકભાવ સંબંધી વાત તો અહીં ગૌણ છે અર્થાત્ ગૌણદ્વારે છે. શુદ્ધ પારિણામિકભાવ ન તો બંધનું કારણ છે અને ન મોકાનું - આ વાત પંચાસ્તિકાયના નીચેના શ્લોકમાં સ્પષ્ટ છે -

મોકં કુર્વતિ મિશ્રૌપશમિકક્ષાયિકાભિધા ।
બંધમૌદ્યિકો ભાવો નિષ્ઠિય: પારિણામિક: ॥

ઔપશામિક, ક્ષયોપશામિક અને ક્ષાયિકભાવ મોકાને કરે છે, ઔદ્યિકભાવ બંધ કરે છે અને પારિણામિકભાવ નિષ્ઠિય છે અર્થાત્ કંઈ કરતું નથી.

તેથી એ સિદ્ધ થાય છે કે નિર્વિકલ્પ શુદ્ધાત્મપરિછિતિ (જાણવાના) લક્ષણવાળું વીતરાગ સમ્યકુત્વ-ચારિત્રના અવિનાભૂત અભેદનયથી શુદ્ધાત્માનુભૂતિ શબ્દથી કહેવાનું ભાવશ્રુતજ્ઞાન ક્ષયોપશામિક હોવા છતાં મોકાનું કારણ થાય છે.

એકદેશવ્યક્તિલક્ષણમાં કથંચિત્ ભેદાભેદદ્વારા દ્રવ્યપર્યાયાત્મક જીવપર્યાયની શુદ્ધભાવના (સ્વાનુભૂતિ)ની અવસ્થામાં શુદ્ધપારિણામિકભાવ ધ્યેયભૂત દ્રવ્ય છે, ધ્યાન કરવા યોગ્ય વિષય છે અને તે શુદ્ધપારિણામિકભાવ ધ્યાનપર્યાયદ્વારા નથી; કારણ કે ધ્યાનની પર્યાય નશ્વર છે.”

આજે પાગ આત્માર્થી જૈન સમાજમાં આવા લોકો છે, જેઓ એમ માને છે કે એકમાત્ર પરમપારિણામિકભાવન્દ્રપ ત્રિકાળીધ્વૃ ભગવાન આત્મા જ મુક્તિનું કારણ છે; અન્ય ક્ષયોપક્ષમાહિબાવ નહીં.

આવા લોક આચાર્ય જ્યસેનના સમયમાં પણ રહ્યા જ હશે. તેથી જ તેમને આ વિષય પર વિશેષ પ્રકાશ પાથરવાનો ભાવ આવ્યો.

તેઓ પોતે આ વિષયની ચર્ચા કરતાં ઉરોમી ગાથાની ટીકામાં આ ભાવને વ્યક્ત કરી ચુક્યા હતા; છતાં પણ ફરીથી તે જ વિષય પર અને અધિક સ્પષ્ટતાર્થી પ્રકાશ પાથરવાનો વિકલ્પ તેમને આવ્યો.

તેઓ અહીં અત્યંત સ્પષ્ટ શબ્દોમાં લખે છે કે મોક્ષમાર્ગ તો પર્યાયક્રપ જ હોય છે, પરિણમન્દ્રપ જ હોય છે, જ્યારે ત્રિકાળીધ્વૃ પરિણમન્દ્રપ નથી, નિષ્ઠિય છે, તેથી બંધ-મોક્ષનું કારણ પણ નથી; બંધનું કારણ તો ઔદ્ઘિકભાવ છે અને મુક્તિનું કારણ ઔપશમિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિકભાવ છે. પારિણામિકભાવ દ્રવ્યની અપેક્ષાએ શુદ્ધ છે અને તે ઔપશમિકાદિભાવ પર્યાયોની અપેક્ષાએ શુદ્ધ છે અને ઔદ્ઘિકભાવ અશુદ્ધ છે; તેથી જ બંધનું પણ કારણ છે.

આવી રીતે અંતે એ જ સુનિશ્ચિત રહ્યું કે ઔપશમિકાદિ શુદ્ધભાવોથી પરિણમેલો નિશ્ચયરત્નત્રયધારી જીવ મુક્તિમાર્ગી છે અને તે નિશ્ચયરત્નત્રયનો ભાવ મુક્તિનો માર્ગ છે. આ નિશ્ચયરત્નત્રયભાવ જ ભાવલિંગ છે, જે મુક્તિનું વાસ્તવિક કારણ છે અને તેની સાથે અનિવાર્યક્રપે થનારા મહત્વતાદિના શુભભાવ અને નગનદિગંબરાદિ ક્રિયાદ્રષ્ટુ દ્રવ્યલિંગ ઉપયરિત કારણ છે. તાત્પર્ય એ છે કે તેની અનિવાર્ય ઉપસ્થિતિ હોવા છતાંપણ તે મુક્તિનું વાસ્તવિક કારણ નથી.

હવે આ પ્રકરણને સમેટાં તે જ ભાવનું પોષક કળશ કાવ્ય લખે છે, જે આ પ્રમાણે છે -

(માલિની)

અલમલમતિજલપૈર્દુર્વિકલ્પૈરનલ્પૈ
 રયમિહ પરમાર્થશ્વેત્યતાં નિત્યમેકઃ ।
 સ્વરસવિસરપૂર્ણજ્ઞાનવિસ્કૃતિમાત્રા
 ન ખલુ સમયસારાદુત્તરં કિંચિદસ્તિ ॥૨૪૪॥

(હરિગીત)

બસ થાઓ, બસ થાઓ બહુ કથનો વિકલ્પોથી હવે,
 બસ એટલું કહીએ નિરંતર અનુભવો આ એકને;
 નિજરસથી પૂર્ણ અહો સ્કુટિત છે સમયસાર મહાન જે,
 તેનાથી ઊંચું છે નહીં આ જગતમાં કંઈ ખરે. ૨૪૪

અધિક કહેવાથી શું લાભ છે, અધિક દુર્વિકલ્પ કરવાથી પણ શું
 લાભ છે; અહીં તો માત્ર એટલું જ પર્યાપ્ત છે કે આ એક પરમાર્થસ્વરૂપ
 આત્માનો જ નિત્ય અનુભવ કરો; નિજરસના પ્રસારથી પરિપૂર્ણ જ્ઞાનના
 સ્કુરાયમાન થવારૂપ સમયસારથી મહાન આ જગતમાં કંઈ પણ નથી.

અહીં નિશ્ચયથી સમયસારનો અર્થ પરમશુદ્ધનિશ્ચયનયનો વિષયભૂત
 નિકળીધ્વિવ ભગવાન આત્મા છે અને વ્યવહારનયથી સમયસાર નામનો
 ગ્રંથાધિરાજ છે.

આ જગતમાં સર્વોત્કૃષ્ટ વસ્તુ આ નિજ ભગવાન આત્મા જ છે,
 જેના આશ્રયથી નિશ્ચયરત્નત્રયરૂપ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. તાત્પર્ય
 એ છે કે જેમાં પોતાપણું સ્થાપિત કરવાનું નામ સમ્યગ્દર્શન છે, જેને
 નિજરૂપ જાણવાનું નામ સમ્યજ્ઞાન છે અને જેમાં જભવાનું નામ
 સમ્યક્યારિત છે; તે નિકળીધ્વિવ ભગવાન આત્મા જ વાસ્તવિક આત્મા
 છે, પોતાને માટે પોતાના આત્મા સિવાય બીજું કંઈ જ મહાન નથી.

આ પ્રમાણે જગતમાં જેટલા શાસ્ત્ર છે; તે બધા શાસ્ત્રોમાં
 સમયસાર સૌથી શ્રેષ્ઠ શાસ્ત્ર છે; તેનાથી મહાન અન્ય કોઈ ગ્રંથ નથી.

આવી રીતે આ કળશમાં સમયસારઙ્પ શુદ્ધાત્મા અને સમયસાર નામના ગ્રથાધિરાજની મહિમા બતાવવામાં આવી છે; સાથે આ આદેશ પણ આપવામાં આવ્યો છે, ઉપદેશ આપવામાં આવ્યો છે કે હવે આ વિકલ્પજળથી મુક્ત થઈને નિજ આત્માના શરણમાં જાઓ ! આત્માના કલ્યાણનો એકમાત્ર ઉપાય આત્માનુભવ જ છે; અન્ય કંઈ નહીં.

આ કળશનો ભાવાનુભાદ કવિવર બનારસીદાસજી બે કળશોમાં કરે છે, જેમાં પહેલો સવૈયા ઈકતીસા છે અને બીજો દોહા છે.

(સવૈયા ઇકતીસા)

આચારજ કહેં જિન વચન કી વિસ્તાર,

અગમ અપાર હૈ કહેંગે હમ કિતનૌ ।

બહુત બોલિબે સૌં ન મકસૂદ ચુપ્પ ભલી,

બોલિયે સુવચન પ્રયોજન હૈ જિતનૌ ॥

નાનારૂપ જલપ સૌં નાના વિકલપ ઉર્ઠે,

તાર્તે જૈતૌ કારજ કથન ભલૌ તિતનૌ ।

સિદ્ધ પરમાત્મા કૌ અનુભૌ અભ્યાસ કીજૈ,

યહે મોખ-પંથ પરમારથ હૈ ઇતનૌ ॥

આચાર્યદેવ કહે છે કે જિનવચનોનો વિસ્તાર તો અગમ છે, અપાર છે; અમે કેટલું કહી શકીએ; તેથી બહુ બોલવાથી શો લાભ છે ? બહુ બોલવા કરતાં ચુપ્પી જ સારી છે, ચુપ રહેવું જ શ્રેયસ્કર છે. જે બોલવું જ હોય તો માત્ર એટલું જ બોલો કે જેટલું બોલવાનું પ્રયોજન હોય; કારણ કે બહુ વધુ બોલવાથી અનેક વિકલ્પ ઉભા થાય છે; તેથી જેટલું કામ હોય બસ એટલું જ બોલવું સાંડ છે.

સિદ્ધપરમાત્મા અથવા સિદ્ધપરમાત્માની માફક પોતાના આત્માના અનુભવનો અભ્યાસ કરીએ; કારણ કે મોક્ષનો અસતી માર્ગ આ જ છે. પરમાર્થકથન તો માત્ર આટલું જ છે.

(દોહા)

સુદ્ગાતમ અનુભૌ ક્રિયા, સુદ્ગ ગ્યાન દ્રિગ દૌર ।

મુક્તિ-પંથ સાધન યહૈ, વાગજાલ સબ ઔર ॥

શુદ્ધાત્માનું દર્શન, જ્ઞાન અને અનુભવ (તીનતા) ઇપક્ષિયા અર્થાત् ચારિત્ર-મુક્તિનો માર્ગ તો બસ એટલો જ છે બાકી તો બધી વાક્યનણ છે, વાણીનો વિલાસ છે, કથનમાત્ર છે.

આ કળશનો ભાવ સ્પષ્ટ કરતાં પૂજ્ય ગુરુદેવ લખે છે - “બસ થાઓ ! બસ થાઓ ! બહુ કહેવાનું અને બહુ વિકલ્પોથી બસ થાઓ!!! બાર અંગોનો સાર તો એકમાત્ર આ જ છે કે - એક માત્ર પરમાર્થનો જ અનુભવ કરો ! ચારેય અનુયોગોનો આ એક જ સાર છે.

પૂર્ણાનંદનો નાથ અભેદ એકડૃપ જે અંદરમાં ધ્યુવડૃપ વિકાળ વિધમાન છે, તે એકનું જ આલંબન લો, તેનો જ અનુભવ કરો ! બેદની વાતો તો બહુ સાંભળી. હવે તો અભેદને ગ્રહણ કરવાનો છે. અહિં માત્ર એ જ કહેવું છે કે વ્યવહારના દુર્વિકલ્પોથી વિરામ લઈને એક અભેદને જ ગ્રહણ કરો.

વચ્ચે ક્યારે, જ્યારે-ત્યારે બેદના વિકલ્પ આવે અવશ્ય છે, પરંતુ તે તો અભેદને જાણવા માટે છે.^૧

જુઓ, જેમ કેવળી ભગવાનની જે અનંત શક્તિઓની વ્યક્તતા પર્યાયમાં પ્રગટ થઈ છે, જે અંદરમાં હતી, તે જ પ્રગટ થઈ; તે જ રીતે ભગવાન ! તારામાં પણ બધી શક્તિઓ નિકાળ મૌજુદ છે, હવે પોતાના ધ્રુવસ્વભાવ પર દાખિ કેન્દ્રિત કર અને તેનું આલંબન લઈને તેનો જ નિરંતર અનુભવ કર ! તેના જ ફળમાં સાદ્ધ-અનંત સમાધિ સુખ પ્રગટ થશે.^૨

અહો ! ચૈતન્ય ચમત્કારથી ભરેલી પરમ અદ્ભૂત વસ્તુ એક આત્મા જ છે. આવા ભગવાન આત્માનું જ નિરંતર અનુભવ કરો.

^૧ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૨૩૨

^૨ તે જ, પાનું ૨૩૨

^૩ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૨૩૬

પ્રશ્ન:- પોતાના આત્માનો અનુભવ કરવાનું તો કહ્યું, તે તો ઠીક વાત; પરંતુ તેનું સાધન પણ કંઈક તો હશે ને !

ઉત્તર:- તેનું અન્ય કોઈ સાધન નથી. આત્માનો અનુભવ કરવા માટે વ્યવહારતનત્રયની પણ અપેક્ષા નથી. અરે ! અનુભવના કાળમાં જે અનંત ગુણોની પર્યાયો પોતે પ્રગટ થઈ, ત્યાં જ્યારે એક ગુણની પર્યાયને બીજી ગુણની પર્યાયની અપેક્ષા હોતી નથી તે વ્યવહારતનત્રય તો બહારની વસ્તુ છે, તેની અપેક્ષા કેવી રીતે હોય ? આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાય શરીરના, કર્મના અને રાગના આધારે નથી; વ્યવહારતનત્રય નિશ્ચયનું સાધન નથી.

આત્મામાં જે કરણ નામનો ગુણ છે, તે સાધન છે અને આધાર નામનો ગુણ આધાર છે. સાધન કોઈ અન્ય હોય અને આધાર કોઈ અન્ય-આમ હોતું નથી. અનંત ગુણમય આત્માના એક ગુણનો આધાર બીજે ગુણ નથી હોતો. તોપછી સ્વાનુભવની દર્શાનો આધાર કોઈ બીજે ગુણ હોય - એમ કેવી રીતે સંબંધ છે ? પર્યાયને પણ તે જ પર્યાયનો આધાર છે અને પર્યાય સ્વયં જ પર્યાયનું સાધન છે. પ્રત્યેક પર્યાય એટલી સ્વતંત્ર છે.”

ઉક્ત કળણનો સાર માત્ર આટલો જ છે કે જે કંઈ કહેવાનું હતું; તે વિસ્તારથી કહેવાઈ ગયું છે; તેથી અધિક કંઈ કહી શકાય નહિ. જેની સમજણમાં આવવાનું હશે, તેને સમજણમાં આવવા માટે, દેશનાલભિય માટે આટલું જ પર્યાખ છે; જેની સમજણમાં આવવાનું નથી, તેને માટે કેટલું પણ કેમ ન કહો, કંઈ જ થવાનું નથી. તેથી હવે અમે (આચાર્યદ્વારા) વિરામ લઈએ છીએ; કારણ કે આખરે તો આ પ્રતિપાદન પણ વિકલ્પજલળ જ તો છે; તમે પણ વિકલ્પોથી વિરામ લઈને પોતામાં સમાઈ જાઓ અને અમે તો પોતાની અંદર જઈએ જ છીએ.

શુદ્ધાત્માના સ્વરૂપનો પ્રતિપાદક આ ગ્રંથાધિરાજ હવે સમાપ્તિ તરફ

જઈ રહો છે. તેથી હવે અંતિમ ગાથા ૪૧૫માં સમયસારના અધ્યયનનું ફળ બતાવતાં તેના માધ્યમથી નિજ આત્માને જાણીને તેમાં જ સ્થિત રહેવાની પ્રેરણા આપવામાં આવી રહી છે.

ઉક્ત અંતિમ ગાથાની ઉત્થાનિકાર્યપ જે કળશ લખવામાં આવ્યો છે તે આ પ્રમાણે છે.

(અનુષ્ટાપ)

ઇદમેકં જગચ્ચક્ષુરક્ષયં યાતિ પૂર્ણતામ् ।

વિજ્ઞાનધનમાનંદમયધ્યક્ષતાં નયત् ॥૨૪૫॥

(હરિગીત)

આનંદમય વિજ્ઞાનધન પ્રત્યક્ષ કરતું એક આ;

અક્ષય જગતચક્ષુ અહા ! પામે હવે છે પૂર્ણતા. ૨૪૫

આનંદમય વિજ્ઞાનધન શુદ્ધાત્મકાર્ય સમયસારને પ્રત્યક્ષ કરતો આ એક અદ્રિતીય અક્ષય જગતચક્ષુ સમયસાર નામનો ગ્રંથાધિરાજ પૂર્ણતાને પ્રાપ્ત થઈ રહ્યો છે.

પાંડે રાજમલજ આ છંદનો જે અર્થ કરે છે; તેનો ભાવ સંક્ષેપમાં આ પ્રમાણે છે -

“સમસ્ત જૈથ વસ્તુઓનો જાતા, શાશ્વત વિજ્ઞાનધન આત્મદ્રવ્યને પ્રત્યક્ષફંપે અનુભવતો શુદ્ધજ્ઞાન પ્રકાશ હવે પૂર્ણતાને પ્રાપ્ત થાય છે. ભાવાર્થ આ છે કે અહીં સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર પૂર્ણ થાય છે.”

પાંડે રાજમલજની કળશટીકાનો આધાર લઈને કવિવર બનારસીદાસજ ત્રણ દોહા લખે છે; જે આ પ્રમાણે છે.

(દોહા)

જગત ચક્ષુ આનંદમય, ગ્યાન ચેતનાભાસ ।

નિરવિકલપ સાસુત સુથિર, કીજૈ અનુભી તાસ ॥

અચલ અખંડિત ગ્યાનમય, પૂરન વીત મમત્વ ।

ગ્યાન ગમ્ય બાધા રહિત, સો હૈ આત્મ તત્ત્વ ॥

સર્વ વિસુદ્ધી દ્વાર યહ, કહો પ્રગટ સિવપંથ ।

કુન્દકુન્દ મુનિરાજ કૃત, પૂરન ભર્યી ગરંથ ॥

આ આત્મતત્ત્વ અચળ, અખંડિત જ્ઞાનમય છે, મમત્વથી રહિત પરિપૂર્ણ છે, સર્વ પ્રકારની બાધાઓથી રહિત જ્ઞાનમય છે, સંપૂર્ણ જગતને જેવા માટે ચક્ષુ સમાન છે, આનંદમય છે, જ્ઞાનચેતનાથી જાણવામાં આવતો શાખત અને સ્થિર છે; તેથી હે ભવ્ય ! નિર્વિકલ્પ થઈને તેનો જ અનુભવ કરો.

આમ આ સાક્ષાત્ મુક્તિનો માર્ગ સર્વવિશુદ્ધ દ્વાર કહેવામાં આવ્યો. હવે અહીં આચાર્ય કુંદુંદ મુનિરાજ વહે રચિત આ સમયસાર ગ્રંથ સમાપ્ત થાય છે.

આવી રીતે આપણે જેઠીએ છીએ કે રાજમલજ પાંડેની માફક બનારસીદાસલુ પણ અહીં સર્વવિશુદ્ધ અધિકારની સમાપ્તિ બતાવે છે; અને સાથે એમ પણ કહે છે કે અહીં સર્વવિશુદ્ધ અધિકારની સાથે સાથે સમયસાર ગ્રંથાધિરાજ પણ સમાપ્ત થઈ રહ્યો છે.

પૂજય ગુરુદેવ ઉક્ત કળશનો ભાવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે.

“અહીં મૂળ કળશમાં ભગવાન આત્માના આનંદમય અને વિજાનધન - આ બે વિશેષણો કહ્યા છે; તેનો અર્થ એ છે કે સમયસાર ગ્રંથનું વાચ્ય ભગવાન આત્મા જ્ઞાન પ્રકારનો પુંજ અને આનંદનો રસકંદ છે.”^૧

આનંદમય વિજાનધન પ્રભુ આત્માનું પોતાના પ્રગટ શ્રુતજ્ઞાનમાં પ્રત્યક્ષ વેદન કરવું, સ્વસંવેદન કરવું તે જ ધર્મ છે.^૨

જેવી રીતે આત્મા લોકાલોકને જાણનારો-દેખનારો અદ્વિતીય ચક્ષુ છે; તેવી જ રીતે લોકાલોકને દેખનારું-જાણનારું આ શાસ્ત્ર અદ્વિતીય જગતચક્ષુ છે.^૩

૧ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૨૩૭

૨ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૨૩૭

૩ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૨૩૭

જેવી રીતે ભગવાન આત્મા અક્ષય છે; તેવી જ રીતે તેને બતાવનાં આ પરમાગમ અક્ષય છે, ભગવાન જેણ પરમેશ્વરની વાણી પ્રવાહણપ અક્ષય છે. જે જ્ઞાનાનંદસ્વરૂપ શુદ્ધચૈતન્યવस્તુનું ભાન કરીને તેમાં જ સ્થિર થઈ જય છે, તેને પૂર્ણ પરમાત્મપદની પ્રાપ્તિ થઈ જય છે.”

ઉક્ત કથનમાં પૂજય ગુરુદેવ સમયસાર ગ્રંથાધિરાજની તુલના ભગવાન આત્મા સાથે કરતાં કહે છે કે ભગવાન આત્માની માફિક આ ગ્રંથરાજ પણ આત્માની સાથે લોકાલોકને બતાવનાં અદ્વિતીય જગતચક્ષુ છે.



આત્મશાંતિ પ્રગટ કર

આત્મા ગમે તેવા સંયોગમાં પણ પોતાની શાંતિ પ્રગટ કરી શકે છે. પોતાની શાંતિને પ્રગટ કરવામાં જગતનો કોઈ બાધ્ય પદાર્થ વિધન કરવા સમર્થ નથી. ગમે તેવા આકરાં પ્રસંગો આવી પડે, દીકરો મરી જાય, દીકરી રડે, જંગલમાં એકલો પડી ગયો હોય ને કોલેરા આદિનો આકરો રોગ થઈ ગયો હોય, કૃધા-તૃખાની આકરી વેદના હોય કે સિંહ, વાધ ફાડી ખાવા આવ્યો હોય કે ગમે તેવા આકરાં પ્રસંગ આવી પડે તોપણ તે સંયોગનું લક્ષ છોડીને અંદરમાં આત્મા પોતાની શાંતિને પ્રગટ કરી શકવા સમર્થ છે.

બાધ્યમાં રહેલી પ્રતિકૂળતા અંદરમાં આત્મશાંતિને રોકી શકતી નથી. શાય્યમાં તો કહે છે કે નરકની જે પીડા જીબથી કહી શકતી નથી. એવી આકરી નરકની પીડા છે. છતાં ત્યાં પણ એ સંયોગનું ને પીડાનું લક્ષ છોડી દે તો આત્મા પોતાની શાંતિને પ્રગટ કરી શકે છે.

ભાઈ ! તારું તત્ત્વ હાજરાહણજુર છે. તેમાં લક્ષ કરીને પોતાની શાંતિ પ્રગટ કરી શકાય છે.

- પૂજય ગુરુદેવશ્રી

समयसार गाथा ४१५

હવे आचार्य कुन्दकुन्देव ग्रंथनी समाप्ति करतां आ ग्रंथना
स्वाध्यायनुं इण उत्तम सुखनी प्राप्ति बतावे छे.

गाथा भूणमां आ प्रभाषे छे.

जो समयपाहुडमिणं पटिदूणं अत्थतच्चदो णादुं ।

अत्थे ठाही चेदा सो होही उत्तमं सोक्खं ॥४१५॥

(हरिगीत)

आ समयप्राभूत पठन करीने, अर्थ-तत्त्वथी जाणीने,

करशे अरथमां आतमा जे, सौभ्य उत्तम ते थशे. ४१५

“जे आतमा आ समयप्राभूतने वांचीने, अर्थ अने तत्त्वथी जाणीने
तेना विश्वभूत अर्थमां पोताने स्थापशे; ते उत्तमसुख (अतीन्द्रिय आनंद)
ने प्राप्त करशे.

आ गाथानो भाव आचार्य अभृतयंद्र आत्मभ्यातिमां आ प्रभाषे
व्यक्त करे छे -

“जे विश्वप्रकाशक होवाथी विश्वमय समयसारभूत भगवान
आत्मानुं प्रतिपादन करे छे; तेथी स्वयं शब्दब्रह्म समान छे; आवा आ
समयसार शास्त्रनो जे आतमा सारी रीते अभ्यास करीने विश्वने प्रकाशित
करवामां समर्थ परमार्थभूत, चैतन्यप्रकाशङ्कप आत्माना निर्णय करता आ

શાસ્ત્રને અર્થ અને તત્ત્વથી જાણીને; તેના જ અર્થભૂત એક પૂર્ણ વિજ્ઞાનધન ભગવાન પરમખ્રબ્રહ્મમાં સર્વ ઉદ્ઘમથી સ્થિર થશે; તે આત્મા તે જ સમયે સાક્ષાત્ પ્રગટ થનારા એક ચૈતન્યરસથી પરિપૂર્ણ સ્વભાવથી સુસ્થિત અને નિરાકૃત હોવાથી જે પરમાનંદ શબ્દનું વાચ્ય ઉત્તમ અને અનાકૃત સુખસ્વરૂપ સ્વયં જ થઈ જશે.”

આ ગાથા અને ટીકાનો ભાવ ભાવાર્થમાં સ્પષ્ટ કરતાં જ્યયંદળ છાબડા લખે છે -

“આ શાસ્ત્રનું નામ સમયપ્રાભૂત છે. સમયનો અર્થ છે પદાર્થ અથવા સમય અર્થાત્ આત્મા. તેને કહેનાંથી આ શાસ્ત્ર છે અને આત્મા તો સમસ્ત પદાર્થોનો પ્રકાશક છે. આવા વિશ્વપ્રકાશક આત્માને કહેતો હોવાથી આ સમયપ્રાભૂત શબ્દખ્રલ સમાન છે; કારણ કે જે સમસ્ત પદાર્થોનો કહેનારો હોય છે તેને શબ્દ બ્રહ્મ કહેવાય છે. દ્વારથાંગશાસ્ત્ર શબ્દખ્રલ છે અને આ સમયપ્રાભૂત શાસ્ત્રને પણ શબ્દખ્રલની ઉપમા આપવામાં આવી છે. આ શબ્દખ્રલ (અર્થાત્ સમયપ્રાભૂતશાસ્ત્ર) પરખ્રલને (અર્થાત્ શુદ્ધ પરમાત્માને) સાક્ષાત્ દેખાડે છે જે આ શાસ્ત્રને વાંચીને તેના યથાર્થ અર્થમાં કરશે; તે પરખ્રલને પ્રાપ્ત કરશે અને તેનાથી જેને ‘પરમાનંદ’ કહેવામાં આવે છે - એવા ઉત્તમ સ્વાત્મીક, સ્વાધીન, બાધારહિત, અવિનાશી સુખને પ્રાપ્ત કરશે. તેથી હે ભવ્ય જીવો ! તમે પોતાના કલ્યાણ માટે તેનો અભ્યાસ કરો, તેનું શ્રવણ કરો, નિરંતર તેનું જ સ્મરણ અને ધ્યાન કરો, કે જેનાથી અવિનાશી સુખની પ્રાપ્તિ થશે. એવો શ્રી ગુરુઓનો ઉપદેશ છે.”

આ ગાથા અને તેની ટીકાનો ભાવ પૂજ્ય ગુરુદેવ આ પ્રમાણે સમજાવે છે.

“જુઓ, આ અંતિમ ગાથામાં તો આચાર્યદેવ જાણે સંપૂર્ણ ગ્રંથનો સાર અર્થાત્ માખણ જ માખણ ભરી દીધું છે. અહા ! આચાર્ય કુન્દકુન્દ લગભગ બે હજાર વર્ષ પહેલા સંવત ૪૮માં ભરતક્ષેત્રના મહામુનિવર થઈ ગયા છે. આત્મધ્યાનમાં લવલીન અને નિજ આનંદસ્વરૂપમાં નિરંતર રમણ

કરનારા આ નગન દિગંબર સંત મહામુનિવર હતા. તેઓને અહીંથી મહાવિદેહક્ષેત્રમાં ભગવાન સીમંધરસ્વામી પાસે લઈ જવામાં આવ્યા હતા. તેઓ ત્યાં આઠ દિવસ રહ્યા હતા. સાક્ષાત્ દિવ્યધ્વનિ સાંભળવાનું સૌભાગ્ય તેમને પ્રાપ્ત થયું હતું. ભલે ને આ સમયસાર ગ્રંથ તે ઘટના બાદ લખવામાં આવ્યું; પરંતુ તેની પ્રમાણિકતા અથવા મહિમાનો આધાર તેમના વિદેહગમન અને સીમંધર ભગવાનની દિવ્યધ્વનિ સાંભળીને લખેલું એમ માનવું તે બરોબર નથી, પરંતુ તેની મહિમા તો આગમનો આધાર, યુક્તિઓનું આલંબન અને સ્વાનુભવ છે, જે દરેક અંતર્મુહૂર્તમાં તેઓ કરતા હતા.^૧

ચૈતન્યના નૂરનું પૂર ભગવાન આત્મા સ્વપરસહિત સંપૂર્ણ વિકાળવતી લોકાલોકનો પ્રકાશક શાયકસ્વભાવી હોવાથી વિશ્વમય છે, સંપૂર્ણ લોકાલોકનો શાયક છે; પણ કર્તા નથી. આત્મા પરપરાર્થની કિયા કરી શકતો જ નથી; કારણ કે પરમાં કર્દી પણ કરવાનો આત્માનો સ્વભાવ જ નથી અને તેનામાં એવું સામર્થ્ય પણ નથી.^૨

લક્ષ્મીનો બંડાર ભગવાન આત્મા વિશ્વનો પ્રકાશક હોવાથી વિશ્વમય છે અને તેવા આત્માનો પ્રતિપાદક હોવાથી આ શાસ્ત્ર પણ શબ્દભ્રલ છે. તે અપેક્ષાએ ભગવાનની વાણી (દિવ્યધ્વનિ) પૂર્ણ શબ્દભ્રલ છે, તેજ અપેક્ષાથી આવા સાક્ષાત્ પરમભ્રલના પ્રતિપાદક, તત્ત્વોનું પ્રતિપાદન કરનારા આ શાસ્ત્રનો પોતાના હિતના લક્ષ્યથી બધાએ અભ્યાસ કરવો જોઈએ.^૩

ભાઈ ! આ તો ભવનો અભાવ કરનાં પરમહિતકારી શાસ્ત્ર છે. આ ભવનું મૂળ એક મિથ્યાત્વ છે. શાસ્ત્ર વાંચીને નિજસ્વરૂપનો નિર્ણય કરવો મિથ્યાત્વનો નાશ કરવાનો ઉપાય છે. સ્વસ્વરૂપનો નિર્ણય કરવો તે જ આ સમયસાર શાસ્ત્રનો સાર છે, પ્રયોજન છે.

૧ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૨૪૦

૨ તે જ, પાનું ૨૪૧

૩ તે જ, પાનું ૨૪૨

‘અર્થ’ અને ‘તત્ત્વ’ ને જાળવાની જે વાત કહી છે, તેનું તાત્પર્ય આ છે કે આત્મા જે નિકાળી વસ્તુ છે, તે તો છે અર્થ અને તેનો જે જ્ઞાન સ્વભાવ છે તે તત્ત્વ. જેવી રીતે સોનું છે અર્થ અને તેનું પીળાપણું, ભારીપણું, ચિકાશા, બહુમૂલ્યપણું વગેરે સ્વર્ણાત્મ છે તેનું તત્ત્વ. આત્મા નિકાળી ધ્રુવ દ્રવ્ય અર્થ છે, અને જ્ઞાન, આનંદ, સ્વર્ણાત્મ, પ્રભુતા આદિ ગુણસ્વભાવ તેનું તત્ત્વ છે.^૧

આત્મવસ્તુ અર્થ છે અને જ્ઞાન તેનું તત્ત્વ. તેને જાળીને, તત્ત્વ સહિત અર્થને જાળીને તું અર્થમાં, આત્મપદાર્થમાં સ્થિર થઈ જ. તેનાથી તારી દરાા ઉત્તમ આનંદમય થઈ જશે.^૨

દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેને જ જાળીને અર્થભૂત ભગવાન આત્મામાં એક, અભેદ, પૂર્ણ વિજ્ઞાનધન પરમખ્રલભમાં દર્શિને એકાગ્ર કરવી, તેમાં જ રહેલું, કરવું તે જ મુક્તિનો માર્ગ છે. બાકી બહારની ડિયા જાળવું/ ભાળાવવું આદિ બધું નિસ્સાર છે. આત્મા પરમખ્રલ વિજ્ઞાનધન છે; તેમાં જ સર્વથા પુરુષાર્થ કરી સ્થિર થવું - તે જ એકમાત્ર સુખી થવાનો સાચો ઉપાય છે.^૩

ખરેખર તો ધર્મનું સ્વરૂપ સર્વજ્ઞસ્વભાવી, સંપૂર્ણ વિશ્વને જાળવાના સામર્થ્યથી સંપત્ત છે. આવા વિશ્વપ્રકાશક પરમખ્રલસ્વરૂપ ભગવાન આત્માને કહેનાડું હોવાથી આ શાસ્ત્ર શબ્દખ્રલ સમાન છે. સર્વપ્રકાશક આત્મા પર ખ્રલ છે અને તેને બતાવનાડું આ શાસ્ત્ર શબ્દખ્રલ છે.”^૪

પૂજય ગુરુદેવના ઉક્ત કથનમાં આ વાત અત્યંત સ્પષ્ટરૂપથી આવી છે કે બલે આચાર્ય કુન્દુકુન્દ સીમંધર પરમાત્માના દર્શનાર્થે વિદેહક્ષેત્ર ગયા હતા અને ત્યાંથી આવીને સમયસાર લખ્યું હતું; છતાં પણ તેની

૧ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૨૪૨.

૨ તે જ, પાનું ૨૪૪

૩ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૨૪૫

૪ તે જ, પાનું ૨૪૭

પ્રમાણિકતાનો આધાર સીમંઘરસ્વામીની વાણી નથી; પરંતુ તેમનો પોતાનો અનુભવ અને આચાર્ય પરંપરાથી પ્રાપ્ત ભગવાન મહાવીરની વાણી છે.

આ વિષયની વિસ્તૃત ચર્ચા સમયસાર અનુશીલન ભાગ ૧ માં પાના ૪૫-૪૬ પર પાંચમી ગાથાના અનુશીલનમાં તો કરવામાં આવી જ છે. સાથે જ તે જ ચર્ચા મેં આચાર્ય કુન્ડકુન્ડ ઔર ઉનકે પંચ પરમાગમ નામના પુસ્તકમાં તથા પંચ પરમાગમોં કી પ્રસ્તાવના માં પણ વિસ્તારથી કરી છે; જેમને વિશેષ જણવાની ઈચ્છા હોય, તેઓ ઉક્ત પ્રકરણનું ઉંડાણથી અધ્યયન કરે.

આમ તો આચાર્ય જ્યસેન આ ગાથાનો અર્થ આત્મભ્યાતિની માફિક જ કરે છે; છતાં પણ અતીન્દ્રિય સુખનું સ્વરૂપ ઉદ્ઘારણ સહિત સમજલવતાં તર્ક, યુક્તિ અને આગમથી સિદ્ધ કરે છે; જે મૂળથી અભ્યાસ કરવા યોગ્ય છે.

મહાશાસ્ત્ર તત્ત્વાર્થસૂત્રમાં પણ જ્યારે સમ્યગ્દર્શનને પરિભાષિત કર્યું તો તે જ લઘું છે કે તત્ત્વાર્થ શ્રદ્ધાનં સમ્યગ્દર્શનમ् તત્ત્વાર્થનું શ્રદ્ધાન સમ્યગ્દર્શન છે. તાત્પર્ય એ છે કે સાત તત્ત્વોને તત્ત્વ અને અર્થથી જાણીને શ્રદ્ધાન કરવાને સમ્યગ્દર્શન કહેવામાં આવ્યું છે.

અહીં પણ સમયસારના પ્રતિપાદને તત્ત્વ અને અર્થથી જાણીને તેમાંજ જણનારા-રમનારાઓને જ ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય છે - એમ કહેવામાં આવ્યું છે.

તે ઉપરાંત આત્મભ્યાતિના કર્તા આચાર્ય અમૃતચન્દ્ર આત્મભ્યાતિ ટીકાની સમાપ્તિ કરતાં આ અધિકારના અંતિમ કળશમાં કહે છે કે ઉક્ત સંપૂર્ણ કથનથી અંતે નિષ્કર્ષણે આ જ સિદ્ધ કરવામાં આવ્યું છે કે આત્મા જ્ઞાનમાત્ર છે.

કળશ મૂળથી આ પ્રમાણે છે -

(અનુષ્ટપ)

ઇતીદમાત્મનસ્તત્ત્વં	જ્ઞાનમાત્રમવસ્થિતમ्	।
અખંડમેકમચલં	સ્વસંવેદમબાધિતમ्	॥૨૪૬॥

(હરિગીત)

થયું જ્ઞાનમાત્ર જ તત્ત્વ આત્માનું નક્કી બસ આ રીતે;
જે એક, અચળ, અખંડ નિજથી વેદ્ય બાધારહિત છે. ૨૪૬

આ પ્રમાણે જે અખંડ છે, અચળ છે, અભાધિત છે. એક છે અને સ્વસંવેદ છે; એવા આત્માનું તત્ત્વ જ્ઞાનમાત્ર અભાધિત સિદ્ધ થયું.

કોણ જણે કેમ, પણ રાજમલજીની કળશ ટીકામાં આ કળશનો અર્થ ઉપલબ્ધ થતો નથી. તેથી પાંડે રાજમલજીનું અનુસરણ કરનાર કવિવર બનારસીદાસજીએ પણ કોઈ આવો છંદ લખ્યો નથી, જે આવા ભાવનો પોષક હોય. એવું પહેલા અનેક જગાએ થયું છે - તેથી પ્રતીત થાય છે કે કવિવર બનારસીદાસજી પણ સંપૂર્ણ રીતે કળશ ટીકા પર જ નિર્ભર રહ્યા છે. તેનું કારણ એ પણ હોઈ શકે કે ધંધા-વ્યાપારમાં વ્યસ્ત એવા કવિહદ્યવાળા વ્યાપારીનો પ્રાકૃત-સંસ્કૃત પર એટલો કાબુ ન હોય અને તે વિના આચાર્ય કુન્દુનંદ અને અમૃતચન્દ્રને સીધું સમજવું સંભવ નથી.

બીજુ એક વાત એ પણ છે કે તે સમયે સમયસાર અને આત્મપ્રાતિની કોઈ પણ હિંદી ટીકા તો ઉપલબ્ધ હતી જ નહિ; એકમાત્ર રાજમલીય કળશ ટીકા જ એક એવું સાધન હતી કે જેના માધ્યમથી બનારસીદાસજી સમયસારનો ભર્મ સમજ શક્યા હતા તેથી તેમાણે તેને જ આધાર બનાવીને નાટક સમયસારની રચના કરી છે.

પૂજ્ય ગુરુદેવ આ કળશનો ભાવ આ પ્રમાણે સ્પષ્ટ કરે છે - “અહીં કહે છે કે આ પ્રમાણે આત્માનું તત્ત્વ પરમાર્થસ્વરૂપ જ્ઞાનમાત્ર છે - આમ નિશ્ચિત થઈ ગયું.”

ભલે અનેક જ્ઞાયકારોથી અને પ્રતિપક્ષી કર્મોદ્યના નિમિત્તથી અખંડ-ખંડ દેખાય છે પરંતુ જ્ઞાનમાત્ર આત્મામાં કોઈ ખંડ નથી. જ્ઞાયોને જાણવાથી આત્મા જ્ઞાયકાર થઈ જતો નથી.

જ્ઞાય શબ્દ જ એ બતાવે છે કે તેને જાણનાંડું કોઈ જ્ઞાન છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે અને સારું વિશ્વ જ્ઞાયકૃપે તે જ્ઞાનમાં જણાઈ જાય છે. જ્ઞાત થાય છે.^૧

અહીં બે વાતો કહી છે -

૧. આત્મા જ્ઞાનમાત્રસ્વરૂપવાળી વસ્તુ છે. શરીર-મન-વાળી-ઈંડ્રિયો આત્મા નથી, રાગાદિ વિકાર આત્મા નથી અને અન્ય જીવ પંચપરમેઝી આદિ પણ નિજ આત્મા નથી અને આત્મા જ્ઞાનમાત્ર વસ્તુ હોવાથી સમસ્ત જગતને જાણવાના સામર્થ્યપણે હોવાથી તેમને જાણે તો છે; પરંતુ તે જ્ઞાયોને જાણવાથી તે પરનો કર્તા થઈ જતો નથી.
૨. તે જ્ઞાનમાત્ર વસ્તુ અખંડ છે. અનંત જ્ઞાયોને જાણવા છીતાં પણ તે જ્ઞાયકારકૃપ થઈ જતી નથી. જ્ઞાનકાર જ રહે છે. બધાને જાણનાંડું જ્ઞાન પોતે પોતાના કારણે જ જ્ઞાનકારપણે હોય છે, જ્ઞાયકારોને કારણે અહીં જ્ઞાન થતું નથી. તેથી જ્ઞાન અંહિત પણ થતું નથી. જ્ઞાન તો અખંડ, અભેદ સ્વભાવે જ રહે છે.^૨

હવે કહે છે કે જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ અચળ છે. ‘અચળ’ છે અર્થात् આત્મા જ્ઞાનકૃપે પરજ્ઞાયકૃપ અથવા જડકૃપ થઈ જતું નથી. સદા જ્ઞાનકૃપ જ રહે છે.^૩

હવે કહે છે કે ભગવાન આત્મા સ્વસંવેદ્ય છે. પોતે પોતાથી જ સ્વસંવેદન જ્ઞાનમાં જાણવામાં આવે છે, જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા

^૧ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૨૪૮-૨૫૦

^૨ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૨૫૧

^૩ પ્રવચનરત્નાકર ભાગ ૧૦, પાનું ૨૫૧-૨૫૨

પરક્ષેયોને જાણે છે, તેથી તે પરવેદનમય થઈ જતું નથી. તે સદા સ્વસંવેદ્ય જ છે. પોતાનું અને પરનું જ્ઞાન કરે છે; પરંતુ વેદન-સંવેદન તો પોતાના સ્વરૂપનું જ કરે છે.

હવે કહે છે કે આત્મતત્ત્વ અભાવિત છે. કોઈ ખોટી અથવા મિથ્યા યુક્તિથી બાવિત થતું નથી. અહીં કોઈ એમ કહી શકે કે આત્માને જ્ઞાનમાત્ર કહેવાથી શું એકાંત નહીં થઈ જય ?

સમાધાન એમ છે કે એકાંત નથી; કારણ કે આત્માને જે જ્ઞાનસ્વરૂપ કહ્યો - તેમાં 'જ્ઞાન છે' - આમ કહેતાં આત્મામાં જ્ઞાનનું અસ્તિત્વ હોવાથી 'અસ્તિત્વ' ગુણ આવી ગયો. 'આ જ્ઞાન જ છે' - આ પ્રમાણે તેમાં શ્રદ્ધાગુણ પણ આવી ગયો. 'જ્ઞાનમાં સ્થિરતા કરવી' આ કથનમાં ચારિત્રગુણ પણ આવી ગયો. 'જ્ઞાન જ મહિમાવંત છે' આ રીતે પ્રભુત્વ ગુણ આવી ગયો. જ્ઞાનમાત્ર કહેતાં એકલું જ્ઞાન જ આવી જતું નથી. તેમાં તો અભેદ્ધપે અનંતગુણ સમાઈ જય છે' 'જ્ઞાનમાત્ર' વસ્તુમાં તેના અનંત ગુણોનો નિષેધ નથી, પરંતુ શરીરાદિ અને રાગાદિ પરપદાર્થોનો નિષેધ છે. આમ જ્ઞાનમાત્ર વસ્તુ કહેવાથી એકાંત નથી.***

આ કળશામાં એમ કહેવામાં આવ્યું છે કે આત્મા જ્ઞાનમાત્ર નિશ્ચિત થયો. આત્માને જ્ઞાનમાત્ર કહેવાનું સહેતુક સ્પષ્ટીકરણ પંડિત જ્યયચંદ્ર છાબડા ભાવાર્થમાં કરે છે; જે આ પ્રમાણે છે -

"અહીં આત્માનું નિજસ્વરૂપ જ્ઞાન જ કહ્યું છે, તેનું કારણ એ છે કે આત્મામાં અનંત ધર્મ છે; પરંતુ તેમાં કેટલાક તો સાધારણ છે, તેથી તે અતિવ્યાપ્તિયુક્ત છે, તેમનાથી આત્માને ઓળખી શકાય તેમ નથી અને અમુક (ધર્મ) પર્યાપ્તિકૃત છે - કોઈ અવસ્થામાં હોય છે અને કોઈ અવસ્થામાં હોતા નથી, તેથી તે અવ્યાપ્તિયુક્ત છે, તેમનાથી પણ આત્મા ઓળખી શકાય નહિ. ચેતનતા ભલે આત્માનું (અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ રહિત) લક્ષણ છે, ઇતાં તે શક્તિમાત્ર છે, અદ્ય છે; તેની વ્યક્તિ દર્શન

અને જ્ઞાન છે. તે દર્શન અને જ્ઞાનમાં પણ જ્ઞાન સાકાર છે, પ્રગટ અનુભવગોચર છે; તેથી તેના વડે આત્મા ઓળખાય છે, તેથી અહીં તે જ્ઞાનને જ પ્રધાન કરીને આત્માનું તત્ત્વ કહ્યું છે.

અહીં એમ ન સમજવું કે 'આત્માને જ્ઞાનમાત્ર તત્ત્વવાળો કહ્યો છે; તેથી એટલો જ પરમાર્થ છે અને અન્ય ધર્મ મિથ્યા છે, તે (ધર્મ) આત્મામાં છે જ નહીં; 'આવો સર્વર્થા એકાંત ગ્રહણ કરવાથી તો મિથ્યાદાચિત્ત આવી જય છે, વિજ્ઞાનાદૈત્યાદી બૌદ્ધો અને વેદાન્તિયોનો મત આવી જય છે; તેથી આવો એકાન્ત બાધાસહિત છે. આવા એકાંત અભિપ્રાયથી કોઈ મુનિવ્રતપણ પાળે અને આત્માનું-જ્ઞાનમાત્રાનું-ધ્યાનપણ કરે તો પણ મિથ્યાત્ત્વ દૂર થતું નથી; મંદ કષાયોને કારણે ભલે ને સ્વર્ગને પ્રાપ્ત થાય; પરંતુ મોક્ષનું સાધન તો થતું નથી. તેથી સ્યાદ્વાદથી યથાર્થ સમજવું જોઈએ."

આ પ્રમાણે આ કળશમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આત્મા જ્ઞાનમાત્ર છે - આ વાત અભાવિતકૃપે સિદ્ધ થઈ ગઈ છે.

'આત્મા જ્ઞાનમાત્ર જ છે' - આ કથનનો વાસ્તવિક અર્થ શું છે - તેનું સ્પષ્ટીકરણ આચાર્ય અમૃતચંદ્ર આત્મઘ્યાતિના પરિશિષ્ટમાં પોતે જ પ્રશ્ન ઉપસ્થિત કરીને તેનો ઉત્તર આપતાં વિસ્તાર કર્યો છે તથા આચાર્ય જ્યસેને પણ તાત્પર્યવૃત્તિના અંતમાં તેના પર પ્રકાશ પાથર્યો છે.

તેથી અહીં આ પ્રકરણનું મંથન અભીષ્ટ નથી; કારણ કે આગળ જતાં સહજ જ તેના પર વિસ્તારથી ચર્ચા થવાની છે.

પ્રત્યેક અધિકારની માફક જ આ સર્વવિશુદ્ધજ્ઞાનાધિકારની સમાપ્તિ કરતાં આ અધિકારની વિષયવસ્તુને સમેટી લેતાં પંડિત જ્યયચંદ્ર છાબડા એક છંદ લખે છે; જે આ પ્રમાણે છે.

(સર્વૈયા)

સર્વવિશુદ્ધજ્ઞાનરૂપ સદા ચિદાનન્દ,

કરતા ન ભોગતા ન પરદ્રવ્યભાવ કો ।

मूरत अमूरत जे आनद्रव्य लोकमांहि,
 ते भी ज्ञानरूप नहीं न्यारे न अभाव को ॥
 यहै जानि ज्ञानी जीव आपकूँ भजै सदीव,
 ज्ञानरूप सुखतूप आन न लगाव को ।
 कर्म कर्मफलरूप चेतना कूँ दूरि टारि,
 ज्ञानचेतना अभ्यास करे शुद्ध भाव को ॥

सदाय सर्वविशुद्धज्ञानङ्गप रહेनारो यैतन्य अने आनन्दङ्गप आ
 चिदानन्द आत्मा परद्रव्य अने परभावोने न तो करे छे अने न तो भोगवे
 छे. आ लोकमां जेटला पण मूर्तिक अने अभूर्तिक पदार्थ छे; ते बंधा ज्ञानङ्गप
 नथी, आत्माथी लिङ्ग ४ छे; आत्मा तेमना अभावङ्गप छे अने ते पण
 आत्माना अभावङ्गप छे.

आम जाणीने ज्ञानीलुव सदाय पोताना ज्ञानानन्दस्वङ्गप आत्मानुं
 भजन करे छे, तेने निजङ्गप जाणे-माने छे अने तेमां लीन रहेवा ईछे
 छे; बीज कोई पण साथे तेमने लगाव रहेतो नथी. तेओ कर्मचेतना अने
 कर्मफलचेतनाने दूरथी ४ छोडीने शुद्धभावङ्गप ज्ञानचेतनानो ४ अभ्यास
 करे छे.

आ प्रभाणे अहीं आचार्य कुन्दकुन्दकृत समयसार समाप्त थाय
 छे. हवे आगण आचार्य अमृतयन्द्र आत्मभ्यातिमां परिशिष्टना इपमां
 स्याद्वाहनी शुद्धि माटे उपाय-उपेय भाव पर विशेष चर्चा करशे; जेमां
 आत्मानी ४७ शक्तिओनी पण चर्चा थशे अने आत्माना 'ज्ञानमात्र'
 विशेषणुनुं स्पष्टीकरण पण विस्तारथी करवामां आवशे.

आ ४ प्रभाणे आचार्य ४८सेन पण परिशिष्टमां आ ४ विषयने

સ્પષ્ટ કરશે. આ બધા પરિશિષ્ટોનું પણ યथાસ્થાન અનુશીલન કરવામાં આવશે.

(સોરઠા)

સમયસાર હૈ સાર ઔર સાર કછુ હૈ નહીં ।
મહિમા અપરમ્પાર સમયસારમય આપકી ॥



મંથન.

* હે જીવ ! હું અકિયન હું અર્થાત્ મારું કાંઈ પણ નથી એવી સમ્યક્ ભાવના પૂર્વક તું નિરંતર રહે, કારણ કે એ જ ભાવનાના સતત વિનિવથી તું વૈલોક્યનો સ્વામી થઈશ. આ વાત માત્ર યોગીશ્વરો જ જાણે છે. એ યોગીશ્વરોને ગમ્ય એવું પરમાત્મતત્ત્વનું રહસ્ય મેળે તને સંક્ષેપમાં કહ્યું.

(શ્રી આત્માનુથાસન)

* નવ નિધિ, ચૌદ રત્ન, ધોડા, મત્ત ઉત્તમ હાથીઓ, ચતુરંગિણી સેના આદિ સામગ્રીઓ પણ ચક્કવતીને શરણરૂપ નથી. તેનો અપાર વૈભવ તેને મૃત્યુથી બચાવી શકતો નથી.

જન્મ, જરા, મરણ, રોગ અને ભયથી પોતાનો આત્મા જ પોતાની રક્ષા કરે છે. કર્મનો બંધ, ઉદ્દ્ય અને સત્તાથી બિત્ર પોતાનો આત્મા જ આ સંસારમાં શરણરૂપ છે. કર્મનો ક્ષય કરીને જન્મ-જરા-મરણાદિના દુઃખોથી પોતાનો આત્મા જ પોતાને બચાવે છે.

(શ્રી કુંદુર્દાચાર્ય, બાર-ભાવના)